

Fundamentals of Cost and Management Accounting

S.Y. B.Com.



**Sardar Patel University
Vallabh Vidyanagar**

**NAAC ACCREDITED GRADE 'A' WITH 3.11 CGPA
(10-01-2023 to 09-01-2028)**

First Edition : November 2020

Copies : 500

Reprint : September 2023

Copies : 100

Price : Rs 200/-

**© Sardar Patel University
Vallabh Vidyanagar - 388 120**

ISBN : 978-93-81386-77-4

The book is strictly written according to the new syllabus available at the time of printing.

Every possible efforts have been made to avoid errors and omissions in this publication by the authors and the Publisher. Inspite of this efforts, some typographical errors might have crept in. Any mistake, error or discrepancy noted may be brought to our notice which shall be taken care of in the forthcoming edition. It is hereby notified that neither the Authors nor the Printer or seller will be liable for any damage or loss to anyone, in any manner there from. It is suggested that to avoid any doubt the reader should cross-check all the facts, law and contents of the publication with original Government publication or notifications wherever applicable. The text of this publication, or any part thereof, may not be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording, storage in an information retrieval system, or reproduced on any disc, tape, perforated media or other information storage device, etc., otherwise, without the prior written permission of the University. No key to this book can be prepared without the prior written permission of the publiser. Any violation will invite prosecution legal action under the Indian Copyright Act.

This book is sold subject to the condition that it shall not by way of trade or otherwise. However it can be lent, resold, hired out or circulated in the wider interest of student community.

For binding mistakes, misprints or for missing pages, etc., the printer liability is limited to replacement within one month of purchase by similar edition. All expenses in this connection are to be borne by the purchaser.

All disputes are subject to jurisdiction of Anand only.

Published by : Registrar, Sardar Patel University,
Vallabh Vidyanagar - 388 120

Available at : Store Section - Room No. 108,
Sardar Patel University, Vallabh Vidyanagar - 388 120

Printed by : University Press, Sardar Patel University,
Vallabh Vidyanagar-388 120

પ્રસ્તાવના

ફંડામેન્ટલ્સ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટીંગનું એસ.વાચ.બી.કોમ.નું આ પુસ્તક સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા મુક્તવામાં આવી રહ્યું છે. જેમાં, પડતર હિસાબી પદ્ધતિ, માલસામાન મજૂરી ખર્ચ, એકમ પડતર, નાણાંકીય હિસાબો અને પડતરનાં હિસાબોની મેળવણી, સંચાલકિય હિસાબી પદ્ધતિ, અંદાજપત્ર, પડતર જથ્થા વિશ્લેષણ અને પ્રમાણ પડતર પદ્ધતિ અને વિચલન વિશ્લેષણ જેવા અભ્યાસક્રમ મુજબ આવરી લીધેલ છે.

કોમર્સ વિષયનાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યાપકો અને સંલગ્ન કોલેજોના સહયોગથી આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે.

આ પુસ્તક તૈયાર કરવામાં ભાનનીય વાઈસ-ચાન્સેલરશ્રી પ્રો. શીરીષભાઈ કુલકર્ણી, રજુસ્ટ્રારશ્રી સરદાર પટેલ યુનિવર્સિટી, યુનિવર્સિટી પ્રેસ, અને બાધ્ય અભ્યાસક્રમ વિભાગનું માર્ગદર્શન, સહકાર અને સૂચનો મળતા રહ્યા છે. આ તબક્કે લેખક ભિત્રોનો પણ આભાર ભાનીએ છીએ.

તા. : ૭ મે ૨૦૨૦
વલભ વિધાનગાર

પ્રો. સંદિપ કે. ભંડુ
ફેફ એન્ડ ડીન
અનુસ્નાતક બિઝનેશ સ્ટડીઝ વિભાગ
સરદાર પટેલ યુનિવર્સિટી
વલભ વિધાનગાર

Fundamentals of Cost and Management Accounting

અનુક્ષમણિકા

પ્રકરણ ૧	પડતર હિસાબી પદ્ધતિની આવશ્યકતા (ફક્ત થીયરી) - શ્રી ચિરાગ જરીવાલા, આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રી આઈ.વી. પેટેલ કોલેજ ઓફ કોમર્સ, નડિયાદ	01
પ્રકરણ ૨	માલસામાન અને મજૂરી પડતર (ખર્ચ) - શ્રી ચિરાગ જરીવાલા, આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રી આઈ.વી. પેટેલ કોલેજ ઓફ કોમર્સ, નડિયાદ	20
પ્રકરણ ૩	પરોક્ષ ખર્ચાઓ / શિરોપરી ખર્ચાઓ - ડૉ. ભૌતિક એ. પેટેલ, કેચ્ચુટી એકાઉન્ટન્ટ, સરદાર પેટેલ યુનિવર્સિટી વલલભ વિદ્યાનગર	52
પ્રકરણ ૪	(૧) એકમ પડતર (૨) નાણાંકીય હિસાબો અને પડતરનાં હિસાબોની મેળવણી - ડૉ. સુનિલ ત્રિવેદી, આસિસ્ટન્ટ પ્રોફેસર (I/c Principal), એઆઈબીએસ, આણંદ	99 131
પ્રકરણ ૫	સંચાલકીય હિસાબી પદ્ધતિ : લાક્ષણિકતાઓ અને કાર્યક્ષેત્ર (ભાગ થીયરી) - ડૉ. સુનિલ ત્રિવેદી, આસિસ્ટન્ટ પ્રોફેસર (I/c Principal), એઆઈબીએસ, આણંદ	159
પ્રકરણ ૬	અંદાજપત્ર (બજેટ) અને અંદાજપત્ર ક્ષારા અંકુશા (બજેટરી કંટ્રોલ) - ડૉ. ખ્યાતિ જે. પેટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સેમકોમ કોલેજ, વલલભ વિદ્યાનગર	176
પ્રકરણ ૭	પડતર - જથ્થા - નફા વિશ્લેષણ - ડૉ. વાય. એમ. દલવાડી, પ્રોફેસર, અનુસ્નાતક બિઝનેશ સ્ટડીઝ વિભાગ, સરદાર પેટેલ યુનિવર્સિટી, વલલભ વિદ્યાનગર	223
પ્રકરણ ૮	પ્રમાણ પડતર પદ્ધતિ અને વિચલન વિશ્લેષણ - ડૉ. વાય. એમ. દલવાડી, પ્રોફેસર, અનુસ્નાતક બિઝનેશ સ્ટડીઝ વિભાગ, સરદાર પેટેલ યુનિવર્સિટી, વલલભ વિદ્યાનગર	253

સંપાદક : પ્રો. સંદિપ કે. ભરૂ

હેડ એન્ડ ડીન

અનુસ્નાતક બિઝનેશ સ્ટડીઝ વિભાગ

સરદાર પેટેલ યુનિવર્સિટી

વલલભ વિદ્યાનગર

સમીક્ષક: ડૉ. અચ. સી. સરદાર

પ્રોફેસર

એસ.ડી. સ્કુલ ઓફ કોમર્સ

ગુજરાત યુનિવર્સિટી

નવરંગપુરા, અમદાવાદ

પ્રકારણા: ૧

પડતર હિસાબી પદ્ધતિની આવશ્યકતા (ફક્ત થીયરી)

- ૧ પડતર હિસાબી પદ્ધતિનો પરિચય, વ્યાખ્યા અને જ્યાંસ
- ૨ નાણાંકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિ
- ૩ પડતર હિસાબી પદ્ધતિની લાક્ષણિકતાઓ (લક્ષણો)
- ૪ પડતર હિસાબી પદ્ધતિની સ્થાપના (પ્રસ્થાપન)
- ૫ પડતર હિસાબી પદ્ધતિનાં ફાયદાઓ અને મર્યાદાઓ
- ૬ પડતર હિસાબી પદ્ધતિની પદ્ધતિઓ અને તકનીકો
- ૭ પડતરનું વર્ગીકરણ
- ૮ પડતરનાં તત્ત્વો (ભૂળતત્ત્વો)
- ૯ પડતરનાં એકમો
- ૧૦ પડતર કેન્દ્ર
- ૧૧ સ્વાધ્યાય

૧ પડતર હિસાબી પદ્ધતિનો પરિચય, વ્યાખ્યા અને ખ્યાલ:

૧.૧ પડતર હિસાબી પદ્ધતિનો પરિચય:

પડતર હિસાબી પદ્ધતિ એ નામાપદ્ધતિની એક આધુનિક શાખા છે. નાણાંકીય હિસાબોમાં નાણાંકીય લેવડ-ટેચડો નોંધવામાં આવે છે અને વર્ષના અંતે નફા-નુકશાન ખાતું, પાંકું સરવૈયું તૈયાર કરી ધંધાનું પરિણામ એટલે કે નફો કે નુકશાન અને આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. નાણાંકીય હિસાબોની મર્યાદાઓ (ખામીઓ)માંથી પડતર હિસાબી પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે. પેદાશ કે સેવા કે વસ્તુની પડતર કેટલી થઈ?, કઈ વસ્તુનું ઉત્પાદન કર્યું?, કઈ વસ્તુની પડતર કેટલી આવી?, કઈ વસ્તુનું ઉત્પાદન બંધ કર્યું?, કઈ વસ્તુમાં નફો થાય છે?, કઈ વસ્તુમાં ખોટ જાય છે?, પેદાશ (વસ્તુ) કે સેવાની વેચાણાક્રિમત કે ટેન્કર કિંમત કેટલી રાખવી?, વિદેશ ઓર્ડર સ્વીકારવો કે નહીં?, કોઈ કરાર કઈ કિંમતે સ્વીકારવો વગેરે નાણાંકીય હિસાબો પરથી જાણી શકાતું નથી. આ બધાં જ પ્રક્રોનાં જવાબો પડતરના હિસાબો પરથી મળી જાય છે.

૧.૨ પડતર હિસાબી પદ્ધતિની વ્યાખ્યા અને ખ્યાલ:

સામાન્ય રીતે પડતરનાં હિસાબો ઉત્પાદિત પેદાશ કે સેવાની પડતર શોધવા માટે તૈયાર કરવામાં આવે છે.

પડતર હિસાબી પદ્ધતિ એવી હિસાબી પદ્ધતિ છે જેમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાના પરિણામે ઉદ્ભવતાં જુદાં-જુદાં પ્રકારનાં પડતરનાં મૂળતત્વો (માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચો)ની નોંધ અને ફાળવણી, અહેવાલ પ્રેષણ કરી વસ્તુ કે સેવાની કુલ પડતર અને એકમદીઠ પડતરનું વિગતવાર પૃથક્કરણ રજૂ કરવામાં આવે છે.

પડતરનાં હિસાબો એક એવી હિસાબી પદ્ધતિ છે કે જેના દ્વારા યોગ્ય ચોકસાઇપૂર્વક ઉત્પાદિત પેદાશ કે સેવાના દરેક એકમની કુલ પડતર શોધી પડતર (ખર્ચ)નું યોગ્ય પૃથક્કરણ રજૂ થાય છે.

ડબલ્યુ. ડબલ્યુ. બીઝાના મતે, “પડતર હિસાબી પદ્ધતિ એટલે પ્રમાણમાં વ્યાજબી, ચોકસાઇપૂર્વક દરેક એકમના ખર્ચનું પૃથક્કરણ અને વર્ગીકરણ કરી કુલ પડતર તથા તેવું વિભાગવાર બંધારણ નક્કી કરવાની કાર્યપદ્ધતિ છે.

માલ કે સેવાની પડતર નક્કી કરી પડતર ઘટાડવા માટેની પદ્ધતિ એટલે પડતર હિસાબી પદ્ધતિ.

૨ નાણાંકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિ:

મુદ્દા	નાણાંકીય હિસાબી પદ્ધતિ	પડતર હિસાબી પદ્ધતિ
અર્થ	નાણાંકીય હિસાબોનો ઉદ્દેશ કાયદાકીય જરૂરિયાતો અને બહારના પક્ષકારોને ધંધાનો નફો કે ખોટ તથા ધંધાની આર્થિક પરિસ્થિતિની માહિતી આપવાનો છે.	પડતરના હિસાબો વસ્તુ કે સેવાની પડતર નક્કી કરવી, પડતરનું પૃથક્કરણ કરવું, પડતરમાં ઘટાડો કરવો અને પડતર પર અંકુશ રાખવો.
ઉપયોગિતા	નાણાંકીય હિસાબો ધંધાનો નફો કે ખોટ નક્કી કરે છે અને આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે.	પડતરના હિસાબો પેદાશ કે સેવાની પડતર નક્કી કરે છે. પડતર ઘટાડવા ઉપયોગી છે, પડતર પર અંકુશ રાખવા ઉપયોગી છે.

મુદ્દા	નાણાંકીય હિસાબી પદ્ધતિ	પડતર હિસાબી પદ્ધતિ
ફરજુયાત કે મરજુયાત	ભારતીય કંપની ધારા સંદિગ્દી અન્ય ધારાઓ હેઠળ નાણાંકીય હિસાબો તૈયાર કરી રજૂ કરવા ફરજુયાત છે.	પડતરનાં હિસાબો રાખવા મરજુયાત છે. કંપનીની જરૂરિયાત મુજબ પડતરનાં હિસાબો રાખી શકાય.
મુદ્દત (સમયગાળો)	નાણાંકીય હિસાબો વર્ષના અંતે (વાર્ષિક) રજૂ થાય છે, તેમ છતાં ત્રિમાસિક, છ માસિક, નવ માસિક કે વાર્ષિક રજૂ થઈ શકે છે.	પડતરનાં હિસાબો ટૂંકાગાળા માટે તૈયાર કરવામાં આવે છે.
સમાવેશ	નાણાંકીય હિસાબોમાં ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. જે નાણાંમાં રજૂ થઈ શકે.	પડતરના હિસાબોમાં ફક્ત પડતરને લગતી જ માહિતીનો સમાવેશ થાય છે.
આધાર (પાચો)	નાણાંકીય હિસાબો ધંધાના આર્થિક વ્યવહારો, નફા-નુકશાન ખાતું, પાકું સરવૈચું, રોકડ પ્રવાહ પત્રક વગેરે પર આધારિત છે.	પડતરનાં હિસાબો પડતર પર આધારિત છે. વસ્તુની પડતર કેવી રીતે બનેલી છે, વસ્તુની કુલ પડતર, વેચાણ કિંમત કેટલી છે વગેરે પર આધારિત છે.
નમૂનો (ફોર્મ)	નાણાંકીય હિસાબો કંપની ધારામાં આપેલા ફોર્મ (નમૂના) મુજબ જ તૈયાર થાય છે એટલે કે નાણાંકીય હિસાબો નિર્ધારીત માળખામાં (સ્ટાન્ડર્ડ ફોર્મમાં) તૈયાર થાય છે.	પડતરનાં હિસાબો રજૂ કરવા અને તૈયાર કરવા કોઈ ચોક્કસ ફોર્મ / નમૂના નથી. જરૂરિયાત મુજબ પડતરના હિસાબો તૈયાર કરવામાં આવે છે.
ઓળારો / સાધનો / પદ્ધતિઓ	નાણાંકીય હિસાબોમાં પડતરનાં હિસાબો, આંકડાશારણ, અર્થશારણ વગેરેનો ઉપયોગ થતો નથી.	પડતરનાં હિસાબોમાં પ્રમાણ પડતર, અંદાજપત્રીય અંકુશ, સીમાંત પડતર, સમતૂટ બિંદુ વિશ્લેષણ, પડતર નફા-જથ્થા વિશ્લેષણ વગેરેનો ઉપયોગ થાય છે.
રકમની ચોક્કસાઈ	નાણાંકીય હિસાબોમાં રકમ ચોક્કસ રૂપિયા સુધી દર્શાવવાની છૂટ છે. દા.ત.: રૂ ૧,૧૫,૫૦૦/- રકમ હોય તો રૂ ૧,૧૫,૭૦૦/- રકમ દર્શાવી શકાય એટલે કે રકમ દરારમાં/ લાખમાં રજૂ કરવાની છૂટ છે.	પડતરનાં હિસાબોમાં રકમ ચોક્કસ હોય છે. રકમ દરાર કે લાખ રૂપિયામાં દર્શાવવાની છૂટ નથી. જે રકમ હોય તે જ દર્શાવાય છે.

૩ પડતર હિસાબી પદ્ધતિની લાક્ષણીકતાઓ (લક્ષણો):

(૧) પેદાશ કે સેવાની પડતર નક્કી કરવી:

ઉત્પાદિત થયેલ પેદાશ કે સેવાની પડતર નક્કી કરવા પડતરનાં હિસાબો ઉપયોગી છે. પેદાશ કે સેવાના ઉત્પાદન માટે થયેલ ખર્ચનો સરવાળો કરવાથી કુલ પડતર મળે છે. પડતરમાં નફો ઉમેરી વેચાણ કિંમત નક્કી કરી શકાય છે.

(૨) ખાતાવાર / વિભાગવાર / વસ્તુ કે પેદાશાદીઠ ખર્ચ (પડતર)નું વર્ગાકરણા:

તેમાં ખર્ચનું વર્ગાકરણ એવી રીતે થાય છે કે જેથી દરેક પ્રકારનાં ખર્ચ ખાતાવાર / વિભાગવાર / વસ્તુ કે પેદાશાદીઠ માહિતી મળી શકે. કઈ પેદાશાદીઠ ખર્ચ વધુ થાય છે કે ઓછો થાય છે, કઈ વસ્તુમાં વધુ નશો મળે છે કે ખોટ જાય છે, કઈ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ ચાલુ રાખવું કે બંધ કરવું વગેરે અંગેની માહિતી મળે છે.

(૩) ખાતાં / વિભાગ / પ્રકિયા / કરાર વગેરે ખાતે ખર્ચની વહેંચણી:

નક્કી કરેલ વર્ગાકરણને આધારે ખર્ચની નોંધ થાય છે પછી ખર્ચ ખાતાં / વિભાગ / પ્રકિયા / કરાર વગેરે ખાતે વહેંચી શકાય છે. દા. ત.: કાર્યાનુસાર પડતર વર્ગાકરણામાં ખર્ચને ચાર વિભાગમાં વહેંચી શકાય. (૧) કારખાના પરોક્ષ ખર્ચ્ચ, (૨) ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ્ચ, (૩) વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ્ચ અને (૪) સંશોધન અને વિકાસ ખર્ચ્ચ.

(૪) સંચાલકોની નીતિ ઘડતર માટે માર્ગદર્શન:

પડતરનાં હિસાબોનો એક ઉદ્દેશ સંચાલકોની નીતિ ઘડતર તેમજ રોજબરોજના સંચાલનમાં માર્ગદર્શન આપવાનો છે. પડતરની માહિતી એવી રીતે ગોઠવામાં આવે છે કે જેથી સંચાલકોને ચોંચ માર્ગદર્શન મળી રહે, ચોંચ નિર્ણયો લઈ શકે, બગાડ ઘટાડી શકાય, પડતર પર અંકુશ રહે, કરકસર લાવી શકાય.

(૫) પડતર હિસાબી પદ્ધતિઓમાં અસરકારક ઉપયોગ:

પડતરનાં હિસાબોમાં દરેક પ્રકારના ખર્ચની એવી રીતે નોંધ કરવામાં આવે છે કે જેથી તેના આધારે પડતરની પદ્ધતિ જેવી કે સીમાંત પડતર પદ્ધતિ, પ્રમાણ પડતર પદ્ધતિ, કરાર પડતર પદ્ધતિ, પ્રકિયા પડતર પદ્ધતિ વગેરે માટે ચોંચ માર્ગદર્શન મળી રહે છે.

(૬) પડતરનાં મૂળતત્વો અનુસાર પડતરનું વર્ગાકરણા:

પડતરનાં હિસાબોમાં પડતરનું વર્ગાકરણા (૧) પડતરનાં તત્ત્વો મુજબ, (૨) કાર્યાનુસાર, (૩) વર્તણૂક કે સ્વરૂપ મુજબ, (૪) સમય અનુસાર, (૫) પેદાશ / વસ્તુ અનુસાર, (૬) સંચાલકીય નિર્ણય અનુસાર થાય છે કે જેથી પડતરની વિવિધ પદ્ધતિ માટે ઉપયોગી નિવંડે છે. નીતિ વિષયક નિર્ણયો લેવામાં ઉપયોગી માર્ગદર્શન મળી રહે છે.

(૭) બગાડ, બંગાર, ઘટ વગેરેની માહિતી મળે છે:

ઉત્પાદનનાં જુદાં-જુદાં તબક્કે સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, અસામાન્ય વધારો, બંગાર, ઘટ, ખામીવાળો માલ વગેરેની માહિતી મળે છે તેથી બગાડ અટકાવવા, પડતર ઘટાડવા તેમજ અસરકારક (કરકસરભર્યું) ઉત્પાદન કરવા ઉપયોગી છે.

(૮) પડતર ઘટાડવા તથા પડતર પર અંકુશ રાખી શકાય છે:

પડતરનાં હિસાબો પરથી પડતર (ખર્ચ) ઘટાડવા, પડતર પર અંકુશ રાખવા ચોંચ પગલાં લઈ શકાય છે.

૪ પડતર હિસાબી પદ્ધતિની સ્થાપના (પ્રસ્થાપન):

પડતર હિસાબી પદ્ધતિનું પ્રસ્થાપન કરવા માટે નીચેની કેટલીક બાબતો દ્યાનમાં રાખવી જોઈએ.

- (૧) વ્યવસ્થાતંત્રમાં ઓછામાં ઓછી ખલેલ (મુશ્કેલી) પડવી જોઈએ.
- (૨) પડતરનાં હિસાબોનો અમલ કરવા ઓછામાં ઓછો વિરોધ થવો જોઈએ.
- (૩) બિનજરૂરી ફોર્મ-પત્રકો રાખવા ન જોઈએ. વહીવટી ખર્ચ વધુ થવો ના જોઈએ.
- (૪) પડતર હિસાબી પદ્ધતિ દાખલ કરવાથી લાભ કરતાં ખર્ચ વધી ના જો જોઈએ. પડતર હિસાબી પદ્ધતિનો અમલ કરકસરભર્યો થવો જોઈએ.
- (૫) પડતરનાં હિસાબોનું માહિતીપ્રેષણ (માહિતીની આપ-લે) એવી રીતે થવું જોઈએ કે જેથી સંચાલકોને યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળી રહે.
- (૬) અપવાદ દ્વારા સંચાલનના સિદ્ધાંતનો ઉપયોગ થવો જોઈએ. જે કાર્ય કે પ્રવૃત્તિ બરાબર થતું હોય તેના પર દ્યાન આપવાને બદલે, જે કાર્ય કે પ્રવૃત્તિ બરાબર થતું ના હોય તેના પર દ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
- (૭) માલસામાન, મજૂરી અને ખર્ચ પર યોગ્ય અંકુશ હોવો જોઈએ. અંકુશ રાખવા યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.
- (૮) પડતર હિસાબનીશ (Cost Accountant)ની નિમણૂંક કરવી જોઈએ.
- (૯) પડતર કેન્દ્રો નક્કી કરવા જોઈએ કે જેથી પડતર પર અંકુશ રાખી શકાય.
- (૧૦) પડતર હિસાબી પદ્ધતિ દાખલ કરવાનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ.
- (૧૧) પડતર ઓફિસની ગોઠવણી કરવી જોઈએ કે જેથી સમયસર અહેવાતો તૈયાર કરી શકાય. દા. ત.: માલસામાનનાં હિસાબો રાખવા જેમાં માલસામાનની આવક-જાવકની નોંધ, બીનકાર્ડ, સ્ટોર્સ લેજર (સ્ટોક પત્રક) તૈયાર કરવા. મજૂરીનાં હિસાબો તૈયાર કરવા જેમાં સમય કાર્ડ, જોબકાર્ડ, તથા મજૂરનાં પત્રકો તૈયાર કરવા જોઈએ. પડતરનાં ખાતાં જેમાં જોબ (કાર્ય), બેચ, કરાર, પ્રક્રિયાના ખાતાનો સમાવેશ થાય છે. પડતર નિયંત્રણ ખાતાં તૈયાર કરવા જોઈએ. પડતર (ખર્ચ)ની અધિક (વધુ) તથા કમ (ઓછી) વસ્તુસાત નક્કી કરવી જોઈએ.
- (૧૨) સત્તા અને જવાબદારીની યોગ્ય સ્પષ્ટતા હોવી જોઈએ કે જેથી સંઘર્ષ (ધર્ષણા)ના પ્રશ્નો ઉપસ્થિત ના થાય.
- (૧૩) પડતર હિસાબી પદ્ધતિ ખર્ચીન ના હોવી જોઈએ. પડતર હિસાબી પદ્ધતિનો કરકસરભર્યો ઉપયોગ થવો જોઈએ.
- (૧૪) સંચાલકો અને કર્મચારીઓ વરચે સાથ-સહકાર હોવો જોઈએ.
- (૧૫) તાલીમ પામેલાં કર્મચારીઓની અછત હોય તો તેમને તાલીમ આપી તૈયાર કરવા જોઈએ.
- (૧૬) એકવખત પડતર હિસાબી પદ્ધતિ દાખલ કર્યા પછી કામગીરીની ચકાસણી કરવી જોઈએ. જરૂરી હોય તો સુધારા-વધારા કરી સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ.

૫ પડતર હિસાબી પદ્ધતિનાં ફાયદાઓ અને મર્યાદાઓ:

પ.૧ પડતર હિસાબી પદ્ધતિનાં ફાયદાઓ (લાભો):

(૧) એકમદીઠ પડતર નક્કી કરવા માટે ઉપયોગી:

પડતરનાં હિસાબો પરથી ઉત્પાદિત થયેલાં પેદાશ કે સેવાની એકમદીઠ પડતર નક્કી કરી શકાય છે. ઉત્પાદનનાં જુદાં-જુદાં તબક્કાઓમાં વસ્તુની પડતર જાણી શકાય છે. પડતરનું વર્ગીકરણ સાચી રીતે કરી શકાય છે.

(૨) વ્યાજબી વેચાણ કિંમત નક્કી કરી શકાય છે:

પડતરનાં હિસાબો પરથી વ્યાજબી પડતર કિંમત નક્કી કરી શકાય છે. વ્યાજબી દરે નફો ઉમેરી વ્યાજબી વેચાણ કિંમત કે ટેન્ડર કિંમત નક્કી કરી શકાય છે.

(૩) પડતર પર અંકુશ રાખી શકાય છે:

ઉત્પાદનનાં જુદાં-જુદાં તબક્કે, દરેક પેદાશ પ્રમાણો, ખાતાં / વિભાગ પ્રમાણો પડતર (ખર્ચ) જાણી શકાય છે તેથી પડતર પર યોગ્ય અંકુશ રાખી શકાય છે, પડતર ઘટાડો કરી શકાય છે.

(૪) માલસામાન પર અંકુશ રાખવા ઉપયોગી:

પડતરનાં હિસાબોના ઉપયોગ દ્વારા વિવિધ પ્રકારનાં માલસામાન જેવાં કે, કાચો માલ, અર્ધતૈયાર માલ, તૈયાર માલ, ભંગાર, ખામીવાળો માલ, ચાલુ કામ વગેરે પર અંકુશ રાખી બગાડનું પ્રમાણ ઘટાડી શકાય છે. માલસામાન પર અંકુશ રાખવા માલસામાનની ABC પદ્ધતિ, બીનકાર્ડ, સ્ટોકપત્રક, આર્થિક વરદી જથ્થો, માલસામાનની વિવિધ સપાટીઓ (કક્ષાઓ) જેવી કે ગુરુતમ સપાટી, લધુતમ સપાટી, વરદી સપાટી (માલનો ઓર્ડર મુકવાની સપાટી), ભય સપાટી, સતત સ્ટોકની ગણતરી વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

(૫) સરખામણી કરવા ઉપયોગી:

ગયા વર્ષની પડતરની માહિતીની ચાલુ વર્ષની માહિતી સાથે સરખામણી કરી શકાય છે. પડતર ઘટાડો થયો કે પડતર વધારો થયો, તેનાં કારણો જાણી સુધારાત્મકી પગલાં લઈ શકાય છે.

(૬) નવીન સંશોધનોને ઉતેજના:

પડતરનાં હિસાબો પરથી નવા-નવા સંશોધનો કરવાની પ્રેરણા મળે છે.

(૭) બિનનફાકારક પ્રવૃત્તિઓ જાણવા ઉપયોગી:

પડતરનાં હિસાબો પરથી ધંધાની બિનનફાકારક પ્રવૃત્તિઓ જાણી શકાય છે. તે દૂર કરવા સુધારાત્મકી પગલાં લઈ શકાય છે.

(૮) નફો કે ખોટના કારણોનો ખ્યાલ આવે છે:

પડતરનાં હિસાબો પરથી ધંધામાં નફો થાય છે કે ખોટ જાય છે તેનાં કારણો જાણી શકાય છે.

(૯) બગાડ / ઘટની માહિતી મળે છે:

પડતરનાં હિસાબો પરથી બગાડ / ઘટની માહિતી મળે છે. સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, અસામાન્ય વધારો વગેરે કેટલાં છે તે જાણી શકાય છે. ઈંધારાનો બગાડ થતો અટકાવી શકાય છે. બગાડ દૂર થતાં કાર્યક્ષમતા કે સરકસરતા લાવી શકાય છે.

(૧૦) મંદી / કટોકટીએં વેચાણ કિંમત ઘટાડવા ઉપયોગી:

મંદી કે કટોકટીએં કંપનીને વસ્તુ / સેવાની વેચાણ કિંમત ઘટાડવાની ફરજ પડે છે. જો વેચાણ કિંમત વધુ પડતી ઘટાડવામાં આવે તો ખોટ જાય છે અથવા નફો ઓછો થાય છે. સમતૂટ બિંદુ શોધી ઉત્પાદન-વેચાણની એવી સપાટી શોધવામાં આવે છે જ્યાં ખર્ચ અને આવક સરખા થાય છે, નફો-નુકશાન હોતાં નથી, સમતૂટ બિંદુ કરતાં ઉત્પાદન અને વેચાણ વધશે તો નફો થશે, સમતૂટ બિંદુ કરતાં ઉત્પાદન અને વેચાણ ઘટશે તો ખોટ જશે.

(૧૧) સંચાલકોને નિર્ણય ઘડતરમાં મદદરૂપ:

પડતરનાં હિસાબો સંચાલકોને મહત્વનાં નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. દા. ત.: ઉત્પાદન કે વેચાણ ચાલુ રાખવું કે બંધ કરવું, ‘ખરીદવું કે બજારવું’, વિદેશ બજારમાં વેચાણ કરવું કે નહીં, વિદેશ બજારનો ઓર્ડર સ્વીકારવો કે નહીં, કઈ વસ્તુ / પેદાશ નફાકારક છે કે ખોટ કરતી છે.

(૧૨) સંચાલકોને ધંધાના સંચાલનામાં મદદરૂપ:

પડતરનાં હિસાબો સંચાલકોને ધંધાના સંચાલનમા અનેક રીતે મદદરૂપ થાય છે. દા. ત.: પડતર અંકુશ, પડતર ઘટાડો, બજેટ (અંદાજપત્રો) તૈયાર કરવાં, આંતરપેઢી તુલના, વેચાણ કિંમત નક્કી કરવી, નફો થશો કે ખોટ જ્શો, વગેરે.

૫.૨ પડતર હિસાબી પદ્ધતિનાં ગેરકાયદાઓ (ગેરલાભો / મર્યાદાઓ / ખામીઓ):

(૧) બિનજરૂરી છે:

ધારણાં નિષ્ઠાંતોના મતે પડતર હિસાબી પદ્ધતિ બિનજરૂરી છે, કારણ કે ભૂતકાળમાં પડતરનાં હિસાબો ન હતા ત્યારે પણ ધંધા / ઉધોગોનો વિકાસ થયો હતો.

પરંતુ હાલના આધુનિક અને હરિફાઈયુક્ત યુગમાં પડતર હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. વેચાણ કિંમત વ્યાજબી રીતે નક્કી કરી શકાય છે કે જેથી ખોટના જાય, બિનજરૂરી કે ખોટાં ખર્ચ દૂર કરી શકાય છે, પડતર ઘટાડો કરી પડતર પર અંકુશ રાખી શકાય છે.

(૨) ખર્ચાળ છે:

એવી પણ દલીલ કરવામાં આવે છે કે પડતર હિસાબી પદ્ધતિ ખર્ચાળ છે. પડતર હિસાબી પદ્ધતિ દાખલ કરવાનો ખર્ચ જરૂર થાય છે પરંતુ તેમાંથી મળતા ફાયદાઓ ધારણાં છે. હાલના જમાનામાં પડતર હિસાબી પદ્ધતિના ઉપયોગ વિના ધંધો ચાલી શકે નથી.

(૩) ઈજારાયુક્ત ઉધોગોમાં બિનજરૂરી:

ઇજારાયુક્ત ઉધોગોમાં પેઢી મનજાવે તે રીતે (મનસ્વી રીતે) ગ્રાહકો પાસેથી કિંમત વસૂલ કરી શકે છે. અવેજુ વસ્તુ બજારમાં દાખલ થવાનો ભય રહે છે.

(૪) ખોટા નિર્ણયોની પ્રતીકૂળ અસરો:

એમ કહેવાય છે કે, ઉપરની ખામીઓ પડતરનાં હિસાબોની નથી પરંતુ ખોટી કે અધુરી માહિતીને લીધે ખોટા નિર્ણયો લેવાય તો તેનાથી ધંધાને નુકશાન જાય છે. પડતરનાં હિસાબોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ધંધા માટે ફાયદાકારક છે જ.

(૧૨) ગૂંચવાડા ભરેલી અથવા જટિલ છે:

પડતર હિસાબી પદ્ધતિ જટિલ છે અને ગૂંચવાડા ભરેલી છે તેથી સામાન્ય ભાણસ સમજુ શકતો નથી. પરંતુ પડતર હિસાબી પદ્ધતિનો અમલ કરતાં પહેલાં યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેનાં લાભો ચોક્કસ મળે જ છે તેમાં કોઈ બેમત નથી જ.

૬ પડતર હિસાબી પદ્ધતિની પદ્ધતિઓ અને તકનીકો:

પડતર હિસાબી પદ્ધતિમાં નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

- (૧) એકમ પડતર પદ્ધતિ
- (૨) જોબ અથવા બેચ પડતર પદ્ધતિ
- (૩) કરાર / કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિ
- (૪) પ્રિયા પડતર પદ્ધતિ
- (૫) સેવા પડતર પદ્ધતિ

(૭) વિવિધ (અનેકવિધ) પડતર પદ્ધતિ

૭.૧ એકમ પડતર પદ્ધતિ:

જે ઉદ્યોગોમાં ઉત્પાદનની પ્રક્રિયા સતત હોય, એકસરખી જ વસ્તુનું ઉત્પાદન થતું હોય, વસ્તુનાં એકમો (units) એકસરખાં હોય, ઉત્પાદન ચોક્કસ એકમમાં માપી શકાય એમ હોય ત્યારે વસ્તુની પડતર શોધવા એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

એકમ પડતર પદ્ધતિમાં પડતરનું પત્રક નીચે મુજબ તૈયાર કરી કુલ પડતર અને એકમદીઠ પડતર શોધવામાં આવે છે.

પડતરનું પત્રક

(ઉત્પાદન અને વેચાણ રૂઠીઓ એકમો)

વિગત	એકમદીઠ (₹)	કુલ (₹)
પ્રત્યક્ષ માલસામાન	૨૦૦	૨૦૦૦૦૦
+ પ્રત્યક્ષ મજૂરી	૧૦૦	૧૦૦૦૦૦
+ પ્રત્યક્ષ ખર્ચ	૫૦	૫૦૦૦૦
પ્રાથમિક પડતર		૩૫૦
+ કારખાના પરોક્ષ ખર્ચ (ઉત્પાદન પરોક્ષ ખર્ચ)	૮૦	૮૦૦૦૦
કારખાના પડતર		૪૩૦
+ ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ	૪૦	૪૦૦૦૦
ઉત્પાદન પડતર		૪૭૦
+ વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ	૩૦	૩૦૦૦૦
કુલ પડતર		૫૦૦
+ ચોખ્ખો નફો ૨૦% પડતર કિંમત પર	૧૦૦	૧૦૦૦૦૦
વેચાણ કિંમત		૬૦૦
		૬૦૦૦૦૦

❖ ઉદ્યોગોનાં નામઃ

એકમ પડતર પદ્ધતિ નીચેનાં ઉદ્યોગોમાં અનુકૂળ છે.

- | | |
|---------------------------------|-----------------------|
| (૧) કાગળની ભીલ | (૨) કોલસાની ખાણ |
| (૩) સિમેન્ટ ઉદ્યોગ | (૪) દાડ ઉદ્યોગ |
| (૫) દંટો બનાવવાનો ઉદ્યોગ | (૬) ડેરી ઉદ્યોગ |
| (૭) અનાજ દળવાની દંટી (ફલોર ભીલ) | (૮) પોલાદનું કારખાનું |

૭.૨ જોબ અથવા બેચ પડતર પદ્ધતિ:

જોબ એટલે કોઈ વ્યક્તિગત નાના-નાના ઓર્ડરનો ઉત્પાદન માટેનો જથ્થો, જોબ પડતરમાં દરેક જોબદીઠ પડતર અલગ-અલગ ગણવામાં આવે છે. દરેક માટે અલગ જોબ ખાતું ખોલવામાં આવે છે.

દા. ત.: પ્રિન્ટીંગ પ્રેસમાં પુસ્તક છાપવા માટે ૫,૦૦૦ પુસ્તકો છાપવાનો ઓર્ડર મળ્યો. કાગળનો ખર્ચ ₹ ૧૦,૦૦૦/-, છપામણી શાહીનો ખર્ચ ₹ ૧૫,૦૦૦/-, બાઈન્ડિંગનો ખર્ચ ₹ ૫,૦૦૦/- થયો. નફો પડતર પર ૨૫% ગણવાનો છે, તો જોબની પડતર નીચે મુજબ શોધાશો.

કાગળનો ખર્ચ	₹ ૧૦,૦૦૦/-
+ છપામણી શાહીનો ખર્ચ	₹ ૧૫,૦૦૦/-
+ બાઈન્ડિંગનો ખર્ચ	₹ ૫,૦૦૦/-
કુલ પડતર	₹ ૩૦,૦૦૦/-
+ નફો (પડતર ₹ ૩૦,૦૦૦ પર ૨૫%)	₹ ૭,૫૦૦/-
જોબની પડતર	₹ ૩૭,૫૦૦/-

❖ ઉદ્ઘોગનાં નામ:

જોબ અથવા બેચ પડતર પદ્ધતિ નીચેનાં ઉદ્ઘોગમાં અનુકૂળ છે.

જોબ પડતર પદ્ધતિ:

- (૧) ફાઉન્ડી ઉદ્ઘોગ
- (૨) ઓટોમોબાઇલ્સ ગેરેજ
- (૩) છાપકામ (પ્રિન્ટીંગ પ્રેસ)
- (૪) રંગરોગાન ઉદ્ઘોગ

બેચ પડતર પદ્ધતિ:

- (૧) દવા બનાવવાનો ઉદ્ઘોગ
- (૨) સાઇકલ, મોટર, બાઈકનાં સ્પેર પાટર્સ બનાવવાનો ઉદ્ઘોગ
- (૩) હાર્ડવેર ઉદ્ઘોગ
- (૪) બિસ્કીટ ઉદ્ઘોગ (બેકરી)

૬.૩ કરાર / કોન્ટ્રાક્ટ પડતર પદ્ધતિ:

કોન્ટ્રાક્ટર્સ મકાન, પુલ, બ્રિજ, વહાણા, જહાજ વગેરે બાંધવાનો કરાર લે છે. કરારનાં ખર્ચ કેટલાં થયા, આવકો કેટલી થઈ, પ્રમાણિત કામ, બિનપ્રમાણિત કામ, હાથ પરનો માલસામાન, હાથ પરનાં ચંત્રો કે પ્લાન્ટ કેટલો છે તથા કરાર મેળવવાથી નફો થયો કે ખોટ ગઈ તે જાણવા દરેક કરારદીઠ ‘કરાર ખાતું’ અલગ-અલગ તૈયાર કરે છે કે જેથી દરેક કરારનો નફો કે નુકશાન અલગ જાણી શકાય.

કરારનાં ખર્ચ કરાર ખાતે ઉધારાય છે, કરારની આવકો કરાર ખાતે જમા થાય છે. કરાર પૂરો થઈ ગયો હોય તો કરાર કિંમત પણ કરાર ખાતે જમા થાય છે. કરાર ખાતાની ઉધાર બાજુ તફાવત નફો કહેવાય છે અને કરાર ખાતાની જમા બાજુ તફાવત ખોટ કહેવાય છે.

દા. ત.: રમેશભાઈએ મકાન બાંધવાનો કરાર ₹ ૫,૦૦,૦૦૦/-માં લીધો. માલસામાન ખર્ચ ₹ ૧,૫૦,૦૦૦/-, મજૂરી ₹ ૩,૦૦,૦૦૦/-, ચંત્રોનો ઘસારો ₹ ૧૦,૦૦૦/-, ઓજરોનું ભાડું ₹ ૨,૦૦૦/-, અન્ય પરચૂરણ ખર્ચ ₹ ૫૦,૦૦૦/- થયાં. કરાર ખાતું નીચે મુજબ તૈયાર થશે.

૬.

કરાર ખાતું

૪.

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
માલસામાન	૧૫૦૦૦૦	કરાર આપનાર ખાતે	૫૦૦૦૦૦
મજૂરી	૩૦૦૦૦૦	(કરાર કિંમત)	
ચંત્રોનો ઘસારો	૧૦૦૦૦		
ઓજારોનું ભાડું	૨૦૦૦		
અન્ય પરચૂરણ ખર્ચ	૫૦૦૦૦		
નફા-નુકશાન ખાતે	૮૮૦૦૦		
(ચોખ્ખો નફા)			
	૫૦૦૦૦૦		૫૦૦૦૦૦

❖ ઉદ્યોગોનાં નામઃ

કરાર પડતર પદ્ધતિ નીચેનાં ઉદ્યોગોમાં અનુકૂળ છે.

- (૧) મકાન બાંધકામ
- (૨) પુલ કે રસ્તા બાંધકામ
- (૩) વહાણ કે જહાજ બાંધકામ

૫.૪ પ્રક્રિયા પડતર પદ્ધતિઃ

કોઈ વસ્તુ કે પેદાશનું ઉત્પાદન જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. પહેલી પ્રક્રિયામાં કાચો માલ દાખલ કરવામાં આવે છે. તેના પર વિવિધ પ્રક્રિયા થતા છેદ્ધી પ્રક્રિયા પૂરી થતા માલ તૈયાર થાય છે અથવા વેચવાને લાયક બને છે. પહેલી પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયા માટે કાચો માલ અથવા દાખલ કરેલ માલ કહેવાય છે. છેદ્ધી પ્રક્રિયા પૂરી થતા તૈયાર માલ ઉત્પાદન ખાતે, વેપાર ખાતે, ગોડાઉનમાં લઈ જવામાં આવે છે.

દરેક પ્રક્રિયાઈઠ પ્રક્રિયાનાં ખાતાઓ અલગ ખોલવામાં આવે છે. પ્રક્રિયાનાં ખર્ચાઓ જેવાં કે, માલસામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ, ઉત્પાદન ખર્ચ (કારખાનાનાં ખર્ચ) તથા અસામાન્ય વધારો પ્રક્રિયા ખાતે ઉધારાય છે. જ્યારે સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, ભંગારમાલનું વેચાણ, તૈયાર માલ હવે પછીની પ્રક્રિયામાં લઈ જવો વગેરે જમા થાય છે.

દા. ત.: કાપડની મીલમાં સ્પિનીંગની પ્રક્રિયાનાં ખર્ચ નીચે મુજબ થયાં.

કાચોમાલ (સુતર) ₹ ૧,૦૦,૦૦૦/-, મજૂરી ₹ ૨,૫૦,૦૦૦/-, કારખાના ખર્ચ ₹ ૧,૦૦,૦૦૦/-, સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના ૧૦%.

સ્પિનીંગની પ્રક્રિયામાં દાખલ કરેલ કાચોમાલ (સુતર) ૧,૦૦૦ કિલોગ્રામ. પ્રક્રિયા ખાતું તૈયાર કરી કિલોટીઠ સુતરની પ્રક્રિયા નીચે પ્રમાણે શોધાશો.

૬.

સ્પિનીંગની પ્રક્રિયાનું ખાતું

૪.

વિગત	કિલો	રકમ (₹)	વિગત	કિલો	રકમ (₹)
માલસામાન	૧૦૦૦	૧૦૦૦૦૦	સામાન્ય બગાડ (દાખલ		
મજૂરી	-	૨૫૦૦૦૦	કરેલ એકમના ૧૦%)	૧૦૦	૦

વિગત	કિલો	રકમ (₹)	વિગત	કિલો	રકમ (₹)
કારખાના પરોક્ષ ખર્ચ	-	૧૦૦૦૦૦	ઉત્પાદન બીજુ પ્રક્રિયા ખાતે લઈ ગયા	૮૦૦	૪૫૦૦૦૦
	૧૦૦૦	૪૫૦૦૦૦		૧૦૦૦	૪૫૦૦૦૦

$$1 \text{ કિલોટીઠ સુતરની પડતર} = \frac{૪૫૦૦૦૦}{૮૦૦} = ₹ ૫૦૦/-$$

❖ ઉધોગોનાં નામઃ

પ્રક્રિયા પડતર પદ્ધતિ નીચેનાં ઉધોગોમાં અનુકૂળ છે.

- (૧) રસાયણ (કેમિકલ) ઉધોગ
- (૨) સાબુ બનાવવાનો ઉધોગ
- (૩) ખાદ્ય પદાર્થો બનાવવાનો ઉધોગ
- (૪) રંગ, શાહી, વાર્નિશ બનાવવાનો ઉધોગ
- (૫) કાપડ ઉધોગ
- (૬) ફર્નિચર ઉધોગ
- (૭) ઓર્ડિલ (પેટ્રોલિયમ) રિફાઇનરી

૭.૫ સેવા પડતર પદ્ધતિઃ

જે ઉધોગોમાં માલનું ઉત્પાદન થતું ના હોથ પરંતુ સેવા પૂરી પાડવામાં આવતી હોથ તેવાં ઉધોગોમાં સેવા પડતર પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. સેવા પડતર પદ્ધતિ ખાસ કરીને પાણી પુરવઠા, વીજળી પુરવઠા, રેલ્વે, વાહનવ્યવહાર, ગેસ પુરવઠા, હોટલ, બેંકિંગ સેવા, વીમા કંપની, હોસ્પિટલ વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.

દા. ત.: આરામ ટ્રાન્ઝપોર્ટ કંપની ૫૦ પેસેન્જર્સની ક્ષમતાવાળી લક્ઝરી બસ ચલાવે છે. બે શહેરો વર્ચે ૫ વળતી ટ્રીપ કરે છે. ને શહેરો વચ્ચેનું અંતર ૨૦ કિલોમીટર છે. બસ મહિનાનાં ૨૫ દિવસ ચાલે છે.

લક્ઝરી બસનાં ખર્ચ નીચે મુજબ છે.

કિકલ	₹ ૧,૫૦,૦૦૦/-
ઓર્ડિલ-ગ્રીસ	૨૦,૦૦૦/-
ડ્રાઇવરનો પગાર	૨,૦૦,૦૦૦/-
કન્કકટરનો પગાર	૧,૮૦,૦૦૦/-
ટાયર-ટ્યુબનાં ખર્ચ	૧,૦૦,૦૦૦/-
આર. ટી. ઓ. ટેક્સ	૧,૦૦,૦૦૦/-

$$\begin{aligned} \text{પેસેન્જર કિલોમીટર} &= ૫૦ \text{ પેસેન્જર} \times ૨૫ \text{ દિવસ} \times ૨૦ \text{ કિ.મી.} \times ૨ \text{ વખત} \times ૫ \text{ ટ્રીપ} \\ &= ૨,૫૦,૦૦૦ \text{ પેસેન્જર કિલોમીટર} \end{aligned}$$

$$\begin{aligned}
 \text{કુલ ખર્ચ} &= ₹ 1,40,000 + ₹ 20,000 + ₹ 2,00,000 + \\
 &\quad ₹ 1,80,000 + ₹ 1,00,000 + ₹ 1,00,000 \\
 &= ₹ 7,40,000 /-
 \end{aligned}$$

$$\therefore \text{પેસેજર કિલોમીટરદીઠ પડતર} = \frac{740000}{240000} = ₹ 3/-$$

❖ ઉધોગોનાં નામઃ

સેવા પડતર પદ્ધતિ નીચેનાં ઉધોગોમાં અનુકૂળ છે.

- | | |
|--------------------|----------------------------------|
| (૧) રેલ્વે વ્યવહાર | (૨) રસ્તા વ્યવહાર |
| (૩) વીજળી ઉધોગ | (૪) ગેસ ઉધોગ |
| (૫) પાણી પુરવણા | (૬) હોસ્પિટલ |
| (૭) હોટલ | (૮) બેર્કિંગ સેવા |
| (૯) વીમા કંપની | (૧૦) વિમાન સેવા (Flight Service) |

૫.૬ વિવિધ (અનેકવિધ) પડતર પદ્ધતિઃ

જ્યારે કોઈ વસ્તુનાં છૂટા ભાગો (Spare Parts) જુદાં-જુદાં ખાતામાં તૈયાર થતાં હોથ અને પછી આ બધાં છૂટા ભાગો જોડી (Assemble) મુખ્ય વસ્તુ બનતી હોથ તેવાં ઉદ્દોગોમાં વિવિધ (અનેકવિધ) પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે.

ઘણીવાર વિવિધ (અનેકવિધ) પડતર પદ્ધતિમાં એક કરતા વધુ પડતરની પદ્ધતિનો ઉપયોગ થાય છે. દા. ત.: મોટરકાર ઉધોગમાં જુદાં-જુદાં ભાગો (Spare Parts) માટે જોબ કે બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે, જ્યારે મોટરકારની પડતર શોધવા માટે એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે.

જુદાં-જુદાં છૂટા ભાગો (Spare Parts)ની કિંમતનો સરવાળો કરી પડતર શોધવામાં આવે છે.

❖ ઉધોગોનાં નામઃ

વિવિધ (અનેકવિધ) પડતર પદ્ધતિ નીચેનાં ઉધોગોમાં અનુકૂળ છે.

- | | |
|-----------------------------|------------------|
| (૧) મોટરકાર, મોટરસાઇકલ ઉધોગ | (૨) ટાઇપરાઇટર |
| (૩) ટી. વી., રેડિયો ઉધોગ | (૪) ધડિયાળ |
| (૫) ઇલેક્ટ્રોનિક સાધનો | (૬) કોમ્પ્યુટર |
| (૭) એરોપ્લેન ઉધોગ | (૮) કેલ્ક્યુલેટર |

૭ પડતરનું વર્ગીકરણઃ

પડતરની લાક્ષણિકતા મુજબ જુદાં-જુદાં જીથ કે વર્ગમાં પડતરનું વર્ગીકરણ નીચે મુજબ થાય છે.

- | |
|--|
| (૧) પડતરનાં મૂળતત્વો મુજબ |
| (૨) કાર્યો કે કામગીરી મુજબ / કાર્યાનુસાર |
| (૩) સ્વરૂપ કે વર્તન મુજબ |
| (૪) સમય અનુસાર |
| (૫) પેદાશ / વસ્તુ કે મુદ્દત મુજબ |

(૬) સંચાલકીય નિર્ણય અનુસાર

૭.૧ પડતરનાં મૂળતટ્ટવો મુજબ વર્ગીકરણાઃ

પડતરનાં મૂળતટ્ટવો ૩ (ત્રણા) છે. (૧) માલસામાન, (૨) મજૂરી અને (૩) ખર્ચ. આ ત્રણા તટ્ટવોને (૧) પ્રત્યક્ષ પડતર, (૨) પરોક્ષ પડતર એવાં બે જૂથ કે વર્ગમાં વહેંચી શકાય.

૭.૧.૧ પ્રત્યક્ષ કે સીધી પડતરઃ

જે ઉત્પાદનનાં એકમ પડતર કેન્દ્ર, કામગીરી એકમ સાથે સીધી રીતે ઓળખી શકાય તેને પ્રત્યક્ષ પડતર કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં, જે પડતર કોઈ જોબ, કાર્ય, પ્રક્રિયા, કરાર, ખાતાં કે વિભાગ ખાતે સીધી ઉધારી શકાય અને જેની ફાળવણી કરવી પડે નહીં તેને પ્રત્યક્ષ પડતર કહેવાય છે. દા. ત.: પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ એ પ્રત્યક્ષ પડતર (ખર્ચ)નાં ઉદાહરણો છે.

૭.૧.૨ પરોક્ષ પડતરઃ

જે ખર્ચ કોઈ એક જ ઉત્પાદનના એકમ માટે અથવા પડતર કેન્દ્ર માટે કરવામાં આવ્યા ના હોય અને સમગ્ર ઉત્પાદન માટે કરવામાં આવ્યા હોય અને જેને સીધા ઉધારી ના શકાય પરંતુ જેની ફાળવણી કરવી પડે તેને પરોક્ષ પડતર કહેવાય છે. દા. ત.: કારખાના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ, વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ.

(અ) પ્રત્યક્ષ ખર્ચાઃ

(૧) પ્રત્યક્ષ માલસામાનઃ જે માલસામાન કોઈ જોબ, પ્રક્રિયા, ઉત્પાદન, કરાર, ખાતાં કે વિભાગ ખાતે સીધો ઉધારી શકાય અને જેની ફાળવણાતી કરવી પડતી નથી તે પ્રત્યક્ષ કે સીધો માલસામાન કહેવાય છે. દા. ત.: ફર્નિચર બનાવવામાં વપરાતું લાકડું, બુટ બનાવવામાં વપરાતી ઢોરી, વગેરે.

(૨) પ્રત્યક્ષ મજૂરીઃ વસ્તુનાં ઉત્પાદન માટે રોકાયેલા કામદારોને ચૂકવેલી મજૂરી એટલે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ.

(૩) સીધા (પ્રત્યક્ષ) ખર્ચાઃ ઉત્પાદનનાં અમુક જ એકમ માટે કરવામાં આવેલાં ખર્ચ એ પ્રત્યક્ષ ખર્ચ ગણાય છે. દા. ત.: કરા માટે ખરીદેલાં ખાસ / વિશિષ્ટ ચંત્રો કે પ્લાંટ.

(બ) પરોક્ષ (આડકતરાં / ઉપરવટ) ખર્ચાઃ

જે ખર્ચ બધાં જ ઉત્પાદનનાં એકમ માટે કરવામાં આવ્યા હોય અને જેની ફાળવણી કરવી પડે તેને પરોક્ષ ખર્ચ કહેવાય છે. દા. ત.: કારખાનાનું ભાડું, વીમો, કરવેરા.

(૧) પરોક્ષ માલસામાનઃ જે માલસામાનનો ખર્ચ એક જ એકમ માટે નહીં પરંતુ સમગ્ર ઉત્પાદનનાં એકમો માટે કરવામાં આવ્યો હોય તેને પરોક્ષ માલસામાન કહેવાય. દા. ત.: ખીલી, સ્ક્રૂ, ઓઇલ, ગ્રીસ.

(૨) પરોક્ષ મજૂરીઃ જે મજૂરી ખર્ચ એક જ એકમ માટે નહીં પરંતુ સમગ્ર ઉત્પાદનનાં એકમો માટે કરવામાં આવ્યો હોય તેને પરોક્ષ મજૂરી કહેવાય. દા. ત.: સુપરવાઈઝરનો પગાર, ટાઇભ કીપરની મજૂરી.

(3) અન્ય પરોક્ષ (આડકતરાં / ઉપટ્વટ) ખર્ચાઃ જે ખર્ચ એક જ એકમ માટે નહીં પરંતુ સમગ્ર ઉત્પાદનનાં એકમો માટે કરવામાં આવ્યા હોય તેને અન્ય પરોક્ષ ખર્ચ કહેવાય. દા. ત.: ભાડું, કરવેરા, વીમો, યંત્રનો ઘસારો, સમારકામ-મરામત ખર્ચ, વીજળી-બતી.

૭.૨ કાર્યો કે કામગીરી મુજબ (કાર્યાનુસાર) વર્ગીકરણાઃ

કાર્યાનુસાર પરોક્ષ ખર્ચનાં ચાર પ્રકારો છે. (૧) કારખાના (ઉત્પાદન) પરોક્ષ ખર્ચ, (૨) ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ, (૩) વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ અને (૪) સંશોધન અને વિકાસ ખર્ચાઃ

(૧) કારખાના (ઉત્પાદન) પરોક્ષ ખર્ચઃ

ઉત્પાદન કરવા કારખાનાની ચાર દિવાલો વચ્ચે કરવામાં આવેલા પરોક્ષ ખર્ચ કારખાના પરોક્ષ ખર્ચ કહેવાય છે. દા. ત.: કારખાનાના મકાનનું ભાડું, કરવેરા, વીમો, કારખાના મેનેજરનો પગાર, પ્લાન્ટ-યંત્રોનો ઘસારો, સમારકામ, યંત્ર ચલાવવાનું રસાયણ કે બળતણા (ગેસ, પાણી, વીજળી, કોલસો, વરાળ (સ્ટીમ), ડિક્રલ), પરોક્ષ માલસામાન (ઓઈલ, ગ્રીસ, ઢનાં ગાબા), ઓવરટાઇભની મજૂરી, સુપરવિક્રિન ખર્ચ.

(૨) ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચઃ

ધંધાની સામાન્ય અને નાણાંડીય બાબતોનો વહીવટી અમલ કરવા માટે જે ખર્ચ થાય તેને વહીવટી પરોક્ષ ખર્ચ કહેવાય છે. દા. ત.: ઓફિસ સ્ટાફ (કર્મચારીઓનો) પગાર, સ્ટેશનરી છપામણી, તાર-ટપાલ-ટેલિફોન ખર્ચ, ઓકિટ ફી, કાનૂની ખર્ચ, ઓફિસનું ભાડું, વીજળી, કરવેરા, ઓફિસ સાધનોનો ઘસારો અને નિભાવ ખર્ચ, બેંક ચાર્જસ કે કમિશન.

(૩) વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચઃ

માલના વેચાણ અને વિતરણ માટે જે ખર્ચ થાય તેને વેચાણ-વિતરણ ખર્ચ કહેવાય છે. જે ખર્ચ વેચાણ મેળવવા માટે કરવામાં આવે તે વેચાણ ખર્ચ કહેવાય છે અને જે ખર્ચ વેચાણ મેળવ્યા પછી ગ્રાહકો સુધી માલ પહોંચાડવા માટે કરવામાં આવે છે તેને વિતરણ ખર્ચ કહેવાય છે. દા.ત.: જાહેરાત ખર્ચ, સેલ્સમેનોનો પગાર, મુસાફરી ભણ્ણું, સેલ્સમેનોનું કમિશન, ગ્રાહકોને આપેલ વટાવ, ધાતખાધ, ધાતખાધ વસૂલાતનો ખર્ચ, ભાવપત્રક (કેટલોગ)નો ખર્ચ, માલના પેકિંગનો ખર્ચ, જાવક માલ ગાડી ભાડું, માલ ડિલિવરી વાનના ખર્ચ (દ્રાઇવરનો પગાર, ડિલિવરી વાનનાં બળતણા (પેટ્રોલ, ડિક્રલ, વગેરે), નિભાવ ખર્ચ, માલ ડિલિવરી વાનનો ઘસારો વગેરે).

૭.૩ સ્વરૂપ કે વર્તન કે વર્તણૂંક કે ગુણ મુજબ વર્ગીકરણાઃ

ગુણ કે વર્તણૂંક પ્રમાણે પડતરનાં ત્રણ પ્રકારો છે. (૧) સ્થાયી / સ્થિર ખર્ચ, (૨) ચલિત ખર્ચ અને (૩) અર્દ્ધચલિત ખર્ચ.

(૧) સ્થાયી / સ્થિર ખર્ચઃ

જે ખર્ચનો ઉત્પાદન સાથે સીધો સંબંધ નથી તેને સ્થાયી ખર્ચ કહેવાય છે એટલે કે ઉત્પાદન વધે કે ઘટે કે ઉત્પાદન ના થાય છતાં જે ખર્ચ કરવા જ પડે અથવા ચૂકવવા જ પડે તેને સ્થિર ખર્ચ કહેવાય છે. ઉત્પાદનમાં ફેરફાર થાય છતાં આવા ખર્ચમાં તેની કોઈ અસર થતી નથી. દા.ત.: કારખાનાનું ભાડું વાર્ષિક ₹ ૧૨,૦૦૦/- હોય તો ઉત્પાદન ના થાય છતાં વાર્ષિક ₹ ૧૨,૦૦૦/- કારખાનાનું ભાડું ચૂકવવું જ પડે. ૧ એકમનું ઉત્પાદન થાય તો પણ ₹ ૧૨,૦૦૦/- - અને ૧,૦૦,૦૦૦ એકમોનું ઉત્પાદન થાય તો પણ ₹ ૧૨,૦૦૦/- કારખાનાનું ભાડું ચૂકવવું જ પડે છે. સ્થાયી ખર્ચનાં ઉદાહરણો જેવાં કે, કારખાનાનું ભાડું, ઓફિસ / મકાનનું ભાડું, કારખાના / ઓફિસનું ભાડું-કરવેરા-વીમો, કારખાના મેનેજરનો પગાર, કારખાના / ઓફિસ મકાનનો ઘસારો, યંત્રો / પ્લાન્ટનો ઘસારો, વખાર / ગોડાઉનનું ભાડું.

(૨) ચલિત ખર્ચ:

જે ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે તેને ચલિત ખર્ચ કહેવાય છે એટલે કે જે ખર્ચ ઉત્પાદન વધે તો વધે છે, ઉત્પાદન ઘોટે તો ઘોટે છે અને જો ઉત્પાદન ના થાય તો આવો ખર્ચ થતો નથી. દા. ત.: માલસામાન, મજૂરી એ ચલિત ખર્ચ છે. આ ખર્ચને ઉદાહરણાથી સમજુઓ. દા. ત.: એક ટેબલ બનાવો તો ₹ ૨૦૦/-નું લાકડું વપરાતું હોય, ૨ ટેબલ બનાવો તો ₹ ૪૦૦/-નું લાકડું વપરાય અને જો ટેબલ બનાવવામાં ના આવે તો લાકડાનો ખર્ચ થતો નથી.

(૩) અર્ધચલિત ખર્ચ:

જે ખર્ચ અમૃક અંશે સ્થિર અને અમૃક અંશે ચલિત હોય તેને અર્ધચલિત ખર્ચ કહેવાય છે. આવા ખર્ચમાં થોડું પ્રમાણ સ્થિર ખર્ચનું અને થોડું પ્રમાણ ચલિત ખર્ચનું હોય છે. દા. ત.: ટેલિફોન બિલ. ટેલિફોનનું ભાડું માસિક ₹ ૧૫૦/- સ્થિર ખર્ચ કહેવાય. ગમે તેટલાં કોલ કરવામાં આવે પરંતુ માસિક ભાડું ₹ ૧૫૦/- સ્થિર જ રહે છે અને કોલ ચાર્જ એ ચલિત ખર્ચ છે. દા. ત.: એક કોલ કરો તો ₹ ૫/-, ૨ કોલ કરો તો ₹ ૧૦/- અને જો કોઈ કોલ ના કરો તો કોલ ચાર્જ લાગતો નથી. એવી જ રીતે, વીજળી બિલ. દા. ત.: મીટર ભાડું માસિક ₹ ૨૪૦/- હોય તો ગમે તટલાં ચુનિટ વાપરવામાં આવે મીટર ભાડું ₹ ૨૪૦/- ચૂકવાનું જ પડે છે. જ્યારે ચુનિટ ચાર્જ એ ચલિત ખર્ચ છે. ૧ ચુનિટનો ચાર્જ ₹ ૧૦/- હોય તો ૨ ચુનિટ વપરાય તો ₹ ૨૦/- અને જો ચુનિટનો વપરાશ ના થાય તો ચુનિટ ચાર્જ થતો નથી.

૭.૪ સમય મુજબ વર્ગીકરણાઃ

સમય અનુસાર પડતરનું વર્ગીકરણા બે રીતે થાય છે. (૧) ઐતિહાસિક પડતર અને (૨) પ્રમાણ (પૂર્વ નિર્ધારીત) પડતર.

(૧) ઐતિહાસિક પડતરઃ

જે પડતર વસ્તુ / પેદાશનાં ઉત્પાદન થઈ ગયા પછી નક્કી કરવામાં આવે છે તેને ઐતિહાસિક પડતર કહેવાય છે એટલે કે ઉત્પાદન થઈ ગયા પછી પડતર નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિ પડતર પર અંકુશ રાખવા ઉપયોગી નથી, કારણ કે ઉત્પાદન થઈ ગયા પછી એટલે કે ખર્ચ થઈ ગયા પછી પડતર પર અંકુશ કેવી રીતે રાખી શકાય?

(૨) પ્રમાણ (પૂર્વ નિર્ધારીત) પડતરઃ

ઉત્પાદન કરતાં પહેલાં જે પડતર અગાઉથી નક્કી કરવામાં આવે તેને પ્રમાણ પડતર કહેવાય છે. પડતર પર અંકુશ રાખવા તે ખૂબ જ ઉપયોગી છે. તેમાં પડતર અગાઉથી નક્કી થાય છે, પછી ઉત્પાદન કરવામાં આવે છે તેથી ખરેખર પડતર મળે છે. પ્રમાણ પડતર અને ખરેખર પડતરની સરખામણી કરતાં તફાવત કે વિચલન મળે છે જે અનુકૂળ કે પ્રતિકૂળ હોઈ શકે. પ્રતિકૂળ વિચલન દૂર કરવા સુધારાલક્ષી પગલાંઓ લઈ શકાય છે.

૭.૫ પેદાશ / વસ્તુ કે મુદ્દત મુજબ વર્ગીકરણાઃ

(૧) પેદાશ / વસ્તુ પડતરઃ

જે પડતર પેદાશ કે વસ્તુ સાથે સીધી રીતે ઓળખી શકાય તેને પેદાશ પડતર કહેવાય. દા. ત.: માલસામાન, મજૂરી અને ઉત્પાદન પરોક્ષ ખર્ચ એ પેદાશ પડતર છે.

(૨) મુદ્દતી પડતર:

જે પડતર કે ખર્ચ સમયને ધ્યાનમાં રાખી કરવામાં આવે તેને મુદ્દતી પડતર કહેવાય છે. દા. ત.: ભાડું માસિક કે વાર્ષિક ચૂકવાય છે. તે જ રીતે પગાર માસિક કે વાર્ષિક ચૂકવાય છે. ધંધો ચાલુ રાખવા આવા ખર્ચ જરૂરી છે. આવા ખર્ચને ઉત્પાદન સાથે કોઈ સીધો સંબંધ હોતો નથી.

૭.૬ સંચાલકીય નિર્ણય મુજબ વર્ગીકરણ:

આવી પડતર સંચાલકોને કોઈ નિર્ણય લેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તેનાં પાંચ પ્રકારો છે: (૧) સીમાંત પડતર, (૨) સંબંધિત પડતર, (૩) તફાવત પડતર, (૪) દૂબેલી પડતર અને (૫) વૈકલ્પિક પડતર.

(૧) સીમાંત પડતર:

ઉત્પાદનમાં એકમનો વધારો કે ઘટાડો કરવાથી પડતરમાં થતો ફેરફાર એટલે સીમાંત પડતર. સીમાંત પડતરમાં પડતરનાં બે ભાગ પાડવામાં આવે છે. ચલિત ખર્ચ (પડતર) અને સ્થિર ખર્ચ. તેમાં ફક્ત ચલિત ખર્ચ જ ધ્યાનમાં લેવામાં આવે છે, સ્થિર ખર્ચ ઉમેરવામાં આવતા નથી તેથી સંચાલકો ચલિત ખર્ચને આધારે મહત્વનાં નિર્ણયો લઈ શકે છે.

(૨) સંબંધિત અથવા પ્રસ્તુત પડતર:

જે ખર્ચ સંચાલકોના નિર્ણયને અસર કરતાં હોય તેને સંબંધિત ખર્ચ કહેવાય છે. દા. ત.: બેંક પોતાની કોઈ શાખા (branch) બંધ કરવા માંગે છે. આ શાખા બંધ થતાં બેંકનાં કર્મચારીઓનો પગાર, વીજળી ખર્ચ, કરવેરા, ભાડું, ટેલિફોન ખર્ચ, સ્ટેશનરી, છપામણી વગેરે ખર્ચાઓ બંધ થશે. આ બંધાં ચલિત ખર્ચ છે. શાખા બંધ થતાં આવા ખર્ચાઓ થશે નહીં. સંબંધિત પડતર ભવિષ્યની પડતર છે. નિર્ણયના આધારે વર્તમાન કરતાં ભવિષ્યમાં પડતર વધુ અથવા ઓછી હોઈ શકે.

(૩) તફાવત પડતર:

કોઈ નિર્ણય લેવાથી હાલની પડતર વધે અને ઘટે તેવા તફાવતને તફાવત પડતર કહેવાય છે.

(૪) દૂબેલી પડતર:

જે ખર્ચ ભૂતકાળમાં થઈ ગયો હોય અને અત્યારે જે નિર્ણય લેવામાં આવે તેને લીધે તે ખર્ચ પર કોઈ અસર નથી ના હોય તેને દૂબેલી પડતર કહેવાય છે. દા. ત.: કોઈ કંપની જૂના યંત્રને બદલે નવું યંત્ર ખરીદવું કે નહીં તેનો નિર્ણય લેતી વખતે જૂના યંત્રની ચોપડે કિંમત બાદ તેની ભંગાર કિ:મત એ દૂબેલી પડતર કહેવાય છે.

(૫) વૈકલ્પિક પડતર:

જ્યારે સંચાલકો નિર્ણય લેતાં હોય અને તેમાં બે વિકલ્પો હોય અને કોઈ એક વિકલ્પ પરસંદ કરવાથી બીજા વિકલ્પની પ્રાપ્ત થતી આવક જતી કરવી પડે તો, બીજા વિકલ્પની જતી કરેલી આવક એ પરસંદ કરેલ (પ્રથમ) વિકલ્પની વૈકલ્પિક પડતર કહેવાય છે.

૮ પડતરનાં તત્ત્વો (ગૂળતત્ત્વો):

પડતરનાં મૂળતત્ત્વો ૩ છે. (૧) માલસામાન, (૨) મજૂરી અને (૩) પરોક્ષ ખર્ચ.

૮.૧ ભાલસામાન:

ભાલસામાનનાં ૨ પ્રકારો છે: (૧) પ્રત્યક્ષ ભાલસામાન અને (૨) પરોક્ષ ભાલસામાન.

૮.૧.૧ પ્રત્યક્ષ / સીધો ભાલસામાન:

જે ભાલસામાન વસ્તુ કે પડતરમાં સીધો સમાચેલો છે તેને પ્રત્યક્ષ ભાલસામાન કહેવાય છે. પ્રત્યક્ષ ભાલસામાન એટલે ઉત્પન્ન થયેલી વસ્તુ જે ભાલસામાનથી બનેલી છે તે. દા. ત.: બુટ બનાવવામાં વપરાતું ચામકું, ફર્નિચર બનાવવામાં વપરાતું લાકું, તિજોરી બનાવવામાં વપરાતું લોખંડ વગેરે.

૮.૧.૨ પરોક્ષ ભાલસામાન:

જે ભાલસામાન સીધી રીતે ઉત્પન્ન થયેલી વસ્તુમાં વપરાય છે પરંતુ તેનો એકમદીઠ ખર્ચ ખૂબ જ નજીવો હોય છે તેથી તેને પરોક્ષ ભાલસામાન ગણવામાં આવે છે. દા. ત.: બુટ બનાવવામાં વપરાતી દોરી.

૮.૨ મજૂરી:

મજૂરીનાં પણ ૨ પ્રકારો છે: (૧) પ્રત્યક્ષ / સીધી મજૂરી અને (૨) પરોક્ષ / આડકતરી મજૂરી.

૮.૨.૧ પ્રત્યક્ષ / સીધી મજૂરી:

પ્રત્યક્ષ મજૂરી એટલે વસ્તુના ઉત્પાદન માટે રોકાચેલા કામદારોએ ચૂકવેલી મજૂરી. દા. ત.: હેન્ડલૂભ / પાવરલૂભ પર કામ કરતાં કામદારોને ચૂકવેલ મજૂરી પ્રત્યક્ષ મજૂરી ગણવાય. આવો ખર્ચ સરળતાથી જાણી શકાય છે તેથી તેનો સમાવેશ વસ્તુની પડતરમાં સીધો કરી શકાય છે.

૮.૨.૨ પરોક્ષ / આડકતરી મજૂરી:

જે મજૂરી કોઈ જોબ / ઉત્પાદન / પ્રક્રિયા / કરાર વગેરે ખાતે સીધી ઉધારી શકાતી નથી પરંતુ તેની ફાળવણી કરવી પડે છે તેને પરોક્ષ મજૂરી કહેવાય છે. આવી મજૂરી ઉત્પાદનનાં બધાં જ એકમો માટે ચૂકવેલી હોય છે.

૮.૩ પરોક્ષ ખર્ચ (આડકતરા અથવા ઉપરવટ ખર્ચ):

જે ખર્ચ કોઈ જોબ, પ્રક્રિયા, ઉત્પાદન, કરાર, ખાતાં કે વિભાગ ખાતે સીધા ઉધારી શકાતા નથી અને જેની ફાળવણી કરવી પડે છે તેને પરોક્ષ ખર્ચ કહેવાય છે. પરોક્ષ ખર્ચને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. (૧) કારખાના (ઉત્પાદન) પરોક્ષ ખર્ચ, (૨) ઓફિસ (વહીવટી) પરોક્ષ ખર્ચ અને (૩) વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ.

૮.૩.૧ કારખાના (ઉત્પાદન) પરોક્ષ ખર્ચ:

કારખાનાની ચાર દિવાલ વરચે થયેલાં ખર્ચ કારખાના પરોક્ષ ખર્ચ કહેવાય છે. આવા ખર્ચ વસ્તુનાં ઉત્પાદન માટે થતા હોવાથી તેને ઉત્પાદન પરોક્ષ ખર્ચ પણ કહેવાય છે. દા. ત.: કારખાનાનું ભાડું, કરવેરા, વીમો, યંત્રોનો ઘસારો, સમારકામ, કારખાના મેનેજરનો પગાર, ભાલસામાનની ખરીદી, સુપરવિકન ખર્ચ, ટેકનીકલી ડિઝાઇનની ફી, પ્લાન અને નકશાનો ખર્ચ, યંત્રનું બળતાણ અથવા ચાલક બળ (ગેસ, પાણી, વીજળી, કોલસો, ડિઝલ, વરણ (સ્ટીમ) વગેરે), પરોક્ષ ભાલસામાન (ઓર્ધિલ, ગ્રીસ, ઇનાં ગાબા (કોટન વેસ્ટ)) વગેરે.

૮.૩.૨ ઓફિસ (વહીવટી) પરોક્ષ ખર્ચ:

ધંધાના સામાન્ય વહીવટ અને નાણાંકીય બાબતોનો વહીવટી અમલ કરવા માટે ઓફિસ (કાર્યાલય)માં જે ખર્ચ થાય તે ઓફિસ અથવા વહીવટી પરોક્ષ ખર્ચ કહેવાય છે. દા. ત.: ઓફિસ કર્મચારીઓનો પગાર, ભથ્થાં, સ્ટશેનરી, છપામણી, તાર-ટપાલ-ટેલિફોન ખર્ચ, ઓડિટ ફી, ઓફિસનું ભાડું, કરવેરા, વીમો, ઓફિસના સાધનોનો ધસારો, બેંક ચાર્જસ કે કમિશન વગેરે.

૮.૩.૩ વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ:

જે ખર્ચ વેચાણ સંબંધિત કરવામાં આવે છે તેને વેચાણ ખર્ચ કહે છે અને જે ખર્ચ માલ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે તેને વિતરણ ખર્ચ કહે છે. દા. ત.: જાહેરાત ખર્ચ, સેલ્સમેનનો પગાર, કમિશન, ભથ્થાં, ગ્રાહકોએ આપેલ વટાવ, ધાલખાધ, ભાવપત્રક (કેટલોગ) ખર્ચ, પેકિંગ ખર્ચ, માલ ડિલિવરી વાનનો ધસારો, ફ્રાઇઝરનો પગાર વગેરે.

૮ પડતરનાં એકમો:

વસ્તુનું ઉત્પાદન કે વેચાણ જેના વડે માપવામાં આવે તેને પડતરનનું એકમ કહેવામાં આવે છે. પડતર નક્કી કરવાના ઉદ્દેશથી ઉત્પાદનને ભૌતિક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જેમાં નંગા, એકમ, વજન, જણ્ણો, લંબાઈ, પહોળાઈ વગેરેનો સમાવેશ થાય છે. દા. ત.: ટી.વી.ની પડતર નંગાઈઠ, કાપડનો ભાવ મીટરદીઠ, દંડ ૧,૦૦૦ નંગાઈઠ, ખનીજ કે ધાતુ ટન / મેટ્રિક ટનદીઠ વગેરેમાં માપવામાં આવે છે.

ઉધોગ અને પડતરનાં એકમો નીચે મુજબ છે.

ક્રમ	ઉધોગ	પડતરનનું એકમ
(૧)	કાગળની મીલ	કિલોટીઠ
(૨)	રસાયણા / કેમિકલ્સ	લિટર / ગોલન / કિલો
(૩)	ચા	કિલોગ્રામ / રતલ / કિવેન્ટલ
(૪)	ખનીજ	ટન / મેટ્રિક ટન
(૫)	પાણી	૧,૦૦૦ ગોલન / લિટર
(૬)	વીજળી	કિલોવોટ કલાક / ચુનિટદીઠ
(૭)	રેલ્વે	પેસેન્જર કિલોમીટરદીઠ / ટન કિલોમીટરદીઠ
(૮)	રસ્તા વાહનવ્યવહાર	મુસાફરદીઠ / પેસેન્જર કિલોમીટરદીઠ
(૯)	હોટેલ	રૂમદીઠ / પથારીદીઠ / મુલાકાતીદીઠ / પ્રવાસીદીઠ
(૧૦)	અનાજ દળવાની ઘંટી (ફ્લોર મીલ)	કિલો / કિવેન્ટલ
(૧૧)	રેડિયો, ટી.વી., ફોન, ઘરઘંટી, એ.સી.	નંગાઈઠ / સંખ્યાઈઠ
(૧૨)	કાપડ	મીટર / વાર / રતલ / કિલોગ્રામ
(૧૩)	દંડ	૧,૦૦૦ નંગાઈઠ
(૧૪)	મોટરકાર, એક્ટિવા, બાઈક, સ્કૂટર	નંગાઈઠ
(૧૫)	દાડ	બોટલદીઠ / બેરલ (પીપ) દીઠ

(૧૬)	સુતર બનાવવાની મીલ	કિલોડીઠ
(૧૭)	સિમેન્ટ / કોલસો (ખનીજ)	ટનદીઠ / કિલોડીઠ / ગુણદીઠ / મેટ્રીક ટનદીઠ
(૧૮)	ઢંડા પીણાં (સોફ્ટ ડ્રિક્સ)	લીટરડીઠ / બેરલ (પીપ)ડીઠ

૧૦ પડતર કેન્દ્ર (Cost Center):

જે વ્યક્તિ, ચંત્ર, ખાતું, વિભાગ, પ્રક્રિયા, કરાર કે કોઈ આધાર ધ્યાનમાં લઈ પડતર એકત્ર કરવામાં આવે તેને ‘પડતર કેન્દ્ર’ કહેવાય.

દા. ત.: ચંત્રનાં બધાં જ ખર્ચ એકત્ર કરી ચંત્ર પર ઉત્પાદન થયેલ એકમોની પડતર નક્કી કરવામાં આવે તો ચંત્ર પડતરનું કેન્દ્ર કહેવાય.

ઇંડિયનની ઇન્સ્ટટ્યુટ ઓફ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સે આપેલી વ્યાખ્યા મુજબ, “ઉત્પાદન કે સેવાનું કોઈ સ્થાન, કાર્ય, પ્રવૃત્તિ કે સાધન જેની પડતર, પડતર એકમોને ફાળવવામાં આવે તેને પડતર કેન્દ્ર કહેવાય.”

પડતર કેન્દ્રનાં બે પ્રકારો ગણાવી શકાય: (૧) વ્યક્તિગત પડતર કેન્દ્ર અને (૨) બિનવ્યક્તિગત પડતર કેન્દ્ર.

(અ) વ્યક્તિગત પડતર કેન્દ્ર: તેમાં પડતર કેન્દ્ર તરીકે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ (જૂથ) હોય છે.

(બ) બિનવ્યક્તિગત પડતર કેન્દ્ર: તેમાં કોઈ સ્થાન, જગ્યા, ચંત્ર, સાધન કે આ બધાંનો સમૂહ હોઈ શકે છે.

ઘણીવાર ઉત્પાદન પડતર કેન્દ્ર અને સેવા પડતર કેન્દ્ર એવા પણ બે ભાગ પાડવામાં આવે છે.

જ્યાં ઉત્પાદનનું કાર્ય થતું હોય તેને ઉત્પાદન પડતર કેન્દ્ર કહેવાય છે.

જ્યાં સેવા આપવામાં આવતી હોય તેને સેવા પડતર કેન્દ્ર કહેવાય છે.

પડતરનાં કેન્દ્રો નક્કી કરવાનાં બે કારણો કે ઉદ્દેશો છે: (૧) પડતર નક્કી કરવી અને (૨) પડતર અંકુશ.

પડતર કેન્દ્ર પરથી વસ્તુની પડતર વધી કે ઓછી થઈ તે માટે જવાબદાર વ્યક્તિ કોણ છે તે નક્કી થઈ શકે છે.

સ્વાધ્યાય

- (૧) પડતર હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપો અને પડતર હિસાબી પદ્ધતિ અને નાણાંકીય હિસાબી પદ્ધતિ વર્ચ્યેનો તષ્ઠાવત સમજાવો.
- (૨) પડતર હિસાબી પદ્ધતિનાં ફાયદા અને મર્યાદાઓની ચર્ચા કરો.
- (૩) પડતર હિસાબી પદ્ધતિની તકનીકોની વિસ્તૃત ચર્ચા કરો.
- (૪) પડતર કેન્દ્ર શું છે ? તેની સમજૂતી આપો અને પડતર એકમ સમજાવી વિવિધ ઉધોગોનાં ઉપયોગમાં લેવાતા પડતર એકમો જણાવો.

☆ ☆ ☆

પ્રકરણ-૨

ભાલસામાન અને મજૂરી પડતર (ખર્ચ)

❖ ભાલસામાન પડતર (ખર્ચ):

૧. પ્રસ્તાવના
૨. ભાલસામાનનો અર્થ
૩. ભાલસામાન અંકુશ
૪. ભાલસામાનની વિવિધ સપાઈઓ
૫. ઉદાહરણો

❖ મજૂરી પડતર (ખર્ચ):

૧. પ્રસ્તાવના, અર્થ, પ્રકારો
૨. મજૂરી ખર્ચ પર અંકુશ
૩. મજૂરી ફેરબદલી દર
૪. વેતન પ્રથાઓ

☛ સ્વાધ્યાય

૧. માલસામાન પડતર (ખર્ચ):

પડતરનાં મૂળતત્વો પૈકીનું આ પ્રથમ તત્ત્વ એ માલસામાન છે. દંધામાં મોટાભાગનું રોકાણ માલસામાનમાં થયેલું હોય છે તેથી માલસામાન પર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. બગાડ, ચોરી, બેદરકારી, ઘટ વગેરે અટકાવવા માલસામાન પર અંકુશ (નિયંત્રણ) ખૂબ જ જરૂરી છે.

૨. માલસામાનનો અર્થ:

શ્રી વ્હેફલનાં મત મુજબ, “પ્રત્યક્ષ માલસામાન એ કોઈ વસ્તુ કે વસ્તુના સમૂહનો એવો ભાગ છે કે જેની કિંમત સાચી રીતે પ્રાથમિક પડતરનાં એક ભાગ તરીકે ગણી શકાય.”

માલસામાનનો ખર્ચ અલગ શોધી વસ્તુની પડતરમાં સીધો / પ્રત્યક્ષ સમાવી શકાય છે.

૩. માલસામાન અંકુશ (નિયંત્રણ) (Material Control):

૩.૧ માલસામાન અંકુશના તબક્કાઓ:

માલસામાનની ખરીદીથી માંડી માલસામાનના વપરાશ (ઉપયોગ) સુધી માલસામાન પર અંકુશ રાખવો જરૂરી છે.

માલસામાન અંકુશ એ એવી પદ્ધતિ છે જેનાં દ્વારા જરૂરી જથ્થામાં, ચોંચ સમયે, ચોંચ ગુણવત્તાવાળો માલસામાન ઓછામાં ઓછા મૂડીરોકાણ દ્વારા મળી શકે.

માલસામાન પર અંકુશ ચાર તબક્કાઓમાં રાખવામાં આવે છે.

- (૧) માલસામાનની ખરીદી
- (૨) માલની આવક અંગે તપાસ
- (૩) માલનો સંગ્રહ અને જાળવણી (નિભાવ)
- (૪) માલનો વપરાશ (ઉપયોગ)

(૧) માલસામાનની ખરીદી પર અંકુશ:

માલસામાનની ખરીદી થાય ત્યારથી જ માલસામાન પર અંકુશ રાખવાની શરૂઆત થાય છે. માલસામાનની ખરીદી કરવાની સત્તા કોને છે, માલની ખરીદી કચારે, કેવી રીતે, કેટલા જથ્થામાં, માલની ગુણવત્તા વગેરે અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. માલ ખરીદવાની સત્તા જે અધિકારીને હોય તે જુદાં-જુદાં ખાતાં / વિભાગો પાસેથી માલનો ઓર્ડર માંગણીપત્રક દ્વારા મંગાવે છે. પછી વેપારી (લેણદારો કે સપ્લાયરો) પાસેથી ભાવ મંગાવે છે. ખરીદીની શરતો તપાસે છે પછી વેપારીને માલનો ઓર્ડર આપે છે. માલનો મૂકેલો ઓર્ડર જરૂરી સમયમાં મળી જાય તે જોવાની જવાબદારી ખરીદ વિભાગની છે.

(૨) માલની આવક અંગે તપાસ:

માલનો ઓર્ડર મૂક્યા પછી વેપારી માલ મોકલી આપે છે તે માલ કોણે મેળવ્યો, તેણે તેની કેવી નોંધ રાખવી, માલની ગુણવત્તા તપાસવી, અહેવાલ (પત્રક) તૈયાર કરવો વગેરેની કાર્યવાહી અનુસરવી જોઈએ.

(૩) માલનો સંગ્રહ અને જાળવણી (નિભાવ):

માલની આવકની તપાસ કરી તેને સંગ્રહ વિભાગમાં ચોંચ વર્ગીકરણ કરી, સંક્ષા (નિશાની) આપી વ્યવસ્થિત સંગ્રહ કરવો જોઈએ. માલનો સંગ્રહ કરવા ખાના, કબાટ, ઘોડા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. દરેક ખાના પર બીનકાર્ડ હોવું જોઈએ તેમાં માલનો સ્ટોક કેટલો છે તે જાણી શકાય. માલ આવે ત્યારે

બીનકાર્ડમાં આવકના ખાનામાં નોંધવો જોઈએ. ઉત્પાદન માટે માલ આપવામાં આવે ત્યારે જાવકના ખાનામાં નોંધવો જોઈએ અને આવકમાંથી જાવક બાદ કરી બાકી સ્ટોક નોંધવો જોઈએ.

માંગાણીપત્રકને આધારે જ ઉત્પાદન માટે માલ આપવો જોઈએ અને સમયસર માલનો ઓર્ડર મૂકવો જોઈએ કે જેથી ઉત્પાદન અટકી ના પડે. કાર્યક્ષમતાપૂર્વક માલનો સંગ્રહ કરવાથી માલસામાનનો બગાડ અટકાવી શકાય છે.

(૪) માલનો વપરાશ (ઉપયોગ):

માલસામાન પર અંકુશ રાખવાનો આ છેષો તબક્કો છે. જરૂરી જથ્થા કરતાં વધુ માલ આપવો ના જોઈએ. દરેક ખાતા / વિભાગમાં માલનો વપરાશ સરેરાશ કેટલો થાય છે તેનું પ્રમાણ / ધોરણ અગાઉથી નક્કી કરવું જોઈએ અને ખરેખર વપરાશ સાથે તેની સરખામણી કરવી જોઈએ.

3.2 માલસામાન અંકુશને અસરકારક બનાવવાના સૂચનો / પગલાં:

- (૧) માલસામાન અંકુશની જવાબદારી એક વ્યક્તિમાં કેન્દ્રિત થયેલી હોવી જોઈએ.
- (૨) માલસામાનનો સંગ્રહ કરવા સંગ્રહ વિભાગમાં પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.
- (૩) સંગ્રહ વિભાગમાં માલસામાનનો યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ. જુદાં-જુદાં પ્રકાનાં માલનો સંગ્રહ કરવા નીન (ખાનાં), કબાટ, ઘોડાં વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
- (૪) સ્ટોર્સ / સંગ્રહ વિભાગમાં માલસામાનની આવક અને જાવક અંગેની વ્યવસ્થિત નોંધ રાખવી જોઈએ.
- (૫) દરેક પ્રકારનાં માલને નિશાની / સંજ્ઞા / ચિનહે કરવાં જોઈએ કે જેથી તેને ઓળખી શકાય.
- (૬) માલસામાનની ખરીદી, આવક, સંગ્રહ અને વપરાશ વગેરે પર અંકુશ હોવો જોઈએ.
- (૭) માલસામાનની વિવિધ સપાટીઓ જેવી કે, વરટી સપાટી (માલનો ઓર્ડર મૂકવાની સપાટી), ગુરુત્વાભ સપાટી, લઘુત્વાભ સપાટી, બચ સપાટી, આર્થિક વરટી જથ્થો વગેરે નક્કી કરવી જોઈએ.
- (૮) માલસામાન પર અંકુશ રાખવા માલસામાન વર્ગીકરણાની ABC પદ્ધતિ, બીનકાર્ડ, માલસામાન ખાતાવહી, સ્ટોક રેકૉર્ડ કાર્ડ, સ્ટોક પત્રક, સતત સ્ટોકની ગણતરી, ‘યોગ્ય સમયે જ’ (JIT – Just In Time) વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.

3.3 માલસામાન અંકુશની પદ્ધતિ:

માલસામાન પર અંકુશ રાખવાની ઘણી બધી પદ્ધતિઓ છે તેમાંથી એક અતિ મહત્વની અને અસરકારક પદ્ધતિ એ માલસામાનનું ABC વર્ગીકરણ અથવા માલસામાનનું અબક વર્ગીકરણ છે.

⇒ માલસામાન વર્ગીકરણાની ABC પદ્ધતિ (માલસામાનનું અબક વર્ગીકરણ):

માલસામાનનો અંકુશ કરકસરભર્યો બનાવવા માટેની એક અસરકારક પ્રથા (પદ્ધતિ) એ ABC (અબક) પદ્ધતિ છે. વિશાળ કંપનીઓમાં મોટા પાયા પર ઘણીબધી ઇન્વેન્ટરી (માલસામાન)નો સમાવેશ થાય છે. તેના પર નિયંત્રણ રાખવા ઘણાં કર્મચારીઓની જરૂર પડે છે. જેમને મોટો પગાર ચૂકવવો પડે છે તેથી ખર્ચમાં બચત કરવા માલસામાનની ABC પદ્ધતિનો ઉપયોગ થાય છે.

માલસામાન વર્ગીકરણાની ABC પદ્ધતિમાં માલસામાનને ત્રણ વિભાગમાં વહેંચી નાંખવામાં આવે છે.

જે માલસામાન (વસ્તુ)ની સંખ્યા ઓછી હોય પરંતુ તેનું મૂલ્ય વધુ હોય તેને A (અ) વર્ગમાં મુકવામાં આવે છે.

જે માલસામાન (વસ્તુ)ની સંખ્યા અને મૂલ્ય લગભગ સરખું હોય તેને B (બ) વર્ગમાં મુકવામાં આવે છે.

જ્યારે માલસામાન (વસ્તુ)ની સંખ્યા વધુ હોય પરંતુ તેનું મૂલ્ય ઓછું હોય તેને C (ક) વર્ગમાં મુકવામાં આવે છે.

માલસામાનનું ABC વર્ગીકરણ નીચે મુજબ રજૂ કરી શકાય છે.

વર્ગ / ગ્રેડ	વસ્તુની સંખ્યા	વસ્તુનું મૂલ્ય
A (અ)	૧૦%	૭૫%
B (બ)	૨૫%	૨૦%
C (ક)	૬૫%	૫%

સમજૂતી: A (અ) વિભાગમાં એવી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની સંખ્યા ઓછી હોય પરંતુ ખૂબ જ મહત્વની અને કિંમતી (ઉંચી કિંમતની) વસ્તુઓ હોય અને જેમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું હોય.

B (બ) વિભાગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે પ્રમાણમાં ઓછી મહત્વની હોય પરંતુ તેના વપરાશ અંગેની નોંધ મહત્વની હોય.

C (ક) વિભાગમાં મહત્વની નાઈ એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી સંખ્યા વધુ હોય પરંતુ કિમત કે મૂલ્ય ઘણું નાનું હોય.

ABC વર્ગીકરણની પદ્ધતિમાં ફક્ત A (અ) વિભાગની જ વસ્તુ પર અંકુશ રાખવો જોઈએ કારણ કે તેમાં વસ્તુનું મૂલ્ય વધુ હોય છે અને મોટાભાગનું મૂડીરોકાણ થયેલું હોય છે.

જ્યારે C (ક) વિભાગની વસ્તુ પર ઓછા અંકુશ રાખવામાં આવે (અથવા અંકુશ રાખવામાં ના આવે) તો પણ ચાલે કારણ કે તેમાં મૂકેલી વસ્તુની કિમત ઘણી નજીવી હોય છે.

⇒ માલસામાન વર્ગીકરણની ABC પદ્ધતિનાં ફાયદાઓ:

- ૧) માલ સંગ્રહ વિભાગને બિનજરી કાર્યોભાંથી મુક્તિ મળે છે.
- ૨) ઉંચી કિંમતવાળી વસ્તુ પર અંકુશ રાખી શકાય છે.
- ૩) ABC વર્ગીકરણથી કરકસરતા અને કાર્યક્ષમતા વધે છે તેથી નફાનું પ્રમાણ વધે છે.
- ૪) અપવાદ ક્ષારા સંચાલનનાં સિઝાંતનું પાલન થાય છે તેથી સ્ટોરકીપર મહત્વની વસ્તુ પર જ દ્યાન કેન્દ્રિત કરી શકે છે.
- ૫) માલસામનની ચોરી, બગાડ, દુરૂપયોગ, બેદરકારી વગેરે અટકાવી શકાય છે.
- ૬) ચોગ્ય સમયે અને ચોગ્ય ગુણવત્તાવાળો માલ મેળવાતો હોવાથી જરીદ વિભાગની કાર્યક્ષમતા વધે છે.
- ૭) ખોટું મૂડીરોકાણ અટકે છે, સંગ્રહ ખર્ચ, સંગ્રહની જગ્યા, વીમો, કારકૂની ખર્ચ, મૂડી ખર્ચ વગેરે ઘટાડી શકાય છે તેથી કાર્યક્ષમતાને ઉતોજન મળે છે. ખર્ચમાં બચત થાય છે.

૪. ભાલસામાનની વિવિધ સપાટીઓ / કક્ષાઓ / જથ્થાઓ (Various Stock Levels):

ભાલસામાનની વિવિધ સપાટીઓ / કક્ષાઓ / જથ્થાઓ નીચે મુજબ છે.

- (૧) ગુરુતમ સપાટી કે જથ્થો
- (૨) લઘુતમ સપાટી કે જથ્થો
- (૩) વરદી સપાટી (પુનઃવરદી સપાટી / ઓર્ડર મુકવાની સપાટી)
- (૪) ભય સપાટી
- (૫) સલામતી જથ્થો
- (૬) સરેરાશ સપાટી
- (૭) આર્થિક વરદી જથ્થો

(૧) ગુરુતમ સપાટી (Maximum Level):

જે મર્યાદાથી વધુ પ્રમાણમાં માલનો જથ્થો રાખવો આર્થિક રીતે નુકશાનકારક સાબિત થાય તેવા જથ્થાને ગુરુતમ સપાટી કહેવાય છે. ગુરુતમ સપાટી કરતાં વધુ માલનો જથ્થો રાખવામાં આવે તો કાર્યશીલ મૂડી બિનજરૂરી રીતે ભાલસામાનમાં રોકાઈ રહે છે, વ્યાજનું નુકશાન જાય છે, માલના સંગ્રહ માટે વધુ જરૂર જોઈએ છે, માલ બગડી જવાનો ભય રહે છે.

ગુરુતમ સપાટી નક્કી કરવા નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે.

ગુરુતમ સપાટી = વરદી સપાટી - (ઓછામાં ઓછો વપરાશ × ઓછામાં ઓછો સમય) + આર્થિક વરદી જથ્થો

(૨) લઘુતમ સપાટી (Minimum Level):

જે મર્યાદાથી કોઈપણ માલનો જથ્થો ઓછો થવો ના જોઈએ તેને લઘુતમ સપાટી કહેવાય છે. લઘુતમ સપાટીથી ઓછો જથ્થો રાખવો ઈર્ષણીય નથી કારણ કે લઘુતમ સપાટી કરતાં માલ ઓછો હોય તો ઉત્પાદન અટકી જાય છે. લઘુતમ જથ્થો નક્કી કરતાં માલ મેળવતાં કેટલો સમય લાગશે તે નક્કી કરવું જોઈએ. જો દેશમાંથી માલ મેળવવાનો હોય તો ઓછો સમય લાગે છે પરંતુ પરદેશમાંથી માલ આચાત કરવાનો હોય તો સમય વધુ લાગે છે, માલનો વપરાશ વધુ અને ઝડપી હોય તો લઘુતમ જથ્થો વધુ રાખવો જોઈએ અને ઓછો વપરાશ હોય તો લઘુતમ જથ્થો ઓછો રાખી શકાય.

લઘુતમ સપાટી નક્કી કરવા નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે.

લઘુતમ સપાટી = વરદી સપાટી - (સરેરાશ વપરાશ × સરેરાશ સમય)

(૩) વરદી સપાટી / પુનઃવરદી સપાટી / ઓર્ડર મુકવાની સપાટી (Ordering Level OR Re-ordering Level):

વરદી એટલે ઓર્ડર. જે સપાટી પર માલનો જથ્થો પહોંચે ત્યારે સ્ટોરકીપર માલનો વધુ જથ્થો મેળવવા માટે ઓર્ડર મુકે છે તેને વરદી સપાટી અથવા પુનઃવરદી સપાટી કહેવાય છે.

વરદી સપાટી હંમેશા ગુરુતમ સપાટી અને લઘુતમ સપાટી બંનેની વર્ચ્યે હોય છે.

વરદી સપાટી (પુનઃવરદી સપાટી) નક્કી કરવા નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે.

વરદી સપાટી = વધુમાં વધુ વપરાશ × વધુમાં વધુ સમય

(૪) ભય સપાટી (Danger Level):

લઘુતમ સપાટીથી પણ નીચેલી સપાટી એ ભય સપાટી છે. જે જથ્થા પર માલની સપાટી પહોંચે ત્યારે માલ મેળવવા માટે તાત્કાલિક પગલાં લેવાં પડે તેને ભય સપાટી કહેવાય છે. ભય સપાટી નક્કી કરવા માલ મેળવતા તાત્કાલિક ખરીદી માટે વધુમાં વધુ કેટલો સમય લાગશે તે નક્કી કરવામાં આવે છે.

ભય સપાટી શોધવા નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે.

$$\text{ભય સપાટી} = \text{સરેરાશ વપરાશ} \times \text{તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુશ્ક્ષત} (\text{સમય})$$

(૫) સલામતી સપાટી / સલામતી જથ્થો:

માલસામાન પર અંકુશ રાખવાના ઉદ્દેશથી સલામતી જથ્થો નક્કી કરવો અનિવાર્ય છે, જ્યારે ઓર્ડર મૂકેલો માલ મેળવવા સામાન્ય કરતાં વધારે સમય લાગે ત્યારે સલામતી જથ્થો ઉત્પાદન બંધ થતું અટકાયે છે.

સલામતી સપાટી નક્કી કરવા નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે.

$$\text{સલામતી સપાટી} = \text{વધુમાં વધુ વપરાશ} \times (\text{માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય} - \text{માલ મેળવતા લાગતો સામાન્ય} (\text{સરેરાશ}) \text{ સમય})$$

(૬) સરેરાશ સપાટી (Average Level):

સરેરાશ સપાટી શોધવા નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે.

$$\text{સરેરાશ સપાટી} = \text{લઘુતમ સપાટી} + \frac{1}{2} (\text{આર્થિક વરદી જથ્થો}) \\ \text{અથવા}$$

$$\text{સરેરાશ સપાટી} = \text{ગુરુતમ સપાટી} + \frac{1}{2} (\text{આર્થિક વરદી જથ્થો})$$

(૭) આર્થિક વરદી જથ્થો (EOQ : Economical Order Quantity):

આર્થિક વરદી જથ્થો બે અર્થમાં વપરાય છે. અમુક પ્રકારનો માલ અમુક જ જથ્થામાં ઉપલબ્ધ હોય તો તે જથ્થામાં જ તેનો ઓર્ડર મૂકી શકાય છે. દા. ત.: કોઈ રંગ ર લિટરના પેકેજમાં મળતો હોય તો ર લિટરના ગુણાંકમાં જ ઓર્ડર મૂકવો પડે. જેમકે, ર લિટર રંગની જરૂર હોય તો એક વાર ઓર્ડર, ૪ લિટર રંગની જરૂર હોય તો ર લિટર \times ર વાર ઓર્ડર મૂકી શકાય અથવા ર લિટર \times ૩ વાર ઓર્ડર મૂકી શકાય.

આર્થિક વરદી જથ્થો એ માલના ઓર્ડરની ઈઝ્ટમ સપાટી જ્યાં માલસામાનની પડતર ન્યૂનતમ હોય છે.

બીજા અર્થમાં માલની ખરીદી માટેનો ઓછામાં ઓછો સૌથી વધુ ફાયદાકારક જથ્થો જે હોઈ શકે તેને આર્થિક વરદી જથ્થો કહેવાય છે.

આર્થિક વરદી જથ્થો શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે.

$$\text{આર્થિક વરદી જથ્થો (EOQ : Economical Order Qty.)} = \sqrt{\frac{2 Q \times D}{B \times S}}$$

જ્યાં, Q = વાર્ષિક વપરાશનો જથ્થો

D = ઓર્ડર મૂકવા માટેની દરેક વરદીઠ ખર્ચ (પડતર)

ખ = એકમદીઠ વાર્ષિક વહનખર્ય (સંગ્રહ ખર્ય સહિત)

ક = માલ / વસ્તુની એકમદીઠ કિંમત

દા. ત.ઃ વાર્ષિક વપરાશ ₹,000 એકમો છે. એકમદીઠ કિંમત ₹ 30/- છે. વરદી (ઓર્ડર) મૂકવાનો ખર્ય ₹ 1%/- છે અને એકમદીઠ વાર્ષિક વહન ખર્ય 10% છે તો આર્થિક વરદી જથ્થો નીચે પ્રમાણે નક્કી થશે.

$$\text{આર્થિક વરદી જથ્થો (EOQ)} = \sqrt{\frac{2 \times v \times p}{h \times k}}$$

જ્યાં, v = વાર્ષિક વપરાશ ₹,000 એકમો

p = ઓર્ડર મૂકવા માટેનો વરદી ખર્ય ₹ 1%/-

h = વહનખર્ય 10%

k = માલસામાનની એકમદીઠ કિંમત ₹ 30/-

$$= \sqrt{\frac{2 \times 6000 \times 1%}{10\% \times 30}}$$

$$= \sqrt{\frac{2 \times 6000 \times 1%}{\frac{10}{100} \times 30}}$$

$$= \sqrt{\frac{240000}{3}}$$

$$= \sqrt{80000}$$

= 300 એકમો આર્થિક વરદી જથ્થો કહેવાય.

૫. : ઉદાહરણો :

⇒ માલસામાનની વિવિધ સપાટીઓ (કક્ષાઓ)ના દાખલાઓ:

ઉદાહરણ: ૧ નીચે આપેતી માહિતી પરથી (૧) વરદી સપાટી, (૨) લઘુતમ સપાટી, (૩) ગુરુતમ સપાટી, (૪) સરેરાશ સપાટી અને (૫) ભય સપાટી શોધો.

માલ મેળવાતા લાગતો સમય	૪૫ દિવસ
માલ મેળવાતા લાગતો ઓછામાં ઓછો સમય	૨૫ દિવસ
તાત્કાલિક ખરીદી મેળવવા લાગતો વધુમાં વધુ સમય	૫ દિવસ
દૈનિક (રોજનો) વધુમાં વધુ વપરાશ	૩૦ એકમો
દૈનિક (રોજનો) ઓછામાં ઓછો વપરાશ	૨૦ એકમો
આર્થિક વરદી જથ્થો	૬૦૦ એકમો

જવાબ: સૌ પ્રથમ ખૂટ્ટી વિગતો શોધી લઈએ.

દાખલામાં સરેરાશ સમય આપ્યો નથી જે નીચે મુજબ શોધાશે.

$$\begin{aligned} \text{સરેરાશ સમય} &= \frac{\text{વધુમાં વધુ સમય} + \text{ઓછામાં ઓછો સમય}}{2} \\ &= \frac{45 \text{ દિવસ} + 25 \text{ દિવસ}}{2} \\ &= \frac{70 \text{ દિવસ}}{2} \end{aligned}$$

\therefore સરેરાશ સમય = 35 દિવસ

દાખલામાં સરેરાશ વપરાશ આપ્યો નથી જે નીચે મુજબ શોધાશે.

$$\begin{aligned} \text{સરેરાશ વપરાશ} &= \frac{\text{ઓછામાં ઓછો વપરાશ} + \text{વધુમાં વધુ વપરાશ}}{2} \\ &= \frac{20 \text{ એકમો} + 30 \text{ એકમો}}{2} \\ &= \frac{50 \text{ એકમો}}{2} \end{aligned}$$

\therefore સરેરાશ વપરાશ = 25 એકમો

$$\begin{aligned} (1) \text{ વરદી સપાઠી} &= \text{વધુમાં વધુ વપરાશ} \times \text{વધુમાં વધુ સમય} \\ &= 30 \text{ એકમો} \times 45 \text{ દિવસ} \\ &= 1350 \text{ એકમો} \end{aligned}$$

$$\begin{aligned} (2) \text{ લઘુતમ સપાઠી} &= \text{વરદી સપાઠી} - (\text{સરેરાશ વપરાશ} \times \text{સરેરાશ સમય}) \\ &= 1350 - (25 \text{ એકમો} \times 35 \text{ દિવસ}) \\ &= 1350 - 875 \\ &= 475 \text{ એકમો} \end{aligned}$$

$$\begin{aligned} (3) \text{ ગુરુતમ સપાઠી} &= \text{વરદી સપાઠી} - (\text{ઓછામાં ઓછો વપરાશ} \times \text{ઓછામાં ઓછો સમય}) + \text{આર્થિક વરદી જથ્થો} \\ &= 1350 - (20 \text{ એકમો} \times 25 \text{ દિવસ}) + 500 \\ &= 1350 - 500 + 500 \\ &= 1450 \text{ એકમો} \end{aligned}$$

$$(4) \text{ સરેરાશ સપાઠી} = \text{લઘુતમ સપાઠી} + \frac{1}{2} \text{ આર્થિક વરદી જથ્થો}$$

$$= 475 + \left(\frac{1}{2} \times 500 \right)$$

$$= 475 + 300$$

$$= 775 \text{ એકમો}$$

(૫) ભય સપાઠી	= સરેરાશ વપરાશ \times માલની તાત્કાલિક ખરીદીનો વધુમાં વધુ સમય (મુદ્દત)
	= ૨૫ એકમો \times ૫ દિવસ
	= ૧૨૫ એકમો

ઉદાહરણ: ૨ નીચે આપેલી માહિતી પરથી (૧) આર્થિક વરદી જથ્થો, (૨) પુનઃવરદી સપાઠી, (૩) લઘુતમ સપાઠી, (૪) ગુરુતમ સપાઠીની ગણતરી કરો.

સરેરાશ વાર્ષિક વપરાશ	૨૫૦૦ એકમો
એકમદીઠ પડતર	₹ ૧૦/-
વરદી મૂકવાનો ખર્ચ	₹ ૧૦૦/-
એકમદીઠ વહન ખર્ચ	૧૦%
વરદી સમય	૨ થી ૩ અઠવાડિયાં
૬૨ અઠવાડિયે સરેરાશ વપરાશ	૪૫ એકમો
૬૨ અઠવાડિયે વધુમાં વધુ વપરાશ	૬૦ એકમો

જવાબ: દાખલામાં ઓછામાં ઓછો વપરાશ આપ્યો નથી જે નીચે મુજબ શોધાશે.

$$\text{સરેરાશ વપરાશ} = \frac{\text{વધુમાં વધુ વપરાશ} + \text{ઓછામાં ઓછો વપરાશ}}{૨}$$

$$૪૫ \text{ એકમો} = \frac{૬૦ \text{ એકમો} + \text{ઓછામાં ઓછો વપરાશ}}{૨}$$

$$૪૫ \text{ એકમો} \times ૨ = ૬૦ \text{ એકમો} + \text{ઓછામાં ઓછો વપરાશ}$$

$$= ૯૦ - ૬૦$$

$$\therefore \text{ઓછામાં ઓછો વપરાશ} = ૩૦ \text{ એકમો}$$

$$(૧) \text{ આર્થિક વરદી જથ્થો} = \sqrt{\frac{૨૫ \times ૫}{૫ \times ૬}}$$

$$= \sqrt{\frac{૨ \times ૨૫૦૦ \times ૨૦૦}{૧૦\% \times ૧૦}}$$

$$= \sqrt{\frac{1000000}{\frac{10}{100} \times 10}}$$

$$= \sqrt{\frac{1000000}{1}}$$

$$= \sqrt{1000000}$$

$$= 1,000 \text{ એકમો}$$

(૨) પુનઃવરદી સપાઈ = વધુમાં વધુ વપરાશ × વધુમાં વધુ સમય

$$= 50 \text{ એકમો} \times 3 \text{ અઠવાડિયાં}$$

$$= 150 \text{ એકમો}$$

(૩) લઘુતમ સપાઈ = વરદી સપાઈ - (સરેરાશ વપરાશ × સરેરાશ સમય)

$$= 180 - (45 \text{ એકમો} \times 2.5 \text{ અઠવાડિયાં})$$

$$= 180 - 112.5$$

$$= 67.5 \text{ એકમો}$$

નોંધ: સરેરાશ સમય = $\frac{\text{વધુમાં વધુ સમય} + \text{ઓછામાં ઓછો સમય}}{2}$

$$= \frac{3 \text{ અઠવાડિયાં} + 2 \text{ અઠવાડિયાં}}{2}$$

$$= \frac{5 \text{ અઠવાડિયાં}}{2}$$

$$\therefore \text{સરેરાશ સમય} = 2.5 \text{ અઠવાડિયાં}$$

(૪) ગુરુતમ સપાઈ = વરદી સપાઈ - (ઓછામાં ઓછો વપરાશ × ઓછામાં ઓછો સમય) + આર્થિક વરદી જથ્થો

$$= 180 - (30 \text{ એકમો} \times 2 \text{ અઠવાડિયાં}) + 1000$$

$$= 180 - 60 + 1000$$

$$= 1120 \text{ એકમો}$$

ઉદાહરણ: 3 આદર્શ મેન્યુફેક્ચરીંગ લિમિટેડનાં ડોલસાના વપરાશ અંગેની માહિતી નીચે ગુજરાત પૂરી પાડવામાં આવી છે.

વરદી જથ્થો	૩૬૦૦ કિલો
વરદી સમય	૩ થી ૫ અઠવાડિયાં
વધુમાં વધુ વપરાશ	અઠવાડિયે ૬૦૦ કિલો
ઓછામાં ઓછો વપરાશ	અઠવાડિયે ૩૦૦ કિલો
સરેરાશ વપરાશ	અઠવાડિયે ૬૦૦ કિલો

વરદી સપાટી, લઘુતમ જથ્થો, ગુરુતમ જથ્થો અને સલામતી જથ્થો નક્કી કરો.

જવાબ:

$$(1) \text{ વરદી સપાટી} = \text{વધુમાં વધુ વપરાશ} \times \text{વધુમાં વધુ સમય}$$

$$= ૬૦૦ \text{ કિલો} \times ૫ \text{ અઠવાડિયાં}$$

$$= ૩૫૦૦ \text{ કિલો}$$

$$(2) \text{ લઘુતમ જથ્થો} = \text{વરદી સપાટી} - (\text{સરેરાશ વપરાશ} \times \text{સરેરાશ સમય})$$

$$= ૩૫૦૦ \text{ કિલો} - (૬૦૦ \text{ કિલો} \times ૪ \text{ અઠવાડિયાં})$$

$$= ૩૫૦૦ - ૨૪૦૦$$

$$= ૧૧૦૦ \text{ કિલો}$$

$$\text{નોંધ: } \text{સરેરાશ સમય} = \frac{\text{વધુમાં વધુ સમય} + \text{ઓછામાં ઓછો સમય}}{૨}$$

$$= \frac{૫ \text{ અઠવાડિયાં} + ૩ \text{ અઠવાડિયાં}}{૨}$$

$$= \frac{૮ \text{ અઠવાડિયાં}}{૨}$$

$$\therefore \text{સરેરાશ સમય} = ૪ \text{ અઠવાડિયાં}$$

$$(3) \text{ ગુરુતમ જથ્થો} = \text{વરદી સપાટી} - (\text{ઓછામાં ઓછો વપરાશ} \times \text{ઓછામાં ઓછો સમય}) + \text{આર્થિક વરદી જથ્થો}$$

$$= ૩૫૦૦ - (૩૦૦ \times ૩) + ૩૬૦૦$$

$$= ૩૫૦૦ - ૯૦૦ + ૩૬૦૦$$

$$= ૭૨૦૦ \text{ કિલો}$$

$$(4) \text{ સલામતી જથ્થો} = \text{વધુમાં વધુ વપરાશ} \times (\text{વધુમાં વધુ સમય} - \text{સરેરાશ સમય})$$

$$= ૬૦૦ \text{ કિલો} \times (૫ \text{ અઠવાડિયાં} - ૪ \text{ અઠવાડિયાં})$$

$$= ૬૦૦ \times ૧$$

$$= ૬૦૦ \text{ કિલો}$$

ઉદાહરણ: ૪ નીચેની માહિતી પરથી ગણાતરી કરો.

(૧) આર્થિક વરદી જથ્થો, (૨) પુનઃવરદી સપાટી, (૩) ગુરુતમ સપાટી, (૪) લઘુતમ સપાટી, (૫) ભય સપાટી, (૬) સલામતી જથ્થો.

દ્રિમાસિક વપરાશ ૨૦૦૦ એકમો

એકમદીઠ પડતર ₹ ૧/-

વહન ખર્ચ ૨૦%

સમયની ગતિ (ગુરુતમ - સરેરાશ - લઘુતમ) ૩૦ - ૨૦ - ૧૦ દિવસ

દૈનિક વપરાશ (ગુરુતમ - સરેરાશ - લઘુતમ) ૪૫ - ૩૦ - ૧૫ દિવસ

માલ મેળવવાનો તાત્કાલિક વધુમાં વધુ સમય પ દિવસ.

જવાબ:

$$(૧) \text{ આર્થિક વરદી જથ્થો} = \sqrt{\frac{૨૫ \times ૫}{૫ \times ૬}}$$

$$\text{વાર્ષિક વપરાશ} = \text{દ્રિમાસિક વપરાશ} \times ૬ \text{ વાર}$$

$$= ૨૦૦૦ \text{ એકમો} \times ૬ \text{ વાર}$$

$$\therefore \text{વાર્ષિક વપરાશ} = ૧૨૦૦૦ \text{ એકમો}$$

$$= \sqrt{\frac{૨ \times ૧૨૦૦૦ \times ૧૨}{૨૦\% \times ૧}}$$

$$= \sqrt{\frac{૨૮૮૦૦૦}{\frac{૨૦}{૧૦૦} \times ૧}}$$

$$= \sqrt{\frac{૨૮૮૦૦૦ \times ૧૦૦}{૨૦}}$$

$$= \sqrt{\frac{૨૮૮૦૦૦૦૦}{૨૦}}$$

$$= \sqrt{૧૪૪૦૦૦૦}$$

$$= ૧,૨૦૦ \text{ એકમો}$$

- (૨) પુનઃવર્દી સપાઠી = વધુમાં વધુ વપરાશ \times વધુમાં વધુ સમય
= ૪૫ એકમો \times ૩૦ દિવસો
= ૧૩૫૦ એકમો
- (૩) ગુરુતમ સપાઠી = વર્દી સપાઠી - (ઓછામાં ઓછો વપરાશ \times ઓછામાં ઓછો સમય) + આર્થિક વર્દી જથ્થો
= ૧૩૫૦ - (૧૫ \times ૧૦) + ૧૨૦૦
= ૧૩૫૦ - ૧૫૦ + ૧૨૦૦
= ૨૪૦૦ એકમો
- (૪) લઘુતમ સપાઠી = વર્દી સપાઠી - (સરેરાશ વપરાશ \times સરેરાશ સમય)
= ૧૩૫૦ - (૩૦ એકમો \times ૨૦ દિવસો)
= ૧૩૫૦ - ૬૦૦
= ૭૫૦ એકમો
- (૫) ભય સપાઠી = સરેરાશ વપરાશ \times માલ મેળવવા લાગતો તાત્કાલિક સમય
= ૩૦ એકમો \times ૫ દિવસ
= ૧૫૦ એકમો
- (૬) સલામતી જથ્થો = વધુમાં વધુ વપરાશ \times (વધુમાં વધુ સમય - સરેરાશ સમય)
= ૪૫ એકમો \times (૩૦ દિવસ - ૨૦ દિવસ)
= ૪૫ \times ૧૦
= ૪૫૦ એકમો

સ્વાધ્યાય

૧. કાલિકા એન્જીનીયરીંગ લિમિટેડની વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની નીચેની માહિતી મેળવેલ છે.

ઓછામાં ઓછો વપરાશ	૫૦ એકમો દર અઠવાડિયે
વધુમાં વધુ વપરાશ	૧૫૦ એકમો દર અઠવાડિયે
સામાન્ય વપરાશ	૧૦૦ એકમો દર અઠવાડિયે
આર્થિક વર્દી જથ્થો	૮૦૦ એકમો
વર્દી મુદ્દત	૪ થી ૬ અઠવાડિયાં

ગણતરી કરો: (૧) વર્દી સપાઠી, (૨) લઘુતમ સપાઠી, (૩) ગુરુતમ સપાઠી, (૪) સરેરાશ સપાઠી અને (૫) સલામતી સપાઠી.

(જવાબ: (૧) વરદી સપાઠી ₹૩૦૦ એકમો; (૨) લઘુતમ સપાઠી ₹૪૦૦ એકમો; (૩) ગુરૂતમ સપાઠી ₹૫૦૦ એકમો; (૪) સરેરાશ સપાઠી ₹૫૦ એકમો; (૫) સલામતી સપાઠી ₹૫૦ એકમો.)

૨. નીચે આપેલી માહિતી પરથી (૧) પુનઃવરદી સપાઠી, (૨) લઘુતમ સપાઠી, (૩) ગુરૂતમ સપાઠી, (૪) સરેરાશ સપાઠી અને (૫) ભય સપાઠીની ગણતરી કરો.

૧. માલ મેળવતા લાગતો મહતમ સમય	₹૩૦ દિવસ
૨. માલ મેળવતા લાગતો સરેરાશ સમય	₹૩૦ દિવસ
૩. તાત્કાલિક ખરીદી મેળવવા લાગતો વધુમાં વધુ સમય	૧૦ દિવસ
૪. ફૈનિક મહતમ વપરાશ	૫૦ એકમો
૫. ફૈનિક લઘુતમ વપરાશ	૪૦ એકમો
૬. આર્થિક વરદી જથ્થો	₹૧૨૦૦ એકમો

(જવાબ: (૧) પુનઃવરદી સપાઠી ₹૪૦૦ એકમો; (૨) લઘુતમ સપાઠી ₹૬૦૦ એકમો; (૩) ગુરૂતમ સપાઠી ₹૫૦૦ એકમો; (૪) સરેરાશ સપાઠી ₹૫૦ એકમો (લઘુતમ સપાઠી + $\frac{1}{2}$ વરદી જથ્થો = ₹૬૦૦ + ($\frac{1}{2} \times ₹૧૨૦૦$ એકમો) = ₹૬૦૦ + ₹૫૦૦ = ₹૧૧૦૦ એકમો); (૫) ભય સપાઠી ₹૫૦ એકમો.)

૩. (અ) માલસામાન કની નીચેની માહિતી પરથી ગણતરી કરો.

(૧) પુનઃવરદી સપાઠી, (૨) ગુરૂતમ સપાઠી, (૩) લઘુતમ સપાઠી.

સામાન્ય વપરાશ	ફૈનિક ₹૧૨૫ એકમો
વધુમાં વધુ વપરાશ	ફૈનિક ₹૧૪૦ એકમો
વરદી મુદ્દત	૩૫ થી ૫૫ દિવસ
વરદી જથ્થો	૫૦૦ એકમો

(બ) નીચેની માહિતી પરથી આર્થિક વરદી જથ્થાની ગણતરી કરો.

આર્થિક વપરાશ	₹૧૨૦ એકમો
ઓર્ડર મૂકવાનો ખર્ચ	₹ ૨૦/-
એકમદીઠ કિંમત	₹ ૧૦૦/-
વહન અને સંગ્રહ ખર્ચ	૩%

(જવાબ: (અ) (૧) પુનઃવરદી સપાઠી ₹૭૦૦ એકમો; (૨) ગુરૂતમ સપાઠી ₹૩૫૦ એકમો; (૩) લઘુતમ સપાઠી ₹૨૦૭૫ એકમો;

(બ) આર્થિક વરદી જથ્થો ₹૪૦ એકમો;

$$\sqrt{\frac{2 \times ₹120 \times ₹20}{30\% \times ₹100}} = \sqrt{₹1600} = ₹40 \text{ એકમો.)}$$

૪. નીચેની માહિતી પરથી (૧) આર્થિક વરદી જણ્ઠો, (૨) વરદી સપાટી, (૩) લઘુતમ સપાટી, (૪) ગુરુતમ સપાટી, (૫) સરેરાશ સપાટી અને (૬) ભય સપાટીની ગણતરી કરો.

૧. વાર્ષિક સરેરાશ	₹ ૬૦૦૦ એકમો
૨. એકમદીઠ ભાલસામાનની પડતર	₹ ૨૦/-
૩. વરદીદીઠ ઓર્ડર મૂકવાનો ખર્ચ	₹ ૧૦૦/-
૪. વરદી મૂકવાનો ખર્ચ	૨૫%
૫. ભાલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય	૪૫ દિવસ
૬. ભાલ મેળવતા લાગતો સરેરાશ સમય	૩૫ દિવસ
૭. ભાલ મેળવા લાગતો ઓછામાં ઓછો સમય	(?)
૮. તાત્કાલિક ખરીદી માટે લાગતો મહત્તમ સમય	૫ દિવસ
૯. ઓછામાં ઓછો ટૈનિક વપરાશ	૨૦ એકમો
૧૦. સરેરાશ ટૈનિક વપરાશના એકમો	(?)

(જવાબ: (૧) આર્થિક વરદી જણ્ઠો ₹૫૦૦ એકમો; (૨) વરદી સપાટી ₹૧૫૫૦ એકમો; (૩) લઘુતમ સપાટી ₹૪૭૫ એકમો; (૪) ગુરુતમ સપાટી ₹૧૪૫૦ એકમો; (૫) સરેરાશ સપાટી ₹૮૩ એકમો; (૬) ભય સપાટી ₹૧૨૫ એકમો.)

૫. K એન્જીનીયરીંગ લિમિટેડની નીચે આપેલી માહિતી પરથી આર્થિક વરદી જણ્ઠાની ગણતરી કરો.

૧. વાર્ષિક વપરાશ	₹ ૧૦૦૦૦ એકમો
૨. એકમદીઠ ભાલની કિંમત	₹ ૮/-
૩. એકમદીઠ વીમા ખર્ચ	₹ ૦.૫૦
૪. એકમદીઠ વ્યાજ ખર્ચ	₹ ૦.૨૦
૫. એકમદીઠ સંગ્રહ ખર્ચ	₹ ૦.૨૦
૬. ઓર્ડર મૂકવાનો ખર્ચ	₹ ૨૫/-

(જવાબ: નોંધ: આ દાખલામાં વહન ખર્ચ ટકામાં નહીં પરંતુ તૃપિયા / પૈસામાં આપેલ હોવાથી નીચે મુજબનું સૂત્ર લાગુ પડશે.

$$\text{આર્થિક વરદી જણ્ઠો} = \sqrt{\frac{૨ X ૫૦૦૦}{૭}}$$

$$\text{કુલ વહન ખર્ચ} = ૦.૫૦ + ૦.૨૦ + ૦.૨૦ = ₹ ૧/-$$

$$\sqrt{\frac{૨ X ૧૦૦૦૦ X ૨૫}{૭}} = \sqrt{૪૦૦૦૦૦} = ૭૦૭ એકમો (લગામગા).)$$

૬. કોમલ લિમિટેડ ખાસ પેદાશ Kનું ઉત્પાદન કરે છે. વર્ષ ૨૦૧૮ માટે નીચેની માહિતી મળે છે.

વસ્તુની માંગ	માસિક ૧૨૦૦ એકમો
દે઱ેક વરદી મૂકવાનો ખર્ચ	₹ ૨૨૫/-
એકમદીઠ વાર્ષિક વહન ખર્ચ	₹ ૩૬/-

અઠવાડિક સામાન્ય વપરાશ	૨૨૫ એકમો
અઠવાડિક ઓછાભાં ઓછો વપરાશ	૧૫૦ એકમો
પુનઃવરદી સમય	૧ થી ૫ અઠવાડિયા

ઉપરની માહિતી પરથી ગણતરી કરો: (૧) આર્થિક વરદી જથ્થો, (૨) વરદી સપાઠી, (૩) ગુરુતમ સપાઠી, (૪) લઘુતમ સપાઠી અને (૫) સલામતી જથ્થો.

(જવાબ: (૧) આર્થિક વરદી જથ્થો $400 \text{ એકમો} \times \frac{2 \times 14400 \times 225}{36} = 800 \text{ એકમો}$; (૨) વરદી સપાઠી ૧૫૦૦ એકમો; (૩) ગુરુતમ સપાઠી ૧૭૫૮ એકમો; (૪) લઘુતમ સપાઠી ૮૨૫ એકમો; (૫) સલામતી જથ્થો ૫૦૦ એકમો.)

૭. ઓમકાર લિમિટેડની આપેલી માહિતી પરથી નીચેની વિગતો શોધી કાઢો. (૧) પુનઃવરદી સપાઠી, (૨) મહતમ સપાઠી, (૩) લઘુતમ સપાઠી, (૪) સરેરાશ સપાઠી, (૫) ભય સપાઠી અને (૬) સલામતી જથ્થો.

તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુશ્કત	અડધું ($\frac{1}{2}$) અઠવાડિયું
વરદી જથ્થો	૧૨૦૦ એકમો

વિગત	મહતમ	સરેરાશ	લઘુતમ
(૧) માલ મેળવતા લાગતો સમય (અઠવાડિયાં)	૫	(?)	૩
(૨) અઠવાડિક વપરાશ (એકમો)	(?)	૭૦	૫૦

(જવાબ: (૧) પુનઃવરદી સપાઠી ૪૦૦ એકમો; (૨) મહતમ સપાઠી ૧૪૨૦ એકમો; (૩) લઘુતમ સપાઠી ૧૨૦ એકમો; (૪) સરેરાશ સપાઠી ૭૨૦ એકમો; (૫) ભય સપાઠી ૩૫ એકમો; (૬) સલામતી જથ્થો ૮૦ એકમો.)

૮. KNS લિમિટેડની નીચેની માહિતી પરથી શોધો.

(૧) પુનઃવરદી સપાઠી, (૨) લઘુતમ સપાઠી, (૩) ગુરુતમ સપાઠી, (૪) ભય સપાઠી અને (૫) સલામતી જથ્થો.

૧. માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય પણ દિવસ
૨. તાત્કાલિક ખરીદીનો મહતમ સમય ૫ દિવસ
૩. માલ મેળવતા લાગતો સરેરાશ સમય ૫૦ દિવસ
૪. ઓછાભાં ઓછો એક દિવસનો વપરાશ ૧૨૦૦ એકમો
૫. સરેરાશ એક દિવસનો વપરાશ ૧૫૦૦ એકમો
૬. આર્થિક વરદી જથ્થો, પુનઃવરદી સપાઠીના ૨૫% જેટલો છે.

(જવાબ: (૧) પુનઃવરદી સપાઠી ૬૬૦૦૦ એકમો; (૨) લઘુતમ સપાઠી ૨૪૦૦૦ એકમો; (૩) ગુરુતમ સપાઠી ૮૮૭૫૦ એકમો; (૪) ભય સપાઠી ૭૫૦૦ એકમો; (૫) સલામતી જથ્થો ૬૦૦૦ એકમો.

$$\begin{aligned}
 & (\text{નોંધ: આર્થિક વરટી જથ્થો, પુનઃવરટી સપાઈના રૂપે જેટલો છે તેથી પુનઃવરટી સપાઈ =} \\
 & \frac{\text{રૂ.૦૦૦} \times ૨૫}{૧૦૦} = ૨૪૭૫૦ \text{ એકમો આર્થિક વરટી જથ્થો ગણાય.})
 \end{aligned}$$

૧. મજૂરી પડતર (ખર્ચ) પ્રસ્તાવના, અર્થ, પ્રકારો (Labour Cost):

પડતરનાં મૂળતાત્વોનું બીજું અંગ / ઘટક / તત્ત્વ એ મજૂરી (labour) છે. ઉત્પાદનના કાર્યમાં રોકાયેલાં કામદારો (મજૂરો)ને તેમના કામના વળતર સ્વરૂપે જે રકમ ચૂકવાય તેને મજૂરી / વેતન કહેવાય છે.

➤ મજૂરીનાં પ્રકારો:

મજૂરી બે પ્રકારની છે: (૧) સીધી કે પ્રત્યક્ષ મજૂરી, (૨) પરોક્ષ કે આડકતરી મજૂરી.

(૧) સીધી કે પ્રત્યક્ષ મજૂરી (Direct Labour):

ઉત્પાદનમાં સીધો જ ભાગ લેનાર કામદારોને ચૂકવેલ મજૂરી પ્રત્યક્ષ મજૂરી કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, વસ્તુનો આકાર, સ્વરૂપ, કદ, સ્થિતિ બદલવા માટેના કાર્યમાં ભાગ લેતાં કામદારોને ચૂકવાતી મજૂરી એ પ્રત્યક્ષ કે સીધી મજૂરી કહેવાય છે. પ્રત્યક્ષ મજૂરી કોઈ જોબ (કાર્ય), ખાતાં, વિભાગ, પ્રક્રિયા, કરાર વગેરે ખાતે સીધી જ ઉધારી શકાય છે અને તેની ફાળવણી કરવી પડતી નથી.

(૨) પરોક્ષ કે આડકતરી કે ઉપરયટ મજૂરી (Indirect Labour):

ઉત્પાદનના કાર્યમાં પરોક્ષ કે આડકતરી રીતે મદદ કરનાર મજૂરોને ચૂકવાતી મજૂરી પરોક્ષ મજૂરી કહેવાય છે. ઉત્પાદનના કાર્ય માટે પરોક્ષ મજૂરી સહાયરૂપ ગણાય છે. દા. ત.: સુપરવાઈઝરનો પગાર, પરોક્ષ મજૂરી કોઈ જોબ (કાર્ય), ખાતાં, વિભાગ, પ્રક્રિયા, કરાર વગેરે ખાતે સીધી ઉધારી શકાતી નથી પરંતુ તેની ફાળવણી કરવી પડે છે.

૨. મજૂરી ખર્ચ પર અંકુશા (Control of Labour Cost):

મજૂરી એ વસ્તુ કે સેવાની પડતરનું મહત્વનું અંગ / ઘટક / તત્ત્વ છે. વસ્તુની પડતર વધી ના જાય તે માટે મજૂરી પર અંકુશ રાખવો જરૂરી છે.

મજૂરી પર અંકુશ રાખવા નીચેનાં સૂચનો કરી શકાય અથવા પગાલાં ભરી શકાય.

- ૧) જ્યારે કામદારોને સમય વેતન પ્રથા મુજબ મજૂરી ચૂકવવાની હોય ત્યારે સમયની નોંધ આવશ્યક છે, સમય નોંધ રાખવાથી કામદારોને ચૂકવવાની મજૂરી ગણી શકાય.
- ૨) મજૂરી ગણવાની પ્રક્રિયા સરળ અને સહેલી હોવી જોઈએ કે જેથી કામદાર સમજુ શકે.
- ૩) સમયની નોંધ રાખવા ચંત્રોનો ઉપયોગ કરવો જોઈએ, જરૂર પડે તો ટાઇમકીપરની નિમણૂંક કરવી જોઈએ, જે કામદારોના આવવા-જવાના સમયની નોંધ રાખે.
- ૪) કામદારોના આવવાના અને જવાના સમય બંનેની નોંધ રાખવી જોઈએ કે જેથી કામદારે કેટલા સમય કામ કર્યું તે જાણી શકાય અને સમય પ્રામણે મજૂરી ચૂકવી શકાય.
- ૫) કામદારોનો આવવા-જવાનો તથા રીશેષ દરમ્યાન બહાર જવાનો તથા પરત આવવાનો સમય નોંધવા ‘સમયકાર્ડ’ નો ઉપયોગ કરવો જોઈએ. સમયકાર્ડ પર કામદારનું નામ, નંબર, અઠવાડિયું, મહિનો દશાવિલો હોવો જોઈએ કે જેથી વેતનની ગણાતરી કરી શકાય.

- ૫) કોઈ કામદાર જો પર કામ કરતો હોય તો તેને ‘જોબકાર્ડ’ આપવું જોઈએ. તે જોબ પર તેણે કેટલો સમય આઓ તેના પરથી મજૂરીની ગણતરી થઈ શકે. જોબકાર્ડ કાર્યદીઠ (જોબદીઠ), કામદારીઠ અથવા ખાતાં કે વિભાગવાર રાખી શકાય.
- ૬) મજૂરીનો દર અગાઉથી નક્કી હોવો જોઈએ.
- ૭) મજૂરોને મજૂરી ચૂકવાય તો તેની સહી અથવા અંગુઠાનું નિશાન મેળવવું જોઈએ.
- ૮) મજૂરી પત્રક કે પગાર પત્રક તૈયાર કરવા જોઈએ.
- ૯) મજૂરોનાં હાજરીપત્રકો તૈયાર કરવા જોઈએ. જેના પરથી મજૂર કેટલાં દિવસ હાજર છે કે ગેરહાજર છે તે જાણી શકાય.
- ૧૦) મજૂરોનાં હાજરીપત્રકો તૈયાર કરવા જોઈએ. જેના પરથી મજૂર કેટલાં દિવસ હાજર છે કે ગેરહાજર છે તે જાણી શકાય.
- ૧૧) જો સમય વેતન પ્રમાણે વેતન ચૂકવવાનું હોય તો વેતનકાર્ડ, કાર્યવેતન પ્રમાણે વેતન ચૂકવવાનું હોય તો તેનું ઉત્પાદન અને જો બોનસ પ્રથા અમલમાં હોય તો બોનસ ધ્યાનમાં લેવું જોઈએ.
- ૧૨) વેતન ઉપરાંત ઘરભાડાં ભથ્થું, અન્ય ભથ્થાં, મોંદવારી વગેરેનો સરવાળો કરી કુલ વેતન નક્કી કરવું જોઈએ. તેમાંથી કપાતો જેવી ડે, પ્રોવિન્ટ ફંડનો ફાળો, રાજ્ય વીમા ચોજનાનો ફાળો, ઉપાડ બાદ કરી ચોખ્ખી મજૂરી ગણવી જોઈએ. સરવાળા, બાદભાડી, ગુણાકારમાં ભૂલ ના થવી જોઈએ.
- ૧૩) કોઈ કામદાર વતી બીજા કામદારને મજૂરી ના ચૂકવાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
- ૧૪) કોઈ કામદારને ઓવરટાઇભની મજૂરી ચૂકવાઈ હોય તો તેની ગણતરી તપાસવી જોઈએ.
- ૧૫) વેતન કારખાનામાં ના ચૂકવતા, પગાર ઓફિસમાં બોલાવી વેતન ચૂકવવું જોઈએ કે જેથી એક કામદારનું વેતન બીજા કોઈ કામદારને ના ચૂકવાઈ જાય. મજૂરી (પગાર) લેવા બધાં જ કામદારોને એક સાથે જ બોલાવવા જોઈએ.
- ૧૬) બને ત્યાં સુધી વેતન ચેકથી ચૂકવવું જોઈએ અથવા કામદારના બેંકના ખાતામાં જમા કરાવવું જોઈએ કે જેથી ઉચાપતને અવકાશ જ ના રહે.
- ૧૭) ભૂતિયા કામદારોને (એવો કામદાર કે જે ધંધામાં કામ જ કરતો ના હોય) મજૂરી ના ચૂકવાઈ જાય તેની કાળજી રાખવી જોઈએ.
- ૧૮) રજાઓનો ચોઝ્ય હિસાબ રાખવો જોઈએ કે જેથી મર્યાદાથી વધુ રજાઓ લીધી હોય તો તેટલો પગાર કાપી શકાય.
- ૧૯) સામાન્ય અનુત્પાદક સમયની મજૂરી, અસામાન્ય અનુત્પાદક સમયની મજૂરી, ઓવરટાઇભની મજૂરી વગેરે પડતરમાં ચોઝ્ય રીતે નોંધવી જોઈએ.
- ૨૦) સામાન્ય, અસામાન્ય બગાડ, અસામાન્ય વધારો વગેરેની નોંધ રાખવી જોઈએ.

૩. મજૂર ફેરબદલી દર (Labour Turnover Rate):

→ મજૂર ફેરબદલી દરનો અર્થ:

વર્ષ દરમ્યાન સરેરાશ કામદારોની સંખ્યાના પ્રમાણમાં કેટલાં કામદારો કારખાનામાં દાખલ થયા અને કેટલાં કામદારો કારખાનું છોડી ચાલ્યા ગયા તે દર્શાવતા દરને મજૂર ફેરબદલી દર કહેવાય છે.

કારખાનામાં નવા કામદારો દાખલ થતાં જ હોય અને જુનાં કામદારો કારખાનું છોડી જાય તેનથી કોઈપણ સંજોગોમાં મજૂર ફેરબદલી દર શુન્ય હોઈ શકે નહીં.

→ મજૂર ફેરબદલી દરનાં કારણો:

મજૂર ફેરબદલી દરનાં કારણોને બે વિભાગમાં વહેંચી શકાય. (અ) દૂર કરી ના શકાય એવાં કારણો (અનિવાર્ય કારણો) અને (બ) દૂર કરી શકાય એવાં કારણો (નિવાર્ય કારણો).

⇒ દૂર કરી ના શકાય એવાં કારણો (અનિવાર્ય કારણો):

આવાં કારણો સંચાલકોના અંકુશ હેઠળ હોતાં નથી તેથી સંચાલકો મજૂર ફેરબદલી દર ઘટાડવા કોઈ પગલાં લઈ શકતા નથી. કામદાર કારખાનું છોડી જાય તો સંચાલકો તેમને રોકી શકતા નથી.

- ૧) માંદગી: લાંબી માંદગી અથવા ગંભીર અસાધ્ય રોગ થવાથી કામદાર કામ કરવા અશક્ત બને તો સ્વાભાવિક રીતે તેણે કારખાનું (નોકરી) છોડી દેવું પડે છે.
- ૨) અકસ્માત: કામદારને અકસ્માત થવાથી કાર્ય કરવા સક્ષમ ના હોય તો પણ કારખાનું છોડી દેવું પડે છે.
- ૩) નિવૃત્તિ: વયર્માંદા અથવા સ્ટેચિક નિવૃત્તિને કારણે કામદારે ફરજીયાત કારખાનું છોડી જવું પડે છે.
- ૪) સ્વી કામદારના લભ: સ્વી કામદારના લભ થતા ઘણીવાર નોકરીમાં ચાલુ રહેવું અશક્ત બની જાય છે એન નોકરી છોડી દે છે.
- ૫) કામદારનું મૃત્યુ: કામદારનું કુદરતી કે અકુદરતી મૃત્યુ નવી ભરતીને અનિવાર્ય બનાવે છે.
- ૬) અન્ય ધંધામાં સારો લાભ: જો કામદારને અન્ય કોઈ ધંધામાં સારો પગાર, સારી નોકરીની શરતોનો લાભ મળતો હોય તો પણ તે કારખાનું છોડી અન્ય ધંધામાં ચાલ્યો જાય છે.
- ૭) અંગત કારણો: કામની અસંતોષકારક સ્થિતિ, ઓછો પગાર, અપ-ડાઉન (આવવા-જવા)ની મુશ્કેલી, શહેરી વાતાવરણ અનુકૂળ ના આવવું, કૌટુંબિક જવાબદારી, સગાં-સંબંધી-મિત્રોની હૂંક વગરે જેવાં અંગત કારણોસર કામદાર નોકરી છોડી દે છે.
- ૮) કામદારોની ભરતરકી (છટણી / છૂટાં કરવાં): ઘણીવાર સંચાલકો કામદારોને છૂટાં કરે છે. કામદાર ગેરશિસ્ત વર્તન કરતો હોય, કાર્યક્ષમ ના હોય, જરૂર કરતાં વધારે રજાઓ પાડી ગેરહાજર રહેતો હોય, મજૂરસંઘની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ લેતો હોય, પગાર વધારાની ગેરવ્યાજની માંગાણી કરતો હોય તો કામદારોને છૂટાં કરવામાં આવે છે.

⇒ દૂર કરી શકાય એવાં કારણો (નિવાર્ય કારણો):

- નીચેનાં કારણો એવાં છે કે જો સંચાલકો ઈચ્છે તો મજૂર ફેરબદલી દર ઘટાડી શકે.
- ૧) કામદારની અવૈજ્ઞાનિક પસંદગી: જ્યારે કારખાનામાં નવા કામદારોની ભરતી કરવાની હોય તો વૈજ્ઞાનિક ધોરણે કામદારની ભરતી થવી જોઈએ. યોગ્ય સ્થાન માટે યોગ્ય લાયકાતવાળા કામદારની ભરતી થવી જોઈએ. યોગ્ય સમયે કામદારની ભરતી થવી જોઈએ. અવૈજ્ઞાનિક રીતે પસંદ થયેલો કામદાર છૂટો કરવામાં આવે છે.
 - ૨) અપૂરતું વેતન: વ્યાજબી વેતન કામદારને પ્રેરણા આપે છે. કામદારનું જીવનધોરણ ટકી રહે તેટલું વેતન મળતું ના હોય તો કારખાનું છોડી જાય છે.
 - ૩) કાર્યની અસંતોષ પરિસ્થિતિ: કારખાનાનું ગંદું વાતાવરણ, સુવિધાઓનો અભાવ, હવા-ઉજાસની કમી, પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સહકર્મચારી સાથે અણાબનાવ, સુપરવાઇઝરની કનંગત (પજવણી), થાક, કંટાળો, કામનાં વધુ કલાકો, અપૂરતું વેતન, અપૂરતી ઉંઘ, પૂરતો આરામ ના મળવો વગેરેને કારણે કામદાર બીજી નોકરીની શોધી લે છે.
 - ૪) અન્ય કારણો: કામદારને અન્યાય થતો હોય, તેની યોગ્ય કે વ્યાજબી ફરિયાદો સંચાલકો સાંભળતા ના હોય, બઢતી (પ્રમોશન) મળતું ના હોય, સુપરવાઇઝરનું ઉંઘતાઈભર્યું વર્તન કામદારને અસંતોષી બનાવે છે. કેન્ટીનની સુવિધા ના હોય, મજૂર કલ્યાણકારી યોજના અમલમાં ના હોય તો કામદાર બીજી કોઈ જર્યાએ નોકરીની શોધ કરે છે.

→ **મજૂર ફેરબદલી દર ઘટાડવાનાં / દૂર કરવાનાં ઉપાયો (સૂચના):**

મજૂર ફેરબદલી દર કોઈ દિવસ શુંચ હોઈ શકે નહીં કારણ કે ઉપરનાં કારણોસર જૂનાં કામદારો કારખાનું છોકી જાય છે અને તેમનાં સ્થાને નવાં કામદારોની ભરતી કરવી પડે છે. છતાં મજૂર ફેરબદલી દર ઘટાડવા / ઓછો કરવા નીચેનાં સૂચનો કરી શકાય.

- (૧) કામદારોની ખામી બરેલી ભરતી પ્રથા બદલી વૈજ્ઞાનિક ધોરણે કામદારોની ભરતી કરવી જોઈએ.
- (૨) કામદારો માટે કામ માટેની સંતોષકારક પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ.
- (૩) કામદારોને તેમના કામના પ્રમાણામાં વ્યાજબી વેતન ચૂકવાવું જોઈએ.
- (૪) કામદારોને કહેવા માટે કવાર્ટ્સ (રહેઠાણનાં મકાનો) પૂરાં પાડવાં જોઈએ.
- (૫) લઘુતમ વેતનનો લાભ આપવો જોઈએ.
- (૬) કારખાનામાં લાંબા સમય સુધી નોકરી કરનાર કામદારને પેન્શન, ગ્રેચ્યુઝન્ટી વગેરે જેવાં લાભો આપવાં જોઈએ.
- (૭) કામદારો માટેની કલ્યાણકારી યોજનાઓ અભલમાં મૂકવી જોઈએ.
- (૮) સંચાલકો (માલિકો) અને કામદારો વચ્ચે સાથ-સહકાર અને સુભેન્ભર્યા સંબંધો હોવાં જોઈએ.
- (૯) કામદારોની વ્યાજબી ફરિયાદો હોય તો તેનો સમયસર નિકાલ થવો જોઈએ.
- (૧૦) કામદારોનો સ્થિર વર્ગ ઉભો કરવા મજૂર સંઘોનો યોગ્ય વિકાસ થાય તેવાં પ્રયત્નો કરવાં જોઈએ.
- (૧૧) ઉતેજન (પ્રગતિશીલ) વેતન પ્રથાઓ જેવી કે, હેલ્સી યોજના, રોવેન યોજના, ટેલરની વિભિન્ન વેતનદરની પદ્ધતિ, બીડો યોજના, નફાભાગ યોજના, સહભાગીદારી યોજના વગેરેનો અભલ કરવો જોઈએ, જેથી કામદારને વેતન ઉપરાંત બોનસ પણ મળે.
- (૧૨) કારખાનામાં પ્રાથમિક સારવાર (દવાખાનું), કેન્ટીન, રમતગમતનાં સાધનો, વાહનવ્યવહારની સવલત, જૂથવિમા યોજના, બોનસ, ઓપરટાઇભ, ગ્રેચ્યુઝન્ટી, પેન્શન, કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો, પ્રોવિકન્ટ ફંડ, રહેઠાણનું મકાન (સ્ટાફ કવાર્ટ્સ) વગેરે જેવી સગાવડો આપી શકાય.

મજૂર ફેરબદલી દર ઘટાડવા જો ઉપરનાં પગલાં લેવામાં આવે તો...

- (૧) કામદારોની કાર્યક્ષમતા વધશે.
- (૨) કામદારોની આપક વધશે.
- (૩) માલિક-કામદારો વચ્ચે સંબંધો સુધરશે.
- (૪) ઉત્પાદનની પડતર ઘટશે.
- (૫) માલની ગુણવત્તા સુધરશે.
- (૬) નવા કામદારની ભરતીનો ખર્ચ ઘટશે.
- (૭) માનવસંપત્તિનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.
- (૮) માલનું ઉત્પાદન વધશે. માલની ગુણવત્તામાં વધારો થશે.

➤ **સારી (આદર્શ) વેતન પદ્ધતિની વિશિષ્ટતાઓ (લક્ષણો):**

- (૧) વેતન, સામાન્ય કામદારના કાર્યના પ્રમાણામાં હોવું જોઈએ.
- (૨) કામદારને લઘુતમ વેતનની બાંહેધરી મળવી જોઈએ.
- (૩) સરેરાશ કામદારની અમૃક સમયમાં કાર્ય કરવાની શક્તિને ધ્યાનમાં લઈ વેતન નક્કી કરવું જોઈએ.
- (૪) વેતન પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેથી કામદારને ઉત્પાદન વધારવા ઉતેજન મળવું જોઈએ.
- (૫) વેતન પદ્ધતિ સરળ અને સહેલી હોવી જોઈએ કે જેથી કામદાર પણ તેને સહેલાઈથી સમજુ શકે.


- (૬) વેતન પદ્ધતિ એવી હોવી જોઈએ કે કામદારને વ્યાજબી વેતન પણ મળી રહે અને માલિક પર બોજ ના પડે.
- (૭) વેતન પદ્ધતિમાંથી મળતાં લાભ કરતાં ખર્ચ વધી ના જવો જોઈએ. ટૂંકમાં, વેતન પદ્ધતિ ખર્ચળ ના હોવી જોઈએ.
- (૮) વેતન પદ્ધતિ પરિવર્તનશીલ હોવી જોઈએ, એટલે કે સમય-સંજોગો મુજબ વેતન પદ્ધતિમાં ફેરફાર કરી શકાય.
- (૯) જે વેતન પદ્ધતિ એકવાર અમલમાં મૂકવામાં આવે તે કાયમી પાચા પર અમલમાં મૂકવી જોઈએ.
- (૧૦) વેતન પદ્ધતિ ન્યાયી અને વ્યવહારું હોવી જોઈએ.

૪. જુદી-જુદી વેતનપ્રથાઓ:

વેતન ચૂકવવા માટેની બે જુનામાં જુની પદ્ધતિઓ (૧) સમય વેતનપ્રથા અને (૨) કાર્ય વેતનપ્રથા છે. આ ઉપરાંત આધુનિક સમયમાં ઉતેજન (પ્રગતિશીલ) વેતનપ્રથાઓ અસ્તિત્વમાં આવી છે.

ઘણીવાર કામદારોને સંતોષી રાખવા સહભાગીદારી યોજના અને નફાભાગ યોજના પણ અમલમાં મૂકી શકાય. આ યોજનામાં કામદારોને ધંધાના સંચાલનમાં ભાગ મળે છે અને ધંધાના નફામાંથી અમૃક ભાગ પણ કામદારોને વહેંચવામાં આવે છે.

વિવિધ વેતનપ્રથાઓ નીચે પ્રમાણે છે.



નોંધ: બી. કોમ. સેમેસ્ટર-૩ના અભ્યાસક્રમમાં (૧) સમય વેતનપ્રથા, (૨) કાર્ય વેતનપ્રથા, (૩) હેલ્પી યોજના અને (૪) રોવેન યોજનાનો જ અભ્યાસ અનિવાર્ય છે. અન્ય વેતનપ્રથાઓ અભ્યાસક્રમમાં નથી.

⇒ **ઝડિગત અથવા પ્રણાલિકાગત વેતનપ્રથાઓ (પદ્ધતિઓ):**

ઝડિગત વેતનપ્રથાઓમાં સમય વેતનપ્રથા અને કાર્ય વેતનપ્રથા ખૂબ જ જૂની અને પ્રચલિત છે.

(૧) **સમય વેતન પ્રથા (Time Wage System):** સમય વેતનપ્રથા ખૂબ જૂની અને આજે પણ ખૂબ જ પ્રચલિત છે. તેનું કારણ તે સરળ અને સહેલી છે. આ પદ્ધતિમાં કામદારે કેટલા સમય કામ કર્યું છે તે સમયના પ્રમાણમાં વેતન આપવામાં આવે છે. વેતન દર કલાકટીઠ, અઠવાડિક, માસિક કે વાર્ષિક હોય છે.

સમય વેતન નીચે મુજબ ગણાય છે.

$$E = T \times R$$

જ્યાં, E = Earning (કમાણી / વેતન / મજૂરી)

T = Time (લીધેલ સમય)

R = Rate (કલાકટીઠ, અઠવાડિક, માસિક વેતનદર)

અથવા

સમય વેતન = લીધેલો સમય × વેતન દર

► **સમય વેતનપ્રથા ક્યાં અનુકૂળ છે ? :**

- ૧) જ્યાં માલની ગુણવત્તા જાળવવી જરૂરી હોય.
- ૨) જ્યાં કામદારે કરવાનું કામ એકમ (Unit)માં માપી શકાતું હોય.
- ૩) જ્યાં કામની ઝડપનો આધાર કામદાર (માણસ) નહીં પરંતુ યંત્ર પર હોય.
- ૪) કામ અનિયંત્રિત પ્રકારનું હોય અને વિલંબિત કામ હોય.
- ૫) કામદારો શિખાઉ હોય.

► **સમય વેતનપ્રથાનાં ફાયદાઓ:** સમય વેતનપ્રથા આજે પણ લોકપ્રિય છે. તેના નીચેનાં ફાયદાઓને આભારી છે.

- ૧) સરળ અને સહેલી છે, કામદારો તેને સહેલાઈથી સમજુ શકે છે.
- ૨) કામદાર ગુણવત્તા પર વધુ ધ્યાન આપે છે. માલની ગુણવત્તા જાળવાય છે.
- ૩) કામદાર કાર્યમાં ઉતાવળ કરતો નથી જેથી યંત્રોની પૂરતી કાળજી રાખી શકાય છે.
- ૪) વેતનની રકમ નિશ્ચિત હોવાથી કામદાર પોતાના જીવનધોરણ નિર્વાહનું આયોજન કરી શકે છે.
- ૫) વેતન ખર્ચ કેટલો થશે તે માલિક જાણી શકે છે તેથી ઉત્પાદનની પડતર નક્કી કરવામાં ઉપયોગી છે.
- ૬) કામદાર વધુ ઉત્પાદન કરવાની ઉતાવળ કરતો નથી તેથી બગાડ અટકે છે.

- ૭) એકસરખા પ્રકારનું કાર્ય કરનાર કામદારોને એકસરખણું વેતન મળે છે તેથી કામદારોમાં સમાનતાનું વાતાવરણ પ્રવર્તે છે.
 ૮) સામૂહિક સોદાગરીમાં વેતન નક્કી કરવા આ પદ્ધતિ આધારભૂત ગણાય છે.

➢ સમય વેતનપ્રથાનાં ગેરલાબો / ગેરકાયદા / ખાભીઓ / ભર્યાદાઓ:

- ૧) કાર્યક્ષમ અને બિનકાર્યક્ષમ કામદારો વરચે કોઈ લેદભાવ રાખવામાં આવતો નથી, તેથી કાર્યક્ષમ કામદારોને અસંતોષ થાય છે. તેઓને કાર્યમાં કોઈ ઉત્સાહ રહેતો નથી.
- ૨) કામદારોને નિશ્ચત વેતનની બાંહેધરી મળતી હોવાથી કામદાર ધીમી ગતિએ કામ કરે છે તેથી દેખરેખ રાખવાનો સુપરવિકન ખર્ચ વધે છે.
- ૩) કામદારોને બઢતી (Promotion) આપવા કોઈ ચોક્કસ ધોરણ કે માપદંડ નથી.

(૨) **કાર્ય વેતન પ્રથા (Piece Wage System):** સમય વેતનપ્રથાની ખાભીઓ દૂર કરવા કાર્ય વેતનપ્રથા ઉપયોગી છે. તેમાં સમય નહીં પરંતુ કામદારનું ઉત્પાદન ધ્યાનમાં લેવાય છે. એકમદીઠ વેતન દર અગાઉથી નક્કી કરવામાં આવે છે. દિવસ દરમ્યાન સરેરાશ કામદાર કેટલું ઉત્પાદન કરશે તેનો અંદાજ કાઢવામાં આવે છે.

કાર્ય વેતન નીચે મુજબ ગણાય છે.

$$E = W \times R$$

જ્યાં, E = Earning (કમાણી / વેતન / મજૂરી)

W = Number of Units (કાર્યનાં એકમો)

R = Rate per Unit (એકમદીઠ દર)

અર્થિત

કાર્ય વેતન = કાર્યના ઉત્પાદનના એકમો × એકમદીઠ દર

➢ કાર્ય વેતનપ્રથા ક્યાં અનુકૂળ છે ? :

- ૧) કામદારે કરેલું કાર્ય એકમોમાં માપી શકતું નથી.
- ૨) જ્યાં માલની ગુણવત્તા કરતાં કામની ઝડપ વધુ મહત્વની હોય.
- ૩) કામ નિયમિત (regular/routine) પ્રકારનું હોય.
- ૪) માલિકે ઉતેજન વેતનપ્રથા લાગુ પાડી હોય.

➢ કાર્ય વેતનપ્રથાનાં ફાયદાઓ:

- ૧) ઉતેજન વેતનપ્રથા માટે અનુકૂળ છે.
- ૨) કાર્યક્ષમતા પ્રમાણે વેતન મળતું હોવાથી કુશળ કામદારો આકર્ષિય છે અને સંતોષ અનુભવે છે.
- ૩) કામદાર પોતે ઉતેજન પામી સ્વૈચ્છિક ઉત્પાદન વધારવા પ્રયત્નો કરે છે, તેથી નિરીક્ષણ રાખવાની જરૂર નથી. કામદાર સ્વયં ઉત્પાદન વધારે છે.

- ૪) પડતર નક્કી કરવા ઉપયોગી છે, કારણ કે એકમદીઠ મજૂરીખર્ચ અગાઉથી નક્કી કરી શકાય છે.
- ૫) સમગ્ર ઉત્પાદન વધે છે તેથી એકમદીઠ સ્થિર ખર્ચ ઘટે છે.
- ૬) કામદારો સંતોષી રહે છે. કારખાનું છોડી ચાલ્યા જતા નથી, તેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.
- ૭) કામદારો પોતે પોતાના વેતનની ગણાતરી કરી પોતાનું જીવનધોરણ નક્કી કરી શકે છે.
- ૮) ઉત્પાદન વધારવા કામદારો નવી પદ્ધતિ શોધવા પ્રયત્ન કરે છે.

➢ કાર્ય વેતનપ્રથાનાં ગેરફાયદાઓ:

- ૧) ઉત્પાદન વધારવાની લાલચમાં કામદારો માલની ગુણવત્તા બગાડે છે, તેથી ગુણવત્તા ચકાસણી / અંકુશ (Quality Check / Quality Control) માટે વ્યવસ્થા કરવી પડે છે.
- ૨) કામદારો ઉત્પાદન વધારવા ઝડપથી કાર્ય કરે છે, શારીરિક શક્તિનો વ્યય થાય છે, કાર્યક્ષમતા ઘટે છે, અકસ્માતો વધે છે.
- ૩) વધુ ઉત્પાદન કરવા જતા યંત્રો / સાધનોનો બગાડ થાય છે.
- ૪) દરેક કામદારને પોતે કરેલા ઉત્પાદન પ્રમાણે વેતન મળે છે. દરેકનું વેતન અલગ-અલગ આવે છે. કાર્યક્ષમ કામદારો વધુ ઉત્પાદન કરી વધુ વેતન મેળવે છે, જ્યારે બિનકાર્યક્ષમ કામદારોને ઓછું વેતન મળવાથી ઈજારી ઉત્પન્ન થાય છે.
- ૫) કામદારના ઉત્પાદનની નોંધ રાખવી પડતી હોવાથી કાર્બૂની (વહીવટી) કામ વધે છે.
- ૬) માલની ગુણવત્તા તપાસવા ઇન્સ્પેક્ટર (તપાસ અધિકારી)ની નિમણૂંક કરવી પડે છે. તેને ચૂકવવાના પગારથી ખર્ચ વધે છે.
- ૭) નવા કામદારો આકર્ષાત્મક નથી. શરૂઆતમાં તેમનું ઉત્પાદન ઓછું હોય છે.
- ૮) કાચા માલનો બગાડ થાય છે.

⇒ પ્રગતિશીલ અથવા ઉત્તેજનાત્મક વેતનપ્રથાઓ (Incentive Wage Systems):

સમય વેતનપ્રથા અને કાર્ય વેતનપ્રથા મુજબ કામદારોને ફક્ત તેમના કામના બદલામાં વેતન મળે છે, બોનસ મળતું નથી. આ ખાંબી ખૂર કરવા પ્રગતિશીલ વેતનપ્રથા ઉપયોગમાં લેવાય છે જેમાં કામદારને તેણે કરેલા કાર્યના બદલામાં વેતન તો મળે જ છે પણ જો કામદાર સમય બચાવે તો બોનસ પણ મળે છે.

➢ ઉત્તેજનાત્મક વેતનપ્રથાનાં લક્ષણો:

- ૧) કામદારને લદુતમ વેતનની બાંહેધરી મળે છે.
- ૨) પ્રમાણ કાર્ય નિશ્ચિત સમયમાં પુરું ના થાય તો પણ ન્યૂનતમ વેતન તો મળે જ છે અને જો કામદાર નિશ્ચિત સમય કરતાં પહેલાં કાર્ય પુરું કરે તો બચાવેલ સમયના પ્રમાણમાં બોનસ પણ મળે છે.
- ૩) વધારાના ઉત્પાદનનો લાભ કામદાર અને માલિક બંનેને મળે છે.

૪) ઉતેજનાત્મક વેતનપ્રથા તે પદ્ધતિ શોધનારના નામથી જ ઓળખાય છે. દા. ત.: હેલ્સી પ્રીમિયમ યોજના, રોવેન યોજના, ટેલરની વિભિન્ન દરની યોજના, ગેન્ટ બોનસ યોજના વગેરે.

નોંધ: સરદાર પટેલ ચુનિવર્સિટીના અભ્યાસક્રમાં (૧) હેલ્સી યોજના અને (૨) રોવેન યોજનાનો જ અભ્યાસ કરવાનો છે.

(૧) હેલ્સી યોજના (Halsey Plan):

૧૮૮૧માં અમેરિકામાં શ્રી હેલ્સીએ આ યોજના દાખલ કરી હતી. આ યોજના મુજબ કામદારને દૈનિક કાર્ય માટે સમય વેતનની બાંહેદરી આપવામાં આવે છે. જે કામદાર નિશ્ચિત સમયમાં પ્રમાણ કાર્ય પુરુષ કરે તેને સમય વેતન મળે છે. નિશ્ચિત સમયમાં પ્રમાણ કાર્ય કરતાં ઓછું કાર્ય કરે તો પણ સમય વેતન મળે જ છે અને જો કામદાર નિશ્ચિત સમય કરતાં ઓછા સમયમાં પ્રમાણ કાર્ય પુરુષ કરે તો બચાવેલ સમયનું બોનસ મળે છે.

› ફાયદાઓ:

- (૧) હેલ્સી યોજના સરળ અને સહેલી છે.
- (૨) પ્રમાણ કાર્ય અગાઉથી નક્કી કરી શકાય છે.
- (૩) કામદારે બચાવેલ સમયનો લાભ માલિકને પણ મળે છે તેથી માલિક અને કામદાર બંને પક્ષે આ યોજના લાભદારી છે.
- (૪) પ્રમાણ કાર્ય પુરુષ નહીં કરનાર કામદારને લઘૃતમ વેતનની બાંહેદરી મળે છે.

› ગેરફાયદાઓ:

- (૧) પ્રમાણ કાર્ય વૈજ્ઞાનિક રીતે નક્કી કરવામાં આવતું નથી ફક્ત ભૂતકાળના અનુભવ પરથી પ્રમાણ કાર્ય નક્કી થાય છે.
- (૨) કાર્ય વેતન જેટલું ઉતેજન કામદારને મળતું નથી.

હેલ્સી યોજના મુજબ વેતન અને બોનસ તથા કુલ વેતન નીચે પ્રમાણે ગણાય છે.

$$E = (T \times R) + \frac{40}{100} (TS \times R)$$

જ્યાં, E = Earning (કમાણી / વેતન / મજૂરી)

T = Time Taken (લીધેલ સમય)

R = Rate per Hour (કલાકદીઠ વેતનદર)

TS = Time Saved (બચાવેલ સમય)

અથવા

કુલ વેતન = ખરેખર સમયનું વેતન × (૫૦%) (બચાવેલ સમયનું વેતન)

અધ્યાત્મ

- (૧) વેતન = ખરેખર લીધેલ સમય × વેતનદર
- (૨) બોનસ = ૫૦% (બચાવેલ સમય × વેતનદર)
- (૩) કુલ વેતન = વેતન + બોનસ / (૧) + (૨)

ઉદાહરણા: ૧ એક કારખાનામાં પ્રમાણા કાર્ય ૧૦ કલાક નક્કી કરવામાં આવ્યું છે. સમય વેતન રૂ ૧/- છે. જો એક કામદાર આ પ્રમાણા કાર્ય ૧૦ કલાકમાં પુરું કરે છે, બીજો કામદાર આ પ્રમાણા કાર્ય ૮ કલાકમાં પુરું કરે છે તો હેલ્સી યોજના મુજબ વેતનની ગણતરી કરો.

જવાબ:

- (૧) જો કામદાર પ્રમાણા કાર્ય ૧૦ કલાકમાં પુરું કરે તો:

$$\begin{aligned} \text{વેતન} &= \text{લીધેલ સમય} \times \text{વેતનદર} \\ &= ૧૦ \text{ કલાક} \times \text{રૂ } ૧/- \\ &= \text{રૂ } ૧૦/- \end{aligned}$$

- (૨) જો કામદાર પ્રમાણા કાર્ય ૮ કલાકમાં પુરું કરે તો:

$$\begin{aligned} - \text{વેતન} &= \text{લીધેલ સમય} \times \text{વેતનદર} \\ &= ૮ \text{ કલાક} \times \text{રૂ } ૧/- \\ &= \text{રૂ } ૮/- \end{aligned}$$

$$- \text{કુલ વેતન} = \text{લીધેલ સમયનું વેતન} + ૫૦\% (\text{બચાવેલ સમયનું વેતન})$$

$$\begin{aligned} &= \text{રૂ } ૮/- + \frac{૫૦}{૧૦૦} (૮ \text{ કલાક} \times \text{રૂ } ૧/-) \\ &= \text{રૂ } ૮/- + \left(\frac{૫૦}{૧૦૦} \times ૮ \right) \\ &= \text{રૂ } ૮/- + \text{રૂ } ૧/- \\ &= \text{રૂ } ૯/- \end{aligned}$$

- (૨) રોવેન યોજના (Rowan Plan):

શ્રી રોવેન આ યોજના ૧૮૮૫માં રજૂ કરી હતી. આ યોજના હેલ્સી યોજના જેવી જ છે ફક્ત બોનસની ગણતરી અલગ રીતે થાય છે.

રોવેન યોજના મુજબ સમય વેતન, બોનસ અને કુલ વેતન નીચે પ્રમાણે ગણાય છે.

$$(૧) \text{ સમય વેતન} = \text{લીધેલો સમય} \times \text{વેતનદર}$$

$$(૨) \text{ બોનસ} = \frac{\text{ખરેખર સમય વેતન} \times \text{બચાવેલ સમય}}{\text{આપેલ સમય}}$$

$$(3) \text{ કુલ વેતન} = \text{સમય વેતન} + \text{બોનસ}$$

ઉદાહરણ: ૨ એક પ્રમાણ કાર્ય ૧૦ કલાકમાં પુરું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વેતનદર કલાકદીઠ રૂ ૧/- છે. એક કામદાર ૮ કલાકમાં આ કાર્ય પુરું કરે તો રોવેન યોજના મુજબ કુલ વેતન કેટલું મળશે?

જવાબ:

$$(1) \text{ સમય વેતન} = \text{લીધેલ સમય} \times \text{વેતનદર}$$

$$= ૮ \text{ કલાક} \times \text{રૂ } ૧/-$$

$$= \text{રૂ } ૮/-$$

$$(2) \text{ બોનસ} = \frac{\text{સમય વેતન} \times \text{બચાવેલ સમય}}{\text{આપેલ સમય}}$$

$$= \frac{૮ \times ૨}{૧૦}$$

$$= \text{રૂ } ૧.૬૦$$

$$(3) \text{ કુલ વેતન} = \text{સમય વેતન} + \text{બોનસ}$$

$$= \text{રૂ } ૮/- + \text{રૂ } ૧.૬૦$$

$$= \text{રૂ } ૯.૬૦$$

ઉપરની ગણતરી પરથી કહી શકાય કે હેલ્સી યોજના કરતા રોવેન યોજના કામદારો માટે વધુ લાભદાયી છે. હેલ્સી યોજનામાં કામદારને રૂ ૯૦/- કુલ વેતન મળે છે, જ્યારે રોવેન યોજનામાં રૂ ૯૬૦ કુલ વેતન મળે છે.

સ્વાચ્છાય

૧. એક કાર્ય પુરું કરવાનો પ્રમાણ સમય ૧૦૦ કલાક છે. એક કારીગરને કલાકદીઠ રૂ ૧૦/- વેતન અપાય છે. આ કાર્ય આ કારીગરે ૮૦ કલાકમાં પુરું કર્યું તો (૧) સમય વેતનપ્રથા અને (૨) કાર્ય વેતનપ્રથા મુજબ કારીગરને કેટલું વેતન ભળશે?

(જવાબ: (૧) સમય વેતનપ્રથા પ્રમાણો રૂ ૮૦૦/- કુલ વેતન મળો (વેતન = લીધેલ સમય × વેતનદર = ૮૦ કલાક × રૂ ૧૦/-);

(૨) કાર્ય વેતનપ્રથા પ્રમાણો રૂ ૧,૦૦૦/- કુલ વેતન મળો (વેતન = પ્રમાણ કામનાં કલાકો × વેતનદર = ૧૦૦ કલાક × રૂ ૧૦/-).

૨. એક કારખાનામાં મીના, ટીના અને લીના ત્રણ કામદારો છે. જોબ માટેનો પ્રમાણ સમય ૫૦ કલાક છે. કલાકદીઠ વેતનનો દર રૂ ૫૦/- છે.

મીના આ જોબ પુરું કરવા ૩૦ કલાક લે છે.

ટીના આ જોબ પુરું કરવા ૪૦ કલાક લે છે.

લીના આ જોબ પુરું કરવા ૫૦ કલાક લે છે.

નીચેની પદ્ધતિઓ મુજબ દરેક કામદારોને કેટલું વતેન ભળશે તેની ગાણતરી કરો.

(અ) કાર્ય વેતન પ્રથા

(બ) હેલ્પી વેતનપ્રથા

(ક) રોવેન વેતનપ્રથા

(જવાબ: (અ) કાર્ય વેતનપ્રથા મુજબ દરેક કામદાર મીના, ટીના અને લીનાને અનુક્રમે રૂ ૩,૦૦૦/- વેતન ભળશે. (કાર્ય વેતન = પ્રમાણ સમય × વેતનદર = ૫૦ કલાક × રૂ ૫૦/-) નોંધ: કામદાર પ્રમાણ સમય જેટલાં, પ્રમાણ સમય કરતાં ઓછાં કે પ્રમાણ સમય કરતાં વધુ સમયમાં કાર્ય પુરું કરે કે ના કરે છતાં ૫૦ કલાક પ્રમાણો વેતન મળો જ છે.;

(બ) હેલ્પી વેતનપ્રથા મુજબ વેતન = લીધેલ સમય × વેતનદર + ૫૦% (બચાવેલ સમયનું વેતન)

મીના: $30 \text{ કલાક} \times રૂ 50/- + 50\% (20 \text{ કલાક} \times રૂ 50/- = રૂ 1,000 + 500 = રૂ 2,500/- \text{ વેતન મળશે.}$

ટીના: $40 \text{ કલાક} \times રૂ 50/- + 50\% (10 \text{ કલાક} \times રૂ 50/- = રૂ 500 + 250 = રૂ 750/- \text{ વેતન મળશે.}$

લીના: $50 \text{ કલાક} \times રૂ 50/- + 50\% (0 \text{ કલાક} \times રૂ 50/- = રૂ 3,000/- \text{ વેતન મળશે.};$

(ક) રોવેન વેતનપ્રથા મુજબ વેતન = લીધેલ સમય × વેતનદર + $\left(\frac{\text{સમય વેતન} \times \text{બચાવેલ સમય}}{\text{આપેલ સમય}} \right)$

મીના: $30 \text{ કલાક} \times રૂ 50/- + \left(\frac{1,000 \times 20}{50} \right) = 1,000 + 400 = રૂ 1,400 = રૂ 2,400/- \text{ વેતન મળશે.}$

ટીના: ૪૦ કલાક \times ₹ ૫૦/- + $\left(\frac{૨૪૦૦ \times ૧૦}{૫૦} \right) = ૨,૪૦૦ + ૪૮૦ = ₹ ૨,૮૮૦/-$
વેતન મળશે.

ટીના: ૫૦ કલાક \times ₹ ૫૦/- + $\left(\frac{૩૦૦૦ \times ૦}{૫૦} \right) = ૩,૦૦૦ + ૦ = ₹ ૩,૦૦૦/-$ વેતન
મળશે.

નોંધ: ટીના સમય બચાવતી નથી તેથી તેને બોનસ મળશે નાઈ.

3. એક જોબ (કાર્ય) પુરું કરવા એ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભગન આ કાર્ય ક કલાકમાં પુરું કરે છે. વેતનદર કલાકના ₹ ૫/- છે. માલસામાનની કિંમત ₹ ૧૦/- હોય, કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના ૧૦૦% છે. નીચેની પદ્ધતિ મુજબ કારખાના પડતર શોધો.

(૧) સમય વેતનપ્રથા અને (૨) કાર્ય વેતનપ્રથા.

જવાબ: સમય વેતનપ્રથા મુજબ વેતન ₹ ૩૦/- (લીધેલ સમય \times વેતનદર) = ૫ કલાક \times ₹ ૫/- = ₹ ૩૦/-;

કાર્ય વેતનપ્રથા મુજબ વેતન ₹ ૪૫/- (૬ કલાક \times ₹ ૫/- = ₹ ૪૫/-);

કારખાના પડતર: સમય વેતનપ્રથા મુજબ ₹ ૭૦/- (માલસામાન ₹ ૧૦/- + મજૂરી ₹ ૩૦/- + કારખાના ખર્ચ મજૂરનાં ૧૦૦% લેખે ₹ ૩૦/- = ₹ ૭૦/-);

કાર્ય વેતનપ્રથા મુજબ ₹ ૧૦૦/- (માલસામાન ₹ ૧૦/- + મજૂરી ₹ ૪૫/- + કારખાના ખર્ચ મજૂરનાં ૧૦૦% લેખે ₹ ૪૫/- = ₹ ૧૦૦/-.)

4. સુરેશને એક જોબ (કાર્ય) પુરું કરવા ૧૫૦ કલાકનો સમય ફાળવેલ છે. તેણે આ કાર્ય ૧૨૫ કલાકમાં પુરું કરેલ છે. કલાકદીર વેતનનો દર ₹ ૨૦/- છે. (૧) સમય વેતનપ્રથા, (૨) કાર્ય વેતનપ્રથા, (૩) હેલ્પી વેતનપ્રથા અને (૪) રોયેન વેતનપ્રથા મુજબ કેટલી મજૂરી મળશે તેની ગણતરી દર્શાવો.

જવાબ: (૧) સમય વેતનપ્રથા મુજબ મજૂરી ₹ ૨,૪૦૦/- (મજૂરી = લીધેલ સમય \times વેતનદર = ૧૨૫ કલાક \times ₹ ૨૦/- = ₹ ૨,૪૦૦/-);

(૨) કાર્ય વેતનપ્રથા મુજબ મજૂરી ₹ ૨,૭૫૦/- (મજૂરી = ફાળવેલ સમય \times વેતનદર = ૧૫૦ કલાક \times ₹ ૨૦/- = ₹ ૩,૦૦૦/-);

(૩) હેલ્પી વેતનપ્રથા મુજબ મજૂરી ₹ ૨,૭૫૦/- (મજૂરી = ખરેખર સમય \times વેતનદર = ૧૨૫ કલાક \times ₹ ૨૦/- = ₹ ૨,૪૦૦/-, બોનસ = ૫૦% \times બચાવેલ સમયનું વેતન = $\frac{૫૦}{૧૦૦} \times$ ૨૫ કલાક \times ₹ ૨૦/- = ₹ ૨૫૦/-, કુલ વેતન = મજૂરી + બોનસ = ₹ ૨,૪૦૦/- + ₹ ૨૫૦/- = ₹ ૨,૭૫૦/-);

(૪) રોવેન વેતનપ્રથા મુજબ મજૂરી ₹, ૯૯૫.૫૭ (મજૂરી = લીધેલ સમય × વેતનદર = ૧૨૫

$$\text{કલાક } \times ₹ 20/- = ₹ 2,400/-, \text{ બોનસ} = \left(\frac{\text{સમય વેતન } \times \text{બચાવેલ સમય}}{\text{આપેલ સમય}} \right) = \\ \left(\frac{2400 \times ૨૫}{૧૫૦} \right) = ₹ ૪૧૬.૫૭, \text{કુલ વેતન} = \text{મજૂરી} + \text{બોનસ} = ₹ 2,400/- + ₹ ૪૧૬.૫૭ = ₹ ૨,૮૧૬.૫૭.)$$

૫. રમણીકલાલને એક કાર્ય પુરું કરવા પ્રમાણા સમય ૩૨ કલાક ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ કાર્ય ૪૮ કલાકમાં જ પુરું કરી દીધું. કલાકદીઠ સમય વેતન ₹ ૧૦/- નક્કી કરવામાં આવ્યું હતું. (૧) હેલ્સી યોજના તથા (૨) રોવેન યોજના મુજબ વેતનની ગણાતરી કરો.

(જવાબ: (૧) હેલ્સી યોજના મુજબ કુલ વેતન ₹ ૫૦૦/- (વેતન = લીધેલ સમય × વેતનદર = ૪૮ × ૧૦
= ₹ ૪૮૦/-, બોનસ = ૫૦% × બચાવેલ સમયનું વેતન = \frac{૫૦}{૧૦૦} \times ૨૪ કલાક \times ₹ ૧૦/-
= ₹ ૧૨૦/-, કુલ વેતન = વેતન + બોનસ = ₹ ૪૮૦/- + ₹ ૧૨૦/- = ₹ ૬૦૦/-;)

(૨) રોવેન યોજના મુજબ કુલ વેતન ₹ ૬૪૦/- (વેતન = લીધેલ સમય × વેતનદર = ૪૮ કલાક
× ₹ ૧૦/- = ₹ ૪૮૦/-, બોનસ = \left(\frac{\text{સમય વેતન } \times \text{બચાવેલ સમય}}{\text{આપેલ સમય}} \right) = \left(\frac{૪૮૦ \times ૨૪}{૭૨} \right) = ₹ ૧૬૦/-, કુલ વેતન = વેતન + બોનસ = ₹ ૪૮૦/- + ₹ ૧૬૦/- = ₹ ૬૪૦/-.)

૬. એક કામદારને કાર્ય પુરું કરવા માટે ૩૦ કલાક આપવામાં આવે છે, પરંતુ તે કાર્ય ૨૧ કલાકમાં પુરું કરે છે. તેને કલાકના ₹ ૭૫/- વેતન ચૂકવવામાં આવે છે.

વેતન શોધો: (૧) સમય વેતન પદ્ધતિ મુજબ, (૨) કાર્ય વેતન પદ્ધતિ મુજબ, (૩) હેલ્સી યોજના મુજબ અને (૪) રોવેન યોજના મુજબ.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, નવેમ્બર ૨૦૧૮)

(જવાબ: (૧) સમય વેતનપ્રથા મુજબ વેતન ₹ ૧,૫૭૫/- (વેતન = લીધેલ સમય × વેતનદર = ૨૧
કલાક \times ₹ ૭૫/- = ₹ ૧,૫૭૫/-);

(૨) કાર્ય વેતનપ્રથા મુજબ વેતન ₹ ૨,૨૫૦/- (વેતન = ફાળવેલ સમય × વેતનદર = ૩૦
કલાક \times ₹ ૭૫/- = ₹ ૨,૨૫૦/-);

(૩) હેલ્સી વેતનપ્રથા મુજબ વેતન ₹ ૧,૬૧૨.૫૦ (વેતન = ખરેખર સમય × વેતનદર = ૨૧
કલાક \times ₹ ૭૫/- = ₹ ૧,૫૭૫/-, બોનસ = ૫૦% × બચાવેલ સમયનું વેતન = \frac{૫૦}{૧૦૦} \times
૯ કલાક \times ₹ ૭૫/- = ₹ ૩૩૭.૫૦, કુલ વેતન = મજૂરી + બોનસ = ₹ ૧,૫૭૫/- + ₹ ૩૩૭.૫૦ = ₹ ૧,૯૧૨.૫૦);

(૪) રોવેન વેતનપ્રથા મુજબ મજૂરી ₹, ૦૪૭.૫૦ (વેતન = લીધેલ સમય × વેતનદર = ૨૧
કલાક \times ₹ ૭૫/- = ₹ ૧,૫૭૫/-, બોનસ = \left(\frac{\text{સમય વેતન } \times \text{બચાવેલ સમય}}{\text{આપેલ સમય}} \right) =

$$\left(\frac{1,075}{30} \times 6 \right) = ₹ 472.50, \text{ कुल वेतन} = \text{वेतन} + \text{बोनस} = ₹ 1,075/- + ₹ 472.50 = ₹ 2,047.50.)$$

7. બોગીલાલ એક જોબ (કાર્ય) ૧૫૨ કલાકમાં પુરું કરે છે. કલાકદીઠ વેતન ₹ ૧૦/- છે. જો તેમને રોવેન યોજનામુજબ ₹ ૧,૬૪૪/- વેતન મળ્યું હોય તો હેલ્સી યોજના મુજબ શું વેતન મળે?

(જવાબ: બોગીલાલને હેલ્સી યોજના મુજબ વેતન ₹ ૧,૮૨૨.૫૦ મળશે.

$$\begin{aligned} \text{રોવેન યોજના મુજબ વેતન} &= \text{લીધેલ સમય} \times \text{વેતનદર} = ૧૫૨ \times ૧૦ = ₹ ૧,૫૨૦/-, \text{ બોનસ} = \\ \text{કુલ વેતન} - \text{વેતન} &= ₹ ૧,૬૪૪/- - ₹ ૧,૫૨૦/- = ₹ ૩૨૪/-, \text{ બચાવેલ સમયની ગણતરી} \\ (\text{બોનસની ગણતરીના સૂત્ર પરથી}) \quad \text{બોનસ} &= \frac{\text{વેતન} \times \text{બચાવેલ સમય}}{\text{કુલ સમય}} = ૩૨૪ = \\ \frac{૧૫૨૦ \times \text{બચાવેલ સમય}}{૧૫૨} &= (૩૨૪ = ૧૦ \times \text{બચાવેલ સમય}) = \dots \therefore \text{બચાવેલ સમય} = \frac{૩૨૪}{૧૦} \\ = \frac{૩૨૪}{૧૦} &= ૩૨.૪ \text{ બચાવેલ સમય (કલાકમાં)}; \end{aligned}$$

$$\begin{aligned} \text{હેલ્સી યોજના મુજબ કુલ વેતન} &= \text{અરેખર સમય વેતન} + ૫૦\% (\text{બચાવેલ સમયનું વેતન}) = \\ (૧૫૨ \text{ કલાક} \times ₹ ૧૦/-) + \frac{૫૦}{૧૦૦} \times ૩૨.૪ \text{ કલાક} \times ₹ ૧૦/- &= ₹ ૧,૫૨૦/- + ₹ ૧૬૨/- = \\ ₹ ૧,૭૮૨/-.) & \end{aligned}$$

8. મિ. શ્રેયસ એક કામ પૂર્ણ કરવા રૂપ કલાક લે છે. કલાકદીઠ મજૂરી ₹ ૩૦/- છે. જો તે રોવેન યોજના મુજબ કુલ મજૂરી ₹ ૧,૦૦૦/- મેળવતો હોય તો હેલ્સી યોજના, કાર્ય વેતનપ્રથા અને સમય વેતનપ્રથા મુજબ કેટલી મજૂરી મળશે?

(જવાબ: મિ. શ્રેયસને હેલ્સી યોજના મુજબ ₹ ૮૩૭.૫૦ મજૂરી મળશે, કાર્ય વેતનપ્રથા મુજબ ₹ ૧,૧૨૫/- મજૂરી મળશે અને સમય વેતનપ્રથા મુજબ ₹ ૭૫૦/- મજૂરી મળશે.

$$\begin{aligned} (1) \quad \text{રોવેન યોજના મજૂરી} &= \text{લીધેલ સમય} \times \text{વેતનદર} = ૨૫ \times ૩૦ = ₹ ૭૫૦/-, \text{ બોનસ} \\ &= \text{કુલ વેતન} - \text{વેતન} = ₹ ૧,૦૦૦/- - ₹ ૭૫૦/- = ₹ ૨૫૦/-, \text{ બોનસની ગણતરીના} \\ \text{સૂત્ર પરથી બચાવેલ સમય નીચે મુજબ શોધાશે.} \quad \text{બોનસ} &= \frac{\text{મજૂરી} \times \text{બચાવેલ સમય}}{\text{કુલ સમય}} = \\ ૨૫૦ &= \frac{૭૫૦ \times \text{બચાવેલ સમય}}{૨૫} = (૨૫૦ = ૩૦ \times \text{બચાવેલ સમય}) = \\ \therefore \text{બચાવેલ સમય} &= \frac{૨૫૦}{૩૦} = \frac{૨૫૦}{૩૦} = ૮.૩૩ \text{ બચાવેલ સમય (કલાકમાં)}; \end{aligned}$$

$$\begin{aligned} (2) \quad \text{હેલ્સી યોજના મુજબ કુલ વેતન} &= \text{અરેખર સમય વેતન} + ૫૦\% (\text{બચાવેલ સમયનું વેતન}) \\ &= (૨૫ કલાક \times ₹ ૩૦/-) + \frac{૫૦}{૧૦૦} \times ૮.૩૩ \text{ કલાક} \times ₹ ૩૦/- = ₹ ૭૫૦/- + \\ ₹ ૧૨૪.૮૫/- &= ₹ ૮૭૪.૮૫; \end{aligned}$$

(3) કાર્ય વેતન = ફાળવેલ સમય \times વેતનદર (ફાળવેલ સમય = લીધેલ સમય + બચાવેલ સમય
= ૨૫ + ૮.૩૩ = ૩૩.૩૩) = ૩૩.૩૩ કલાક \times ₹ ૩૦/- = ₹ ૯૯૯.૬૦;

(૪) સમય વેતન = લીધેલ સમય \times વેતનદર = ૨૫ કલાક \times ₹ ૩૦/- = ₹ ૭૫૦/-.)

e. શ્રી અશોક જોબવક્ પુરું કરવા ૪૦ કલાકનો સમય લે છે. કલાકદીઠ વેતનદર ₹ ૧૫/- છે. રોવેન યોજના મુજબ વેતન ₹ ૯૦૦/- છે તો હેલ્સી યોજના મુજબ વેતન શોધો.

(જવાબ: હેલ્સી યોજના મુજબ કુલ વેતન ₹ ૯૦૦/- (ખરેખર વેતન = ₹ ૫૦૦/- અને બોનસ = ₹ ૩૦૦/-, બચાવેલ સમય ૧૫ કલાક.)

૧૦. અરથિએ એક કામ ૧૦૮ કલાકમાં પુરું કર્યું. કલાકદીઠ વેતનદર ₹ ૫૦/- છે. જો તેને રોવેન યોજના મુજબ ₹ ૫,૪૮૦/- વેતન મળ્યું હોય તો હેલ્સી યોજના મુજબ કેટલું વેતન મળશે?

(જવાબ: હેલ્સી યોજના મુજબ કુલ વેતન ₹ ૫,૦૭૫/-, બચાવેલ સમય ૨૭ કલાક), આપેલ સમય ૧૩૫ કલાક (લીધેલ સમય ૧૦૮ કલાક + બચાવેલ સમય ૨૭ કલાક.)

★ ★ ★

પ્રકારણ: ૩
પરોક્ષ ખર્ચાઓ / શિરોપરી ખર્ચાઓ

- ૧ પ્રસ્તાવના
 - ૨ શિરોપરી ખર્ચનું વર્ગીકરણ / શિરોપરી ખર્ચનાં પ્રકાર
 - ૩ શિરોપરી ખર્ચનું વિભાગીકરણ / ખાતાકીયકરણ
 - ૪ શિરોપરી ખર્ચની વહેંચણી અને ફાળવણી
 - ૫ વહેંચણી અને ફાળવણી વચ્ચે તફાવત
 - ૬ શિરોપરી ખર્ચની વસૂલાત
 - ૭ શિરોપરી ખર્ચ વસૂલાતની પદ્ધતિઓ
 - ૮ સેવા વિભાગના ખર્ચની પુનઃફાળવણી
- ઉદાહરણો**
- ૧ સ્વાધ્યાય

૧ પ્રસ્તાવનાઃ


દરેક પ્રકારનાં ઉત્પાદન પડતરમાં મુખ્ય બે પ્રકારનાં ખર્ચ હોય છે, (૧) પ્રત્યક્ષ પડતર (ખર્ચી) અને (૨) પરોક્ષ (શિરોપરી પડતર ખર્ચી). જે ખર્ચની વહેંચણી પડતરના એકમાં સરળતાથી કરી શકાય તેને પ્રત્યક્ષ ખર્ચ કહેવાય છે, જેમકે, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ માલસામાન, સીધા ખર્ચ જેને પ્રાથમિક પડતર પણ કહેવામાં આવે છે. જ્યારે જે ખર્ચની વહેંચણી પડતરના એકમાં સરળતાથી કરી શકાતી નથી તેને પરોક્ષ ખર્ચ કહેવાય છે. આવા દરેક પ્રકારના ખર્ચ (જેવાં કે, પરોક્ષ માલસામાન, પરોક્ષ મજૂરી વગેરે)ના સરવાળાને પરોક્ષ ખર્ચ (શિરોપરી ખર્ચ) તરીકે ઓળખવામાં આવે છે. પરોક્ષ ખર્ચ કે જેમાં પડતર હિસાબનીશ (Cost Accountant) સામાન્ય રીતે ખર્ચની વહેંચણી પડતરના એકમ સાથે કરી શકતો નથી તેથી તેને પડતરના એકમ અથવા પડતરના કેન્દ્ર સાથે ફાળવવામાં આવે છે.

સામાન્ય શબ્દોમાં કહીએ તો શિરોપરી ખર્ચ એટલે દરેક પ્રકારના પરોક્ષ ખર્ચ જેમાં પરોક્ષ માલસામાન, પરોક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચનો સમાવેશ થાય છે.

CIMA, U. K.ના જાળાવ્યા પ્રમાણે, પરોક્ષ માલસામાન, પરોક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચનો સરવાળો એટલે શિરોપરી ખર્ચી.

Wheldonના ભત મુજબ, “શિરોપરી ખર્ચ એટલે પરોક્ષ માલસામાન, પરોક્ષ મજૂરી અને અન્ય ખર્ચ જેમાં સેવાઓના ખર્ચનો પણ સમાવેશ થાય છે. જેની સીધી રીતે પડતરના એકમ સાથે વહેંચણી કરી શકાતી નથી.”

બીજા શબ્દોમાં કહીએ તો, “શિરોપરી ખર્ચ એટલે પ્રત્યક્ષ ખર્ચ સિવાયના ખર્ચી.”



ઉપરોક્ત આકૃતિ પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે પરોક્ષ માલસામાન, પરોક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચનો સરવાળો એટલે શિરોપરી ખર્ચી.

૨ શિરોપરી ખર્ચનું વર્ગીકરણ / શિરોપરી ખર્ચનાં પ્રકાર (Classification of Overhead Cost):

શિરોપરી ખર્ચને મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજુત કરવામાં આવે છે.

(અ) કાર્યાનુસાર શિરોપરી ખર્ચનું વર્ગીકરણ

- (૧) ઉત્પાદન શિરોપરી ખર્ચાઓ
- (૨) ઓફિસનાં શિરોપરી ખર્ચાઓ/વહીવટી શિરોપરી ખર્ચા
- (૩) વેચાણનાં શિરોપરી ખર્ચાઓ
- (૪) વિતરણનાં શિરોપરી ખર્ચાઓ

(બ) પડતરણનાં તરફે અનુસાર શિરોપરી ખર્ચાનું વર્ગીકરણ

- (૧) પરોક્ષ માલસામાન
- (૨) પરોક્ષ મજૂરી
- (૩) અન્ય પરોક્ષ ખર્ચા

(ક) વર્તણૂક / ગુણ પ્રમાણે શિરોપરી ખર્ચાનું વર્ગીકરણ

- (૧) સ્થિર ખર્ચા
- (૨) ચલિત ખર્ચા
- (૩) અર્ધચલિત ખર્ચા

ઉપરોક્ત વર્ગીકરણની વિગતવાર સમજ મેળવીએ.

૨.૧ કાર્યાનુસાર શિરોપરી ખર્ચાનું વર્ગીકરણ (Functional Classification of Overhead Costs):

કાર્યાનુસાર શિરોપરી ખર્ચાનું મુખ્યત્વે નીચે મુજબ ચાર ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે.

- (૧) ઉત્પાદન / કારખાના શિરોપરી ખર્ચા
- (૨) ઓફિસ શિરોપરી ખર્ચા
- (૩) વેચાણનાં શિરોપરી ખર્ચાઓ
- (૪) વિતરણનાં શિરોપરી ખર્ચાઓ

૨.૧.૧ ઉત્પાદન / કારખાના શિરોપરી ખર્ચા:

આ પ્રકારનાં પરોક્ષ ખર્ચાઓ ઉત્પાદનના કાર્ય સાથે સંકળાયેલા છે. કારખાનાને લગતા પરોક્ષ માલસામાન, પરોક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચાનો સમાવેશ આ પ્રકારનાં ખર્ચાઓમાં કરવામાં આવે છે. પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરીથી વિતરીત કારખાના શિરોપરી ખર્ચા એ તૈયાર માલની સાથે સીધી રીતે જોડાયેલા નથી અને સીધી રીતે ગણતરી પણ કરી શકાતી નથી. કારખાના શિરોપરી ખર્ચાઓમાં પરોક્ષ મજૂરી, પરોક્ષ માલસામાન, કારખાના યંત્રોનો ધસારો અને વિમા પ્રિમીયમ, કારખાનાનાં મકાનનો ધસારો અને વિમા પ્રિમીયમ, કારખાના વીજળી ખર્ચ, યંત્રોનો મરામત અને સમારકામ ખર્ચ, યંત્રોમાં વપરાયેલ ગેસ, ટ્યુલ્બ્રિકન્ટ્સ (lubricants) વગેરેનો સમાવેશ થાય છે.

૨.૧.૨ ઓફિસનાં શિરોપરી ખર્ચા / વહીવટી શિરોપરી ખર્ચા (Office / Administration Overhead Costs):

ધંધાના સંચાલકીય કાર્ય જેવા કે, આયોજન, અંકુશ, વહીવટી (જેમાં નાણાંકીય અને હિસાબી અંકુશનો પણ સમાવેશ થાય છે) કાર્ય માટે થયેલ ખર્ચાઓનો સમાવેશ થાય છે. જે સીધી રીતે ઉત્પાદન, વેચાણ અને વિતરણના કાર્ય સાથે સંકળાયેલ નથી. ઓફિસના અથવા વહીવટના શિરોપરી ખર્ચના ઉદાહરણ નીચે મુજબ છે.

ઓડિટ ફી, કાનૂની ખર્ચ, તાર અને ટપાલ, સ્ટેશનરી અને છપામણી, ટેલિફોન ખર્ચ, ઓફિસનું ભાડું અને વેરા, ઓફિસનો વીજળી ખર્ચ, કારકુનનો પગાર, બેંક બ્યાજ અને બેંક ખર્ચ, ઓફિસનાં પરચૂરણ ખર્ચ, ઓફિસ સ્ટાફનો પગાર, મેનેજરનો પગાર વગેરે.

૨.૧.૩ વેચાણનાં શિરોપરી ખર્ચ (Selling Overhead Costs):

આ પ્રકારનાં ખર્ચ વસ્તુની માંગમાં વધારો કરવા માટે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વેચાણ વૃદ્ધ માટે કરવામાં આવતી જાહેરાત પાછળ થતો ખર્ચ. વેચાણ શિરોપરી ખર્ચમાં જાહેરાત ખર્ચ, સેલ્સમેનનું કબિશન અને પગાર, શોરૂમનો ખર્ચ, મુસાફરી ખર્ચ, ઘાલખાધ, ભાવપત્રક અને કેટલોગનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

૨.૧.૪ વિતરણ શિરોપરી ખર્ચ (Distribution Overhead Costs):

કારખાનામાં માલ તૈયાર થઈ ગયા બાદ ગ્રાહક સુધી માલ પહોંચે તે દરમ્યાન જે પણ ખર્ચ કરવામાં આવે છે તેને વિતરણનાં ખર્ચ કહે છે. જેમાં પેર્કિંગ ખર્ચ, ડિલિવરી વાનનો ઘસારો, જાવકમાલ ગાડાભાડું, ગોદામ ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.

૨.૨ પડતરણાં તરફો અનુસાર શિરોપરી ખર્ચાઓનું વર્ગીકરણ (Elementwise Classification of Overhead Costs):

આ પદ્ધતિ પ્રમાણે શિરોપરી ખર્ચનું વર્ગીકરણ તેના રૂપદર્શન અને સ્ત્રોતના આધારે કરવામાં આવે છે. આ પદ્ધતિ તાકિક રીતે શિરોપરી ખર્ચની વ્યાખ્યા બનાવે છે. આ પદ્ધતિ મુજબ શિરોપરી ખર્ચ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

૨.૨.૧ પરોક્ષ માલસામાન (Indirect Material):

પરોક્ષ માલસામાનની વહેંચણી સીધી રીતે પડતરણા એકમ અથવા પડતરણા કેન્દ્ર સાથે કરી શકાતી નથી પરંતુ તેની ફાળવણી અથવા તેની વસ્તુલાત પડતરણા એકમ અથવા પડતરણા કેન્દ્રથી કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો એવો માલસામાન જે સીધી રીતે ઉત્પાદિત વસ્તુનો ભાગ બનતો નથી પરંતુ ઉત્પાદનમાં મદદ કરે છે. જેમાં કોટન વેસ્ટ, બળતણા, સામાન્ય વપરાશનાં સાધનો, પેક્ચિંગ માલસામાન વગેરે મુખ્ય છે.

૨.૨.૨ પરોક્ષ મજૂરી (Indirect Labour):

પરોક્ષ મજૂરીની વહેંચણી સીધી રીતે પડતરણા એકમ અથવા પડતરણા કેન્દ્ર સાથે કરી શકાતી નથી, પરંતુ તેની ફાળવણી અથવા તેની વસ્તુલાત પડતરણા એકમ અથવા પડતરણા કેન્દ્રથી કરવામાં આવે છે. જેમાં સ્વીપરનો પગાર, મેનેજરનો પગાર, અનઉંટપાદક સમયની મજૂરી, માલિકનો ESIમાં ફાળો, પ્રોવિન્ટ ફંડમાં ફાળો, વોયાજેનનો પગાર, સેલસમેનનો પગાર અને કબિશન વગેરે મુખ્ય છે.

૨.૨.૩ પરોક્ષ ખર્ચ (Indirect Expenses):

પરોક્ષ ખર્ચની વહેંચણી સીધી રીતે પડતરણા એકમ અથવા પડતરણા કેન્દ્ર સાથે કરી શકાતી નથી, પરંતુ તેની ફાળવણી અથવા તેની વસ્તુલાત પડતરણા એકમ અથવા પડતરણા કેન્દ્રથી કરવામાં આવે છે. જેમાં ભાડું અને વેરા, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, ઘસારો, વીમો, તાર-ટપાલ, સ્ટેશનરી અને છપામણી, વીજળી ખર્ચ, ટેલિફોન ખર્ચ, તાતીમ ખર્ચ વગેરે મુખ્ય છે.

૨.૩ વર્તણૂક / ગુણ પ્રમાણે શિરોપરી ખર્ચનું વર્ગીકરણ (Behaviourwise Classification of Overhead Costs):

જેમ ઉત્પાદન બદલાય છે તેમ જુદાં-જુદાં શિરોપરી ખર્ચની વર્તણૂક બદલાય છે. આથી ઉત્પાદનમાં થતા બદલાવની અસર શિરોપરી ખર્ચ પર થાય છે. જેનું વર્ગીકરણ નીચે મુજબ છે.

૨.૩.૧ સ્થિર ખર્ચ (Fixed Overhead Costs):

આ પ્રકારના શિરોપરી ખર્ચ ઉત્પાદનના વધારા સાથે વધતા નથી પરંતુ કુલ ખર્ચમાં એકસરખા જ રહે છે તેથી તેને સ્થિર અથવા સ્થાયી ખર્ચ પણ કહેવામાં આવે છે. દા. ત.: ભાડું અને વેરા, મેનેજરનો પગાર, મકાનનો ઘસારો, વોચમેનનો પગાર, કાનૂની ખર્ચ, ઓડિટ ફી વગેરે.

૨.૩.૨ ચલિત ખર્ચ (Variable Overhead Costs):

આ પ્રકારના શિરોપરી ખર્ચમાં ઉત્પાદનના વધારા સાથે કુલ ખર્ચમાં સીધો વધારો થાય છે પરંતુ એકમદીઠ સરખા રહે છે તેને ચલિત ખર્ચ કહે છે. દા. ત.: પરોક્ષ માલસામાન, પરોક્ષ મજૂરી, સેટ્સમેનનું કબિશન અને બથથાં, ટ્યુબિકન્ટ્સ, ફ્લ્યુઅલ, વીજળી વગેરે.

૨.૩.૩ અર્ધચલિત ખર્ચ (Semi-Variabile Overhead Costs):

આ પ્રકારનાં ખર્ચનો અમુક ભાગ સ્થિર અને બાકીનો ભાગ ચલિત છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ ખર્ચનો અમુક હિસ્સો ઉત્પાદનના વધારા સાથે વધે છે અને બાકીનો હિસ્સો સ્થિર રહે છે તેથી તેને અર્ધચલિત ખર્ચ કહેવાય છે. દા. ત.: સુપરવાઈઝરનો પગાર, મરામત ખર્ચ, યંત્રોનો ઘસારો, ટેલિફોન બીલ, વીજળી ખર્ચ વગેરે.

૩ શિરોપરી ખર્ચનું વિભાગીકરણ / ખાતાકીયકરણ (Departmentalisation of Overhead Cost):

શિરોપરી ખર્ચની વહેંચણી અને ફાળવણી થાય તે દિશાનું પ્રથમ પગલું એટલે વિભાગીકરણ (ખાતાકીયકરણ - Departmentalisation). વિભાગીકરણ એટલે પેઢી કે કંપનીમાં વિભાગો (ખાતાં) બનાવવાં જેથી શિરોપરી ખર્ચની સરળતાથી વહેંચણી અથવા ફાળવણી થઈ શકે. કાર્યક્ષમ કાર્ય કરવા માટે અને શિરોપરી ખર્ચની વહેંચણી, ફાળવણી અને પુનઃફાળવણીની પ્રક્રિયા માટે પેઢી/કંપનીને જુદાં-જુદાં વિભાગોમાં જેવા કે, મશીનીંગ, કર્મચારી, જાળવણી, એકાઉન્ટ્સ, સ્ટોર વગરેમાં વિભાજીત કરવામાં આવે છે અને ત્યાર બાદ શિરોપરી ખર્ચને આ વિભાગો (ખાતાઓ) વરચે વહેંચવામાં, ફાળવવામાં અથવા પુનઃફાળવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને વિભાગીકરણ કહેવાય છે. જે દરેક વિભાગની (ખાતાની) પડતર શોધવામાં અને તેના પર અંકુશ મેળવવામાં મદદરૂપ થાય છે.

૪ શિરોપરી ખર્ચની વહેંચણી અને ફાળવણી (Allocation & Apportionment of Overhead Cost):

૪.૧ શિરોપરી ખર્ચની વહેંચણી (Allocation of Overhead Cost):

CIMA, U. K.ના જણાવ્યા પ્રમાણે, “ખર્ચની વહેંચણી એટલે અલગ ઓળખી શકાય તેવી વસ્તુઓની પડતરની પડતરના કેન્દ્ર અથવા પડતરના એકમાં વિતરણ.”

સરળ શબ્દોમાં કહીએ તો, શિરોપરી ખર્ચનું કોઈ વિભાગ અથવા કોઈ પેદાશામાં પુરેપુરું વિતરણ તાર્કિક અને સમાન ધોરણે કરવું જેને શિરોપરી ખર્ચની વહેંચણી કહેવાચ છે. જ્યાં પડતરના કેન્દ્ર અથવા પડતરના એકમભાંથી ખર્ચ શોધી શકાય ત્યારે તે ખર્ચને પડતરના એકમ અથવા પડતરના કેન્દ્રમાં વહેંચવામાં આવે છે. બીજા શબ્દોમાં સમજુએ તો, શિરોપરી ખર્ચની વહેંચણી એ એવી પ્રક્રિયા છે જેમાં પડતરના કેન્દ્ર અથવા પડતરના એકમભાં ખર્ચની વહેંચણી સીધી જ કરવામાં આવે છે. દા. ત.: દરેક વિભાગમાં જો વીજળીના અલગ મીટર મુક્યા હોય તો વીજળી ખર્ચની વિભાગમાં સીધી જ વહેંચણી કરી શકાય. સ્ટોર વિભાગના કારકુનના પગારના ખર્ચની વહેંચણી કરી શકાય, ચંત્રનો ઘસારો સીધો જ વિવિધ વિભાગોનાં ચંત્રો પ્રમાણે વહેંચણી કરી શકાય.

શિરોપરી ખર્ચની વહેંચણી એટલે કોઈપણ પ્રકારના વિભાજન વિના ખર્ચની જે-તે પડતરના કેન્દ્રો અથવા પડતરના એકમોમાં વહેંચણી.

૪.૨ શિરોપરી ખર્ચાઓની ફાળવણી (Apportionment of Overhead Costs):

ખર્ચની ફાળવણી એટલે પડતરના કેન્દ્રમાં ખર્ચની પ્રમાણાસર વહેંચણી જ્યારે શક્ય હોય ત્યારે ખર્ચની વહેંચણી કરવી. પરંતુ, જ્યારે ખર્ચની વહેંચણી પડતરના કેન્દ્ર અથવા પડતરના એકમભાં કરવી શક્ય ન હોય ત્યારે ખર્ચને વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય આધારે ફાળવણી કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શિરોપરી ખર્ચની ફાળવણી કહેવાચ છે.

જ્યારે કોઈ ખર્ચ પડતરના જુદાં-જુદાં કેન્દ્રો માટે હોય ત્યારે તેવા ખર્ચની વિવિધ પડતરના કેન્દ્રો વચ્ચે તાર્કિક અને અગાઉથી નક્કી કરેલા યોગ્ય આધારના પ્રમાણે ખર્ચની ફાળવણી કરવામાં આવે છે.

સરળ શબ્દોમાં સમજુએ તો, કોઈ ખર્ચ એક કરતાં વધુ વિભાગો માટે કરવામાં આવ્યો હોય તેવા ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. દા.ત.: કારખાનાના મકાનનું ભાડું એ વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય આધાર મુજબ કરવામાં આવશે જેમકે વિભાગોએ રોકેલ જગ્યાના પ્રમાણામાં ફાળવવામાં આવશે.

જનરલ મેનેજરનો પગાર કોઈ એક વિભાગને લાગુ પડતો નથી તેથી જુદાં-જુદાં વિભાગોમાં ચોક્કસ આધાર મુજબ તેની ફાળવણી કરવામાં આવશે.

૪.૨.૧ પરોક્ષ ખર્ચની વિભાગવાર / ખાતાવાર ફાળવણી (Apportionment of Overhead Cost to Different Departments):

ક્રમ	ખર્ચ	ફાળવણીનો આધાર
૧.	મકાનનું ભાડું અને વેરા	રોકેલ જગ્યાના પ્રમાણામાં
૨.	કેન્ટીન ખર્ચ	કામદારોની સંખ્યાના પ્રમાણામાં
૩.	વીમો	મિલકતની કિંમતના પ્રમાણામાં
૪.	ઘસારો	મિલકતના કિંમતના પ્રમાણામાં
૫.	વીજળી ખર્ચ	વીજળીના પોઇન્ટ્સની સંખ્યાના પ્રમાણામાં / રોકેલ જગ્યાના પ્રમાણામાં
૬.	ઇલેક્ટ્રીક પાવર	ચંત્રના હોર્સપાવર (ચંત્રની શક્તિ)ના પ્રમાણામાં / ચંત્રિક કલાકના પ્રમાણામાં / ચંત્રની કિંમતના પ્રમાણામાં
૭.	પરોક્ષ મજૂરી	દરેક વિભાગ / ખાતાની પ્રત્યક્ષ મજૂરી

ક્રમ	ખર્ચ	ફાળવણીનો આધાર
૮.	ટેકનીકલ કિએક્ટરની ફી, મેનેજરનો પગાર	વિભાગને આપેલ સમયના પ્રમાણાં
૯.	સ્ટોર શિરોપરી ખર્ચ	માલસામાન માંગણીપત્રની સંખ્યા અથવા ઈસ્યુ કરેલ માલસામાનની કિંમત
૧૦.	કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI)	પ્રત્યક્ષ ભજૂરી
૧૧.	સામાન્ય શિરોપરી ખર્ચ	પ્રત્યક્ષ ભજૂરી
૧૨.	સુપરવીઝન ખર્ચ	કર્મચારીઓની સંખ્યાના પ્રમાણાં

આમ, ઉપરોક્ત જણાવેલ માહિતીને આધારે શિરોપરી ખર્ચની ફાળવણી ઉત્પાદન અને સેવા વિભાગો વચ્ચે કરવામાં આવે છે અને ત્યારબાદ સેવા વિભાગના શિરોપરી ખર્ચની પુનઃફાળવણી ઉત્પાદન વિભાગ અને સેવા વિભાગમાં કરવામાં આવે છે. દા. ત.: ઉત્પાદન કરતા એકમો X, Y અને Z છે. જ્યારે સેવા પુરી પાડતા એકમો A અને B છે. સંપૂર્ણ શિરોપરી ખર્ચની ફાળવણી બાદ સેવા વિભાગ A અને Bના શિરોપરી ખર્ચની પુનઃફાળવણી ઉત્પાદન એકમો X, Y અને Z વચ્ચે થશે.

૫ વહેંચણી અને ફાળવણી વચ્ચે તફાવત (Distinction Between Allocation and Apportionment of Overhead Cost):

શિરોપરી ખર્ચની વહેંચણી અને ફાળવણી બંનેનો હેતુ એકસમાન છે તેમ છતાં ખર્ચની પડતરના કેન્દ્ર અથવા પડતરના એકમોમાં વહેંચણી અને ફાળવણી સમાન નથી.

વહેંચણી એ કોઈ વસ્તુના કુલ ખર્ચ સાથે સંબંધિત છે અને ફાળવણી એ વસ્તુના પ્રમાણસર ખર્ચ સાથે સંબંધ ધરાવે છે.

વહેંચણી એ શિરોપરી ખર્ચની વિભાગીકરણની સીધી પ્રક્રિયા છે, જ્યારે ફાળવણી યોગ્ય આધાર મુજબ શિરોપરી ખર્ચની પેટા-વિભાગમાં યોગ્ય આધાર મુજબ કરવામાં આવે છે.

કોઈ શિરોપરી ખર્ચની વહેંચણી થશે કે ફાળવણી એ ખર્ચના સ્વરૂપ પર આધારિત નથી પણ જે પડતરના કેન્દ્રમાં અથવા પડતરના એકમોમાં વિતરણ કરવાનું હોય તેના સંબંધ પર આધારિત છે.

૬ શિરોપરી ખર્ચની વસૂલાત (Absorption (Recovery) of Overhead Cost):

જ્યારે શિરોપરી ખર્ચની ઉત્પાદન વિભાગમાં વહેંચણી, ફાળવણી અને પુનઃફાળવણી પૂર્ણ થાય ત્યારબાદ ઉત્પાદન વિભાગના શિરોપરી ખર્ચમાં મુખ્યત્વે તે વિભાગના ખર્ચ જેવાં કે, પરોક્ષ માલસામાન, પરોક્ષ ભજૂરી વગેરે તથા કેટલાક સમાન ખર્ચ જેમકે કારખાનાના મકાનનું ભાડું, વીજળી વગેરે અને સેવા વિભાગમાં પુનઃફાળવણી કરેલ ખર્ચી.

પરોક્ષ ખર્ચની વહેંચણી જો એક જ પેદાશ (product) માટે હોય તો ખૂબ જ સરળ બને છે પણ અહીં મહત્વનું એ છે કે અંદાજીત શિરોપરી ખર્ચને અંદાજીત ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે છે, જેનાથી દરેક ઉત્પાદન વિભાગ (Production Department)ના કુલ શિરોપરી ખર્ચ મળશે. આવા ઉત્પાદન વિભાગના કુલ શિરોપરી ખર્ચ ઉત્પાદિત પેદાશ સામે વસૂલવામાં આવે છે જેને શિરોપરી ખર્ચની વસૂલાત કહેવાય છે.

શિરોપરી ખર્ચની વસૂલાત એટલે ઉત્પાદન વિભાગમાં ઉત્પાદિત એકમોમાં ઉત્પાદન વિભાગના શિરોપરી ખર્ચનું વિતરણ.

આમ, શિરોપરી ખર્ચની વસૂલાત બે તબક્કામાં કરવામાં આવે છે.

- (૧) શિરોપરી ખર્ચના વસૂલાતનો દર શોધવો
- (૨) પડતરના એકમમાં શિરોપરી ખર્ચનો દર વહેંચવો

૫.૧ શિરોપરી ખર્ચના વસૂલાતનો દર શોધવો:

વસૂલાતનો દર શોધવાનો મુખ્ય હેતુ પડતરના એકમની પડતરમાં શિરોપરી ખર્ચની વસૂલાતનો છે. વસૂલાતનો દર શોધવાની મુખ્ય છ (૫) પદ્ધતિઓ છે. વિસ્તૃત માહિતી આ પ્રકારણમાં આગળ આપેલી છે. આ દરેક પદ્ધતિમાં શિરોપરી ખર્ચનો દર શોધવા માટે વિભાગ (ખાતાં)ના કુલ શિરોપરી ખર્ચને કુલ ઉત્પાદનના એકમો, યાંત્રિક કલાકો, મજૂરીના કલાકો (કુલ એકમોનો આધાર કહેવાય છે) વગેરે વડે ભાગવામાં આવે છે જે નીચે મુજબ છે.

$$\text{શિરોપરી ખર્ચના વસૂલાતનો દર} = \frac{\text{પડતરના કેન્દ્રનો કુલ શિરોપરી ખર્ચ}}{\text{કુલ એકમોનો આધાર}}$$

૫.૨ પડતરના એકમોમાં શિરોપરી ખર્ચનો દર વહેંચવો:

દરેક પડતરના એકમની પડતર શોધવા માટે શિરોપરી ખર્ચના દરને કુલ એકમોના આધાર સાથે ગુણવામાં આવે છે.

$$\text{શિરોપરી ખર્ચની વસૂલાત} = \text{શિરોપરી ખર્ચનો દર} \times \text{કુલ એકમોનો આધાર}$$

દા. ત.: યાંત્રિક કલાક દર ₹ ૫/- છે અને પડતરના એકમ માટે કુલ ૧૦ કલાક વપરાશ થયેલ છે.
પડતરના એકમમાં શિરોપરી ખર્ચની વસૂલાત = ૧૦ કલાક × ₹ ૫/- = ₹ ૫૦/-.

આમ, શિરોપરી ખર્ચની વસૂલાત કોઈ નક્કી કરેલ દર મુજબ થાય છે. આવો દર નીચે દરશાવેલ પ્રકારનો હોઈ શકે.

૫.૨.૧ ખરેખર વસૂલાતનો દર (Actual Rate):

ખરેખર વસૂલાતનો દર શોધવા માટે ખરેખર થયેલ શિરોપરી ખર્ચને ખરેખર આધાર વડે ભાગવાથી જાણી શકાય છે.

$$\text{ખરેખર વસૂલાતનો દર (Actual Rate)} = \frac{\text{ખરેખર થયેલ શિરોપરી ખર્ચ}}{\text{ખરેખર આધાર}}$$

દા. ત.: ઓક્ટોબર ૨૦૧૮માં કુલ શિરોપરી ખર્ચ ₹ ૫૦,૦૦૦/- થયેલ હોય અને ૧૦,૦૦૦ એકમોનું ઉત્પાદન થયેલ હોય તો ખરેખર વસૂલાતનો દર ₹ ૫/- ગણાશે.

$$\text{ખરેખર વસૂલાતનો દર} = \frac{50000}{10000} = ₹ ૫/-$$

આ પ્રકારના વસૂલાતના દરની કેટલીક ખામીઓના કારણે દર વખતે આ રીતે દર શોધી શકાય નહીં.

ક.૨.૨ પૂર્વનિર્ધારીત વસૂલાતનો દર (Pre-determined Rate):

જે સમયગાળા દરમાન આ દરનો ઉપયોગ થવાનો હોય તેના પહેલાં વસૂલાતનો દર શોધવામાં આવે છે. આમ, પૂર્વનિર્ધારીત વસૂલાતનો દર શોધવા માટે વર્ષ દરમાનના અંદાજુત શિરોપરી ખર્ચને વર્ષ માટેના અંદાજુત આધાર વડે ભાગવામાં આવે છે.

$$\text{પૂર્વ નિર્ધારીત વસૂલાતનો દર} = \frac{\text{વર્ષ માટેના અંદાજુત શિરોપરી ખર્ચ}}{\text{વર્ષ માટેના અંદાજુત આધાર}}$$

દા. ત.: એક કારખાનામાં વર્ષ ૨૦૧૮ માટે કારખાનાના અંદાજુત શિરોપરી ખર્ચ ₹ ૫૦,૦૦૦/- નક્કી થયો અને અંદાજુત ચાંત્રિક કલાકો ૧૦,૦૦૦ નક્કી થયા. ડિસેમ્બર ૨૦૧૮ના માસ દરમાન ૩૦૦૦ એકમોનું ઉત્પાદન થયું હોય તો શિરોપરી ખર્ચની વસૂલાત નીચે મુજબ થશે.

$$\begin{aligned}\text{પૂર્વ નિર્ધારીત વસૂલાતનો દર} &= \frac{\text{અંદાજુત શિરોપરી ખર્ચ}}{\text{અંદાજુત ચાંત્રિક કલાકો}} \\ &= \frac{50000}{10000} = ₹ ૫/-\end{aligned}$$

ડિસેમ્બર ૨૦૧૮ના માસ દરમાન શિરોપરી ખર્ચની વસૂલાત = ૩,૦૦૦ એકમો × ₹ ૫/- = ₹ ૧૫,૦૦૦/-.

ખરેખર વસૂલાતના દરની સરખામણીમાં પૂર્વ નિર્ધારીત વસૂલાતના દરની પદ્ધતિ વધારે ઉપયોગી છે, કારણ કે પૂર્વ નિર્ધારીત વસૂલાતના દરની પદ્ધતિના આધારે ત્વરિત અંદાજુત પડતર પત્રક, વેચાણ કિંમત નિર્ધારણ કરી શકાય છે. ખરેખર શિરોપરી ખર્ચ અને પૂર્વ નિર્ધારીત વસૂલાતના દરની સરખામણી કરી ખર્ચ ઘટાડો પણ અમલમાં મૂકી શકાય છે.

ક.૨.૩ સમાન વસૂલાતનો દર (Blanket Rate / Single Rate):

સમાન વસૂલાતનો દર આખા કારખાના માટે નક્કી કરવામાં આવે છે જે નીચે મુજબ છે.

$$\text{સમાન વસૂલાતનો દર} = \frac{\text{કારખાનાનો શિરોપરી ખર્ચ}}{\text{ખરેખર ઉત્પાદિત થબેલ કુલ એકમોનો આધાર}}$$

જ્યારે ઉત્પાદન સમાન હોય ત્યારે જ સમાન વસૂલાતના દરનો ઉપયોગ કરવો જોઈએ, નહિ તો સમાન વસૂલાતના દરનું પરિણામ અધિક (વધુ) એકમણીઠ પડતર અથવા ઓછી એકમણીઠ પડતર હશે. તદૃઅપરાંત જ્યારે સમાન વસૂલાતના દરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કોઈ એક વિભાગ (ખાતા) અથવા પડતરના કેન્દ્રણી કાર્યક્ષમતા તપાસી શકાતી નથી અને અંકુશ રાખવો પણ કપરો બને છે.

ક.૨.૪ જુદાં-જુદાં વસૂલાતનાં દર / વિભાગીય દર (Multiple Rate / Departmental Rate):

વિભાગીય / ખાતાવાર વસૂલાતનો દર એટલે દરેક પડતરના કેન્દ્ર અથવા વિભાગનો અલગ વસૂલાતનો દર.

દા. ત.: દરેક ઉત્પાદન વિભાગોનાં, દરેક પ્રકારની પેદાશોનાં સ્થિર અને ચલિત શિરોપરી ખર્ચ શોધવામાં આવે.

$$\text{વિભાગીય વસૂલાતનો દર} = \frac{\text{પડતરના એકમના શિરોપરી ખર્ચ}}{\text{વિભાગ પ્રમાણે આધાર}}$$

વિભાગીય વસૂલાતનો દર એ સમાન વસૂલાતના દર કરતા વધારે ઉપયોગિતા ધરાવે છે અને હંમેશા ચોક્સાઈ અને અંકુશ માટે વધુ ઉપયોગી છે.

૭ શિરોપરી ખર્ચ વસૂલાતની પદ્ધતિઓ:

ઉત્પાદન અથવા કારખાના શિરોપરી ખર્ચ વસૂલાતની પદ્ધતિઓ નીચે મુજબ છે.

- (૧) પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર અભુક ટકા (Percentage on Direct Material Cost)
- (૨) પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર અભુક ટકા (Percentage on Direct Labour / Wages)
- (૩) પ્રાથમિક પડતર પર અભુક ટકા (Percentage on Prime Cost)
- (૪) પ્રત્યક્ષ કામદાર કલાક દર (Direct Labour Hour Rate)
- (૫) ચાંત્રિક કલાક દર (Machine Hour Rate)
- (૬) ઉત્પાદન એકમદીઠ દર (Rate per Unit of Production)

(૧) પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર અભુક ટકા (Percentage on Direct Material Cost):

આ પદ્ધતિ પ્રમાણે પેદાશ (Product)નું ઉત્પાદન કરવામાં વપરાયેલ કુલ પ્રત્યક્ષ માલસામાન મુજબ શિરોપરી ખર્ચની વસૂલાત થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન શિરોપરી ખર્ચની વસૂલાત ઉત્પાદનમાં કે વપરાશમાં લેવામાં આવતા પ્રત્યક્ષ માલસામાનના ખર્ચના કારખાના (ઉત્પાદન) ખર્ચની ટકાવારી મુજબ થાય છે. કુલ પડતરમાં માલસામાનનું પ્રમાણ વધુ હોય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

$$\text{શિરોપરી ખર્ચનો દર} = \frac{\text{ઉત્પાદન/કારખાના શિરોપરી ખર્ચ (અંદાજુત)}}{\text{અંદાજુત પ્રત્યક્ષ માલસામાન ખર્ચ}} \times 100$$

દા. ત.: કોઈ એક કારખાનામાં અંદાજુત પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 4,00,000/- છે અને અંદાજુત કારખાના / ઉત્પાદન શિરોપરી ખર્ચ ₹ 2,00,000/- છે, તો શિરોપરી ખર્ચનો દર 40% થશે.

$$\text{શિરોપરી ખર્ચનો દર} = \frac{200000}{400000} \times 100 = 40\%$$

આ પદ્ધતિ નીચેના સંજોગોમાં અપનાવી શકાય.

- ૧) જ્યાં કુલ ખર્ચમાં શિરોપરી ખર્ચનું પ્રમાણ નોંધપાત્ર હોય
- ૨) જ્યાં માલસામગ્રીનો ભાવ સ્થિર હોય
- ૩) જ્યાં ઉત્પાદન સમાન હોય અને ફક્ત એક જ પ્રકારની પેદાશનું ઉત્પાદન કરવામાં આવતું હોય

→ ફાયદા:

- (૧) આ પદ્ધતિ પ્રમાણે શિરોપરી ખર્ચનો દર શોધવો સરળ છે.

(૨) જ્યાં ઉત્પાદન સમાન હોય અને માલસામગીનો ભાવ સ્થિર હોય ત્યાં આ પદ્ધતિ પ્રમાણે પરિણામ ચોકસાઈવાળું મળે છે.

→ ગેરકાયદા:

- (૧) માલસામાનના ભાવો જલ્દી બદલાતા હોય છે તેથી સ્થિર ભાવોના આધારે કરેલ અનુમાન ખોટું પડે છે.
- (૨) આ પદ્ધતિ તાર્કિક નથી, કારણ કે માલસામાન ખર્ચ અને શિરોપરી ખર્ચ વર્ચે કોઈ સંબંધ નથી.
- (૩) આ પદ્ધતિ સમયના પરિબળને દ્યાનમાં લેતી નથી.

(૨) પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર અભુક ટકા (Percentage on Direct Labour / Wages):

આ પદ્ધતિ ખૂબ જ સાદી અને સરળ છે અને મોટાભાગના દંડામાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. શિરોપરી ખર્ચનો દર નીચે મુજબ શોધવામાં આવે છે. કુલ પડતરમાં મજૂરીનું પ્રમાણ વધારે હોય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

$$\text{શિરોપરી ખર્ચનો દર} = \frac{\text{ઉત્પાદન/કારખાના શિરોપરી ખર્ચ (અંદાજુત)}}{\text{પ્રત્યક્ષ મજૂરી (અંદાજુત)}} \times 100$$

દા. ત.: એક એકમનો કારખાના (ઉત્પાદન) શિરોપરી ખર્ચ (અંદાજુત) ₹ ૨,૦૦,૦૦૦/- છે અને પ્રત્યક્ષ મજૂરી (અંદાજુત) ₹ ૪,૦૦,૦૦૦/- છે, તો શિરોપરી ખર્ચનો દર ૫૦% થશે.

$$\text{શિરોપરી ખર્ચનો દર} = \frac{200000}{400000} \times 100 = 50\%$$

કોઈ એક વસ્તુનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ ₹ ૫૦૦/- હોય તો કારખાના શિરોપરી ખર્ચની વસૂલાત ₹ ૨૫૦/- (પ્રત્યક્ષ મજૂરી ખર્ચ ₹ ૫૦૦/-ના ૫૦%).

→ કાયદા:

- (૧) માલસામાનના ભાવોની જેમ મજૂરીનો દર જલ્દી બદલાતો નથી તેથી આ પદ્ધતિ સ્થિર પરિણામ આપે છે.
- (૨) આ પદ્ધતિ સરળ છે અને તેના ઉપયોગમાં જે પણ માહિતી જોઈએ તે સરળતાથી મળી શકે છે.
- (૩) જ્યાં કામદારોને ચૂકવાતી મજૂરીનો દર સમાન છે, જ્યાં કામદારોની કાર્યક્ષમતા સમાન છે, જ્યાં કામદારો એકસરણું કામ કરે છે ત્યાં આ પદ્ધતિનો લાભ અસરકારક રીતે મેળવી શકાય છે.

→ ગેરકાયદા:

- (૧) જ્યાં કામદારો ઉત્પાદનનું મુખ્ય સાધન નથી ત્યાં આ પદ્ધતિ વધુ ઉપયોગી નથી.
- (૨) કામદારોને જ્યારે વસ્તુના ઉત્પાદનના આધારે મહેનતાણું ચૂકવાતું હોય ત્યારે આ પદ્ધતિ સંતોષકારક પરિણામ આપતી નથી, કારણ કે સમયના પરિબળને દ્યાનમાં લેવામાં આવતું નથી.

(3) આ પદ્ધતિ કુશળ અને બિનકુશળ કામદારો દ્વારા કરવામાં આવેલ કામમાં તફાવત દર્શાવતી નથી. બિનકુશળ કામદારો કાર્ય કરવામાં વધારે સમય લે છે.

(4) ચંત્ર અને કામદારો દ્વારા કરવામાં આવેલા કાર્યમાં કોઈ બિનાતા આ પદ્ધતિ પ્રમાણે દર્શાવવામાં આવતી નથી.

આ પદ્ધતિનો ઉપયોગ નીચેના સંજોગોમાં અપનાવી શકાય.

- 1) જ્યાં ઉત્પાદન સમાન હોય
- 2) જ્યાં કુલ ઉત્પાદન ખર્ચનો મોટો હિસ્સો પ્રત્યક્ષ ભજૂરી હોય
- 3) જ્યાં કુશળ અને બિનકુશળ કામદારોનું પ્રમાણ સતત હોય
- 4) જ્યાં કામદાર પગાર દરમાં કોઈ બિનાતા ન હોય.

(3) પ્રાથમિક પડતર પર અમુક ટકા (Percentage on Prime Cost):

એવી દલીલ કરવામાં આવે છે કે પ્રત્યક્ષ ભાલસામાન અને પ્રત્યક્ષ ભજૂરી બંનેને કારણે ઉત્પાદન શિરોપરી ખર્ચ વધે છે. તેઓની ગણતરી કોઈ પેદાશાન કારખાના / ઉત્પાદન ખર્ચની ગણતરી વખતે કરવી જોઈએ તેથી આ પદ્ધતિમાં પ્રત્યક્ષ ભાલસામાન અને પ્રત્યક્ષ ભજૂરી બંને દ્વારા ઉત્પાદન શિરોપરી ખર્ચની વસૂલાત કરવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ શિરોપરી ખર્ચની ગણતરી નીચે મુજબ છે. કુલ પડતરમાં ભાલસામાન અને ભજૂરીનું વર્ચસ્વ હોય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

$$\text{શિરોપરી ખર્ચનો દર} = \frac{\text{ઉત્પાદન/કારખાના શિરોપરી ખર્ચ (અંદાજુત)}}{\text{પ્રાથમિક પડતર}} \times 100 \\ (\text{પ્રત્યક્ષ ભજૂરી} + \text{પ્રત્યક્ષ ભાલસામાન})$$

દા. ત.: કારખાના ખર્ચ (અંદાજુત) ₹ 2,00,000/-

પ્રત્યક્ષ ભાલસામાન ₹ 1,25,000/-

પ્રત્યક્ષ ભજૂરી ₹ 75,000/-

$$\text{શિરોપરી ખર્ચનો દર} = \frac{200000}{125000 + 75000} \times 100 = 100\%$$

આ પદ્ધતિ ખૂબ જ સરળ અને સહેલી રીતે ગણતરી કરી શકાય તેવી છે પરંતુ આ પદ્ધતિમાં પ્રત્યક્ષ ભાલસામાન ખર્ચ અને પ્રત્યક્ષ ભજૂરી ખર્ચ પદ્ધતિનાં ગેરકાયદા જોવા મળે છે.

(4) પ્રત્યક્ષ કામદાર કલાક દર (Direct Labour Hour Rate):

કામદાર કલાક દર એટલે પ્રત્યક્ષ કામદારો કેટલા કલાકમાં કામ પૂર્ણ કરે છે તેના આધારે પરોક્ષ ખર્ચનો કલાકદીઠ દર શોધવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે શિરોપરી ખર્ચના દરની ગણતરી નીચે મુજબ છે. ઉત્પાદનમાં કામદારો કલાકનું પ્રમાણ વધુ હોય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

$$\text{શિરોપરી ખર્ચનો દર} = \frac{\text{ઉત્પાદન/કારખાના શિરોપરી ખર્ચ}}{\text{પ્રત્યક્ષ કામદારોના કામનાં કલાકો}}$$

દા. ત.: કારખાના શિરોપરી ખર્ચ ₹ 1,00,000/-

પ્રત્યક્ષ કામદારના કામના કલાકો ₹ 1,00,000/-

$$\text{શિરોપરી ખર્ચનો દર} = \frac{100000}{100000} = ₹ 1/-$$

→ કાયદા:

- (૧) સમયના પરિબળને દ્યાનમાં લેવામાં આવે છે.
- (૨) જ્યાં કામદારો ઉત્પાદનનું મુખ્ય સાધન હોય ત્યાં સૌથી વધુ અનુકૂળ છે.
- (૩) આ પદ્ધતિ પ્રમાણે શિરોપરી ખર્ચના દરને મજૂરી ચૂકવણીની પદ્ધતિ અસર કરતી નથી, જેવી કે, કાર્ય વેતન પ્રથા અને સમય વેતન પ્રથા.

→ ગેરકાયદા:

- (૧) કામદારોનો વધારાનો રેકોર્ડ રાખવો પડે છે જેથી ખર્ચમાં વધારો થાય છે. દા. ત.: આ કાર્ય સંભાળતા કાર્યકુનો પગાર.
- (૨) ઉત્પાદનનાં અન્ય સાધનો મૂડી, નિયોજક, જમીનને દ્યાનમાં લેવામાં આવતી નથી.

આ પદ્ધતિનો ઉપયોગ નીચેની પરિસ્થિતિમાં અનુકૂળ છે.

- ૧) જ્યાં ભોટાભાગનું કાર્ય કામદારો દ્વારા જ થતું હોય
- ૨) જ્યાં ઉત્પાદન સમાન ન હોય
- ૩) જ્યાં વેતન ચૂકવણીની પદ્ધતિ જુદી-જુદી હોય.

(૫) યાંત્રિક કલાક દર (Machine Hour Rate):

યાંત્રિક કલાક દર એટલે એક કલાક યંત્રના ઉપયોગથી થતો ખર્ચ. કામદાર કલાક દર અને યાંત્રિક કલાક દર પદ્ધતિમાં સામ્યતા છે. બંને પદ્ધતિ સમયના પરિબળને દ્યાનમાં લે છે. બંને પદ્ધતિમાંથી પસંદગી કરવી એ પરિસ્થિતિ પર આધાર રાખે છે. જ્યાં ઉત્પાદનમાં વધુમાં વધુ યંત્રનો ઉપયોગ થતો હોય ત્યાં યાંત્રિક કલાક દરની પદ્ધતિ વધુ અનુકૂળ છે. આવું સામાન્ય રીતે જ્યાં પુરેપુરુ યાંત્રિકિકરણ હોય અને તેમાં પેદાશની (Product) ગુણવત્તા અને જણ્ઠો નિયમિત ઉત્પાદિત થતો હોય ત્યાં યાંત્રિક કલાક દરની પદ્ધતિથી દરેકના ઉત્પાદન શિરોપરી ખર્ચની યોગ્ય વહેંચણી પર આધાર રાખે છે. યાંત્રિક કલાક દર શોધવા માટે યંત્ર અથવા યંત્રોના સમૂહ પાછળ થયેલ શિરોપરી ખર્ચને યંત્ર અથવા યંત્રના સમૂહના વપરાશના કલાકો વડે ભાગવામાં આવે છે.

$$\text{યાંત્રિક કલાક દર} = \frac{\text{કુલ શિરોપરી ખર્ચ}}{\text{યંત્રના કામકાજનાં કલાકો}}$$

દા.ત.: કારખાનામાં શિરોપરી ખર્ચ ₹ 10,000/- છે અને યંત્ર વપરાશ / કામકાજનાં કલાકો 2,000 છે.

$$\text{યાંત્રિક કલાક દર} = \frac{10000}{2000} = ₹ 5/- \text{ પ્રતી કલાક}$$

માટે જો યંત્ર કોઈ વસ્તુના ઉત્પાદનમાં 100 કલાક ઉપયોગમાં લેવાયું હોય તો 100 કલાક × 5/- = ₹ 500/- એ વસ્તુ પાછળ શિરોપરી ખર્ચ થયો ગણાય.

યાંત્રિક કલાક દરની ગણતરી માટે નીચે મુજબ પગલાં લેવાં જોઈએ.

- ૧) દરેક ચંત્ર અથવા ચંત્રોના સમૂહને પડતરણું કેન્દ્ર ગણાવું.
- ૨) દરેક ચંત્ર અથવા ચંત્રોના સમૂહ માટે કોઈ ચોક્કસ સમયગાળાનો અંદાજુત શિરોપરી ખર્ચ નક્કી કરવો.
- ૩) ચંત્રને લગતા શિરોપરી ખર્ચને બે ભાગમાં વિભાજુત કરવા જેમકે, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ.
- ૪) દરેક ચંત્ર માટેના ચોક્કસ સમયગાળા દરમયાનના કુલ સ્થિર ખર્ચને સામાન્ય ચાંત્રિક કલાકો વડે વિભાજુત કરવામાં આવે છે, જેનાથી સ્થિર ખર્ચનો પ્રતિ કલાકનો દર મળે છે. દરેક ચલિત ખર્ચને સામાન્ય ચાંત્રિક કલાકો વડે વિભાજુત કરવામાં આવે છે જેથી દરેક ચલિત ખર્ચનો ચાંત્રિક કલાક દર મળે છે.
- ૫) સ્થિર ખર્ચનો પ્રતિ ચાંત્રિક કલાક દર અને ચલિત ખર્ચનો પ્રતિ ચાંત્રિક કલાક દરનો સરવાળો કરવાથી ચાંત્રિક કલાક દર મળશે.

ચાંત્રિક કલાક દરની ગણાતરી માટે કેટલાંક ખર્ચની ફાળવણી કરવા જુદાં-જુદાં આધાર આપવામાં આવેલાં છે, જે નીચે મુજબ છે.

(૧) ભાડું અને વેરા	ચંત્રએ રોકેલી જગ્યાના પ્રમાણમાં
(૨) વીજળી ખર્ચ	ચંત્ર માટે વિશિષ્ટ વીજળી (લાઇટિંગ) અને હીટીંગનો ખર્ચ ઉપરાંત લાઇટ પોઇન્ટની સંખ્યા / ચંત્રએ રોકેલ જગ્યાના પ્રમાણમાં
(૩) સુપરવીઝન (નિરીક્ષણ)	સુપરવાઇઝર ફ્લારા પ્રત્યેક ચંત્રને આપવામાં આવેલ સમયના પ્રમાણમાં
(૪) ભરામત ખર્ચ	ચંત્રની કિંમતના આધારે / ચંત્રના કલાકો
(૫) વીભો	ચંત્રની કિંમત
(૬) ઘસારો	ચંત્રની કિંમત / ચાંત્રિક કલાકો
(૭) બળતણ અને સ્ટોર્સ	ચંત્રની કિંમત / ચાંત્રિક કલાકો વપરાશ

→ ઘસારાની નોંધ:

ઘસારો એ અર્ધચલિત ખર્ચ છે. ઘણાં નિષ્ણાંતો ઘસારાને સ્થિર ખર્ચ ગણે છે, પરંતુ ઘસારો એ સ્થિર ખર્ચ છે કે ચલિત ખર્ચ એ કઈ પદ્ધતિ મુજબ ઘસારાની ગણાતરી કરી છે તેના પર આધાર રાખે છે. આ પ્રકરણમાં ઘસારો ચલિત ખર્ચ તરીકે ગણેલ છે.

→ ચાંત્રિક કલાક દરના પત્રકનો નમૂનો:

ચાંત્રિક કલાક દર દર્શાવતું પત્રક

વિગત	વાર્ષિક કુલ ખર્ચ (₹)	કલાકદીન (₹)
(અ) સ્થિર ખર્ચાં:		
(૧) ભાડું	000	
(૨) કારાખાનાની વીજળી	000	

(૩) સુપરવાઇઝરનો પગાર	000	
(૪) વીમા પ્રિમિયમ	000	
(૫) પરોક્ષ માલસામગ્રી	000	
કુલ સ્થિર ખર્ચ (અ)	<u>000</u>	000
(બ) ચલિત ખર્ચ:		
(૧) ઘસારો		000
(૨) ભરામત અને નિભાવ ખર્ચ		000
(૩) પાવર		000
(૪) ડિક્ઝલ વગેરે		000
યાંત્રિક કલાક દર		<u>000</u>
		000

→ ફાયદા:

- (૧) કારખાના શિરોપરી ખર્ચની વસ્તુલાટની આ પદ્ધતિ ચોગ્ય અને વૈજ્ઞાનિક છે.
- (૨) આ પદ્ધતિ સમયના પરિબળને ધ્યાનમાં લે છે જેથી વધારે ચોક્સાઈવાળું પરિણામ મળે છે.
- (૩) જ્યાં યંત્રની મદદથી ઉત્પાદન થતું હોય ત્યાં આ પદ્ધતિ ઉત્તમ છે.
- (૪) સ્થિર અને ચલિત ખર્ચની અલગથી ગાળતરી કરાતી હોવાથી નિષ્ક્રિય યંત્ર સરળતાથી શોધી શકાય છે.

→ બેચ્કાયદા:

- (૧) જ્યાં ફક્ત યંત્રની મદદથી કાર્ય થતું હોય ત્યાં જ યાંત્રિક કલાક દરની પદ્ધતિ ઉપયોગી નિવકે છે.
- (૨) અગાઉથી યાંત્રિક કલાકો નક્કી કરવા મુશ્કેલ છે.
- (૩) આ પદ્ધતિને કારણે ખર્ચમાં વધારો થાય છે કારણ કે અલગથી હિસાબોનો રેકૉર્ડ રાખવો પડે છે.

(૬) ઉત્પાદન એકમદીઠ દર (Rate per Unit of Production):

આ પદ્ધતિ ખૂલ્ય જ રીધી અને સરળ છે. ખાણ ઉધોગ, દંડિ બજાવવાના ઉધોગ, નિષ્કર્ષ ઉધોગ વગેરે પ્રકારનાં ઉધોગ જ્યાં ઉત્પાદનનાં એકમોને અનુકૂળ ભૌતિક એકમો જેવા કે સંખ્યા, વજન, જથ્થો વગેરેમાં માપવામાં આવે છે ત્યાં આ પદ્ધતિ ચોગ્ય છે. ઉત્પાદન એકમદીઠ દર નીચે મુજબ શોધવામાં આવે છે.

$$\text{ઉત્પાદન એકમદીઠ દર} = \frac{\text{શિરોપરી ખર્ચ (અંદાજુત)}}{\text{ઉત્પાદન (અંદાજુત)}}$$

ડા. ત.: શિરોપરી ખર્ચ (અંદાજુત) ₹ 40,000/-

ઉત્પાદન (અંદાજુત) ₹ 20,000/-

$$\text{ઉત્પાદન એકમદીઠ દર} = \frac{80000}{20000} = ₹ 2/- \text{ પ્રતિ કિલોગ્રામ}$$

આ પદ્ધતિની મુખ્ય મર્યાદા એ છે કે તે ફક્ત એક જ વસ્તુનું ઉત્પાદન અથવા સમાન ગુણા ધરાવતું ઉત્પાદન જેમકે, ગુણવત્તા, માપ વગેરે પ્રકારના જ ઉધોગમાં ઉપયોગી છે.

✓ **સેવા વિભાગના ખર્ચની પુનઃફાળવણી (Re-apportionment of Service Department Cost):**

શિરોપરી ખર્ચની વહેંચણી અને ફાળવણી ઉત્પાદન અને સેવા વિભાગમાં પૂર્ણ થયા બાદ તેનો સરવાળો કરી સેવા વિભાગનો ખર્ચ પુનઃ ઉત્પાદન વિભાગમાં ફાળવવામાં આવે છે. આમ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે ઉત્પાદન સેવા વિભાગ દ્વારા કરવામાં આવતું નથી તેથી ઉત્પાદિત એકમની સાચી પડતર શોધવા સેવા વિભાગના ખર્ચને ઉત્પાદન વિભાગમાં ફાળવવામાં આવે છે.


દા. ત.:: એક કારખાનામાં ત્રણ ઉત્પાદન કરતા વિભાગ A, B અને C છે. જ્યારે બે સેવા પૂરી પાડતા વિભાગ પાવર હાઉસ અને કેન્ટીન છે. શિરોપરી ખર્ચની વહેંચણી અને ફાળવણી આ પાંચ વિભાગો (ત્રણ ઉત્પાદન વિભાગો અને બે સેવા વિભાગો)માં પૂર્ણ થયા બાદ સેવા વિભાગના ખર્ચને પુનઃ ઉત્પાદન વિભાગમાં ફાળવવામાં આવે છે એટલે કે પાવર હાઉસ અને કેન્ટીન વિભાગના કુલ ખર્ચની ઉત્પાદન A, B અને C વિભાગોમાં યોગ્ય આધાર પ્રમાણે પુનઃફાળવણી કરવામાં આવશે.

અહીં ઉત્પાદન વિભાગ એટલે જે વિભાગમાં પેદાશનું કે સેવાનું ઉત્પાદન થતું હોય એટલે કે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થતું હોય તેવા વિભાગ. જ્યારે સેવા વિભાગ એટલે જે પોતે ઉત્પાદન કરતા નથી પરંતુ ઉત્પાદનની પ્રક્રિયામાં સહાય કરે છે જેમકે કેન્ટીન વિભાગ, સ્ટોર્ઝમ, પાવર હાઉસ વગેરે.

સેવા વિભાગના ખર્ચની પુનઃફાળવણી ઉત્પાદન વિભાગમાં નીચે મુજબ થશે.

ક્રમ	સેવા વિભાગ	ફાળવણીનો આધાર
(૧)	ખરીદ વિભાગ	- ખરીદીના ઓર્ડરની સંખ્યા - ખરીદિલ માલની કિંમત
(૨)	સમય નોંધણી વિભાગ	- કર્મચારીઓની સંખ્યા - ચૂકવેલ મહેનતાનું
(૩)	માલસામાન સંગ્રહ વિભાગ	- માલસામાનના માંગણાપત્રની સંખ્યા - ઇસ્થિ કરેલ માલસામાનની કિંમત
(૪)	કેન્ટીન વિભાગ	- કર્મચારીઓની સંખ્યા - ચૂકવેલ મજૂરી
(૫)	હિસાબી વિભાગ	- કર્મચારીઓની સંખ્યા
(૬)	મરામત અને નિભાવ વિભાગ	- કરેલ કામના કલાકો પ્રમાણે
(૭)	પાવર હાઉસ	- ચંત્રના હોર્સ પાવર - વપરાશના આધારે (મીટર રીડિંગ) - દાનકૂટ વિસ્તાર

સેવા વિભાગના શિરોપરી ખર્ચની ફાળવણી કરવા માટે જુદી-જુદી પદ્ધતિઓ અમલમાં છે. જે નીચે મુજબ છે.



નોંધ: સરદાર પેટેલ ચુનિવર્સિટીના અભ્યાસકમાં ફક્ત પુનરાવર્ત્તી ફાળવણી પદ્ધતિ અને યાંત્રિક કલાક દર પદ્ધતિના જ દાખલા છે જેની વિધાર્થીઓએ નોંધ લેવી.

૮.૧ ફક્ત ઉત્પાદન વિભાગને ફાળવણીની પદ્ધતિ:

જ્યારે સેવા વિભાગના શિરોપરી ખર્ચને ફક્ત ઉત્પાદન વિભાગમાં જ ફાળવવામાં આવતો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

૮.૧.૧ પ્રત્યક્ષ ફાળવણી પદ્ધતિ (Direct Distribution Method):

સેવા વિભાગના શિરોપરી ખર્ચ સીધા જ ઉત્પાદન વિભાગને ફાળવી દેવામાં આવે છે અને એક સેવા વિભાગના ખર્ચ બીજા સેવા વિભાગમાં ફાળવવામાં આવતા નથી.

જ્યારે એક સેવા વિભાગનો લાભ બીજા સેવા વિભાગ ન મેળવતાં હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

ઉદાહરણા: ૧ એક કારખાનામાં ત્રણ ઉત્પાદન વિભાગ X, Y અને Z તથા બે સેવા વિભાગ કેન્ટીન અને પાવર હાઉસ છે. દરેક વિભાગને ફાળવેલ કુલ ખર્ચની માહિતી નીચે મુજબ છે.

ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
X (₹)	Y (₹)	Z (₹)	કેન્ટીન (₹)	પાવર હાઉસ (₹)
૨૯,૦૦૦	૧૦,૦૦૦	૧૧,૦૦૦	૬,૦૦૦	૪,૦૦૦

અન્ય માહિતી નીચે મુજબ છે.

વિગત	X	Y	Z
કામદારોની સંખ્યા	૨૫	૧૫	૨૦
યંત્રોનો હોર્સ પાવર	૧૫	૧૩	૧૨

નંને સેવા વિભાગનો ખર્ચ ઉત્પાદન વિભાગ ખાતે પ્રત્યક્ષ ફાળવણીની પદ્ધતિએ ગણતરી કરો.

જવાબ:

સેવા વિભાગના ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક

વિગત	ફાળવણીનો આધાર	કુલ (₹)	ઉત્પાદન વિભાગો		
			X (₹)	Y (₹)	Z (₹)
ફાળવેલ ખર્ચ	---	૫૦,૦૦૦	૨૯,૦૦૦	૧૦,૦૦૦	૧૧,૦૦૦
કેન્ટીન વિભાગ	કામદારોની સંખ્યા (૫:૩:૪)	૬,૦૦૦	૨,૫૦૦	૧,૫૦૦	૨,૦૦૦
પાવર હાઉસ	યંત્રોનો હોર્સ પાવર (૧૫:૧૩:૧૨)	૪,૦૦૦	૧,૫૦૦	૧,૩૦૦	૧,૨૦૦
	કુલ	૫૦,૦૦૦	૩૩,૦૦૦	૧૨,૮૦૦	૧૪,૨૦૦

ઉપરોક્ત ગણતરી પરથી ખ્યાલ આવશે કે સેવા વિભાગના ખર્ચની ફાળવણી સીધી જ ઉત્પાદન વિભાગમાં કરવામાં આવે છે.

૮.૨ ઉત્પાદન વિભાગ અને સેવા વિભાગ બંનેને ફાળવણીની પદ્ધતિ:

ઘણીવાર એક સેવા વિભાગ તેની સેવા ફક્ત ઉત્પાદન વિભાગને જ નહીં પરંતુ બીજા સેવા વિભાગને પણ આપે છે. દા. ત.: પાવર હાઉસ વિભાગ તેની સેવા ઉત્પાદન વિભાગ ઉપરાંત કેન્ટીન વિભાગ, નિભાવ અને ભરામત વિભાગ વગેરેને આપે છે તેવી જ રીતે નિભાવ અને ભરામત વિભાગ તેની સેવા ઉત્પાદન વિભાગ તથા પાવર હાઉસ વિભાગ વગેરેને આપે છે. સેવા વિભાગના આ પ્રકારના પરસ્પર આંતરિક શિરોપરી ખર્ચની ફાળવણી બિન-પારસ્પરિક પદ્ધતિ અથવા પારસ્પરિક પદ્ધતિને આધારે થાય છે.

૮.૨.૧ બિન-પારસ્પરિક પદ્ધતિ (Non-Reciprocal Method):

બિન-પારસ્પરિક પદ્ધતિ પ્રમાણે સેવા વિભાગ તેની સેવા બીજા સેવા વિભાગને આપે છે, પરંતુ તે સેવા વિભાગ પાસેથી તેની સેવા મેળવતો નથી એટલે કે સેવા વિભાગ એકબીજા પર આધાર રાખતા નથી.

દા. ત.: પાવર હાઉસ તેની સેવા કેન્ટીન વિભાગને આપે છે પણ કેન્ટીન વિભાગ તેની સેવા પાવર હાઉસ વિભાગને આપતો નથી.

.૮.૨.૧.૧ કમિક ફાળવણી પદ્ધતિ (Step Ladder Method):

કમિક ફાળવણીની પદ્ધતિ એ બિન-પારસ્પરિક પદ્ધતિનો એક પ્રકાર છે. જ્યારે એક સેવા વિભાગ તેની સેવા બીજા સેવા વિભાગને પૂરી પાડે છે પરંતુ બીજો સેવા વિભાગ તેના સેવા પર આધાર રાખતો નથી ત્યારે આ પદ્ધતિ પ્રમાણે નીચે મુજબ ફાળવણી થશે.

જો બે સેવા વિભાગ હોય ત્યારે જે સેવા વિભાગ તેની સેવા બીજા સેવા વિભાગને આપે છે તેની ફાળવણી પ્રથમ કરવામાં આવે છે. ત્યારબાદ બીજા સેવા વિભાગના પોતાના શિરોપરી ખર્ચ તથા સેવા વિભાગમાંથી મળેલ ભાગનો સરવાળો થશે અને તે ઉત્પાદન વિભાગો વચ્ચે ફળાવવામાં આવશે.

દા. ત.: ‘અ’ અને ‘બ’ એમ બે સેવા વિભાગ છે. ‘અ’ તેની સેવા ‘બ’ વિભાગને અને અન્ય ઉત્પાદન વિભાગોને આપે છે. જ્યારે ‘બ’ વિભાગ તેની સેવા ફક્ત ઉત્પાદન વિભાગને જ આપે છે. આવા સંજોગોમાં પહેલાં ‘અ’ વિભાગના શિરોપરી ખર્ચની ફાળવણી ઉત્પાદન વિભાગ અને ‘બ’ સેવા વિભાગમાં થશે અને ત્યારબાદ જ ‘બ’ વિભાગના શિરોપરી ખર્ચ અને ‘અ’ વિભાગમાંથી મળેલ ભાગની ફાળવણી ઉત્પાદન વિભાગ ખાતે થશે.

ઉદાહરણ: ૨ એક કારખાનામાં બે ઉત્પાદન વિભાગ ‘ક’ અને ‘ખ’ તથા બે સેવા વિભાગ ‘અ’ અને ‘બ’ છે. ‘અ’ વિભાગ તેની સેવા ઉત્પાદન વિભાગો અને ‘બ’ વિભાગને ૨:૨:૧ના પ્રમાણમાં પૂરી પાડે છે. ‘બ’ વિભાગ તેની સેવા ઉત્પાદન વિભાગોને ૩:૨ના પ્રમાણમાં પૂરી પાડે છે. દરેક વિભાગને ફાળવેલ રકમ નીચે મુજબ છે.

ઉત્પાદન વિભાગ		સેવા વિભાગ	
ક (₹)	ખ (₹)	અ (₹)	બ (₹)
૨૦,૦૦૦	૩૦,૦૦૦	૧૦,૦૦૦	૧૮,૦૦૦

જવાબ:

સેવા વિભાગના ખર્ચની કમિક પદ્ધતિએ ફાળવણી દર્શાવતું પત્રક

વિગત	ફાળવણીનો આધાર	કુલ (₹)	ઉત્પાદન વિભાગો		સેવા વિભાગ	
			ક (₹)	ખ (₹)	અ (₹)	બ (₹)
ફાળવેલ ખર્ચ ‘અ’ સેવા વિભાગ ‘બ’ સેવા વિભાગ	આપેલ સેવા (૨:૨:૧) આપેલ સેવા (૩:૨)	૭૮,૦૦૦	૨૦,૦૦૦	૩૦,૦૦૦	૧૦,૦૦૦	૧૮,૦૦૦
			૪,૦૦૦	૪,૦૦૦	(-૧૦,૦૦૦)	૨,૦૦૦
			૧૨,૦૦૦	૮,૦૦૦	---	(-૨૦,૦૦૦)
	કુલ	૭૮,૦૦૦	૩૬,૦૦૦	૪૨,૦૦૦	---	---

૮.૨.૨ પારસ્પરિક પદ્ધતિ (Reciprocal Method):

પારસ્પરિક પદ્ધતિ એટલે સેવા વિભાગ પરસ્પર એકબીજાની પર આધાર રાખે છે, એટલે કે એક સેવા વિભાગ તેની સેવા બીજા વિભાગને આપે છે ત્યારે બીજો સેવા વિભાગ તેની સેવા પહેલા સેવા વિભાગને આપે છે.

દા. ત.: ‘અ’ અને ‘બ’ એમ બે સેવા વિભાગ છે. ‘અ’ તેની સેવા ‘બ’ વિભાગને આપે છે અને ‘બ’ વિભાગ તેની સેવા ‘અ’ વિભાગને પણ આપે છે. આ પદ્ધતિને પારસ્પરિક પદ્ધતિ છે.

૮.૨.૨.૧ યુગપત સમીકરણ પદ્ધતિ (Simultaneous Equation Method):

સેવા વિભાગના કુલ શિરોપરી ખર્ચ યુગપત સમીકરણની પદ્ધતિની મદદથી કરવામાં આવે છે. યુગપત સમીકરણની પદ્ધતિની મદદથી મેળવેલ પરિણામ (શિરોપરી ખર્ચ)ની ઉત્પાદન વિભાગમાં ફાળવણી કરવામાં આવે છે એટલે કે આ પદ્ધતિ મુજબ સેવા વિભાગના શિરોપરી ખર્ચની વહેંચણી યુગપત સમીકરણ મુજબ કરવામાં આવે છે.

નીચે આપેલ સમીકરણ મુજબ શિરોપરી ખર્ચની ફાળવણી કરવામાં આવે છે.

$$x = a + by$$

$$y = a + bx$$

ઉદાહરણ: ૩ નીચે આપેલી માહિતી એક પેદાશનું ઉત્પાદન કરતી કંપનીની છે. જેમાં ત્રણ ઉત્પાદન વિભાગ A, B અને C તથા બે સેવા વિભાગ X અને Y છે.

	ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
	A (₹)	B (₹)	C (₹)	X (₹)	Y (₹)
પ્રાથમિક ફાળવણી પ્રમાણે શિરોપરી ખર્ચ	૧૨,૬૦૦	૧૪,૮૦૦	૫,૬૦૦	૬,૦૦૦	૪,૦૦૦

સેવા વિભાગના શિરોપરી ખર્ચની ફાળવણી નીચે પ્રમાણે થશે.

Service Dept.	A	B	C	X	Y
X	૪૦%	૩૦%	૨૦%	--	૧૦%
Y	૩૦%	૩૦%	૨૦%	૨૦%	--

યુગપત સમીકરણ પદ્ધતિ મુજબ ઉત્પાદન વિભાગના કુલ શિરોપરી ખર્ચની ગણાતરી કરો.

જવાબ:

x એ સેવા વિભાગ Xના કુલ શિરોપરી ખર્ચ દર્શાવે છે.

y એ સેવા વિભાગ Yના કુલ શિરોપરી ખર્ચ દર્શાવે છે.

$$x = ૬,૦૦૦ + y \text{ ના } ૨૦\%$$

$$y = ૪,૦૦૦ + x \text{ ના } ૧૦\%$$

$$\therefore x = ૬,૦૦૦ + ૦.૨y$$

$$y = 4,000 + 0.1x$$

સમીકરણનું થોડું વિસ્તરણ કરી ૧૦ વડે ગુણતાં,

$$10x - 2y = 60,000 \quad \dots (1)$$

$$-x + 10y = 40,000 \quad \dots (2)$$

સમીકરણ (2)ને ૧૦ વડે ગુણતાં અને ઉમેરો કરતાં,

$$10x - 2y = 60,000$$

$$\underline{- 10x + 100y = 400,000}$$

$$68y = 4,60,000$$

$$\therefore y = \frac{4,60,000}{68} \quad \therefore y = \underline{\underline{4,000}}$$

સમીકરણ (1)માં યની કિંમત મૂકતાં,

$$10x - 2y = 60,000$$

$$10x - 2(4,000) = 60,000$$

$$10x - 10,000 = 60,000$$

$$10x = 60,000 + 10,000$$

$$10x = 70,000$$

$$\therefore x = \frac{70,000}{10} \quad \therefore x = \underline{\underline{7,000}}$$

શિરોપરી ખર્ચની દ્વિતીય ફાળવણી દર્શાવતું પત્રક:

વિગત	કુલ (₹)	ઉત્પાદન વિભાગો		
		A (₹)	B (₹)	C (₹)
ફાળવેલ ખર્ચ	33,000	12,500	14,800	4,500
સેવા વિભાગ X (100000ના 60%)	60,000	8,000	3,000	2,000
સેવા વિભાગ Y (5000ના 20%)	8,000	1,400	1,400	1,000
કુલ	45,000	18,100	16,300	7,500

૨.૨.૨.૨ પુનરાવર્તી ફાળવણી પદ્ધતિ (Repeated Distribution Method):

આ પદ્ધતિ મુજબ એક સેવા વિભાગનો ખર્ચ ઉત્પાદન વિભાગ અને અન્ય સેવા વિભાગની વચ્ચે નક્કી કરેલ દર અથવા વ્યાજબી આધારે ફાળવવામાં આવે છે. ત્યારબાદ બીજા સેવા વિભાગનો ખર્ચ ઉત્પાદન વિભાગો અને પહેલા સેવા વિભાગ વચ્ચે નક્કી કરેલ દર અથવા વ્યાજબી આધારે ફાળવવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ સેવા વિભાગનો ખર્ચ ઉત્પાદન

વિભાગ અને અન્ય સેવા વિભાગને ફાળવવામાં આવે છે. આમ, આ પુનરાવર્તી પ્રક્રિયા જ્યાં સુધી સેવા વિભાગનો ખર્ચ નહિયત અથવા શૂન્ય ન થાય ત્યાં સુધી ચાલશે.

ઉદાહરણ: ૪ નીચે આપેલી માહિતી એક પેદાશનું ઉત્પાદન કરતી કંપનીની છે. જેમાં ત્રણ ઉત્પાદન વિભાગ A, B અને C તથા બે સેવા વિભાગ X અને Y છે.

	ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
	A (₹)	B (₹)	C (₹)	X (₹)	Y (₹)
પ્રાથમિક ફાળવણી પ્રમાણે શિરોપરી ખર્ચ	૧૨,૬૦૦	૧૪,૮૦૦	૫,૬૦૦	૬,૦૦૦	૪,૦૦૦

સેવા વિભાગના શિરોપરી ખર્ચની ફાળવણી નીચે પ્રમાણે થશે.

Service Dept.	A	B	C	X	Y
X	૪૦%	૩૦%	૨૦%	--	૧૦%
Y	૩૦%	૩૦%	૨૦%	૨૦%	--

પુનરાવર્તી ફાળવણી પદ્ધતિ મુજબ ઉત્પાદન વિભાગના કુલ શિરોપરી ખર્ચની ગણતરી કરો.

જવાબ:

સેવા વિભાગના શિરોપરી ખર્ચનું પુનરાવર્તી પદ્ધતિએ ફાળવણી દર્શાવ્યું પત્રક

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગ	
	A (₹)	B (₹)	C (₹)	X (₹)	Y (₹)
ફાળે આપેલ કુલ ખર્ચ સેવા વિભાગ X (આપેલ ટકાવારી મુજબ)	૧૨,૬૦૦	૧૪,૮૦૦	૫,૬૦૦	૬,૦૦૦	૪,૦૦૦
	૩,૬૦૦	૨,૭૦૦	૧,૮૦૦	(૬,૦૦૦)	૬૦૦
સેવા વિભાગ Y	૧૬,૨૦૦	૧૭,૫૦૦	૭,૪૦૦	---	૪,૬૦૦
	૧,૪૭૦	૧,૪૭૦	૬૮૦	૬૮૦	(૪,૬૦૦)
સેવા વિભાગ X	૧૭,૬૭૦	૧૮,૮૭૦	૮,૩૮૦	૬૮૦	---
	૩૬૨	૨૯૪	૧૯૬	(૬૮૦)	૬૮
સેવા વિભાગ Y	૧૮,૦૬૨	૧૮,૨૬૪	૮,૫૭૬	---	૬૮
	૨૬	૨૯	૨૦	૨૦	(૬૮)
સેવા વિભાગ X	૧૮,૦૬૧	૧૮,૨૬૩	૮,૫૮૬	૨૦	---
	૬	૭	૪	(૨૦)	---
કુલ	૧૮,૧૦૦	૧૮,૩૦૦	૮,૬૦૦	---	---

નોંધ: (૧) ફાળવણી પહેલા કુલ પડતર ₹ ૧૨,૬૦૦, ₹ ૧૪,૮૦૦, ₹ ૫૬૦૦, ₹ ૬,૦૦૦, ₹ ૪,૦૦૦ અનુક્રમે A,B,C,X અને Yના છે = ₹ ૪૬,૦૦૦

(૨) ફાળવણી બાદ કુલ પડતર ₹ ૧૮,૧૦૦, ₹ ૧૮,૩૦૦ અને ₹ ૮,૬૦૦ અનુક્રમે A,B અને Cના છે. = ₹ ૪૬,૦૦૦

ઉદાહરણ: ૫ એક કારખાનામાં A, B અને C એમ ત્રણ ઉત્પાદન વિભાગો તથા x અને y એમ બે સેવા વિભાગો છે. સેવા વિભાગોનો લાભ જુદા-જુદા વિભાગોમાં નીચે મુજબ મળે છે.

	ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
	A 20%	B 40%	C 30%	x ---	y 10%
x	20%	40%	30%	---	10%
y	40%	20%	20%	20%	---

પાંચ વિભાગોના શિરોપરી ખર્ચ અનુક્રમે ₹ ૧૬,૦૦૦/-, ₹ ૧૪,૦૦૦/-, ₹ ૧૨,૦૦૦/-, ₹ ૪,૬૮૦/- અને ₹ ૫,૦૦૦/- છે.

પુનરાવર્ત્તી પદ્ધતિ અનુસાર સેવા વિભાગના કારખાના શિરોપરી ખર્ચની ઉત્પાદન વિભાગોમાં ફાળવણી કરો.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, એસ. વાય. બી.કોમ., એપ્રિલ ૨૦૦૫)

જવાબ:

શિરોપરી ખર્ચનું પુનરાવર્ત્તી પદ્ધતિએ ફાળવણી દર્શાવ્યું પત્રક

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	A (₹)	B (₹)	C (₹)	x (₹)	y (₹)
કાળે આવેલ કુલ ખર્ચ સેવા વિભાગ xની ફાળવણી (20%, 40%, 30%, 10%)	16,000 636	14,000 1,872	12,000 1,408	4,680 (-4,680)	5,000 492
	16,636 2,487	14,872 1,264	13,408 1,264	--- 1,263	5,492 (-5,492)
	16,423 2,466	17,166 4,917	14,568 3,888	1,263 (-1,263)	--- 126
	16,782 42	17,583 29	14,025 29	--- 25	126 (-126)
	16,834 4	17,706 10	14,112 8	25 (-25)	--- 2
	16,836	17,716	14,120	---	2

સેવા વિભાગ યની ફાળવણી (૪૦%, ૨૦%, ૨૦%, ૨૦%)	૧	૦.૫	૦.૫	---	(-૨)
કુલ	૧૬,૮૪૦	૧૭,૭૧૬.૫	૧૫,૧૨૦.૫	---	---

ઉદાહરણ: ૬ એક કારખાનામાં અ, બ અને ક એમ ત્રણ ઉત્પાદન વિભાગો તથા ક્ષ અને ય નામના બે સેવા વિભાગો છે. ખાતાવાર ફાળવણી મુજબ દરેક ઉત્પાદન વિભાગને ફાળે અનુક્રમે ₹ ૫,૦૦૦/-, ₹ ૪,૨૫૦/- અને ₹ ૩,૭૫૦/- તથા સેવા વિભાગને ફાળે અનુક્રમે ₹ ૨,૦૦૦/- અને ₹ ૩,૦૦૦/- ફાળવવામાં આવ્યા છે.

દરેક સેવા વિભાગે બીજા વિભાગોને નીચે પ્રમાણે સેવા (ટકાવારી)માં આપી છે.

	ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
	અ	બ	ક	ક્ષ	ય
સેવા વિભાગ ક્ષ	૪૦%	૩૦%	૧૦%	---	૨૦%
સેવા વિભાગ ય	૩૦%	૨૦%	૪૦%	૧૦%	---

પુનરાવર્ત્તી ફાળવણી પદ્ધતિ પ્રમાણે ફાળવણી કરો.

(સરદાર પેટેલ ચુનિવર્સિટી, એસ. વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૩)

જવાબ:

સેવા વિભાગોના શિરોપરી ખર્ચનું પુનરાવર્ત્તી પદ્ધતિ મુજબ ફાળવણી દર્શાવ્યું પત્રક

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	અ (₹)	બ (₹)	ક (₹)	ક્ષ (₹)	ય (₹)
કાળે આવેલ કુલ ખર્ચ સેવા વિભાગ ક્ષની ફાળવણી (૪:૩:૧:૨)	૫,૦૦૦ ૮૦૦	૪,૨૫૦ ૫૦૦	૩,૭૫૦ ૨૦૦	૨,૦૦૦ (-૨,૦૦૦)	૩,૦૦૦ ૪૦૦
સેવા વિભાગ યની ફાળવણી (૩:૨:૪:૧)	૫,૮૦૦ ૧,૦૨૦	૪,૮૫૦ ૬૮૦	૩,૬૫૦ ૧,૩૬૦	---	૩,૪૦૦ (-૩,૪૦૦)
સેવા વિભાગ ક્ષની ફાળવણી (૪:૩:૧:૨)	૫,૮૨૦ ૧૩૬	૫,૫૩૦ ૧૦૨	૫,૩૧૦ ૩૪	૩૪૦ (-૩૪૦)	---
સેવા વિભાગ યની ફાળવણી (૩:૨:૪:૧)	૫,૮૫૬ ૨૦	૫,૫૩૨ ૧૪	૫,૩૪૪ ૨૭	---	૬૮ (-૬૮)
સેવા વિભાગ ક્ષની ફાળવણી (૪:૩:૧:૨)	૫,૮૭૬ ૩	૫,૫૪૬ ૨	૫,૩૭૧ ૧	૭ (-૭)	---
	૫,૮૭૬	૫,૫૪૮	૫,૩૭૨	---	૧

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	અ (₹)	બ (₹)	ક (₹)	શ (₹)	ય (₹)
સેવા વિભાગ થની ફાળવણી (૩:૨:૪:૧)	૧	---	---	---	(-૧)
કુલ	૬,૬૮૦	૫,૬૪૮	૫,૩૭૨	---	---

ઉદાહરણ: ૭ મનિષા લિમિટેડ, માર્ચ-૨૦૦૪ માસની નીચેની માહિતી તમને પૂરી પાડે છે.

	ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
	અ	બ	ક	શ	ય
પ્રત્યક્ષ મજૂરી (₹)	૭,૦૦૦	૬,૦૦૦	૫,૦૦૦	૧,૦૦૦	૧,૦૦૦
પ્રત્યક્ષ ભાલસાભાન (₹)	૩,૦૦૦	૨,૫૦૦	૨,૦૦૦	૧,૫૦૦	૧,૦૦૦
કામદારોની સંખ્યા	૨૦	૧૫	૧૫	૫	૫
વીજળી (કિલોવોટ)	૮૦૦	૬૦૦	૬૦૦	૨૦૦	૩૦૦
લાઇટ પોઈન્ટ્સ (સંખ્યા)	૧૦	૧૫	૧૫	૫	૫
ચંત્રની કિંમત (₹)	૫૦૦૦૦	૩૦૦૦૦	૨૦૦૦૦	૧૦૦૦૦	૧૦૦૦૦
રોકેલ જગ્યા (ચો. મી.)	૮૦	૬૦	૬૦	૨૦	૨૦

માસિક ખર્ચ	(₹)
પાવર	૧૫,૦૦૦
સ્ટોર્સ પરોક્ષ ખર્ચ	૪,૦૦૦
દિવાબત્તી	૨,૦૦૦
કામદાર કલ્યાણ ખર્ચ	૩,૦૦૦
ઘસારો	૮,૦૦૦
સામાન્ય પરોક્ષ ખર્ચ	૧,૫૦૦
સમારકામ અને નિભાવ ખર્ચ	૧,૮૦૦
ભાડું અને વેરા	૬,૦૦૦

સેવા વિભાગો શ અને થના ખર્ચની ફાળવણી નીચે મુજબ કરવાની છે. (ટકાવારી)

વિભાગ શ	ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
	અ	બ	ક	શ	ય
વિભાગ થ	૩૦%	૪૦%	૨૦%	---	૧૦%
વિભાગ શ	૧૦%	૨૦%	૫૦%	૨૦%	---

ઉત્પાદનના અંદાજીત કામના કલાકો:

‘અ’ - ૧,૫૦૦ કલાક, ‘બ’ - ૧,૨૦૦ કલાક, ‘ક’ - ૧,૫૦૦ કલાક

ઉપરોક્ત માહિતી પરથી પુનરાવર્તી પદ્ધતિએ અ, બ અને ક વિભાગના પરોક્ષ ખર્ચની વસૂલાતનો ઉત્પાદન કલાક દર શોધો.

(એસ.પી.ચુ., એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૪ સુધારેલ)

જવાબ:

પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક

વિગત	ફાળવણીનો આધાર	કુલ (₹)	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
			અ (₹)	બ (₹)	ક (₹)	ક્ષ (₹)	ય (₹)
પાયર	વીજળી (કિલોવોટ) (૮:૬:૬:૨:૩)	૧૫,૦૦૦	૪,૮૦૦	૩,૬૦૦	૩,૬૦૦	૧,૨૦૦	૧,૮૦૦
સ્ટોર્સ	પ્રત્યક્ષ માલસામાન (૬:૫:૪:૩:૨)	૪,૦૦૦	૧,૨૦૦	૧,૦૦૦	૮૦૦	૬૦૦	૪૦૦
દિવાબતી	લાઇટ પોઈન્ટ્સ (૨:૩:૩:૧:૧)	૨,૦૦૦	૪૦૦	૬૦૦	૬૦૦	૨૦૦	૨૦૦
કામદાર કલ્યાણ ખર્ચ	કામદારોની સંખ્યા (૪:૩:૩:૧:૧)	૩,૦૦૦	૧,૦૦૦	૭૫૦	૭૫૦	૨૫૦	૨૫૦
ઘસારો	ચંત્રની કિંમત (૫:૩:૨:૧:૧)	૮,૦૦૦	૩,૭૫૦	૨૨૫૦	૧૫૦૦	૭૫૦	૭૫૦
સામાન્ય પરોક્ષ ખર્ચ	પ્રત્યક્ષ મજૂરી (૭:૬:૫:૧:૧)	૧,૫૦૦	૫૨૫	૪૫૦	૩૭૫	૭૫	૭૫
સમારકામ અને નિભાવ ખર્ચ	ચંત્રની કિંમત (૫:૩:૨:૧:૧)	૧,૮૦૦	૭૫૦	૪૫૦	૩૦૦	૧૫૦	૧૫૦
ભાડું અને વેરા	રોકેલ જગ્યા (૪:૩:૩:૧:૧)	૬,૦૦૦	૨,૦૦૦	૧,૪૦૦	૧,૪૦૦	૪૦૦	૪૦૦
પ્રત્યક્ષ મજૂરી પ્રત્યક્ષ માલસામાન	આપેલ આપેલ	૨,૦૦૦ ૨,૫૦૦	---	---	---	૧,૦૦૦ ૧,૫૦૦	૧,૦૦૦ ૧,૦૦૦
કુલ		૪૬,૮૦૦	૧૪,૪૨૫	૧૦,૬૦૦	૬,૪૨૫	૬,૨૨૫	૬,૧૨૫

સેવા વિભાગોના શિરોપરી ખર્ચનું પુનરાવર્તી પદ્ધતિ મુજબ ફાળવણી દર્શાવ્યું પત્રક

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	અ (₹)	બ (₹)	ક (₹)	ક્ષ (₹)	ય (₹)
ફાળે આવેલ કુલ ખર્ચ ક્ષ વિભાગની ફાળવણી (૩:૪:૨:૧)	૧૪,૪૨૫ ૧,૮૯૭	૧૦,૯૦૦ ૨,૪૯૦	૬,૪૨૫ ૧,૨૪૫	૫,૨૨૫ (-૫,૨૨૫)	૫,૧૨૫ ૫૨૩
ય વિભાગની ફાળવણી (૧:૨:૫:૨)	૧૬,૨૮૨ ૫૭૫	૧૩,૦૯૦ ૧,૩૪૯	૧૦,૯૭૦ ૩,૩૭૪	---	૫,૭૪૮ (-૫,૭૪૮)
ક્ષ વિભાગની ફાળવણી (૩:૪:૨:૧)	૧૬,૬૯૭ ૪૦૫	૧૪,૪૩૯ ૫૪૦	૧૪,૦૪૪ ૨૭૦	૧,૩૫૦ (-૧,૩૫૦)	---
ય વિભાગની ફાળવણી (૧:૨:૫:૨)	૧૭,૩૭૨ ૧૩	૧૪,૮૭૯ ૨૭	૧૪,૩૧૪ ૬૮	---	૧૩૫ (-૧૩૫)
ક્ષ વિભાગની ફાળવણી (૩:૪:૨:૧)	૧૭,૩૮૫ ૮	૧૫,૦૦૬ ૧૧	૧૪,૩૮૨ ૫	૨૭ (-૨૭)	---
ય વિભાગની ફાળવણી (૧:૨:૫:૨)	૧૭,૩૯૩ ---	૧૫,૦૧૭ ૧	૧૪,૩૮૭ ૨	---	૩ (-૩)
કુલ	૧૭,૩૯૩	૧૫,૦૧૮	૧૪,૩૮૯	---	---

	ઉત્પાદન વિભાગો		
	અ	બ	ક
કલાક દર = $\frac{\text{શિરોપરી ખર્ચ}}{\text{કામગા કલાકી}}$	= $\frac{૧૭૩૯૩}{૧૫૦૦}$	= $\frac{૧૫૦૧૮}{૧૨૦૦}$	= $\frac{૧૪૩૮૯}{૧૫૦૦}$
કલાક દર (₹)	૧૦.૮૭	૧૨.૫૧૫	૯.૫૯

ઉદાહરણ: એક કંપનીમાં ઉત્પાદનનાં ત્રણ વિભાગો ‘અ’, ‘બ’ અને ‘ક’ તથા ‘ડ’ અને ‘ય’ સેવા વિભાગો છે. માર્ચ ૨૦૦૭ના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે.

(₹)

- | | |
|--------------------------|--------|
| ૧. કારખાના મેળેજરનો પગાર | ૩૦,૦૦૦ |
| ૨. પાવર | ૩૬,૦૦૦ |
| ૩. ચંત્રનો ધસારો | ૨૬,૭૦૦ |
| ૪. E. S. I.માં ફાળો | ૬,૫૦૦ |

પ. ભાડું અને કરવેરાં	૨૦,૦૦૦
ક. વીજળી	૧૬,૦૦૦
ગ. કેન્ટીન ખર્ચ	૬,૦૦૦
દ. વીમા ખર્ચ	૬,૬૦૦
એ. પરોક્ષ મજૂરી	૧૩,૦૦૦

અન્ય માહિતી:

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	અ	બ	ક	શ	ઈ
વીજળીના પોઇન્ટ	૬	૫	૪	૩	૨
પ્રત્યક્ષ મજૂરી (₹)	૪,૫૦૦	૪,૦૦૦	૨,૬૦૦	૧,૨૦૦	૪૦૦
ચંત્રની કિંમત (₹)	૭૨,૦૦૦	૪૮,૦૦૦	૩૬,૦૦૦	૧૨,૦૦૦	૧૨,૦૦૦
ચંત્રના હોર્સ પાવર	૪	૬	૨	-	-
રોક્લ જગ્યા (ચો. ફ્લ.)	૫૦૦	૪૦૦	૫૦૦	૩૦૦	૨૦૦
કારખાના મેનેજરે ફાળવેલ	૫	૪	૩	૨	૧
સમયનું પ્રમાણા	૫	૬	૪	૩	૨
કામદારોની સંખ્યા	૪૦૦	૩૦૦	૫૦૦	-	-
કામના કલાકો					

સેવા વિભાગના ખર્ચની ફાળવણી નીચે પ્રમાણે કરવાની છે.

વિભાગ	ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
	અ	બ	ક	શ	ઈ
શ	૨૦%	૩૦%	૪૦%	---	૧૦%
ઈ	૩૦%	૩૦%	૨૦%	૨૦%	---

ઉપરની માહિતીને આધારે પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરી સેવા વિભાગના ખર્ચની ફાળવણી પુનરાવર્ત્તી પદ્ધતિએ કરો.

(એસ.પી.યુ., એસ.વાય.બી.કોમ્બ., એપ્રિલ ૨૦૦૭ સુધારેલ)

જવાબ:

પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક

વિગત	ફાળવણીનો આધાર	કુલ (₹)	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગ	
			અ (₹)	બ (₹)	ક (₹)	શ (₹)	ચ (₹)
કારખાના મેનેજરે ફાળવેલ	સમય	૩૦,૦૦૦	૧૦,૦૦૦	૮,૦૦૦	૬,૦૦૦	૪,૦૦૦	૨,૦૦૦
મેનેજરનો પગાર (૫:૪:૩:૨:૧)							
પાવર	ચંત્રના હોર્સ પાવર (૪:૬:૨)	૩૬,૦૦૦	૧૨,૦૦૦	૧૮,૦૦૦	૬,૦૦૦	-	-
ચંત્રનો પગાર (૪:૬:૨)	ચંત્રની કિંમત	૨૬,૭૦૦	૧૧,૮૮૦	૭,૮૨૦	૫,૬૪૦	૧,૬૮૦	૧,૬૮૦

વિગત	ફાળવણીનો આધાર	કુલ (₹)	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગ	
			અ (₹)	બ (₹)	ક (₹)	ક્ષ (₹)	ય (₹)
ઘસારો E.S.I.માં	(ક:૪:૩:૧:૧) પ્રત્યક્ષ મજૂરી	૫,૪૦૦	૨,૨૫૦	૨,૦૦૦	૧૪૫૦	૬૦૦	૨૦૦
ફાળો ભાડું	(૪૫:૪૦:૨૮:૧૨:૪) શોકેલ જથ્યા	૨૦,૦૦૦	૬,૦૦૦	૪,૦૦૦	૪૦૦૦	૩,૦૦૦	૨,૦૦૦
અને કરવેરાં	(ક:૪:૫:૩:૨)						
વીજળી	વીજળીનાં પોઈન્ટ (ક:૫:૪:૩:૨)	૧૬,૦૦૦	૪,૮૦૦	૪,૦૦૦	૩૨૦૦	૨,૪૦૦	૧,૬૦૦
કેન્ટીન	કામદારોની સંખ્યા	૬,૦૦૦	૧,૪૦૦	૧,૮૦૦	૧૨૦૦	૬૦૦	૬૦૦
ખર્ચ	(૫:૬:૪:૩:૨)						
વીમા	ચંત્રની કિંમત	૬,૬૦૦	૨,૬૪૦	૧,૭૬૦	૧૩૨૦	૪૪૦	૪૪૦
ખર્ચ	(ક:૪:૩:૧:૧)						
પરોક્ષ	પ્રત્યક્ષ મજૂરી	૧૩,૦૦૦	૪,૫૦૦	૪,૦૦૦	૨૬૦૦	૧,૨૦૦	૪૦૦
મજૂરી	(૪૫:૪૦:૨૮:૧૨:૪)						
પ્રત્યક્ષ	આપેલ	૧,૬૦૦	---	---	---	૧,૨૦૦	૪૦૦
મજૂરી							
	કુલ	૧,૬૫,૪૦૦	૫૫,૫૭૦	૫૧,૪૮૦	૩૩,૦૧૦	૧૫,૭૨૦	૬,૬૨૦

સેવા વિભાગોના શિરોપરી ખર્ચનું પુનરાવર્ત્તી પદ્ધતિ મુજબ ફાળવણી દર્શાવતું પત્રક

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	અ (₹)	બ (₹)	ક (₹)	ક્ષ (₹)	ય (₹)
ફાળો આપેલ કુલ ખર્ચ	૫૫,૫૭૦	૫૧૪૮૦	૩૩,૦૧૦	૧૫,૭૨૦	૬,૬૨૦
૬ સેવા વિભાગ (૨:૩:૪:૧)	૩,૧૪૪	૪૭૧૬	૬,૨૮૮	(-૧૫,૭૨૦)	૧,૫૭૨
૬ સેવા વિભાગ (૩:૩:૨:૨)	૫૮,૭૧૪	૫૬૧૬૬	૩૬,૨૬૮	---	૧૧,૧૬૨
૬ સેવા વિભાગ (૨:૩:૪:૧)	૩,૩૫૮	૩૩૪૮	૨,૨૩૮	૨,૨૩૮	(-૧૧,૧૬૨)
૬ સેવા વિભાગ (૩:૩:૨:૨)	૫૨,૦૭૨	૫૮૫૫૪	૪૧,૫૩૬	૨,૨૩૮	---
૬ સેવા વિભાગ (૨:૩:૪:૧)	૪૪૮	૬૭૧	૮૮૫	(-૨,૨૩૮)	૨૨૪
૬ સેવા વિભાગ (૩:૩:૨:૨)	૫૨,૫૨૦	૫૦૨૨૫	૪૨,૪૩૧	---	૨૨૪
૬ સેવા વિભાગ (૨:૩:૪:૧)	૫૭	૫૭	૪૫	૪૫	(-૨૨૪)
	૫૨,૫૮૭	૫૦૨૯૨	૪૨,૪૭૬	૪૫	---
	૯	૧૪	૧૮	(-૪૫)	૪

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	અ (₹)	બ (₹)	ક (₹)	શ (₹)	ય (₹)
ઈ સેવા વિભાગ (૩:૩:૨:૨)	૫૨,૫૮૬ ૧	૫૦,૩૦૬ ૧	૪૨,૪૮૪ ૧	---	૪ (-૪)
ક સેવા વિભાગ (૨:૩:૪:૧)	૫૨,૫૮૭ ---	૫૦,૩૦૭ ---	૪૨,૪૮૫ ૧	૧ (-૧)	---
કુલ	૫૨,૫૮૭	૫૦,૩૦૭	૪૨,૪૮૫	---	---

ઉદાહરણ: ૬

તમને આપવામાં આવેલી નીચેની માહિતી પરથી પુનરાવર્તી પદ્ધતિને આધારે ‘અ’, ‘બ’ અને ‘ક’ વિભાગનાં પરોક્ષ ખર્ચની વસુલાતનો ઉત્પાદન કલાક દર શોધો.

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	અ	બ	ક	પી	ક્યુ
પરોક્ષ ખર્ચ (₹)	૭૮૧૦	૧૨૫૪૩	૪૫૪૭	૪૦૦૦	૨૫૦૦

સેવા વિભાગ ‘પી’ અને ‘ક્યુ’ ના ખર્ચની ફાળવણી નીચે પ્રમાણે કરવાની છે (ટકાવારીમાં).

	ઉત્પાદન વિભાગ			સેવા વિભાગ	
	અ	બ	ક	પી	ક્યુ
વિભાગ પી	૩૦%	૪૦%	૨૦%	---	૧૦%
વિભાગી ક્યુ	૧૦%	૨૦%	૫૦%	૨૦%	---

ઉત્પાદનનાં અંદાજીત કામનાં કલાકો:

‘અ’ - ૧,૦૦૦ કલાક, ‘બ’ - ૨,૫૦૦ કલાક, ‘ક’ - ૧,૪૦૦ કલાક.

(એસ.પી.યુ., એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૪)

જવાબ:

પરોક્ષ ખર્ચની ફાળવણી (પુનરાવર્તી પદ્ધતિ મુજબ) તથા કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક

વિગત	ફાળવણીનો આધાર	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગ	
		અ (₹)	બ (₹)	ક (₹)	પી (₹)	ક્યુ (₹)
પરોક્ષ ખર્ચ પી વિભાગની ફાળવણી	૩:૪:૨:૧	૭,૮૧૦ ૧,૨૦૦	૧૨,૫૪૩ ૧,૫૦૦	૪૫૪૭ ૮૦૦	૪,૦૦૦ (-૪,૦૦૦)	૨,૫૦૦ ૪૦૦
ક્યુ વિભાગની ફાળવણી		૬,૦૧૦ ૩૦૦	૧૪,૧૪૩ ૫૦૦	૫૩૪૭ ૧૫૦૦	---	૩,૦૦૦ (-૩,૦૦૦)

વિગત	કાળવણીનો આધાર	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગ	
		અ (₹)	બ (₹)	ક (₹)	પી (₹)	ક્યુ (₹)
પી વિભાગની ફાળવણી	3:૪:૨:૧	૮,૩૧૦ ૧૮૦	૧૪,૭૪૩ ૨૪૦	૬,૮૪૭ ૧૨૦	૬૦૦ (-૬૦૦)	---
		૮,૪૮૦ ૬	૧૪,૬૮૩ ૧૨	૬,૮૬૭ ૩૦	---	૬૦ (-૬૦)
	3:૪:૨:૧	૮,૪૮૬ ૪	૧૪,૬૯૫ ૫	૬,૮૯૭ ૨	૧૨ (-૧૨)	---
		૮,૪૦૦ ---	૧૫,૦૦૦ ---	૬,૯૯૯ ૧	---	૧ (-૧)
	કુલ	૮,૪૦૦	૧૫,૦૦૦	૬,૯૯૯	---	---

ઉત્પાદન વિભાગો			
	અ	બ	ક
કલાક દર = $\frac{\text{કુલ ફાળવેલ પરોક્ષ ખર્ચ}}{\text{કામના કલાકો}}$	= $\frac{૮૫૦૦}{૧૦૦૦}$	= $\frac{૧૫૦૦૦}{૨૫૦૦}$	= $\frac{૭૦૦૦}{૧૪૦૦}$
કલાક દર (₹)	૮.૫૦	૬.૦૦	૫.૦૦

ઉદાહરણ: ૧૦ નીચે આપેલી માહિતીને આધારે યંત્ર નંબર ૧૦ની ચાંત્રિક કલાક દરની ગણતરી કરો.

- (૧) યંત્રની કિંમત ₹ ૧૫,૦૦૦/-
- (૨) ભંગારની કિંમત ₹ ૧,૦૦૦/-
- (૩) અંદાજુત આચુષ્ય ₹ ૮,૦૦૦ કલાકો
- (૪) સમારકામ અને નિભાવ ખર્ચ (આખા આચુષ્ય દરમ્યાન) ₹ ૭,૦૦૦/-
- (૫) સ્થિર ખર્ચ ₹ ૨,૦૦૦/- પ્રતિ વર્ષ
- (૬) કામના કલાકો રું કલાક પ્રતિદિન
- (૭) મહિના દરમ્યાન વાપરેલ પાવર ₹ ૧૦૦/-
- (૮) યંત્રનું વીમા પ્રિમિયમ યંત્રની મૂળ કિંમતના ૨% (વાર્ષિક)
- (૯) કામના કલાકોની ગણતરી માટે રૂપ દિવસનો મહિનો ગણવો.

જવાબ:

યંત્રના કામના કલાકો = $2 \text{ કલાક ટૈનિક} \times 24 \text{ દિવસ}$
= 200 કલાક માસિક
= $200 \text{ કલાક માસિક} \times 12 \text{ માસ}$
= $2,400 \text{ કલાક વાર્ષિક}$

ચાંત્રિક કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક (૧ વર્ષ માટે) (૨૪૦૦ કલાકો)

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
<u>સ્થિર ખર્ચાઃ</u>		
<u>સ્થિર ખર્ચ</u> વીમા પ્રિમિયમ ($14000 \times 2\%$)	2,000 300 <u>2,300</u>	0.૯૫૮૩
<u>ચલિત ખર્ચાઃ</u>		
ઘસારો $\left(\frac{14000 - 1000}{24000} \right)$		0.૫૦૦૦
સમારકામ અને નિભાવ ખર્ચ $\left(\frac{7000}{24000} \right)$		0.૨૫૦૦
પાવર (100×12) $\left(\frac{1200}{2400} \right)$		0.૫૦૦૦
ચાંત્રિક કલાક દર		2.૨૦૮૩

ઉદાહરણ: ૧૧

એક ઉત્પાદક યુનિટે હાલમાં તેના પાંચ મશીનોના સમૂહમાં એક નવું મશીન ખરીદીને ઉમેરો કર્યો. નવી મશીનરીની ખરીદ કિમત તથા ગોઠવવાના ખર્ચ સહિતની કિમત ₹ ૭,૫૦,૦૦૦/- થઈ. આ ચંત્રનું અંદાજુત આયુષ્ય ૧૫ વર્ષનું છે. તેના ઉપયોગી આયુષ્યના અંતે ₹ ૩૦,૦૦૦/- ભંગાર કિમત તરીકે ઉપજશે તેવી ધારણા છે. બીજુ માહિતી નીચે પ્રમાણે છે.

- (૧) દરરોજનાં આઠ કલાકના હિસાબે, વર્ષના ૩૦૦ દિવસોના કુલ ૨,૪૦૦ કલાકો કામના અંદાજેલ છે. તેમાં ૪૦૦ કલાકો મશીન રીપેરીંગનો સમાવેશ થાય છે.
- (૨) ચંત્ર કલાકટીઠ ૧૫ યુનિટ વીજળીનો વપરાશ કરે છે. યુનિટટીઠ વીજળીનો ભાવ ₹ ૨/- છે. ચંત્ર રીપેરીંગમાં હોય છે ત્યારે વીજળીનો વપરાશ થતો નથી.
- (૩) ચંત્રને ગરમ કરવા માટે ખાસ ઓઇલની જરૂરિયાત રહે છે. ઓઇલ બદલવાનો ખર્ચ દર મહિને ₹ ૨,૫૦૦/- આવે છે.
- (૪) છ દિવસના કામકાજના અઠવાડિયા પ્રમાણે ચંત્રનો રીપેરીંગ ખર્ચ ₹ ૫૦૦/- દર અઠવાડિયે અંદાજેલ છે.

(૫) ગ્રાન્ડ ઓપરેટર આ છ મશીનો ઓપરેટ કરે છે. દરેક ઓપરેટરનો વાર્ષિક પગાર ₹ ૨૪,૦૦૦/- છે તથા ૪૦% અન્ય લાભો પ્રાપ્ત કરે છે.

તમારે ચાંત્રિક કલાક દર શોધવાનો છે.

(એસ.પી.ચુ., એસ.વાય. બી.કોમ., એપ્રિલ ૨૦૦૬)

જવાબ:

યંત્રના કામનાં ચોખ્ખા કલાકો:

= ₹ ૪૦૦ કલાક વાર્ષિક - ૪૦૦ મશીન રીપેરીંગ કલાક

= ₹ ૨,૦૦૦ કલાક

ચાંત્રિક કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક (૨૦૦૦ કલાકો)

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
<u>સ્થિર ખર્ચ:</u> વીજળી ખર્ચ (૧૫ ચુનિટ × ₹ ૨ × ૨૦૦૦ કલાક) ઓઇલ ખર્ચ (₹ ૨૫૦૦ × ૧૨ મહિના) ઓપરેટરનો પગાર (૨૪૦૦૦ × ૩ = ૭૨૦૦૦ + ૪૦% અન્ય લાભો = ૨૮૮૦૦ = ૧૦૦૮૦૦ × ૧/૯) કુલ સ્થિર ખર્ચ	૬૦,૦૦૦ ૩૦,૦૦૦ <u>૯૬,૮૦૦</u> <u>૧,૦૬,૮૦૦</u>	૫૩.૪૦
<u>ચલિત ખર્ચ:</u> ઘસારો $\left(\frac{૭૫૦૦૦૦ - ૩૦૦૦૦}{૧૫} \right)$ રીપેરીંગ ખર્ચ (₹ ૫૦૦ × ૫૨ અઠવાડિયા) ચાંત્રિક કલાક દર	૪૮,૦૦૦ ૨૬,૦૦૦	૨૪.૦૦ ૧૩.૦૦ <u>૬૦.૪૦</u>

ઉદાહરણ: ૧૨ એક કારખાનું તેનું બધું જ કામ જ સરખા યંત્રો ફ્લાર કરે છે. કારખાનાનાં વાર્ષિક ખર્ચ નીચે મુજબ છે. કુલ ચાંત્રિક કલાકો ૮૦૦ છે.

(₹)

ભાડું અને વેરા	૪૨,૦૦૦
પાવર વપરાશ ચુનિટદીઠ ₹ ૧.૨૦	૩૩,૬૦૦
યંત્રોની ભરામત અને નિભાવ	૫,૭૨૦
કારખાના વીજળી	૫,૫૦૦
દેખરેખ રાખનાર બે મજૂરનો પગાર	૫,૦૪૦
સુપરવાઈઝરનો પગાર	૫૦,૪૦૦

પરચુરણ માલસામગ્રી	700
દરેક યંત્રનો ભાડા ખરીદનો હસો	₹, 800
(₹ 2,900 વ્યાજ સહિત)	
દરેક યંત્રનો ઘસારો	4,200
દરેક યંત્રનો કલાકદીઠ પાવરનો વપરાશ	35 ચુનિટ

ઉપરની માહિતી પરથી યાંત્રિક કલાક દરની ગણાતરી કરો.

(એસ.પી.ચુ., એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૫)

જવાબ:

યાંત્રિક કલાક:

$$= 33,600 \div 1.20 = 28,000 \text{ ચુનિટ} \div 35 \text{ ચુનિટ પ્રતિ કલાક}$$

$$= 800 \text{ કલાક} \div 4 \text{ યંત્રો} \div 200 \text{ કલાક યંત્રદીઠ}$$

યાંત્રિક કલાક દરની ગણાતરી દર્શાવતું પત્રક (૨૦૦ કલાકો)

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
<u>સ્થિર ખર્ચો:</u>		
ભાડું અને વેરા (42000 ÷ 4 યંત્રો)	10,400	
કારખાના વીજળી (5600 ÷ 4 યંત્રો)	1,400	
મજૂર પગાર (5040 ÷ 4 યંત્રો)	1,250	
સુપરવાઈઝર પગાર (50400 ÷ 4 યંત્રો)	12,500	
પરચુકરણ માલસામગ્રી (700 ÷ 4 યંત્રો)	175	
ભાડા ખરીદ હસાનું વ્યાજ	2,100	
કુલ સ્થિર ખર્ચ (28035 ÷ 200 કલાક)	28,035	140.175
<u>ચલિત ખર્ચો:</u>		
પાવર ખર્ચ (35 ચુનિટ × ₹ 1.20)	4,200	42.000
સમારકામ ખર્ચ (5720 ÷ 4 યંત્રો = 1430 ÷ 200 કલાક)	1,580	7.900
ઘસારો (4200 ÷ 200 કલાક)	21.000	21.000
યાંત્રિક કલાક દર	42315	211.575

ઉદાહરણ: ૧૩ નીચેની માહિતી પરથી ચંત્ર ‘અ’ના યાંત્રિક કલાક દરની ગણાતરી કરો.

(૧) યંત્રની કિંમત	₹ 19750/-
યંત્રની ભંગાર કિંમત	₹ 12000/-
ચંત્ર ગોઠવવાનો ખર્ચ	₹ 4500/-

	ચંત્રનું ઉપયોગી આયુષ્ય	૮ વર્ષ
(૨)	કારખાનાનું ભાડું અને વેરા (માસિક)	₹ ૧૦૦૦/-
	(કારખાનાની કુલ જગ્યામાં બીજા એકસરખા ૩ ચંત્રો ગોઠવેલ છે.)	
(૩)	ચંત્ર 'અ'નું વીમા પ્રિમિયમ (ત્રિમાસિક)	₹ ૮૩૭.૫૦
(૪)	ચંત્ર 'અ'નો પાવરનો વપરાશ (વાર્ષિક)	₹ ૩૦૦૦૦/-
(૫)	કારખાનાની વીજળી-બટી (દ્વિમાસિક)	₹ ૧,૫૦૦/-
	(કારખાનાના કુલ ૧૫ વીજળીના પોઇન્ટ્સમાંથી ચંત્ર 'અ' પુનર્નિર્માણ કરે છે.)	
(૬)	કામદારોનું વેતન (કામદારીઠ - માસિક)	₹ ૧,૬૦૦/-
	(કારખાનામાં કુલ ૩ કામદારો છે, જેઓ બધાં ચંત્રો પર સરખી દેખરેખ રાખે છે.)	
(૭)	કામદાર કલ્યાણ ખર્ચ (કામદારીઠ - વાર્ષિક)	₹ ૨,૪૦૦/-
(૮)	સુપરવાઈઝરનો પગાર (માસિક)	₹ ૫૦૦૦/-
	(સુપરવાઈઝર પોતાનો $\frac{3}{4}$ સમય બધાં ચંત્રોના સુપરવીઝનમાં ગાળે છે.)	
(૯)	ચંત્ર 'અ'નો ભાડે ખરીદનો હસ્તો (ઇ માસિક)	₹ ૧૦૦૦૦/-
	(વ્યાજ ₹ ૧૭૨૫/- સહિત)	
(૧૦)	ચંત્ર 'અ'નો સમારકામ અને નિભાવ ખર્ચ	₹ ૪૦૦૦૦/-
	(ઉપયોગી આયુષ્ય દરમ્યાન)	
(૧૧)	ચંત્ર 'અ'નો પાવરનો વપરાશ કલાકટીઠ રં ચુનિટ છે. ચુનિટટીઠ ભાવ ₹ ૩/-છે.	
		(એસ.પી.ચુ., એસ.વાચ.બી.કોમ., એપ્રિલ ૨૦૦૪)

જવાબ:

➤ વાર્ષિક કામના કલાકની ગણતરી:

$$\text{કલાકટીઠ રં ચુનિટ પાવર વપરાશ} = ૨ \text{ ચુનિટ} \times ₹ ૩ = ₹ ૬/-$$

$$\text{વાર્ષિક કામના કલાકો} = ૩૦૦૦૦ \div ₹ ૬/- = ૫૦૦૦ \text{ કલાકો}$$

ચાંત્રિક કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક (૫૦૦૦ કલાકો)

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
<u>સ્થિર ખર્ચો:</u>		
ભાડું અને વેરા ((૧૦૦૦ × ૧૨) ÷ ૪ ચંત્રો)	3,000	
વીમા પ્રિમિયમ (૮૩૭.૫૦ × ૪ ચંત્રો)	3,340	
વીજળી-બટી (૧૫૦૦ × ૬ = ₹૦૦૦૦ × $\frac{૪}{૧૫}$)	3,000	

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
કામદારોનું વેતન ($1600 \times 12 \times 3 = 57600 \div 4$ ચંત્રો)	14,400	
કામદાર કલ્યાણ ખર્ચ ($2400 \times 3 = 7200 \div 4$ ચંત્રો)	1,800	
સુપરવાઈઝરનો પગાર ($5000 \times 12 = 72000 \times \frac{3}{4} = 54000 \div 4$ ચંત્રો)	13,400	
ખરીદ હમાનું વ્યાજ (1725×2)	3,450	
કુલ સ્થિર ખર્ચ ($42400 \div 4000$ કલાક)	42,400	4.40
<u>સીધા ખર્ચ: (ચલિત ખર્ચ):</u>		
ઘસારો $\left(\frac{197400 + 4500 - 12000}{4 \text{ વર્ષ}} \right)$	20,000	4.00
સમારકામ અને નિભાવ ખર્ચ ($40000 \div 4$ વર્ષ)	4,000	1.00
પાવર	30,000	5.00
ચાંત્રિક કલાક દર	67400	16.40

ઉદાહરણ: ૧૪ નીચેની માહિતીને આધારે ચંત્ર ક્ષણ લગતા ચાંત્રિક કલાક દરની ગણતરી કરો.

- (૧) ચંત્રની કિંમત ₹ 320000/-
ચંત્રની બંગાર કિંમત ચંત્રની કિંમતના 10%
- ચંત્રનું અસરકારક આચુષ્ય ૧૬ વર્ષ
- (૨) દરેક ઓપરેટરની ભજૂરી અને બોનસ (માસિક) ₹ ૧૦૦૦/-
(બે ઓપરેટર્સ છે, જેઓ બંને ચંત્રોની સરખે હિસ્સે સંભાળ રાખે છે.)
- (૩) કારખાનાનું ભાડું અને વેરા (માસિક) ₹ ૩૦૦૦/-
- (૪) કારખાનાની વીજળી-બતી (માસિક) ₹ ૧૫૦૦/-
- (૫) ચંત્રના વીમાનું પ્રિમિયમ (વાર્ષિક) ₹ ૫૦૦૦/-
- (૬) સમારકામ અને નિભાવ ખર્ચ (વાર્ષિક) ₹ ૬૫૦૦/-
- (૭) ફોર્મેનનો પગાર(માસિક)
(જે પોતાના સમયનો $\frac{1}{4}$ સમય ચંત્રને આપે છે.) ₹ ૨૫૦૦/-
- (૮) ચંત્રનો પાવર વપરાશ કલાકદીઠ ૧૦ ચુનિટ અને ચુનિટના ભાવ દર ૧૦૦ ચુનિટદીઠ ₹ ૧૫૦/- છે.
- (૯) આ ચંત્ર કારખાનાની જગ્યાનો $\frac{1}{4}$ ભાગ રોકે છે.
- (૧૦) સામાન્ય રીતે આ ચંત્ર વર્ષમાં ૪૦૦૦ કલાક ચાલશે એવી અપેક્ષા છે, પણ એવો અંદાજ છે કે ૨૦૦ કલાકો સમારકામ પાછળ અને બીજા ૮૦૦ કલાકો સામાન્ય સ્ટેગારીંગને કારણે ગુમાવવા પડશે.

(એસ.પી.ચુ., એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૩)

જવાબ:

➤ વાર્ષિક કામના કલાકની ગણતરી:

કુલ કલાકો	4000	
બાદ: સમારકામ	200	
સ્ટેગરીંગ	200	આ એક પ્રકારનાં સામાન્ય બગાડ છે તેથી તેની પડતર ઉત્પાદકીય કલાકો વર્ચે વહેંચાશે તેથી તે બાદ કર્યા છે.
ચોખા વાર્ષિક કામના કલાકો	<u>3000</u>	

ચાંત્રિક કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક (3000 કલાકો)

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
<u>સ્થિર ખર્ચ:</u> ઓપરેટરની મજૂરી $((1000 \times 2 \times 12) \div 2 \text{ ચંત્રો)$ ભાડું અને વેરા (3000 \times 12 = 36000 \times \frac{1}{4}) વીજળી-બટી (1400 \times 12 = 16800 \times \frac{1}{4}) વીમા પ્રિમિયમ ફોર્મેનનો પગાર (2400 \times 12 = 30000 \times \frac{1}{4})	12,000 6,000 4,400 6,000 6,000	
કુલ સ્થિર ખર્ચ (37400 \div 3000 કલાક)	37,400	12.40
<u>ચલિત ખર્ચ:</u> ધસારો $\left(\frac{32000 - 32000}{16 \text{ વર્ષ}} \right)$ સમારકામ અને નિભાવ ખર્ચ પાવર (30000 ચુનિટ \times 150 \div 100)	12,000 6,000 45,000	5.00 3.30 15.00
ચાંત્રિક કલાક દર	1,10,100	35.40

ઉદાહરણ: ૧૫ નીચેની માહિતી પરથી ચાંત્રિક કલાક દર શોધો.

મશીન વર્ષ દરમ્યાન 60% શક્તિઅનુભૂતિ ચાલે છે. 10% સમય ચંત્ર ખોટકાવાથી બગાડે છે અને રવિવારને બાદ કરતાં દિવાળીની 3, હોળીની 2 અને 2 જાહેર રજાઓ હોય છે.

કારખાનું અઠવાડિયામાં ૫ દિવસ ચ કલાક અને શનિવારના રોજ ૪ કલાક કામ કરે છે.

મશીન રૂમનાં વાર્ષિક ખર્ચાઓ નીચે મુજબ છે.

પાવર	₹ 1,814/-
ફોર્મેનનો પગાર	₹ 1,200/-
મશીનરી રીપેરીંગ	₹ 607/-
ભાડું અને વેરા	₹ 1,200/-
લાઈટિંગ	₹ 640/-
ઓઇલ ખર્ચ	₹ 66/-
ધસારો	₹ 785/-

ભાડે ખરીદનો વાર્ષિક હસો (₹ ૮૧૫/- વ્યાજ સાથે) ₹ ૨,૫૦૦/-
 (એસ.પી.યુ., એસ.વાચ.બી.કોમ., એપ્રિલ ૨૦૦૮)

જવાબ:

➤	<u>વાર્ષિક કામના કલાકોની ગણતરી:</u>	
	વર્ષનાં કુલ દિવસોની સંખ્યા	૩૬૫ દિવસ
બાદ:	કુલ તહેવારો અને જાહેર રજાઓ:	
	(દિવાળી ૩ + હોળી ૨ + જાહેર રજાઓ ૨)	૭ દિવસ
		૩૫૮ દિવસ
બાદ:	રવિવાર (વર્ષના કુલ)	૫૨ દિવસ
		૩૦૯ દિવસ
બાદ:	શનિવાર (૪ કલાક કામનાં)	૫૨ દિવસ
		૨૫૪ દિવસ
ગુણો:	કામનાં કલાકો	૮ કલાકો
		૨૦૩૨ કલાકો
ઉમેરો:	શનિવારના કલાકો (૫૨ × ૪ કલાકો)	૨૦૮ કલાકો
		૨૨૪૦ કલાકો
	કુલ ક્ષમતાના ૬૦% ૨૦૧૬ કલાકો	
બાદ:	યંત્ર ખોટકાઈ જાય (૧૦%)	૨૦૨ કલાકો
	ખરેખર કામનાં કલાકો	૧૮૧૪ કલાકો
	યાંત્રિક કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક	(૧૮૧૪ કલાકો)

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
<u>સ્થિર ખર્ચ:</u>		
લાઈટિંગ	૬૪૦	
ફોર્મેનનો પગાર	૧,૨૦૦	
ઓઇલ ખર્ચ	૬૬	
ભાડું અને વેરા	૧,૨૦૦	
ભાડે ખરીદનો વ્યાજનો હસો	૮૧૫	
	કુલ સ્થિર ખર્ચ	૩,૬૨૧
<u>ચલિત ખર્ચ:</u>		૨.૧૬
પાવર	૧,૮૧૪	૦
મશીનરી શીપેરીંગ	૬૦૭	૧.૦૦
		૦.૫૦

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
ઘસારો	૭૮૫	૦.૪૩
ચાંત્રિક કલાક દર	૭,૪૨૭	૪.૦૯

ઉદાહરણ: ૧૬ નીચેની માહિતીને આધારે મશીન 'A'ના ચાંત્રિક કલાક દરની ગણતરી કરો.

- (૧) ચંત્રની કિંમત ₹ ૨૮૩૭૮૦/-
- (૨) ભંગાર કિંમત કિંમતના ૧૦%
- (૩) ગોઠવણી ખર્ચ ₹ ૧૬૨૨૦/-
- (૪) અંદાજુત આયુષ્ય ૧૫ વર્ષ
- (૫) કારખાના ભાડું અને વેરા (પ્રતિ માસ) ₹ ૧૨૦૦૦/-
- (૬) કારખાનાની કુલ જગ્યામાં આવા જ અન્ય ત્રણા ચંત્રો ગોઠવેલ છે.
- (૭) વીમા પ્રિમિયમ મશીન 'A' માટે (દર ૨ મહિને) ૦.૨૫%
- (૮) વાર્ષિક પાવરનો વપરાશ (મશીન 'A')
- (૯) કારખાના વીજળી ખર્ચ (પ્રતિ માસ) ₹ ૧૫૦૦/-
- (૧૦) મશીન 'A' પ લાઈટ પોઇન્ટનો ઉપયોગ કરે છે.
- (૧૧) કારખાનામાં કુલ ૧૫ લાઈટ પોઇન્ટ હોય.
- (૧૨) કામદારોની મજૂરી (પ્રતિ કામદાર - પ્રતિ માસ) ₹ ૨૮૦૦/-
- (૧૩) કારખાનામાં કુલ ૩ કામદારો છે. જે દરેક ચંત્રને સમાન રીતે ધ્યાન આપે છે.
- (૧૪) કામદાર કલ્યાણ ખર્ચ (પ્રતિ કામદાર - પ્રતિ વર્ષ) ₹ ૨૪૦૦/-
- (૧૫) સુપરવાઈઝરનો પગાર (પ્રતિ માસ) ₹ ૩૦૦૦/-
- (૧૬) સુપરવાઈઝર પોતાનો $\frac{3}{4}$ સમય ચંત્રો પાછળ વાપરે છે.
- (૧૭) સમારકભ અને નિભાવ ખર્ચ (અંદાજુત આયુષ્ય દરમ્યાન) ₹ ૨૫૦૦૦/-
- (૧૮) મશીન 'A' પ્રતિકલાક ૨ ચુનિટ પાવરનો ઉપયોગ કરે છે.
- (૧૯) પાવરનો દર ચુનિટીઠ ₹ ૩.૫૦ છે.
- (૨૦) ભાડે ખરીદનો મશીન 'A'નો હમ્બો (૭ માસિક) ₹ ૮૦૦૦/-
(₹ ૧૮૬૨.૫૦ વ્યાજ સાથે)

(એસ.પી.યુ., એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૭)

જવાબ:

➤ કામનાં કલાકોની ગણતરી:

$$\text{કામનાં કલાકો} = \frac{\text{કુલ પાવર ખર્ચ}}{\text{પ્રતિ કલાક ચુનિટ વપરાશ} \times \text{પ્રતિ ચુનિટ દર}} \\ (\text{પ્રતિ કલાક પાવર ખર્ચ})$$

$$= \frac{34000}{2 \times 3.40} = \frac{34000}{6} = 5000 \text{ કલાક}$$

યાંત્રિક કલાક દરની ગણતરી દર્શાવતું પત્રક (5000 કલાકો)

વિગત	વાર્ષિક ખર્ચ (₹)	કલાક દર (₹)
<u>સ્થિર ખર્ચ:</u>		
ભાડું અને વેરા ($12000 \times 12 \div 4$)	36,000	
વીમા પ્રિમિયમ ($283780 \times 0.25\% \times 5$)	4,257	
વીજળી ($1500 \times 12 \times \frac{4}{14}$)	5,000	
કામદાર કલ્યાણ ખર્ચ ($2400 \times 3 \times \frac{1}{4}$)	1,800	
સુપરવાઈઝરનો પગાર ($3000 \times 12 \times \frac{3}{4} \times \frac{1}{4}$)	5,745	
કામદારોની મજૂરી ($2800 \times 3 \times 12 \times \frac{1}{4}$)	25,200	
ભાડે ખરીદનો વ્યાજનો હસ્તો (1852.50×2)	3,725	
કુલ સ્થિર ખર્ચ	13,732	15.7454
<u>ચલિત ખર્ચ:</u>		0
ઘસારો $\left(\frac{283780 + 15220 - 30000}{14 \text{ વર્ષ}} \right)$	12,000	3.5000
પાવર	34,000	7.00
સમારકામ અને નિભાવ ખર્ચ ($25000 \div 14$)	1,557	0.3333
યાંત્રિક કલાક દર	138366	27.5767

સ્વાધ્યાત્મ

૧. કરણ પ્રોડક્શન લિમિટેડને પાંચ ઉત્પાદન વિભાગો A, B, C, D અને E છે. પરોક્ષ ખર્ચનાં નીચેનાં આંકડા કંપનીના ઓપડામાંથી લેવામાં આવ્યા છે.

(₹)

બાંડું	4,000/-
સામાન્ય વીજળી	500/-
પરોક્ષ મજૂરી	3,000/-
પાવર	1,400/-
મશીનરીનો ઘસારો	4,000/-
મશીનરીનો વીમો	10,000/-

કંપની નીચેની વધારાની માહિતી આપે છે.

	A	B	C	D	E
રોકેલ જગ્યા (ચો. મી.)	2,000	2,400	3,000	2,000	500
પોઇન્ટની સંખ્યા	10	14	20	10	5
સીધી મજૂરી	3,000	2,000	3,000	1,400	500
મશીનરીના હોર્સેપાવર	50	30	40	10	---
મશીનરીની કિંમત	3,0000	40,000	40,000	2,400	2,400

પરોક્ષ ખર્ચની વિવિધ વિભાગ વચ્ચે ફાળવણી કરો.

(એસ.પી.યુ., એસ. વાય. બી. કોમ., એપ્રિલ ૨૦૦૮)

(નોંધ: ઉપરોક્ત દાખલો પરીક્ષામાં અપેક્ષિત નથી. ફક્ત જાણકારી પૂરતો જ છે.)

૨. જથું એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં એ, બી, સી ત્રણ ઉત્પાદન ખાતાનો તથા ડી અને ઇ બે સેવા ખાતાઓ છે. કંપનીના રેકૉર્ડમાંથી નીચેની માહિતી પ્રાપ્ત થઈ છે.

- (૧) બાંડું ₹ 4,000/-
- (૨) જનરલ લાઈટિંગ ₹ 500/-
- (૩) પરોક્ષ વેતન ₹ 3,000/-
- (૪) પાવર ₹ 1,400/-
- (૫) ચંત્રોનો ઘસારો ₹ 4,000/-
- (૬) પરચ્યૂરણ ₹ 10,000/-

નીચેની વધારાની વિગતો છે.

વિગત	કુલ	એ	બી	સી	ડી	ઇ
જગ્યા (ચો. ફૂટ)	10,000	2,000	2,400	3,000	2,000	500
લાઈટિંગ પોઇન્ટ	50	10	14	20	10	5
પ્રત્યક્ષ વેતન (₹)	10,000	3,000	2,000	3,000	1,400	500
ચંત્રોના હોર્સેપાવર	140	50	30	40	10	---

યંત્રોની કિંમત	૧,૨૫,૦૦૦	૩૦,૦૦૦	૪૦,૦૦૦	૫૦,૦૦૦	૨,૫૦૦	૨,૫૦૦
કામનાં કલાકો	---	૬,૨૦૦	૪,૦૦૦	૪,૫૦૦	---	---

ડી અને ઈના ખર્ચની વહેંચણી નીચે પ્રમાણે કરવામાં આવે છે.

	એ	બી	સી	ડી	ઇ
ડી	૨૦%	૩૦%	૪૦%	---	૧૦%
ઇ	૩૦%	૪૦%	૨૦%	૧૦%	---

એક વસ્તુની કુલ પડતર કેટલી થશે, જો તેનો ભાલસામાનનો ખર્ચ ₹ ૫૦/-, મજૂરી ખર્ચ ₹ ૩૦/- અને તેને એ, બી અને સી ખાતામાંથી પસાર થવા માટે અનુકૂળ ૪, ૫ અને ૩ કલાક થતાં હોય?

(સરદાર પટેલ યુનિવર્સિટી, એસ. વાય. બી. કોમ., માર્ચ ૨૦૧૫)

3. એક કંપની પાસે ત્રણ ઉત્પાદન વિભાગો A, B અને C તથા બે સેવા વિભાગો X અને Y છે. ચોક્કસ સમયગાળા માટે કંપનાના ચોપડામાંથી નીચેના આંકડા મેળવવામાં આવ્યા છે.

(₹)

ભાડું અને વેરા	૨૫,૦૦૦/-
સામાન્ય વીજળી-બટી	૩,૦૦૦/-
પરોક્ષ મજૂરી	૭,૫૦૦/-
પાવર	૭,૫૦૦/-
ઘસારો	૫૦,૦૦૦/-
પરચૂરણ ખર્ચ	૫૦,૦૦૦/-

વધારાની ભાહિતિ:

વિગત	કુલ	A	B	C	X	Y
સીધી મજૂરી (₹)	૫૦,૦૦૦	૧૫,૦૦૦	૧૦,૦૦૦	૧૫,૦૦૦	૭,૫૦૦	૨,૫૦૦
યંત્રનાં હોર્સ્પાવર	૧૫૦	૬૦	૩૦	૫૦	૧૦	---
યંત્રની મૂળકિમત	૧૨,૫૦,૦૦૦	૩,૦૦,૦૦૦	૪,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦	૨૫,૦૦૦	૨૫,૦૦૦
રોકેલ જયા (ચો. મી.)	૧૦,૦૦૦	૨,૦૦૦	૨,૫૦૦	૩,૦૦૦	૨,૦૦૦	૫૦૦
વીજળીના પોઈન્ટ (સંખ્યા)	૬૦	૧૦	૧૫	૨૦	૧૦	૫
ઉત્પાદન વિભાગોના કામનાં કલાકો	---	૬,૨૨૯	૪,૦૨૮	૪,૦૬૬	---	---

સેવા વિભાગનાં ખર્ચની ફાળવણી:

	A	B	C	X	Y
X	૨૦%	૩૦%	૪૦%	---	૧૦%
Y	૪૦%	૨૦%	૩૦%	૧૦%	---

તમારે પુનરાવર્તી વહેંચણીની પ્રક્રિયાના આધારે ઉત્પાદન વિભાગો ખાતે ફાળવણી કરી પરોક્ષ ખર્ચના કલાકદીઠ દર નક્કી કરો.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, એસ. વાય. બી. કોમ., એપ્રિલ ૨૦૧૦, એક્ષટરનલ)

૪. એસકે અન્જુનીથર્ટીંગ કંપનીના ત્રણ ઉત્પાદન વિભાગો A, B અને C તથા બે સેવા વિભાગો X અને Y છે. કંપનીના હિસાબોમાંથી નીચેની માહિતી મળે છે.

(₹)

બાબું - વેરો	૮૦,૦૦૦/-
સામાન્ય દિવાબતી	૧૨,૦૦૦/-
પરોક્ષ મજૂરી	૧૮,૦૦૦/-
પાવર	૧૮,૦૦૦/-
મશીનનો ધસારો	૧,૬૦,૦૦૦/-
સામાન્ય ખર્ચ	૧,૦૦,૦૦૦/-

નીચેની વધારાની માહિતી પ્રાપ્ય છે.

વિગત	વિભાગ A	વિભાગ B	વિભાગ C	વિભાગ X	વિભાગ Y
રોકેલી જગ્યા (ચો. ફૂટ)	૪,૦૦૦	૫,૦૦૦	૬,૦૦૦	૪,૦૦૦	૧,૦૦૦
લાઇટ પોઈન્ટ	૨૦	૩૦	૪૦	૨૦	૧૦
પ્રત્યક્ષ મજૂરી (₹)	૨૪,૦૦૦	૧૬,૦૦૦	૨૪,૦૦૦	૧૨,૦૦૦	૪,૦૦૦
મશીનનાં H. P.	૧૨૦	૯૦	૧૦૦	૨૦	---
મશીનની કિંમત (₹)	૧,૨૦,૦૦૦	૧,૬૦,૦૦૦	૨,૦૦,૦૦૦	૧૦,૦૦૦	૧૦,૦૦૦
કામનાં કલાકો	૧૨,૦૦૦	૮,૦૦૦	૮,૪૦૦	---	---

સેવા વિભાગો X અને Yનાં ખર્ચાઓ નીચે મુજબ ફાળવવાનાં છે.

	A	B	C	X	Y
વિભાગ X	૨૦%	૩૦%	૪૦%	---	૧૦%
વિભાગ Y	૪૦%	૨૦%	૩૦%	૧૦%	---

જો કાચા માલની પડતર ₹ ૫૦/-, મજૂરી ₹ ૩૦/- હોય અને વસ્તુ A, B અને C વિભાગમાંથી પસાર થઈ અનુકૂળે C, ૧૨ અને ૪ કલાક ઉત્પાદન માટે લેતી હોય તો વસ્તુની કારખાના પડતર શું થશે?

(સરદાર પટેલ ચુનિવર્સિટી, એસ. વાય. બી. કોમ.-૩, નવેમ્બર ૨૦૧૮)

૫. નીચેની માહિતી ઉપરથી શિરોપરી ખર્ચની વસૂલાતનો કલાકદીઠ દર X, Y અને Z વિભાગ માટે પુનરાવર્તી પદ્ધતિ મુજબ શોધો.

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	X	Y	Z	I	U
ફાળવેલ ખર્ચ (₹)	૭,૫૫૦	૭,૨૦૦	૬,૯૫૦	૪,૯૨૫	૧,૫૭૫
કામનાં કલાકો	૫,૨૨૫	૪,૦૨૮	૪,૦૫૬	---	---
'I' વિભાગની ફાળવણી	૨૦%	૩૦%	૪૦%	---	૧૦%
'U' વિભાગની ફાળવણી	૪૦%	૨૦%	૩૦%	૧૦%	---

(સરદાર પટેલ યુનિવર્સિટી, એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૨)

૬. એક કંપનીમાં ત્રણ ઉત્પાદન વિભાગો અને બે સેવા વિભાગો છે. વહેંચણીનો સારાંશ નીચે પ્રમાણે છે.

વિગત	ઉત્પાદન વિભાગો			સેવા વિભાગો	
	P	Q	R	X	Y
ફાળવેલ ખર્ચ (₹)	૩,૭૭૫	૩,૬૦૦	૪,૮૨૫	૨,૩૧૨	૭૮૮
કામનાં કલાકો	૩,૧૧૩	૨,૦૧૪	૨,૦૩૩	---	---

સેવા વિભાગનાં શિરોપરી ખર્ચાઓની ફાળવણી નીચે મુજબ છે.

	P	Q	R	X	Y
વિભાગ 'X'	૨૦%	૩૦%	૪૦%	---	૧૦%
વિભાગ 'Y'	૪૦%	૨૦%	૩૦%	૧૦%	---

સેવા વિભાગનાં શિરોપરી ખર્ચાની ઉત્પાદન વિભાગો વર્ષે ફાળવણી પુનરાવર્તીત ફાળવણીની પદ્ધતિથી કરો અને ચાંત્રિક કલાક દર શોધો.

(સરદાર પટેલ યુનિવર્સિટી, એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૧)

૭. એક કારખાનામાં લગભગ બધું જ કામ એકસરખા ચાર ચંત્રો દ્વારા કરવામાં આવે છે.

વાર્ષિક (₹)

(૧) ભાડું અને વેરા	૧૨,૦૦૦/-
(૨) કારખાનાની વીજળી	૮૨૦/-
(૩) સમારકામ ખર્ચ	૧,૧૮૦/-
(૪) સુપરવીઝન ખર્ચ	૧,૨૬૦/-
(૫) ચંત્રની દેખરેખ રાખનાર બે મજૂરોનો પગાર દરેકને મહિને ₹ ૫૦૦/- લેખે	---
(૬) વપરાયેલ પાવર યુનિટના ૧૦ પૈસા લેખે	૪,૮૦૦/-
(૭) ચંત્રોનો ભાડા ખરીદનો હસો (₹ ૪૦૦/- વ્યાજ સહિતનો)	૧,૫૦૦/-
(૮) દરેક ચંત્રનો ઘસારો	૬૦૦/-
(૯) દરેક ચંત્રનો કલાકદીઠ પાવરનો વપરાશ ૧૦ યુનિટ છે.	

(૧૦) પરચૂરણ ભાલસામગ્રી ૪૨૦/-
યાંત્રિક કલાક દરની ગણતરી કરો.

(સરદાર પટેલ યુનિવર્સિટી, એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૨)

૮. એક ચંત્ર જાન્યુઆરી ૨૦૦૦માં ₹ ૫,૦૦,૦૦૦/--માં ખરીદેલું. ચંત્રોના કુલ ખર્ચ નવા ચંત્રને ગણિતે ₹ ૭૨,૦૦,૦૦૦/- હતા. નીચેની માહિતી પરથી ચંત્રિક કલાક દર શોધો.

 - ચંત્રનું અંદાજીત આયુષ્ય ૧૦ વર્ષ છે.
 - બંગાર કિંમત ૧૦ વર્ષ પછી ₹ ૫,૦૦૦/-.
 - સમારકામ અને મરામત (વાર્ષિક) ₹ ૩,૦૦૦/-.
 - સામાન્ય રીતે ચંત્ર વર્ષ દરમ્યાન ૪,૦૦૦ કલાક કામ કરે છે.
 - વીમો બધાં જ ચંત્રોનો (વાર્ષિક) ₹ ૪,૫૦૦/-.
 - ચંત્રનો વીજળી વપરાશ એક કલાકે ૨૫ યુનિટ (૭૫ પૈસા પ્રતિ યુનિટ)
 - રોકેલ જગ્યા નવા ચંત્રની ૧૦૦ ચો. ફૂટ.
 - રોકેલ જગ્યા બીજા ચંત્રોની ૧,૫૦૦ ચો. ફૂટ.
 - વિભાગનું ભાડું (માસિક) ₹ ૮૦૦/-.
 - આખા વિભાગનાં દિવાબતી ખર્ચ ૨૦ પોઇન્ટ જેમાંથી તૃ પોઇન્ટ નવા ચંત્રના ર ૧૨૦/- (૯૨ મહિનાનો ખર્ચ).

(સરદાર પટેલ યનિવર્સિટી, એસ.વાય.બી.કોમ., એપ્રિલ ૨૦૦૧)

- c. નીચે આપેલ માહિતીનાં આધારે યાંત્રિક કલાક દરની ગણતરી કરો.

યંત્રની કિંમત ₹ ૬૦,૦૦૦/- છે અને ગોઠવણીનો ખર્ચ ₹ ૧૦,૦૦૦/- છે. યંત્રની અંદાજુત ભંગાર કિંમત ₹ ૧૦,૦૦૦/- છે. યંત્રનું અસરકારક કામનું આયુષ્ય ૧૦ વર્ષ છે.

યંત્રને લગતા ખર્ચાઓ નીચે મુજબ છે.

 - (૧) સુપરવાઈઝરનો પગાર - માસિક - ₹ ૨,૦૦૦/-
 - (૨) ફોરમેનનો પગાર - ત્રિમાસિક - ₹ ૩,૦૦૦/-
 - (૩) કારખાનાનું ભાડું-વેરા - વાર્ષિક - ₹ ૨૪,૦૦૦/-
 - (૪) કારખાનાની સામાન્ય દિવાબતી - માસિક - ₹ ૩,૦૦૦/-
 - (૫) પાવર કલાકનાં ૧૦ ચુનિટ અને પાવરનો દર ૧૦૦ ચુનિટનાં ₹ ૮૦/-
 - (૬) વીમા પ્રિમિયમ - વાર્ષિક - ૧.૫% લેખે
 - (૭) ભાડે ખરીદનો અર્ધવાર્ષિક હસો - ₹ ૩,૦૦૦/- (₹ ૫૦૦/- વ્યાજ સહિત)
 - (૮) સમારકામ અને મરામત - વાર્ષિક - ₹ ૫,૦૦૦/-

યંત્ર વર્ષ દરમ્યાન ₹૦ ટકાની કાર્યશક્તિથી ચાલે છે અને ૧૦ ટકા યંત્ર ખોટવાય છે. વર્ષમાં રવિવારનાં દિવસને બાદ કરતાં બાર રજાઓ રહે છે. કારખાનું અઠવાડિયામાં પાંચ દિવસ દરમ્યાન ૮ કલાક અને શનિવારે ૪ કલાક ચાલે છે. યંત્ર કારખાનાની ૨૦ ટકા જરૂર રોકે છે. સુપરવાઈઝર પોતાના સમયનો $\frac{1}{4}$ ભાગ આ યંત્ર પર આપે છે. જથ્યારે ફોરમેન $\frac{1}{3}$ જેટલો સમય આ યંત્ર પર આપે છે. સામાન્ય દિવાબતીના ખર્ચ રોકેલી જરૂરાનાં પમાગામાં વહેંચવાનો છે.

(સરદાર પટેલ ચન્દીપટી, એસ.વાય.બી.કોઓ., અપ્રિલ ૩૦૦૦)

૧૦. નીચેની વિગતો પરથી ચાંત્રિક કલાક દર શોધો.

યંત્ર વર્ષ દરમયાન ૬૦%ની કાર્યશક્તિથી ચાલે છે. તેમાં ૪૩૨ કલાક મશીન ખોટકાય તે કારણે ગુમાવવા પડે છે. રવિવારના દિવસને બાદ કરતાં ત્રણ દિવાળીના, બે હોળીના અને બે નાતાલના દિવસની રજાઓ રહે છે. ફેફરી અઠવાડિયામાં પાંચ દિવસ દરમયાન ૧૫ કલાક ચાલે છે, જ્યારે શાનિવારે ૮ કલાક ચાલે છે.

યંત્રના ખર્ચ નીચે મુજબ છે.

- (૧) યંત્રની કિંમત રૂ ૬૦,૦૦૦/-
- યંત્રની ભંગાર કિંમત રૂ ૬,૦૦૦/-
- યંત્રનું ઉપયોગી આયુષ્ય ૧૦ વર્ષ
- (૨) યંત્રનું ભાડું અને વેરો (માસિક) રૂ ૪૦૦/-
- (૩) યંત્રની વીજળીબતી (વાર્ષિક) રૂ ૨,૮૦૦/-
- (૪) ફોર્મેનનો પગાર (વાર્ષિક) રૂ ૪,૮૦૦/-
- (૫) વીમા પ્રિમિયમ (વાર્ષિક) ૧%
- (૬) કામદારોની મજૂરી (માસિક) રૂ ૧,૦૦૦/-
- (૭) ભાડે ખરીદના હસા પર વ્યાજ રૂ૦૦૦/- (વાર્ષિક)
- (૮) યંત્રનું સમારકામ કલાકદીઠ રૂ ૧/-
- (૯) પરોક્ષ ખર્ચ રૂ ૨,૦૦૦/- (વાર્ષિક)
- (૧૦) ઓર્ડિલ ખર્ચ રૂ ૮૦૦/- (વાર્ષિક)
- (૧૧) કામદાર કલ્યાણ ખર્ચ (વાર્ષિક) રૂ ૨,૦૦૦/-
- (૧૨) પાવર વપરાશ કલાકદીઠ રૂ ૨૦૦૦/- છે.

(સરદાર પટેલ યુનિવર્સિટી, સત્ર - ૩, નવેમ્બર ૨૦૧૮)

૧૧. કંપનીએ નવું મશીન ખરીદું છે. આ સાથે બીજા પાંચ (૫) મશીન છે. મશીનની કુલ પડતર રૂ ૭,૫૦,૦૦૦/- છે. મશીનનું કાર્યરત જીવન ૧૫ વર્ષ છે અને તે સ્કેપ તરીકે રૂ ૩૦,૦૦૦/-માં વેચાશે. અન્ય વિગતો નીચે મુજબ છે.

- (૧) કામના નક્કી કલાકો : રોજના ૮ કલાક, ૩૦૦ દિવસ માટે, જેમાં ૪૦૦ કલાક મશીનની મરામતમાં જાય છે.
- (૨) મશીન એક કલાકમાં ૧૫ યુનિટ ખર્ચે છે. યુનિટદીઠ ભાવ રૂ ૨/- છે.
- (૩) મશીન ચલાવવા/ગરમ કરવા માટે એક ખાસ પ્રકારના ઓર્ડિલની જરૂર પડે છે. આ ઓર્ડિલ દર મહિને રૂ ૨,૫૦૦/-ની પડતરથી બદલવામાં આવે છે.
- (૪) મશીનની સારસંભાળનો દર અઠવાડિયે રૂ ૫૦૦/- ખર્ચ થાય છે. એક અઠવાડિયાના રૂ ૫ દિવસ છે.
- (૫) રૂ (૫) મશીનના આખા ગૃપને ચલાવવા રૂ ૩ ઓપરેટરો (કારીગરો)ની જરૂર છે. આ દરેક કારીગરને પગાર દર અઠવાડિયે રૂ ૪૫૦/- વતા ૪૦% ઈન્સેન્ટીવ છે.
- (૬) કારખાનાના વાર્ષિક શિરોપરી ખર્ચાઓ રૂ ૬૦,૦૦૦/- હતા. જેમાં આ વર્ષે ૧૨.૫૦%નો વધારો થશે.

ચાંત્રિક કલાક દરની ગણતરી કરો.

(સરદાર પટેલ યુનિવર્સિટી, એસ.વાય.બી.કોમ., માર્ચ ૨૦૧૪, એક્ષટરનલ)

૧૨. નીચેની વિગતો માર્ય, ૨૦૧૨ના સમયની એક ચંત્રને લગતી છે. જેના પરથી ચંત્રિક કલાક દર શોધો.

(₹)

(૧) ચંત્રની પડતર કિંમત	3,૬૦,૦૦૦/-
(૨) ઉપયોગી આચુષ્ણને અંતે ભંગાર કિંમત	૭૦,૦૦૦/-
(૩) અંદાજીત વાર્ષિક ભરામત અને સમારકામ	૧૨,૫૪૦/-
(૪) કારખાનાનું માસિક ભાડું	૭,૨૫૦/-
(૫) કામદારનો માસિક પગાર	૧,૦૫૦/-
(૬) ચંત્ર ચલાવવાનો માસિક રસાયણ ખર્ચ	૧,૬૦૦/-
(૭) માસિક પરોક્ષ ખર્ચ	૩,૫૦૦/-
(૮) વાર્ષિક વીમા પ્રિમિયમ દર ૧% લેખે	

અન્ય માહિતી:

(અ) ચંત્રનું અંદાજીત આચુષ્ણ	:	૨,૦૦,૦૦૦ કલાક
(બ) માસિક કલાક	:	૨,૦૦૦ કલાક
(ક) ચંત્રનો ગોઠવણી સમય	:	૧૦૦ કલાક
(દ) કલાકટીઠ પાવર વપરાશ દર પાંચ યુનિટ છે અને યુનિટટીઠ દર ૯.૫૦ લેખે છે.		
(ઘ) આ ચંત્ર પર ચાર કામદારો કાર્ય કરે છે, જે બીજા બે ચંત્રોની પણ દેખરેખ રાખે છે.		
(ઝ) આ ચંત્ર કારખાનાની $\frac{1}{4}$ ભાગની જગ્યા રોકે છે.		

(સરદાર પટેલ યુનિવર્સિટી, સત્ર - ૩, ડિસેમ્બર ૨૦૧૨)

★ ★ ★

પ્રકણણ: ૪

(૧) એકમ પડતર

- ૪.૧ પ્રસ્તાવના
- ૪.૨ પડતર પત્રકનો અર્થ અને વ્યાખ્યાઓ
- ૪.૩ પડતર પત્રકનાં હેતુઓ / કાચદાઓ
- ૪.૪ પડતરનાં ઘટકો / તત્ત્વો
- ૪.૫ પડતર પ્રક્રિયા
- ૪.૬ સ્ટોકની ગણાતરી - નફાની ગણાતરી
- ૪.૭ પડતર પત્રકનો નમૂનો
- ૪.૮ પડતર પત્રકનાં ઉદાહરણો
- ૪.૯ ટેન્કર અને ટેન્કરનું પત્રક
- ૪.૧૦ ટેન્કર પત્રકનાં ઉદાહરણો

☞ સ્વાધ્યાય

૪.૧ પ્રસ્તાવના:

એકમ પડતર એટલે એકમદીઠ ઉત્પાદન પડતર શોધવી. જે ધંધામાં ઉત્પાદન એકસમાન વસ્તુનું અને સતત થતું રહેતું હોય તેવા ધંધામાં તથા જ્યાં મોટા પ્રમાણમાં એકસમાન એકમોનું ઉત્પાદન થતું હોય અને વસ્તુઓનું કદ, આકાર અને ગુણવત્તા પણ એકસમાન હોય ત્યારે એકમદીઠ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. એકમદીઠ પડતર પદ્ધતિ ખાસ કરીને ખાણ ઉધોગો, સિમેન્ટ ઉધોગ, ઇંટ ઉધોગ જેવાં ઉધોગમાં થાય છે. આમ, આ પદ્ધતિથી એકમદીઠ પડતર નક્કી કરવામાં ઉપયોગી હોવાથી તેને એકમ પડતર કહે છે. વિવિધ પડતરનાં એકમો તરીકે ટન, મીટર, કિલોગ્રામ, ગેલન, લિટર જેવાં પડતર એકમોનો ઉપયોગ થાય છે.

૪.૨ પડતર પત્રકનો અર્થ અને વ્યાખ્યાઓ:

૪.૨.૧ પડતર પત્રકનો અર્થ:

પડતર પત્રક એ પડતરનાં વિવિધ ઘટકો દર્શાવતું પત્રક છે. જે ઉત્પાદનનો કુલ ખર્ચ અને એકમદીઠ પડતર બતાવે છે. પડતરનાં વિવિધ ઘટકો જેવાં કે ભાલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ કે જે પ્રત્યક્ષ અને પરોક્ષ હોય છે. આ વસ્તુનું ઉત્પાદન અલગ પાડેલ ખર્ચ છે. આ પત્રક ગત વર્ષની વિગતો પણ દર્શાવતું હોય છે. જેનો ઉપયોગ પ્રવર્તમાન વર્ષ સાથે ગયા વર્ષની સરખામણી માટે ઉપયોગી થાય છે. આ પ્રકારની સરખામણીથી પડતરનું વર્ગીકરણા, સરખામણી અને તેની ગ્રુપ્ટિઓને જાણી શકાય છે.

૪.૨.૨ પડતર પત્રકની વ્યાખ્યાઓ:

- (૧) જે. આર. બાટીલોયના મતે, - “પડતરનું પત્રક એ ગણતરીનું પત્રક છે, કે જે સામાન્ય રીતે નિશ્ચિત સમયની કુલ ઉત્પાદનની વિગતપૂર્ણ પડતર દર્શાવે છે. તે દ્વિનોંધી હિસાબની પડતરની ગણતરીનું પત્રક નથી. આ પડતર પત્રકમાં વધારાના ખાના રાખીને જે-તે સમયની પાછલા વર્ષની પડતરની તુલનાત્મક સરખામણી દર્શાવી શકાય છે.”
- (૨) વોલ્ટર બિગના મતે, - “નાણાંકિય પત્રક પરથી ઉત્પાદન માટે થતા ખર્ચને શોધવામાં આવે છે અને તે કામચલાઉ પત્રકમાં ગોઠવવામાં આવે છે. આ પત્રકને જે-તે સમયના ઉત્પાદન સાથેની પડતર સાથે દર્શાવવામાં આવે તો તેને પડતર પત્રક કહેવાય છે.”

૪.૩ પડતર પત્રકનાં હેતુઓ / ફાયદાઓ:

પડતર પત્રકનાં હેતુઓ / ફાયદાઓ નીચે મુજબ છે.

- (૧) તે ઉત્પાદન પાછળનો કુલ ખર્ચ / પડતર અને એકમદીઠ પડતર શોધે છે / બતાવે છે.
- (૨) તે પડતરનાં વિવિધ ઘટકોની માહિતી આપે છે.
- (૩) એકમદીઠ પડતરના આધારે વેચાણ કિમત શોધી શકાય છે.
- (૪) તે ગત વર્ષની વિગતો સાથે સરખામણીનો આધાર પૂરો પાડે છે. આના કારણે પડતર પર અંકુશ રાખી શકાય.
- (૫) વિવિધ નિર્ણયોમાં તે મદદરૂપ થાય છે.
- (૬) ખર્ચાઓનું તેની કામગીરીના આધારે વર્ગીકરણ દર્શાવે છે.

૪.૪ પડતરનાં ઘટકો / તત્ત્વો:

પડતર પત્રક બનાવવા પડતરનું વર્ગીકરણ જરૂરી છે અને તે મુખ્યત્વે ત્રણ ઘટકમાં વહેંચાય છે.

૪.૫ ભાલસામાન:

આ પ્રત્યક્ષ ખર્ચ છે, જે ઉત્પાદન પ્રક્રિયા સાથે સીધેસીધો સંબંધ ધરાવે છે અને ભાલસામાન એ કુલ પડતરનો મહત્વ ભાગ ધરાવે છે. ભાલસામાન પડતરમાં ભાલસામાન ખરીદી તથા ખરીદીને લગતાં ખર્ચ જેવાં કે, આવકમાલગાડાભાડું, રેલ્વેન્ટર, કસ્ટમ ડ્યુટી, વગેરેનો સમાવેશ થાય છે.

(२) **મજૂરી:**
મજૂરી પણ પ્રત્યક્ષ ખર્ચ છે. તેને ઉત્પાદક મજૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો પ્રાથમિક પડતરમાં સમાવેશ કરાય છે.

(३) **પરોક્ષ ખર્ચ:**
ઉપર જણાવેલ પ્રથમ બે ખર્ચ એ ઉત્પાદનનાં પ્રત્યક્ષ ખર્ચા છે, જ્યારે આ સિવાયનાં ઉત્પાદનને લગતાં ખર્ચ પરોક્ષ ખર્ચા તરીકે ગણાય છે. જેમાં માલસામાન પરોક્ષ ખર્ચ, પરોક્ષ મજૂરી, કારખાના ખર્ચ, ઓફિસ ખર્ચ તથા વેચાણ-વિતરણનાં ખર્ચાઓનો સમાવેશ થાય છે. આ બધાં ખર્ચ ઉત્પાદન સાથે પરોક્ષ સંબંધ ધરાયે છે અને આ ખર્ચાઓ શિરોપરી ખર્ચા તરીકે પણ ઓળખાય છે.

૪.૫ પડતર પ્રક્રિયા:

પડતર પ્રક્રિયા એ કોઈ નિશ્ચિત સમયના આધારે થતી પ્રક્રિયા નથી, પરંતુ તે સતત અને સમયાંતરે કરવામાં આવતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા વસ્તુના ઉત્પાદન ખર્ચની માહિતી મેળવી શકાય છે. જેને પડતર પત્રક દ્વારા જાણી શકાય છે. પડતર પત્રક કુલ પડતર તથા એકમદીઠ પડતર શોધી આપે છે. જેનાં દ્વારા એકમદીઠ વેચાણ કિંમત પણ મેળવી શકાય છે.

$$\text{એકમદીઠ પડતર} = \frac{\text{કુલ પડતર}}{\text{કુલ ઉત્પાદન}} \quad (\text{એકમોમાં})$$

આમ, જો કુલ ઉત્પાદનને ઉત્પાદિત એકમો વડે ભાગવામાં આવે તો એકમદીઠ પડતર મેળવી શકાય.

૪.૬ સ્ટોકની ગણતરી - નફાની ગણતરી:

પડતર પત્રકમાં સ્ટોકની અને નફાની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા નીચે મુજબ છે.

* સ્ટોકની ગણતરી:

સ્ટોક સામાન્ય રીતે ત્રણ પ્રકારનો હોય છે. જેમાં કાચામાલનો સ્ટોક, અર્ધ તૈયારમાલનો સ્ટોક અને તૈયાર માલના સ્ટોકને ધ્યાનમાં લેવાય છે.

(૧) કાચામાલના સ્ટોકનું મૂલ્યાંકન:

પડતર પત્રકમાં સૌ પ્રથમ કાચામાલની વપરાશ પડતર શોધવામાં આવે છે. આ પડતર શોધતી વખતે કાચામાલનો શરૂનો અને આખરનો સ્ટોક ધ્યાનમાં લેવામાં આવે છે. જેની ગણતરી નીચે મુજબ છે.

	કાચામાલનો શરૂનો સ્ટોક	---
+	કાચામાલની ખરીદી	---

-	કાચામાલના ભંગાળું વેચાણ	---

-	કાચામાલનો આખરનો સ્ટોક	---
	વપરાશેલ કાચામાલની પડતર	---

નોંધ: કાચામાલનું કે આડપેદાશનું વેચાણ પ્રાથમિક પડતર પહેલાં બાદ કરવામાં આવે છે.

(૨) અર્ધતૈયારમાલના સ્ટોકનું મૂલ્યાંકન:

અર્ધતૈયારમાલના સ્ટોકને પડતર પત્રકની પ્રાથમિક પડતર અને કારખાના ખર્ચ સાથે સમાવવામાં આવે છે. તેનો શરૂઆતનો સ્ટોક ઉમેરવામાં આવે છે, જ્યારે આખરનો સ્ટોક બાદ કરવામાં આવે છે.

કેટલાંક લેખકોના મતે અર્ધતૈયારમાલના સ્ટોકને પ્રાથમિક પડતર બાદ તેનો સમાવેશ કરવામાં આવે છે અને તેના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ, અર્ધતૈયારમાલનું મૂલ્યાંકન નીચે મુજબ બેઠીતે કરી શકાય છે.

(અ) પ્રાથમિક પડતરના ધોરણે અર્ધતૈયારમાલનું મૂલ્યાંકન:

	પ્રત્યક્ષ ભાલસામાન	---
+	પ્રત્યક્ષ મજૂરી	---
+	સીધા ખર્ચ	---
+	અર્ધતૈયારમાલનો શરૂઆતનો સ્ટોક	---

-	અર્ધતૈયારમાલનો આખરનો સ્ટોક	---

(બ) કારખાના પડતરના ધોરણે અર્ધતૈયારમાલનું મૂલ્યાંકન:

	વપરાયેલ કાચારમાલની પડતર	---
+	પ્રત્યક્ષ મજૂરી	---
+	પ્રત્યક્ષ ખર્ચ	---
	પ્રાથમિક પડતર	---
+	કારખાના પરોક્ષ ખર્ચ	---

+	અર્ધતૈયારમાલનો શરૂઆતનો સ્ટોક	---

-	અર્ધતૈયારમાલનો આખરનો સ્ટોક	---

	કારખાના પડતર	---

(૩) તૈયારમાલના સ્ટોકનું મૂલ્યાંકન:

તૈયારમાલના સ્ટોકની ગણતરી ઉત્પાદન પડતર પછી કરવામાં આવે છે. તૈયારમાલનો શરૂઆતના સ્ટોકને ઉત્પાદન પડતરમાં ઉમેરવામાં આવે છે અને આખરનો સ્ટોક તેમાંથી બાદ કરવામાં આવે છે. આમ, ત્યારબાદ આપણાને વેચેલ માલની ઉત્પાદન પડતર મળશે. તૈયારમાલના સ્ટોકનું મૂલ્યાંકન નીચે મુજબ છે.

	કારખાના ખર્ચ	---
+	ઓફિસ ખર્ચ	---
	ઉત્પાદિત માલની પડતર	---
+	તૈયારમાલનો શરૂઆતનો સ્ટોક	---

-	તૈયારમાલનો આખરનો સ્ટોક	---
	વેચેલ માલની ઉત્પાદન પડતર	---

નોંધ: તૈયારમાલના સ્ટોકનું મૂલ્યાંકન ઓફિસ પડતરના ધોરણે કરવામાં આવે છે.

*** નફાની ગણતરી:**

ઉત્પાદનની કુલ પડતર બાદ તેની વેચાણ કિંમત નક્કી કરવા માટે અમુક ટકા તેમાં નફો કંપનીની નીતિ મુજબ ઉમેરવો પડતો હોય છે. આ નફો બે પ્રકારે હોય છે.

(૧) પડતરના અમુક ટકા લેખે

(૨) વેચાણ કિંમતના અમુક ટકા લેખે

વેચાણ કિંમત = પડતર કિંમત + ચોખ્ખો નફો

પડતર કિંમત = વેચાણ કિંમત - ચોખાનો નફો

નફાની ગાણતરી માટે જે ટકા આપ્યા હોય તેને ૧૦૦% ધારીને તેની ગાણતરી કરવી.

(૧) જો નફો પડતરના અમુક ટકા આપેલ હોય તો,

$$\text{નફો} = \text{વેચાણ પડતર} \times \frac{\text{આપેલ ટકાનો દર}}{100}$$

(૨) જો નફો વેચાણ કિંમતના અમુક ટકા આપેલ હોય તો,

$$\text{નફો} = \text{વેચાણ પડતર} \times \frac{\text{આપેલ ટકાનો દર}}{(100 - \text{આપેલ ટકાનો દર})}$$

ઉપર મુજબનાં સૂત્રોની મદદથી, સામાન્ય રીતે વેચાણ સાથે પડતરની ટકાવારી નીચે મુજબ કરી શકાય.

વેચાણની ટકાવારી		પડતરની ટકાવારી	
૨૫%	૧/૪	૩૩.૩૩૩%	૧/૩
૩૩.૩૩૩%	૧/૩	૫૦%	૧/૨
૨૦%	૧/૫	૨૫%	૧/૪
૫૦%	૧/૨	૧૦૦%	૧

૪.૭ પડતર પત્રકનો નમૂનો:

કંપનીનું પડતર પત્રક

(ઉત્પાદન એકમો)

વિગતો	કુલ ખર્ચ પડતર	ઓકમદીન પડતર
કાચામાલનો શરૂઆતનો સ્ટોક	---	
ઉનેરો: કાચામાલની ખરીદી	---	
ઉનેરો: આવકમાલગાડાભાડું અને અન્ય ખરીદીના ખર્ચ (પ્રત્યક્ષ)	---	
બાદ: કાચામાલનો આખર સ્ટોક	કુલ	---
ઉનેરો: પ્રત્યક્ષ ઉત્પાદન મજૂરી અન્ય પ્રત્યક્ષ ખર્ચ	વપરાયેલ માલની પડતર	---
ઉનેરો: કારખાના પરોક્ષ / શિરોપદી ખર્ચ	---	---
પરોક્ષ માલસામાન	---	---
પરોક્ષ મજૂરી	---	---
વીજળી ખર્ચ	---	---
ગેસ-પાણી	---	---
ઓઇલ	---	---
કોલસો	---	---
કારખાનાનું ભાડું-વેરો	---	---
વીમા પ્રિમીયમ	---	---
સુપરવાઈઝરનો પગાર	---	---
કારખાના રસ્ટેશનરી	---	---
મરામત અને સમારકામ	---	---

વિગતો	કુલ ખર્ચ પડતર	એકમાર્ટ પડતર
કેન્ટીનનાં ખર્ચ બળતાણ ખર્ચ સ્ટોર કીપરનો પગાર ફ્રોંચિંગ ઓફિસરનો પગાર પ્રાવિદન્ટ ફંડ કામદાર કલચાણ ખર્ચ કામદાર રાખ વીમા યોજનામાં ફાળો ટેકનીકલ ડિરેક્ટરની ફી ટેકનીકલ સામચિકનું લવાજમ ઓજારોનો ધસારો બળતાણ, ચ્યુલિકેટીંગ બિનઉંટપાદક સમયની મજૂરી સંબોધન ખર્ચ આંતરિક ટ્રાન્સપોર્ટ ખર્ચ	---	---
બાદ: ઉમેરો:	બંગારનું વેચાણ અધ્યતૈયારમાલનો શરૂ.નો સ્ટોક	---
બાદ: ઉમેરો:	અધ્યતૈયારમાલનો આખર સ્ટોક <u>કારખાના પડતર</u> ઓફિસ / વહીવટી / શિરોપરી ખર્ચ:	---
	ઓફિસ કારીગરનો પગાર ઓફિસ ભાડું-વેચ ડિરેક્ટરની ફી સ્ટેશનરી ખર્ચ ઓફિસ વહીવટી ખર્ચ કાનૂની ખર્ચ ઓફિસ વીજણી ઓડિટ ફી કર્મચારી મોટરનો વીમો કર્મચારી મોટરનો ધસારો પોસ્ટેજ ઓફિસ સાધન પરનો ધસારો પ્રિન્ટિંગ ખર્ચ વેપારી સામચિકનું લવાજમ ફર્નિયરનો ધસારો તાર-ટપાલ ખર્ચ	---
ઉમેરો:	<u>ઉત્પાદિત માલની પડતર</u> તૈયારમાલનો શરૂઆતનો સ્ટોક	---
બાદ: ઉમેરો:	તૈયારમાલનો આખરનો સ્ટોક <u>વેચેલ માલની ઉત્પાદન પડતર</u> <u>વેચાણ વિતરણ ખર્ચ:</u>	---
	જાહેરાત ખર્ચ જાવકમાલગાડાભાડું શો રૂમનું ભાડું ધાલખાધ પેકીંગ ખર્ચ સેલ્સમેનનો પગાર અને ખર્ચ ડિલીવરી વાનનો ધસારો ડિલીવરી વાનનો નિભાવ ખર્ચ	---

વિગતો	કુલ ખર્ચ પડતર	એકમદીઠ પડતર
મુસાફરી ખર્ચ	---	
સ્ટેશનરી ખર્ચ	---	
વેચાણ ડિરેક્ટરની ફી	---	
વેચાણ મેળજરનો પગાર	---	
શો રૂમનો ખર્ચ	---	
પ્રાઇસ લિસ્ટ છપામણી ખર્ચ	---	
લવાજમ	---	
વેચાણ ઓફિસ ખર્ચ	---	
નમૂના વિતરણ ખર્ચ	---	
આપેલ વટાવ	---	
વેચાણ શાખાનો ખર્ચ	---	
વેચાણ પડતર / કુલ પડતર		---
ઉમેરો: નંદો		---
વેચાણ મૂલ્ય		---

* જ્યારે પડતર પત્રક બનાવવામાં આવે છે ત્યારે નીચે જણાવેલ મુદ્દાને દ્યાનમાં લેવામાં આવતા નથી, જેની નોંધ લેવી.

૧)	ચૂક્યેલ વ્યાજ	૧૦)	કરવેરાની જોગવાઈ
૨)	માંડી વાળેલ પાઘડી	૧૧)	સ્ક્રીટ ડિવિડન્ડ
૩)	માંડી વાળેલ પેટન્ટ	૧૨)	ધારખાધની જોગવાઈ
૪)	માંડી વાળેલ ટ્રેડમાર્ક	૧૩)	દાન / સપ્નાવત
૫)	માંડી વાળેલ કોપીરાઇટ	૧૪)	ચૂક્યેલ કરવેલો
૬)	રોકડ વટાવ	૧૫)	વટાવ અનામત
૭)	મિલકત વેચાણની ખોટ / નંદો	૧૬)	દંડ
૮)	આવકો	૧૭)	સામાન્ય અનામત તેમજ અન્ય નફાની ફાળવણી
૯)	માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો		

૪.૮ પડતર પત્રકનાં ઉદાહરણો:

ઉદાહરણ: ૧ અક્ષય લિમિટેડના ચોપકેથી પડતર વિષેની નીચેની માહિતી મેળવેલ છે.

ઉત્પાદન અને વેચાણ	₹	૧૦,૦૦૦ એકમો
પ્રત્યક્ષ માલસામાન		૨૦,૦૦૦
પ્રત્યક્ષ મફૂરી		૧૨,૦૦૦
પ્રત્યક્ષ ખર્ચ		૪,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ		૧૬,૦૦૦
ઓફિસ પરોક્ષ ખર્ચ		૨૦,૦૦૦
વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચ		૮,૦૦૦

એકમ પડતર પત્રક બનાવો અને જો નફાની ટકાવારી ૨૦% પડતર પર હોય તો એકમદીઠ પડતર શોધો.

જવાબ:

અક્ષય લિમિટેડનું પડતર પત્રક

(ઉત્પાદન એકમો ૧૦,૦૦૦)

વિગત		કુલ રકમ (₹)	એકમાર્ગ (₹)
પ્રત્યક્ષ ભારતસામાન		૨૦,૦૦૦	૨.૦૦
	પ્રત્યક્ષ મજૂરી	૧૨,૦૦૦	૧.૨૦
	પ્રત્યક્ષ ખર્ચ	૪,૦૦૦	૦.૪૦
(અ) કારણાના પરોક્ષ ખર્ચ	પ્રાથમિક પડતર	૩૫,૦૦૦	૩.૫૦
		૧૬,૦૦૦	૧.૬૦
(બ) ઓફિસ પરોક્ષ ખર્ચ	કારણાના પડતર	૫૨,૦૦૦	૫.૨૦
		૨૦,૦૦૦	૨.૦૦
(ક) વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચ	ઉત્પાદન પડતર	૭૨,૦૦૦	૭.૨૦
		૮,૦૦૦	૦.૮૦
(ક) વેચાણ પડતર		૮૦,૦૦૦	૮.૦૦
		૨૦,૦૦૦	૨.૦૦
નંબો (વેચાણ પડતરનાં ૨૫%)	(દ)	૧૦,૦૦,૦૦૦	૧૦.૦૦

ઉદાહરણા: ૨ અંદો લિમિટેડની પકતરની વિગતો નીચે મુજબ છે.

	(₹)
કાચો માલસામાન:	૬,૫૦૦
શરૂઆતનો સ્ટોક	૬,૦૦૦
આખરનો સ્ટોક	૮,૦૦૦
અધીતૈયારમાલ:	૬,૦૦૦
શરૂઆતનો સ્ટોક	૪,૦૦૦
આખરનો સ્ટોક	૮,૦૦૦
તૈયાર માલ: શરૂઆતનો સ્ટોક	૨,૦૦૦
આખરનો સ્ટોક	૧૨,૦૦૦
કોર્ષેનનો પગાર	૧૮,૦૦૦
કારખાના સુપરવાઇઝરનો પગાર	૨૪,૦૦૦
હિસાબનીશાળો પગાર	૪૦,૦૦૦
ઓફિસ સ્ટાફનો પગાર	૧૦,૦૦૦
વીજળી ખર્ચો:	
ચંત્રો છારા વપરાયેલ વીજળી	૧૦,૦૦૦
કારખાના વીજળી ખર્ચી	૪,૦૦૦
ઓફિસ વીજળી ખર્ચી	૫,૦૦૦
પ્રત્યક્ષ ઉત્પાદન ખર્ચી	૪,૦૦૦
અન્ય કારખાના ખર્ચી	૨,૦૦૦
અન્ય ઓફિસ ખર્ચી	૩,૦૦૦
ડિલીવરી વાણના ખર્ચી	૪૦૦
ભાવપત્રક છપામણી ખર્ચ	૧,૦૦૦
વિકેતાનું કમિશન	૫,૨૦૦
જહેરાત અને વેચાણ વુર્દી ખર્ચી	૨,૪૦૦
કાચા માલસામાનની ખરીટી	૪૦,૦૦૦
આવકમાલગાડાભાડું	૪૦૦
વેચાણ	૨,૦૦,૦૦૦

એકમ પડતર પત્રક બનાવો અને કાચા ભાલ વપરાશ પડતર, પ્રાથમિક પડતર, કારખાના ખર્ચો, ઉત્પાદન પડતર, વેચાણ પડતર અને નકો શોધો. નજીની ટકાવારી શોધો.

નોંધ: અર્ધતૈયાર ભાલના સ્ટોકનું કારખાના પડતરનાં આધારે મૂલ્યાંકન કરો.

જવાબ:

૩૦ લિમિટેડનું પડતર પત્રક

	વિગત	રકમ (₹)	કુલ પડતર (₹)
ઉમેરો:	કાચા માલસામાનનો શરૂઆતનો સ્ટોક ખરીદી આવકમાલગાડાભાડું	૯,૫૦૦ ૪૦,૦૦૦ ૪૦૦ ૫૦,૦૦૦ ૮,૦૦૦ ૪૨,૦૦૦ ૧૮,૦૦૦ ૧૦,૦૦૦ ૪,૦૦૦	
બાદ:	કાચા માલસામાનનો આખરનો સ્ટોક વપરાયેલ કાચા માલની પડતર	૮,૦૦૦ ૪૨,૦૦૦ ૧૮,૦૦૦ ૧૦,૦૦૦ ૪,૦૦૦	
ઉમેરો:	ફોરેનજનો પગાર ચંત્રો છ્ણા વપરાયેલ વીજળી પ્રત્યક્ષ ઉત્પાદન ખર્ચ	૧૮,૦૦૦ ૧૮,૦૦૦ ૧૦,૦૦૦ ૪,૦૦૦	
ઉમેરો:	કારખાના પરોક્ષ ખર્ચ: કારખાના સુપરવાઈઝરનો પગાર કારખાના વીજળી ખર્ચ અન્ય કારખાના ખર્ચ	૨૪,૦૦૦ ૪,૦૦૦ ૩,૦૦૦ ૩૧,૦૦૦ ૬,૦૦૦ ૩૭,૦૦૦ ૪,૦૦૦	૭૪,૦૦૦
ઉમેરો:	અર્ધતૈયારમાલનો શરૂઆતનો સ્ટોક	૩૧,૦૦૦	
બાદ:	અર્ધતૈયારમાલનો આખરનો સ્ટોક	૩૭,૦૦૦ ૪,૦૦૦	૩૩,૦૦૦
ઉમેરો:	કારખાના પડતર વહીવટી પરોક્ષ ખર્ચ: હિસાબનીશનો પગાર ઓફિસ વીજળી ખર્ચ ઓફિસ સ્ટાફનો પગાર	૪૦,૦૦૦ ૬,૦૦૦ ૧૦,૦૦૦	૧,૦૭,૦૦૦
ઉમેરો:	ઉત્પાદિત માલની પડતર તૈયારમાલનો શરૂઆતનો સ્ટોક	૫૬,૦૦૦ ૧,૬૩,૦૦૦ ૨૦,૦૦૦	
બાદ:	તૈયારમાલનો આખરનો સ્ટોક વેચેલ માલની ઉત્પાદન પડતર	૧,૮૩,૦૦૦ ૧૨,૦૦૦ ૧,૭૧,૦૦૦	
ઉમેરો:	વેચાણ અને વિતરણ પરોક્ષ ખરાયા: ડિલીવરી વાનના ખર્ચ ભાવપત્રક છપામણી ખર્ચ વિકેતાનું કમિશન જાહેરત અને વેચાણ વૃદ્ધિ ખર્ચ	૪૦૦ ૧,૦૦૦ ૫,૨૦૦ ૨,૪૦૦	
ઉમેરો:	વેચાણ પડતર નશે (નાકી રહેતી રકમ) (તફાવત)	૬,૦૦૦ ૧,૮૦,૦૦૦ ૨૦,૦૦૦	
	વેચાણ	૨,૦૦,૦૦૦	

$$\begin{aligned}
 \text{નફાની ટકાવારી} &= \frac{\text{નકો}}{\text{વેચાણ}} \times 100 \\
 &= \frac{૨૦,૦૦૦}{૨,૦૦,૦૦૦} \times 100 = \text{વેચાણના } \underline{\underline{10\%}}
 \end{aligned}$$

ઉદાહરણ: ૩ ડિસેમ્બર ૨૦૧૮ માસ દરમ્યાન ૩૨,૦૦૦ એકમોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જેમાંથી રૂ.૭,૦૦૦ એકમો રૂ.૮ એકમદીઠ લેખે વેચાણ કરેલ. વપરાયેલ કાચાભાલની પડતર રૂ.૧,૨૦,૦૦૦ હતી અને પ્રત્યક્ષ મજૂરી રૂ.૩૨,૮૫૦ ચૂકવેલ. કારખાના ખર્ચ રૂ.૫ થાંત્રિક કલાક મુજબ કલાકે ઉત્પાદન પર ગણોલ અને માસ દરમ્યાન રૂ.૪૦૦ કલાક કામ થયેલ છે. ઓફિસ ખર્ચ કારખાના પડતરના ૨૦% લેખે ગણવા અને વેચાણ ખર્ચ એકમદીઠ ૨૫ પૈસા ગણવા. એકમ પડતર પત્રક બનાવો અને એકમદીઠ પડતર અને ડિસેમ્બર ૨૦૧૮નો નફો શોધો.

જવાબ:

ડિસેમ્બર ૨૦૧૮ના માસનું પડતર પત્રક

(ઉત્પાદન એકમો ૩૨,૦૦૦)

	વિગત	રકમ (₹)	એકમદીઠ પડતર (₹)
ઉમેરો:	વપરાયેલ કાચાભાલની પડતર	૧,૨૦,૦૦૦	૩.૭૫૦
	પ્રત્યક્ષ મજૂરી	૩૨,૮૫૦	૧.૦૩૦
ઉમેરો:	કારખાના પરોક્ષ ખર્ચ (૩૨૦૦ એકમો રૂ.૫/- લેખે)	૧,૫૨,૯૫૦	૪.૭૧૦
		૧૨,૦૦૦	૦.૩૭૫
ઉમેરો:	કારખાના પડતર	૧,૯૪,૯૫૦	૫.૧૫૫
	વહીવટી ખર્ચ (કારખાના પડતરના ૨૦%)	૩૨,૯૮૨	૧.૦૩૧
બાદ:	કારખાના પડતર	૧,૬૭,૯૫૨	૫.૧૮૭
	આખરનો સ્ટોક (૫,૦૦૦ એકમો રૂ.૧૮૯/- લેખે)	૩૦,૯૩૦	
ઉમેરો:	ઉત્પાદિત ભાલની પડતર	૧,૯૭,૦૨૨	
	વેરેલ ભાલની ઉત્પાદન પડતર (૨૭,૦૦૦ એકમો)	૬,૭૫૦	૦.૨૫૦
ઉમેરો:	વેચાણ ખર્ચ (૨૫ પૈસા લેખે ૨૭,૦૦૦ એકમો)	૧,૭૩,૭૭૨	૫.૪૩૭
		૪,૨૨૮	૧.૫૭૪
ઉમેરો:	વેચાણ પડતર	૨,૭૬,૦૦૦	૮.૦૦૦
	વેચાણ (૨૭,૦૦૦ × ૮)		

નોંધ: તૈયાર ભાલનો શરૂઆતનો સ્ટોક આપેલ નથી તેથી ઉમેરેલ નથી.

ઉદાહરણ: ૪ એક કંપનીની ટનદીઠ આપેલ ઉત્પાદન પડતર પરથી એકમ પડતર પત્રક બનાવો.

પ્રત્યક્ષ ભાલસામાન:

પેપર પલ્ય : ૫,૦૦૦ ટન, રૂ. ૫૦૦ ટનદીઠ

અન્ય ભાલસામાન : ૧,૦૦૦ ટન, રૂ. ૩૦૦ ટનદીઠ

પ્રત્યક્ષ મજૂરી:

૮૦ કુશળ કામદારો રૂ. ૩૦૦ દરેક દિવસના ૨૫ દિવસ માટે

૪૦ બિનકુશળ કામદારો રૂ. ૨૦૦ દરેક દિવસના ૨૫ દિવસ માટે

પ્રત્યક્ષ ખર્ચ:

વિશિષ્ટ સાધનો રૂ. ૬,૦૦૦

विशिष्ट डॉक्यूमेंट रु 2,000

કારખાના ખર્ચ:

પ્રત્યક્ષ ભજૂરીના ૧૦૦% ચલિત અને ૫૦% સ્થિર

વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચઃ

કારખાના પડતરણા ૧૫%

૪,૦૦૦ ટન વિશિષ્ટ પેપરનું ઉત્પાદન કર્યું અને ₹ ૮૦,૦૦૦ બગડેલ માલને વેચવાથી મળેલા. વિશિષ્ટ સાધનોની ભંગાર કિંમત ઉત્પાદનમાં ઉપયોગ બાદ શૂન્ય હતી.

ੴ ਪਾਖ:

૪,૦૦૦ ટન એકમોનું પડતર પત્રક

(8,000 ₦)

વિગતો		કુલ (₹)	ટનાઈ પડતર (₹)
પ્રત્યક્ષ માલસામાન:			
પેપર પટ્યે ૫,૦૦૦ ટન, ૫ ૫૦૦/- ટનાઈં		૨૫,૦૦,૦૦૦	૬૨૫
અન્ય માલસામાન ૧,૦૦૦ ટન, ૫ ૩૦૦/- ટનાઈં		૩,૦૦,૦૦૦	૭૫
બાદ:	બગડેલ માલનું વેચાણ	૨૮,૦૦,૦૦૦	૭૦૦
		૮૦,૦૦૦	૨૦
ઉમેરો:	પ્રત્યક્ષ મજૂરીઃ	૨૭,૨૦,૦૦૦	૬૮૦
	૮૦ કુલાળ કમદારો-૫ ૩૦૦ લેખ ૨૫ દિવસ	૫,૦૦,૦૦૦	૧૫૦
	૪૦ બિનજુલાળ કમદારો-૫ ૨૦૦ લેખ ૨૫ દિવસ	૨,૦૦,૦૦૦	૫૦
ઉમેરો:	પ્રત્યક્ષ ખર્ચાઃ વિશિષ્ટ સાધનો	૫૦,૦૦૦	૧૫
	વિશિષ્ટ ડાઈ	૨૦,૦૦૦	૫
ઉમેરો:	કારખાના પરોક્ષ ખર્ચાઃ	૩૫,૦૦,૦૦૦	૬૦૦
	ચલિત ખર્ચા - પ્રત્યક્ષ મજૂરીનાં ૧૦૦%	૮,૦૦,૦૦૦	૨૦૦
	સ્થિર ખર્ચા - પ્રત્યક્ષ મજૂરીનાં ૫૦%	૪,૮૦,૦૦૦	૧૨૦
ઉમેરો:	વહીવટી પરોક્ષ ખર્ચાઃ	૪૮,૮૦,૦૦૦	૧,૨૨૦
	કારખાના પડતરનાં ૧૦%	૪,૮૮,૦૦૦	૧૨૨
ઉમેરો:	વેચાણ અને વિતરણ ખર્ચાઃ	૫૩,૬૮,૦૦૦	૧,૩૪૨
	કારખાના પડતરનાં ૧૫%	૭,૩૨,૦૦૦	૧૮૩
		૫૧,૦૦,૦૦૦	૧,૪૨૫

ઉદાહરણા: ૫ તાર્કેશ કંપની ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજ પૂરા થતા વર્ષના અંતે નીચે મુજબની ભાટ્ટિ પૂરી પાડે છે. જેના આધારે કંપનીનાં પડતર પત્રક તૈયાર કરો.

	(₹)
શરૂઆતનો માલસામાન સ્ટોક	૨૦,૦૦૦
ખરીદી	૧,૭૦,૦૦૦
અપરનો માલસામાન સ્ટોક	૮,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૪૦,૦૦૦
અન્ય પ્રત્યક્ષ ખર્ચ	૨૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	પ્રત્યક્ષ મજૂરીનાં ૧૦૦%
ઓફિસ પરોક્ષ ખર્ચ	કારખાના પડતણનાં ૧૦૦%
વેચાણ અને વિતરણ ખર્ચ (વેચેલ એકમદીઠ)	૨

(₹)

તैयार भाल:

वर्षनी शडआतभां हाथ परना	2,000 एकमो (मूल्य प 32,000)
वर्ष दरवाननुं उत्पादन वर्षना अंतभां हाथ पर	20,000 एकमो 4,000 एकमो

वेचाणा किंमत पर 20% नफो भजे ते रीते तेनी एकमदीठ वेचाणा किंमत शोधो.

જવाब: तारकेश कंपनीनुं 31 मार्च 2016ना रोज पुरा थां वर्षनुं पडतर पत्रक

विगतो	रकम (₹)
भालसामान शडआतनो स्टोक	20,000
भरीटी	<u>1,70,000</u>
बाद: आभरनो स्टोक	<u>1,60,000</u>
	<u>4,000</u>
	काचाभालनो वपराश
उभेऽः प्रत्यक्ष भूरी	1,82,000
उभेऽः अन्य प्रत्यक्ष खर्च	40,000
	20,000
उभेऽः कारभाना परोक्ष खर्च (प्रत्यक्ष भूरीनां 100%)	2,42,000
	40,000
उभेऽः ओफिस परोक्ष खर्च (कारभाना पडतरनां 10%)	2,42,000
	28,200
उभेऽः तैयार भालनो शडआतनो स्टोक (2,000 एकमो)	3,10,200
	32,000
बाद: तैयार भालनो आभरनो स्टोक (4,000 × प 14.49)	3,42,200
	52,040
उभेऽः वेचाणा खर्च (18,000 एकमो × प 2/-)	2,80,960
	35,000
उभेऽः नफो (20% वेचाणा पर)	3,15,160
	56,080
	वेचाणा $\left(3,15,160 \times \frac{100}{20} \right)$
	3,45,200

$$\rightarrow \text{वेचाणा किंमत एकमदीठ} = \frac{3,45,200}{18,000} = \text{प } 21.66$$

$$\begin{aligned} \rightarrow \text{एकमदीठ नफो} &= \frac{56,080}{18,000} = \text{प } 4.36 \\ \text{शडनो स्टोक} + \text{उत्पादन} &= \text{वेचाणा} - \text{आभर स्टोक} \\ 2000 + 20000 &= 18000 - 4000 \end{aligned}$$

४.६ टेन्डर अने टेन्डरनुं पत्रक:

घणीवार जाहेरातना संदर्भमां उत्पादके टेन्डर अथवा टेन्डर किंमत आपवानी होय छे.

उत्पादक जे वस्तुओनुं उत्पादन अथवा तेनो जग्थो पूरो पाडतो होय त्यारे तेनी टेन्डर किंमत आपवानी होय छे.

टेन्डर खुल ज काणज्जपूर्वक भरीने कोईपणा प्रकारना ओर्करने भेजववा भाटे जे-ते कचेरीमे भोकलवानुं होय छे, जेना आधारे तेनो स्वीकार के अस्वीकार करवाभां आवतो होय छे.

सरकारी कचेरीभां अथवा तो भोटी संस्थाओभां कोईपणा प्रकारनुं भेदुं काम बहारथी कराववानुं होय त्यारे अथवा तेनो कोन्ट्राक्ट आपवानो होय त्यारे वस्तुनी भरीटी करवानी होय, भावताल नक्की करवाना होय तेना भाटे टेन्डर मंगाववाभां आवे छे.

ટેન્કર બનાવવા માટે એકમ પડતરના દરેક ઘટકોને ધ્યાનમાં લેવાચ છે. જેમકે, પ્રાથમિક પડતર, કારખાના પડતર, વહીવટી અને વેચાણ-વિતરણાના પરોક્ષ ખર્ચાઓને તેમજ તેના આધારે થયેલ નશો પણ ગણતરીમાં ધ્યાનમાં લેવાચ છે. ટેન્કર બનાવવા ભૂતકાળમાં થયેલ કામગીરીને અને તેની પડતર વિગતો ધ્યાનમાં લેવામાં આવે છે અને તેના આધારે તેમાં પડતર વિગતો નશો સહિત ગણાચ છે. આમ, ટેન્કર એટલે કુલ અંદાજુત પડતર + નશો. ટેન્કર બનાવતી પખતે તેના પરોક્ષ ખર્ચ આપેલ હોતા નથી, તેથી પરોક્ષ ખર્ચાઓ કથા આધારે વસૂલ કરવાના છે તે શોધવું જરૂરી બને છે. જેની ગણતરી અથવા આધાર ભૂતકાળના અનુભવોના આધારે પરોક્ષ ખર્ચની ટકાવારીથી નક્કી કરી શકાય છે. સામાન્ય રીતે તે ટકાવારીના આધારે અંદાજવામાં આવે છે. જેમકે, કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ ભજૂરી પર અમુક ટકા લેખે ગણાચ છે. જ્યારે વહીવટી, વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ કારખાનાની પડતરના અમુક ટકા તરીકે લેવામાં આવે છે. આમ, પડતર અંદાજ નીચે મુજબ કરી શકાય છે.

- એકમદીઠ પડતરના આધારે.
- પરોક્ષ ખર્ચના અમુક ટકાના આધારે.
- ચલિત, અર્ધચલિત અને સ્થિર પરોક્ષ ખર્ચને ધ્યાનમાં લઈને અને
- ભૂતકાળના એકમ પડતર પત્રકના આધારે.

જો ટકાવારીને આધારે પરોક્ષ ખર્ચ ગણવામાં આવે તો નીચે મુજબ ગણતરી કરવામાં આવે છે.

- (૧) કારખાના પરોક્ષ ખર્ચની ટકાવારી પ્રત્યક્ષ ભજૂરી સાથે શોધવામાં આવે છે, જે નીચેના સૂચની શોધી શકાય.

$$\frac{\text{કારખાના પરોક્ષ ખર્ચ}}{\text{પ્રત્યક્ષ ભજૂરી}} \times 100$$

- (૨) વહીવટી પરોક્ષ ખર્ચ અથવા વેચાણ-વિતરણ ખર્ચની ટકાવારી કારખાનાની પડતર સાથે શોધાય છે, જે નીચેના સૂચની શોધી શકાય.

$$\frac{\text{વહીવટી પરોક્ષ ખર્ચ}}{\text{કારખાના પડતર}} \times 100$$

૪.૧૦ ટેન્કર પત્રકનાં ઉદાહરણો:

ઉદાહરણ: ૫ વર્ષ ૨૦૧૮માં એક ટી. વી. બનાવતી કંપનીના ચોપડે નીચે મુજબ માહિતી બતાવે છે.

	(₹)
માલસામાન	૭,૦૦,૦૦૦
ભજૂરી	૫,૪૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૧,૫૨,૦૦૦
વહીવટી પરોક્ષ ખર્ચ	૧,૧૨,૧૬૦

કંપનીએ ટી. વી. માટેની કઈ કિંમત આંકડી જોઈએ? એમ ધારવામાં આવે છે કે ₹ ૨,૦૦૦ માલસામાન અને ₹ ૬૦૦ ભજૂરી તરીકે એક ટી. વી.ના થશે.

કારખાના પરોક્ષ ખર્ચ ભજૂરીના આધારે ગણવાના અને વહીવટી પરોક્ષ ખર્ચ કારખાના પડતરના આધારે ગણવા. વેચાણ પર ૧૨.૫૦% નશો અપેક્ષિત છે.

જવાબ:

ખરેખર પડતરનું પત્રક

વિગતો	કુલ (₹)
માલસામાન	૭,૦૦,૦૦૦
મજૂરી	૫,૪૦,૦૦૦
પ્રાથમિક પડતર	૧૨,૪૦,૦૦૦
<u>ઉમેરો:</u> કારખાના પરોક્ષ ખર્ચ	૧,૬૨,૦૦૦
કારખાના પડતર	૧૪,૦૨,૦૦૦
<u>ઉમેરો:</u> વહીવટી પરોક્ષ ખર્ચ	૧,૧૨,૧૯૦
ઉત્પાદન પડતર	૧૫,૧૪,૧૯૦

(૧) કારખાના શિરોપરી ખર્ચના મજૂરી સાથેના ટકા

$$\begin{aligned}
 &= \frac{\text{કારખાના શિરોપરી ખર્ચ}}{\text{મજૂરી}} \times 100 \\
 &= \frac{1,62,000}{5,40,000} \times 100 = 30\%
 \end{aligned}$$

(૨) વહીવટી પરોક્ષ ખર્ચના કારખાના પડતર સાથેના ટકા

$$\begin{aligned}
 &= \frac{\text{વહીવટી પરોક્ષ ખર્ચ}}{\text{કારખાના પડતર}} \times 100 \\
 &= \frac{1,12,190}{14,02,000} \times 100 = 8\%
 \end{aligned}$$

ટી. વી.નું અંદાજુત વેચાણ કિંમત દર્શાવતું પત્રક

વિગતો	કુલ (₹)
માલસામાન	૨,૦૦૦.૦૦
મજૂરી	૧,૪૦૦.૦૦
પ્રાથમિક પડતર	૩,૪૦૦.૦૦
<u>ઉમેરો:</u> કારખાના પરોક્ષ ખર્ચ (૩૦% મજૂરીના)	૪૨૦.૦૦
કારખાના પડતર	૩,૮૨૦.૦૦
<u>ઉમેરો:</u> વહીવટી પરોક્ષ ખર્ચ (૮% કારખાના પડતરના)	૩૦૪.૯૦
ઉત્પાદન પડતર	૪,૧૨૫.૯૦
<u>ઉમેરો:</u> નંદો (૪૧૨૫.૯૦ \times \frac{૧૨.૫૦}{૧૭.૫૦})	૫૮૮.૩૮
વેચાણ કિંમત	૪,૭૧૪.૬૭

ઉદાહરણ: ૭ નીચેની માહિતી કંપનીના ચોપડામાંથી પ્રાપ્ત થયેલ છે.

રકમ (₹)

કાચો માલસામાન (૦૧-૦૧-૨૦૧૮)	૪૫,૦૦૦
તૈચાર માલ (૦૧-૦૧-૨૦૧૮)	૮૦,૦૦૦
ખરીદી	૧૦,૬૫,૦૦૦
ઉત્પાદન મજૂરી	૭,૨૦,૦૦૦
તૈચાર માલનું વેચાણ	૨૧,૦૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૧,૪૬,૬૧૬
ઓફિસ અને વહીવટી પરોક્ષ ખર્ચ	૧,૨૭,૧૨૫
તૈચાર માલ (૩૧-૦૧-૨૦૧૮)	૨,૧૦,૦૦૦

કાચો માલસામાન (૩૧-૦૧-૨૦૧૮)

₹0,000

કંપનીએ એક મોટું ટેન્ડર મોકલવાનું છે. તેના માટે માલસામાન અને મજૂરી અનુક્રમે ૭,૫૦,૦૦૦ અને ₹૫,૦૦,૦૦૦ થશે. વેચાણ પર ૨૦% નફો મળે તે હેતુથી ટેન્ડર પત્રક બનાવો. કારખાનાના ખર્ચો પ્રત્યક્ષ મજૂરી પર અને વહીવટી ખર્ચો કારખાના પડતર પર આધારિત છે.

જવાબ:

પડતર પત્રક

વિગત	રકમ (₹)
શરૂઆતનો માલસામાન સ્ટોક	૪૫,૦૦૦
+ ખરીદી	૧૦,૬૫,૦૦૦
- આખરનો માલસામાન સ્ટોક	૧૧,૧૦,૦૦૦
કાચામાલનો વપરાશ	૦૦,૦૦૦
ઉમેરો: ઉત્પાદન મજૂરી	૧૦,૨૦,૦૦૦ ૭,૨૦,૦૦૦
ઉમેરો: કારખાના પરોક્ષ ખર્ચ	૧૭,૪૦,૦૦૦ ૧,૪૫,૬૧૬
ઉમેરો: ઓફિસ અને વહીવટી ખર્ચ	૧૮,૮૬,૬૧૬ ૧,૨૭,૧૨૫
ઉમેરો: તૈયારમાલનો શરૂઆતનો સ્ટોક	૨૦,૧૪,૦૪૧ ૦૦,૦૦૦
બાદ: તૈયારમાલનો આખરનો સ્ટોક	૨૧,૦૪,૦૪૧ ૨,૧૦,૦૦૦
ઉમેરો: નફો	૧૮,૬૪,૦૪૧ ૨,૦૫,૬૫૬
	વેચાણ
	૨૧,૦૦,૦૦૦

અંદાજીત પડતર પત્રક

વિગત	રકમ (₹)
માલસામાન	૭,૫૦,૦૦૦
મજૂરી	૫,૦૦,૦૦૦
ઉમેરો: કારખાના પરોક્ષ ખર્ચ (૨૦.૪૦૫% મજૂરી પર)	૧૩,૫૦,૦૦૦ ૧,૨૨,૪૩૦
ઉમેરો: ઓફિસ અને વહીવટી ખર્ચ (૫.૭૩૭% કારખાના પડતરના)	૧૪,૭૨,૪૩૦ ૮૮,૧૮૮
ઉમેરો: નફો (૨૫% પડતર પર)	૧૫,૭૧,૫૨૮ ૩,૬૨,૬૦૭
	વેચાણ
	૧૮,૬૪,૫૩૫

ઉદાહરણ: ૮ ઉત્પાદક પાસેથી વર્ષ ૨૦૧૮ની પડતર માહિતી નીચે મુજબ છે.

ઉત્પાદન	૨,૦૦૦ એકમો
કાચામાલની પડતર	₹ ૪૦,૦૦૦
મજૂરી પડતર	₹ ૨૪,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	₹ ૧૬,૦૦૦
વહીવટી પરોક્ષ ખર્ચ	₹ ૮,૦૦૦
વેચાણ પરોક્ષ ખર્ચ	₹ ૨,૦૦૦

વેચાણ પર નક્ષાની ટકાવારી 25%

ઉત્પાદકે વર્ષ 2016 દરમ્યાન 3,000 એકમો ઉત્પાદન કરવાનો નિર્ણય કરેલ છે. કાચા માલસામાનની પડતરમાં 20% વધારો અંદાજુત છે. મજૂરી પડતર 10% વધશે. પરોક્ષ ખર્ચના 50% સ્થિર અને બાકીના 50% ચલિત છે. વેચાણ કિંમત એકમદીઠ 20% ઘટશે. નક્ષાનું ધોરણ એકસમાન રહેશે.

વર્ષ 2016 માટેનું નક્ષો દર્શાવતું પડતર પત્રક બનાવો અને એકમદીઠ વેચાણ કિંમત દર્શાવો.

જવાબ:

વર્ષ 2016નું પડતર પત્રક (2,000 એકમો)

વિગતો	કુલ પડતર (₹)	એકમદીઠ પડતર (₹)
કાચા માલસામાનની પડતર મજૂરી પડતર	40,000 24,000	20,00 12,00
<u>ઉમેરો:</u> કારખાના પરોક્ષ ખર્ચ: સ્થિર (₹ 15,000ના 50%) ચલિત (₹ 15,000ના 50%)	12,000 12,000	4.00 4.00
<u>ઉમેરો:</u> વહીવટી પરોક્ષ ખર્ચ: સ્થિર (₹ 8,000ના 50%) ચલિત (₹ 8,000ના 50%)	4,000 4,000	2.00 2.00
<u>ઉમેરો:</u> વેચાણ ખર્ચ:	22,000 2,000	14.00 1.00
<u>ઉમેરો:</u> નક્ષો (વેચાણના 25%) વેચાણ	50,000 30,000 1,20,000	35.00 15.00 50.00

વર્ષ 2016નું અંદાજુત પડતર પત્રક (3,000 એકમો)

વિગતો	એકમદીઠ પડતર (₹)	કુલ પડતર (₹)
કાચા માલસામાનની પડતર (₹ 20 + 20% વધારો) મજૂરી પડતર (₹ 10 + 12% વધારો)	24.00 13.20	72,000 36,500
<u>ઉમેરો:</u> કારખાના પરોક્ષ ખર્ચ: સ્થિર (₹ 15,000ના 50%) ચલિત	37.20 2.57 4.00	1,11,500 8,000 12,000
<u>ઉમેરો:</u> વહીવટી પરોક્ષ ખર્ચ: સ્થિર (₹ 8,000ના 50%) ચલિત	43.79	1,31,500
<u>ઉમેરો:</u> વેચાણ ખર્ચ: સ્થિર (₹ 15,000ના 50%) ચલિત	47.20 0.80	1,41,500 2,800
<u>ઉમેરો:</u> નક્ષો (0 %)	47.00 00.00	1,44,000 00,000
	47.00	1,44,000

નોંધ: (1) પ્રાથમિક પડતર પહેલાંની તમામ પડતરો ચલિત છે. પરોક્ષ ખર્ચો ચલિત અથવા સ્થિર હોઈ શકે. ચલિત ખર્ચમાં વધારો/ઘટાડો ચલિત થાય જથારે સ્થિર ખર્ચમાં વધારો/ઘટાડો કુલ ખર્ચમાં થાય.

(2) સામાન્ય રીતે શિરોપરી ખર્ચ સ્થિર હોય છે. જો કોઈ સ્પષ્ટતા ન કરેલ હોય તો શિરોપરી ખર્ચ સ્થિર ગણાવા.

ઉદાહરણાઃ ૬ સ્વાતિ કંપનીએ ૨૦૧૮ના વર્ષ દરમ્યાન બધું જ ઉત્પાદન ₹ ૧૪,૪૦,૦૦૦/-માં વેચ્યું હતું. કંપનીની એકમીઠ પડતર નીચે મુજબ હતી.

વિગત	રકમ (₹)
માલસામાન ખર્ચ	૨૪૦
મજૂરી ખર્ચ	૧૮૦
સીધા ખર્ચ	૫૦
કારખાના શિરોપરી ખર્ચ: સ્થિર	૨૪
ચલિત	૩૬
ઓફિસ શિરોપરી ખર્ચ	૫૦
વેચાણ શિરોપરી ખર્ચ: સ્થિર	૩૬
ચલિત	૨૪
	<u>૬૬૦</u>
+ નફો	<u>૫૦</u>
વેચાણ કિંમત	<u>૭૨૦</u>

કંપનીની વાર્ષિક ઉત્પાદન શક્તિના ૮૦% ઉત્પાદન ૨૦૧૮માં કરવામાં આવ્યું, જ્યારે ૨૦૧૯નો અંદાજ નીચે મુજબ છે.

- (૧) ૨૦૧૯ના પ્રથમ ૬ માસ દરમ્યાન ઉત્પાદન શક્તિના ૮૦% જેટલું અને પછીના ૬ માસ દરમ્યાન ઉત્પાદન શક્તિના ૧૦૦% જેટલું ઉત્પાદન થશે.
- (૨) બધાં જ ચલિત ખર્ચમાં ૨૦% વધારો થશે, જ્યારે બધાં જ સ્થિર ખર્ચમાં ૧૦% વધારો થશે.
- (૩) ૨૦૧૯ના વર્ષનું અંદાજીત પત્રક તૈયાર કરો.
વેચાણ કિંમત પર $33\frac{1}{3}\%$ નફો મેળવવાનો છે.

જવાબ:

ઉત્પાદન એકમોની ગણતરી:

$$\text{વર્ષ } 2018 \text{ કુલ વેચાણ} = ₹ 14,40,000$$

$$\text{વેચાણ કિંમત} = ₹ 720$$

$$\text{કુલ ઉત્પાદિત એકમો} = \frac{14,40,000}{720} = \underline{\underline{2,000 \text{ એકમો}}}$$

૨,૦૦૦ ઉત્પાદન એકમો એ ૮૦%ની ઉત્પાદનશક્તિએ આપેલ છે. જે ૧૦૦% શક્તિએ, ૨૦૦૦ $\times \frac{100}{80} = 2,500$ એકમો થાય.

વર્ષ ૨૦૧૯ માટે ઉત્પાદન એકમોની ગણતરી નીચે મુજબ કરી શકાય.

- (૧) પ્રથમ ૬ માસ માટે ૮૦% ઉત્પાદન ક્ષમતા:

$$2,500 \times \frac{80}{100} \times \frac{6}{12} = 1,000 \text{ એકમો}$$

(२) દ્વિતીય ક માસ માટે ૧૦૦% ઉત્પાદન ક્ષમતા:

$$2,400 \times \frac{5}{12} = \underline{\underline{1,240 \text{ એકમો}}}$$

અંદાજીન ઉત્પાદિત એકમો = ૨,૨૫૦ એકમો

વર્ષ ૨૦૧૮નું પદ્તતિ પત્રક

(૨,૦૦૦ એકમો)

વિગતો		એકમીઠ પડતર (₹)	કુલ પડતર (₹)
<u>ઉમેશો:</u> કારખાના શિરોપરી ખર્ચ:	પ્રાથમિક પડતર	૨૪૦.૦૦	૪,૮૦,૦૦૦
		૧૮૦.૦૦	૩,૫૦,૦૦૦
	સ્થિર ચલિત	૫૦.૦૦	૧,૨૦,૦૦૦
		૪૮૦.૦૦	૮,૯૦,૦૦૦
<u>ઉમેશો:</u> ઓફિસ શિરોપરી ખર્ચ	કારખાના પડતર	૨૪.૦૦	૪૮,૦૦૦
		૩૬.૦૦	૭૨,૦૦૦
		૫૪૦.૦૦	૧૦,૮૦,૦૦૦
<u>ઉમેશો:</u> વેચાણ શિરોપરી ખર્ચ:	ઉત્પાદન પડતર	૫૦.૦૦	૧,૨૦,૦૦૦
		૬૦૦.૦૦	૧૨,૦૦,૦૦૦
		૩૬.૦૦	૭૨,૦૦૦
<u>ઉમેશો:</u> નકો	વેચાણ પત્રક માલની કુલ વેચાણ પડતર	૨૪.૦૦	૪૮,૦૦૦
		૬૬૦.૦૦	૧૩,૨૦,૦૦૦
		૫૦.૦૦	૧,૨૦,૦૦૦
	વેચાણ	૭૨૦.૦૦	૧૪,૪૦,૦૦૦

ਪੰਨਾ 2016 ਨੂੰ ਅੰਦਾਜ਼ੂਤ ਪੜਤਰ ਪਤ੍ਰਕ

(અંદાજીત ઉત્પાદિત એકમો ૨,૨૫૦)

વિગતો	એકમેટિક પડતર (₹)	કુલ પડતર (₹)
માલસામાન ખર્ચ (₹ ૨૪૦ + ૨૦% વધારો)	૨૮૮.૦૦	૫,૪૮,૦૦૦
મજૂરી ખર્ચ (₹ ૧૮૦ + ૨૦% વધારો)	૨૧૬.૦૦	૪,૩૬,૦૦૦
સીધા ખર્ચ (₹ ૫૦ + ૨૦% વધારો)	૭૨.૦૦	૧,૫૨,૦૦૦
	પ્રાથમિક પડતર	
ઉમેરો: કારખાના શિરોપદી ખર્ચ:	૫૭૯.૦૦	૧૪,૯૬,૦૦૦
સ્થિર (₹ ૪૮,૦૦૦ + ૧૦% વધારો)	૨૩.૪૭	૫૨,૮૦૦
ચલિત (₹ ૩૬ + ૨૦% વધારો)	૪૩.૨૦	૯૭,૨૦૦
	કારખાના પડતર	
ઉમેરો: ઓફિસ શિરોપદી ખર્ચ (૫૧,૨૦,૦૦૦+૧૦% વધારો)	૭૪૨.૭૭	૧૪,૪૬,૦૦૦
	ઉત્પાદન પડતર	
	૭૦૧.૩૩	૧૫,૭૮,૦૦૦

ઉમેરો:	વેચાણ શિરોપદી ખર્ચ:		
	સ્થિર (₹ ૭૨,૦૦૦ + ૧૦% વધારો)	૩૫.૨૦	૭૮,૨૦૦
ઉમેરો:	ચલિત (₹ ૨૪ + ૨૦% વધારો)	૨૮.૮૦	૫૪,૮૦૦
	વેચાણ પત્રક માલની કુલ વેચાણ પડતર	૭૭૫.૩૩	૧૭,૨૨,૦૦૦
ઉમેરો:	નક્ષે (૫૦%)	૩૮૨.૯૭	૮,૬૧,૦૦૦
	વેચાણ	૧,૧૪૮.૦૦	૨૫,૮૩,૦૦૦

ઉદાહરણ: ૧૦ કુલિંગ લિમિટેડ ૧,૦૦૦ રોકિજરેટરનું ઉત્પાદન અને વેચાએ તૃતીય ડિસેન્બર ૨૦૧૮ના રોજ પુરા થતા વર્ષ દરમ્યાન કર્યું. તેના વેચાએ અને નફા-નુકસાન ખાતાની તારીજ નીચે મુજબ છે.

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
માલસામગ્રીની પડતર	૧,૦૦,૦૦૦	વેચાએ	૫,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૧,૫૦,૦૦૦		
અન્ય ઉત્પાદન ખર્ચ	૫૨,૪૦૦		
કાચો નફો (ન. નુ. ખાતે)	૧,૮૭,૪૦૦		
	૫,૦૦,૦૦૦		૫,૦૦,૦૦૦
સંચાલન અને સ્ટાફનો પગાર	૭૫,૦૦૦	કાચો નફો	૧,૮૭,૪૦૦
ભાડું, વેરા અને વીમો	૧૨,૪૦૦		
સામાન્ય ખર્ચ	૨૫,૦૦૦		
વેચાએ ખર્ચ	૩૭,૪૦૦		
ચોખ્ખો નફો	૩૭,૪૦૦		
	૧,૮૭,૪૦૦		૧,૮૭,૪૦૦

વર્ષ ૨૦૧૮ માટે નીચે મુજબ અંદાજ કાઢવામાં આવ્યો છે.

- (૧) ઉત્પાદન અને વેચાએ ૧,૨૦૦ રોકિજરેટરનું થશે.
- (૨) પાછળા વર્ષ કરતા માલસામાનના ભાવમાં ૨૦% વધારો થશે.
- (૩) મજૂરીનો દર ૫% વધશે.
- (૪) ઉત્પાદન ખર્ચના માલસામાન અને મજૂરીના સંયુક્ત ખર્ચના પ્રમાણમાં વધારો થશે.
- (૫) એકમીઠ વેચાએ ખર્ચમાં ફેરફાર થશે નહીં.
- (૬) બીજા ખર્ચમાં ઉત્પાદનમાં વધારાની અસર થશે નહીં.

તમારે વેચાએ કિંમત પર ૧૦% નફો મળે તે રીતે ૨૦૧૮ના દરમ્યાન બનાવેલા રોકિજરેટરનો બજારભાવ શો રાખવો તે દર્શાવતું પત્રક તૈયાર કરો.

જવાબ:

તૃતીય ડિસેન્બર ૨૦૧૮ના રોજ પુરા થતા વર્ષનું પડતર પત્રક (૧૦૦૦ એકમો)

વિગતો	કુલ પડતર (₹)	એકમીઠ પડતર (₹)
માલસામગ્રી પડતર	૧,૦૦,૦૦૦	૧૦૦.૦૦
પ્રત્યક્ષ મજૂરી	૧,૫૦,૦૦૦	૧૫૦.૦૦
ઉમેરો: ઉત્પાદન ખર્ચ	૨,૫૦,૦૦૦	૨૫૦.૦૦
	૫૨,૪૦૦	૫૨.૪૦
ઉમેરો: વહીવટી પરોક્ષ ખર્ચ:	૩,૧૨,૪૦૦	૩૧૨.૪૦
	૭૫,૦૦૦	૭૫.૦૦
	૧૨,૪૦૦	૧૨.૪૦
ઉમેરો: વેચાએ શિરોપરી ખર્ચ: વેચાએ ખર્ચ	૨૫,૦૦૦	૨૫.૦૦
	૪,૨૫,૦૦૦	૪૨૫.૦૦
	૩૭,૪૦૦	૩૭.૪૦
ઉમેરો: નફો	૪,૭૨,૪૦૦	૪૭૨.૪૦
	૩૭,૪૦૦	૩૭.૪૦
વેચાએ	૫,૦૦,૦૦૦	૫૦૦.૦૦

૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પુરા થતાં વર્ષનું અંદાજીત પડતર પત્રક

(અંદાજીત ઉત્પાદિત એકમો ૧,૨૦૦)

વિગતો	એકમદીઠ પડતર (₹)	કુલ પડતર (₹)
માલસામગી પડતર (₹ ૧૦૦ + ૨૦% વધારો) પ્રત્યક્ષ ભજૂરી (₹ ૧૫૦ + ૫% વધારો)	૧૨૦.૦૦	૧,૪૪,૦૦૦
	૧૫૭.૫૦	૧,૮૮,૦૦૦
	૨૭૭.૫૦	૩,૩૩,૦૦૦
	૯૬.૩૭	૮૩,૨૫૦
કારખાના પરોક્ષ ખર્ચ (પ્રાથમિક પડતરના ૨૫%)	૩૪૬.૮૭	૪,૧૬,૨૫૦
વહીવટી પરોક્ષ ખર્ચ: સંચાલન અને સ્ટાફનો પગાર ભાડું, વેરા અને વીળો સામાન્ય ખર્ચ	૫૨.૫૦	૭૫,૦૦૦
	૧૦.૪૨	૧૨,૫૦૦
	૨૦.૮૩	૨૫,૦૦૦
	૪૪૦.૫૨	૫,૨૮,૭૫૦
વેચાણ શિરોપરી ખર્ચ: વેચાણ ખર્ચ	૩૭.૫૦	૪૫,૦૦૦
નફો (વેચાણ કિંમતનાં ૧૦%) (૪૭૮.૧૨ × $\frac{100}{૬૦}$)	૪૭૮.૧૨	૫,૭૩,૭૫૦
	૫૩.૧૨	૬૩,૭૪૪
	૫૩૧.૨૪	૫,૩૭,૪૬૪

નોંધ: ઉત્પાદન ખર્ચ એ કારખાના ખર્ચ હોય છે.

ઉદાહરણ: ૧૧ શ્રી રામ કંપની સંયુક્ત ખર્ચથી ‘એસ’ અને ‘ટી’ એમ બે પ્રકારની પેદાશ બનાવે છે. જેની પડતર ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પુરા થતાં વર્ષના અંતે નીચે મુજબ હતી.

પ્રત્યક્ષ માલસામાન	₹ ૨૪,૦૦,૦૦૦
પ્રત્યક્ષ ભજૂરી	₹ ૧૩,૪૪,૦૦૦
ઉત્પાદન પરોક્ષ ખર્ચ	₹ ૫,૭૬,૦૦૦
	₹ ૪૩,૨૦,૦૦૦

વર્ષની શરૂઆતમાં અને અંતમાં કોઈ અર્ધતૈયારમાલ હતો નહીં અને એમ શોધાયું કે...

- (૧) ‘એસ’ પ્રકારની પેદાશની એકમદીઠ કાચામાલની પડતર ‘ટી’ પ્રકારની પેદાશની એકમદીઠ પડતર કરતાં બે ગણી છે.
- (૨) ‘ટી’ પ્રકારની પેદાશની એકમદીઠ પ્રત્યક્ષ ભજૂરી ‘એસ’ પ્રકારની પેદાશની એકમદીઠ પ્રત્યક્ષ ભજૂરીનાં ૫૦% છે.
- (૩) ‘એસ’ અને ‘ટી’ બંને પ્રકારની પેદાશનાં એકમદીઠ ઉત્પાદન પરોક્ષ ખર્ચ સરખા છે.
- (૪) દરેક પ્રકારમાં ઓફિસ પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ ભજૂરીના ૧૨૦% છે.
- (૫) વેચાણ ખર્ચ પેદાશદીઠ ₹ ૪ છે.
- (૬) વર્ષ દરમ્યાન ‘એસ’ પ્રકારની પેદાશનાં ₹૪,૦૦૦ એકમોભાંથી ૫૭,૫૦૦ એકમો તથા ‘ટી’ પ્રકારની પેદાશનાં ₹૧,૮૮,૦૦૦ એકમોભાંથી ₹૧,૬૦,૦૦૦ એકમો વેચેલા હતા.
- (૭) વેચાણ કિંમત ‘એસ’ પ્રકારની પેદાશ ₹ ૪૫ એકમદીઠ
‘ટી’ પ્રકારની પેદાશ ₹ ૩૦ એકમદીઠ
કંપનીનું પડતર અને નફો બતાવતું પત્રક તૈયાર કરો.

જવાબ:

(૧) માલસામાન ખર્ચ:

ધારો કે 'ટી' પેદાશની માલસામાન પડતર X છે,
ત્યારે 'એસ' પેદાશની માલસામાન પડતર $2X$ છે.

$$1,62,000 + 1,28,000 = 24,00,000$$

$$3,20,000 = 24,00,000$$

$$X = 4 \text{ રૂ.} 40$$

'ટી' પેદાશની એકમદીઠ માલસામાન પડતર રૂ 4.40 છે.

'એસ' પેદાશની એકમદીઠ માલસામાન પડતર રૂ 1.40 છે.

(૨) મજૂરી:

ધારો કે 'એસ' પેદાશનો મજૂરી ખર્ચ X છે,

ત્યારે 'ટી' પેદાશનો મજૂરી ખર્ચ $\frac{40}{100}X$ અથવા $0.40X$ થશે.

$$54,000 + (1,62,000 + 0.40X) = 13,44,000$$

$$1,50,000 = 13,44,000$$

$$X = 4 \text{ રૂ.} 40$$

'એસ' પેદાશનો એકમદીઠ મજૂરી ખર્ચ રૂ 4.40 છે.

'ટી' પેદાશનો એકમદીઠ મજૂરી ખર્ચ રૂ 1.40 છે.

૩૧ માર્ચ ૨૦૧૬ના રોજ પુરા થતા વર્ષનું પડતર અને નફાનું પત્રક

વિગતો	પેદાશ 'એસ'		પેદાશ 'ટી'	
	કુલ પડતર (રૂ.)	એકમદીઠ પડતર (રૂ.)	કુલ પડતર (રૂ.)	એકમદીઠ પડતર (રૂ.)
ઉમ્ભેનો: પ્રત્યક્ષ માલસામાન પ્રત્યક્ષ મજૂરી	6,50,000	1.40	14,40,000	4.40
	4,37,500	0.40	8,05,400	1.40
ઉમ્ભેનો: ઉત્પાદન પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતર	14,67,500	23.40	22,45,400	91.40
	1,44,000	2.24	4,32,000	2.24
ઉમ્ભેનો: વહીવટી પરોક્ષ ખર્ચ: બાદ: આખરનો સ્ટોક	15,41,500	24.54	25,78,400	133.64
	5,45,120	10.08	6,57,520	4.08
ઉમ્ભેનો: વેચાણ ખર્ચ બાદ: આખરનો સ્ટોક	22,45,720	34.73	35,46,020	12.66
	2,28,572	4.56	5,07,920	1.40
ઉમ્ભેનો: વેચાણ ખર્ચ ઉમ્ભેનો: વેચાણ ખર્ચ	20,48,048	34.73	30,32,400	12.66
	2,30,800	4.00	5,80,000	1.40
ઉમ્ભેનો: નફો ઉમ્ભેનો: વેચાણ	22,78,448	34.73	35,78,400	12.66
	3,03,448	4.27	91,29,500	4.09
	24,42,000	44.00	48,00,000	30.00

નોંધ: (૧) સામાન્ય રીતે વેચાણ ખર્ચ વધેતા એકમો પર ગણાય છે.

(૨) આખર સ્ટોક : 'એસ' 5400 એકમો 'ટી' 32000 એકમો

સ્વાચ્છાય

૧. નીચેની વિગતો પરથી પડતર પત્રક બનાવો.

વિગત	રૂપાં (₹)
શરૂઆતનો સ્ટોક:	માલસામાન ૮,૦૦,૦૦૦ અધ્યતૈયારમાલ ૨,૪૦,૦૦૦ તૈયારમાલ ૨૦,૦૦૦
આખરનો સ્ટોક:	માલસામાન ૭,૨૦,૦૦૦ અધ્યતૈયારમાલ ૨,૦૦,૦૦૦ તૈયારમાલ ૫૦,૦૦૦
માલસામાન ખરીદી	૨૦,૦૦,૦૦૦
પ્રત્યક્ષ ભજૂરી	૫,૦૦,૦૦૦
ઉત્પાદન ખર્ચ	૪,૦૦,૦૦૦
વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચ	૮૦,૦૦૦
વેચાણ	૩૨,૦૦,૦૦૦

અધ્યતૈયાર માલ કારખાના પડતરના આધારે ગણો.

(જવાબ: પ્રાથમિક પડતર ₹ ૨૬,૮૦,૦૦૦; કારખાનાપડતર ₹ ૩૧,૨૦,૦૦૦; વેચાણ માલ પડતર ₹ ૩૦,૮૦,૦૦૦; કુલ પડતર ₹ ૩૧,૬૦,૦૦૦; નફો ₹ ૪૦,૦૦૦.)

૨. નીચેની ભાહિતી પરથી પડતર પત્રક બનાવો.

વિગત	રૂપાં (₹)
ઉત્પાદન ખર્ચ	૫૦,૦૦૦
માલસામાન પડતર	૨,૫૦,૦૦૦
પ્રત્યક્ષ ભજૂરી	૩,૦૦,૦૦૦
પરોક્ષ ભજૂરી	૭૫,૦૦૦
માલસામાન સંગ્રહ ખર્ચ	૨૦,૦૦૦
ઓફિસ ખર્ચ	૭૫,૦૦૦
વેચાણ ખર્ચ	૪૦,૦૦૦
અન્ય ખર્ચ	૩૦,૦૦૦
ડાયરેક્ટરની ફી	૨૦,૦૦૦
મેનેજરુંગ ડાયરેક્ટરની ફી	૨૫,૦૦૦

નફાનું ધોરણ વેચાણ પર ૨૦% લેખે રાખેલ છે.

(જવાબ: વેચાણ પડતર ₹ ૮,૮૫,૦૦૦; નફો ₹ ૨,૨૧,૨૫૦; વેચાણ પ ૧૧,૦૫,૨૫૦.)

૩. રેક્શાઈન ઇન્ડસ્ટ્રીઝના ચોપડેથી નીચેની ભાહિતી મેળવવામાં આવેલ છે.

વિગત	રૂપાં (₹)
કાચા માલસામાનનો શરૂઆતનો સ્ટોક	૧,૦૦,૦૦૦
કાચા માલસામાનની ખરીદી	૩,૪૦,૦૦૦
કાચા માલસામાનનો આખરનો સ્ટોક	૧,૫૦,૦૦૦
આવકમાલગાડાભાડું	૨૦,૦૦૦
પ્રત્યક્ષ ભજૂરી	૩,૦૦,૦૦૦
પરોક્ષ ભજૂરી	૪૦,૦૦૦
અન્ય પ્રત્યક્ષ ખર્ચ	૫૦,૦૦૦
ભાડું અને કર (કારખાનાના)	૨૦,૦૦૦
ભાડું અને કર (ઓફિસના)	૨,૦૦૦
પરોક્ષ માલસામાન	૩,૦૦૦
ઘસારો: પ્લાન્ટ વગેરે	૫,૦૦૦
ઓફિસ - ફર્નિચર	૪૦૦
પગાર: ઓફિસ	૧૦,૦૦૦

વિગત	રૂપાં (₹)
સેલ્સમેન	₹,000
અન્ય કારખાના ખર્ચ	₹२,८૦૦
અન્ય ઓફિસ ખર્ચ	₹,૬૦૦
મેનજુંગ ડિરેક્ટરનું ભેનનાણું	₹૮,૦૦૦
અચ વેચાણ ખર્ચ	₹,૦૦૦
સેલ્સમેનના મુસાફરી ખર્ચ	₹,૪૦૦
જાપકમાલગાડાભાડું	₹,૦૦૦
વેચાણ	₹૧૦,૦૦,૦૦૦
અગાઉથી ચૂક્યેલ કરવેશે	₹૫૦,૦૦૦
જાહેરાત	₹,૦૦૦

મેનજુંગ ડિરેક્ટરના ભેનનાણાંની વહેંચણી નીચે મુજબ કરવાની છે.

કારખાના ₹ ૧૬,૦૦૦

ઓફિસ ₹ ₹,૦૦૦

વેચાણ વિભાગ ₹ ૨૪,૦૦૦

ઉપર મુજબની માહિતી પરથી (૧)પ્રાથમિક પડતર, (૨) કારખાના પડતર, (૩) ઉત્પાદન પડતર, (૪) વેચાણ પડતર અને (૫) ચોખ્ખો નફો શોધો.

(જવાબ: પ્રાથમિક પડતર ₹ ૫,૫૦,૦૦૦; કારખાના પડતર ₹ ૭,૭૭,૮૦૦; ઉત્પાદન પડતર ₹ ૭,૬૦,૮૦૦; વેચાણ પડતર ₹ ₹,૪૩,૨૦૦; નફો ₹ ૧,૫૬,૮૦૦.)

૪. એક કંપની એકસમાન વસ્તુનું ઉત્પાદન કરે છે. તમને જાન્યુઆરી ૨૦૧૮ માટેની નીચેની માહિતી પૂરી પાડવામાં આવેલ છે. પૂરી પાડેલ માહિતી ૧૦,૦૦૦ એકમોની છે અને વેચાણ ખર્ચ એકમદીઠ ₹ ૨ છે.

વિગત	રૂપાં (₹)
કાચામાલનો વપરાશ	₹,૫૪,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	₹,૧૬,૦૦૦
અન્ય પ્રત્યક્ષ ખર્ચ	₹૪,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૮૦% (પ્રત્યક્ષ મજૂરીનાં)
ઓફિસ પરોક્ષ ખર્ચ	૧૦% (કારખાના પડતરનાં)

ચોખ્ખો નફો વેચાણ કિંમત પર ૨૦% છે.

(જવાબ: નફો ₹ ૧,૭૪,૫૨૦; વેચાણ ₹ ₹,૪૩,૯૦૦.)

૫. ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષ માટે એક વસ્તુના ઉત્પાદન માટે થયેલ ખર્ચ નીચે મુજબ છે.

વિગત	રૂપાં (₹)
પ્રત્યક્ષ માલસામાન	₹,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૩,૦૦,૦૦૦
પ્રત્યક્ષ ખર્ચ	૨,૦૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૩,૦૦,૦૦૦
વહીવટી પરોક્ષ ખર્ચ	૪,૦૦,૦૦૦
વેચાણ અને વિતરણ ખર્ચ	૩,૦૦,૦૦૦

વેચાણ કિંમત ₹૫,૦૦,૦૦૦ રાખવામાં આવે છે. તમારે વર્ષ ૨૦૧૮ માટેનું નફો દર્શાવતું પત્રક અને અંદાજુત વેચાણ કિંમત વર્ષ ૨૦૨૦ માટેની શોધવાની છે. વર્ષ ૨૦૨૦માં માલસામાન ₹ ₹,૦૦,૦૦૦, મજૂરી

₹ 10,00,000 અને પ્રત્યક્ષ ખર્ચ ₹ 2,00,000 અપેક્ષિત છે. પરોક્ષ ખર્ચને નીચે મુજબ ફાળવવામાં આવશે. નફાની ટકાવારી ગયા વર્ષ જેટલી રાખવાની છે.

- (૧) કારખાના પરોક્ષ ખર્ચની વસૂલાત પ્રત્યક્ષ મજૂરી દરની ટકાવારી મુજબ હશે.
- (૨) વહીવટી અને વેચાણ પરોક્ષ ખર્ચની વસૂલાતની ટકાવારી કારખાના પડતરની ટકાવારી મુજબ હશે.

(જવાબ: વર્ષ ૨૦૧૯ : ઉત્પાદન પડતર ₹ ૧૭,૦૦,૦૦૦; વેચાણ પડતર ₹ ૨૦,૦૦,૦૦૦;
વર્ષ ૨૦૨૦ : અંદાજીત નફો ₹ ૬,૨૩,૧૦૦; અંદાજીત વેચાણ કિંમત ₹ ૫૫,૩૮,૫૦૦.)
કારખાના ખર્ચ મજૂરી ૧૦૦%, વહીવટી અને વેચાણ ખર્ચ કારખાના પડતરના ૩૦.૭૭% અને
૨૮.૦૮% અનુક્રમે.

૬. ચંદ્ર લિમિટેડ વર્ષ ૨૦૧૮માં ₹ ૨૦,૦૦૦ એકમોનું ઉત્પાદન કર્યું. જેમાંથી ₹ ૨,૦૦૦ એકમો વેચાયા વિનાના પડી રહ્યાં હતાં. નીચેની માહિતી હિસાબી ચોપડામાંથી મેળવવામાં આવી છે.

વિગત	રૂપાં (₹)
પ્રત્યક્ષ વપરાયેલ માલસામાન	૮,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૬,૦૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૪,૦૦,૦૦૦ (૫૦% ચલિત ખર્ચ)
ઓફિસ પરોક્ષ ખર્ચ	૨,૦૦,૦૦૦ (૮૦% સ્થિર ખર્ચ)
વેચાણ પરોક્ષ ખર્ચ	૬૦,૦૦૦ (૫૦% ચલિત ખર્ચ)
વેચાણ કિંમત	૨૪,૬૦,૦૦૦

વર્ષ ૨૦૧૮માં કંપની ₹ ૨૨,૦૦૦ એકમોનું ઉત્પાદન કરવા ઈચ્છે છે. કંપની પડતરમાં નીચે મુજબનાં ફેરફાર કરવાનું પણ નક્કી કરેલ છે.

- (૧) માલસામાન પતરમાં ૫% વધારો થશે.
- (૨) સ્થિર કારખાનાના પરોક્ષ ખર્ચ ૧૦%થી વધશે.
- (૩) ઓફિસના ચલિત ખર્ચ એકમદીઠ ૫ રૂથી વધશે.

વર્ષ ૨૦૧૮નું પડતર પત્રક તૈયાર કરો અને વર્ષ ૨૦૧૯નું અંદાજીત પડતરનું પત્રક તૈયાર કરો.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૫)

(જવાબ: વર્ષ ૨૦૧૮: નફો ₹ ૫,૭૦,૦૦૦; આખર સ્ટોક ₹ ૨,૦૦,૦૦૦; અને વર્ષ ૨૦૧૯ નફો ₹ ૭,૦૬,૨૮૦; વેચાણ ₹ ૩૦,૫૧,૦૮૦. ગયા વર્ષના કુલ પડતર ૫૨ નફો ૩૦.૧૬ %)

૭. એક ઉત્પાદક કંપનીના ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષની ૫,૦૦૦ એકમોના ઉત્પાદનની વિગતો નીચે મુજબ હોય.

વિગત	રૂપાં (₹)
વપરાયેલો માલસામાન	૧,૮૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૧,૨૦,૦૦૦
કારખાનાની દિવાબતી	૧૧,૦૦૦
કામદાર કલ્યાણ ખર્ચ	૧૦,૦૦૦
પાવર અને બળતાણ	૨૪,૦૦૦
ઓફિસ પગાર	૨૦,૦૦૦
વેચાણ ખર્ચ	૩૫,૦૦૦
કારખાનાની પરોક્ષ મજૂરી	૩૦,૦૦૦
પ્લાન્ટ સમારકામ અને ઘસારો	૧૦,૦૦૦

બધાં જ ઉત્પાદિત એકમોનું વેચાણ એકમદીઠ ₹ ૧૦૦ લેખે થયેલ છે. આવતા વર્ષ માટે ધારવામાં આવે છે કે :-

- (૧) વેચાણ કિંમત એકમદીઠ ₹ ૮૮ થશે.
- (૨) પ્રત્યક્ષ ભાલસામાન અને મજૂરીનો ખર્ચ ૧૦% વધશે.
- (૩) આગામી વર્ષનું ઉત્પાદન અને વેચાણ ₹ ૧૦,૦૦૦ એકમો થશે.
ઉપરની વિગતો પરથી,
- (૧) ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષનું પડતર પત્રક તૈયાર કરો.
- (૨) આગામી વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂરા થતા વર્ષનું અંદાજુટ પડતર પત્રક ₹ ૧૦,૦૦૦ એકમોના ઉત્પાદન અને વેચાણ માટે તૈયાર કરો અને કારખાનાના ખર્ચો પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીના પ્રમાણે ગણવાના છે. વહીવટી ખર્ચ અને વેચાણ-વિતરણાના ખર્ચો કારખાનાના ખર્ચની ટકાવારીના પ્રમાણમાં ગણવાના છે.

(સરદાર પટેલ યુનિવર્સિટી, ૨૦૧૨)

(જવાબ: વર્ષ ૨૦૧૮ : નફો ₹ ૫૦,૦૦૦; વેચાણ ₹ ૫,૦૦,૦૦૦; વર્ષ ૨૦૨૦ : અંદાજુટ નફો ₹ ૧૨,૦૦૦; વેચાણ ₹ ૮,૮૦,૦૦૦; કારખાનાના ખર્ચો મજૂરીના ૭૦.૮૩%, વહીવટી અને વેચાણ ખર્ચો કારખાના પડતરનાં ૫.૨૦% અને ૮.૦૮%)

- c. વર્ષ ૨૦૧૮ દરમ્યાન દ્વાનિ લિમિટેડ ₹ ૨૦,૦૦૦ એકમોનું ઉત્પાદન કરે છે, જેના માટે એકમદીઠ પડતર આપેલી છે.

	વિગતો	રકમ (₹)	રકમ (₹)
પ્રાથમિક ખર્ચો:			
પ્રત્યક્ષ ભાલસામગ્રી	૫૦		
પ્રત્યક્ષ મજૂરી	૪૦		૧૦૦
કારખાનાના ખર્ચો:			
સ્થિર	૧૦		
ચલિત	૧૫		૨૫
વહીવટી ખર્ચો:			
સ્થિર	૧૫		
ચલિત	૧૦		૨૫
વેચાણ ખર્ચ:			
સ્થિર	૧૦		
ચલિત	૨૦	૩૦	
ઉમેરો:	કુલ પડતર	૧૮૦	
	નફો	૨૦	
			૨૦૦
	વેચાણ		

વર્ષ ૨૦૧૮માં ₹ ૮૫,૦૦૦ એકમોનું ઉત્પાદન અને વેચાણની ધારણા છે અને કંપની પોતાનો વેચાણ પરનો નફો જાળવવા માંગે છે. નીચે આપેલી માહિતીના આધારે જરૂરી ધારણાને દ્યાનમાં લઈ એકમદીઠ વેચાણ ખર્ચ નક્કી કરો:

- (૧) દરેક સ્થિર પડતર ૨૦%થી વધશે.
- (૨) પ્રત્યક્ષ ભાલસામાન પડતર ૧૦%થી વધશે, જ્યારે પ્રત્યક્ષ મજૂરી ૨૦%થી વધશે.
- (૩) ચલિત વેચાણ ખર્ચ ૧૦%થી વધશે, જ્યારે અન્ય ચલિત ખર્ચ ૧૦%થી ઘટશે.

(સરદાર પટેલ યુનિવર્સિટી, ૨૦૧૫, બી. બી. એ.)

(જવાબ: પ્રાથમિક પડતર રૂ. ૨૮,૫૦,૦૦૦, કારખાના પડતર રૂ ૩૪,૨૭,૫૦૦, વહીવટી પડતર રૂ ૪૦,૧૨,૫૦૦, કુલ પડતર રૂ ૪૮,૦૨,૫૦૦ નફોરૂ ૫,૩૩,૫૦૦; વેચાણરૂ ૫૩,૩૬,૦૦૦.)

- c. શ્રી કૃષ્ણ ઉત્પાદન કંપનીની વર્ષ ૨૦૧૮ની ચોપકે કિંમત નીચે પ્રમાણે છે. વર્ષ ૨૦૧૮માં ઉત્પાદન અને વેચાણના એકમો ૧૦,૦૦૦ છે.

વિગત	રકમ (રૂ)
પ્રત્યક્ષ ભાલસામાન	૧૩,૦૦,૦૦૦
ઉત્પાદકીય મજૂરી	૭,૦૦,૦૦૦
પ્રત્યક્ષ ખર્ચ	૧,૦૦,૦૦૦
કારખાનાનાં ખર્ચ (૫૦% ચલિત)	૪,૫૦,૦૦૦
ઓફિસનાં ખર્ચ	૨,૮૦,૦૦૦
વેચાણ અને વિતરણનાં ખર્ચ (૩૦% સ્થિર)	૩,૨૦,૦૦૦

નફાની ટકાવારી વેચાણના ૩૩.૩૩% છે. વર્ષ ૨૦૧૮માં ઉત્પાદન અને વેચાણ વર્ષ ૨૦૧૮ કરતાં પ ગણો છે. વર્ષ ૨૦૧૮ માટે પડતર પત્રક તૈયાર કરો અને વર્ષ ૨૦૧૯ માટે નીચેની માહિતી ધ્યાનમાં લીધા બાદ અંદાજુત પડતર પત્રક તૈયાર કરો.

- (૧) મજૂરી ૧૨%થી વધશે.
- (૨) સ્થિર કારખાનાનાં ખર્ચ રૂ ૨,૭૦,૦૦૦ સુધી વધશે.
- (૩) ઓફિસનાં ખર્ચ ૧૦%થી ઘટશે.
- (૪) વેચાણ અને વિતરણનાં સ્થિર ખર્ચ રૂ ૧,૪૦,૦૦ હશે.

અન્ય કોઈ ધારણા નથી.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૨, બી. ની. એ.)

(જવાબ: વર્ષ ૨૦૧૮ : નફોરૂ ૧૫,૭૫,૦૦૦; વેચાણરૂ ૪૭,૨૫,૦૦૦; વર્ષ ૨૦૧૯ : નફોરૂ ૭૧,૧૫,૦૦૦; વેચાણરૂ ૨,૧૩,૪૮,૦૦૦.)

૧૦. કલાપી લિમિટેડ એક્સ્પોર્ટ પ્લાસ્ટિકની ખુરશીઓનું ઉત્પાદન કરે છે. જેની ઉત્પાદન ક્ષમતા રૂ ૨૪,૦૦૦ ખુરશીઓ દર મળિને છે. નીચેની માહિતી અલગ વિભાગોની ત્રણ વર્ષની પડતર સૂચયે છે.

મહિના	એકમો	વેચાણ કિંમત (એકમદીઠ)	ભાલસામાન	મજૂરી	કારખાના ખર્ચ	ઓફિસ ખર્ચ	વેચાણ
ડિસે-૧૮	૧૦,૦૦૦	૨૨૦	૭,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦	૪,૪૪,૦૦૦	૨,૬૮,૦૦૦	૪૦,૦૦૦
જાન્યુ-૧૯	૧૨,૦૦૦	૨૩૫	૮,૪૦,૦૦૦	૬,૦૦,૦૦૦	૫,૦૪,૦૦૦	૩,૦૦,૦૦૦	૪૮,૦૦૦
ફેબ્રુ-૧૯	૧૫,૦૦૦	૨૪૫	૧૦,૫૦,૦૦૦	૭,૫૦,૦૦૦	૫,૮૪,૦૦૦	૩,૪૮,૦૦૦	૫૦,૦૦૦

માર્ચ ૨૦૧૯ માટે કંપનીને ખરીદનાર તરફથી ૨૦,૦૦૦ ખુરશીઓનો ઓર્ડર મળવાની સંભાવના છે. માર્ચ ૨૦૧૯ની માહિતી અહીં આપેતી છે.

- (૧) ભાલસામાનનો ભાવ એકમદીઠ ૧૦% વધશે અને મજૂરીનો દર ૫%થી વધશે.
- (૨) સ્થિર ખર્ચાઓ નીચે પ્રમાણે વધશે.
 - કારખાના ખર્ચ (સ્થિર) રૂ ૫૫,૦૦૦
 - ઓફિસનાં ખર્ચ (સ્થિર) રૂ ૪૨,૦૦૦

ફેબ્રુઆરી મહિના માટેનું પડતર પત્રક તૈયાર કરો અને માર્ચ મહિના માટે અંદાજુત પડતર પત્રક તૈયાર કરો. રૂ પર.૫૦ નફો એકમદીઠ મેળવવા માટે વેચાણ કિંમત શોધો. કારખાનાનો એકમદીઠ ચલિત ખર્ચ રૂ ૩૦, વહીવટી રૂ ૧૫, વેચાણ રૂ ૪ નવા કારખાના સ્થિર ખર્ચ રૂ ૨,૦૦,૦૦૦, નવા વહીવટી સ્થિર ખર્ચ રૂ ૧,૫૦,૦૦૦

(જવાબ: ફેલ્યુઆરી મહિનાનું પડતર પત્રક : કુલ પડતર રૂ ૨૮,૦૨,૦૦૦; માર્ચ મહિનાનું અંદાજીત પડતર પત્રક : નફો રૂ ૧૦,૫૦,૦૦૦; વેચાણ કિંમત રૂ ૪૦,૦૦,૦૦૦.)

૧૧. બશ કંપની લિમિટેડ વર્ષ ૨૦૧૮માં ૧૦,૦૦૦ એકમોનું ઉત્પાદન અને વેચાણ કર્યું હતું. જેની એકમદીઠ માહિતી આપવામાં આવેલ છે.

વિગતો	રકમ (₹)
પ્રત્યક્ષ માલસાગન	૭૦
પ્રત્યક્ષ મજૂરી	૩૦
<u>કારખાનાનાં ખર્ચો:</u>	<u>સ્થિર</u>
	૧૦
	ચલિત
	૧૦
<u>વહીવટી ખર્ચો:</u>	<u>સ્થિર</u>
	૧૫
	ચલિત
	૧૫
<u>પેચાણનાં ખર્ચો:</u>	<u>સ્થિર</u>
	૨૦
	ચલિત
	૧૦
<u>કુલ પડતર</u>	<u>૧૮૦</u>
નશે	૨૦
	વેચાણ
	૨૦૦

વર્ષ ૨૦૧૮માં અંદાજીત ૧૨,૦૦૦ એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવશે અને કંપની વેચાણ પર સરખો નકો રાખવા માંગે છે. નીચેના અંદાજને ધ્યાનમાં રાખીને એકમદીઠ વેચાણકિભત નક્કી કરો:

- (૧) દરેક સ્થિર પડતર ૨૦%થી વધશે.

(૨) પ્રત્યક્ષ ભાલસામાન અને પ્રત્યક્ષ મજૂરી અનુક્તમે ૧૦% અને ૨૦%થી વધશે.

(૩) ચલિત વેચાણ ખર્ચા ૧૦%થી વધશે, જ્યારે અન્ય ચલિત ખર્ચા ૧૦%થી ઘટશે.

(સરદાર પટેલ યુનિવર્સિટી, ૨૦૧૨, બી. બી. એ.-આઈ. એસ. એમ.)

(જવાબ: વર્ષ ૨૦૧૮ : નફો ₹ ૨,૦૦,૦૦૦; વેચાણ ₹ ૨૦,૦૦,૦૦૦; વર્ષ ૨૦૧૯ : નફો ₹ ૨,૫૪,૩૩૩; વેચાણ ₹ ૨૫,૫૩,૩૩૩.) વેચાણ પર નફાની ટકાવારી ૧૦%.

૧૨. ‘અ’ એકમની અડદા વર્ષની ૩૧-૧૨-૨૦૧૮ના પૂર્ણ થતા વર્ષની માહિતી નીચે મુજબ છે.

બિગત	૨૫મ (₹)
કાચામાલસામાની ખરીદી	૧,૨૦,૦૦૦
કામાં ખર્ચ	૪૮,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૧૦,૦૦૦
આપકમાલગાડાભાડું	૧,૪૪૦
અંતિમ માત વેચણા	૩,૦૦,૦૦૦

વિગતો	૦૧-૦૭-૨૦૧૮ના રોજ સ્ટોક (જથ્યો)	૩૧-૧૨-૨૦૧૮ના રોજ સ્ટોક (જથ્યો)
કાચો માલસામાન	૨૦,૦૦૦	૨૨,૨૪૦
ચાંપ કામકાજ	૪,૮૦૦	૧૬,૦૦૦
અંતિમ ઉત્પાદન	૧૫,૦૦૦	૩૨,૦૦૦
	(૧,૦૦૦ એકમો)	(૨,૦૦૦ એકમો)

વેચાણ અને વિતરણ ખર્ચ ₹ ૧ એકમદીઠ છે. ૧૬,૦૦૦ એકમોનું ઉત્પાદન આ સમયગાળા દરમ્યાન કરવામાં આવ્યું. આ માટેનું પડતર પત્રક અને ફુલ પડતર અને ફુલ નફો આપેલ સમય માટે શોધો.

(જવાબ: અર્દતીયાર માલ કારખાના પડતરમાં ગાણોલ છે. પ્રાથમિક પડતર ₹ 2, ૧૬, ૨૦૦; કારખાના પડતર ₹ ૨, ૫૮, ૦૦૦; વેચેલ માલની પડતર ₹ ૨, ૪૦, ૦૦૦; વેચાણ પડતર ₹ ૨, ૫૫, ૦૦૦; નફો રૂ ૪૫, ૦૦૦.)

૧૩. નીચે આપેલી વિગતો પરથી ૧,૫૦૦ ટનના ઉત્પાદનનું પડતર પત્રક બનાવો.

વિગત	રકમ (₹)
માલસામાન પડતર	૧,૨૦,૦૦૦
પગાર (સ્થિર)	૦૦,૦૦૦
મજૂરી (સ્થિર)	૧,૮૦,૦૦૦
કારખાનાનાં ખર્ચ	૭૫,૦૦૦
ભાંડું, કર, વીળો	૧૫,૦૦૦
વેચાણનાં ખર્ચ	૪૫,૦૦૦
સામાન્ય ખર્ચ (સ્થિર)	૩૦,૦૦૦
વેચાણ	૫,૦૦,૦૦૦

કંપનીના વેચાણ અધિકારીએ અંદાજીત વેચાણ આગલા વર્ષમાં ૨,૦૦૦ ટન થશે તેમ ધારણા કરી છે. આ માટે ૨,૦૦૦ ટન માટે અંદાજીત પડતર અને એકમદીઠ વેચાણ કિંમત પર ૨૦% નફો મળે તે રીતે વેચાણ કિંમત શોધો. નીચેના ફેરફારોની શક્યતાઓ છે.

- (અ) કાચા માલસામાનનો ભાવ ૨૦% વધશે.
- (બ) મજૂરી ૫%થી વધશે.
- (ક) બીજા ખર્ચ સરખા રહેશે.

(જવાબ: અંદાજીત નફો રૂ ૧,૭૫,૦૦૦; વેચાણ રૂ ૮,૮૦,૦૦૦.)

૧૪. ‘ક્ષ’ મશીનના ખાતામાંથી વર્ષ ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ની નીચેની માહિતી લેવામાં આવી છે.

વિગત	રકમ (₹)
કાચામાલનો શરૂઆતનો સ્ટોક	૫૦,૦૦૦
કાચામાલની ખરીદી	૧૨,૦૦,૦૦૦
કાચામાલ ગાડાભાંડું	૫૦,૦૦૦
મજૂરોની વાર્ષિક મજૂરી અને મશીન પરનું કાર્ય	૭,૦૦,૦૦૦
કારખાના ખર્ચ	૧,૬૯,૦૦૦
સ્થાપના અને સામાન્ય ખર્ચ	૧,૪૮,૧૭૦
કાચામાલનો આખર સ્ટોક	૭૫,૦૦૦

યંત્રની કારખાના પડતર અને કુલ પડતર શોધો.

કારખાના ખર્ચની મજૂરી સાથેની ટકાવારી અને સ્થાપના તથા સામાન્ય ખર્ચની કારખાના પડતરની ટકાવારી શોધો. એમ અંદાજવામાં આવ્યું છે કે કાચામાલનો ખર્ચ ₹ ૫,૦૦૦ અને મજૂરી ₹ ૪,૦૦૦ થશે. કંપનીએ યંત્રની કેટલી કિંમત રાખવી કે જેથી કુલ પડતરના ૨૫% લેખે નફો થાય.

(જવાબ: વર્ષ ૨૦૧૮ : કારખાના પડતર ₹ ૨૧,૩૧,૦૦૦; કુલ પડતર ₹ ૨૨,૮૦,૧૭૦; અંદાજીત નફો ₹ ૨,૭૦૭.૧૦; અંદાજીત વેચાણ કિંમત ₹ ૧૩,૫૩૫.૫૦.)

૧૫. મે. પટેલે આપણાને વર્ષ ૨૦૧૮ માટે નીચેની માહિતી આપી છે.

વિગતો	રકમ (૫)
માલસામાનની પડતર	૩,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૨,૫૦,૦૦૦
કારખાનાનાં ખર્ચ	૧,૫૦,૦૦૦
વહીવટી ખર્ચ	૧,૬૮,૦૦૦

વેચાણ ખર્ચી	₹ 1,12,000
વિતરણ ખર્ચી	₹ 70,000
નફો	₹ 2,90,000

વર્ષ ૨૦૧૮માં એક ઓર્ડર મુજબ કામ શરૂ કર્યું અને નીચેના ખર્ચી કરવામાં આવ્યા.

માલસામાન	₹ 4,000
મજૂરી	₹ 4,000

એમ ધારો કે વર્ષ ૨૦૧૮માં કારખાનાનાં ખર્ચી ૨૦% વધ્યા છે. વિતરણ ખર્ચી ૧૦%થી ઘટ્યા છે. વેચાણ અને વહીવટી ખર્ચી ૧૨.૫%થી વધ્યા છે. વર્ષ ૨૦૧૮ જેટલો જ નફાનો દર કમાવા માટે કેટલી વેચાણ કિંમત રાખવી જોઈએ?

કારખાનાનાં ખર્ચી પ્રત્યક્ષ મજૂરી પર આધારિત છે, જ્યારે અન્ય ખર્ચી કારખાનાની પડતર પર આધારિત છે.

(જવાબ: વર્ષ ૨૦૧૮ : વેચાણ ₹ 12,50,000; વર્ષ ૨૦૧૯ નફો ₹ 3,220.૮૦; વેચાણ ₹ 23,284.૮૦, પડતર પર નફાનો દર ૨૦%)

૧૬. વિશ્વમુક્ત્યુદ્ધકારીના કંપનીએ વર્ષ ૨૦૧૮માં પોતાની ૫૦% ઉત્પાદન ક્ષમતાએ ૫,૦૦૦ સાયકલનું ઉત્પાદન અને વેચાણ કર્યું. એકમદીઠ પડતર નીચે મુજબ છે.

વિગતો	ક્રમ (₹)
પ્રત્યક્ષ માલસામાન	100
પ્રત્યક્ષ મજૂરી	40
	140
કારખાના પરોક્ષ ખર્ચ:	
સ્થિર	10
ચલિત	20
	30
ઓફિસ પરોક્ષ ખર્ચ:	
સ્થિર	20
	20
વેચાણનાં ખર્ચ:	
સ્થિર	40
ચલિત	10
કુલ પડતર	250
નફો	40
વેચાણ કિંમત	300

વર્ષ ૨૦૧૯ માટે અંદાજ છે કે,

- (૧) ઉત્પાદન તેની પૂરેપૂરી ક્ષમતાએ થશે, જેમાંથી ૮૦% એકમોનું વેચાણ થશે.
- (૨) માલસામાન ખર્ચી, મજૂરી અને ચલિત કારખાના પરોક્ષ ખર્ચ ૧૦%થી વધશે.
- (૩) સ્થિર અને ચલિત વેચાણ પરોક્ષ ખર્ચ અનુક્રમે ₹ 8,000 અને એકમદીઠ ₹ 2થી વધશે.
- (૪) વેચાણ પર નફાનો દર ૨૦% રહેશે.

ઉપરની ભાહિતી પરથી વર્ષ ૨૦૧૯ માટે કુલ પડતર તેમજ અંદાજુત નફો દર્શાવતું પત્રક તૈયાર કરો.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૯)

(જવાબ: વર્ષ ૨૦૧૮ : નફો ₹ ૨,૫૦,૦૦૦; વેચાણ ₹ ૧૫,૦૦,૦૦૦; વર્ષ ૨૦૧૯ : નફો ₹ ૪,૮૦,૦૦૦;
વેચાણ ₹ ૨૪,૦૦,૦૦૦.)

૧૭. નીચેની માહિતી અંદાજિના હિસાબી ચોપડામાંથી વર્ષ ૨૦૧૭ માટેની મળેલી છે.

વિગતો	રકમ (₹)
પ્રત્યક્ષ માલસામાન	૧૨,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૬,૦૦,૦૦૦
કારખાના શિરોપરી ખર્ચ	૬,૦૦,૦૦૦
ઓફિસ શિરોપરી ખર્ચ	૩,૭૫,૦૦૦
વેચાણ શિરોપરી ખર્ચ	૨,૨૫,૦૦૦
વેચાણ (૧૦,૦૦૦ એકમો)	૩૭,૫૦,૦૦૦

વર્ષ ૨૦૧૮ માટેના અંદાજો

- (૧) ઉત્પાદન અને વેચાણ રૂ ૨૦%થી વધશે.
- (૨) માલસામાનની પડતર એકમદીઠ રૂ ૧૦થી વધશે.
- (૩) કારખાનાનાં સ્થિર શિરોપરી ખર્ચ અનુકૂલ રૂ ૫૦,૦૦૦થી વધશે.
- (૪) વેચાણ ચાલિત ખર્ચ એકમદીઠ રૂ ૨થી વધશે.
- (૫) વેચાણ પર નફાનો દર ૨૦% રહેશે.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૯)

(જવાબ: વર્ષ ૨૦૧૭ : કુલ પડતર ₹ ૩૦,૦૦,૦૦૦; નફો ₹ ૭,૫૦,૦૦૦; વેચાણ ₹ ૩૭,૫૦,૦૦૦; વર્ષ ૨૦૧૮ : અંદાજીત કુલ પડતર ₹ ૩૬,૭૮,૦૦૦; અંદાજીત નફો ₹ ૮,૧૭,૦૦૦; અંદાજીત વેચાણ ₹ ૪૫,૮૫,૦૦૦.)

૧૮. વર્ષ ૨૦૧૮ દરમ્યાન રાજ કંપની લિમિટેડ ૨૦,૦૦૦ એકમોનું ઉત્પાદન અને વેચાણ કરેલ હતું. જે અંગે એકમદીઠ માહિતી નીચે મુજબ આપેલી છે.

વિગતો	રકમ (₹)	રકમ (₹)
<u>પ્રાથમિક પડતર:</u>		
માલસામાન	૫૦	
મજૂરી	૪૦	૧૦૦
<u>કારખાના પરોક્ષ ખર્ચ:</u>		
સ્થિર	૧૦	
ચાલિત	૧૫	૨૫
<u>વહીવટી પરોક્ષ ખર્ચ:</u>		
સ્થિર	૧૫	
ચાલિત	૧૦	૨૫
<u>વેચાણ પરોક્ષ ખર્ચ:</u>		
સ્થિર	૧૦	
ચાલિત	૨૦	૩૦
કુલ પડતર		૧૮૦
નફો		૨૦
વેચાણ		૨૦૦

વર્ષ ૨૦૧૯ દરમ્યાન અંદાજે ૨૫,૦૦૦ એકમોનું ઉત્પાદન અને વેચાણ થશે અને કંપની વેચાણ ઉપર નફાનો દર જાળવી રાખવા ઈચ્છે છે. તમારે નીચેની માહિતી દ્વારા રાખીને એકમદીઠ વેચાણ કિંમત શોધવાની છે.

- (૧) તમામ સ્થિર ખર્ચ ૨૦%થી વધશે.
 (૨) પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ૧૦% અને પ્રત્યક્ષ મજૂરી ૨૦% વધશે.
 (૩) ચલિત વેચાણ ખર્ચ ૧૦% વધશે, જ્યારે અન્ય ચલિત પરોક્ષ ખર્ચ ૧૦%થી ઘટશે.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૨૦)

(જવાબ: વર્ષ ૨૦૧૬ : અંદાજીત કુલ પડતર ₹ ૪૮,૦૨,૪૦૦; નફો ₹ ૫,૩૩,૬૧૧; વેચાણ ₹ ૫૩,૩૫,૧૧૧.)

૧૬. એમ. કે. મેન્યુફેક્ચરીંગ કંપનીએ વર્ષ ૨૦૧૬ દરમાન ૫૦૦ ટી. વી. સેટનું ઉત્પાદન અને વેચાણ કર્યું.
 વર્ષ ૨૦૧૭નું વેપાર અને નફો-નુકસાન ખાતું નીચે મુજબ છે.

વિગત	રૂમ (₹)	વિગત	રૂમ (₹)
માલસામાન ખાતે	૩,૨૦,૦૦૦	વેચાણ	૧૬,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૪,૮૦,૦૦૦		
ઉત્પાકીય ખર્ચ	૨,૦૦,૦૦૦		
કાચો નફો	૬,૦૦,૦૦૦		
	૧૬,૦૦,૦૦૦		
નેનેજમેન્ટ સ્ટાફનો પગાર	૨,૪૦,૦૦૦	કાચો નફો	૧૬,૦૦,૦૦૦
બાંસું-કર અને વીમો	૪૦,૦૦૦		
સામાન્ય ખર્ચાઓ	૮૦,૦૦૦		
વેચાણ ખર્ચાઓ	૧,૨૦,૦૦૦		
ચોખ્ખાઓ નફો	૧,૨૦,૦૦૦		
	૫,૦૦,૦૦૦		
			૫,૦૦,૦૦૦

વર્ષ ૨૦૧૭ માટે એવું અંદાજવામાં આવ્યું છે કે,

- (૧) ઉત્પાદન અને વેચાણ ૨,૦૦૦ ટી. વી. સેટનું થશે.
 (૨) માલસામાનની કિંમત ૨૫%થી વધશે.
 (૩) મજૂરી દર ૧૦%થી વધશે.
 (૪) ઉત્પાદનના ખર્ચા, માલસામાન અને મજૂરીના સંયુક્ત પડતરના પ્રમાણવામાં વધશે.
 (૫) વેચાણ ખર્ચ એકમદી રૂપથી વધશે.
 (૬) અન્ય ખર્ચાઓ પર ઉત્પાદન વધારાની કોઈ અસર થશે નહીં.

વર્ષ ૨૦૧૭માં ટી. વી. સેટની કઈ કિંમતે ઉત્પાદન કરી વેચાણ કરવું જોઈએ કે જેથી વેચાણ કિંમત પર ૨૦% નફો મળે? તે દર્શાવતું પત્રક તૈયાર કરો.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૭)

(જવાબ: વર્ષ ૨૦૧૬ : કુલ પડતર ₹ ૧૪,૮૦,૦૦૦; નફો ₹ ૧,૨૦,૦૦૦; વેચાણ ₹ ૧૬,૦૦,૦૦૦; વર્ષ ૨૦૧૭ : અંદાજીત કુલ પડતર ₹ ૫૬,૦૦,૦૦૦; નફો ₹ ૧૪,૦૦,૦૦૦; વેચાણ ₹ ૭૦,૦૦,૦૦૦.) ઉત્પાદનના ખર્ચ પ્રાથમિક પડતર (માલસામાન+મજૂરી) પર આધારિત ગણાશે.
 જે ૨૫% થશે તે પ્રમાણે ગણાતરી થશે.

૨૦. વર્ષ ૨૦૧૮ માટે સુનિલ લિમિટેડના ચોપડામાંથી નીચેની વિગતો મેળવવામાં આવી છે.

ઉત્પાદન અને વેચાણ	૧,૨૦૦ એકમો
પ્રત્યક્ષ માલસામાન	૨૫મ (₹)

પ્રત્યક્ષ મજૂરી	1,02,000
પ્રત્યક્ષ ખર્ચી	14,800
કારખાના પરોક્ષ ખર્ચી (50% સ્થિર)	1,02,000
ઓફિસ પરોક્ષ ખર્ચી (સ્થિર)	57,600
વેચાણ પરોક્ષ ખર્ચી (80% ચલિત)	82,000
વેચાણ પર નફાનો દર	20%

વર્ષ ૨૦૧૬ માટેનો અંદાજ નીચે મુજબ છે.

- (૧) ઉત્પાદન અને વેચાણમાં ₹ 1,800 એકમોનો વધારો થશે.
- (૨) એકમદીઠ પ્રત્યક્ષ ભાલસાભાન ખર્ચમાં ₹ 25નો વધારો થશે.
- (૩) એકમદીઠ મજૂરી ખર્ચ 20% ઘટશે.
- (૪) સ્થિર કારખાના ખર્ચમાં ₹ 4,800નો વધારો થશે.
- (૫) એકમદીઠ ચલિત વેચાણ ખર્ચમાં ₹ 1.50નો વધારો થશે.
- (૬) પડતર પર નફાનો દર પાછળા વર્ષ જેટલો જ રહેશે.

તૈયાર કરો:

- (૧) વર્ષ ૨૦૧૮નું કુલ પડતર તથા એકમદીઠ પડતર દર્શાવતું પત્રક
- (૨) વર્ષ ૨૦૧૬ માટે અંદાજુત નફો દર્શાવતું પત્રક.

(જવાબ: વર્ષ ૨૦૧૮ : કુલ પડતર ₹ 4,84,800; નફો ₹ 1,21,200; વેચાણ ₹ 5,05,000; વર્ષ ૨૦૧૬ : કુલ પડતર ₹ 5,25,220; નફો ₹ 1,71,720; વેચાણ ₹ 7,48,500, પડતર પર નફાનો દર 25%).

પ્રકારણ: ૪

(૨) નાણાંકીય હિસાબો અને પડતરનાં હિસાબોની મેળવણી

- ૧ પ્રસ્તાવના
- ૨ મેળવણી પત્રકની જરૂરિયાત
- ૩ પડતર અને નાણાંકીય હિસાબોનાં નફા-ખોટનાં તફાવતનાં કારણો
- ૪ મેળવણી પત્રક તૈયાર કરવાની કાર્યવાહી
- ૫ મેળવણી પત્રકનો નમૂલો
- ૬ ઉદાહરણો
- ૭ સ્વાધ્યાય

૧. પ્રસ્તાવના

જ્યારે કંપનીઓ દ્વારા પડતર અને નાણાંકીય હિસાબો અલગ-અલગ તૈયાર કરવામાં આવતા હોય ત્યારે પડતર હિસાબો દ્વારા મેળવેલ નશો નાણાંકીય હિસાબો કરતાં અલગ ભણે છે અને બંનેનો તફાવત જોવા મળે છે. આપણો જાણીએ છીએ કે હિસાબી પદ્ધતિની ત્રણ શાખાઓ છે જેમકે, નાણાંકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ તથા સંચાલકીય હિસાબી પદ્ધતિ. ત્રણોથ પદ્ધતિ અંતર્ગત અલગ-અલગ ખાતાઓ કે પત્રકો તૈયાર કરી નશો જાણી શકાય છે.

નાણાંકીય અને પડતરનાં હિસાબો તૈયાર કરવાની હિસાબી કાર્યવાહી એકસરખી નથી. બંને હિસાબોમાં હિસાબી પદ્ધતિ અલગ હોય છે અને તેને કારણે નશો અલગ પડે છે અને તેમાં તફાવત જોવા મળે છે તેથી જ એ જરૂરી બને છે કે બંને ચોપકે મેળવેલ નશો કે નુકસાનની મેળવણી કરવામાં આવે. આમ કરવાથી પડતર હિસાબોબી વિશ્વસનીયતા જળવાય છે.

એચ. જી. હેલેનનાં શબ્દોમાં કહીએ તો, કોઈપણ હિસાબી પદ્ધતિ પૂર્ણ નથી જો તેને નાણાંકીય હિસાબો સાથે જોડવામાં ન આવે, તેથી પડતર અને નાણાંકીય હિસાબોની મેળવણી કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, અમૃત તારીખે બેંકમાં સિલક અને બેંક પાસબુક મુજબની સિલકમાં કેટલાંક કારણોસર તફાવત રહે છે. તે જ પ્રમાણે, પડતરનાં હિસાબો મુજબનો નશો અને નાણાંકીય હિસાબો મુજબના નશામાં કેટલોક તફાવત રહે છે. જે મેળવણી પત્રક તૈયાર કરી દૂર કરવો જરૂરી છે.

૨. મેળવણી પત્રકની જરૂરિયાત:

અમૃત કારણોસર પડતર અને નાણાંકીય હિસાબોમાં નશો કે નુકસાન અલગ-અલગ બતાવે છે. નીચેનાં કારણોને લીધે મેળવણી પત્રક બનાવવું જરૂરી બને છે.

- (૧) નાણાંકીય હિસાબો અને પડતર હિસાબોમાં મેળવેલ નશો કે નુકસાન કથા કારણે અલગ છે તેનાં કારણો જાણવા.
- (૨) બંને પદ્ધતિ મુજબ હિસાબોનાં ખર્ચનું વિશ્લેષણ કરવા માટે.
- (૩) મેળવણી કરવાથી બંને હિસાબો મુજબનાં નશાની આંકડાકીય ચોકસાઈ તપાસી શકાય છે.
- (૪) હિસાબોની પૂર્ણતા માટે મેળવણી પત્રક જરૂરી છે જેથી ખર્ચ કે આવક નોંધવાનાં રહી ન જાય અથવા પરોક્ષ ખર્ચની વસુલાત યોગ્ય છે કે નહીં તે જાણવા માટે પણ જરૂરી છે.
- (૫) ધંધાની વિવિધ નીતિ જેવી કે, સ્ટોકનું મૂલ્યાંકન, ઘસારો અને પરોક્ષ ખર્ચને ગણવાની પદ્ધતિમાં એકસમાનતા લાવવા.
- (૬) મેળવણી પત્રક બંને હિસાબો પદ્ધતિમાં સંકલન કરી આપે છે.
- (૭) મેળવણી સંચાલકોને નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે.

૩. પડતર અને નાણાંકીય હિસાબોનાં નશા-ખોટનાં તફાવતનાં કારણો:

જ્યારે હિસાબો બિન સંકલિત ધોરણે બનાવવામાં આવે છે એટલે કે નાણાંકીય અને પડતરના હિસાબો જુદા તૈયાર કરવામાં આવે છે ત્યારે કેટલીક હિસાબી બાબતોમાં તફાવતો જોવામાં આવે છે અને તેના કારણો નશો કે નુકસાનમાં તફાવત હોય છે. આ માટે ઘણાં કારણો જવાબદાર છે જે નીચે મુજબ છે.

- (૧) ફક્ત નાણાંકીય હિસાબોમાં દર્શાવવામાં આવતાં ફાળવણી અને ખર્ચ:

કેટલાંક ખર્ચ એવાં હોય છે જે નાણાંકીય સ્વરૂપમાં હોવાથી માત્ર નાણાંકીય હિસાબોમાં જ નોંધવામાં આવે છે અને પડતરનાં હિસાબો બનાવતી વખતે દ્યાનમાં લેવામાં આવતા નથી. તેને કારણે નફા કે નુકસાનમાં તફાવત આવે છે. આવા ખર્ચ નીચે જાણાવેલ છે.

(અ) નફાની ફાળવણી અને ખર્ચાઓ:

- કંપનીની શેરમૂડી પર ડિવિડન્ડ
- કરયેરાની જોગવાઈ
- દાન અને ધર્મદા
- સામાન્ય અનામત તથા અન્ય અનામતો ખાતે ફાળવેલ નફા
- મૂડી ખર્ચ જે મહેસુલી તરીકે ગણેલ હોય
- માંડી વાળેલ અદશ્ય અને અવાસ્તવિક ભિલકતો જેવી કે, પાદડી, પ્રાથમિક ખર્ચ, પ્રસારિત મહેસુલી ખર્ચ, શેર વટાવ, ડિબેન્ચર વટાવ.

(બ) બિન ધંધાકીય અને વારંવાર ન ઉદ્ભવતા ખર્ચ:

- રોકાણો, ચંત્રો, મકાનો વગેરે ભિલકતોનાં વેચાણ પર થયેલ ખોટ
- કોન્ટ્રાક્ટ મોડો પૂરો કરવાના કારણે ચૂકવેલ દંડ વગેરે
- શેર વટાવ, ડિબેન્ચર વટાવ, શેરમૂડી બહાર પાડવાનો ખર્ચ
- ડિબેન્ચર પર વ્યાજ, બેંક લોન પર વ્યાજ

(ક) નાણાંકીય આવકો:

- મેળવેલ ભાંડું, કમિશન, આકસ્મિક આવકો
- શેર ફેરબદતી ફી
- રોકાણો, ચંત્રો, મકાનો વગેરે ભિલકતોનાં વેચાણ પર થયેલ નફા
- મૂડી નફા, આકસ્મિક નફા
- બેંક ડિપોઝીટ પર વ્યાજ
- રોકાણો પર વ્યાજ
- રોકડ વટાવ

(૨) ફક્ત પડતરનાં હિસાબોમાં દર્શાવતાં ખર્ચ:

કેટલાંક ખર્ચ એવાં છે જે નાણાંકીય હિસાબોમાં નોંધવામાં આવતાં નથી અને તેને ફક્ત પડતરનાં હિસાબોમાં જ દર્શાવાય છે. તેનો હેતુ વાસ્તવિક પડતર ગણાવા માટેનો હોય છે. આવા ખર્ચ વાસ્તવિકમાં ચૂકવાતા નથી. નીચે આપેલ ખર્ચનો સમાવેશ પડતર હિસાબોમાં થાય છે.

- (અ) માલિકે રોકેલી મૂડી પરનું વ્યાજ
- (બ) માલિકીના મકાનનું વ્યાજ
- (ક) માલિકનું મહેનતાણું

(3) પરોક્ષ ખર્ચની વધુ અથવા ઓછી વસૂલાતઃ

નાણાંકીય હિસાબો બનાવતી વખતે ઐતિહાસિક પડતર એટલે કે ખરેખર થયેલ પડતર કે ચૂકવેલ પરોક્ષ ખર્ચને જ દ્યાનમાં લેવાય છે. પડતર હિસાબો અંદાજુત રકમનાં આધારે બનાવાય છે, જેથી તેમાં વધુ અથવા ઓછી વસૂલાત પરોક્ષ ખર્ચની બનાવતી હોય છે. આમ, પડતરનાં હિસાબોમાં અગાઉથી નક્કી કરવામાં આવેલ ધોરણે પરોક્ષ ખર્ચ નોંધાય છે અને નાણાંકીય હિસાબોમાં ખરેખર ખર્ચને નોંધવામાં આવે છે. જેના કારણે બંને હિસાબો મુજબનાં નક્કા કે નુકસાનમાં તફાવત આવે છે. પરોક્ષ ખર્ચની વધુ કે ઓછી વસૂલાતના કારણે નક્કો કે ખોટ જુદો હોય છે. વધુ વસૂલાત એટલે પડતરનો અંદાજ વધુ અને ખરેખર ખર્ચ ઓછો તેમજ ઓછી વસૂલાત એટલે પડતરનો અંદાજ ઓછો અને ખરેખર ખર્ચ વધુ.

(4) સ્ટોકની કિંમત આંકવાની પદ્ધતિને કારણો:

નાણાંકીય હિસાબોમાં છેવટનાં સ્ટોકની કિંમત નક્કી કરવા માટે તેની બજાર કિંમત અથવા પડતર કિંમતને દ્યાનમાં લેવાય છે અને તેમાંથી જે કિંમત ઓછી હોય તે કિંમતે સ્ટોકની નોંધ થાય છે. જ્યારે પડતર હિસાબી પદ્ધતિમાં સ્ટોકની કિંમત પડતર કિંમતે જ ગણાતરી કરવામાં આવે છે. નાણાંકીય હિસાબો અનુસાર આખર સ્ટોકનું મૂલ્યાંકન કરતી વખતે ઓફિસ કે વહીવટી ખર્ચનો સમાવેશ ન કરતાં ભાત્ર કારખાના પડતરના ધોરણે કરવામાં આવે છે. તેનાથી વિરુદ્ધ પડતર હિસાબો મુજબ તેમાં ભાલસામાન, મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચ અને વહીવટી પરોક્ષ ખર્ચને ઉમેરીને આવતા મૂલ્ય પર ગણવામાં આવે છે. આખરનાં સ્ટોકના મૂલ્યાંકનમાં તફાવત જોવા મળે છે.

આ કારણે બંને હિસાબોનાં નક્કા કે નુકસાનમાં તફાવત જોવા મળે છે જે મેળવણી પત્રક તૈયાર કરીને દૂર કરી શકાય છે.

૪. મેળવણી પત્રક તૈયાર કરવાની કાર્યવાહી:

મેળવણી પત્રક બનાવતી વખતે નીચે મુજબનાં મુદ્દા દ્યાનમાં રાખવામાં આવે છે. આ મેળવણી પત્રક એ બેંકનાં મેળવણી પત્રક જેણું જ પત્રક છે. નાણાંકીય હિસાબોના અને પડતર હિસાબોના નક્કો કે ખોટમાં તફાવત દર્શાવેલ હોય ત્યારે મેળવણી પત્રક દ્વારા નીચેની કાર્યવાહી કરવી પડે છે, જેથી તફાવત દૂર કરી નક્કાની મેળવણી કરી શકાય.

- (૧) સૌ પ્રથમ નાણાંકીય અને પડતર પદ્ધતિ દ્વારા તૈયાર થયેલ હિસાબો પ્રમાણે નક્કો કે નુકસાન શોધવું.
- (૨) નાણાંકીય હિસાબો પ્રમાણે નોંધાયેલ વ્યવહારની તપાસ તેનાં ઉધાર અને જમા બાજુની વિગતોમાં કરવી જેથી ખર્ચ કે આવક જે પડતર હિસાબોમાં ન બતાવેલ હોય તે જુદાં કરીને શોધી લેવાં.
- (૩) તેવી જ રીતે પડતર હિસાબોમાં નોંધેલ ખર્ચની તારવણી કરવી અને જે ખર્ચ નાણાંકીય હિસાબોમાં ન નોંધાયેલ હોય તે ખર્ચને શોધી કાઢવા.
- (૪) પરોક્ષ ખર્ચની વધુ કે ઓછી વસૂલાત થઈ છે કે નાઈ તેની તપાસ કરવી અને આ ઉપરાંત આખરના સ્ટોકના મૂલ્યાંકનમાં રહેલો તફાવત બંને હિસાબો મુજબ શોધી કાઢવો.
- (૫) ઉપરની કાર્યવાહી બાદ મેળવણી પત્રક બનાવતી વખતે સૌ પ્રથમ નોંધ પડતર હિસાબી અથવા નાણાંકીય હિસાબી પદ્ધતિથી મેળવેલ નક્કો કે ખોટને બંનેમાંથી એક હિસાબી ચોપડામાંથી દર્શાવવામાં આવે છે.

એટલે કે જો પડતરનાં હિસાબો મુજબનાં નક્કાની મેળવણી પત્રક બનાવીએ તો તફાવત અંગે જરૂરી હવાલા નાંખ્યા પછી જે મૂલ્ય મળે તે નાણાંકીય હિસાબો મુજબનો નક્કો કે ખોટ હશે અને આનાથી વિરુદ્ધ જો

મેળવણી પત્રક નાણાંકીય હિસાબો મુજબના નફો કે ખોટથી કરીએ તો તફાવત અંગે જરૂરી હવાલા નાંખ્યા બાદ મળતી રકમ એ પડતર હિસાબી મુજબનો નફો કે ખોટ હશે.

મેળવણી પત્રક બનાવતા બે પક્ષકારો હોય છે.

નોંધ: (૧) નાણાંકીય હિસાબો મુજબ નફો/નુકસાન (૨) પડતરના હિસાબો મુજબ નફો/નુકસાન

જે પક્ષકારથી મેળવણીપત્રક તैયાર કરેલ હોય તે આપણો પક્ષકાર ગણાય અને અન્ય પક્ષકાર સામેનો પક્ષકાર ગણાય. દા.ત. મેળવણીપત્રક પડતરના હિસાબોના નફો/નુકસાનથી શરૂ કરેલ હોય તો તમારે પક્ષ પડતરના હિસાબો ગણાય અને સામેનો પક્ષ નાણાંકીય હિસાબો ગણાય- ત્યારબાદ તફાવતના કારણો શોધો અને જે તે તફાવતોના કારણે સામેવાળા પક્ષનો નફો વધ્યો હોય તો તે આપણા નફામાં ઉમેરો અને નફો ઘટચો હોય તો નફામાંથી બાદ કરો.

૫ મેળવણી પત્રકનો નમૂનો:

તારીખ: ના રોજનું નાણાંકીય હિસાબો અને પડતર હિસાબો મુજબનું મેળવણી પત્રક

	વિગત	રકમ (₹)	રકમ (₹)
ઉમેરો:	પડતર હિસાબો મુજબ ચોખ્ખો નફો		----
(૧)	<u>ફક્ત પડતરનાં હિસાબોમાં સમાવેલ ખર્ચ:</u> - પોતાની માલિકીના ભકાનનું ભાડું - માલિકે રોકેલ મૂડી પરનું વ્યાજ	---	---
(૨)	<u>પડતરનાં હિસાબોમાં નહીં સમાવેલ આવકો:</u> - મળેલું ડિવિડન્ડ - સ્ટાફ કવાર્ટસનું ભાડું - મળેલ વ્યાજ - શેર ટ્રાન્સફર ફી - મિલકત કે રોકાણ વેચાણનો નફો	---	---
(૩)	<u>પડતરનાં હિસાબોમાં પરોક્ષ ખર્ચની વધુ વસૂલાતઃ</u> - કારખાનાનો પરોક્ષ ખર્ચ - ઓફિસનો પરોક્ષ ખર્ચ - વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ	---	---
(૪)	<u>નાણાંકીય હિસાબોમાં વધુ કિંમતે ગણાયેલ આખર સ્ટોક:</u> (તફાવતની રકમ) બાદ:	---	----
(૧)	<u>પડતરનાં હિસાબોમાં પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાતઃ</u> - કારખાનાનો પરોક્ષ ખર્ચ - ઓફિસનો પરોક્ષ ખર્ચ - વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ	---	---
(૨)	<u>પડતરનાં હિસાબોમાં નહીં નોંધાયેલ ખર્ચ:</u> - ડિલેન્યરનું વ્યાજ	---	---

વિગત	રકમ (₹)	રકમ (₹)
- કરવેરાની જોગવાઈ	---	---
- માંડી વાળેલ અદશ્ય કે અવાસ્તવિક મિલકતો	---	---
- દાન કે ધર્માદા ખર્ચી	----	----
- મિલકત કે રોકાણ વેચાણની ખોટ	----	----
(3) નાણાંકીય હિસાબોમાં છેવટનાં સ્ટોકની ઓછી ગણેલી કિંમત	----	----
નાણાંકીય હિસાબો મુજબ નફો કે ખોટ		----

નોંધ: આ પત્રકમાં મેળવણીપત્રક પડતરનાં હિસાબોથી શરૂ કરેલ છે. જો નાણાંકીય હિસાબોથી શરૂ કરીએ તો ઉમેરો વાળા વ્યવહારો બાદ થાય અને બાદ કરવાના વ્યવહારો ઉમેરામાં ધ્યાનમાં લેવાય.

અગત્યના મુદ્દાઓ:

- (૧) સામાન્ય રીતે પ્રાથમિક પડતર પહેલાની પડતરો જેવી કે પ્રત્યક્ષ ભાલ, સામાન્ય પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચી નાણાંકીય અને પડતરનાં હિસાબોમાં એકસરખી હોયછે. જો પ્રક્ષમાં જુદી રકમ આપેલ હોય ત્યારે જ જુદી રકમ ધ્યાનમાં લેવી.
- (૨) નાણાંકીય હિસાબોમાં તૈયારના આખર ભાલના સ્ટોકનું મૂલ્યાંકન કારખાના પડતરના આધારે (નાણાંકીય હિસાબોની પડતરની વિગતો પ્રમાણેની) અને પડતરના હિસાબોમાં વહીવટી (ઓફીસ) પડતર (પડતરના હિસાબોની પડતરની વિગતો પ્રમાણેની)ના આધારે થશે.
- (૩) તૈયાર ભાલના આખરના સ્ટોકના મૂલ્યાંકન અંગે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ જણાવેલ ન હોય તો FIFO પદ્ધતિના આધારે ગણતરીઓ કરવી.
- (૪) શરૂઆતના સ્ટોક અંગે બજે હિસોબામાં જુદી જુદી કિંમતો ન આપેલ હોય તો બજે હિસાબોમાં આપેલ કિંમતે ગણતરી કરવી.
- (૫) દાખલામાં સૂચના ન આપેલ હોય ત્યારે અર્ધતૈયાર ભાલની કુલ રકમ (ભાલસામાન, મજૂરી અને કારખાના ખર્ચની વિગતો અલગ ન આપેલ હોય ત્યારે) કારખાના પડતરમાં ધ્યાનમાં લેવી.
- (૬) અર્ધતૈયાર ભાલના આખરના સ્ટોકની રકમોમાં ભાલસામાન, મજૂરી અને કારખાનાના ખર્ચ જુદા આપેલ હોય તો જે તે ખર્ચમાંથી આ જે તે રકમ બાદ કરવી.

૬. ઉદાહરણો:

ઉદાહરણા: ૧ નીચેની વિગતો પરથી મેળવણી પત્રક બનાવો.

વિગત	રકમ (₹)
પડતર હિસાબ મુજબનો નફો	૩,૭૮,૩૦૦
કારખાના પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત	૨૪,૭૦૦
વહીવટી પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત	૫૮,૧૫૦
વેચાણ પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત	૫૦,૭૦૦
પડતર હિસાબોમાં શરૂઆતના સ્ટોકનું વધુ મૂલ્યાંકન	૩૮,૦૦૦
પડતર હિસાબોમાં આખરના સ્ટોકનું વધુ મૂલ્યાંકન	૧૮,૫૦૦

વર્ષ દરમ્યાન મળેલ વ્યાજ	₹,740
વર્ષ દરમ્યાન મળેલ ભાડું	₹,200
વર્ષ દરમ્યાન માંડી વાળેલ ઘાલખાધ	₹,400
વર્ષ દરમ્યાન માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ	₹,600
નાણાંકીય હિસાબો મુજબનો નફો	3,74,400

જવાબ:

મેળવણી પત્રક

વિગત		રકમ (₹)	રકમ (₹)
ઉમેરો:	પડતર હિસાબ મુજબનો નફો		3,74,300
	વેચાણ પરોક્ષ ખર્ચની વધુ વસ્તુલાટ	50,700	
	પડતર હિસાબોમાં શરૂઆતના સ્ટોકનું વધુ મૂલ્યાંકન	36,000	
	વર્ષ દરમ્યાન મળેલ વ્યાજ	₹,740	
	વર્ષ દરમ્યાન મળેલ ભાડું	₹,200	1,96,540
બાદ:	કારખાના પરોક્ષ ખર્ચની ઓછી વસ્તુલાટ	24,700	
	વહીવટી પરોક્ષ ખર્ચની ઓછી વસ્તુલાટ	56,140	
	પડતર હિસાબોમાં આખરના સ્ટોકનું વધુ મૂલ્યાંકન	16,400	
	વર્ષ દરમ્યાન માંડી વાળેલ ઘાલખાધ	₹,400	
	વર્ષ દરમ્યાન માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ	₹,600	1,73,540
	નાણાંકીય હિસાબો મુજબ નફો		3,74,400

નોંધ: (૧) મેળવણીપત્રક પડતરના હિસાબોથી શરૂ કરેલ છે તેથી પડતર આપણો પક્ષ ગણાય અને સામેનો પક્ષ નાણાંકીય હિસાબો ગણાય.

(૨) શરૂઆતનો સ્ટોક ઉધાર અસર દર્શાવે છે જ્યારે આખરનો સ્ટોક જમા અસર દર્શાવે છે.

ઉદાહરણ: ૨ નીચેની વિગતો પરથી (૧) ઉત્પાદન પડતર પત્રક, (૨) પડતરનાં હિસાબો મુજબનું પત્રક, (૩) નાણાંકીય હિસાબો મુજબ નફો-નુકસાન ખાતું અને (૪) મેળવણી પત્રક તૈયાર કરો.

	રકમ (₹)
કાચા માલનો શરૂઆતનો સ્ટોક	1,12,400/-
કાચા માલનો આખરનો સ્ટોક	1,58,740/-
તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક	2,25,000/-
તૈયાર માલનો આખરનો સ્ટોક	56,240/-
કાચા માલની ખરીદી	5,74,000/-
મજૂરી	2,81,240/-

કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરનાં ૨૫% ગણવાના છે. વહીવટી પરોક્ષ ખર્ચને કારખાના પરોક્ષ ખર્ચના ૧૫% લેખે લેવાના છે. ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ ₹ 2,17,656/- છે અને ખરેખર વહીવટી પરોક્ષ ખર્ચ ₹ 1,71,52/- થયેલ છે. વેચાણ કિંમત પર ૨૫% નક્કી કરવામાં આવ્યા હતા.

જવાબ:

(૧) ઉત્પાદન પડતર પત્રક:

વિગત	રકમ (₹)	રકમ (₹)
માલસામાન વપરાશ:		
કાચા માલનો શરૂઆતનો સ્ટોક	૧,૧૨,૫૦૦	
(+) ખરીદી	૫,૭૫,૦૦૦	
	૭,૮૭,૫૦૦	
(-) કાચા માલનો આખરનો સ્ટોક	૧,૫૮,૭૫૦	
ઉમેરો: મજૂરી		૬,૧૮,૭૫૦
પ્રાથમિક પડતર		૨,૮૧,૨૫૦
ઉમેરો: કારખાના પરોક્ષ ખર્ચ (પ્રા. પડતરના ૨૫%)		૮,૦૦,૦૦૦
કારખાના પડતર		૨,૨૫,૦૦૦
ઉમેરો: વહીવટી પરોક્ષ ખર્ચ (કા. પ. ખર્ચના ૧૫%)		૧૧,૨૫,૦૦૦
ઉત્પાદન પડતર		૧૬૮૭૫૦
		૧૨૯૩૭૫૦

(૨) પડતરનાં હિસાબો મુજબનું પત્રક:

વિગત	રકમ (₹)
તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક	૨,૨૫,૦૦૦
ઉમેરો: ઉત્પાદન પડતર	૧૨,૮૩,૭૫૦
	૧૫,૧૮,૭૫૦
બાદ: તૈયાર માલનો આખરનો સ્ટોક	૫૮,૨૫૦
વેચાણ માલની પડતર	૧૪,૯૨,૫૦૦
નકો (વેચાણ પડતરના ૨૫%)	૩,૬૫,૯૨૫
વેચાણ	૧૮,૨૮,૧૨૫

(૩) નાણાકીય હિસાબો મુજબ નફા-નુકસાન ખાતું:

વિગતો	રકમ (₹)	વિગતો	રકમ (₹)
શરૂઆતનો સ્ટોક:			
કાચો માલસામાન	૧,૧૨,૫૦૦	વેચાણ	૧૮,૨૮,૧૨૫
તૈયાર માલસામાન	૨,૨૫,૦૦૦	આખરનો સ્ટોક:	
ખરીદી	૫,૭૫,૦૦૦	કાચો માલસામાન	૧,૫૮,૭૫૦
મજૂરી	૨,૮૧,૨૫૦	તૈયાર માલસામાન	૫૮,૨૫૦
કારખાના પરોક્ષ ખર્ચ	૨,૧૭,૮૯૬		
વહીવટી પરોક્ષ ખર્ચ	૧,૭૧,૫૬૨		
ચોખ્ખો નકો	૩,૬૮,૮૪૪		
	૨૦,૫૩,૧૨૫		૨૦,૫૩,૧૨૫

- નોંધ: (૧) સામાન્ય રીતે પ્રત્યક્ષ માલ, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ, વેચાણ પડતર અને નાણાકીય હિસાબોમાં સરખા હોય છે.
- (૨) તૈયાર માલનો શરૂનો અને આખર સ્ટોક પડતર અને નાણાકીય માટે સરખુ મૂલ્ય ધરાવે છે (આ પ્રક્રિયામાં)

(૪) મેળવણી પત્રક:

વિગત	રકમ (₹)	રકમ (₹)
નાણાંકીય હિસાબ મુજબનો નફો		3,૬૮,૮૪૪
ઉમ્ભે: વહીવટી પરોક્ષ ખર્ચની પડતર હિસાબી પદ્ધતિમાં ઓછી વસૂલાત	૨,૮૧૨	૨,૮૧૨
બાદ: કારખાના પરોક્ષ ખર્ચની પડતર હિસાબી પદ્ધતિમાં વધુ વસૂલાત	૭,૦૩૧	૭,૦૩૧
પડતર પત્રક મુજબ નફો		3,૬૫,૬૨૫

ઉદાહરણ: ૩ સ્વાતિ લિમિટેડનું તારીખ: ૩૧-૦૩-૨૦૧૮ના રોજ પૂરી થતાં વર્ષનું નફા-નુકસાન ખાતું નીચે મુજબ છે.

વિગતો	રકમ (₹)	વિગતો	રકમ (₹)
માલસામાન	3,૬૦,૦૦૦	વેચાણ	૭,૨૦,૦૦૦
મજૂરી	૨,૭૦,૦૦૦	અર્ધતૈયાર માલ:	
પ્રત્યક્ષ ખર્ચ	૧,૮૦,૦૦૦	કાચો માલસામાન	૨૨,૫૦૦
કાચો નફો	૬૦,૦૦૦	મજૂરી	૧૩,૪૦૦
	૬૦,૦૦,૦૦૦	પ્રત્યક્ષ ખર્ચ	૬,૦૦૦
વહીવટી પરોક્ષ ખર્ચ	૪૫,૦૦૦	આખરનો સ્ટોક	૧,૩૪,૦૦૦
ચોખ્ખો નફો	૪૬,૫૦૦		૬૦,૦૦૦
	૮૪,૫૦૦	કાચો નફો	૬૦,૦૦૦
		મેળવેલ ડિવિડન્ડ	૪,૫૦૦
			૮૪,૫૦૦

પડતર હિસાબોની નોંધ મુજબ પ્રત્યક્ષ ખર્ચને એકમદીઠ ₹ ૩૦/- અંદાજવામાં આવ્યા છે અને વહીવટી પરોક્ષ ખર્ચ કિલોગ્રામદીઠ ₹ ૧૫/- લેખે, વર્ષ દરમ્યાન ૪,૫૦૦ કિલોગ્રામનું ઉત્પાદન થયું હતું અને વેચાણ ૩,૬૦૦ કિલોગ્રામનું થયું હતું.

પડતર હિસાબો મુજબ નફો દર્શાવતું પત્રક બનાવો અને નફાને નાણાંકીય હિસાબોના નફા સાથે મેળવો.

જવાબ:

પડતર હિસાબોનું પત્રક

વિગતો	રકમ (₹)	રકમ (₹)
માલસામાન ખરીદી	3,૬૦,૦૦૦	
બાદ: અર્ધતૈયાર માલ	૨૨,૫૦૦	3,૩૭,૫૦૦
મજૂરી	૨,૭૦,૦૦૦	
બાદ: અર્ધતૈયાર માલ	૧૩,૪૦૦	૨,૫૬,૫૦૦
		૫,૮૪,૦૦૦

વિગતો	રકમ (₹)	રકમ (₹)
ઉમેરો: પ્રત્યક્ષ ખર્ચ (30 × ૪૫૦૦)		૧,૩૫,૦૦૦
પ્રાથમિક પડતર		૭,૨૬,૦૦૦
ઉમેરો: વહીવટી પરોક્ષ ખર્ચ (૧૫ × ૪૫૦૦)		૬૭,૫૦૦
ઉત્પાદન પડતર (૪૫૦૦ એકમો)		૭,૮૬,૫૦૦
બાદ:		
તૈયાર માલનો સ્ટોક		૧,૫૬,૩૦૦
(૭,૮૬,૫૦૦ × $\frac{૮૦૦}{૪,૫૦૦}$)		
વેચેલ માલની પડતર		૬,૩૭,૨૦૦
નફો		૮૨,૮૦૦
		૭,૨૦,૦૦૦

મેળવણી પત્રક

વિગત	રકમ (₹)	રકમ (₹)
પડતર હિસાબો મુજબ નફો		૮૨,૮૦૦
ઉમેરો: પડતર હિસાબોમાં વહીવટી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત મળેલ ડિવિડન્ડ	૨૨,૫૦૦ ૪,૫૦૦	૨૭૦૦૦
બાદ:		૧,૦૬,૮૦૦
આખરના સ્ટોકનું વધુ મૂલ્યાંકન પ્રત્યક્ષ ખર્ચની ઓછી વસૂલાત નાણાંકીય હિસાબો (ન. નુ. ખાતા) મુજબ નફો	૨૪,૩૦૦ ૩૬,૦૦૦	૬૦,૩૦૦
		૪૬,૫૦૦

નોંધ: પ્રત્યક્ષ ખર્ચ = નાણાંકીય હિસાબો મુજબ ૧,૭૧,૦૦૦/-

(૧,૮૦,૦૦૦ - ₹૫,૦૦૦)

(-) પડતર હિસાબો મુજબ ૧,૩૫,૦૦૦/-

૩૬,૦૦૦/-

ઉદાહરણ: ૪ ટી. વી. બનાવતી કંપની તમને તેના ધંધાની માહિતી તારીખ: ૧ એપ્રિલ, ૨૦૧૮ના રોજની પૂરી
પાડે છે અને તમારે નફો દર્શાવતું પત્રક બનાવવાનું છે.

મજૂરી અને માલસામાન ખર્ચ તેના ખેટેખર પડતરે લેવાનું છે. કારખાના ખર્ચ મજૂરીના ૭૫% અને
ઓફિસ ખર્ચ કારખાના પડતરના ૩૦% લેખે લેવાના છે.

તમારે નફોનું મેળવણી પત્રક તથા નફો-નુકસાન ખાતું ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષનું
પણ બનાવવાનું છે. ટી. વી. નો સ્ટોક ઉપલબ્ધ ન હતો. વર્ષ દરમ્યાન ૫,૪૦૦ ટી. વી.નું વેચાણ થયું હતું.

એકમદીઠ માહિતી નીચે મુજબ છે.

માલસામાન ₹ ૨,૪૦૦/-

મજૂરી ₹ ૮૦૦/-

વેચાણ કિંમત ₹ ૫,૦૦૦/-

વર્ષનો ખરેખર નફો દર્શાવતું પત્રક બનાવો. જો કારખાના ખર્ચ ₹ ૩,૨૧,૬૦૦/- અને વહીવટી પરોક્ષ ખર્ચ ₹ ૬,૧૮,૦૦૦/- હોય.

જવાબ:

પડતર હિસાબોનું પત્રક

(૫,૪૦૦ ટી. વી. સેટ)

વિગતો	રકમ (₹) એકમદીઠ	રકમ (₹) કુલ
માલસામાન	૨,૪૦૦	૧,૨૮,૬૦,૦૦૦
મજૂરી	૮૦૦	૪૩,૨૦,૦૦૦
પ્રાથમિક પડતર	૩,૨૦૦	૧,૭૨,૮૦,૦૦૦
<u>ઉમેરો:</u> કારખાના ખર્ચ (મજૂરીના ૭૫%)	૬૦૦	૩૨,૪૦,૦૦૦
કારખાના પડતર	૩,૮૦૦	૨,૦૫,૨૦,૦૦૦
<u>ઉમેરો:</u> વહીવટી પરોક્ષ ખર્ચ (કા. પ.ના ૩૦%)	૧,૧૪૦	૬૧,૫૬,૦૦૦
કુલ પડતર	૪,૬૪૦	૨,૬૬,૭૬,૦૦૦
નફો	૧,૦૫૦	૫૭,૨૪,૦૦૦
વેચાણ	૬,૦૦૦	૩,૨૪,૦૦,૦૦૦

નાણાંકિય હિસાબો મુજબ નફો-નુકસાન ખાતું

વિગતો	રકમ (₹)	વિગતો	રકમ (₹)
માલસામાન	૧,૨૮,૬૦,૦૦૦	વેચાણ	૩,૨૪,૦૦,૦૦૦
મજૂરી	૪૩,૨૦,૦૦૦		
કારખાના પરોક્ષ ખર્ચ	૩૨,૧૬૦૦		
વહીવટી પરોક્ષ ખર્ચ	૬,૧૮,૦૦૦		
નફો	૧,૪૧,૮૦,૪૦૦		
	૩,૨૪,૦૦,૦૦૦		૩,૨૪,૦૦,૦૦૦

મેળવણી પત્રક

વિગત	રકમ (₹)
પડતર હિસાબો મુજબનો નફો	૫૭,૨૪,૦૦૦
<u>ઉમેરો:</u> કારખાના ખર્ચની વધુ વસૂલાત	૨૬,૧૮,૪૦૦
વહીવટી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત	૫૫,૩૮,૦૦૦
નફો-નુકસાન મુજબનો નફો	૧,૪૧,૮૦,૪૦૦

ઉદાહરણા: પ એક કંપની બે પ્રકારની કાચની શીશી ‘અ’ અને ‘બ’ બનાવે છે. તેના ખર્ચની વિગતો નીચે મુજબ છે.

‘અ’ પ્રકારની શીશી ‘બ’ પ્રકારની શીશી

માલસામાન (એકમ્બીઠ)	₹ ૫૦	₹ ૩૦
પ્રત્યક્ષ મજૂરી (એકમ્બીઠ)	₹ ૪૦	₹ ૨૪

કારખાના ખર્ચ મજૂરીના ૧૦૦% છે અને ઓફિસ ખર્ચ કારખાના પડતરના ૨૫% છે. ‘અ’ પ્રકારની શીશીના ૨૦૦ એકમ્બો અને ‘બ’ પ્રકારની શીશીનાં ૫૦૦ એકમ્બો બનાવ્યાં હતાં અને દરેક અનુકૂલ રૂ ૨૦૦/- અને રૂ ૧૨૦/-ની એકમ્બીઠ કિમતે વેચવામાં આવ્યા હતાં. શરૂઆતનો કે આખરનો સ્ટોક કોઈ નથી.

કારખાનાનો ખરેખર ખર્ચ ₹ ૧૬,૨૦૦/- અને ઓફિસ ખર્ચ ₹ ૧૬,૮૦૦/- થયો હોય તો, પડતર અને નાણાંકીય હિસાબોનાં ચોપડામાં દર્શાવવામાં આવેલ પરિણામનું મેળવણી પત્રક તૈયાર કરો.

જવાબ:

વિગત	‘અ’ પ્રકારની શીશી (૨૦૦ એકમ્બો)		‘બ’ પ્રકારની શીશી (૫૦૦ એકમ્બો)		કુલ (₹)
	કુલ (₹)	એકમ્બીઠ (₹)	કુલ (₹)	એકમ્બીઠ (₹)	
ઉમેરો:	માલસામાન	૧૦,૦૦૦	૫૦.૦૦	૧૫,૦૦૦	૨૫,૦૦૦
	પ્રત્યક્ષ મજૂરી	૮,૦૦૦	૪૦.૦૦	૧૨,૦૦૦	૨૦,૦૦૦
ઉમેરો:	પ્રાથમિક પડતર	૧૮,૦૦૦	૯૦.૦૦	૨૭,૦૦૦	૪૪.૦૦
	કારખાના ખર્ચ (મજૂરીના ૧૦૦%)	૮,૦૦૦	૪૦.૦૦	૧૨,૦૦૦	૨૪.૦૦
ઉમેરો:	કારખાના પડતર	૨૯,૦૦૦	૧૩૦.૦૦	૩૬,૦૦૦	૭૮.૦૦
	ઓફિસ ખર્ચ (કારખાના પડતરના ૨૫%)	૬,૫૦૦	૩૨.૫૦	૬,૭૫૦	૧૬.૫૦
નફો	ઓફિસ ખર્ચ (કારખાના પડતરના ૨૫%)	૩૨,૫૦૦	૧૬૨.૫૦	૪૮,૭૫૦	૮૭.૫૦
	નફો	૭,૫૦૦	૩૭.૫૦	૧૧,૨૫૦	૨૨.૫૦
વેચાણ	૪૦,૦૦૦	૨૦૦.૦૦	૫૦,૦૦૦	૧૨૦.૦૦	૧,૦૦,૦૦૦

પડતર પત્રક

વેપાર અને નફા-નુકસાન ખાતું

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
માલસામાન	૨૫,૦૦૦	વેચાણ	૧,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૨૦,૦૦૦		
કારખાના પરોક્ષ ખર્ચ	૧૬,૨૦૦	કાચો નફો	૧,૦૦,૦૦૦
કાચો નફો	૩૪,૮૦૦		૩૪,૮૦૦
	૧,૦૦,૦૦૦		
ઓફિસ ખર્ચ	૧૬,૮૦૦		
ચોખ્ખો નફો	૧૬,૦૦૦		
	૩૪,૮૦૦		

નાણાંકીય હિસાબો અને પડતર હિસાબો મુજબના નફા-નુકસાનનું

મેળવણી પત્રક

	વિગત	રકમ (₹)
ઉમેરો:	પડતર હિસાબો મુજબ ચોખો નફો	૧૮,૭૫૦
	પડતર હિસાબોમાં વધારે વસૂલ કરેલ કારખાના ખર્ચ	૮૦૦
બાદ:	પડતર હિસાબોમાં ઓછા વસૂલ કરેલ ઓફિસ ખર્ચ નફા-નુકસાન ખાતા મુજબનો નફો	૧૬,૫૫૦ ૫૫૦ ૧૬,૦૦૦

ઉદાહરણ: ૬ નાણાંકીય હિસાબોના ચોપડેથી ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષની માહિતી નીચે મુજબ છે.

	રકમ (₹)
વપરાયેલ પ્રત્યક્ષ માલસામાન	૫,૦૦,૦૦૦/-
પ્રત્યક્ષ મજૂરી	૨,૦૦,૦૦૦/-
કારખાના પરોક્ષ ખર્ચ	૭,૫૦,૦૦૦/-
વહીવટી પરોક્ષ ખર્ચ	૫,૦૦,૦૦૦/-
વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ	૬,૫૦,૦૦૦/-
ઘાલખાધ	૪૦,૦૦૦/-
પ્રાથમિક ખર્ચ (માંડી વાળેલ)	૨૦,૦૦૦/-
કાનૂની ખર્ચ	૧૦,૦૦૦/-
મળેલ ડિવિડન	૧,૦૦,૦૦૦/-
થાપણ પર મળેલ વ્યાજ	૨૦,૦૦૦/-
વેચાણ (૨,૪૦,૦૦૦ એકમો)	૧૪,૦૦,૦૦૦/-
આખરનો સ્ટોક:	
તૈયાર સ્ટોક (૮૦,૦૦૦ એકમો)	૨,૪૦,૦૦૦/-
અર્દતૈયાર સ્ટોક	૧,૬૦,૦૦૦/-

પડતરનાં હિસાબો નીચે મુજબની માહિતી પૂરી પાડે છે.

પ્રત્યક્ષ માલસામાન વપરાશ ₹ ૫,૫૦,૦૦૦/- છે. કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરનાં ૨૦% લેખે અને વહીવટી પરોક્ષ ખર્ચ ઉત્પાદનના દરેક એકમદીઠ ₹ ૩/- લેખે ગણવામાં આવે છે. વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચ દરેક એકમદીઠ ₹ ૪/- ગણેલ છે. આખર માલ કારખાના પડતરે ગણવાનો છે.

ઉપરની માહિતી પરથી (૧) પડતરના હિસાબો મુજબ નફા-નુકસાન દર્શાવતું પત્રક, (૨) નાણાંકીય હિસાબો મુજબ નફા-નુકસાન ખાતું અને (૩) પડતર હિસાબો અને નાણાંકીય હિસાબોના નફા-ખોટની મેળવણીનું પત્રક તૈયાર કરો.

જવાબ:

$$\begin{aligned}
 (1) \text{ ઉત્પાદન એકમો} &= \text{વેચાણ એકમો} + \text{આખર સ્ટોકના એકમો} \\
 &= 2,40,000 + 80,000 = 3,20,000
 \end{aligned}$$

(૨) ભાલસામાનનો ખર્ચ અલગ આપેલ છે તેથી પડતરણા હિસાબોમાં તે રકમ મુકાય રૂ ૫,૬૦,૦૦૦ પડતર હિસાબો મુજબ નશો-નુકસાન દર્શાવતું પત્રક

વિગત	રૂમા (₹)
પ્રત્યક્ષ માલસામાન	૫,૬૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૨,૦૦,૦૦૦
પ્રાથમિક પડતર	૭,૬૦,૦૦૦
<u>ઉમેદો:</u> કારખાના પરોક્ષ ખર્ચ (પ્રાથમિક પડતરનાં ૨૦%)	૧,૫૨,૦૦૦
<u>બાદ:</u> અર્ધતૈયાર માલનો આખર સ્ટોક (કારખાના પડતરે)	૧,૬૦,૦૦૦
કારખાના પડતર	૭,૫૨,૦૦૦
<u>ઉમેદો:</u> ઓફિસ પરોક્ષ ખર્ચ ($3,૨૦,૦૦૦ \times ₹ 3/-$)	૬,૬૦,૦૦૦
ઉત્પાદન પડતર	૧૭,૧૨,૦૦૦
<u>બાદ:</u> તૈયાર માલનો આખરનો સ્ટોક $(17,12,000 \times \frac{20,000}{3,20,000})$	૪,૨૮,૦૦૦
વેચેલ માલની ઉત્પાદન પડતર	૧૨,૮૪,૦૦૦
<u>ઉમેદો:</u> વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ ($2,૪૦,૦૦૦ \times ₹ ૪/-$)	૬,૬૦,૦૦૦
કુલ પડતર	૨૨,૪૪,૦૦૦
<u>બાદ:</u> ખોટ	૮,૪૪,૦૦૦
વેચાણ	૧૪,૦૦,૦૦૦

નાણાંકીય હિસાબો મુજબ નફા-નુકસાન ખાતું

વિગતો	રકમ (₹)	વિગતો	રકમ (₹)
માલસામાન વપરાશ	૫,૦૦,૦૦૦	વેચાણા	૧૪,૦૦,૦૦૦
મજૂરી	૨,૦૦,૦૦૦	મેળવેલ ડિવિડન્ડ	૧,૦૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૭,૬૦,૦૦૦	થાપણ પરનું વ્યાજ	૨૦,૦૦૦
વહીવટી પરોક્ષ ખર્ચ	૫,૦૦,૦૦૦	આખરનો સ્ટોક:	
વે.-વિત. પરોક્ષ ખર્ચ	૬,૫૦,૦૦૦	તૈયાર માલ	૨,૪૦,૦૦૦
કાનૂની ખર્ચ	૧૦,૦૦૦	અર્ધ તૈયાર માલ	૧,૫૦,૦૦૦
ઘાલખાદ	૪૦,૦૦૦	ચોખી ખોટ	૧૦,૭૦,૦૦૦
માંડી વાળેલ પ્રા. ખર્ચ	૨૦,૦૦૦		
	૨૬,૬૦,૦૦૦		૨૬,૬૦,૦૦૦

મેળવણી પત્રક

વિગત	રકમ (₹)	રકમ (₹)
ઉમેરો: પડતર હિસાબો મુજબની ખોટ	(૮,૪૪,૦૦૦)	
પડતર હિસાબમાં ભાલસામાનની વધુ વસૂલાત વહીપટી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત	૬૦,૦૦૦	
મળેલ ડિવિડન થાપણ પરણું વ્યાજ	૪,૫૦,૦૦૦	
	૧,૦૦,૦૦૦	
	૨૦,૦૦૦	૬,૪૦,૦૦૦
બાંદ: પડતર હિસાબમાં કારખાના પરોક્ષ ખર્ચની ઓછી		(૨,૦૪,૦૦૦)
વસૂલાત	૬,૦૮,૦૦૦	
માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ	૨૦,૦૦૦	
કાનૂની ખર્ચ	૧૦,૦૦૦	
ઘાલખાધ	૪૦,૦૦૦	
આખરના સ્ટોકનું વધુ મૂલ્યાંકન	૧,૮૮,૦૦૦	(૮,૬૬,૦૦૦)
નાણાંકીય હિસાબો મુજબની ચોખી ખોટ		(૧૦,૭૦,૦૦૦)

ઉદાહરણ: ૭ મહિને લિમિટેડના નાણાંકીય હિસાબોમાંથી ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષની માહિતી નીચે મુજબ આપવામાં આવે છે.

	રકમ (₹)
પ્રત્યક્ષ ભાલસામાન	૭,૨૨,૭૭૫/-
પ્રત્યક્ષ મજૂરી	૧,૩૬,૭૨૫/-
કારખાનાનો પરોક્ષ ખર્ચ	૧,૧૦,૪૦૦/-
ઓફિસ ખર્ચ	૧,૮૪,૦૦૦/-
વેચાણ ખર્ચ	૮૭,૭૫૦/-
મકાન વેચાણની ખોટ	૩,૦૮૨/-
માંડી વાળેલ ઘાલખાધ	૧,૫૧૮/-
મળેલ વ્યાજ	૪,૬૦૦/-
વેચાણ (૮,૩૮૫)	૧૪,૬૫,૦૦૦/-
તૈયાર ભાલનો આખર સ્ટોક (૨૩૦ એકમો)	૨૬,૬૦૦/-

પડતર હિસાબોમાં ભાલસામાન અને મજૂરી ખર્ચ તેની પડતર કિંમતે દર્શાવવામાં આવેલ છે, જ્યારે કારખાના ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના ૭૫% લેખે વસૂલ કરવામાં આવે છે. ઓફિસ ખર્ચ કારખાનાની પડતરના ૨૦% લેખે વસૂલ કરવામાં આવે છે તથા વેચાણ ખર્ચ વેચેલ એકમદીઠ ₹ ૧૨/- લેખે ગણોલ છે. વર્ષની શરૂઆતમાં તૈયાર ભાલનો કોઈ સ્ટોક ન હતો.

ઉપરની માહિતી પરથી, નાણાંકીય હિસાબ મુજબ વેપાર તથા નફા-નુકસાન ખાતું, કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું, ઓફિસ પરોક્ષ ખર્ચનું ખાતું, પડતર પત્રક તથા પડતર હિસાબો અને નાણાંકીય હિસાબોનું મેળવણી પત્રક તૈયાર કરો.

જવાબ:

કુલ ઉત્પાદન એકમો= વેચાણ + આખર સ્ટોક

$$= ૮,૩૯૫ + ૨૩૦$$

$$= ૮,૬૨૫ એકમો$$

નાણાંકીય હિસાબો મુજબ નફા-ગુક્સાન ખાતું

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
પ્રત્યક્ષ ભાલસાભાન	૭,૨૨,૭૭૫	વેચાણ (૮૩૯૫)	૧૪,૯૫,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૧,૩૬,૭૨૫	તૈથાર ભાલનો	
કારખાના પરોક્ષ ખર્ચ	૧,૧૦,૪૦૦	આખરનો સ્ટોક	૨૬,૬૦૦
ઓફિસ પરોક્ષ ખર્ચ	૧,૮૪,૦૦૦	મળેલ વ્યાજ	૪,૬૦૦
વેચાણ પરોક્ષ ખર્ચ	૮૭,૭૫૦		
મકાન વેચાણની ખોટ	૩,૦૮૨		
માંડી વાળેલ ઘાલખાધ	૧,૫૧૮		
નફો	૨,૭૦,૨૫૦		
	૧૫,૨૬,૫૦૦		૧૫,૨૬,૫૦૦

કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
રોકડ બેંક ખાતે (ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ)	૧,૧૦,૪૦૦	કારખાના પરોક્ષ ખર્ચની વસૂલાત (પડતર હિસાબ મુજબ)	૧,૦૪,૭૯૪
	૧,૧૦,૪૦૦	કારખાના પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત	૫,૬૦૬

ઓફિસ પરોક્ષ ખર્ચનું ખાતું

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
રોકડ બેંક ખાતે (ખરેખર ઓફિસ પરોક્ષ ખર્ચ)	૧,૮૪,૦૦૦	ઓફિસ પરોક્ષ ખર્ચ (પડતર હિસાબ મુજબ)	૧,૯૩,૪૫૬
ઓફિસ પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત	૮,૪૫૬		

નોંધ: ઉપર મુજબના ખાતાની ઉધાર બાજુ ખૂટટી રકમ પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત અને જમા બાજુ ખૂટટી રકમ પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત ગણાય છે.

પડતર પત્રક

વિગત	રકમ (₹)
કાચા ભાલના વપરાશની પડતર	૭,૨૨,૭૭૫
પ્રત્યક્ષ મજૂરી	૧,૩૮,૭૨૫
પ્રાથમિક પડતર	૮,૬૨,૫૦૦
<u>ઉમેરો:</u> કારખાના પરોક્ષ ખર્ચ (પ્રત્યક્ષ મજૂરીનાં ૭૫%)	૧,૦૪,૭૯૪
કારખાના પડતર	૬,૯૭,૨૯૪
<u>ઉમેરો:</u> ઓફિસ ખર્ચ (કારખાના પડતરનાં ૨૦%)	૧,૯૩,૪૫૮
ઉત્પાદન પડતર	૧૧,૬૦,૭૫૩
<u>બાદ:</u> તૈયાર ભાલનો આખરનો સ્ટોક $(11,60,753 \times \frac{200}{2,525})$	૨૬,૮૧૯
વેચેલ ભાલની ઉત્પાદન પડતર	૧૧,૩૩,૮૩૭
<u>ઉમેરો:</u> વેચાણ પરોક્ષ ખર્ચ	૧,૦૦,૭૪૦
કુલ પડતર	૧૨,૩૪,૫૭૭
<u>ઉમેરો:</u> નફો	૨,૬૦,૪૨૩
વેચાણ	૧૪,૯૫,૦૦૦

મેળવણી પત્રક

વિગત	રકમ (₹)	રકમ (₹)
પડતર હિસાબો મુજબ નફો		૨,૬૦,૪૨૩
<u>ઉમેરો:</u> ઓફિસ ખર્ચની વધુ વસૂલાત	૮,૪૫૮	
વેચાણ ખર્ચની વધુ વસૂલાત	૨,૮૮૦	
મળેલ વ્યાજ	૪,૬૦૦	૨૦,૦૩૩
આખર સ્ટોકનું નાણાંકીય હિસાબોમાં વધુ મૂલ્યાંકન	૨,૮૮૪	
<u>બાદ:</u> કારખાના ખર્ચની ઓછી વસૂલાત	૫,૬૦૯	
મકાન વેચાણની ખોટ	૩,૦૮૨	
માંડી વાળેલ ઘાલખાધ	૧,૫૧૮	૧૦,૨૦૬
નફો-નુકસાન ખાતા મુજબ નફો		૨,૭૦,૨૫૦

સ્વાધ્યાય

૧. નીચેની માહિતી પરથી મેળવણી પત્રક બનાવો.

વિગત	રકમ (₹)
૧) નાણાંકીય હિસાબો મુજબ ચોખ્ખો નફો	૩,૪૮,૭૬૫
૨) પડતર હિસાબો મુજબ ચોખ્ખો નફો	૫,૦૭,૨૦૦
૩) કારખાના પરોક્ષ ખર્ચની પડતર હિસાબોમાં ઓછી વસૂલાત	૮,૩૬૦
૪) વહીવટી પરોક્ષ ખર્ચની પડતર હિસાબોમાં વધુ વસૂલાત	૧૫,૧૦૦
૫) ઘસારો (માત્ર નાણાંકીય હિસાબોમાં નોંધેલ)	૩૩,૬૦૦
૬) ડિવિન્ડ મળેલ પણ પડતર હિસાબોમાં નહીં નોંધેલ	૨૪,૦૦૦
૭) માંડી વાળેલ ખર્ચ નાણાંકીય હિસાબોમાં દર્શાવેલ	૧૭,૧૦૦
૮) આવકયેરો	૧,૨૦,૯૦૦

૬)	લેંક વ્યાજ નાણાંકીય ચોપડામાં જમા કરેલ	રૂ.૨૫૦
૧૦)	મળેલ વટાવ	રૂ.૪૨૫
૧૧)	આખર સ્ટોકનું પડતરમાં વધુ મૂલ્યાંકન	રૂ.૨૫૦

(જવાબ: જો મેળવણી પત્રક પડતર હિસાબ મુજબનાં ચોપડા નફા મુજબથી કરીએ તો તફાવતની રકમ નાણાંકીય હિસાબ મુજબનો નફો મળશે, પડતરના હિસાબોથી શરૂ થતા રૂ ૫,૦૭,૨૦૦ + રૂ ૪૨,૭૭૫ = રૂ ૫,૪૯,૮૭૫ - રૂ ૨૦૧,૨૧૦ = રૂ ૩,૪૮,૭૬૫)

૨. નીચેની માહિતી પરથી તૈયાર કરો:

- (૧) પડતર હિસાબો મુજબ નફો કે ખોટ દર્શાવતું પત્રક
- (૨) નાણાંકીય હિસાબો અને પડતર હિસાબોનું મેળવણી પત્રક

વિગતો	રકમ (₹)	વિગતો	રકમ (₹)
કાચામાલની વપરાશ	રૂ૧,૨૪,૦૦૦	વેચાણા	
પ્રત્યક્ષ મજૂરી	૧૧,૧૩,૦૦૦	(૬૦૦૦ એકમો)	૪૫,૦૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૬,૩૬,૦૦૦	તૈયાર માલનો સ્ટોક	
વહીવટી પરોક્ષ ખર્ચ	૨,૮૬,૫૦૦	(૩૦૦૦ એકમો)	૬,૪૬,૫૦૦
વેચાણા-વિતરણ પરોક્ષ ખર્ચ	૩,૪૦,૫૦૦	અધ્યતૈયાર માલ:	
નફો	૧૦,૩૩,૫૦૦	માલસામાન	૫૧,૦૦૦
		મજૂરી	૨૪,૦૦૦
		કારખાના પરોક્ષ ખર્ચ	૧૫,૦૦૦
			૫૫,૩૬,૫૦૦

પડતરનાં હિસાબો તપાસતાં નીચે મુજબની માહિતી મળે છે.

- (૧) કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના ૨૦%ના દરે ગણવાના છે.
- (૨) વહીવટી પરોક્ષ ખર્ચ ઉત્પાદનના દરેક એકમ દીઠ રૂ ૩૦/- લેખે ગણવાનો છે.
- (૩) વેચાણા-વિતરણ પરોક્ષ ખર્ચ વેચેલ એકમદીઠ રૂ ૪૦/- લેખે ગણવાનો છે.

(જવાબ: પડતર હિસાબ મુજબની કુલ પડતર રૂ ૩૪,૭૫,૮૦૦/-; નફો રૂ ૧૦,૨૪,૨૦૦/-; પડતરના હિસાબ મુજબના નફામાં કારખાના પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત રૂ ૮,૪૦૦/- અને વેચાણા-વિતરણ પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત રૂ ૧૬,૫૦૦/- ઉમેરો તથા તેમાંથી વહીવટી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાતના રૂ ૭૩,૫૦૦/- અને પડતર હિસાબોમાં આખરના સ્ટોકનું વધુ મૂલ્યાંકન રૂ ૬૨,૧૦૦/- બાદ કરતાં નાણાંકીય હિસાબો મુજબનો નફો રૂ ૧૦,૩૩,૫૦૦/- મળશે.)

૩. હનુમાન કંપનીની એકમદીઠ પડતર નીચે મુજબ બનેલી છે.

માલસામગ્રી ખર્ચ	રૂ ૪૦/-
મજૂરી ખર્ચ	રૂ ૩૦/-
કારખાના શિરોપરી ખર્ચ પ્રાથમિક પડતરના	૨૦%
ઓફિસ શિરોપરી ખર્ચ એકમદીઠ	રૂ ૫/-
વેચાણા-વિતરણ શિરોપરી ખર્ચ એકમદીઠ	રૂ ૪/-

કંપનીનું નફા-નુકસાન ખાતું નીચે ગુજરાત હતું.

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
શરૂઆતનો તૈયાર સ્ટોક (૨૦૦૦ એકમો)	૧,૦૦,૦૦૦	વેચાણ આખરનો સ્ટોક	૧૮,૦૦,૦૦૦
માલસામાન ખર્ચ	૮,૦૦,૦૦૦	તૈયાર માલનો સ્ટોક (૬૦૦૦ એકમો)	૨,૮૦,૦૦૦
મજૂરી ખર્ચ	૬,૦૦,૦૦૦	મળેલ વ્યાજ	૧૬,૦૦૦
કારખાના ખર્ચ	૩,૦૦,૦૦૦	મળેલ ડિવિડન	૪,૦૦૦
ઓફિસ ખર્ચ	૧,૩૦,૦૦૦		
વેચાણ ખર્ચ	૭૦,૦૦૦		
માંડી વાળેલ પાઘડી	૧૦,૦૦૦		
પ્રાથમિક ખર્ચ	૬,૦૦૦		
કરવેરાની જોગવાઈ	૪,૦૦૦		
ચોખ્ખો નફો	૮૦,૦૦૦		
	૨૧,૦૦,૦૦૦		૨૧,૦૦,૦૦૦

પડતર પત્રક અને મેળવણી પત્રક બનાવો.

(જવાબ: ઉત્પાદનના એકમો આપેલા નથી. સામાન્ય રીતે માલસામાન અને મજૂરી ખર્ચ બને હિસાબોમાં સરખા છોય છે. તેથી માલસામાન ખર્ચ $₹ 8,00,000 \div \text{એકમદીઠ } ₹ 40 = \text{ઉત્પાદનના એકમો } 20,000$. શરૂનો સ્ટોક ૨૦૦૦ + ઉત્પાદન ૨૦,૦૦૦ બાદ આખર સ્ટોક ૬,૦૦૦ એકમો = વેચાણ ૧૬૦૦૦ એકમો પડતરના હિસાબો મુજબ કુલ પડતર $₹ 14,24,000$ અને નફો $₹ 3,76,000$ પડતરનાં હિસાબો માટે શરૂના સ્ટોકનું મૂલ્ય આપેલ નથી તેથી બને હિસાબોમાં $₹ 1,00,000$ દયાનમાં લેવાશે. પડતરનાં હિસાબોમાં આખરનો સ્ટોક $₹ 4,80,000$ ($18,00,000 \times 6,000 \div 20,000$) FIFO પદ્ધતિના આધારે)

૪. શ્રેયશ લિમિટેડના ચોપડેથી નીચેની નાણાંકીય માહિતી મળે છે.

વિગત	રકમ (₹)
કાચામાલનો શરૂનો સ્ટોક	૧,૫૦,૦૦૦
કાચામાલનો આખરનો સ્ટોક	૫૦,૦૦૦
પ્રત્યક્ષ વેતન	૨૪,૫૦,૦૦૦
કાચામાલની ખરીટી	૧૭,૪૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૧૨,૩૦,૦૦૦
વહીવટી શિરોપરી ખર્ચ	૬,૦૦,૦૦૦
અર્ધતૈયાર માલનો આખરનો સ્ટોક:	
માલસામાન	૩૦,૦૦૦
વેતન	૫૦,૦૦૦
કારખાના ખર્ચ	<u>૩૦,૦૦૦</u>
વેચાણ (૨૪,૦૦૦ એકમો)	૭૨,૦૦,૦૦૦
વેચાણ ખર્ચ	૫,૭૬,૦૦૦
વિતરણ ખર્ચ	૨,૦૪,૦૦૦
માંડી વાળેલ પાઘડી	૫૦,૦૦૦

આપેલ દાન	30,000
માંડી વાળેલ ડિબેન્ચર વટાવ	€0,000
મળેલ કમિશન	1,08,000
મળેલ ભાડાની આવક	72,000
તૈયાર માલનો આખરનો સ્ટોક (5,000 એકમો)	1,08,000

વર્ષ દરમ્યાન 30,000 એકમોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. પડતરના હિસાબો માટે નીચેની પદ્ધતિ અપનાવવામાં આવે છે.

- (૧) માલસામાન અને પ્રત્યક્ષ વેતન તેની ખરેખર કિંમતે દર્શાવેલ છે.
 - (૨) કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ વેતનના 50% લેખે ગણવામાં આવે છે.
 - (૩) વહીવટી શિરોપરી ખર્ચ કારખાના પડતરના 10% લેખે ગણવામાં આવે છે.
 - (૪) વેચાણ ખર્ચ એકમદીઠ ₹ 20/- લેખે ગણાય છે.
 - (૫) વિતરણ ખર્ચ વેચાણના 5% લેખે ગણાય છે.
- ઉપરની વિગતો પરથી,
- (૧) નાણાંકીય હિસાબો મુજબનું વેપાર અને નફા-નુકસાન ખાતું
 - (૨) પડતર પત્રક
 - (૩) નફા-નુકસાનનું મેળવણી પત્રક તૈયાર કરો.

(જવાબ: નફા-નુકસાન ખાતાનો નફો ₹ 12,00,000/-; પડતર હિસાબ મુજબનો નફો ₹ 13,65,800/-; નાણાંકીય હિસાબ મુજબ આખર સ્ટોકનું મૂલ્યાંકન ₹ 10,80,000/- અને પડતર હિસાબો મુજબ ₹ 12,40,800/-.)

૫. દર્શન મેન્યુફેક્ચરીંગ કંપની લિમિટેડના તારીખ: ૩૧-૧૨-૨૦૧૮ના પૂરા થતા વર્ષના નાણાંકીય હિસાબોને લગતી માહિતી નીચે મુજબ છે.

વિગત	રકમ (₹)
પ્રત્યક્ષ માલસામગ્રીનો વપરાશ	1,25,000
સીધી મજૂરી	40,000
કારખાના ખર્ચ	1,60,000
વહીવટી ખર્ચ	1,25,000
વેચાણ-વિતરણ ખર્ચ	2,40,000
ધાલખાધ	10,000
પ્રાથમિક ખર્ચ (માંડી વાળેલ)	5,000
કાનૂની ખર્ચ	2,400
મળેલ ડિવિડન	25,000
થાપણો પર વ્યાજ	5,000
વેચાણ (1,20,000 એકમો)	3,40,000
આખર સ્ટોક: તૈયાર માલ (40,000 એકમો)	50,000
અર્ધતૈયાર માલ (પ્રાથમિક પડતરે બંને ચોપડે)	40,000

પડતરના હિસાબો મુજબ:

- સીધા માલસામાનની વપરાશ રૂ ૧૪૦૦૦૦/-.
- કારખાના ખર્ચ પ્રાથમિક પડતરના ૨૦%.
- વહીવટી ખર્ચ ઉત્પાદિત એકમદીઠ રૂ ૧/- લેખે.
- વેચાણ-વિતરણ ખર્ચ વેચેલ એકમદીઠ રૂ ૨/- લેખે.

ઉપર્ણી માહિતી પરથી (૧) પડતરનું પત્રક, (૨) નાણાંકીય હિસાબો મુજબનું નફા-નુકસાન ખાતું તથા (૩) પડતરના અને નાણાંકીય હિસાબો ઢ્ણારા દર્શાવતા નફાનું મેળવણી પત્રક તૈયાર કરો.

(જવાબ: પડતર હિસાબો મુજબ ખોટ રૂ ૧,૫૧,૦૦૦/-; નાણાંકીય હિસાબો મુજબ ખોટ રૂ ૨,૫૭,૫૦૦/-.)

૬. ઉમંગ કંપનીની એકમદીઠ પડતર નીચે મુજબ છે.

માલસામાન વપરાશ	રૂ ૩૦/-
મજૂરી	રૂ ૨૦/-
કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના ૨૫%	
ઓફિસ પરોક્ષ ખર્ચ	રૂ ૬/-
વેચાણ અને વિતરણ ખર્ચ	રૂ ૨.૫૦

કંપનીનું નફા-નુકસાન ખાતું નીચે મુજબ છે.

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક (૫૦૦૦ એકમો)	૩,૫૦,૦૦૦	વેચાણ આખરનો તૈયાર માલનો સ્ટોક (૫,૫૦૦ એકમો)	૩૮,૮૦,૦૦૦
માલસામાન ખર્ચ	૧૫,૦૦,૦૦૦	બેંક વ્યાજ	૪,૫૦,૭૫૦
મજૂરી ખર્ચ	૧૦,૦૦,૦૦૦	આવકવેરા રીફંડ	૧૫,૦૦૦
કારખાના ખર્ચ	૬,૪૦,૦૦૦		૮,૦૦૦
ઓફિસ ખર્ચ	૩,૨૫,૦૦૦		
વેચાણ ખર્ચ	૧,૧૫,૨૫૦		
પેનલ્ટી	૧૫,૦૦૦		
માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ	૩,૦૦૦		
કરવેરાની જોગવાઈ	૩૪,૦૦૦		
ચોખો નફો	૩,૭૦,૫૦૦		
	૪૩,૫૩,૭૫૦		૪૩,૫૩,૭૫૦

પડતર પત્રક અને મેળવણી પત્રક તૈયાર કરો.

(જવાબ: પડતરના હિસાબોમાં આખર સ્ટોક રૂ ૪,૪૫,૨૫૦, પડતર હિસાબો મુજબ નફો રૂ ૪,૨૬,૦૦૦/-; મેળવણી પત્રકના તફાવતની રકમ નાણાંકીય હિસાબ મુજબના નફો રૂ ૩,૭૦,૫૦૦/- આવશે.) ઉત્પાદનનાં એકમો માલસામાન અથવા મજૂરીના આધારે શોધાશે. સામાન્ય રીતે બજે હિસાબોમાં માલસામાન અને મજૂરી ખર્ચ સરખા હોય છે.

$$\frac{રૂ. ૧૫૦૦૦૦૦}{રૂ. ૩૦} = ૫૦૦૦૦ \text{ એકમો}$$

$$\begin{aligned}
 & 400000 એકમો \\
 + & 4000 શરૂ સ્ટોક \\
 & 44000 - 5400 આખર સ્ટોક = 38400 વેચાણ
 \end{aligned}$$

૭. નીચેની વિગતો ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષના નાણાંકીય હિસાબોમાંથી મેળવવામાં આવી છે.

વિગત	રકમ (₹)
પ્રત્યક્ષ ભાલસાભાનનો વપરાશ	40,000
પ્રત્યક્ષ મજૂરી	30,000
કારખાના પરોક્ષ ખર્ચ	16,000
ઓફિસ પરોક્ષ ખર્ચ	7,000
વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ	6,500
ધાલખાદ	200
પ્રાથમિક ખર્ચ માંડી વાળેલ	800
કાનૂની ખર્ચ	100
ડિવિડન્ડ મળ્યું	1,000
બેંક થાપણો પર વ્યાજ મળ્યું	200
વેચાણ (12000 એકમો)	1,20,000
આખરનો સ્ટોક (તૈયાર ભાલ 400 એકમો)	3,200
આખરનો સ્ટોક (અર્ધ તૈયાર ભાલ)	2,400

પડતરના હિસાબોમાં:

પ્રત્યક્ષ ભાલસાભાનનો વપરાશ ₹ 45,000/- હતો અને કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના 20% લેખે વસૂલાત કરવામાં આવે છે. ઓફિસ પરોક્ષ ખર્ચ ઉત્પાદિત એકમદીઠ ₹ 0.50 લેખે અને વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ વેચેલ એકમદીઠ ₹ 0.80 લેખે ગણવામાં આવે છે. પડતરના હિસાબોમાં અર્ધતૈયાર ભાલ કારખાના પડતર પર ગણો.

પડતરનું પત્રક, નાણાંકીય હિસાબો મુજબ નફા-નુકસાન ખાતું અને મેળવણી પત્રક તૈયાર કરો.

(સરદાર પેટેલ યુનિવર્સિટી, નયેભર ૨૦૧૪)

(જવાબ: પડતર પત્રક મુજબનો નફો ₹ 5,542/-; નાણાંકીય હિસાબો મુજબ નફા-નુકશાન ખાતાનો નફો ₹ 12,600/-, પડતરના હિસાબોમાં આખર સ્ટોક ₹ 3,462)

૮. એકસ લિમિટેડનું તારીખ: ૩૧-૦૩-૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષનું નફા-નુકસાન ખાતું નીચે મુજબ છે.

નફા-નુકસાન ખાતું

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
કાચાભાલની ખરીદી	10,00,000	વેચાણ(14,000 એકમો)	22,40,000
પ્રત્યક્ષ મજૂરી	4,00,000	અર્ધતૈયાર ભાલ:	
કારખાના ખર્ચ	3,00,000	ભાલસાભાન	40,000

ઓફિસ ખર્ચ	2,00,000	મજૂરી	20,000	
વેચાણ ખર્ચ	1,40,000	કારખાના ખર્ચ	10,000	80,000
આવકવેરો	30,000	તૈયાર માલનો આખર		
મિલકત વેચાણની ખોટ	20,000	સ્ટોક (3000 એકમો)		3,40,000
ચોખ્ખો નફો	5,00,000	આવકવેરા રીફંડ		10,000
		વ્યાજ		20,000
	27,00,000			27,00,000

પડતર હિસાબો નીચેની માહિતી પૂરી પાડે છે.

- (૧) કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના 20% લેખે ગણવામાં આવે છે.
- (૨) ઓફિસ પરોક્ષ ખર્ચ કારખાના પડતરના 14% લેખે ગણવામાં આવે છે.
- (૩) વેચાણ પરોક્ષ ખર્ચ એકમદીઠ ₹ 8/- લેખે ગણવામાં આવે છે.

પડતરનું પત્રક અને મેળવણીનું પત્રક તૈયાર કરો. (સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૫)

(જવાબ: પડતર પત્રક મુજબ કુલ પડતર ₹ 17,54,400/- અને પડતરનાં હિસાબો મુજબ નફો ₹ 4,14,400/-; મેળવણી પત્રક : પડતર પત્રક મુજબનો નફો ₹ 4,14,400/-; તેમાં ઉમેરો: ઓફિસ ખર્ચની વધુ વસૂલાત ₹ 47,400/-; તૈયાર માલનું ઓછું મૂલ્યાંકન ₹ 11,100/- અને વ્યાજ ₹ 20,000/-; હવે બાદ કરો: કારખાના ખર્ચની ઓછી વસૂલાત ₹ 4,000/-; વેચાણ ખર્ચની ઓછી વસૂલાત ₹ 3,000/-; આવક વેરો ₹ 30,000/- અને મિલકત વેચાણ ખોટ ₹ 20,000/-; છેવટે નાણાંકીય હિસાબો મુજબ ચોખ્ખો નફો ₹ 4,00,000/- મળશે.)

- e. બિંદુ લિમિટેડનું તારીખ: ૩૧-૧૨-૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા-નુકસાન ખાતું નીચે પ્રમાણે છે.

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
માલસામાન	40,000	વેચાણ	
પ્રત્યક્ષ મજૂરી	24,000	(2,700 એકમો)	1,00,000
ઉત્પાદનનાં ખર્ચ	16,000	આખર સ્ટોક	
ઓફિસ ખર્ચ	14,000	(ઉત્પાદનના 10%)	4,000
વેચાણ-વિતરણ ખર્ચ	6,000	વ્યાજ મળ્યું	400
માંડી વાગેલ પ્રાથીમક ખર્ચ	4,000	ડિવિડન મળ્યું	400
માંડી વાગેલ પાઘડી	200	ભારું મળ્યું	400
ચોખ્ખો નફો	2,000		
	1,06,200		1,06,200

પડતરના હિસાબો નીચેની માહિતી પૂરી પાડે છે.

- (૧) માલસામાન અને મજૂરી તેની પડતર કિંમતે દર્શાવવામાં આવે છે.
- (૨) ઉત્પાદનના ખર્ચ મજૂરીના 50% લેખે વસૂલ કરવામાં આવે છે.
- (૩) ઓફિસ પરોક્ષ ખર્ચ કારખાના પડતરના 20% લેખે છે.
- (૪) વેચાણ-વિતરણ પરોક્ષ ખર્ચ એકમદીઠ ₹ 3/- લેખે ગણવાના છે.

તैयार कરो : (૧) પડતરનું પત્રક, (૨) મેળવણીનું પત્રક. (સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૬)

(જવાબ: પડતર પત્રક મુજબ કુલ પડતર ₹ ૯૦,૧૮૦/- અને નફો ₹ ૬,૮૨૦/-, પડતરમાં આખરનો સ્ટોક ₹ ૬,૧૨૦, ઉત્પાદન = ૨૭૦૦ × ₹૦ એકમો)

૧૦. મહારાજા કંપની લિમિટેડનું તારીખ: ૩૧-૦૩-૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર અને નફા-નુકસાન ખાતું નીચે મુજબ છે.

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
માલસામાની વપરાશ	૩,૦૦,૦૦૦	વેચાણ	
પ્રત્યક્ષ મજૂરી	૧,૫૦,૦૦૦	(૧૮૦૦૦ એકમો)	૬,૩૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૭૫,૦૦૦	તैયાર માલનો સ્ટોક	
વહીવટી પરોક્ષ ખર્ચ	૩૦,૦૦૦	(૨૦૦૦ એકમો)	૫૦,૦૦૦
વેચાણ અને વિતરણ ખર્ચ	૪૫,૦૦૦	મળેલ ડિવિન્ડ	૬,૦૦૦
પ્રાથમિક ખર્ચ ભાંડી વાળેલ	૧૦,૦૦૦	મળેલ વ્યાજ	૧૦,૦૦૦
આવકવેરો	૨૦,૦૦૦		
ચોખ્ખો નફો	૬૬,૦૦૦		
	૭,૮૮,૦૦૦		૭,૮૮,૦૦૦

કંપની એકમાન એકમોનું ઉત્પાદન કરે છે. પડતર હિસાબોમાં:

- (૧) કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના ૨૦% ફાળવ્યા છે.
- (૨) વહીવટી પરોક્ષ ખર્ચ ઉત્પાદિત એકમો પર ₹ ૨/- લેખે એકમદીઠ ગણવાનો છે.
- (૩) વેચાણ અને વિતરણ ખર્ચ વેચેલ એકમદીઠ ₹ ૩/- લેખે ગણવાનો છે.
તમારે પડતર પત્રક અને નાણાંકીય હિસાબો મુજબ આપેલ નફા સાથેનું મેળવણી પત્રક બનાવવાનું છે. (સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૨)

(જવાબ: કુલ વેચાણ પડતર : પડતર પત્રક મુજબ ₹ ૫,૭૯,૦૦૦/-; વેચાણ હિસાબો મુજબ નફો ₹ ૫૪,૦૦૦/-, પડતરમાં આખરનો સ્ટોક ₹ ૫૮,૦૦૦)

૧૧. ગણેશ કંપની તેની ઉત્પાદનની એકમદીઠ પડતર નીચે મુજબ પૂરી પાડે છે.

માલસામાન વપરાશ	₹ ૧૮૦/-
મજૂરી	₹ ૧૦૦/-
કારખાના શિરોપરી ખર્ચ પ્રાથમિક પડતરના	૫૦% લેખે
ઓફિસ શિરોપરી ખર્ચ	₹ ૪૦/-
વેચાણ અને વિતરણ ખર્ચ	₹ ૩૦/-

નાણાંકીય હિસાબો મુજબનું નફા-નુકસાન ખાતું

વિગત	રકમ (₹)	વિગત	રકમ (₹)
તैયાર માલનો શરૂઆતનો સ્ટોક (૨૦૦ એકમો)	૭૯,૦૦૦	વેચાણ તૈયાર માલનો આખરનો સ્ટોક (૧૦૦ એકમો)	૮૦,૦૦૦
માલસામાન ખર્ચ	૨,૭૦,૦૦૦		૩૪,૦૦૦

મજૂરી ખર્ચ	૧,૫૦,૦૦૦	વ્યાજ-ડિવિડન્ડ મળું	૫,૦૦૦
કારખાના ખર્ચ	૧,૦૦,૦૦૦		
ઓફિસ ખર્ચ	૫૫,૦૦૦		
વેચાણ ખર્ચ	૪૫,૦૦૦		
પ્રાથમિક ખર્ચ	૧૪,૦૦૦		
ચોખ્ખો નકો	૧,૩૦,૦૦૦		
	૮,૪૦,૦૦૦		૮,૪૦,૦૦૦

પડતર હિસાબોમાં માલસામાન અને મજૂરી તેવી ખરી કિંમતે ગણવાના છે. પડતર હિસાબોનો શરૂઆતનો સ્ટોક નાણાંકીય હિસાબોના મૂલ્યાંકન પ્રમાણે ગણવાનો છે, જ્યારે આખરનો સ્ટોક વર્ષ દરમ્યાન થયેલ ઉત્પાદન એકમોને આધારે મૂલ્યાંકીત કરવાનો છે. પડતર પત્રક અને મેળવણી પત્રક બનાવો.

(સરદાર પટેલ યુનિવર્સિટી, ૨૦૧૪)

(જવાબ: કુલ પ્રતીર : ₹ ૮,૦૭,૨૦૦/-; પ્રતીર પત્રક મુજબ ખોટ ₹ ૭,૨૦૦/- પ્રતીરનો આપણ સ્ટોક ₹ ૪૮,૮૦૦, બેચાણ ૧૫૦૦ એકમો, વેચાણ ૧૫૦૦ એકમો, પ્રક્રિયા રૂંડ જુઓ)

૧૨. દક્ષ લિમિટેડના ચોપકેથી નીચેની ભાહિતી ઉપલબ્ધ છે.

વિગત	રકમ (₹)
કાચામાલનો શરૂનો સ્ટોક	૨૬,૦૦૦
કાચામાલની ખરીદી	૧,૮૭,૦૦૦
કાચામાલનો આખરનો સ્ટોક	૩૨,૦૦૦
પ્રત્યક્ષ ભજૂરી: ચૂકવેલ	૨,૮૦,૦૦૦
ચૂકવવાની બાકી	<u>૧૮,૦૦૦</u>
ચૂકવવાની બાકી	૨,૬૮,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચા	૧,૯૦,૭૫૦
વહીવટી શિરોપણી ખર્ચા	૧,૨૨,૫૦૦
અર્ધતૈથાર માલ (આખરનો સ્ટોક):	
માલસામાન	૪,૦૦૦
વેતન	૫,૫૦૦
કારખાના ખર્ચ	<u>૩,૩૦૦</u>
વેચાણ (૭,૫૦૦ એકમો)	૧૨,૮૦૦
વેચાણ ખર્ચ	૬,૧૨,૦૦૦
વિતરણ ખર્ચ	૧,૦૦,૦૦૦
માંડી વાગેલ પ્રાથમિક ખર્ચ	૬૪,૦૦૦
ચૂકવેલ દંડ	૫,૦૦૦
ડિબેન્ચર ડિસ્કાઉન્ટ માંડી વાગેલ	૧,૫૦૦
ભાડાની આવક	૩,૦૦૦
ડિવિડની આવક	૨,૫૦૦
તૈથાર માલનો આખરનો સ્ટોક (૧,૪૦૦ એકમો)	૧,૧૭,૫૦૦

પડતરના હિસાબો મુજબ નીચેની ભાહિતી છે.

- (૧) માલસામાન અને મજૂરી તેની ખરેખર કિંમતે લીધેલ છે.

(૨) કારખાના ખર્ચ પ્રત્યક્ષ મજૂરી પર ૫૦% લેખે.

(૩) વહીપટી પરોક્ષ ખર્ચ ઉત્પાદન એકમો પર ₹ ૧૨/- લેખે.

(૪) વેચાણ ખર્ચ વેચેલ એકમદીઠ રૂ ૧૦/-.

(૫) વિતરણ ખર્ચ વેચાણના ૮% લેખે.

તૈથાર કરો. ૧) નાણાંકીય નફા-નુકસાન ખાતું, ૨) પડતર પત્રક, ૩) મેળવણી પત્રક.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૭)

(જવાબ: નાણાંકીય નફા-નુકસાન ખાતા મુજબ નફો રૂ ૮૧,૧૫૦/-; પડતર હિસાબ મુજબ કુલ પડતર રૂ ૭,૮૭,૩૫૦/-; પડતર હિસાબો મુજબ નફો રૂ ૧,૨૪,૫૪૦/-; મેળવણી પત્રક મુજબ તફાવતની રકમ એ નાણાંકીય હિસાબ મુજબનો નફો આવશે, પડતરના હિસાબોમાં આખર સ્ટોક રૂ ૧,૧૭,૫૦૦) (૭,૫૫,૦૦૦ x ૧૪૦૦ ÷ ૬૦૦૦)

૧૩. બી. આર. કંપનીના નાણાંકીય હિસાબો ૩૧-૦૩-૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષના અંતે નીચે મુજબની રકમ ઉપલબ્ધ છે.

વિગત	રકમ (રૂ)
વેચાણ (૫૦૦૦૦ એકમો)	૫,૦૦,૦૦૦
આખરનો સ્ટોક (તૈથાર સ્ટોક ૨૦૦૦૦ એકમો)	૫૦,૦૦૦
પ્રત્યક્ષ માલસામાન	૧,૨૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૬૦,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૪૫,૦૦૦
વહીવટી પરોક્ષ ખર્ચ	૨,૪૦,૦૦૦
વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચ	૮૦,૦૦૦
ડિબેન્યર પર વ્યાજ	૨૦,૦૦૦
આવકવેરો ચૂકવેલ	૭,૫૦૦
કાનૂની ખર્ચ	૨,૫૦૦
શેર-સંકુમાંથી મળેલ નફો	૧૨,૫૦૦
થાપણ પર મેળવેલ વ્યાજ	૭,૫૦૦

પડતરના હિસાબો મુજબ:

માલસામાન વપરાશ રૂ ૧,૩૫,૦૦૦/-, વહીવટી પરોક્ષ ખર્ચ રૂ ૨/- ઉત્પાદિત એકમદીઠ, કારખાના પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના ૨૦% લેખે તથા વેચાણ અને વિતરણ ખર્ચ રૂ ૫/- એકમદીઠ.

તૈથાર કરો: ૧) પડતર પત્રક, ૨) નાણાંકીય નફા-નુકસાન ખાતું, ૩) નાણાંકીય અને પડતર પત્રકના નફા કે ખોટનું મેળવણી પત્રક. (સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૭)

(જવાબ: પડતર પત્રક મુજબ કુલ પડતર રૂ ૬,૮૨,૫૦૦/- અને ખોટ રૂ ૮૨,૫૦૦/-; નફા-નુકસાન ખાતે નફો રૂ ૭૫,૦૦૦/-, પડતરના હિસાબોમાં આખર સ્ટોક રૂ ૧,૦૭,૫૦૦) (રૂ ૪,૩૦,૦૦૦ x ૨૦,૦૦૦ એકમો ÷ ૬૦૦૦૦ એકમો)

૧૪. આર. કે. કંપનીના નાણાંકીય હિસાબી ચોપડેથી નીચે મુજબની માહિતી મળે છે.

વિગત	રકમ (₹)
૧) વેચાણ (૮૦,૦૦૦ એકમો)	૮,૦૦,૦૦૦
૨) આખરનો સ્ટોક : તૈયાર સ્ટોક (૨૦,૦૦૦ એકમો)	૭૦,૦૦૦
૩) પ્રત્યક્ષ માલસામાન વપરાશ	૧,૭૫,૦૦૦
૪) પ્રત્યક્ષ મજૂરી	૭૫,૦૦૦
૫) કારખાના શિરોપરી ખર્ચ	૧,૦૦,૦૦૦
૬) વહીવટી શિરોપરી ખર્ચ	૩,૦૦,૦૦૦
૭) વેચાણ અને વિતરણ ખર્ચ	૬૦,૦૦૦
૮) ડિલેન્યર પર ચૂકવેલ વ્યાજ	૧૨,૦૦૦
૯) ચૂકવેલ આવકવેરો	૬,૦૦૦
૧૦) કાળૂની ખર્ચ	૪,૦૦૦
૧૧) શેરસંઝ્ઞામાંથી મળેલ નફો	૨૮,૦૦૦
૧૨) થાપણ પર મળેલ વ્યાજ	૬,૦૦૦

પડતર હિસાબો મુજબ:

પ્રત્યક્ષ માલસામાન વપરાશ ₹ ૧૬૦૦૦૦/-

કારખાના શિરોપરી ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના ૨૫%.

વહીવટી શિરોપરી ખર્ચ ₹ ૩/- ઉત્પાદન એકમદીઠ.

વેચાણ અને વિતરણ ખર્ચ ₹ ૫/- એકમદીઠ.

તૈયાર કરો.

૧) પડતર પત્રક, ૨) નાણાંકીય નફા-નુકસાન ખાતું, ૩) મેળવણી પત્રક.

(સરદાર પટેલ ચુનિવર્સિટી, ૨૦૧૮)

- (જવાબ: (૧) પડતર પત્રક મુજબ કુલ પડતર ₹ ૮,૬૭,૦૦૦/- અને ખોટ ₹ ૬૭,૦૦૦/-.
(૨) નફા-નુકસાન ખાતે નફો ₹ ૧,૪૨,૦૦૦/-.
(૩) મેળવણી પત્રક પડતર હિસાબો મુજબની ખોટથી શરૂ કરાતાં નાણાંકીય હિસાબો મુજબ નફો મળશે તેની તફાવતની રકમ મુજબ.)
(૪) પડતરના હિસાબો મુજબ આખર સ્ટોક ₹ ૧,૧૬,૭૫૦

૧૫. ધારો કે કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના ૫૦% અને ઓફિસ પરોક્ષ ખર્ચ કારખાના પડતરના ૨૦% લેખે વસ્તુલ કરવામાં આવતા હોય અને ખરેખર થયેલાં ખર્ચ નીચે મુજબ છે.

	રકમ (₹)
માલસામાન	૧,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૭૫,૦૦૦
કારખાના પરોક્ષ ખર્ચ	૫૦,૦૦૦
ઓફિસ પરોક્ષ ખર્ચ	૪૦,૦૦૦
૧૦% જેટલો તૈયાર માલ સ્ટોકમાં રહે છે.	
વેચાણ	૨,૫૦,૦૦૦

તૈયાર કરો.

- (૧) નફા-નુકસાનના પત્રક મુજબનો નફો.(૨) પડતર પત્રક મુજબનો નફો.(૩) મેળવણી પત્રક.
(ગુજરાત ચુનિવર્સિટી, ૨૦૦૭)

(જવાબ: નાણાંકિય હિસાબો મુજબ: ચોખ્ખો નફો રૂ ૭,૫૦૦/-; આખર સ્ટોકનું કારખાના પડતરે મૂલ્યાંકન
રૂ ૨૨,૫૦૦/-.

પડતર હિસાબો મુજબ: ચોખ્ખો નફો રૂ ૧૨,૪૦૦/-; કારખાના પરોક્ષ ખર્ચ રૂ ૪૫,૦૦૦/-; ઓફિસ
પરોક્ષ ખર્ચ રૂ ૪૪,૦૦૦/-; આખર સ્ટોક રૂ ૨૫,૪૦૦/-.

પડતર હિસાબોથી મેળવણી પત્રકમાં ઉમેરો: ઓફિસ ખર્ચની વધુ વસૂલાત રૂ ૪,૦૦૦/- અને
બાદ કરો: કારખાના પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત રૂ ૫,૦૦૦/- અને આખર સ્ટોકનું વધુ મૂલ્યાંકન
રૂ ૩,૬૦૦/-.)

★ ★ ★

પ્રકરણાઃ ૫

સંચાલકીય હિસાબી પદ્ધતિ : લાક્ષણિકતાઓ અને કાર્યક્ષેત્ર (માત્ર થીયરી)

- ૫.૧ પ્રસ્તાવના
- ૫.૨ સંચાલકીય હિસાબી પદ્ધતિનો અર્થ અને વ્યાખ્યા
- ૫.૩ સંચાલકીય હિસાબી પદ્ધતિની લાક્ષણિકતાઓ અને કાર્યક્ષેત્ર
- ૫.૪ સંચાલકીય હિસાબી પદ્ધતિનાં લાભો અને મર્યાદાઓ
- ૫.૫ સંચાલકીય હિસાબી પદ્ધતિનાં કાર્યો
- ૫.૬ સંચાલકીય હિસાબી પદ્ધતિની મુખ્ય પદ્ધતિઓ
- ૫.૭ સંચાલકીય હિસાબી પદ્ધતિ, નાણાંકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવત
- ૫.૮ સંચાલકીય હિસાબનીશનું સ્થાન અને ભૂમિકા (કાર્યો)
- ૫.૯ સ્વાધ્યાય

૫.૧ પ્રસ્તાવનાઃ

૫.૧.૧ સંચાલકીય હિસાબી પદ્ધતિનો પરિચયઃ

ધંધાકીય પ્રવૃત્તિ માટે નાણાંકીય માહિતી ખૂબ જ જરૂરી છે અને આ માહિતી પૂરી પાડવાના હેતુથી હિસાબો રાખવામાં આવે છે, જે ધંધાકીય પ્રવૃત્તિમાં રસ ધરાવતાં વિવિધ પક્ષોને પહોંચાડવાની હોય છે. આવા ધંધાકીય હિત ધરાવતાં વિવિધ પક્ષો જેવાં કે, શેરધારકો, બેંકર્સ, લેણાદારો, સરકાર, કરયેરા સત્તાધીશો તથા સૌથી મહત્વનો પક્ષ એ સામાન્ય પ્રજા છે. નાણાંકીય માહિતીને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે જેવાં કે, નાણાંકીય હિસાબો, પડતર હિસાબો અને સંચાલકીય હિસાબો.

અત્યારના સમય પ્રમાણે માત્ર નાણાંકીય હિસાબોના ધોરણો જ ધંધાકીય નિર્ણય કરવો એ ચોઝ્ય નથી. પ્રવર્તમાન ધંધાકીય વાતાવરણ ખૂબ જ ઝડપથી વિકસાતું અને જુદાં-જુદાં ઘટકોથી અસર પામતું રહે છે. જેને કારણો માત્ર નાણાંકીય કે પડતર હિસાબો પર આધાર રાખવો એ જોખમ બરેલ છે અને તેની અમુક મર્યાદાઓ પણ છે જેને લીધે નવી હિસાબી પદ્ધતિ ઉદ્ભબી જેને સંચાલકીય હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જો કે ત્રણેય હિસાબી પદ્ધતિઓનું ધંધામાં પોતાનું અલગ અસ્તિત્વ, હેતુ અને મહત્વ છે.

૫.૧.૨ નાણાંકીય હિસાબી પદ્ધતિઃ

નાણાંકીય હિસાબો મુજબત્વે ધંધાના નાણાંકીય વ્યવહારો સાથે સંબંધ ધરાવતાં હોય છે, જેનો હેતુ વાર્ષિક હિસાબો સંચાલકો અને અન્ય ધંધા સાથે જોડાયેલ વિવિધ પક્ષકારો સમક્ષ રજૂ કરવાનો હોય છે. સમાજના વિકાસ સાથે ધંધામાં હિસાબોની જરૂરિયાત ઉભી થઈ છે જે અનિવાર્ય પણ છે.

અમેરિકન ઇન્સ્ટિટ્યુટ ઓફ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સના મતે, “નાણાંકીય હિસાબો એ આર્થિક વ્યવહારોને ચોપડે નોંધવા, વર્ગીકૃત કરવા અને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવાની કળા છે તેમજ નાણાંકીય વ્યવહારો તથા બનાવોના સંદર્ભમાં તેના પરિણામનું અર્થાદાન કરે છે.”

આમ, ઉપર મુજબની વ્યાખ્યા પરથી એ ફિલિત થાય છે કે નાણાંકીય હિસાબોનાં મુજબત્વે બે મહત્વનાં પત્રકો દ્વારા ધંધાની નફાકારકતા અને આર્થિક સફ્ફરતાની માહિતી મેળવી શકાય છે, જે વર્ષના અંતે તૈયાર કરવામાં આવતા હોય છે.

- (૧) નફા અને નુકશાન ખાતું, જે-તે વર્ષનો ચોખ્ખો નફો કે ખોટ દર્શાવે છે. (નફાકારકતા દર્શાવે છે)
- (૨) પાંકું સરવૈયું, જે-તે સમયની ધંધાની નાણાંકીય સ્થિતિ દર્શાવે છે. (આર્થિક સફ્ફરતા દર્શાવે છે)

આ બે પત્રકોનો આધાર લઈ ધંધાની નાણાંકીય પરિસ્થિતિનો અંદાજ કરી શકાય છે, જે નાણાંકીય નિર્ણયો માટે ખૂબ જ જરૂરી છે.

નાણાંકીય હિસાબોનો હેતુ કંપનીની આવક અને નાણાંકીય સ્થિતિને સાચી અને ચોઝ્ય રીતે રજૂ કરવાનો છે.

❖ નાણાંકીય હિસાબી પદ્ધતિની મર્યાદાઓ:

નાણાંકીય હિસાબો વગર ધંધાની કોઈપણ પ્રવૃત્તિ શક્ય નથી જ. પરંતુ આધુનિક ધંધાકીય વ્યવહારોનો વધતો જતો વ્યાપ અને તેનો વિકાસ તેમજ તેની ગ્રૂપવણાભરી પ્રક્રિયાને લીધે માત્ર નાણાંકીય હિસાબોથી જ ન ચાલી શકે, કારણ કે નાણાંકીય હિસાબોની અમુક મર્યાદાઓને લીધે ધંધાના બધાં જ નિર્ણયો ચોઝ્ય રીતે લઈ ન શકાય. આમ, નાણાંકીય હિસાબો અમુક હંદ સુધી સંચાલકીય નિર્ણયોમાં સિમિત થઈ જાય છે. નાણાંકીય હિસાબોની મર્યાદાઓ નીચે મુજબ છે.

૧. મર્યાદિત માહિતી જ પૂરી પાડે છે.
૨. ધંધાની ઐતિહાસિક પડતરની વિગતો પૂરી પાડે છે જે નિર્ણય માટે એટલી ઉપયોગી નથી થતી.
૩. સંચાલનની વિવિધ સપાઠીએ જોઈતી માહિતી પૂરી નથી પાડતું.
૪. માત્ર આંકડાકીય માહિતી આપે છે તેનું અર્થધટન નહીં.
૫. નિર્ણય ઘડતર માટે અપૂરતી માહિતીના કારણે ખામી ભરેલાં નિર્ણયો લેવાતાં હોય છે તેથી તે નિર્ણયો માટે ઉપયોગી નથી.
૬. માહિતીને પુનઃ ગોઠવવાની અને મૂલવવાની જરૂર પડે છે.

આમ, ઉપરની નાણાંકીય હિસાબોની મર્યાદાને કારણે સંચાલકીય હિસાબોનો ઉદ્ભવ થયેલ છે જે આ મર્યાદાઓને કેટલેક અંશે દૂર કરે છે અને સંચાલકીય નિર્ણયોમાં ખૂબ ઉપયોગી સાબિત થયેલ છે. જો કે નાણાંકીય હિસાબો પોતાના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. સંચાલકીય નિર્ણયો માટે સંચાલકીય હિસાબી પદ્ધતિની જરૂર છે.

૫.૧.૩ પડતર હિસાબી પદ્ધતિ:

ધંધાકીય હિસાબો માટેની બીજી શાખા એટલે પડતર હિસાબી પદ્ધતિ જે નાણાંકીય હિસાબોની મર્યાદાઓ દૂર કરવામાં અગત્યનો ભાગ બજવે છે. માત્ર નાણાંકીય હિસાબોની માહિતી આધુનિક ધંધાકીય વ્યવહારો અને નિર્ણયો માટે અપૂરતી છે અને તેથી પડતર હિસાબો પણ એટલાં જ મહત્વનાં છે. જેના આધારે સંચાલનમાં વિવિધ નિર્ણયો લદ્ય શકાય છે. પડતર હિસાબો દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી ધંધાના ખામી ભરેલ સ્ત્રોતોનો મહત્વ ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે અને તેના લીધે ધંધાની ઉત્પાદકતા અને નકારાકતા વધારી શકાય છે. પડતર હિસાબો ધંધાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની પડતર શોધવામાં મદદરૂપ થાય છે.

પડતર હિસાબોનો મુખ્ય ધ્યેય ઉત્પાદન પડતર, વેચાણ કિંમત, કુલ પડતર અને એકદીઠ પડતર શોધવાનો છે. આ ઉપરાંત અન્ય મહત્વનો ઉદ્દેશ એ પડતર પર અંકુશ રાખવાનો અને તેને ઘટાડવાનો છે. પડતર હિસાબનીશે આ અંગેનો અહેવાલ સંચાલકોને પૂરો પાડવાનો હોય છે જે ધંધાકીય નિર્ણયોમાં ખૂબ જ ઉપયોગી બને છે.

ધી ચાર્ટર્ડ ઇન્સ્ટટ્યુટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટાન્સ, યુ. કે. પડતર હિસાબોને આ રીતે વ્યાખ્યાયિત કરે છે, “તે પડતર નક્કી કરવાની પદ્ધતિ અને પ્રક્રિયા છે.”

૫.૨ સંચાલકીય હિસાબી પદ્ધતિનો અર્થ અને વ્યાખ્યા:

૫.૨.૧ સંચાલકીય હિસાબી પદ્ધતિનો અર્થ:

સંચાલકીય હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ / વિકાસ નાણાંકીય અને પડતર હિસાબોની મર્યાદા દૂર કરવા માટે થયેલ છે. સંચાલકીય હિસાબો એ સંચાલનનાં હિસાબો દર્શાવે છે એટલે કે સંચાલકોએ તેમના કાર્યો કેવી રીતે અદા કરવા તેની માહિતી પૂરી પાડે છે. સંચાલનનાં વિવિધ કાર્યો જેવાં કે, આયોજન, વ્યવસ્થાતંત્ર, માર્ગદર્શન, અંકુશ, માહિતીસંચાર વગેરે યોગ્ય રીતે તેનો અમલ કરવા તથા કરાવવા જરૂરી માહિતી અને અહેવાલ સંચાલકીય હિસાબોથી મેળવી શકાય છે. આમ, ધંધાકીય કોઈપણ પ્રવૃત્તિ કે જે ધંધાને વધુ સક્રિય અને વધુ સરળ પ્રક્રિયા બનાવે તેમજ તેની અસરકારકતા વધારે તેને સંચાલકીય હિસાબો કહી શકાય. આ પ્રકારની માહિતી સંચાલકને સમસ્યા ઓળખવામાં તેનું નિરાકરણ લાવવામાં અને કામગીરીનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ બને છે.

પ.૨.૨ સંચાલકીય હિસાબી પદ્ધતિની વ્યાખ્યા:

સંચાલકીય હિસાબી પદ્ધતિ એ સંચાલકોને મદદરૂપ થાય એવી હિસાબી પદ્ધતિ છે જે નિર્ણયલક્ષી અને અંકુશલક્ષી પદ્ધતિ તરીકે ઉપયોગી છે. આ પદ્ધતિની કેટલીક વ્યાખ્યાઓ વિવિધ લેખકો દ્વારા આપેલ છે જે નીચે વર્ણવેલી છે:

- (૧) અમેરિકન એકાઉન્ટિંગ એસોસીએશને આપેલી વ્યાખ્યા મુજબ, “સંચાલકીય હિસાબી પદ્ધતિમાં એવી પદ્ધતિઓ અને ખાલોનો સમાવેશ થાય છે જે અસરકારક આયોજન માટે ધંધાકીય પગલાં પૈકી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે તથા કામગીરીના મૂલ્યાંકન અને અર્થઘટન દ્વારા તેના અંકુશ માટે જરૂરી છે.”
- (૨) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટે આપેલી વ્યાખ્યા જોતાં, “સંચાલકીય હિસાબી પદ્ધતિ એ કાર્ય પ્રવૃત્તિઓનો સમૂહ કે પ્રક્રિયા છે. જેમાં નાણાંકીય અને કાર્યકારી સમગ્ર માહિતીની ઓળખ, એકત્રીકરણ, વિશ્લેષણ, અર્થઘટન અને મૂલ્યાંકન કરી જરૂરી અહેવાલો તૈયાર કરવા અને માહિતી પ્રેક્ષણાનું કાર્ય કરવું જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે; જેની મદદથી સંચાલકો ધંધાકીય એકમ માટે જરૂરી નિર્ણયો લઈ શકે છે.”
- (૩) શ્રી બેઝ્લીના મત મુજબ, “મેનેજમેન્ટ એકાઉન્ટન્સી એ એવી પદ્ધતિ છે, જે વિશિષ્ટ જ્ઞાન અને શક્તિ સાથ સંચાલકોને વધુ નફાકારકતા અને નુકશાનને ઓછું કરવામાં સહાયરૂપ બને છે.”
- (૪) રોબર્ટ એન્થની, “સંચાલકીય હિસાબી પદ્ધતિને એવી હિસાબી માહિતી સાથે સંબંધ છે જે સંચાલકોને ઉપયોગી નિવકે છે.”
- (૫) ધી ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ (ઇંડીઝિએ)એ આપેલ સુધારેલ વ્યાખ્યા પ્રમાણે;

સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે સંચાલકોને નીચે પ્રમાણોના હેતુ માટે માહિતી પૂરી પાડવી:

- * નીતિનું ઘડતર કરવા.
- * સાહસની પ્રવૃત્તિઓના આયોજન અને અંકુશ માટે.
- * નિર્ણય ઘડતર માટે એટલે કે લેવાનાં વૈકલ્પિક પગલાં પૈકી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા.
- * મિલકતોનો ભણ્ણતમ ઉપયોગનાં વિકલ્પો વિકસાવવા.
- * નાણાંકીય અને પડતરની માહિતીનું વિશ્લેષણ કરવું.
- * ભવિષ્યની વ્યુહરચનાઓ વિકસાવવી.

પ.૩ સંચાલકીય હિસાબી પદ્ધતિની લાક્ષણિકતાઓ અને કાર્યક્ષેત્ર:

પ.૩.૧ સંચાલકીય હિસાબી પદ્ધતિની લાક્ષણિકતાઓ:

ધંધા માટેની વિવિધ માહિતી સંચાલકીય હિસાબો દ્વારા યોગ્ય રૂપમાં સંચાલકોને પૂરી પાડવામાં આવે છે જે ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેના યોગ્ય અમલ પર જ ધંધાની સફળતાનો આધાર રહેલ છે. સંચાલકીય હિસાબોની વિવિધ લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

(૧) પૂર્વધારણા:

સંચાલકીય હિસાબો માત્ર માહિતી એકઠી કરવા માટે નથી. સંચાલકીય હિસાબો દ્વારા આ માહિતીનો ઉપયોગ ભવિષ્યના આયોજન કરવા માટે તથા યોગ્ય અને સચોટ નિર્ણય કરવા માટે થાય છે.

(૨) સંચાલનમાં મદદરૂપ:

સંચાલકીય હિસાબો સંચાલનમાં અનેક રીતે ઉપયોગી બને છે. તે સંચાલનનો એક ભાગ જ છે. સંચાલકીય હિસાબી માહિતી સંચાલનના કાર્યોમાં અસરકારકતા લાવે છે અને તેના લિધે સંચાલકીય કાર્યો સરળ અને વધુ ફળદારી બને છે.

(૩) કોઈ ચોક્કસ માળખું નથી:

સંચાલકીય હિસાબો બનાવવા અથવા સંચાલકો સામે રજૂ કરવા માટે તેનું કોઈ ચોક્કસ માળખું પૂર્વનિર્ધારીત નથી. નાણાંકીય હિસાબોમાં ચોક્કસ માળખા હોય છે અને તેમાં જ તેની નોંધ કરવાની હોય છે. સંચાલકીય હિસાબોમાં આ રીતનું કોઈ ચોક્કસ માળખું નથી. આ માહિતી સંચાલનની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવે છે અને તેને સંચાલકો સમક્ષ રજૂ કરાય છે.

(૪) કાર્યક્ષમતામાં વધારો કરે છે:

ધંધામાં વિવિધ સમસ્યા ઉદ્ભવતી હોય છે અને તેનું નિવારણ કરવાનું પણ જરૂરી બને છે. આ ઉપરાંત ધંધાના હિતોને દ્યાનમાં રાખીને જુદાં-જુદાં વિકલ્પોના પડતર અને વિશ્લેષણ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે. સંચાલકીય હિસાબો ધંધાને લગતી સમસ્યા નિવારવા તથા મહિતવના નિર્ણયોમાં શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ બને છે. આમ, તે એકમની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

(૫) તકનીકો અને ખ્યાલનો ઉપયોગ:

સંચાલકીય હિસાબોમાં માત્ર માહિતી સંગ્રહ કરવાની નથી હોતી. જરૂરી માહિતીને એકઠી કરી તેને વ્યવસ્થિત ગોઠવી અને તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે. આ પ્રક્રિયામાં વિવિધ તકનીકો જેવી કે, સીમાંત પડતર, અંદાજપત્ર અંકુશ વગેરેનો ઉપયોગ કરી આ માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે.

(૬) કારણ અને અસરનું /વિશ્લેષણ:

કોઈપણ પ્રકારના ધંધાકીય નિર્ણયને અંતિમ રૂપ આપતા પહેલાં તેની અસર તથા કારણોનો અભ્યાસ કરવામાં આવે છે જેમ કે, ધંધાકીય પડતર ઘટાડવા કથા કારણો જવાબદાર છે અને કઈ આડઅસર થતી હોય છે તેનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવે છે.

(૭) ગતિશીલ અને દિર્દરદ્ધિવાળી પ્રવૃત્તિ:

સંચાલકીય હિસાબી પદ્ધતિ સતત ચાલતી અને ગતિશીલ પ્રવૃત્તિ છે અને તે ભવિષ્યની રૂપોખાને નજરમાં રાખીને નીતિ-વિષયક નિર્ણય લેવામાં મદદરૂપ બને છે.

(૮) આ પદ્ધતિ મહદુંદંશો નાણાંકીય હિસાબો અને પડતર હિસાબો પર આધારિત છે.

(૯) આ પદ્ધતિમાં વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે જે સંચાલનને લગતાં છે. જેવાં કે, માહિતીની જાણકારી, માપણી, એકત્રીકરણ, અર્થધારણ અનેવાલ તૈયાર કરવો વગેરે.

૫.૩.૨ સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્યક્ષેત્ર:

સંચાલકીય હિસાબોનું કાર્યક્ષેત્ર ધંધાના વિવિધ વિભાગો સાથે સંકળાયેલું છે. તેનું કાર્યક્ષેત્ર ખૂબ બહોળું છે અને તેનો આશાય સંચાલનના વિવિધ કાર્યોમાં મદદનીશ તરીકે કામ કરવાનો છે. તેમાં ધંધાની અલગ-અલગ કામગીરીની બાબતોનો સમાવેશ થાય છે. નીચેનાં કાર્યો સંચાલકીય હિસાબોનું કાર્યક્ષેત્ર દર્શાવે છે.

(૧) નાણાંકીય હિસાબો:

સંચાલકીય હિસાબોના સફળતાપૂર્વક અને અસરકારક પરિણામ માટે યોગ્ય અને સાચી નાણાંકીય માહિતી અત્યંત જરૂરી છે. જો કે નાણાંકીય માહિતી એ ઐતિહાસિક આંકડાકીય માહિતી હોય છે. પરંતુ

ભવિષ્યના આચોજન અને નાણાંકીય પૂર્વધારણા માટે તે ખૂબ જ ઉપયોગી છે માટે નાણાંકીય હિસાબી પદ્ધતિનો યોગ્ય સુમેળ અને તેનો વ્યવસ્થિત અમલ આવશ્યક બને છે.

(૨) પડતર હિસાબો:

પડતર હિસાબો ઉત્પાદનની કુલ પડતર તથા એકમદીઠ પડતર શોધવા માટે ઉપયોગી છે. ઉત્પાદન પડતરને કેવી રીતે ઘટાડવી અથવા તેના પર અંકુશ રાખવો એ ધંધાની ક્ષમતા વધારવા માટે પાચારુપ છે. સંચાલકીય હિસાબોમાં પડતર હિસાબોની વિવિધ પદ્ધતિઓ અને તકનીકો જેવી કે, પ્રમાણાભૂત પડતર પદ્ધતિ, વૈકલ્પિક પડતર પદ્ધતિ, તફાવત પડતર પદ્ધતિ તથા પડતરની અન્ય પદ્ધતિઓથી જ સંચાલકીય હિસાબી પદ્ધતિ ખરા અર્થમાં ફળાયી બને છે.

(૩) અંદાજપત્ર દ્વારા અંકુશઃ

અંદાજપત્ર દ્વારા એકમોની ભવિષ્યનાં ચોક્કસ સમયની પ્રવૃત્તિ સંદર્ભમાં આચોજન, નીતિ ઘડતર અને ધંધાનાં ઉદ્દેશ્યો દર્શાવાય છે. ભવિષ્યમાં ધંધા પર વિવિધ ઘટકોની અસર શું થશે તે અંદાજુને તેને આધારે અંદાજપત્રો બનાવવામાં આવે છે. આ કાર્યક્રેત્રમાં ધંધાકીય અંદાજપત્રો થકી ખરેખર કામગીરીને અંદાજુલ અંકડા સાથે સરખાવવામાં અને તેમાં રહેલ ખાખીઓને દૂર કરવામાં આવે છે. ધંધા પર અંકુશ પ્રાસિ માટે માલસામાન અંકુશ પદ્ધતિ અને અંદાજપત્રો દ્વારા સ્ટોક તથા વિવિધ ખર્ચમાં અંકુશ મેળવી શકાય છે. આમ, ધંધાકીય પ્રવૃત્તિઓના આચોજન માટે અંદાજપત્ર દ્વારા અંકુશ અગત્યનો ભાગ ભજયે છે.

(૪) કરવેરા આચોજનઃ

સંચાલકીય હિસાબી પદ્ધતિ કરવેરા સાથે પણ સંકળાયેલ છે. ધંધાના ચોખ્ખા નફા પર કંપનીએ કરવેરો ચૂકવવો પડતો હોય છે અને તેને લગતી માહિતી જેવી કે, કર ભારણ, અગાઉથી ચૂકવેલ કરવેરો, આવક પર ભરવાનો થયેલ કર વગેરે માહિતીની સંચાલકોને ખૂબ જરૂર પડતી હોય છે. આ ઉપરાંત રીટર્ન ભરવું, કરવેરા આચોજન તેનેલગતી જોગવાઈ તથા કરવેરા બચત વગેરેનો સમાવેશ થાય છે.

(૫) વચ્ચગાળાના અહેવાલો:

સમયસર અને અસરકારક નીતિ ઘડતરના નિર્ણયો માટે ત્વરિત અને અર્થપૂર્ણ અહેવાલો રજૂ કરવાની પ્રક્રિયા હોવી જોઈએ. અહેવાલો અઠવાડિક, માસિક, ત્રિમાસિક, ઇ માસિક હોઈ શકે છે. તેમાં નાણાંકીય પત્રકોની માહિતી, રોકડ પ્રવાહની માહિતી અને અન્ય પત્રકોની માહિતી યોગ્ય સ્વરૂપમાં મૂકી એકાઉન્ટન્ટ દ્વારા સંચાલકો સમક્ષ રજૂ કરવાની હોય છે. આ માટે તે અંકડાકીય માહિતીને ગ્રાફ, ચાર્ટ કે ટેબલના સ્વરૂપમાં રજૂ કરી શકે છે. અહેવાલ રાબેતા મુજબનો અથવા ખાસ પ્રકારનો હોય છે.

(૬) અંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ:

અંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ દ્વારા ધંધાની વિવિધ પ્રવૃત્તિની અંકડાકીય માહિતીનું અવલોકન કરી તેની સરખામણી કરવામાં આપતી હોય છે. આનો હેતુ હિસાબી માહિતીને વધુ સરળ અને અર્થપૂર્ણ બનાવવાનો છે.

(૭) ઇન્વેન્ટરી અંકુશઃ

ઇન્વેન્ટરી અંકુશમાં ઇન્વેન્ટરી પર અંકુશ તેના પ્રાસિથી વપરાશ સુધી રાખવામાં આવે છે. જેમાં ઇન્વેન્ટરીની વિવિધ સપાટીઓ નક્કી કરવા અને તેના પર અંકુશ મૂકવામાં આવે છે. ઇન્વેન્ટરીની વિવિધ સપાટી જેવી કે, મહત્વમાં સ્ટોક સપાટી, લઘુત્વમાં સ્ટોક સપાટી, પુનઃ ઓર્ડર સપાટી હોય છે. માલસામાન પર જો અંકુશ રાખવામાં ન આવે તો ધંધાને મોટું નુકશાન બોગવાનું પડતું હોય છે.

(૮) પુનઃસ્થાપનાના હિસાબો:

તૈયાર કરેલા હિસાબોમાંથી માહિતીને મેળવીને પુનઃસ્થાપનાની દખિએ ભિલકતોનું મૂલ્યાંકન કરી ફરીથી હિસાબો તૈયાર કરવામાં આવે છે. જેને પરિણામે સાચો નશો જાણી શકાય અને સંચાલકીય દખિએ મૂડીની અસરકારકતા જાણી શકાય છે.

(૯) ઓફિસ સેવાઓ:

વહીવટી સેવાઓ દ્વારા સંચાલકોને નીતિ વિષયક માહિતી મળી શકે છે. ઓફિસ સેવાઓમાં મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ પાસે ત્વરિત માહિતી પૂરી પાડવાની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. સમગ્ર માહિતી ઝડપથી, સરળતાથી તૈયાર થાય, યોગ્ય રીતે રજૂ થાય અને માહિતીની અસરકારકતા વધે તે રીતે રજૂ કરવા માટે તેનો ચોગ્ય સંગ્રહ અને તેના પર ચોગ્ય પ્રક્રિયા કરીને માહિતી તૈયાર કરવાની હોય છે. હાલના સમયમાં ઓફિસ સેવાઓમાં ચોગ્ય ચાંત્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

(૧૦) આંતરિક ઓર્કિટ:

આંતરિક અંકુશ અને ગુણવત્તા અંકુશની પદ્ધતિઓનો ઉપયોગ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે છે. ધંધાના બધાં જ વિભાગો દ્વારા ચોગ્ય અને એક ધોયે સિદ્ધ માટે કામગીરી થઈ રહી છે કે કેમ તથા કોઈપણ પ્રકારની અચોગ્ય પ્રવૃત્તિ કે ગેરીતિઓ થાય છે કે કેમ તેની તપાસ જરૂરી બને છે.

(૧૧) નાણાંકીય વિશ્લેષણ અને અર્થધારણ:

નાણાંકીય પત્રકો એ નાણાંકીય હિસાબી પદ્ધતિની અંતિમ પેદાશ છે. નાણાંકીય પત્રકો ભૂતકાળના અંકડાઓની મદદથી તૈયાર કરેલા પત્રકોને આધારે તૈયાર કરવામાં આવે છે. તેનું અર્થધારણ હિસાબનીશ દ્વારા સરળ અને સમજું શકાય તેમ બનાવવામાં આવે છે જેથી સંચાલન તેના ઉદ્દેશ્યો અસરકારક રીતે પૂર્ણ કરી શકે છે.

૫.૪ સંચાલકીય હિસાબી પદ્ધતિનાં લાભો અને મય્યાંદા:

૫.૪.૧ સંચાલકીય હિસાબી પદ્ધતિનાં લાભો:

સંચાલકીય હિસાબી પદ્ધતિ સંચાલનનાં બધાં જ કાર્યોમાં અમૂલ્ય સેવાઓ પૂરી પાડે છે. સંચાલકીય હિસાબી પદ્ધતિ મહત્વાની નશો માટે અને જોટને ઘટાડવામાં સંચાલનને મદદરૂપ બને છે. આ પદ્ધતિનાં ધણાં લાભો છે જે નીચે સમજાવવામાં આવેલ છે.

(૧) આચોજન અને નીતિ ઘડતરમાં મદદરૂપ:

આચોજન એ સંચાલનનું એક પ્રાથમિક કાર્ય છે. ધંધાકીય આચોજનમાં પ્રાસ માહિતીને આધારે ધોયે નક્કી કરવો, નીતિ ઘડતર કરવું, શૈખ વિકલ્પનું મૂલ્યાંકન કરી પસંદગી કરવી વગેરેનો સમાવેશ થાય છે. આમ, આચોજન બૌદ્ધિક પ્રક્રિયા છે જે સત્ય પર આધારિત છે. સંચાલકીય હિસાબી પદ્ધતિ ભૂતકાળના પરિણામો અને ભવિષ્યના અંદાજુત પરિણામો ધ્યાનમાં લઈને ચોગ્ય પત્રકો દ્વારા આચોજન અને નીતિ ઘડતરમાં ઉપયોગી બને છે.

(૨) અર્થધારણની પ્રક્રિયામાં સહાયરૂપ:

સંચાલકીય સિહાબી પદ્ધતિથી નાણાંકીય હિસાબોની માહિતીને સરળ અને સમજું શકાય તેવી બનાવવામાં આવે છે તેથી તેનું અર્થધારણ સાચું અને ચોગ્ય કરી શકાય. સંચાલનની ઉર્ય સપાઠીએ બધાં જ અધિકારીઓ પાસે નાણાંકીય હિસાબોનું ઉંડું જ્ઞાન ન પણ હોય તેથી તેને ચોગ્ય સ્વરૂપમાં નાણાંકીય માહિતી પૂરી પાડવાનું કામ સંચાલકીય હિસાબનીશ કરે છે જેથી નાણાંકીય હિસાબોની અંકડાકીય માહિતી સમજવી સરળ બને છે.

(૩) નિર્ણય લેવામાં મદદ કરે છે:

કોઈપણ ધંધાકીય એકમ માટે સાચો નિર્ણય ધંધાની સફળતા માટે ખૂબ જ મહત્વનો છે. સંચાલકીય હિસાબી પદ્ધતિ નિર્ણય પ્રક્રિયાને વધુ વૈજ્ઞાનિક પદ્ધતિથી મહત્વની માહિતી પડતર અને નફાની માહિતી પ્રાપ્ત વિકલ્પો માટે પૂરી પાડે છે. જેના આધારે કચા વિકલ્પનો નિર્ણય ફાયદાકારક રહેશે તે જાણી શકાય છે અને ચોંચ નિર્ણય લઈ શકાય છે.

(૪) કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ:

સંચાલકીય હિસાબી પદ્ધતિ ધ્યેય અને આચ્યુતની નક્કી કરીને ધંધાની અસરકારતામાં વધારે કરે છે. આ માટે તે ધંધાના કર્મચારીઓને પ્રોત્સાહિત કરે છે અને તેમને વધુ સારું ચોગાન આપવા માટે પ્રેરિત કરે છે. કર્મચારીઓને ધંધાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે અને લખ્યોની અસરકારકપૂર્વક માપણી કરવા માટે સંચાલકીય હિસાબી પદ્ધતિ એક અસરકારક સાધન તરીકી કામ કરે છે.

(૫) વ્યવસ્થાત્રંત્રમાં મદદરૂપ:

પડતર અંકુશ અને નફામાં વૃદ્ધિ માટે સંચાલકીય હિસાબી પદ્ધતિ વિકેન્દ્રીકરણાના સિદ્ધાંત પર કામ કરે છે. આમ, તે હિસાબી કાર્યની ગોઠવણી અને નાણાંકીય હિસાબોને આધુનિક રેખામાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે.

(૬) સંકલન કાર્યોમાં સહાય:

અંદાજપત્રો, નાણાંકીય વિશ્લેષણો અને અર્થઘટન તથા નાણાંકીય અહેવાલો વગેરે દ્વારા સંચાલકીય હિસાબી પદ્ધતિ ધંધાની અસરકારકતામાં વધારો કરે છે. તે મેળવણી પત્રકો દ્વારા ચોક્કસ ધારા-ધોરણો નક્કી કરીને સંચાલનને સંકલનનાં કાર્યો માટે ચોંચ દિશા પૂરી પાડે છે.

(૭) કામગીરી અંકુશ:

અંકુશ એ સંચાલનના હાથમાં ખૂબ જ ઉપયોગી સાધન છે. પ્રમાણ પડતર, અંદાજપત્ર અંકુશ, રોકડ પ્રવાહ પત્રકો અને ભંડોળ પ્રવાહ પત્રકો કામગીરીના અંકુશ માટે અત્યંત મહત્વનું બની રહે છે.

(૮) અહેવાલ:

અહેવાલ સંચાલકોને સમયસર નિર્ણયો લેવા માટે મદદરૂપ થાય છે. આ પદ્ધતિ દ્વારા વિવિધ વિકલ્પોનું સરખામણી પત્રક ઉત્ત્ય સપાટીને અહેવાલના રૂપમાં રજૂ કરવામાં આવે છે. સંચાલકોએ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી નિર્ણય લેવાનો હોય છે. તેમાં આ અહેવાલ એ પાચાડ્યી માહિતી ઉપલબ્ધ કરાવે છે.

૫.૪.૨ સંચાલકીય હિસાબી પદ્ધતિની મર્યાદાઓ:

(૧) તે સંચાલકોનો વિકલ્પ નથી:

સંચાલકીય હિસાબી પદ્ધતિ માત્ર એક સાધન છે, તે સંચાલકનો વિકલ્પ નથી થઈ શકતું. સંચાલનમાં નિર્ણયો અને ખરાઈ પગલાં સંચાલકો દ્વારા લેવામાં આવતા હોય છે. આ હિસાબી પદ્ધતિ દ્વારા આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવે છે જે નીતિ ઘડતર માટે ઉપયોગી બનતી હોય છે. ઘણીવાર સંચાલકો પોતાની મનસુઝી મુજબ નિર્ણયો કરતાં હોય છે જેમાં સંચાલકીય હિસાબી પદ્ધતિનો અહેવાલ દ્યાનમાં ન પણ લેવાનો હોય.

(૨) સતત પ્રયત્નોની જરૂરિયાત:

સંચાલનની દરેક સપાટીએ સતત પ્રયત્નો ધંધાકીય હેતુઓ પ્રાપ્ત કરવા માટે થતાં રહેવાં જોઈએ. સંચાલકીય હિસાબનીશ દ્વારા જે પણ નીચોડ કાઢવામાં આવતો હોય છે તેના માટે સંચાલનની દરેક સપાટીનું એકસમાન દિશામાં કામ અને સતત ધ્યેયસિદ્ધિની પ્રાપ્તિ માટે પ્રયત્નો થતાં રહેવાં જોઈએ.

(3) **વિશાળ કાર્યક્રમ:**

સંચાલકોને જરૂરી માહિતી પૂરી પાડવા સંચાલકીય હિસાબનીશ દ્વારા જુદાં-જુદાં વિભાગોમાંથી વિવિધ માહિતી એકત્રીત કરવામાં આવે છે. વિશાળ કાર્યક્રમેને કારણી ઘણીબધી સમસ્યાઓ ઉદ્ભવે છે અને માહિતીમાં ચોકસાઈનો અભાવ પણ કારણારૂપ બને છે. આમ, સંચાલકીય હિસાબી પદ્ધતિનું વિશાળ કાર્યક્રમ પણ તેની એક મર્યાદા છે.

(4) **મૌલિક પદ્ધતિ નથી:**

આ પદ્ધતિ એ અન્ય પદ્ધતિની માહિતીનું મિશ્રણ ધરાવે છે જેવી કે, નાણાંકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ વગેરે. તેનું પોતાનું આગામી અસ્તિત્વ નથી. આમ, તે મૌલિક પદ્ધતિ નથી.

(5) **નાણાંકીય હિસાબોની ખામીઓ:**

સંચાલકીય પદ્ધતિ એ ખાસ કરીને નાણાંકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિની માહિતીને આધારે હિસાબો રાખતી હોય છે. આ પદ્ધતિમાં હિસાબોમાં જો કોઈ કારણાસર ભૂલ હોય અથવા તેમાં કોઈપણ પ્રકારની અચોકસાઈ થઈ હોય તો તે માહિતી નિર્ણય ધરતર માટે ઉપયોગી બનતી નથી. સંચાલકીય હિસાબનીશ દ્વારા જે કોઈ અહેવાલ આવા ખામીબર્યા હિસાબો પરથી બનાવવામાં આવ્યો હોય તો તે અહેવાલ સંચાલકોને ગેરમાર્ગ દોરી શકે છે.

(6) **વ્યક્તિગત અભિપ્રાય:**

જો સંચાલકીય હિસાબનીશ પોતાના વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે પરિણામોનું અર્થધટન કરે તો તે સાંચ ન પણ હોઈ શકે. સંચાલકીય હિસાબનીશના વ્યક્તિગત અભિપ્રાય વ્યાજબી ન હોય તો તેની વિપરિત અસર સંચાલન પર પડે છે.

(7) **ખર્ચાળ પદ્ધતિ:**

સંચાલકીય હિસાબી પદ્ધતિના વિકાસ માટે નાણાંકીય અને પડતર હિસાબી પદ્ધતિની પણ જરૂર પડે છે. આ પદ્ધતિની અસરકારક ઉપયોગિતા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાતીમ પામેલ કર્મચારીની જરૂરિયાત ઉભી થાય છે. આ ઉપરાંત માહિતી સંગ્રહ અને અન્ય જરૂરી સાધનોની વ્યવસ્થા કરવી પડતી હોય છે. આ વ્યવસ્થા ઉભી કરવી એ ખર્ચાળ છે અને તે નાના ધંધાકીય એકમોને પરવકે તેમ નથી હોતી.

(8) **કર્મચારીનો વિરોધ:**

સંચાલકીય પદ્ધતિને અપનાવવી હોય તો ધંધાકીય એકમમાં ધરખમ સુધારો માંગી લે છે. જે લોકો જુની માન્યતા ધરાવતાં હોય છે તેઓ નવીન પદ્ધતિઓનો ધંધામાં ઉપયોગ ન કરવા દેવા વિરોધ કરતાં હોય છે.

પ.૫ સંચાલકીય હિસાબી પદ્ધતિનાં કાર્યો:

સંચાલકીય હિસાબી પદ્ધતિનાં વિવિધ કાર્યો નીચે મુજબ છે.

(૧) **આધારણ અને આયોજન:**

ધંધાને લગતી કોઈપણ પ્રવૃત્તિમાં આધારણ અને આયોજન એ પાચાનું કાર્ય છે. ધંધાકીય આયોજનમાં દરેક કાર્યની પૂરી વિગત, આંકડાઓની સમજૂતી અને માહિતી તથા મહિત્વનાં અન્ય પરિબળોનું અનુભાન કરવામાં આવે છે. આ માહિતી પરથી વૈકલ્પિક યોજનાઓ ધરવામાં આવે છે અને નીતિ વિષયક નિર્ણયો કરવામાં આવે છે. સંચાલકીય હિસાબી પદ્ધતિ સંચાલનનાં આયોજનમાં મૂલ્યવાન સેવા પૂરી પાડે છે. આયોજનમાં પ્રમાણ પડતર, સીમાંત પડતર, અંદાજપત્રકો વગેરે તકનીકોનો ઉપયોગ થાય છે.

(૨) વ્યવસ્થાતંત્રની રૂપના:

વ્યવસ્થાતંત્ર એટલે કર્મચારી જૂથ અને તેમનું કાર્ય. કચો કર્મચારી કચાં અને કેટલો તથા શેના માટે જવાબદાર છે તે વ્યવસ્થાતંત્ર દ્વારા વર્ણવવામાં આવે છે. વ્યવસ્થાતંત્રમાં સત્તા સોંપણી અને જવાબદારી નક્કી કરવામાં આવે છે. સંચાલકીય પદ્ધતિ સંચાલનને તેના સ્ત્રોતોની યોગ્ય વ્યવસ્થા રચવામાં અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદરૂપ બને છે. ધંધાકીય એકમના વ્યવસ્થાતંત્રને મજબૂત બનાવવાનું કાર્ય એ સંચાલકીય હિસાબી પદ્ધતિનું છે.

(૩) સંકલન:

સંકલન, હિસાબી પદ્ધતિ માટે જ નહીં પરંતુ સંચાલનની દરેક સપાટીએ અનિવાર્ય છે. જો ધંધામાં સંકલનનો અભાવ હશે તો કોઈપણ કાર્ય અપેક્ષિત પરિણામ મેળવવામાં મદદરૂપ બનશે નહીં. સંકલન એ ધંધાકીય એકમનાં વિવિધ વિભાગોનું સુચોઽય જોડાણ અને ધંધાના હેતુ સિંક્રિયાનું જરૂરી કાર્ય છે. સંચાલકીય હિસાબનીશ સંકલનની વિવિધ તકનીકોનો ઉપયોગ કરીને ધંધાની અસરકારકતા અને નફાકારકતામાં વધારો કરે છે. બજેટરી કંટ્રોલ (અંદાજપત્ર દ્વારા અંકુશ)ના ધોરણો નક્કી કરવા અને તેને વિચારન સાથે સરખાવવા વગેરે સંકલનમાં ખૂબ જ ઉદ્યોગી છે.

(૪) અંકુશ:

વ્યવસ્થાતંત્રની દરેક પ્રવૃત્તિ પર અંકુશ મહત્વનો છે. અંકુશ દ્વારા ધંધાની અંદર ચાલી રહેલ દરેક પ્રવૃત્તિ પર ધ્યાન રાખી શકાય છે અને ધંધાના પરિણામનું પદ્ધતિસર વિશેષજ્ઞાન કરી યોજના મુજબ થતાં કામની માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે. વધુમાં જો યોજના મુજબ અને ખરેખર કાર્યમાં તશીષત જણાય તો તેમાં સુધારાનાં પગલાં લઈ શકાય. પ્રમાણ પડતર પદ્ધતિ એ અંકુશ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે જેનો ઉપયોગ સંચાલકીય હિસાબનીશ દ્વારા કરવામાં આવે છે.

(૫) માહિતી સંચાર:

માહિતી સંચાર એ માહિતીની આપ-લે સાથે સંકળાયેલ કાર્ય છે. યોગ્ય માહિતી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે મળે તો જ તેના પરિણામો ઉત્તમ મળી શકે છે. સંચાલકીય હિસાબી પદ્ધતિમાં માહિતી સંચાર અહેવાલોના રૂપમાં થાય છે. અહેવાલોને બે ભાગમાં વહેંચી શકાય છે, જેમકે સામયિક એટલે કે સમયાંતરે તૈયાર થતાં અહેવાલો અને નિર્ણય માટે ખાસ તૈયાર કરવામાં આવતા અહેવાલો. માહિતી સંચારનું કાર્ય સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આગામું સ્થાન ધરાવે છે કારણ કે માહિતી સંચાર માત્ર કર્મચારીઓ પૂરતું સીમિત નથી, પરંતુ ધંધાના બાબુ પક્ષકારોને પણ પ્રગટ થયેલ હિસાબો દ્વારા માહિતી પૂરી પાડે છે, માટે તે સરળ અને સમજું શકાય તેવી રીતે કરવામાં આવતી હોવી જોઈએ. જો માહિતી સંચાર યોગ્ય હશે તો સમસ્યાના ઉકેલ અને નિર્ણયો વધુ ઝડપથી શક્ય બનશે.

(૬) દોષવધીનું કાર્ય:

જો ધંધામાં દરેક કર્મચારી અસરકારક અને સંતોષકારક કામ કરતાં હોય તો તેનું અર્થધટન એમ થાય કે માર્ગદર્શન યોગ્ય રીતે થઈ રહ્યું છે. દરેક કર્મચારીને તેમનું સન્ભાન જળવાય એમ તેમને માર્ગદર્શન અને સલાહ-સૂચનો આપી તેમને વધુ સારું કામ કરવા પ્રેરિત કરવાનું કાર્ય સંચાલકીય હિસાબનીશનું છે. આ કાર્ય પરથી સંચાલકોની કાર્યક્રમતા માપી શકાય છે.

(૭) ધંધાકીય મિલકતોનું રક્ષણ:

ધંધાકીય મિલકતોનું રક્ષણ કરવું એ સંચાલકીય હિસાબનીશની જવાબદારી છે. તેણે ઉત્પાદનની સરળ અને સતત કાર્યવાહી થતી રહેતે માટે જરૂરી ભંડોળ, ધંધાની સ્થિર મિલકતોની મરામત, જાળવણી, વીમો અને તેની પુનઃસ્થાપના માટેની ખાતરી આપવાની હોય છે.

(૮) નાણાકીય વિશ્લેષણ અને અર્થધાટન :

સંચાલકીય હિસાબી પદ્ધતિમાં નાણાકીય હિસાબો, પડતરના હિસાબો અને પોતે એકત્રિત કરેલ માહિતીનું નાણાકીય વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના આધારે ખર્ચ/લાભ વિશ્લેષણ કરવામાં આવે છે.

૫.૬ સંચાલકીય હિસાબી પદ્ધતિની મુખ્ય પદ્ધતિઓ:

સફળ સંચાલન માટે માત્ર માહિતી બેગી કરી તેનો અહેવાલ બનાવવો એટલું જ પૂરતું નથી. સંચાલનના દરેક કાર્યને અસરકારક બનાવવા અને ધંધાકીય એકમના દ્યેયને સિઝ્ક કરવા મેળવેલ માહિતીને યોગ્ય રૂપમાં ગોઠવી તેનું વિશ્લેષણ અને અર્થધાટન પણ ખૂબ જ જરૂરી છે. હિસાબનીશ દ્વારા સમયસર અને જરૂરી માહિતી જે ઉપયોગી હોય તે મુજબ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી પરિણામલક્ષી સૂચનો કરવા જોઈએ. હિસાબનીશ પોતે આ પદ્ધતિઓનો પૂરૈપૂરો ઉપયોગ કરવા પોતે તેવું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને કાર્યક્ષમ હોવો જોઈએ. સંચાલકીય હિસાબી પદ્ધતિની મુખ્ય પદ્ધતિઓ નીચે પ્રમાણે છે:

(૧) નાણાકીય નીતિ અને હિસાબોનું આયોજન:

નાણાં એ ધંધાના હૃદય સમાન છે માટે નાણાકીય આયોજન અને તેની નીતિ ઘડતર માટે નાણાકીય હિસાબો તથા કંપનીની લેવડ-દેવડની નોંધ જરૂરી બને છે. વધુમાં કંપની ધારાની જોગવાઈઓ પણ મહત્વની છે. નાણાકીય નીતિમાં કંપની પોતાના મૂડી માળખાનો નિર્ણય કરતી હોય છે જેમાં નાણાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ, ટ્રંકાગાળાના તેમજ લાંબાગાળાના ઉદ્દેશો નક્કી કરે છે એ મુજબ તેનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત કંપની તેના મૂડી માળખાનાં કેટલો હિસ્સો શેરમૂડીનો અને કેટલો હિસ્સો ઉધાર લીધેલ મૂડીનો રાખવા ધર્છે છે તથા તેના ઉધાર વ્યવહારોની નીતિ જેવી કે ઉધાર વેચાણ, વટાવ વગેરેને પણ ધ્યાનમાં લેવાય છે.

(૨) સીમાંત પડતર પદ્ધતિ:

કોઈપણ વસ્તુના ઉત્પાદનમાં તેની કુલ પડતરને ધ્યાનમાં લેવાય છે. વસ્તુની કુલ પડતરમાં મુખ્યત્વે ચલિત અને સ્થિર પડતરનો સમાવેશ થતો હોય છે. વસ્તુની એકમદીઠ પડતરમાં માત્ર ચલિત ખર્ચનો સમાવેશ થાય છે. આ પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ સંચાલનને કિંમતનીતિ, નફા-જથ્થાનું આયોજન, પડતર વિશ્લેષણ, સમતૂટ વિશ્લેષણ વગેરેની મદદથી યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. સંચાલકો માટે ખર્ચ, આવક અને નફાની માહિતી યોગ્ય નિર્ણય માટે મહત્વની છે.

(૩) અંદાજપત્ર દ્વારા અંકુશ:

અંદાજપત્ર એટલે ધંધાકીય એકમોનું અપેક્ષિત કાર્ય, ઉત્પાદન, નફો કે ખર્ચ વગેરે માટે તૈયાર કરવામાં આવતું પત્રક. અંદાજપત્રમાં અંદાજુત અંકડા મૂકવામાં આવતા હોય છે અને અંદાજપત્ર બનાવાય છે. ત્યારબાદ ચોક્કસ સમયના અંતે જે કાંઈ ખરેખર કામ થયેલ હોય તેને અંદાજપત્રના અંકડાઓ સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણી પરથી ધંધાની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે અને વધુમાં સુધારાત્મક પગલાં લેવાં કે નહીં તેનો નિર્ણય લેવામાં આવે છે. આ પદ્ધતિની મદદથી ઘણી બધી નાણાકીય પ્રવૃત્તિઓનું આયોજન અને અંકુશ થઈ શકે છે. આ પદ્ધતિ સંચાલકોને અપેક્ષિત વળતરનો દર પ્રાપ્ત કરવામાં સહાયરૂપ બને છે.

(૪) પ્રમાણ પડતર પદ્ધતિ:

પ્રમાણ પડતર પદ્ધતિ મુખ્યત્વે માલસામાન અને મજૂરીના ખર્ચને ધ્યાનમાં રાખીને ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિ અંતર્ગત પહેલાંથી જ ખર્ચનાં યોગ્ય પ્રમાણ / ધોરણો નક્કી કરવામાં આવે છે અને તે મુજબ કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. આ પૂર્વ નિર્ધારિત પડતરને બાદમાં ખરેખર પડતર સાથે રજૂ કરી તેની સરખામણી કરવામાં આવે છે. સરખામણી દ્વારા મળતા સકારાત્મક અથવા નકારાત્મક

વિચલનોના વિશ્લેષણાત્મક અભ્યાસથી સંચાલકીય હિસાબનીશ સુધારાલક્ષી જરૂરી પ્રક્રિયા કરીને અંકુશ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રક્રિયાથી સમગ્ર ધંધાકીય એકમ ઉપર અંકુશ રહે છે. પ્રમાણ પડતર પ્રક્રિયા ધંધાકીય પ્રવૃત્તિઓ પર અંકુશ અને તેના ભવિષ્યની નીતિ ઘડતરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

(૫) ઐતિહાસિક પડતર પ્રક્રિયા:

નાણાંકીય હિસાબો એ ઐતિહાસિક પડતરને આધિન છે એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ તેનાં બધાં ખર્ચ ઉપરથી જે પડતર શોધવામાં આવે છે તેને ઐતિહાસિક પડતર કહેવામાં આવે છે. સંચાલકીય હિસાબનીશ નાણાંકીય હિસાબી પ્રક્રિયા મુજબની પડતરની માહિતીનો ઉપયોગ કરે છે. આ પડતરની માહિતીને પ્રમાણ પડતર સાથે સરખાવી પડતર અંકુશનો હેતુ સિદ્ધ કરી શકાય છે.

(૬) ગુણોત્તર વિશ્લેષણ:

ગુણોત્તર વિશ્લેષણ એ સંચાલકોનું અતિ મહત્વનું અને અસરકારક સાધન છે. ગુણોત્તર વિશ્લેષણમાં વિવિધ ગુણોત્તર જેવાં કે, એકમની નફાકારતા, તરલતા, સંક્રતા અને કાર્યક્ષમતાને સંબંધ ધરાવતાં ગુણોત્તરનો ઉપયોગ કરી એકમની કાર્યદક્ષતા અને ભાવિ અનુમાન કરી શકાય છે. વધુમાં, ગુણોત્તર વિશ્લેષણ ધંધાનાં બાધ્ય પક્ષો માટે પણ રોકાણ અંગેના નિર્ણય માટે ઉપયોગી બને છે.

(૭) કુગાવાલકીય હિસાબો:

બજારમાં કુગાવો પ્રવર્તમાન હોય છે અને તે સતત બદલાતો રહે છે. દેશની આર્થિક સ્થિતિને આધારે કુગાવાનો દર બદલાતો રહે છે. કુગાવાની અસરને કારણે ભાવસપાટીમાં સતત બદલાવ થતો રહે છે. ભાવસપાટીમાં થતાં બદલાવને કારણે ધંધાની મૂડીને જાળવવાનું કામ અધિં બની જાય છે. કુગાવાની અસર નાણાંકીય પ્રવૃત્તિઓ અને પત્રકો પર ક્યારે, કેટલી અને કેવી રીતે થશે તે જાણવું સંચાલકો માટે ખૂબ જરૂરી છે. આમ, સંચાલકીય હિસાબનીશ દ્વારા આ હિસાબો મહત્વનાં બને છે.

(૮) ભંડોળ પ્રવાહ વિશ્લેષણ:

ધંધાકીય એકમમાં પ્રાપ્ત થયેલ ભંડોળનાં પ્રાભિસ્થાનો અને તેનો ઉપયોગ કર્યાં અને કેટલા પ્રમાણમાં થથો છે તેની માહિતી ભંડોળ પ્રવાહ પત્રકો પરથી મળે છે. આ પત્રકો દ્વારા ધંધાની કાર્યશીલ મૂડીમાં અને તેની ચાલુ મિલકતો અને જવાબદારીઓમાં કેટલો ફેરફાર થથો તે જાણી શકાય છે. ભંડોળની આપ-લે કેવી રીતે થાય છે તેનું વિશ્લેષણ આ પત્રકો દ્વારા થાય છે. જેના આધારે ધંધાકીય ભંડોળમાં થયેલ ફેરફારની નોંધો મળે છે.

૫.૭ સંચાલકીય હિસાબી પદ્ધતિ, નાણાંકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવત:

મુદ્દા	સંચાલકીય હિસાબી પદ્ધતિ	નાણાંકીય હિસાબી પદ્ધતિ	પડતર હિસાબી પદ્ધતિ
હેતુ	આ પદ્ધતિનો મૂળ હેતુ સંચાલકોને સંચાલકીય નિર્ણયો વિશેની માહિતી પૂરી પાડવાનો છે. તે આંતરિક વપરાશકારો માટેની પદ્ધતિ છે.	આ પદ્ધતિનો હેતુ ધંધાની નફાકારકતા અને આર્થિક પરિસ્થિતિની માહિતી આપવાનો છે. નાભ વપરાશકર્તાઓ માટેની પદ્ધતિ છે.	પડતર હિસાબી પદ્ધતિ ખાસ કરીને પડતરને સંબંધિત માહિતીનું એકત્રીકરણ, વિભાજન, વહેંચણી અને પડતર નક્કી કરવાનો હેતુ ધરાવે છે. તે પડતર ઘટાડા સાથે પણ સંકળાયેલ છે.
ઉપયોગિતા	સંચાલકીય હિસાબી પદ્ધતિ મુખ્યત્વે આંતરિક પક્ષકારો માટે ઉપયોગી છે અને એટલ કે તે સંચાલકો માટે ઉપયોગી છે.	નાણાંકીય હિસાબો ધંધાની પરિણામ અને પરિસ્થિતિને બાબુ પક્ષકારોને માટે ઉપયોગી બને છે જેમાં શેરધારકો, લેણદારો વગેરેનો સમાવેશ થાય છે.	પડતર હિસાબી પદ્ધતિ સંચાલકોને મદદ કરવામાં ઉપયોગી બને છે. આમ, તે આંતરિક પક્ષો માટે ઉપયોગી છે.
મુદ્દત	સંચાલકીય હિસાબી અહેવાલોની રજુઆતની મુદ્દત સંચાલકોની જરૂરિયાત પર આધારિત છે. તેની મુદ્દત અઠવાડિયું, પખવાડિયું કે માસિક પણ હોય.	નાણાંકીય હિસાબો કંપની ધારાને આધિન છે. સામાન્ય રીતે તેનો સમયગાળો એક વર્ષનો હોય છે.	પડતરના હિસાબો સામાન્ય રીતે ટ્રૂકાગાળા માટેનાં હોય છે. તે માત્ર સંચાલકોને જરૂરી માહિતી પૂરી પાડવામાં ઉપયોગી હોય છે.
કાર્યક્ષેત્ર	સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં નાણાંકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિનો સમાવેશ થાય છે. આમ, આ પદ્ધતિનો વ્યાપ બહોળો છે.	નાણાંકીય હિસાબી પદ્ધતિમાં માત્ર નાણાંકીય વ્યવહારોને જ ધ્યાનમાં લેવાય છે. તે કોઈ સૂચન કરતું નથી.	પડતર હિસાબી પદ્ધતિમાં માત્ર પડતર વિશેની માહિતીની ગોધ કરવામાં આવે છે.
કાનૂની જરૂરિયાત	આ પદ્ધતિ મરજુઆત છે. કાયદા દ્વારા તેનું કોઈ કાયદાકીય બંધન નથી. સંચાલકોની જરૂરિયાત મુજબ હિસાબો તૈયાર કરવામાં આવે છે.	કંપની ધારા હેઠળ કંપની સ્વરૂપ માટે નાણાંકીય હિસાબો અને જરૂરી પત્રકો બનાવવા ફરજુઆત છે. એકાંકી વેપારીએ પણ ફરજુઆત નાણાંકીય હિસાબો રાખવા પડે છે.	કંપની ધારાની કલમ ૨૦૮ પ્રમાણે અમૃક પ્રકારની કંપનીઓએ પડતરના હિસાબો રાખવા ફરજુઆત છે, પરંતુ આ સિવાયની કંપનીઓ માટે મરજુઆત છે.
અભિગમ	સંચાલકીય હિસાબી પદ્ધતિનો અભિગમ વિશાળ અને ભવિષ્યલક્ષી છે. તેનો સંચાલકોના નિર્ણય અને નીતિ ઘડતર સાથે સંબંધ છે.	નાણાંકીય હિસાબોનો અભિગમ એતિહાસિક બાબતો પર આધારિત છે.	પડતર હિસાબોનો અભિગમ ખૂબ જ સંક્ષિપ્ત છે. તેનો અભિગમ માત્ર પડતરને લગતી બાબતો પૂરતો મથ્યાદિત હોય છે.
પત્રકોનો નમૂનો	સંચાલકીય હિસાબી પદ્ધતિમાં માહિતી રજૂ કરવા માટે કોઈ ચોક્કસ નમૂનો હોતો નથી. સંચાલકોની જરૂરિયાત મુજબ તેને રજૂ કરવામાં આવે છે અને ચોંચ નમૂનાના ઉપયોગ કરવામાં આવે છે.	નાણાંકીય હિસાબો તેના નિયત કોરેલ ફોર્મમાં જ રજૂ કરવાના હોય છે. તેના પત્રકોના નમૂના પૂર્વનિર્ધારિત છે. તેના મુજબ જ હિસાબો તૈયાર કરવાનાં હોય છે.	સંચાલકીય હિસાબોની માફક પડતર હિસાબો તૈયાર કરવાનાં કોઈ ચોક્કસ ફરજુઆત નિયત નમૂના નથી. માહિતીના આધારે તેને રજૂ કરવામાં આવે છે.

મુદ્રા	સંચાલકીય હિસાબી પદ્ધતિ	નાણાંકીય હિસાબી પદ્ધતિ	પડતર હિસાબી પદ્ધતિ
રજૂઆતની પદ્ધતિ	સંચાલકીય હિસાબી પદ્ધતિમાં નાણાંકીય તેમજ બિન-નાણાંકીય વ્યવહારોને નોંધવામાં આવે છે અને એને સંચાલકોના હેતુને ધ્યાનમાં લઈ અહેવાલ રજૂ કરવામાં આવે છે.	નાણાંકીય હિસાબોમાં માત્ર આર્થિક વ્યવહારોની જ નોંધ થાય છે અને તે માત્ર નાણાંમાં જ રજૂ થઈ શકે છે.	પડતર હિસાબી પદ્ધતિમાં માત્ર પડતરને લગતી જ માહિતીની રજૂઆત કરવામાં આવે છે. તેને સંચાલકીય નિર્ણયો સાથે ઓછો સંબંધ છે.
અન્ય શાસ્ત્રો અને પદ્ધતિઓનો ઉપયોગ	સંચાલકીય હિસાબો તૈયાર કરવા માટે જુદી-જુદી પડતર હિસાબોની પદ્ધતિ, આંકડાશાસ્ત્રીય તકનીકો, અર્થશાસ્ત્રો જેવાં સાધનોનો ઉપયોગ થાય છે.	નાણાંકીય હિસાબી પદ્ધતિમાં અન્ય શાસ્ત્રો કે સાધનોનો ઉપયોગ થતો નથી. તેમાં માત્ર હિસાબી નીતિનો જ અભલ પદ્ધતિ, અંદાજપત્ર દ્વારા અંકુશ, સીમાંત પડતર પદ્ધતિ વગેરેનો ઉપયોગ થાય છે.	પડતર હિસાબોમાં વિવિધ સાધનો કે શાસ્ત્રોનો ઉપયોગ થાય છે. જેમાં પ્રમાણ પડતર હિસાબી નીતિનો જ અભલ પદ્ધતિ, અંદાજપત્ર દ્વારા અંકુશ, સીમાંત પડતર પદ્ધતિ વગેરેનો ઉપયોગ થાય છે.
માહિતી જાળવણી	સંચાલકીય હિસાબો આંતરિક ઉપયોગ માટે રાખવામાં આવતા હોય છે તેથી તેની માહિતીનું રહસ્ય જાળવી શકાય છે.	નાણાંકીય હિસાબો એ બાહ્ય પક્ષકારો માટે પણ તૈયાર કરવામાં આવે છે તેથી કંપનીની માહિતીને જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે છે.	પડતર હિસાબી પદ્ધતિ પણ ધેરાની આંતરિક માહિતી દરખાયે છે માટે તેનું રહસ્ય પણ જાળવી રખાય છે.
આધારીતતા	સંચાલકીય હિસાબી પદ્ધતિનો આધાર નાણાંકીય હિસાબો અને પડતરના હિસાબો બંને પર આધારિત છે.	નાણાંકીય હિસાબો ધંધાકીય આર્થિક વ્યવહારો, નાણાંકીય પત્રકો પર આધારિત છે.	પડતરના હિસાબો પડતર માહિતી પર આધારિત છે અને તે સંચાલકીય હિસાબોનો આધાર પૂરો પાડે છે.

૫.૮ સંચાલકીય હિસાબનીશનું સ્થાન અને ભૂમિકા (કાર્યો):

૫.૮.૧ સંચાલકીય હિસાબનીશનું સ્થાન:

સંચાલકીય હિસાબી પદ્ધતિ મહત્વની આર્થિક અને નાણાંકીય માહિતી સંચાલકોને પૂરી પાડે છે અને આ માહિતી સંચાલકો સુધી ચોંચ અને અસરકારક રીતે સંચાલકીય હિસાબનીશ દ્વારા પહોંચાડવામાં આવે છે.

સંચાલકીય હિસાબી પદ્ધતિની સ્થાપના, વિકાસ અને તેને કાર્યાન્વિત કરવામાં સંચાલકીય હિસાબનીશનું સ્થાન અને ભૂમિકા ખૂબ જ મહત્વની છે. હિસાબનીશ નાણાંકીય અને પડતર અંકુશ અહેવાલનું પ્રેષણ કરે છે જે સંચાલનની દરેક સપાઠીએ મહત્વની અને ચોંચ માહિતી સમયસર પ્રાપ્ત કરાયે છે. વિવિધ આર્થિક વ્યવહારો અને બનાવોનું માપ કાઢી હિસાબનીશ દ્વારા સંચાલકો સમક્ષ અહેવાલના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જેના આધારે રોજબરોજનાં સંચાલન કાર્યમાં, નીતિ ઘડતરમાં અને અંકુશને લગતીના કાર્યોમાં સહાયરૂપ બને છે.

સંચાલકીય હિસાબનીશ તેનું સ્થાન ઉચ્ચ સપાઠીનું ધરાવે છે. તે પથર્દીક અને રાહબર બનીને દરેક સપાઠીના અધિકારીઓને મદદ કરતો રહે છે. તે અધિકારીઓને અંકુશ માહિતી અને તેનો ઉપયોગ કરવાની બાબતમાં માહિતગાર કરી તેમને પ્રશિક્ષણ આપે છે. ઉચ્ચ સપાઠીના અધિકારીઓ અથવા સંચાલકો ઉપરાંત માત્ર સંચાલકીય હિસાબનીશ જ મહત્વની માહિતીથી જાણકાર હોય છે અને આ પરથી કાઢી શકાય છે કે સંચાલકીય હિસાબનીશનું એક અલગ જ સ્થાન સંચાલનમાં હોય છે. તેને કંટ્રોલર તરીકે પણ ઓળખવામાં આવે છે.

સંચાલકીય હિસાબનીશે પોતાની આગવી સ્તુત અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી ધંધાકીય એકમની ઉત્પાદકતા અને નફાકારકતા વિશેનો અહેવાલ રજૂ કરવાનો હોય છે અને તેમાં અસરકારક રીતે વધારો કરવાનો હોય છે.

સંચાલકીય હિસાબનીશ મુજબ કંટ્રોલર તરીકે કંપનીની વિવિધ બાબતો વિશેની માહિતી એકત્રિત કરે છે. તેને વર્ગીકરણ કરીને યોગ્ય સ્વરૂપમાં અર્થસભર રીતે ગોઠવે છે. તે સંચાલનની જરૂરી માહિતી જુદી તાર્યે છે અને તેમને પસંદગીના ક્રમમાં ગોઠવે છે અને સંચાલકોની જરૂરિયાત પ્રમાણે કમાંક આપે છે. તે સંચાલનને મહિનેની અને જરૂરી માહિતી તેની બુદ્ધિ કૌશલ્ય દ્વારા પૂરી પાડે છે. ઉપરાંત સંચાલકીય હિસાબનીશ દ્વારા ખરેખર થયેલ પરિણામની અપેક્ષિત પરિણામ સાથે સરખામણી કરવામાં આવે છે અને તેમાં સૂચિત પગલાંઓ અહેવાલના રૂપમાં ઉચ્ચ સપાટીએ સંચાલકો સમક્ષ રજૂ કરે છે.

શ્રી પી. એલ. ટંડને સંચાલકીય હિસાબનીશના સ્થાનનું મહિનેની અને જરૂરી માહિતી મેળવનાર હબને જોડે છે. તે આવી માહિતી પર વધુ પ્રક્રિયા કરે છે અને જ્યાંથી તે માહિતી આવી હોય ત્યાં આવી સુધારેલી માહિતી પહોંચાડે છે.”

દી કન્ટ્રોલર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકાએ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સંચાલકીય હિસાબનીશ)નાં કાર્યો નીચે મુજબ વર્ણવેલા છે.

- (૧) ધંધાની પ્રક્રિયાઓના અંકુશ માટે સંચાલનના એક સુગણિત ભાગ તરીકે એક પૂર્તી યોજના તૈયાર કરવી, તેનું સંકલન કરવું અને તેનો વહીવટ કરવો.
- (૨) ખરેખર થઈ રહેલ કાર્યોને નક્કી કરેલ કાર્યવાહી, યોજના અને પ્રમાણો સાથે સરખાવવાં અને સંચાલનની બધી સપાટીએ તે અંગે અહેવાલો રજૂ કરવાં.
- (૩) ધંધાના સંચાલનના કોઈપણ પાસા અંગેની નિતિ કે કાર્ય માટે જવાબદાર એવા સંચાલનના બધાં જ ભાગો સાથે વિચારણા કરવી.
- (૪) કરવેરા અંગેની નિતિ અને કાર્યવાહીનો વહીવટ કરવો.
- (૫) સરકારી સંસ્થાઓને મોકલવાનાં અહેવાલો અંગે સુપરવિક્રન રાખવું અને તે તૈયાર કરવાનાં કાર્યનું સંકલન કરવું.
- (૬) યોગ્ય આંતરિક અંકુશ માટે વીમા આયોજન દ્વારા ધંધાની ભિલકતોનાં નાણાંકીય રક્ષણાની ખાતરી આપવી.
- (૭) આંતરિક વિશિષ્ટ પરિબળોનું અને સરકારી અસરોનું સતત મૂલ્યાંકન કરતા રહેવું અને તેની ધંધા પર કેવી અસર થશે તેનું અર્થઘટન કરતા રહેવું.

૫.૮.૨ સંચાલકીય હિસાબનીશની ભૂમિકા (કાર્યો):

આધુનિક સમયમાં હિસાબનીશની ભૂમિકા મહિનેની બની ગયેલ છે. પછી તે નાણાંકીય હિસાબનીશ હોય અથવા પડતર હિસાબનીશ હોય અથવા સંચાલકીય હિસાબનીશ હોય. તેઓનું કાર્ય માત્ર માહિતી બેગી કરવા પૂરતું સીમિત નથી રહ્યું કે માત્ર વ્યવહારોની નોંધો પૂરતું પણ નથી રહ્યું. સંચાલકો માટે તેઓએ સલાહકાર, માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવાની હોય છે. સંચાલકીય હિસાબનીશ તરીકે હિસાબનીશે માત્ર હિસાબો સિવાય સંચાલનના આયોજન, સંકલન, અંકુશ, માહિતી સંચાર અને અંતે

ઇચ્છિત ધોય સુધીનું પરિણામ લાવવા માટે સંચાલકોને સહાયરૂપ બનવાનાં ફાળો આપવાનો હોય છે. સંચાલકીય હિસાબનીશનાં કાર્યો નીચે મુજબ છે.

(૧) હિસાબી માહિતીની યોગ્ય ગોઠવણી:

ધંધાકીય એકમનાં વિવિધ નિર્ણયો માટે ઘણીબધી માહિતીની જરૂર પડતી હોય છે. આ માહિતી વિવિધ વિભાગો પાસેથી એકઠી કરવાની હોય છે જેનો ઉપયોગ નિર્ણય ઘડતર માટે કરવાનો હોય છે. પરંતુ આ માહિતીને યોગ્ય રૂપમાં ગોઠવવી પડતી હોય છે જે કાર્ય સંચાલકીય હિસાબનીશનું છે. સંચાલકીય હિસાબનીશ સંચાલકોને જે સ્વરૂપમાં જે માહિતી જોઈએ અને તેમને ઉપયોગી થાય તેમ તેની ગોઠવણી કોષ્ટક રૂપમાં, માહિતી રૂપમાં કે ચાર્ટના રૂપમાં બનાવે છે. દા. ત.: ઉત્પાદન પડતર માહિતી તેની વિવિધ પડતર, તેનું પ્રમાણ, એકમણીઠ પડતર, પ્રાથમિક પડતર, કુલ પડતર, ધંધાની એક કે વધુ પેદાશ વિશેની માહિતી વગેરે સંચાલકોની જરૂરિયાત પ્રમાણે અને તેમને ઉપયોગી બને તે અંગેનું કાર્ય સંચાલકીય હિસાબનીશનું છે.

(૨) માહિતીનું અર્થધટન:

સંચાલનની ઉર્ચય સપાટીએ કાર્ય કરતા સંચાલકોને વિગતવાર માહિતીમાં રસ હોતો નથી તેમજ તેમની પાસે એટલા અભ્યાસ માટનો સમય પણ હોતો નથી. તેઓએ ત્વરિત નિર્ણય પણ કરવાનાં હોય છે માટે સંચાલકીય હિસાબનીશો માહિતીનું એકગીકરણ કરીને તેની યોગ્ય ગોઠવણી કર્યા બાદ તેનું વિશ્લેષણ કરી તેનું અર્થધટન પણ કરવાનું હોય છે. માહિતીનું અર્થધટન કરી સંચાલકોને પૂર્ણ માહિતી સમજાવવાની હોય છે જેથી આ માહિતીનો ઉપયોગ કરી અને તેના મૂલ્યાંકન દ્વારા ધંધાકીય એકમના ભાવિ નિર્ણયો લેવામાં આવતા હોય છે. આમ, હિસાબનીશો માહિતીનું અર્થધટનનું કાર્ય ખૂલ જ ગંભીરતાપૂર્વક કરવાનું હોય છે. માહિતીના વિશ્લેષણ અને અર્થધટન માટે હિસાબનીશ દ્વારા વિવિધ તકનીકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

(૩) આયોજનનાં કાર્યો:

સંચાલનના આયોજન કાર્યમાં સંચાલકીય હિસાબનીશે જુદી-જુદી ધંધાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું હોય છે અને સંચાલકોને સહાયરૂપ બનવાનું હોય છે. આ માટે વિવિધ અંદાજપત્રો જેવાં કે, રોકડ અંદાજપત્રો, પરિવર્તનશીલ અંદાજપત્રો, માલસામાન ખર્ચ અંદાજપત્રો, વેચાણ-ઉત્પાદન અંદાજપત્રો વગેરે તૈયાર કરીને તેનું યોગ્ય સરખામણીનું કાર્ય કરવાનું હોય છે. આ માટે ભૂતકાળનાં આંકડાઓને આધારરૂપ ગણીને ભવિષ્યનું આયોજન કરવામાં આવે છે. વધુમાં હિસાબનીશો માસ્ટર અંદાજપત્ર તૈયાર કરીને સંચાલકોની સમક્ષ રજૂ કરવાનું હોય છે.

(૪) અહેવાલ પ્રેષણનું કાર્ય:

અસરકારક સંચાલન માટે અસરકારક માહિતી સંચાર અને તેનું અહેવાલ પ્રેષણ થવું જરૂરી છે. અહેવાલ પ્રેષણ દ્વારા મુદ્દાઓ તરફ સંચાલકોનું ધ્યાન આકર્ષિત કરી શકાય છે. અહેવાલની રજૂઆત તેના યોગ્ય રૂપમાં ખૂલ જરૂરી છે. અહેવાલ મુખ્યત્વે લે પ્રકારનાં હોય છે જે સંચાલકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. (અ) ખાસ પ્રકારનો અહેવાલ અને (બ) નિયમિત / રાખેતા મુજબનો અહેવાલ.

ધંધાકીય એકમનાં કોઈ વિશિષ્ટ પ્રકારનો નિર્ણય લેવાનો હોય અથવા ફેરફારો કરવાનાં હોય ત્યારે કંપનીની નાણાંકીય પરિસ્થિતિ પર અથવા તેના અન્ય વિભાગો પર શું અસર થઈ શકે તેમ છે તે જાણવા માટેનો અહેવાલ હિસાબનીશ દ્વારા બનાવવામાં આવે છે અને તેની માહિતી સંચાલકો સમક્ષ રજૂ કરવાની હોય છે. દા. ત. ધંધાકીય એકમનું વિસ્તારણ કરવું, યંત્રોનું નવીનીકરણ અથવા નવા યંત્રો સ્થાપવા વગેરે નિર્ણયો અંગેનો અહેવાલ એ ખાસ પ્રકારના અહેવાલ અંતર્ગત રજૂ કરવામાં આવે છે.

આ ઉપરાંત વિવિધ નિયમિત અહેવાલો સંચાલનની વિવિધ સપાટીએ સંચાલકો સમક્ષ રજૂ કરવાનાં હોય છે. જેવાં કે ધંધાકીય એકમની ફૈનિક માહિતી જેવી કે, કામદાર ખર્ચ, ઉત્પાદન, ભાલસામાન વપરાશ વગેરે. તદ્દુરાંત કારખાના ખર્ચ, વેચાણ-વિતરણ ખર્ચ, વેચાણ કિંમત યોગ્ય છે કે નહીં તેવી માહિતીનું પ્રેષણ નિયમિત અહેવાલમાં કરવામાં આવે છે.

(૪) કરવેરા આયોજન:

સંચાલકીય હિસાબી પદ્ધતિમાં વિકસાવેલ વિવિધ વિકલ્પો હેઠળ સંચાલકીય હિસાબનીશે કરવેરા આયોજન બાબતે પણ મદદરૂપ બનવાનું હોય છે. કરવેરાની નીતિવિષયક બાબતો જેવી કે કરવેરા બચત, કરવેરાનું ભારણ વગેરેમાં હિસાબનીશ દ્વારા પૂરતું માર્ગદર્શન સંચાલકોને પુરું પાડવાનું હોય છે.

(૫) નાણાંકીય બાબતોમાં મદદરૂપ થિએ:

નાણાંકીય સંચાલનમાં વિવિધ કાર્યો હોય છે. સંચાલકીય હિસાબનીશ નાણાં પ્રાસિ માટેનાં ઝ્રોતો, તેનું રોકાણ અને અંદાજપત્રો બનાવી નાણાંના અસરકારક ઉપયોગ માટે સંચાલકોને સહાયરૂપ બનવાનું કામ કરે છે. નવા પ્રોજેક્ટના કાર્યમાં પણ હિસાબનીશ મદદરૂપ બને છે. ધંધાના વિકાસ માટે યોજના કરવી, મૂડી ખર્ચ કરવો વગેરે અંગે માર્ગદર્શન સંચાલકો માટે ઉપયોગી બને છે. વિવિધ યોજનાઓની યોગ્ય માહિતી લેગી કરી તેનું વિશ્લેષણ કરી યોગ્ય નફાકારક વિકલ્પોની પસંદગી કરી તેનો અહેવાલ સંચાલકો સમક્ષ ઉર્ચ્ચ સપાટીએ કરવાનો હોય છે.

સ્વાધ્યાય:

- (૧) સંચાલન શું છે ? સંચાલકીય હિસાબી પદ્ધતિ ઉપર ટૂંકનોંધ લખો.
- (૨) સંચાલકીય હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ અને કાર્યક્ષેત્રની ચર્ચા કરો.
- (૩) સંચાલકીય હિસાબી પદ્ધતિના કાર્ય, લાભ અને મર્યાદાઓની સમજૂતી આપો.
- (૪) સંચાલકીય હિસાબી પદ્ધતિ, નાણાંકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિ એકબીજાથી કઈ રીતે અલગ છે ? તશીષત જણાવો.
- (૫) સંચાલકીય હિસાબનીશનું કાર્યક્ષેત્ર અને ભૂમિકાઓ જણાવો.

★ ★ ★

પ્રકણણઃ ૬
અંદાજપત્ર (બજેટ) અને અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંટ્રોલ)

૬.૧ અંદાજપત્ર (બજેટ) અને અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંટ્રોલ)નો અર્થ અને વ્યાખ્યા

૬.૨ અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંટ્રોલ)નાં હેતુઓ

૬.૩ અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંટ્રોલ)નાં ફાયદા અને મર્યાદાઓ

૬.૪ રોકડ અંદાજપત્ર અને પરિવર્તનશીલ અંદાજપત્ર

૭. સ્વાધ્યાય

૭.૧ અંદાજપત્ર (બજેટ) અને અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંટ્રોલ)નો અર્થ અને વ્યાખ્યા:

૭.૧.૧ અંદાજપત્ર (બજેટ)નો અર્થ અને વ્યાખ્યા:

❖ અર્થ:

સંચાલનનું સૌથી મહત્વનું કાર્ય ધંધાની પ્રવૃત્તિઓનું અગાઉથી આયોજન કરવાનું છે અને પ્રવૃત્તિઓનું સંકલન કરી તેના પર અંકુશ રાખવાનું છે, જેથી ધંધાનું નક્કી કરેલ દ્વેય સિદ્ધ થઈ શકે. લગભગ દરેક વ્યક્તિએ એક ચા બીજા પ્રકારે અંદાજપત્ર બનાવવું પડે છે. તે હંમેશા વિચારશે કે આવતા મહિને તેની આવક કેટલી હશે અને ખર્ચ કેટલો થશે? જો તેને લાગે કે આવક કરતા ખર્ચ વધી જશે તો ખર્ચ પર નિયંત્રણ રાખવાનાં પ્રયત્નો કરશે. આવા વ્યક્તિગત બજેટ લેખિત ન હોઈ ફક્ત વ્યક્તિનાં મનમાં જ અસ્તિત્વ ધરાવતાં હોય છે. ધંધાકીય બજેટનો ઉદ્દેશ પણ આપો જ હોય છે. સામાન્ય રીતે ધંધાના બજેટ લેખિત હોય છે અને વધુ વિગતવાર હોય છે. આમ, અંદાજપત્ર દ્વારા સંચાલક ધંધાની પ્રવૃત્તિઓનું અમુક ચોક્કસ રીતે સંચાલન કરી શકે છે.

❖ વ્યાખ્યા:

૧. “ભવિષ્યની આવક-જાવકનો નક્શો એટલે બજેટ.”
૨. શ્રી શુભિન જણાવે છે કે, “બજેટ એક સર્વગ્રાહી યોજના છે, જેમાં સંચાલન, અંદાજુત વેચાણ અને આવકને આધારે ભવિષ્યની કામગીરી માટે પડતર અને ખર્ચની છૂટ નક્કી કરે છે અને એ રીતે કાળજીપૂર્વક નક્કી કરેલ દ્વેય તરફ પ્રવૃત્તિઓને દોરે છે અને તેનું અસરકારક સંકલન કરે છે.”
૩. ઈઝેન્ડની સર્ટીફિકાર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સે તૈયાર કરેલ ટર્મિનોલોજી ઓફ કોસ્ટ એકાઉન્ટન્સી મુજબ, “અંદાજપત્ર એ અમુક ચોક્કસ મુદ્દત પહેલાં તૈયાર કરેલ અને તે મુદ્દત દરમિયાન જેનો નક્કી કરેલ દ્વેય-સિક્લિનાં હેતુ માટે અભલ કરવાનો છે. એવી નીતિની નાણાંકીય કે પરિણામાત્રક રજૂઆત છે.”
૪. શ્રી જેભ્સ ફેન્નેજેનના જણાવ્યા મુજબ, “બજેટ એ મુદ્દત માટે પેઢીની કામગીરી અને સાધનો અંગેની, નાણાંકીય સ્વરૂપે રજૂ કરેલી એક વિસ્તૃત અને સંકલિત યોજના છે.”

૭.૧.૨ અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંટ્રોલ)નો અર્થ અને વ્યાખ્યા:

અંદાજપત્ર દ્વારા અંકુશ અથવા બજેટરી કંટ્રોલ એ એક પ્રકિયા છે જેમાં બજેટ ઘડવામાં આવે છે. ખરેખર થઈ રહેલ કામગીરીને બજેટ સાથે સરખાવવામાં આવે છે અને તે દ્વારા કચ્ચાં વિચલનો જણાય છે તે શોધીને વિચલનો દૂર કરવા અને ભવિષ્યમાં તે ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.

❖ વ્યાખ્યા:

૧. શ્રી જેન વેલ્સ જણાવે છે કે, “બજેટરી કંટ્રોલમાં સંપૂર્ણ મુદ્દત દરમિયાન બજેટ અહેવાલોનો ઉપયોગ થાય છે કે જેથી બજેટમાં જણાવ્યું છે કે જેમાં જેમજ તેના પર અંકુશ રાખી શકાય. બજેટરી કંટ્રોલમાં ખરેખર પરિણામને બજેટમાં લક્ષ્યાંક સાથે સરખાવી તેના પર સતત અંકુશ રાખવામાં આવે છે અને તે રીતે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે જેથી જચાં જરૂર જણાય ત્યાં સુધારાનાં પગલાં લઈ શકાય.”
૨. શ્રી મૂર્ખ અને જેકેટીએ જણાવ્યું છે કે, “પ્રવૃત્તિઓનાં અંકુશ માટેના સાધન તરીકે બજેટનો ઉપયોગ કરવો તેનું નામ બજેટરી કંટ્રોલ.”
૩. સર્ટીફિકાર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ પ્રમાણે, “નીતિની જરૂરિયાત મુજબ વહીવઠી અધિકારીઓની જવાબદારીને લગતાં બજેટો નક્કી કરવા અને ખરેખર પરિણામ સાથે સતત

સરખાવતા રહેવું કે જેથી વ્યક્તિગત પગલા દ્વારા તે નીતિનું ધ્યેય સિક્ક થઈ શકે અથવા તેની પુનઃરચના કરવાનો આધાર પ્રાપ્ત થઈ શકે.”

ક.૨ અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંટ્રોલ)નાં હેતુઓ:

અંદાજપત્ર દ્વારા અંકુશ અથવા બજેટરી કંટ્રોલનો મૂળભૂત ઉદ્દેશ એ છે કે પેઢીના ધ્યેય સ્પષ્ટ રીતે રજૂ થાય અને સંચાલનમાં કાર્યો બજાવવામાં તે એવી રીતે મદદરૂપ થાય કે જેથી આપેલ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે.

બજેટરી કંટ્રોલનાં હેતુઓ નીચે મુજબ છે.

૧. પેઢીના ધ્યેયની રજૂઆત
૨. ધ્યેયની જાણ કરવી
૩. કામગીરી બજાવવા માટેની યોજના
૪. પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું સંકલન
૫. અંકુશ માટેનું સાધન પુરુષ પાડવું

ક.૨.૧ પેઢીના ધ્યેયની રજૂઆત:

પેઢી પોતાના લાંબાગાળાના ધ્યેય નક્કી કરે છે અને તે સિક્ક કરવા માટે ટૂંકાગાળાની જે યોજનાઓ ઘડે છે તેનું નામ બજેટ. આમ, બજેટ પેઢીના લાંબાગાળાના અને ટૂંકાગાળાનાં ધ્યેય વર્ચ્યે એક પ્રકારની સંવાદિતા સ્થાપે છે. ટૂંકાગાળાના ધ્યેય બજેટમાં જાણવામાં આવે છે અને તે સિક્ક કરવા બજેટમાં લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. આ લક્ષ્યાંકો ધ્યેયસિક્કમાં બે રીતે મદદરૂપ થાય છે. એક, તે માર્ગદર્શનરૂપ છે અને બીજું તે પ્રોત્સાહક છે. જુદી-જુદી પ્રવૃત્તિઓ માટે વિગતવાર લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે તેને આધારે કોણે શું કરવાનું છે તે દરેક વ્યક્તિ જાણી શકે છે. આ દાખિએ તે માર્ગદર્શક છે. બણી, તેમાં જાણાવેલ લક્ષ્યાંકો કેટલે અંશો સિક્ક થઈ શક્યા તેને આધારે વ્યક્તિગત કામગીરીનું મૂલ્યાંકન થાય છે એ રીતે તે પ્રોત્સાહક પણ છે. આ લક્ષ્યાંકો પેઢીનાં લાંબાગાળાના ધ્યેય સ્પષ્ટ કરે છે.

ક.૨.૨ ધ્યેયની જાણ કરવી:

ધ્યેય ગમે તેટલી સ્પષ્ટતાથી નક્કી કર્યું હોય પરંતુ જ્યાં સુધી તે સંબંધિત પક્ષકારોના ધ્યાનમાં અને જાણમાં ન આવે ત્યાં સુધી તેની કોઈ ઉપયોગિતા નથી, એટલે બજેટ તૈયાર કરવાનો હેતુ એ છે કે પેઢીના ધ્યેય બધી જ કક્ષાનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં ધ્યાનમાં આવે. ઉપલી કક્ષાનાં અધિકારીઓની ફરજ એ છે કે નીચલી કક્ષાનાં અધિકારીઓની તેમની પાસે કેટલી અપેક્ષા રાખવામાં આવે છે તેની માહિતી આપે. આમ થવાથી પેઢીના ધ્યેય તેઓ વધુ સારી રીતે સમજુ શકશો, જેથી તેઓ તેને ટેકો આપશો અને તેનો અમલ કરવામાં સહાય આપશો.

ક.૨.૩ કામગીરી બજાવવા માટેની યોજના:

બજેટનો હેતુ એ છે કે શું કામ કરવાનું, કેવી રીતે કરવાનું અને કોણે કેટલું કામ કરવાનું છે તેની વિગતવાર યોજના તૈયાર કરવી. આમ કરવાથી અચોક્કસતા દૂર થાય છે અને વ્યક્તિએ અથવા વ્યક્તિઓનાં જૂથે ધ્યેય સિક્ક કરવા કઈ દિશામાં પ્રયત્નો કરવાનાં છે તે અંગે તેમને માર્ગદર્શન મળે છે. આ કામગીરીની યોજનામાં જુદી-જુદી કક્ષાના અધિકારીની જવાબદારી કેટલી છે તેનો ઉદ્દેશ હોય છે. કેટલી મુદ્દતમાં કોણે કેટલી અને કેવી કામગીરી બજાવવાની છે તેનો સમયબદ્ધ કાર્યક્રમ આપવાનો હેતુ તેમાં રહેલો છે.

ક.૨.૪ જુદા જુદા વિભાગોની પ્રવૃત્તિઓનું સંકલન:

બધાં વિભાગોનાં પ્રયત્નો સંવાદી બને તે માટે બજેટ ઉપયોગી છે. બજેટ તૈયાર કરવાનો એક હેતુ એ પણ છે કે જુદાં-જુદાં ખાતાનાં પ્રયત્નો એકબીજાથી વિરુદ્ધ દિશામાં ન હોય પરંતુ પેઢીનું ધ્યેય સિક્ક કરે તે

રીતે એક જ દિશામાં થતા હોય. ઉત્પાદન ખાતાના બજેટમાં એવી વસ્તુનાં ઉત્પાદનની જોગવાઈ ન હોવી જોઈએ કે જે વેચાણ ખાતું વેચી ન શકે. વેચાણ બજેટમાં એવી વસ્તુનાં વેચાણની જોગવાઈ ન હોવી જોઈએ કે જે ઉત્પાદન વિભાગમાં જરૂરી પ્રમાણમાં તૈયાર ન થઈ શકે. ખરીદ વિભાગ એવી વસ્તુની ખરીદી મોટા પાચા પર ન કરે જે ઉત્પાદન વિભાગને તેટલા પ્રમાણમાં જરૂરી ન હોય. આમ, જુદાં-જુદાં ખાતાનાં પ્રયત્નો સંવાદી બને તે માટે પણ બજેટ ઉપયોગી બને છે.

૭.૨.૫ અંકુશ માટેનું સાધન પુરું પાડવું:

બજેટમાં કામગીરીની વિસ્તૃત ચોજના રજૂ થતાં દરેક ખાતાએ, અધિકારીએ અને કર્મચારીએ શું કરવાનું છે તેનો સ્પષ્ટ ખ્યાલ તેમને આવે છે. જેણે આધારે તેમની કામગીરીનું મૂલ્યાંકન થાય છે. વખતોવખત બજેટનાં વિભાગ પ્રમાણે અહેવાલો તૈયાર થાય છે. જેમાં ખરેખર કામગીરી સાથે બજેટનાં લખ્યાંક સરખાવવામાં આવે છે. આ રીતે કર્મચારીએ તેમની પાસે જે અપેક્ષા રાખવામાં આવી હતી તે પ્રમાણે જ કામગીરી કરી છે કે નહીં તેનું મૂલ્યાંકન ગઈ શકે છે. અલબત્તા, આ સાથે બદલાયેલા સંજોગો પણ દ્યાનમાં લેવા જોઈએ. કદાચ એવું બને કે જેણા પર અધિકારી કે કર્મચારીનો કોઈ અંકુશ ન હોય તેવા સંજોગોમાં ફેરફાર થવાને કારણો બજેટમાં જાણાવેલ લખ્યાંકો સિદ્ધ થઈ શક્યા ન હોય. આમ, કામગીરીનું મૂલ્યાંકન કરતા બિનઅંકુશિત અને બાધ્ય પરિબળોની અસર પણ દ્યાનમાં લેવી જોઈએ. આ રીતે તફાવતનાં કારણોની વિગતવાર તપાસ કરી તે દૂર કરવા પગલા લેવામાં આવે છે.

૭.૩ અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટટી કંટ્રોલ)નાં ફાયદા અને મર્યાદાઓ:

૭.૩.૧ અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટટી કંટ્રોલ)નાં ફાયદા:

સંચાલકો માટે બજેટ એ આયોજન અને અંકુશ માટેનું એક મહત્વનું હથિયાર છે. તેનાં ફાયદા નીચે મુજબ છે:

(૧) આયોજન:

બજેટ એ ભવિષ્ય માટેનું ટૂંકાગાળાનું આયોજન છે. ભવિષ્યમાં શું બની શકે તેનો અંદાજ મુકવાનો હોવાથી સંચાલન વધુ કાર્યક્ષમ અને અસરકારક બને છે. ભવિષ્યની મુશ્કેલીઓનો સામનો કરવા સંચાલકોને તે તૈયાર કરે છે.

(૨) સંકલન:

જુદાં-જુદાં ખાતાઓનાં અંદાજપત્રોનું સંકલન કરી એક સર્વોત્તમ અંદાજપત્ર (બજેટ) બનાવવાનું હોવાથી તેમની પ્રવૃત્તિઓનું સંકલન શક્ય બને છે. ધંધાના નિયત કરેલ ધ્યેયની સિડ્ઝિની દિશામાં જ બધાં ખાતાનાં પ્રયત્નો વાળવાનું બજેટ દ્વારા શક્ય બને છે.

(૩) અંકુશ:

બજેટમાં પ્રવૃત્તિ અંગે નક્કી કરેલ લખ્યાંકો એ કામગીરીનું મૂલ્યાંકન કરવાનો આધાર પૂરો પાડે છે. તેને ખરેખર પરિણામો સાથે સરખાવવાથી શું થઈ શક્યું છે તેનો સારો ખ્યાલ આવે છે. જરૂર જાણાય ત્યાં સુધારાનાં પગલાં લઈ શકાય છે. આમ, ધંધાની દરેક પ્રવૃત્તિ પર અને દરેક અધિકારીની કામગીરી પર અંકુશ રાખવાનું શક્ય બને છે.

(૪) કાર્યક્ષમતામાં સુધારો:

બજેટ તૈયાર કરતાં પહેલાં ધંધાને અસર કરતાં બધાં પરિબળોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. જેથી, કચ્ચાં-કચ્ચાં ખામીઓ છે અને સુધારાને અવકાશ છે તેનો ખ્યાલ પહેલાં જ આવી જાય છે. તે ખામીઓ દૂર કરવા સુધારા દાખલ થતાં ધંધાની સમગ્ર કાર્યક્ષમતામાં સુધારો થાય છે.

(૪) વિકેન્દ્રીકરણા:

બજેટ દ્વારા ધંધાની પ્રવૃત્તિઓનું વિકેન્દ્રીકરણ થાય છે અને જવાબદારીની સોંપણી શક્ય બને છે. ધંધાને જુદાં-જુદાં વિભાગ અંગે બજેટ તૈયાર કરવાની અને તેનો અમલ કરવાની જવાબદારી તે વિભાગનાં વડાને સોંપવામાં આવે છે અને તે માટે જરૂરી સત્તા પણ તેમને આપવામાં આવે છે.

(૫) સહકાર:

બજેટ તૈયાર કરતાં જુદાં-જુદાં ખાતાનાં ઉપરી અધિકારીઓ બેગા થઈ ચર્ચા-વિચારણા કરે છે, જેથી બધાં એકબીજાનાં પ્રક્ષો સમજે છે. પરિણામે ઘર્ષણાની શક્યતાઓ ઘેટે છે અને તેઓ પરસ્પર સહકારથી કામ કરે છે.

(૬) સાધનોનો દીઢ ઉપયોગ:

બજેટને કારણે પેઢીનાં સાધનોનો દીઢ ઉપયોગ શક્ય બને છે. તે દ્વારા બધી વ્યક્તિઓનાં પ્રયોસો એક જ દિશામાં કેન્દ્રિત થાય છે. આમ, ધંધાના ભૌતિક અને માનવીય સાહસોનો મહત્વ અને કરકસરયુક્ત ઉપયોગ થઈ શકે છે. જેથી, મહત્વમાં નફાનું ધ્યેય સિદ્ધ થઈ શકે છે.

(૭) માહિતીસંચાર કાર્યક્ષમ્બના:

બજેટને કારણે ધંધામાં માહિતીસંચારની વ્યવસ્થા કાર્યક્ષમ બને છે. બજેટ એ કાર્યક્ષમના અમલના એક ભાગ તરીકે ધંધાનાં ધ્યેય, યોજના, દરેકની જવાબદારી, સત્તા વગેરે લેખિતમાં આપવામાં આવે છે. જેથી કોણે શું કરવાનું છે?, કેવી રીતે અને કેટલી મુદ્દતમાં કામ કરવાનું છે તે અંગે કોઈ ડ્રિફ્ટ રહેતી નથી, તેથી સંચાલકો અને તાબેદારો વચ્ચે ગેરસમજૂતી દૂર થાય છે અને સુમેળભર્યું વાતાવરણ સર્જાય છે.

(૮) અપવાદ દ્વારા સંચાલન:

બજેટનો વિગતવાર કાર્યક્રમ તૈયાર થઈ જતા વિભાગીય અધિકારીઓને તેના અમલની જવાબદારી અને તેને અનુરૂપ સત્તા સોંપવામાં આવે છે. આ રીતે, ઉચ્ચ સંચાલકોનો બોજ ઘેટે છે. હવે, તેમણે ફક્ત એવી બાબતો પર જ ધ્યાન આપવાનું રહે છે જ્યાં નક્કી કર્યા મુજબ કામ ન થયું હોય એટલે કે અપવાદ દ્વારા સંચાલન થાય છે.

(૯૦) ઉંચો જુસ્ટસો અને ઉત્પાદકતા:

કર્મચારીઓ અને અધિકારીઓને બજેટ કાર્યક્રમ ધડવામાં ભાગ આપવામાં આવતો હોવાથી તેમનો જુસ્ટસો ઉંચો રહે છે. પેઢીનું અને વ્યક્તિગત કર્મચારીઓનાં ધ્યેય એકરૂપ બને છે. કર્મચારીઓ ઉત્સાહી બજેટનાં અમલમાં ભાગ લે છે. પરિણામે, ધંધાની ઉત્પાદકતામાં પણ વધારો થાય છે.

(૯૧) ગણતરીપૂર્વક કામ કરવાની ટેવ:

દરેક વહીવટી અધિકારી બજેટને કારણે નાની-નાની દરખાસ્તો ખર્ચ પર કેવી અસર કરે છે તેનો વિચાર કરતાં થાય છે. દરેક બાબતમાં ગણતરીપૂર્વક કામ કરવાની વૃત્તિનો વિકાસ થાય છે. આમ, ખર્ચ અને નફા-સભાનતાનું વાતાવરણ ઉલ્લં થાય છે.

(૯૨) બેંક લોન મેળવવામાં સરળતા:

જ્યાં બજેટ દ્વારા અંકુશની પદ્ધતિનો અમલ થતો હોય એવા ધંધાને બેંક જલ્દીથી લોન આપે છે, કારણ કે તેને ખાતરી રહે છે કે ધંધો વ્યવસ્થિત રીતે ચાલે તે માટે સંચાલકોએ પોતે જ અંકુશની વ્યવસ્થા કરી છે. તેથી, તેમને નિયમિત વ્યાજ મળશે તેમજ નિયત સમયે મુદ્દલ રકમ પણ પરત મળી શકશે.

૬.૩.૨ અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંદ્રોલ)ની મર્યાદાઓ:

અંદાજપત્ર દ્વારા અંકુશ (બજેટરી કંદ્રોલ) રાખવાનાં ફાયદા ખૂલ જ આકર્ષક જણાય છે. ઇતાં જો તેની મર્યાદાઓનો જ્યાં રાખવામાં નહીં આવે તો તે નિષ્ફળ નિવકે છે.

- (૧) સફળતાનો આધાર અંદાજો પર:
- બજેટનો આધાર અંદાજો પર છે એટલે જુદી-જુદી પ્રવૃત્તિઓ વિશે જે અંદાજો મુક્યા હોય તે જેટલે અંશો ચોક્કસ હોય તેટલે અંશો જ બજેટ સફળ થઈ શકે. માટે પૂર્તી માહિતી ભેગી કરીને તેમજ અનુભવ અને બુદ્ધિપૂર્વકની ગણતરી કરીને જ છેવટનાં આંકડાઓ નક્કી કરેલા હોવા જોઈએ.
- (૨) પરિવર્તનશીલતાનો અભાવ:
- બજેટના કાર્યક્રમને બદલાતા જતા સંજોગોને અનુકૂળ બનાવવા તેમાં સતત ફેરફાર કરતા રહેવાની જરૂર છે. બજેટ તૈયાર કરવા માટે જુદી-જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરતા રહેવું જોઈએ અને અનુભવ પરથી જેમ જરૂર જણાય તેમ ફેરફારો કરતા રહેવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો બજેટ કાર્યક્રમ ગતિશીલ હોવો જોઈએ.
- (૩) બજેટ ફક્ત સાધન:
- બજેટ પોતે સંચાલન અને વહીવટની જગ્યા લઈ શકે નહીં. સંચાલકોએ પોતાનો ભાગ તો ભજવવાનો જ છે. બજેટ તો ફક્ત તેમનાં હાથમાં એક હથિયાર છે.
- (૪) સફળતાનો આધાર સહકાર પર:
- બજેટનો અમલ કરવાનું કામ સરળ નથી. તેનો અમલ બધાં જ વહીવટી અધિકારીઓનાં પ્રયત્નો દ્વારા જ થઈ શકે છે. માટે દરેકે તેમાં જ જાણાવેલ લક્ષ્યાંકો સિંક્ર થાય તે માટે ખાસ પ્રયત્નો કરતા જ રહેવું જોઈએ. દરેક ખાતાનાં વડાને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે પોતાના ખાતાનો લક્ષ્યાંક સિંક્ર થઈ શક્યો નહીં તો બીજા ખાતાનાં પ્રયત્નો પર પણ તેની અસર થશે.
- (૫) લાંબેગાળે સફળતા:
- બજેટની કાર્યક્રમ પદ્ધતિ અપનાવવાનું કામ ટૂંકાગાળાનું નથી. ટૂંકાગાળામાં તેમાંથી ખૂલ આશ્ર્યકારક પરિણામોની અપેક્ષા રાખનારા સંચાલકો નિરાશ થાય છે. ધંધાને અનુકૂપ બજેટની કાર્યવાહી અને પદ્ધતિઓ વિકસાવતાં લાંબો સમય લાગે છે અને અનુભવને આધારે ઘડાયા પછી જ તે સારાં પરિણામો આપે છે.
- (૬) અર્થાત:
- અંદાજપત્રો તૈયાર કરવા અને તેના અમલ માટેની વ્યવસ્થા ગોઠવવી વગેરે કામો મોટી રકમનાં ખર્ચ માંગી લે છે. તેથી, નાની પેઢીઓ તેનો અમલ કરી શકતી નથી. વળી, જો તેનો ગણતરીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો તેના ફાયદા કરતાં તેનો ખર્ચ વધી જાય છે.
- (૭) મૂલ્યાંકન વ્યવસ્થાની ખામી:
- બજેટ દ્વારા નક્કી કરાયેલાં લક્ષ્યાંકો કેટલે અંશો પાર પડી રહ્યાં છે તેનું સતત મૂલ્યાંકન થવું જોઈએ. આવી વ્યવસ્થાની ખામી હોય તો કર્મચારીઓની અકાર્યક્ષમતા ઢંકાઈ જશે અને અંદાજપત્ર દ્વારા અંકુશા (બજેટરી કંટ્રોલ) વ્યવસ્થા કોઈ ઉપયોગી હેતુ પાર પાડી શક્યો નહીં.
- (૮) ઊચા લક્ષ્યાંકોથી નિરાશા:
- બજેટમાં જુદી-જુદી પ્રવૃત્તિઓ માટેનાં લક્ષ્યાંકો ખૂલ ઊચા ન હોવા જોઈએ. જો તે અવાસ્તવિક હોય અને કર્મચારીઓ તે પૂરાં ન કરી શકે તો તેઓ નિરાશ થાય છે, જેથી તેમનો જુસ્સો નીચો આવે છે. જે સમગ્ર ધંધાની કાર્યક્ષમતા નીચી લાવે છે, તેથી ખૂલ કાળજીપૂર્વક લક્ષ્યાંકો નક્કી કરવા જોઈએ.

૭.૪ રોકડ અંદાજપત્ર અને પરિવર્તનશીલ અંદાજપત્ર

૭.૪.૧ અર્થ, લક્ષણો, લાભો અને મર્યાદાઓ

બજેટ (Budget) શબ્દની ઉત્પત્તિ ફેન્ચ ભાષાના બજેટ શબ્દ પરથી થઈ છે. જેનો અર્થ ચામડાની થેલી એવો થાય છે. ધીરે ધીરે આ શબ્દનો ઉપયોગ થેલી માટે ન થતા આવક-ખર્ચના પત્રો માટે થવા લાગ્યો. પ્રવર્તમાન વાર્ષિક આવક-ખર્ચનાં વિતરણાપત્રો માટે બજેટ શબ્દ વપરાય છે. અંદાજપત્રમાં વિતીય વ્યવસ્થાનું પ્રતિનિવેદન, વિતીય સ્થિતિનું અનુમાન તથા વિતીય કાર્યક્રમોના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. સ્પષ્ટ કે અંદાજપત્ર ભૂતકાળની નજર સમક્ષ રાજીને પ્રવર્તમાન પરિસ્થિતિને આધારે ભાવિ માટે વિતીય સ્થિતિનું નિર્ધારણ કરવામાં આવે છે.

- * અંદાજપત્ર એટલે સંસ્થાકીય હેતુઓ, નીતિઓ અને કાર્યક્રમોનાં અમલીકરણ માટેનું એક વિશિષ્ટ આયોજન છે.
- * અંદાજપત્ર એ નિશ્ચિત સમયગાળા માટે એક વિશિષ્ટ કાર્યક્રમ છે, કે જેના દ્વારા આવક અને જાવકનો હેતુપૂર્વક અંદાજ લગાવી શકાય છે.

અંદાજપત્રના લાભ

૧. આવકના માર્ગ કચા કચા છે તેની સ્પષ્ટતા કરે છે.
૨. આર્થિક આયોજનમાં મદદ કરે છે.
૩. વિવિધ તત્વોનો અંદાજિત ખર્ચ દર્શાવે છે.
૪. વિવિધ ત્રોતોમાંથી પ્રાસ કરવાની નાણાકીય વિગતો નક્કી કરે છે.
૫. સ્વીકાર્ય આયોજન પ્રમાણે વહીવઠમાં મદદરૂપ બને છે.

૭.૪.૨ રોકડ અંદાજપત્ર:

કાર્યશીલ અંદાજપત્રો રોકડની અંદાજુત આવકના સંદર્ભમાં જોઈતી કુલ આવક અંગેનું આ અંદાજપત્ર છે.

લાક્ષણિકતાઃ

ધંધો ગમે તે પ્રકારનો હોથ પરંતુ દરેક ધંધામાં પ્રવૃત્તિના એક ચા બીજા સ્તરે રોકડની જરૂરિયાત તો રહેવાની જ આ સંજોગોમાં મળી શકે એવી રોકડ અને રોકડની જરૂરિયાત હોથ એવી પ્રવૃત્તિઓ વચ્ચે ચોંચ સંકલન હોવું જોઈએ. રોકડ પ્રાસિના જુદા જુદા સાધનોમાં કચારે અને કેટલી રોકડ મળી શકે એમ છે એ નાણાકીય સંચાલનનું મહત્વનું અંગ બન્યું છે.

ભવિષ્યના અમુક ચોક્કસ સમય માટે ભેગા સાધનોમાંથી થનાર રોકડ આવક બધા હેતુઓ માટે કરવાની રોકડ ચૂકવણી અને એના પરિણામે ઉદ્ભવતી રોકડનો વિગતવાર અંદાજ તે રોકડ અંદાજપત્ર.

રોકડ અંદાજપત્ર નીજા અંદાજપત્રો સાથે આનુસંગિક રીતે સંકળાયેલું છે. દેવાદારોને માટે રોકડ અંદાજપત્ર ખૂલ મહત્વનું છે. કચા સમયે કેટલી મુદ્દત માટે નાણાં ફાજલ પકી શકે છે તેનો રોકડ અંદાજપત્ર પરથી જ્યાલ આવે છે. રોકડની આવકની પરિસ્થિતિથી વાકેક થવાનું હોવાથી મોટા પાચે ખરીદી અને વેપારી તરફથી આપવામાં આવેલ રોકડ વટાવની આવક અંગે પણ ચોંચ નિર્ણય લઈ શકાય છે.

અંદાજપત્રની મર્યાદાઓ:

અંદાજપત્રની સાત મર્યાદાઓ નીચે પ્રમાણે છે.

(૧) સફળતાનો આધાર અંદાજ પર:

અંદાજપત્રમાં હંમેશા ઉંચા લક્ષ્યાંકો આવ્યા હોવા છતાં પણ ધારણા કરવામાં અને અંદાજપત્ર ઘડવામાં સંપૂર્ણ ચોક્સાઈ રાખવાનું શક્ય નથી. જે ચોક્સાઈથી અંદાજો ઘડવામાં આવે છે તેના પર અંદાજપત્રની પદ્ધતિની સફળતાનો આધાર રહેલો છે. અંદાજપત્રના પરિણામોનું અર્થદાટન કરતી વખતે તે અંદાજો પર આધારિત છે. તેથી હંમેશા ખ્યાલ રાખવો જોઈએ.

(૨) પરિવર્તનશીલતાનો અભાવ:

બધી પ્રસ્તુત માહિતીના આધારે અંદાજપત્ર તૈયાર કરવામાં આવતું હોવાથી અંદાજપત્રના આંકડાને આખરી ગણવાનું વલણ ઘણી વાર અપનાવવામાં આવે છે, પણ ધંધાની સતત પરિવર્તનશીલતા તેમજ પરિસ્થિતિ સાથે તેનો સંબંધ હોવાથી જો તેનામાં જડતા આવી જાય તો તે ઉપયોગીતા ગુમાવી દે છે. આથી ધંધાની અંદર અને બહારની પરિસ્થિતિના સંદર્ભમાં પરિવર્તન પામે એવું પરિવર્તનશીલ અંદાજપત્ર હોય એ જરૂરી છે.

(૩) ઘણી મોટી પડતર:

અંદાજપત્ર પદ્ધતિનું માળખું ઘણું ભારે અને ખર્ચાળ બની જાય છે અને એના પરિણામે નાના એકમો અપનાવી શકતા નથી. તેની પડતર તેમાંથી મળતા ફાયદા સાથે સુસંગતતા હોવી જોઈએ. આનો આધાર દરેક ધંધાના કદ, પ્રકાર અને તેની પ્રવૃત્તિઓ પર રહેતો હોવાથી કોઈ ચોક્સ નિયમો ઘડી શકાય નહીં.

(૪) અંદાજપત્ર એક સાધન છે:

અંદાજપત્ર દ્વારા સંચાલકોને વિવિધ માહિતી મળે છે જેના આધારે સંચાલનમાં મુખ્ય કાર્ય અમલમાં મૂકી શકાય છે. પણ એક વસ્તુ ખ્યાલમાં રાખવી જોઈએ કે અંદાજપત્ર એ સંચાલનનું એક સાધન છે.

(૫) વધુ ખર્ચાળ:

અંદાજપત્રની તૈયારી, તેનો અમલ અને વ્યવસ્થા માટે મોટી રકમ ખર્ચવી પડે છે. જેથી તે વધુ ખર્ચાળ છે.

(૬) અંદાજપત્ર સાધન છે, સાધ્ય નથી:

અંદાજપત્ર એ સાધન છે, સાધ્ય નથી. સંચાલકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર તેની સફળતાનો આધાર રહેલો છે.

(૭) ઉંચા લક્ષ્યાંકોથી નિરાશા:

ખૂબ ઉંચા લક્ષ્યાંકો જો સિઝ ન થાય તો અંદાજપત્રમાં નિરાશા સાંપડે છે. કર્મચારીનો જુસ્સો નીચે લાવે છે અને ઉત્સાહ ઘટાડે છે. ઘણીવાર એમ માનવામાં આવે છે કે અંદાજપત્ર દાખલ કરવાથી જ ધંધાની ભવિષ્યની સફળતા અને નફાકારકતા અંગે ખાત્રી મળી જાય છે પણ આ માન્યતા બરાબર નથી. અંદાજપત્ર તૈયાર કર્યા પછી તેની સફળતા માટે યોગ્ય વ્યવસ્થાતંત્રના સાથ અને સહકારની જરૂર રહે છે.

❖ રોકડ અંદાજપત્રનો નમૂનો:

જાન્યુઆરી ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ સુધીનું રોકડ અંદાજપત્ર

	વિગત	જાન્યુઆરી	ફેબ્રુઆરી	માર્ચ
ઉમેરો:	શરૂઆતની રોકડ સિલક	---	---	---
	રોકડ આવકો:			
	રોકડ વેચાણ	---	---	---
	ઉધાર વેચાણની રકમ ભળી/દેવાદારો પાસેથી મળેલ રોકડ	---	---	---
	લેણીહૂંકીના મખ્યા	---	---	---
	વ્યાજ અને ડિવિડની આવક	---	---	---
	કાચભી મિલકતની વેચાણની ઉપજ	---	---	---
	નવા શેર કે ડિલેન્ચર બહાર પાડ્યા	---	---	---
	અન્ય આવકો	---	---	---
	(અ) કુલ આવકો	---	---	---
બાદ:	રોકડ ચૂકવણી:			
	રોકડ ખરીદી	---	---	---
	ઉધાર ખરીદીની રકમ ચૂકવી/લેણાદારોને ચૂકવવાની રોકડ	---	---	---
	મજૂરી અને પગાર	---	---	---
	મિલકતોની ખરીદી	---	---	---
	જાહેરાત ખર્ચ	---	---	---
	ડિલેન્ચર પરત કર્યો	---	---	---
	આવકવેરો ચૂકવ્યો	---	---	---
	ડિવિડન ચૂકવ્યું	---	---	---
	અન્ય જાપકો	---	---	---
	(બ) કુલ ચૂકવણી	---	---	---
	છેવટની રોકડ સિલક (અ - બ)	---	---	---

રોકડ અંદાજપત્રનાં દાખલા

પ્ર.: ૧ નીચે આપેલી માહિતી પરથી જાન્યુઆરી ૧૯૯૯થી માર્ચ ૧૯૯૯ સુધીનું રોકડ અંદાજપત્ર બનાવો.

મહિનો	વેચાણ (₹)	અન્ય ખર્ચ (₹)
નવેમ્બર ૧૯૯૮	૪૦,૦૦૦	૫,૦૦૦
ડિસેમ્બર ૧૯૯૮	૫૦,૦૦૦	૪,૦૦૦
જાન્યુઆરી ૧૯૯૯	૬૦,૦૦૦	૩,૦૦૦
ફેબ્રુઆરી ૧૯૯૯	૮૦,૦૦૦	૨,૦૦૦
માર્ચ ૧૯૯૯	૪૦,૦૦૦	૬,૦૦૦
એપ્રિલ ૧૯૯૯	૬૦,૦૦૦	૮,૦૦૦

અન્ય માહિતી:

- દોષક મહિનાનાં અપેક્ષિત વેચાણ માટે ખરીદી થઈ છે અને તે અગાઉનાં મહિનામાં ચૂકવેલ છે.
- વેચાણ પર કાચા નકારો દર ૨૫% છે.

3. કુલ વેચાણામાંથી 30% વેચાણ થથેલ માસમાં વસ્તુલ થાથ છે અને બાકીના 70% બીજા માસમાં ભણે છે.
4. અન્ય ખર્ચ માટે ગોળો (lag) $\frac{1}{4}$ માસ છે.
- પ. તારીખ: ૦૧-૦૧-૧૯૯૯ના રોજની શરૂઆતની રોકડ સિલક રૂ ૫૦,૦૦૦/- છે.

(સ. પ. ચુનિ. નવેમ્બર ૧૯૯૯)

જાન્યુઆરી ૧૯૯૯થી માર્ચ ૧૯૯૯ સુધીનું રોકડ અંદાજપત્ર

	વિગત	જાન્યુઆરી	ફેબ્રુઆરી	માર્ચ
ઉમેરો:	શરૂઆતની રોકડ સિલક	૫૦૦૦૦	૩૮૭૫૦	૭૩૫૦૦
	રોકડ આવકો:			
	રોકડ વેચાણ (નોંધ ૧)	૧૮૦૦૦	૨૪૦૦૦	૧૨૦૦૦
	ઉધાર વેચાણ (નોંધ ૧)	૩૪૦૦૦	૪૨૦૦૦	૫૬૦૦૦
	(અ) કુલ આવકો	૧૦૩૦૦૦	૧૦૫૭૫૦	૧૪૧૫૦૦
બાદ:	રોકડ ચૂકવણી:			
	ખરીદી (નોંધ ૨)	૫૦૦૦૦	૩૦૦૦૦	૪૫૦૦૦
	અન્ય ખર્ચ (નોંધ ૩)	૩૨૫૦	૨૨૫૦	૫૦૦૦
	(બ) કુલ ચૂકવણી	૬૩૨૫૦	૩૨૨૫૦	૫૦૦૦૦
	છેવટની રોકડ સિલક (અ - બ)	૩૮૭૫૦	૭૩૫૦૦	૮૧૫૦૦

નોંધ: ૧ વેચાણા:

		૩૦%	૭૦%
		રોકડ	ઉધાર
નવેમ્બર	૪૦૦૦૦	૧૨૦૦૦	૨૮૦૦૦ ડિસેમ્બર
ડિસેમ્બર	૫૦૦૦૦	૧૫૦૦૦	૩૫૦૦૦ જાન્યુઆરી
જાન્યુઆરી	૬૦૦૦૦	૧૮૦૦૦	૪૨૦૦૦ ફેબ્રુઆરી
ફેબ્રુઆરી	૮૦૦૦૦	૨૪૦૦૦	૫૬૦૦૦ માર્ચ
માર્ચ	૪૦૦૦૦	૧૨૦૦૦	૨૮૦૦૦ એપ્રિલ
એપ્રિલ	૬૦૦૦૦	૧૮૦૦૦	૪૨૦૦૦ મે

નોંધ: ૨ ખરીદી:

ધારો કે	વેચાણ	₹ ૧૦૦/-
(-) કાચો નષ્ટો (૨૫%)		₹ ૨૫/-
	પડતર કિંમત	₹ <u>૭૫/-</u>
નવેમ્બર	૪૦૦૦૦ → ૭૫%	૩૦૦૦૦ ઓક્ટોબર
ડિસેમ્બર	૫૦૦૦૦ → ૭૫%	૩૭૫૦૦ નવેમ્બર
જાન્યુઆરી	૬૦૦૦૦ → ૭૫%	૪૫૦૦૦ ડિસેમ્બર
ફેબ્રુઆરી	૮૦૦૦૦ → ૭૫%	૬૦૦૦૦ જાન્યુઆરી
માર્ચ	૪૦૦૦૦ → ૭૫%	૩૦૦૦૦ ફેબ્રુઆરી
એપ્રિલ	૬૦૦૦૦ → ૭૫%	૪૫૦૦૦ માર્ચ

નોંધ: ૩ અન્ય ખર્ચો:

નવેમ્બર	૫૦૦૦	$\frac{3}{4}$ $\frac{1}{4}$	૩૭૫૦ ૧૨૫૦	નવેમ્બર ડિસેમ્બર
ડિસેમ્બર	૪૦૦૦	$\frac{3}{4}$ $\frac{1}{4}$	૩૦૦૦ ૧૦૦૦	ડિસેમ્બર જાન્યુઆરી
જાન્યુઆરી	૩૦૦૦	$\frac{3}{4}$ $\frac{1}{4}$	૨૨૫૦ ૭૫૦	જાન્યુઆરી
ફેબ્રુઆરી	૨૦૦૦	$\frac{3}{4}$ $\frac{1}{4}$	૧૫૦૦ ૪૦૦	ફેબ્રુઆરી
માર્ચ	૬૦૦૦	$\frac{3}{4}$ $\frac{1}{4}$	૪૫૦૦ ૧૫૦૦	માર્ચ
એપ્રિલ	૮૦૦૦	$\frac{3}{4}$ $\frac{1}{4}$	૬૦૦૦ ૨૦૦૦	એપ્રિલ
				મે

પ્ર.: ૨ નીચે આપેલી માહિતી પરથી ૩૧-૧૨-૨૦૧૮ના રોજ પુરા થતા વર્ષ માટે ૩ માસનું રોકડ અંદાજપત્ર બનાવો.

૧. તારીખ: ૦૧-૧૦-૨૦૧૮ના રોજની શરૂઆતની રોકડ સિલક રૂ ૧,૦૦,૦૦૦/- છે.

મહિનો	વેચાણ (₹)	ખરીદી (₹)	ઓફિસ ખર્ચ (₹)	વેચાણ ખર્ચ (₹)	ફેક્ટરી ખર્ચ (₹)
જુલાઈ	૧,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦	૧૦,૦૦૦	૫,૦૦૦	૧૦,૦૦૦
ઓગષ્ટ	૨,૦૦,૦૦૦	૮૦,૦૦૦	૨૦,૦૦૦	૬,૦૦૦	૧૦,૦૦૦
સપ્ટેમ્બર	૩,૦૦,૦૦૦	૧,૪૦,૦૦૦	૩૦,૦૦૦	૭,૦૦૦	૧૦,૦૦૦
ઓક્ટોબર	૪,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦	૪૦,૦૦૦	૮,૦૦૦	૧૦,૦૦૦
નવેમ્બર	૩,૦૦,૦૦૦	૧,૦૦,૦૦૦	૨૦,૦૦૦	૬,૦૦૦	૧૦,૦૦૦
ડિસેમ્બર	૨,૦૦,૦૦૦	૮૦,૦૦૦	૧૦,૦૦૦	૫,૦૦૦	૧૦,૦૦૦

૨. લેણદારોને એક માસની મુદ્દત આપી છે.
૩. ઉધાર વેચાણના ૫૦% વેચાણ થયેલ માસનાં એક માસ બાદ મળશે અને બાકીના ૫૦% બીજા માસે મળશે. રોકડ અને ઉધાર વેચાણનો ભાગ ૫૦% અને ૪૦% છે.
૪. કુલ ખરીદીનાં ૫૦% રોકડ છે.
૫. નવેમ્બર ૨૦૧૮માં રૂ ૫૦,૦૦૦/-ની કિંમતનું એક ચંત્ર ખરીદાશે અને રૂ ૧૦,૦૦૦/- કરાર વખતે ચૂકવવાનાં છે.
૬. તારીખ: ૧૫-૧૨-૨૦૧૮ના રોજ રૂ ૨૦,૦૦૦/- ડિવિડન મળશે.
૭. રૂ ૨,૦૦૦/- ભાડું દર માસે ચૂકવવાનું છે.
૮. ચૂકવણીનો ગાળો (lag): ઓફિસ ખર્ચ - અડધો માસ વેચાણ ખર્ચ - એક અઠવાડિયું
૯. ફેક્ટરી ખર્ચમાં દર માસે રૂ ૨,૦૦૦/-નો ઘસારો સમાયેલ છે. ફેક્ટરી ખર્ચ ર માસ બાદ ચૂકવવાનાં છે.

તારીખ: ૩૧-૧૨-૨૦૧૮ના રોજ પુરા થતા વર્ષનું ત્રિમાસિક રોકડ અંદાજપત્ર

		વિગત	ઓક્ટોબર	નવેમ્બર	ડિસેમ્બર
ઉમેરો:	શરૂઆતની રોકડ સિલક રોકડ આવકો: રોકડ વેચાણ (નોંધ ૨) ઉધાર વેચાણ (નોંધ ૨) મળેલ ડિવિઙ્ડન	૧૦૦૦૦૦	૨૧૨૨૫૦	૩૨૩૫૦૦	
		૨૪૦૦૦૦	૧૮૦૦૦૦	૧૨૦૦૦૦	
		૧૦૦૦૦૦	૧૪૦૦૦૦	૧૪૦૦૦૦	
		---	---	૨૦૦૦૦	
		૪૪૦૦૦૦	૫૩૨૨૫૦	૬૦૩૫૦૦	
	(અ) કુલ આવકો રોકડ ચૂકવણી: રોકડ ખરીદી (નોંધ ૧) ઉધાર ખરીદી (નોંધ ૧) ચંત્રની ખરીદી ભાડું ઓક્સિ ખર્ચ (નોંધ ૩) વેચાણ ખર્ચ (નોંધ ૪) ફેક્ટરી ખર્ચ (નોંધ ૫)	૧૦૦૦૦૦	૫૦૦૦૦	૪૦૦૦૦	
		૭૫૦૦૦	૧૦૦૦૦૦	૫૦૦૦૦	
		---	૧૦૦૦૦	---	
		૨૦૦૦	૨૦૦૦	૨૦૦૦	
		૩૪૦૦૦	૩૦૦૦૦	૧૫૦૦૦	
	(બ) કુલ ચૂકવણી	૭૭૫૦	૮૭૫૦	૮૭૫૦	
		૮૦૦૦	૮૦૦૦	૮૦૦૦	
	(બ) કુલ ચૂકવણી	૨૨૭૭૫૦	૨૦૮૭૫૦	૧૨૪૭૫૦	
	છેવણી રોકડ સિલક (અ - બ)	૨૧૨૨૫૦	૩૨૩૫૦૦	૪૭૮૭૫૦	

નોંધ: ૧ ખરીદી:

	૫૦%	૫૦%
	રોકડ	ઉધાર
જુલાઈ	૧૦૦૦૦૦	૫૦૦૦૦
ઓગષ્ટ	૬૦૦૦૦	૪૫૦૦૦
સપ્ટેમ્બર	૧૫૦૦૦૦	૭૫૦૦૦
ઓક્ટોબર	૨૦૦૦૦૦	૧૦૦૦૦૦
નવેમ્બર	૧૦૦૦૦૦	૫૦૦૦૦
ડિસેમ્બર	૮૦૦૦૦	૪૦૦૦૦

નોંધ: ૨ વેચાણ:

	૫૦% રોકડ	૪૦% ઉધાર	વેચાણનાં	ઉધાર
			૫૦%	
જુલાઈ	૧૦૦૦૦૦	૫૦૦૦૦	૪૦૦૦૦	૨૦૦૦૦ ઓગષ્ટ
ઓગષ્ટ	૨૦૦૦૦૦	૧૨૦૦૦૦	૮૦૦૦૦	૨૦૦૦૦ સપ્ટેમ્બર
સપ્ટેમ્બર	૩૦૦૦૦૦	૧૮૦૦૦૦	૧૨૦૦૦૦	૪૦૦૦૦ ઓક્ટોબર
ઓક્ટોબર	૪૦૦૦૦૦	૨૪૦૦૦૦	૧૬૦૦૦૦	૪૦૦૦૦ નવેમ્બર
નવેમ્બર	૩૦૦૦૦૦	૧૮૦૦૦૦	૧૨૦૦૦૦	૪૦૦૦૦ ડિસેમ્બર
ડિસેમ્બર	૨૦૦૦૦૦	૧૨૦૦૦૦	૮૦૦૦૦	૪૦૦૦૦ જાન્યુઆરી

નોંધ: ૩ ઓફિસ ખર્ચ:

જુલાઈ	૧૦૦૦૦	$\frac{1}{2}$	૪૦૦૦	જુલાઈ
		$\frac{1}{2}$	૪૦૦૦	ઓગાષ
ઓગાષ	૨૦૦૦૦	$\frac{1}{2}$	૧૦૦૦૦	ઓગાષ
		$\frac{1}{2}$	૧૦૦૦૦	સપ્ટેમ્બર
સપ્ટેમ્બર	૩૦૦૦૦	$\frac{1}{2}$	૧૫૦૦૦	સપ્ટેમ્બર
		$\frac{1}{2}$	૧૫૦૦૦	ઓક્ટોબર } ૩૪૦૦૦
ઓક્ટોબર	૪૦૦૦૦	$\frac{1}{2}$	૨૦૦૦૦	ઓક્ટોબર }
		$\frac{1}{2}$	૨૦૦૦૦	નવેમ્બર } ૩૦૦૦૦
નવેમ્બર	૨૦૦૦૦	$\frac{1}{2}$	૧૦૦૦૦	નવેમ્બર }
		$\frac{1}{2}$	૧૦૦૦૦	ડિસેમ્બર } ૧૫૦૦૦
ડિસેમ્બર	૧૦૦૦૦	$\frac{1}{2}$	૪૦૦૦	ડિસેમ્બર }
		$\frac{1}{2}$	૪૦૦૦	જાન્યુઆરી

નોંધ: ૪ વેચાણ ખર્ચ:

જુલાઈ	૫૦૦૦	$\frac{3}{4}$	૩૭૫૦	જુલાઈ
		$\frac{1}{4}$	૧૨૫૦	ઓગાષ
ઓગાષ	૬૦૦૦	$\frac{3}{4}$	૪૫૦૦	ઓગાષ
		$\frac{1}{4}$	૧૫૦૦	સપ્ટેમ્બર
સપ્ટેમ્બર	૭૦૦૦	$\frac{3}{4}$	૫૨૫૦	સપ્ટેમ્બર
		$\frac{1}{4}$	૧૭૫૦	ઓક્ટોબર } ૩૭૫૦
ઓક્ટોબર	૮૦૦૦	$\frac{3}{4}$	૬૦૦૦	ઓક્ટોબર }
		$\frac{1}{4}$	૨૦૦૦	નવેમ્બર } ૮૭૫૦
નવેમ્બર	૯૦૦૦	$\frac{3}{4}$	૭૭૫૦	નવેમ્બર }
		$\frac{1}{4}$	૨૨૫૦	ડિસેમ્બર } ૮૭૫૦
ડિસેમ્બર	૧૦૦૦	$\frac{3}{4}$	૭૫૦૦	ડિસેમ્બર }
		$\frac{1}{4}$	૨૫૦૦	જાન્યુઆરી

નોંધ: ૫ ફેક્ટરી ખર્ચ:

	ઘસારો				
જુલાઈ	૧૦૦૦૦	- ૨૦૦૦	= ૮૦૦૦	સપ્ટેમ્બર	
ઓગાષ	૧૦૦૦૦	- ૨૦૦૦	= ૮૦૦૦	ઓક્ટોબર	
સપ્ટેમ્બર	૧૦૦૦૦	- ૨૦૦૦	= ૮૦૦૦	નવેમ્બર	
ઓક્ટોબર	૧૦૦૦૦	- ૨૦૦૦	= ૮૦૦૦	ડિસેમ્બર	
નવેમ્બર	૧૦૦૦૦	- ૨૦૦૦	= ૮૦૦૦	જાન્યુઆરી	
ડિસેમ્બર	૧૦૦૦૦	- ૨૦૦૦	= ૮૦૦૦	ફેલુઆરી	

પ્ર.: 3 ખુશાતી લિમિટેડની નીચેની માહિતી પરથી એપ્રિલ-૨૦૦૪થી જૂન-૨૦૦૪ સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો.

1. તારીખ: ૦૧-૦૪-૨૦૦૪ના રોજની શરૂઆતની રોકડ સિલક રૂ ૪૦,૦૦૦/- છે.
2. ખરીદી: માર્યની ખરીદી રૂ ૨,૦૦,૦૦૦/- છે. ત્યારબાદ પ્રતિ માસ પાછળા માસની સરખામણીમાં ૨૦% લેખે ખરીદી વધી છે. ૫૦% રોકડ ખરીદી છે જેના પર ૧૦% વટાવ મળે છે અને ૫૦% ઉધાર ખરીદી છે જેની ચૂકવણી ૧ માસ બાદ કરવાની છે.
3. અપેક્ષિત પગાર: માસિક રૂ ૨,૦૦૦/- દર માસની જમી તારીખે ચૂકવાય છે. મે માસમાં માસિક ૧૦% લેખે પગાર વધે છે.
4. વેચાણ: ફેલ્બુઅારી માસનું વેચાણ રૂ ૩,૫૦,૦૦૦/- છે. દર માસે વેચાણમાં રૂ ૪૦,૦૦૦/-નો વધારો થાય છે. રોકડ અને ઉધાર વેચાણનું પ્રમાણ ૧:૧ છે. ઉધાર વેચાણનાં પૈસા ૧ માસ બાદ મળે છે.
5. ચૂકવણી માટેનો ગાળો (lag): ઉત્પાદન ખર્ચ - $\frac{1}{2}$ માસ
ઓફિસ ખર્ચ - ૧ માસ
વેચાણ ખર્ચ - ૨ માસ

૬. અન્ય માહિતી:

મહિનો	ઉત્પાદન ખર્ચ (₹)	ઓફિસ ખર્ચ (₹)	વેચાણ ખર્ચ (₹)
ફેલ્બુઅારી	૨૦,૦૦૦	૨૦,૦૦૦	૫૪,૦૦૦
માર્ચ	૨૨,૦૦૦	૨૩,૦૦૦	૧૮,૦૦૦
એપ્રિલ	૨૪,૦૦૦	૨૫,૪૦૦	૨૨,૦૦૦
મે	૨૬,૦૦૦	૨૬,૨૮૦	૨૮,૦૦૦
જૂન	૨૮,૦૦૦	૩૨,૦૦૦	૩૨,૦૦૦

(સ. પ. ચુનિ. ૨૦૦૪ પર આધારિત)

ખુશાતી લિમિટેડનું એપ્રિલ ૨૦૦૪થી જૂન ૨૦૦૪ સુધીનું રોકડ અંદાજપત્ર

વિગત	એપ્રિલ	મે	જૂન
શરૂઆતની રોકડ સિલક	૪૦૦૦૦	૧૫૦૦૦૦	૨૮૬૮૫૦
રોકડ આવકો:			
રોકડ વેચાણ (નોંધ ૩)	૨૨૦૦૦૦	૨૪૦૦૦૦	૨૬૦૦૦૦
ઉધાર વેચાણ (નોંધ ૩)	૨૦૦૦૦૦	૨૨૦૦૦૦	૨૪૦૦૦૦
(અ) કુલ આવકો	૪૬૦૦૦૦	૬૧૦૦૦૦	૭૮૬૮૫૦
રોકડ ચૂકવણી:			
રોકડ ખરીદી (નોંધ ૧)	૧૦૮૦૦૦	૧૨૬૫૦૦	૧૫૫૫૨૦
ઉધાર ખરીદી (નોંધ ૧)	૧૦૦૦૦૦	૧૨૦૦૦૦	૧૪૪૦૦૦
અપેક્ષિત પગાર (નોંધ ૨)	૨૦૦૦	૨૧૫૦	૨૨૦૦
ઉત્પાદન ખર્ચ (નોંધ ૪)	૨૩૦૦૦	૨૫૦૦૦	૨૭૦૦૦
ઓફિસ ખર્ચ	૨૩૦૦૦	૨૫૪૦૦૦	૨૮૨૮૦
વેચાણ ખર્ચ (નોંધ ૫)	૫૪૦૦૦	૧૮૦૦૦	૨૨૦૦૦
(બ) કુલ ચૂકવણી	૩૧૦૦૦૦	૩૨૦૧૫૦	૩૮૦૦૦૦
છેવટની રોકડ સિલક (અ - બ)	૧૫૦૦૦૦	૨૮૬૮૫૦	૪૦૮૮૫૦

નોંધ: ૧ ખરીદી:

	૫૦% રોકડ	૧૦% વટાવ	ચોખી રોકડ ખરીદી	૫૦% ઉધાર	
માર્ચ	૨૦૦૦૦૦	૧૦૦૦૦૦	- ૧૦૦૦૦	૮૦૦૦૦	૧૦૦૦૦૦ એપ્રિલ
એપ્રિલ	૨૪૦૦૦૦	૧૨૦૦૦૦	- ૧૨૦૦૦	૧૦૮૦૦૦	૧૨૦૦૦૦ મે
મે	૨૮૮૦૦૦	૧૪૪૦૦૦	- ૧૪૪૦૦	૧૨૯૬૦૦	૧૪૪૦૦૦ જૂન
જૂન	૩૪૫૬૦૦	૧૭૨૮૦૦	- ૧૭૨૮૦	૧૫૫૫૨૦	૧૭૨૮૦૦ જુલાઈ
જુલાઈ	૪૧૪૭૨૦	૨૦૭૩૬૦	- ૨૦૭૩૬૦	૧૮૬૬૨૪	૨૦૭૩૬૦ ઓગષ્ટ

નોંધ: ૨ અપેક્ષિત પગાર:

કેલુઆરી	૨૦૦૦	૧૫૦૦	કેલુઆરી
		૫૦૦	માર્ચ
માર્ચ	૨૦૦૦	૧૫૦૦	માર્ચ
		૫૦૦	એપ્રિલ } ૨૦૦૦
એપ્રિલ	૨૦૦૦	૧૫૦૦	એપ્રિલ } ૨૦૦૦
	(૧૦% વધારો)	૫૦૦	મે } ૨૧૫૦
મે	૨૨૦૦	૧૬૫૦	મે } ૨૨૦૦
		૫૫૦	જૂન } ૨૨૦૦
જૂન	૨૨૦૦	૧૬૫૦	જૂન } ૨૨૦૦
		૫૫૦	જુલાઈ
જુલાઈ	૨૨૦૦	૧૬૫૦	જુલાઈ
		૫૫૦	ઓગષ્ટ

નોંધ: ૩ વેચાણ:

	૫૦% રોકડ	૫૦% ઉધાર	
કેલુઆરી	૩૬૦૦૦૦	૧૮૦૦૦૦	૧૮૦૦૦૦ માર્ચ
માર્ચ	૪૦૦૦૦૦	૨૦૦૦૦૦	૨૦૦૦૦૦ એપ્રિલ
એપ્રિલ	૪૪૦૦૦૦	૨૨૦૦૦૦	૨૨૦૦૦૦ મે
મે	૪૮૦૦૦૦	૨૪૦૦૦૦	૨૪૦૦૦૦ જૂન
જૂન	૫૨૦૦૦૦	૨૬૦૦૦૦	૨૬૦૦૦૦ જુલાઈ
જુલાઈ	૫૬૦૦૦૦	૨૮૦૦૦૦	૨૮૦૦૦૦ ઓગષ્ટ

નોંધ: ૪ ઉત્પાદન ખર્ચ:

કેલુઆરી	૨૦૦૦૦	૧૦૦૦૦	કેલુઆરી
		૧૦૦૦૦	માર્ચ
માર્ચ	૨૨૦૦૦	૧૧૦૦૦	માર્ચ
		૧૧૦૦૦	એપ્રિલ } ૨૩૦૦૦
એપ્રિલ	૨૪૦૦૦	૧૨૦૦૦	એપ્રિલ } ૨૩૦૦૦
		૧૨૦૦૦	મે } ૨૫૦૦૦
મે	૨૫૦૦૦	૧૩૦૦૦	મે } ૨૫૦૦૦
		૧૩૦૦૦	જૂન } ૨૭૦૦૦
જૂન	૨૬૦૦૦	૧૪૦૦૦	જૂન } ૨૭૦૦૦
		૧૪૦૦૦	જુલાઈ

નોંધ: ૫ વેચાણ ખર્ચ:

ફેબ્રુઆરી	૫૪૦૦૦	એપ્રિલ
માર્ચ	૧૮૦૦૦	મે
એપ્રિલ	૨૨૦૦૦	જૂન
મે	૨૮૦૦૦	જુલાઈ
જૂન	૩૨૦૦૦	ઓગષ્ટ

પ્ર.: ૪ એપ્રિલ ૨૦૦૦થી જૂન ૨૦૦૦ના ત્રણ માસ માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો.

૧. તારીખ: ૦૧-૦૪-૨૦૦૦ના રોજની રોકડ સિલક અને બેંક સિલક ₹ ૪૦,૦૦૦/- છે.
૨. વેચાણ પર કાચા નફાનો દર $33\frac{1}{3}\%$ છે.
૩. અન્ય માહિતી:

મહિનો	કુલ ખરીદી (₹)	શરૂઆતનો સ્ટોક (₹)	પરોક્ષ ખર્ચ (₹)
માર્ચ	૧,૨૦,૦૦૦	૧૦,૦૦૦	૨૦,૦૦૦
એપ્રિલ	૧,૪૦,૦૦૦	૧૫,૦૦૦	૨૫,૦૦૦
મે	૧,૫૦,૦૦૦	૨૫,૦૦૦	૩૦,૦૦૦
જૂન	૧,૮૦,૦૦૦	૩૦,૦૦૦	૩૫,૦૦૦
જુલાઈ	૨૦૦,૦૦૦	૨૭,૫૦૦	૪૦,૦૦૦

૪. મે ૨૦૦૦માં ₹ ૧,૨૦,૦૦૦/-ની કિંમતનું ચંત્ર ખરીદાશે. ૫૦% રકમ ખરીદી સમયે અને બાકીની રકમ બીજા મહિને ચૂકવાશે.
૫. ૫૦% ખરીદી અને વેચાણ ઉધાર પર છે.
૬. સમયગાળો (lag): ઉધાર વેચાણ - ૧ માસ
ઉધાર ખરીદી - $\frac{1}{2}$ માસ

(સ. પ. ચુનિ. માર્ચ ૨૦૦૦ પર આધારિત)

એપ્રિલ ૨૦૦૦થી જૂન ૨૦૦૦નું ત્રિમાસિક રોકડ અંદાજપત્ર

	વિગત	એપ્રિલ	મે	જૂન
ઉમેરો:	શરૂઆતની રોકડ અને બેંક સિલક રોકડ આવકો:	૪૦૦૦૦	૫૨૫૦૦	૨૮૫૦૦
	રોકડ વેચાણ (નોંધ ૧)	૭૮૦૦૦	૬૩૦૦૦	૧૦૬૫૦૦
	ઉધાર વેચાણ (નોંધ ૧)	૧૦૩૪૦૦	૧૧૭૦૦૦	૧૩૬૫૦૦
	(અ) કુલ આવકો	૨૨૧૫૦૦	૨૭૨૫૦૦	૨૭૭૫૦૦
બાદ:	રોકડ ચૂકવણી:			
	રોકડ ખરીદી (નોંધ ૨)	૫૬૦૦૦	૫૪૦૦૦	૭૨૦૦૦
	ઉધાર ખરીદી (નોંધ ૨)	૭૮૦૦૦	૬૦૦૦૦	૧૦૨૦૦૦
	પરોક્ષ ખર્ચી	૨૫૦૦૦	૩૦૦૦૦	૩૫૦૦૦
	ચંત્રની ખરીદી	---	૫૦૦૦૦	૫૦૦૦૦
	(બ) કુલ ચૂકવણી	૧૫૬૦૦૦	૨૪૪૦૦૦	૨૬૬૦૦૦
	ઇવટની રોકડ સિલક (અ - બ)	૫૨૫૦૦	૨૮૫૦૦	૮૫૦૦

નોંધ: ૧ વેચાણ:

ધારો કે	વેચાણ	₹ ૧૫૦/-
(-) કાચો નફો (૩૩ $\frac{1}{3}$ %)		₹ ૫૦/-
	પડતર કિંમત	₹ ૧૦૦/-
માર્ચ	ખરીદી શરીર સ્ટોક આખર સ્ટોક	પડતર કિંમત નફો કુલ વેચાણ
માર્ચ	૧૨૦૦૦૦ + ૧૦૦૦૦	- ૧૫૦૦૦ = ૧૧૫૦૦૦ + ૫૪૫૦૦ = ૧૭૨૫૦૦
એપ્રિલ	૧૪૦૦૦૦ + ૧૫૦૦૦	- ૨૫૦૦૦ = ૧૩૦૦૦૦ + ૬૫૦૦૦ = ૧૯૫૦૦૦
મે	૧૬૦૦૦૦ + ૨૫૦૦૦	- ૩૦૦૦ = ૧૪૫૦૦૦ + ૭૭૫૦૦ = ૨૨૨૫૦૦
જૂન	૧૮૦૦૦૦ + ૩૦૦૦૦	- ૨૭૫૦૦ = ૧૮૨૫૦૦ + ૯૧૨૫૦ = ૨૭૩૭૫૦

	કુલ વેચાણ	૪૦% રોકડ	૫૦% ઉધાર
માર્ચ	૧૭૨૫૦૦	૬૬૦૦૦	૧૦૩૫૦૦ એપ્રિલ
એપ્રિલ	૧૯૫૦૦૦	૭૮૦૦૦	૧૧૭૦૦૦ મે
મે	૨૨૨૫૦૦	૯૩૦૦૦	૧૩૯૫૦૦ જૂન
જૂન	૨૭૩૭૫૦	૧૦૯૫૦૦	૧૬૪૨૫૦ જુલાઈ

નોંધ: ૨ ખરીદી:

	૪૦% રોકડ	૫૦% ઉધાર		
માર્ચ	૧૨૦૦૦૦	૪૮૦૦૦	૭૨૦૦૦	માર્ચ
એપ્રિલ	૧૪૦૦૦૦	૫૬૦૦૦	૮૪૦૦૦	એપ્રિલ } એપ્રિલ
મે	૧૬૦૦૦૦	૬૪૦૦૦	૯૬૦૦૦	મે } મે
જૂન	૧૮૦૦૦૦	૭૨૦૦૦	૧૦૮૦૦૦	જૂન } જૂન
જુલાઈ	૨૦૦૦૦૦	૮૦૦૦૦	૧૨૦૦૦૦	જુલાઈ } ઓગાષ

પ્ર.: ૫ નીચે આપેલી માહિતી પરથી ૩૧-૧૨-૧૯૯૮ના રોજ પુરા થતા વર્ષ માટેનું ત્રિમાસિક રોકડ અંદાજપત્ર બનાવો.

માસ	કુલ વેચાણ (₹)	કુલ ખરીદી (₹)	મજૂરી (₹)	અન્ય ખર્ચો (₹)
ઓગાષ	૩,૦૦,૦૦૦	૧,૪૦,૦૦૦	૪૦,૦૦૦	૮૦,૦૦૦
સપ્ટેમ્બર	૪,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦	૫૦,૦૦૦	૧૧,૦૦૦
ઓક્ટોબર	૪,૫૦,૦૦૦	૧,૬૦,૦૦૦	૬૦,૦૦૦	૧૨,૦૦૦
નવેમ્બર	૫,૦૦,૦૦૦	૨,૪૦,૦૦૦	૭૦,૦૦૦	૧૩,૦૦૦
ડિસેમ્બર	૬,૦૦,૦૦૦	૩,૦૦,૦૦૦	૮૦,૦૦૦	૧૪,૦૦૦

વધારાની માહિતી:

- રોકડ વેચાણ અને ઉધાર વેચાણનું પ્રમાણ ૧:૪ છે.
- ૨૦% ખરીદી રોકડેથી કરી છે.
- દર માસે ઉધાર વેચાણનાં ૫% વેચાણ પરત છે.

૪. ચોખા ઉધાર વેચાણનાં ૫૦% વેચાણ થયેલ માસના પછીના મળે છે અને બાકીના ૫૦% તેના બીજા માસે મળે છે.
૫. ₹ ૧,૦૦,૦૦૦/-નું ચંત્ર ઓક્ટોબર ૧૯૯૮માં ખરીદશો જેમાંથી ૨૦% ખરીદી વખતે અને બાકીની રકમ ત્રણ માસ પછી ચૂકવાશે.
૬. ઉધાર ખરીદીનો સમય (lag) ૧ માસ છે.
૭. ખર્ચાઓમાં દર માસે ₹ ૫,૦૦૦/- ઘસારાનો સમાવેશ થાય છે.
૮. મજૂરી માટેનો સમયગાળો $\frac{1}{2}$ માસ છે.
૯. તારીખ: ૦૧-૧૦-૧૯૯૮ના રોજની રોકડ સિલક ₹ ૧,૨૦,૦૦૦/- છે.

(સ. પ. ચુનિ. એપ્રિલ ૧૯૯૯ પર આધારિત)

તારીખ: ૩૧-૧૨-૧૯૯૮ના રોજ પૂરા થતા વર્ષનું ત્રિમાસિક રોકડ અંદાજપત્ર

	વિગત	એપ્રિલ	મે	જૂન
ઉમેરો:	શરૂઆતની રોકડ અને બેંક સિલક રોકડ આવકો:	૧૨૦૦૦૦	૨૦૩૦૦૦	૩૭૮૦૦૦
	રોકડ વેચાણ (નોંધ ૧)	૮૦૦૦૦	૧૦૦૦૦૦	૧૨૦૦૦૦
	ઉધાર વેચાણ (નોંધ ૧)	૨૫૫૦૦૦	૩૨૩૦૦૦	૩૫૧૦૦૦
બાદ:	(અ) કુલ આવકો	૪૭૫૦૦૦	૬૨૬૦૦૦	૮૫૬૦૦૦
	રોકડ ચૂકવણી:			
	રોકડ ખરીદી (નોંધ ૨)	૩૨૦૦૦	૪૮૦૦૦	૫૦૦૦૦૦
	ઉધાર ખરીદી (નોંધ ૨)	૧૫૦૦૦૦	૧૨૮૦૦૦	૧૯૨૦૦૦
	ચંત્રની ખરીદી	૨૦૦૦૦	---	---
	મજૂરી (નોંધ ૩)	૫૫૦૦૦	૬૫૦૦૦	૩૪૦૦૦
	અન્ય ખર્ચાઓ (નોંધ ૪)	૫૦૦૦	૭૦૦૦	૮૦૦૦
	(બ) કુલ ચૂકવણી	૨૭૩૦૦૦	૨૪૮૦૦૦	૩૩૪૦૦૦
	છેવટની રોકડ સિલક (અ - બ)	૨૦૩૦૦૦	૩૭૮૦૦૦	૫૨૪૦૦૦

નોંધ: ૧ વેચાણા:

	કુલ વેચાણા	૧/૪ રોકડ વેચાણા	૧/૪ ઉધાર વેચાણા	૫% વેચાણા પરત	ચોખું વેચાણા
ઓગાઝ	૩૦૦૦૦૦	૫૦૦૦૦	૨૪૦૦૦૦ - ૧૨૦૦૦	૨૨૮૦૦૦	૧૧૪૦૦૦ સાપેન્ટ્સ ૧૧૪૦૦૦ ઓક્ટોબર
સપ્ટેમ્બર	૪૦૦૦૦૦	૮૦૦૦૦	૩૨૦૦૦૦ - ૧૬૦૦૦	૩૦૪૦૦૦	૧૫૨૦૦૦ ઓક્ટોબર ૧૫૨૦૦૦ નવેમ્બર
ઓક્ટોબર	૪૫૦૦૦૦	૬૦૦૦૦	૩૬૦૦૦૦ - ૧૮૦૦૦	૩૪૨૦૦૦	૧૭૧૦૦૦ નવેમ્બર ૧૭૧૦૦૦ ડિસેમ્બર
નવેમ્બર	૫૦૦૦૦૦	૧૦૦૦૦૦	૪૦૦૦૦૦ - ૨૦૦૦૦	૩૮૦૦૦૦	૧૬૦૦૦૦ ડિસેમ્બર ૧૬૦૦૦૦ જાન્યુઆરી
ડિસેમ્બર	૫૦૦૦૦૦	૧૨૦૦૦૦	૪૮૦૦૦૦ - ૨૪૦૦૦	૪૫૬૦૦૦	૨૨૮૦૦૦ જાન્યુઆરી ૨૨૮૦૦૦ ફેબ્રુઆરી
			૧૧૪૦૦૦ + ૧૫૨૦૦૦ = ૨૬૬૦૦૦		
			૧૫૨૦૦૦ + ૧૭૧૦૦૦ = ૩૨૩૦૦૦		
			૧૭૧૦૦૦ + ૧૬૦૦૦૦ = ૩૫૧૦૦૦		

નોંધ: ૨ ખરીદી:

	૨૦% રોકડ	૮૦% ઉધાર	
ઓગાષ	૧૪૦૦૦૦	૨૮૦૦૦	૧૧૨૦૦૦ સપેન્બર
સપેન્બર	૨૦૦૦૦૦	૪૦૦૦૦	૧૧૬૦૦૦ ઓક્ટોબર
ઓક્ટોબર	૧૬૦૦૦૦	૩૨૦૦૦	૧૨૮૦૦૦ નવેમ્બર
નવેમ્બર	૨૪૦૦૦૦	૪૮૦૦૦	૧૬૨૦૦૦ ડિસેમ્બર
ડિસેમ્બર	૩૦૦૦૦૦	૬૦૦૦૦	૨૪૦૦૦૦ જાન્યુઆરી

નોંધ: ૩ મજૂરી:

ઓગાષ	૪૦૦૦૦	૨૦૦૦૦ ઓગાષ	
		૨૦૦૦૦ સપેન્બર	
સપેન્બર	૫૦૦૦૦	૨૫૦૦૦ સપેન્બર	
		૨૫૦૦૦ ઓક્ટોબર } ૫૫૦૦૦	
ઓક્ટોબર	૬૦૦૦૦	૩૦૦૦૦ ઓક્ટોબર } ૩૦૦૦૦ નવેમ્બર } ૬૫૦૦૦	
		૩૦૦૦૦ નવેમ્બર } ૩૪૦૦૦ નવેમ્બર } ૩૪૦૦૦ ડિસેમ્બર } ૭૪૦૦૦	
નવેમ્બર	૭૦૦૦૦	૩૪૦૦૦ ડિસેમ્બર } ૪૦૦૦૦ ડિસેમ્બર } ૪૦૦૦૦ જાન્યુઆરી	
ડિસેમ્બર	૮૦૦૦૦		

નોંધ: ૪ અન્ય ખર્ચો:

	ઘસારો	
ઓગાષ	૮૦૦૦૦ - ૫૦૦૦	૭૫૦૦૦ સપેન્બર
સપેન્બર	૧૧૦૦૦ - ૫૦૦૦	૬૦૦૦ ઓક્ટોબર
ઓક્ટોબર	૧૨૦૦૦ - ૫૦૦૦	૭૦૦૦ નવેમ્બર
નવેમ્બર	૧૩૦૦૦ - ૫૦૦૦	૮૦૦૦ ડિસેમ્બર
ડિસેમ્બર	૧૪૦૦૦ - ૫૦૦૦	૬૦૦૦ જાન્યુઆરી

નોંધ: ઘસારો બિનરોકડ ખર્ચ હોવાથી રોકડ અંદાજપત્ર માટે દ્યાનમાં લેવાશે નહીં.

પ્ર.: ૬ અક્ષય લિમિટેડની નીચેની માહિતી પરથી ૩૧-૦૩-૧૯૯૭ના રોજ પુરા થતા વર્ષનું ત્રિમાસિક રોકડ અંદાજપત્ર બનાવો.

મહિનો	કુલ વેચાણ (₹)	કુલ ખરીદી (₹)	મજૂરી (₹)	પરોક્ષ ખર્ચ (₹)
નવેમ્બર ૧૯૯૬	૨,૪૦,૦૦૦	૧,૪૪,૦૦૦	૫૭,૫૦૦	૫૬,૦૦૦
ડિસેમ્બર ૧૯૯૬	૨,૦૦,૦૦૦	૧,૨૮,૦૦૦	૫૪,૦૦૦	૫૨,૦૦૦
જાન્યુઆરી ૧૯૯૭	૩,૨૦,૦૦૦	૧,૫૦,૦૦૦	૭૦,૪૦૦	૬૦,૦૦૦
ફેબ્રુઆરી ૧૯૯૭	૪,૦૦,૦૦૦	૨,૦૮,૦૦૦	૬૭,૨૦૦	૬૪,૦૦૦
માર્ચ ૧૯૯૭	૩,૯૦,૦૦૦	૧,૭૬,૦૦૦	૭૬,૮૦૦	૭૨,૦૦૦

૧. ૦૧-૦૧-૧૯૯૭ના રોજની રોકડ સિલક ₹ ૧૬,૦૦૦/- છે.
૨. કુલ વેચાણનાં ૪૦% રોકડ અને ૫૦% ઉધાર વેચાણ છે.
૩. લેણાદારોને ૧ માસની મુદ્દત આપવામાં આવી છે.

૪. ૧૦% ખરીદીના પૈસા તરત જ ચૂકવાય છે.
૫. કુલ ચોખા વેચાણના ૫% કમિશન વેચાણ થયેલ માસથી એક માસ બાદ અપાય છે.
૬. ચોખા ઉધાર વેચાણના ૫૦% વેચાણના એક માસ બાદ મળે છે, જ્યારે બાકીના ૫૦% બીજા માસે મળે છે.
૭. પરોક્ષ ખર્ચમાં દરેક માસે ₹ ૮,૦૦૦/- ઘસારાનો સમાવેશ થાય છે.
૮. સમયગાળો : મજૂરી - $\frac{1}{4}$ માસ
પરોક્ષ ખર્ચ - ૧ માસ
૯. ફેબ્રુઆરી ૧૯૯૭માં કંપની રૂ ૧,૦૦,૦૦૦/-ના કિંમતનું ચંત્ર હસે ખરીદશે. રૂ ૨૪,૦૦૦/- કરાર વખતે ચૂકવાશે. બાકીની રકમ ચાર સરખા હમામાં ચૂકવાશે.
૧૦. માર્ચ ૧૯૯૭માં રૂ ૮,૦૦૦/- ડિલેન્ચર પર વ્યાજ ચૂકવાશે અને રૂ ૧૨,૮૦૦/- ડિવિડના મળશે.
૧૧. ટપાલ ખર્ચના રૂ ૨૦૦/- અને રૂ ૪૦૦/- દુકાનનું ભાડું દર મહિને ચૂકવવાનું છે.

(સ. પ. ચુનિ. એપ્રિલ ૧૯૯૮ પર આધારિત)

અક્ષય લિમિટેડનું તારીખ: ૩૧-૦૩-૧૯૯૭ના રોજ પૂરા થતા વર્ષનું ત્રિમાસિક રોકડ અંદાજપત્ર

	વિગત	જાન્યુઆરી	ફેબ્રુઆરી	માર્ચ
ઉમેરો:	શરૂઆતની રોકડ અને બેંક સિલક રોકડ આવકો:	૧૬૦૦૦	૨૧૪૦૦	૧૨૦૦૦
	રોકડ વેચાણ (નોંધ ૧)	૧૨૮૦૦૦	૧૬૦૦૦૦	૧૪૪૦૦૦
	ઉધાર વેચાણ (નોંધ ૧)	૧૩૨૦૦૦	૧૫૬૦૦૦	૨૧૬૦૦૦
	મળેલ ડિવિડન	---	---	૧૨૮૦૦
	(અ) કુલ આવકો	૨૭૬૦૦૦	૩૩૭૪૦૦	૩૮૪૮૦૦
બાદ:	રોકડ ચૂકવણી:			
	રોકડ ખરીદી (નોંધ ૨)	૧૬૦૦૦	૨૦૮૦૦	૧૭૬૦
	ઉધાર ખરીદી (નોંધ ૨)	૧૧૫૨૦૦	૧૪૪૦૦૦	૧૮૭૨૦૦
	વેચાણ પર કમિશન (નોંધ ૩)	૧૦૦૦૦	૧૬૦૦૦	૨૦૦૦૦
	પરોક્ષ ખર્ચ (નોંધ ૪)	૪૪૦૦૦	૫૨૦૦૦	૫૬૦૦૦
	મજૂરી (નોંધ ૫)	૬૮૮૦૦	૬૮૦૦૦	૭૪૪૦૦
	ચંત્રની ખરીદી	---	૨૪૦૦૦	---
	ડિલેન્ચર પર વ્યાજ	---	---	૮૦૦૦
	ટપાલ ખર્ચ	૨૦૦	૨૦૦	૨૦૦
	દુકાન ભાડું	૪૦૦	૪૦૦	૪૦૦
	(બ) કુલ ચૂકવણી	૨૫૪૫૦૦	૩૨૫૪૦૦	૩૬૩૮૦
	ઇવટની રોકડ સિલક (અ - બ)	૨૧૪૦૦	૧૨૦૦૦	૨૧૦૦૦

નોંધ: ૧ વેચાણ:

	૪૦% રોકડ	૬૦% ઉધાર					
નવેમ્બર	૨૪૦૦૦૦	૮૯૦૦૦	૧૪૪૦૦૦	૭૨૦૦૦	કિસેન્બર		
કિસેન્બર	૨૦૦૦૦૦	૮૦૦૦૦	૧૨૦૦૦૦	૭૨૦૦૦	જાન્યુઆરી		૧૩૨૦૦૦
જાન્યુઆરી	૩૨૦૦૦૦	૧૨૮૦૦૦	૧૬૨૦૦૦	૫૦૦૦૦	જાન્યુઆરી		૧૫૬૦૦૦
ફેબ્રુઆરી	૪૦૦૦૦૦	૧૬૦૦૦૦	૨૪૦૦૦૦	૫૦૦૦૦	ફેબ્રુઆરી		૨૧૬૦૦૦
માર્ચ	૩૬૦૦૦૦	૧૪૪૦૦૦	૨૧૬૦૦૦	૧૨૦૦૦૦	માર્ચ		
				૧૨૦૦૦૦	માર્ચ		
				૧૨૦૦૦૦	એપ્રિલ		
				૧૦૮૦૦૦	એપ્રિલ		
				૧૦૮૦૦૦	મે		

નોંધ: ૨ ખરીદી:

	૧૦% રોકડ	૬૦%		
		ઉધાર		
નવેમ્બર	૧૪૪૦૦૦	૧૪૪૦૦	૧૨૬૬૦૦	કિસેન્બર
કિસેન્બર	૧૨૮૦૦૦	૧૨૮૦૦	૧૧૫૨૦૦	જાન્યુઆરી
જાન્યુઆરી	૧૬૦૦૦૦	૧૬૦૦૦	૧૪૪૦૦૦	ફેબ્રુઆરી
ફેબ્રુઆરી	૨૦૮૦૦	૨૦૮૦૦	૧૮૭૨૦૦	માર્ચ
માર્ચ	૧૭૬૦૦૦	૧૭૬૦૦૦	૧૫૮૪૦૦	એપ્રિલ

નોંધ: ૩ વેચાણ પર કમિશન:

	કુલ વેચાણ	૫% કમિશન		
નવેમ્બર	૨૪૦૦૦૦	૧૨૦૦૦	કિસેન્બર	
કિસેન્બર	૨૦૦૦૦૦	૧૦૦૦૦	જાન્યુઆરી	
જાન્યુઆરી	૩૨૦૦૦૦	૧૬૦૦૦	ફેબ્રુઆરી	
ફેબ્રુઆરી	૪૦૦૦૦૦	૨૦૦૦૦	માર્ચ	
માર્ચ	૩૬૦૦૦૦	૧૮૦૦૦	એપ્રિલ	

નોંધ: ૪ પરોક્ષ ખર્ચ:

	ઘસારો			
નવેમ્બર	૫૮૦૦૦	- ૮૦૦૦	= ૪૮૦૦૦	કિસેન્બર
કિસેન્બર	૫૨૦૦૦	- ૮૦૦૦	= ૪૪૦૦૦	જાન્યુઆરી
જાન્યુઆરી	૫૦૦૦૦	- ૮૦૦૦	= ૪૨૦૦૦	ફેબ્રુઆરી
ફેબ્રુઆરી	૫૪૦૦૦	- ૮૦૦૦	= ૪૬૦૦૦	માર્ચ
માર્ચ	૭૨૦૦૦	- ૮૦૦૦	= ૬૪૦૦૦	એપ્રિલ

નોંધ: ૫ મજૂરી:

નવેમ્બર	૫૭૬૦૦	$\frac{3}{4}$	૪૩૨૦૦	નવેમ્બર
કિસેન્બર	૫૪૦૦૦	$\frac{3}{4}$	૧૪૪૦૦	કિસેન્બર
			૪૮૦૦૦	કિસેન્બર

જાન્યુઆરી	૭૦૪૦૦	$\frac{1}{4}$	૧૬૦૦૦ જાન્યુઆરી	૫૮૮૦૦
		$\frac{3}{4}$	૫૨૮૦૦ જાન્યુઆરી	
ફેબ્રુઆરી	૬૭૨૦૦	$\frac{1}{4}$	૧૭૬૦૦ ફેબ્રુઆરી	૫૮૦૦૦
		$\frac{3}{4}$	૫૦૪૦૦ ફેબ્રુઆરી	
માર્ચ	૭૬૮૦૦	$\frac{1}{4}$	૧૬૮૦૦ માર્ચ	૭૪૪૦૦
		$\frac{3}{4}$	૫૭૬૦૦ માર્ચ	
		$\frac{1}{4}$	૧૬૨૦૦ એપ્રિલ	

પ્ર.: ૭ નીચેની માહિતી પરથી તારીખ: ૩૦-૦૬-૧૯૯૮ના રોજ પુરા થતા વર્ષ માટે ત્રિમાસિક રોકડ અંદાજપત્ર બનાવો.

૧. તારીખ: ૧-૪-૧૯૯૮ના રોજની રોકડ સિલક ₹ ૨૦,૦૦૦/-.
- ૨.

માસ	કુલ વેચાણ (₹)	કુલ ખરીદી (₹)	મજૂરી (₹)	પરોક્ષ ખર્ચ (₹)
ફેબ્રુઆરી	૩,૦૦,૦૦૦	૧,૮૦,૦૦૦	૭૨,૦૦૦	૭૦,૦૦૦
માર્ચ	૨,૫૦,૦૦૦	૧,૬૦,૦૦૦	૮૦,૦૦૦	૬૫,૦૦૦
એપ્રિલ	૪,૦૦,૦૦૦	૧,૨૦,૦૦૦	૮૮,૦૦૦	૭૫,૦૦૦
મે	૨,૦૦,૦૦૦	૨,૬૦,૦૦૦	૮૪,૦૦૦	૮૦,૦૦૦
જૂન	૪,૫૦,૦૦૦	૨,૨૦,૦૦૦	૯૬,૦૦૦	૯૦,૦૦૦

૩. કુલ વેચાણનાં ૪૦% રોકડ અને ૫૦% ઉધાર વેચાણ છે.
૪. જો વેચાણની રકમ એક માસની અંદર મળશે તો ૫% રોકડ વટાવ આપવો.
૫. ઉધાર વેચાણનાં ૫૦% વેચાણ થયેલ માસનાં એક માસ બાદ મળશે અને બાકીના ૫૦% વેચાણનાં બીજા માસમાં મળશે.
૬. સપ્લાયર્સને ૧ માસની મુદ્દત આપવી.
૭. પરોક્ષ ખર્ચમાં પ્રતિમાસ ₹ ૧૦,૦૦૦/- ઘસારાના સમાચેલા છે.
૮. ચૂકવવાનો ગાળો : મજૂરી - $\frac{1}{4}$ માસ
પરોક્ષ ખર્ચ - ૧ માસ
૯. કંપની મે ૧૯૯૮માં ₹ ૧,૦૦,૦૦૦/-ની કિંમતનું એક ચંત્ર ખરીદશે, ₹ ૩૦,૦૦૦/- કરાર વખતે ચૂકવવાનાં છે બાકીની રકમ ચાર સરખા હસામાં ચૂકવવી.
૧૦. જૂન ૧૯૯૮માં ડિબેન્ચર પર વ્યાજ ₹ ૧૦,૦૦૦/- ચૂકવવાનું છે.

(સ. પ. ચુનિ. નવેમ્બર ૧૯૯૮ પર આધારિત)

એપ્રિલ ૧૯૯૮થી જૂન ૧૯૯૮નું રોકડ અંદાજપત્ર

ઉમેરો:	વિગત	એપ્રિલ	મે	જૂન
બાદ:	શરૂઆતની રોકડ અને બેંક સિલક રોકડ આપકો:	૨૦૦૦૦	૪૦૨૫૦	૪૮૨૫૦
	રોકડ વેચાણ (નોંધ ૧) ઉધાર વેચાણ (નોંધ ૧)	૧૬૦૦૦૦ ૧૬૧૨૫૦	૨૦૦૦૦૦ ૧૮૬૦૦૦	૧૮૦૦૦૦ ૨૬૨૫૦૦
	(અ) કુલ આવકો	૩૪૧૨૫૦	૪૨૮૨૫૦	૪૮૧૭૫૦
	રોકડ ચૂકવણી:			

	વિગત	એપ્રિલ	મે	જૂન
ખરીદી		૧૬૦૦૦૦	૨૦૦૦૦૦	૨૬૦૦૦૦
મજૂરી (નોંધ ૨)		૭૫૦૦૦	૮૪૦૦૦	૯૩૦૦૦
પરોક્ષ ખર્ચ (નોંધ ૩)		૫૫૦૦૦	૬૫૦૦૦	૭૦૦૦૦
ચંત્રાની ખરીદી		---	૩૦૦૦૦	---
ડિમેન્ચર પર વ્યાજ		---	---	૧૦૦૦૦
(બ) કુલ ચૂકવણી		૩૦૧૦૦૦	૩૮૦૦૦૦	૪૩૩૦૦૦
છેવટની રોકડ સિલક (અ - બ)		૪૦૨૫૦	૪૮૨૫૦	૫૮૭૫૦

નોંધ: ૧ વેચાણા:

	૪૦% રોકડ	૫૦% ઉધાર		૫% રોકડ વટાવ		
		વેચાણ	વેચાણ	એપ્રિલ	મે	જૂન
ફેલ્બુઆરી	૩૦૦૦૦૦	૧૨૦૦૦૦	૧૮૦૦૦૦	૬૦૦૦૦ - ૪૫૦૦	૮૫૫૦૦	૮૮૫૦૦ માર્ચ
માર્ચ	૨૫૦૦૦૦	૧૦૦૦૦૦	૧૪૦૦૦૦	૭૫૦૦૦ - ૩૭૫૦	૭૧૨૫૦	એપ્રિલ
એપ્રિલ	૪૦૦૦૦૦	૧૬૦૦૦૦	૨૪૦૦૦૦	૧૨૦૦૦૦ - ૫૦૦૦	૧૧૪૦૦૦	મે
મે	૫૦૦૦૦૦	૨૦૦૦૦૦	૩૦૦૦૦૦	૧૫૦૦૦૦ - ૭૫૦૦	૧૪૨૫૦૦	જૂન
જૂન	૪૫૦૦૦૦	૧૮૦૦૦૦	૨૭૦૦૦૦	૧૩૪૦૦૦ - ૫૭૫૦	૧૨૮૨૫૦	જુલાઈ
એપ્રિલ	૬૦૦૦૦ + ૭૧૨૫૦			= ૧૬૧૨૫૦		
મે	૭૫૦૦૦ + ૧૧૪૦૦૦			= ૧૮૬૦૦૦		
જૂન	૧૨૦૦૦૦ + ૧૪૨૫૦૦			= ૨૬૨૫૦૦		

નોંધ: ૨ મજૂરી:

ફેલ્બુઆરી	૭૨૦૦૦	$\frac{3}{4}$	૫૪૦૦૦ ફેલ્બુઆરી
		$\frac{1}{4}$	૧૮૦૦૦ માર્ચ
માર્ચ	૮૦૦૦૦	$\frac{3}{4}$	૬૦૦૦૦ માર્ચ
		$\frac{1}{4}$	૨૦૦૦૦ એપ્રિલ
એપ્રિલ	૮૮૦૦૦	$\frac{3}{4}$	૬૬૦૦૦ એપ્રિલ
		$\frac{1}{4}$	૨૨૦૦૦ મે
મે	૮૪૦૦૦	$\frac{3}{4}$	૬૩૦૦૦ મે
		$\frac{1}{4}$	૨૧૦૦૦ જૂન
જૂન	૬૬૦૦૦	$\frac{3}{4}$	૭૨૦૦૦ જૂન
		$\frac{1}{4}$	૨૪૦૦૦ જુલાઈ

નોંધ: ૩ પરોક્ષ ખર્ચ:

		ઘસારો	
ફેલ્બુઆરી	૭૦૦૦૦	- ૧૦૦૦૦ = ૬૦૦૦૦	માર્ચ
માર્ચ	૬૫૦૦૦	- ૧૦૦૦૦ = ૫૫૦૦૦	એપ્રિલ

એપ્રિલ	૭૫૦૦૦	- ૧૦૦૦૦	= ૬૫૦૦૦	મે
મે	૮૦૦૦૦	- ૧૦૦૦૦	= ૭૦૦૦૦	જૂન
જૂન	૯૦૦૦૦	- ૧૦૦૦૦	= ૮૦૦૦૦	જુલાઈ

પ્ર.: ચ નીચે આપેલ માહિતી પરથી તારીખ: ૦૧-૦૪-૧૯૯૭ના રોજ શરૂ થતા વર્ષ માટે ત્રિમાસિક રોકડ અંદાજપત્ર બનાવો.

માસ	કુલ વેચાણ (₹)	કુલ ખરીદી (₹)	ફેક્ટરી ખર્ચ (₹)	વેચાણ ખર્ચ (₹)
ફેબ્રુઆરી	૫,૦૦,૦૦૦	૩,૦૦,૦૦૦	૪૦,૦૦૦	૨૦,૦૦૦
માર્ચ	૫,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦	૪૪,૦૦૦	૩૦,૦૦૦
એપ્રિલ	૫,૦૦,૦૦૦	૪,૦૦,૦૦૦	૪૮,૦૦૦	૨૦,૦૦૦
મે	૬,૦૦,૦૦૦	૫,૦૦,૦૦૦	૫૨,૦૦૦	૩૦,૦૦૦
જૂન	૭,૦૦,૦૦૦	૪,૦૦,૦૦૦	૫૬,૦૦૦	૨૦,૦૦૦
જુલાઈ	૪,૦૦,૦૦૦	૩,૦૦,૦૦૦	૫૦,૦૦૦	૩૦,૦૦૦

૧. ૦૧-૦૪-૧૯૯૭ના રોજની રોકડ સિલક ₹ ૪૫,૦૦૦/- છે.
૨. કુલ વેચાણમાંથી રોકડ અને ઉધાર વેચાણનું પ્રમાણા ૨:૩ છે.
૩. કુલ ખરીદીમાંથી રોકડ અને ઉધાર ખરીદીનું પ્રમાણા ૧:૪ છે.
૪. ચોખખા ઉધાર વેચાણનાં ૧૦% એક માસ બાદ ચૂકવાય છે.
૫. વેચાણ ખર્ચમાં દર માસે ₹ ૧૦,૦૦૦/- ભાડાના સમાયેલા છે.
૬. એપ્રિલ ૧૯૯૭માં ₹ ૧,૦૦૦/-ની સિક્યુરીટી પર ૧૫% વ્યાજ મળવાપાત્ર છે. જેનો કરવેરાનો દર ૪૦% છે.
૭. જૂન ૧૯૯૭માં આવકવેરો ₹ ૧૦,૦૦૦/- ચૂકવવાનો છે.
૮. ફેક્ટરી ખર્ચના ૨૫% અને વેચાણ ખર્ચના ૫૦% પણીના મહિને ચૂકવાશે.
૯. ૫૦% દેવાદારોને ૧ માસ બાદ અને ૫૦% લેણાદારોને ૨ માસ બાદ ચૂકવણી કરવી.
૧૦. જૂન ૧૯૯૭માં ₹ ૩,૦૦,૦૦૦/-નું ચંત્ર ખરીદાશે.

(સ. પ. ચુનિ. એપ્રિલ ૧૯૯૭ પર આધારિત)

તારીખ: ૦૧-૦૪-૧૯૯૭ના રોજ શરૂ થતા વર્ષનું ત્રિમાસિક રોકડ અંદાજપત્ર

ઉમેરો:	વિગત	એપ્રિલ	મે	જૂન
	શરૂઆતની રોકડ અને બેંક સિલક રોકડ આવકો:	૪૫૦૦૦	૧૬૮૦૦૦	૩૪૨૦૦૦
બાદ:	રોકડ વેચાણ (નોંધ ૧)	૨૦૦૦૦૦	૨૪૦૦૦૦	૨૮૦૦૦૦
	ઉધાર વેચાણ (નોંધ ૧)	૩૩૦૦૦૦	૩૦૦૦૦૦	૩૩૦૦૦૦
(અ) કુલ આવકો	સિક્યુરીટી પર વ્યાજ (૧,૦૦,૦૦૦ × ૧૫%)	૧૪૦૦૦	---	---
	રોકડ ચૂકવણી:	૫૮૦૦૦૦	૭૦૮૦૦૦	૮૫૨૦૦૦
	રોકડ ખરીદી (નોંધ ૨)	૮૦૦૦૦	૧૦૦૦૦૦૦	૮૦૦૦૦
	ઉધાર ખરીદી (નોંધ ૨)	૨૪૦૦૦૦	૧૬૦૦૦૦૦	૩૨૦૦૦૦
	વેચાણ પર કમિશન (નોંધ ૩)	૩૦૦૦૦	૩૦૦૦૦	૩૬૦૦૦
	વેચાણ ખર્ચ (નોંધ ૪)	૧૫૦૦૦	૧૫૦૦૦	૧૫૦૦૦

	વિગત	એપ્રિલ	મે	જૂન
બાંકું		૧૦૦૦૦	૧૦૦૦૦	૧૦૦૦૦
ફેક્ટરી ખર્ચ (નોંધ ૫)		૪૭૦૦૦	૫૧૦૦૦	૫૫૦૦૦
આપક વેરો	---	---	---	૧૦૦૦૦
ચંત્રની ખરીદી	---	---	---	૩૦૦૦૦૦
(બ) કુલ ચૂકવણી		૪૨૨૦૦૦	૩૬૬૦૦૦	૮૨૬૦૦૦
છેવટની રોકડ સિલક (અ - બ)		૧૯૮૦૦૦	૩૪૨૦૦૦	૧૨૬૦૦૦

નોંધ: ૧ વેચાણા:

	૨/૪ રોકડ વેચાણ	૩/૪ ઉધાર વેચાણ		
ફેબ્રુઆરી	૫૦૦૦૦૦	૨૪૦૦૦૦	૩૯૦૦૦૦	૧૮૦૦૦૦ માર્ચ ૧૮૦૦૦૦ એપ્રિલ ૧૫૦૦૦૦ એપ્રિલ } ૧૫૦૦૦૦ મે } ૧૫૦૦૦૦ મે } ૧૨૦૦૦૦ જૂન } ૧૮૦૦૦૦ જૂન } ૧૮૦૦૦૦ જુલાઈ } ૨૧૦૦૦૦ જુલાઈ } ૨૧૦૦૦૦ ઓગાષ } ૧૨૦૦૦૦ ઓગાષ } ૧૨૦૦૦૦ સપ્ટેમ્બર }
માર્ચ	૪૦૦૦૦૦	૨૦૦૦૦૦	૩૦૦૦૦૦	૩૦૦૦૦૦
એપ્રિલ	૪૦૦૦૦૦	૨૦૦૦૦૦	૩૦૦૦૦૦	૩૩૦૦૦૦
મે	૫૦૦૦૦૦	૨૪૦૦૦૦	૩૯૦૦૦૦	
જૂન	૭૦૦૦૦૦	૨૮૦૦૦૦	૪૨૦૦૦૦	
જુલાઈ	૪૦૦૦૦૦	૧૬૦૦૦૦	૨૪૦૦૦૦	

નોંધ: ૨ ખરીદી:

	૧/૪ રોકડ	૩/૪ ઉધાર	
ફેબ્રુઆરી	૩૦૦૦૦૦	૫૦૦૦૦	૨૪૦૦૦૦ એપ્રિલ
માર્ચ	૨૦૦૦૦૦	૪૦૦૦૦	૧૬૦૦૦૦ મે
એપ્રિલ	૪૦૦૦૦૦	૮૦૦૦૦	૩૨૦૦૦૦ જૂન
મે	૫૦૦૦૦૦	૧૦૦૦૦૦	૪૦૦૦૦૦ જુલાઈ
જૂન	૪૦૦૦૦૦	૮૦૦૦૦	૩૨૦૦૦૦ ઓગાષ
જુલાઈ	૩૦૦૦૦૦	૫૦૦૦૦	૨૪૦૦૦૦ સપ્ટેમ્બર

નોંધ: ૩ વેચાણ પર કમિશન:

	ચોખું ઉધાર વેચાણ	૧૦% કમિશન	
ફેબ્રુઆરી	૩૬૦૦૦૦	૩૬૦૦૦	માર્ચ
માર્ચ	૩૦૦૦૦૦	૩૦૦૦૦	એપ્રિલ
એપ્રિલ	૩૦૦૦૦૦	૩૦૦૦૦	મે
મે	૩૬૦૦૦૦	૩૬૦૦૦	જૂન
જૂન	૪૨૦૦૦૦	૪૨૦૦૦	જુલાઈ
જુલાઈ	૨૪૦૦૦૦	૨૪૦૦૦	ઓગાષ

નોંધ: ૪ વેચાણ ખર્ચ:

ભાડું					
ફેલુઆરી	૨૦૦૦૦	- ૧૦૦૦૦	= ૧૦૦૦૦	૫૦૦૦ ફેલુઆરી ૫૦૦૦ માર્ચ	
માર્ચ	૩૦૦૦૦	- ૧૦૦૦૦	= ૨૦૦૦૦	૧૦૦૦૦ માર્ચ ૧૦૦૦૦ એપ્રિલ	૧૪૦૦૦
એપ્રિલ	૨૦૦૦૦	- ૧૦૦૦૦	= ૧૦૦૦૦	૫૦૦૦ એપ્રિલ ૫૦૦૦ મે	૧૪૦૦૦
મે	૩૦૦૦૦	- ૧૦૦૦૦	= ૨૦૦૦૦	૧૦૦૦૦ મે ૧૦૦૦૦ જૂન	૧૪૦૦૦
જૂન	૨૦૦૦૦	- ૧૦૦૦૦	= ૧૦૦૦૦	૫૦૦૦ જૂન ૫૦૦૦ જુલાઈ	૧૪૦૦૦
જુલાઈ	૩૦૦૦૦	- ૧૦૦૦૦	= ૨૦૦૦૦	૧૦૦૦૦ જુલાઈ ૧૦૦૦૦ ઓગષ્ટ	

નોંધ: ૫ ફેક્ટરી ખર્ચ:

ફેલુઆરી	૪૦૦૦૦	૭૫% ૨૫%	૩૦૦૦૦ ફેલુઆરી ૧૦૦૦૦ માર્ચ	
માર્ચ	૪૪૦૦૦	૭૫% ૨૫%	૩૩૦૦૦ માર્ચ ૧૧૦૦૦ એપ્રિલ	૪૭૦૦૦
એપ્રિલ	૪૮૦૦૦	૭૫% ૨૫%	૩૬૦૦૦ એપ્રિલ ૧૨૦૦૦ મે	૫૧૦૦૦
મે	૫૨૦૦૦	૭૫% ૨૫%	૩૯૦૦૦ મે ૧૩૦૦૦ જૂન	૫૫૦૦૦
જૂન	૫૬૦૦૦	૭૫% ૨૫%	૪૨૦૦૦ જૂન ૧૪૦૦૦ જુલાઈ	
જુલાઈ	૬૦૦૦૦	૭૫% ૨૫%	૪૫૦૦૦ જુલાઈ ૧૫૦૦૦ ઓગષ્ટ	

પ્ર.: એ વિવેક લિમિટેડની નીચે આપેલી માહિતી પરથી ૩૦-૦૬-૧૯૯૫ના રોજ પુરા થતા વર્ષ માટે ત્રિમાસિક રોકડ અંદાજપત્ર તૈયાર કરો.

૧. તારીખ: ૩૦-૦૬-૧૯૯૫ના રોજની શરૂઆતની રોકડ સિલક રૂ ૧,૨૦,૦૦૦/- છે.

૨.

માસ	કુલ વેચાણ (₹)	કુલ ખરીદી (₹)	મજૂરી (₹)	પરોક્ષ ખર્ચ (₹)
ફેલુઆરી	૩,૦૦,૦૦૦	૧,૪૦,૦૦૦	૩૦,૦૦૦	૮૦,૦૦૦
માર્ચ	૪,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦	૪૦,૦૦૦	૧,૦૦,૦૦૦
એપ્રિલ	૪,૪૦,૦૦૦	૨,૪૦,૦૦૦	૪૦,૪૦૦	૧,૨૦,૦૦૦
મે	૫,૦૦,૦૦૦	૩,૦૦,૦૦૦	૫૦,૦૦૦	૧,૪૦,૦૦૦
જૂન	૫,૬૦,૦૦૦	૩,૪૦,૦૦૦	૭૦,૦૦૦	૧,૫૦,૦૦૦

૩. રોકડ અને ઉધાર વેચાણનું પ્રમાણ ૧:૪ છે.

૪. રોકડ અને ઉધાર ખરીદીનું પ્રમાણ ૨:૩ છે.

૫. ઉધાર વેચેલ માત્ર દર માસે ૫% પરત આવે છે.

૬. ચોખ્ખા ઉધાર વેચાણનાં ૫૦% આવતા માસે અને બાકીના ૫૦% બીજા માસે મળશે.

૭. વેપારીઓને ૧ માસની મુદ્દત આપવી અને ચૂકવણી વખતે ૧૦% રોકડ વટાવ આપવો.
૮. કુલ વેચાણ પર ૨% કમિશન ખરેખર વેચાણના પછીના મહિને અપાશે.
૯. પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતો પરનો ધસારો ₹ ૧૦,૦૦૦/- માસિક અને માસિક ભાડું ₹ ૨૦,૦૦૦/- સમાચેતું છે. દર માસે ભાડું ચૂકવાથ છે અને તેના પછીના મહિને બાકીની રકમ ચૂકવાય છે.
૧૦. મજૂરી માટેનો મુદ્દત ગાળો $\frac{1}{4}$ છે અને પરોક્ષ ખર્ચનો $\frac{1}{2}$ છે.
૧૧. જૂન ૧૯૯૫માં ₹ ૧૫,૦૦૦/- આવકવેરાનાં ચૂકવવા.
૧૨. એપ્રિલ ૧૯૯૫માં ₹ ૨,૦૦૦/-ની સરકારી સિક્યુરીટી પર ૧૫% અર્ધવાર્ષિક વ્યાજ મળશે.

(સ. પ. ચુનિ. નવેમ્બર ૧૯૯૫ પર આધારિત)

એપ્રિલ ૧૯૯૫ થી જૂન ૧૯૯૫ સુધીનું તિમાસિક રોકડ અંદાજપત્ર

	વિગત	એપ્રિલ	મે	જૂન
ઉમેરો:	શરૂઆતની રોકડ અને બેંક સિલક રોકડ આવકો:	૧૨૦૦૦૦	૧૨૭૮૨૦	૧૦૬૯૮૦
	રોકડ વેચાણ (નોંધ ૧) ઉધાર વેચાણ (નોંધ ૧) સરકારી સિક્યુરીટી પર વ્યાજ (૨૨,૦૦,૦૦૦×૧૫%× $\frac{5}{12}$)	૮૦૦૦૦ ૨૬૬૦૦૦ ૧૫૦૦૦	૧૦૦૦૦૦ ૩૨૩૦૦૦ ---	૧૨૦૦૦૦ ૩૫૧૦૦૦ ---
	(અ) કુલ આવકો	૪૮૧૦૦	૫૫૦૮૫૦	૫૮૦૯૮૦
બાદ:	રોકડ ચૂકવણી:			
	રોકડ ખરીદી (નોંધ ૨) ઉધાર ખરીદી (નોંધ ૨) વેચાણ પર કમિશન (નોંધ ૩) ભાડું (નોંધ ૪) પરોક્ષ ખર્ચ (નોંધ ૪) મજૂરી (નોંધ ૫) આવક વેરો	૧૦૦૦૦૦ ૧૦૮૦૦૦ ૭૬૮૦ ૨૦૦૦૦ ૮૦૦૦૦ ૪૭૫૦૦ ---	૧૨૦૦૦૦ ૧૩૪૦૦૦ ૮૬૪૦ ૨૦૦૦૦ ૧૦૦૦૦૦ ૫૭૫૦૦ ---	૧૪૦૦૦૦ ૧૬૨૦૦૦ ૮૬૦૦ ૨૦૦૦૦ ૧૨૦૦૦૦ ૬૭૫૦૦ ૧૫૦૦૦
	(બ) કુલ ચૂકવણી	૩૬૩૧૮૦	૪૪૧૧૪૦	૫૩૪૧૦૦
	છેવટની રોકડ સિલક (અ - બ)	૧૨૭૮૨૦	૧૦૬૯૮૦	૫૮૦૯૮૦

નોંધ: ૧ વેચાણ:

	$\frac{1}{4}$ રોકડ	$\frac{1}{4}$ ઉધાર	૫% વેચાણ		
	વેચાણ	વેચાણ	પરત		
ફેબ્રુઆરી	૩૦૦૦૦૦	૬૦૦૦૦	૨૪૦૦૦૦ - ૧૨૦૦૦	૨૨૮૦૦૦	૧૧૪૦૦૦ માર્ચ
					૧૧૪૦૦૦ એપ્રિલ
માર્ચ	૪૦૦૦૦૦	૮૦૦૦૦	૩૨૦૦૦૦ - ૧૬૦૦૦	૩૦૪૦૦૦	૧૫૨૦૦૦ એપ્રિલ
					૧૫૨૦૦૦ મે
એપ્રિલ	૪૫૦૦૦૦	૯૦૦૦૦	૩૬૦૦૦૦ - ૧૮૦૦૦	૩૪૨૦૦૦	૧૭૧૦૦૦ મે
					૧૭૧૦૦૦ જૂન

મે	૫૦૦૦૦૦	૧૦૦૦૦૦	૪૦૦૦૦૦	- ૨૦૦૦૦	૩૮૦૦૦૦	૧૬૦૦૦૦ જૂન ૧૬૦૦૦૦ જુલાઈ ૨૨૮૦૦૦ જુલાઈ ૨૨૮૦૦૦ ઓગષ્ટ
જૂન	૬૦૦૦૦૦	૧૨૦૦૦૦	૪૮૦૦૦૦	- ૨૪૦૦૦	૪૫૬૦૦૦	
અપ્રિલ	૧૧૪૦૦૦ + ૧૫૨૦૦૦		=	૨૬૬૦૦૦		
મે	૧૫૨૦૦૦ + ૧૭૧૦૦૦		=	૩૨૩૦૦૦		
જૂન	૧૭૧૦૦૦ + ૧૬૦૦૦૦		=	૩૬૧૦૦૦		

નોંધ: ૨ ખરીદી:

		૨/૫ રોકડ ખરીદી	૩/૫ ઉધાર ખરીદી	૧૦% વટાવ		
ફેલુઆરી	૧૫૦૦૦૦	૫૦૦૦૦	૬૦૦૦૦	- ૬૦૦૦	૮૯૦૦૦	માર્ચ
માર્ચ	૨૦૦૦૦૦	૮૦૦૦૦	૧૨૦૦૦૦	- ૧૨૦૦૦	૧૦૮૦૦૦	અપ્રિલ
અપ્રિલ	૨૫૦૦૦૦	૧૦૦૦૦૦	૧૫૦૦૦૦	- ૧૫૦૦૦	૧૩૫૦૦૦	મે
મે	૩૦૦૦૦૦	૧૨૦૦૦૦	૧૮૦૦૦૦	- ૧૮૦૦૦	૧૬૨૦૦૦	જૂન
જૂન	૩૫૦૦૦૦	૧૪૦૦૦૦	૨૧૦૦૦૦	- ૨૧૦૦૦	૧૮૯૦૦૦	જુલાઈ

નોંધ: ૩ વેચાણ પર કમિશન:

	રોકડ વેચાણ	ઉધાર વેચાણ	કુલ વેચાણ	૨% કમિશન	
ફેલુઆરી	૫૦૦૦૦	૨૨૮૦૦૦	૨૮૮૦૦૦	૫૭૬૦	માર્ચ
માર્ચ	૮૦૦૦૦	૩૦૪૦૦૦	૩૮૪૦૦૦	૭૬૮૦	અપ્રિલ
અપ્રિલ	૯૦૦૦૦	૩૪૨૦૦૦	૪૩૨૦૦૦	૮૬૪૦	મે
મે	૧૦૦૦૦૦	૩૮૦૦૦૦	૪૮૦૦૦૦	૯૬૦૦	જૂન
જૂન	૧૨૦૦૦૦	૪૫૬૦૦૦	૫૭૬૦૦૦	૧૧૫૨૦	જુલાઈ

નોંધ: ૪ પરોક્ષ ખર્ચ:

	ઘસારો	ભાડું	ચોખો	
			પરોક્ષ ખર્ચ	
ફેલુઆરી	૮૦૦૦૦	- ૧૦૦૦૦	- ૨૦૦૦૦	૫૦૦૦૦ ૫ેલુઆરી
માર્ચ	૧૦૦૦૦૦	- ૧૦૦૦૦	- ૨૦૦૦૦	૭૦૦૦૦ ૨૫૦૦૦ માર્ચ
અપ્રિલ	૧૨૦૦૦૦	- ૧૦૦૦૦	- ૨૦૦૦૦	૯૦૦૦૦ ૩૪૦૦૦ માર્ચ ૩૪૦૦૦ અપ્રિલ } ૮૦૦૦૦
મે	૧૪૦૦૦૦	- ૧૦૦૦૦	- ૨૦૦૦૦	૧૧૦૦૦૦ ૪૪૦૦૦ માર્ચ ૪૪૦૦૦ અપ્રિલ } ૧૦૦૦૦૦
જૂન	૧૬૦૦૦૦	- ૧૦૦૦૦	- ૨૦૦૦૦	૧૩૦૦૦૦ ૪૪૦૦૦ મે ૪૪૦૦૦ જૂન } ૧૨૦૦૦૦

નોંધ: ૫ ભજૂરી:

ફેબ્રુઆરી	30000	$\frac{3}{4}$	22500 ફેબ્રુઆરી	
		$\frac{1}{4}$	7500 માર્ચ	
માર્ચ	40000	$\frac{3}{4}$	30000 માર્ચ	
		$\frac{1}{4}$	10000 એપ્રિલ	$\} 47500$
એપ્રિલ	50000	$\frac{3}{4}$	37500 એપ્રિલ	
		$\frac{1}{4}$	12500 મે	57500
મે	60000	$\frac{3}{4}$	45000 મે	
		$\frac{1}{4}$	15000 જૂન	57500
જૂન	70000	$\frac{3}{4}$	52500 જૂન	
		$\frac{1}{4}$	17500 જુલાઈ	

સ્વાધ્યાય

૧. પી. પી. લિમિટેડની નીચે આપેલી માહિતી પરથી ૦૧-૦૪-૧૯૯૪ના રોજ શરૂ થતા વર્ષનું ત્રિમાસિક રોકડ અંદાજપત્ર બનાવો.
૧. ૦૧-૦૪-૧૯૯૪ના રોજની રોકડ સિલક ₹ ૧,૬૫,૦૦૦/- છે.

	જાન્યુઆરી	ફેબ્રુઆરી	માર્ચ	એપ્રિલ	મે	જૂન
વેચાણા	1,23,000	1,32,750	1,26,000	1,36,400	1,08,000	1,23,700
વેચાણા ખર્ચ	7,500	8,875	5,150	5,505	8,815	5,800
ખરીદી	50,000	45,400	50,000	48,460	46,840	42,000
મજૂરી	15,000	20,000	12,500	13,200	6,000	14,800
ફેક્ટરી ખર્ચ	12,500	8,520	8,880	8,960	8,820	6,000
ઓફિસ ખર્ચ	5,100	3,750	5,680	3,720	3,600	3,560
રિસર્વ ખર્ચ	3,000	3,500	3,500	3,500	3,600	3,600

૨. સમયગાળો (lag):

- | | |
|-------------------------------|----------------------|
| મજૂરી - $\frac{1}{4}$ માસ | ફેક્ટરી ખર્ચ - ૧ માસ |
| ઓફિસ ખર્ચ - $\frac{1}{2}$ માસ | વેચાણા ખર્ચ - ૧ માસ |
| રિસર્વ ખર્ચ - ૧ માસ | ઉધાર ખરીદી - ૩ માસ |
| ઉધાર વેચાણા - ૨ માસ | |

૩. અપક્ષિત ખર્ચ:

- (અ) એપ્રિલ ૧૯૯૪માં કંપની ₹ ૧,૫૦,૦૦૦/-નું ચંત્ર ખરીદશે, જેની ચૂકવણી કરાર વખતે જ થશે.
- (બ) એપ્રિલ માસમાં ₹ ૧૨,૦૦,૦૦૦/-નું મકાન ખરીદશે, જેની ચૂકવણી ચાર સરખા હસામાં થશે. પ્રથમ હસો મે ૧૯૯૪માં ચૂકવશે.

૪. જૂન ૧૯૯૪માં રોકાણો પર ડિવિડન્ડ ₹ ૨૫,૦૦૦/- મળશે.

૫. જૂન ૧૯૯૪માં ₹ 30,000/- આવકવેરો ચૂકવશે.

૬. દર માસે રોકડ વેચાણ રૂ ૨૦,૦૦૦- થશે.

૭. કંપનીની બહાર પાડેલી મૂડી રૂ ૫,૦૦,૦૦૦/- છે. જે રૂ ૧૦/-નો એક એવા ૫૦,૦૦૦ શેરની બજેલી છે. જેમાંથી મે ૧૯૯૪માં શેરદીઠ રૂ ૩/- મળ્યો.

(સ. પ. ચુનિ. એપ્રિલ ૧૯૯૪ પર આધારિત)

(જવાબ: છેવટની રોકડ સિલક : એપ્રિલર ૫૧,૩૮૦/-, મે રૂ ૫૬,૨૩૫/-, જૂન રૂ ૧૬,૧૧૦/-;

રોકડ આવકો : એપ્રિલ રૂ ૨,૬૭,૭૫૦/-, મે રૂ ૩,૨૭,૩૮૦/-, જૂન રૂ ૧,૦૫,૫૨૫/-;

રોકડ ચૂકવણી : એપ્રિલ રૂ ૨,૪૯,૩૫૦/-, મે રૂ ૩,૮૯,૫૨૫/-, જૂન રૂ ૧,૨૪,૩૭૫/-)

૨. ૩૦-૦૬-૧૯૯૪ના રોજ પૂરા થતા વર્ષ માટે ત્રિમાસિક રોકડ અંદાજપત્ર બનાવો.

૧. ૦૧-૦૪-૧૯૯૪ના રોજની રોકડ સિલક રૂ ૨૦,૦૦૦/- છે.

માસ	કુલ વેચાણ (રૂ)	કુલ ખરીદી (રૂ)	મજૂરી (રૂ)	પરોક્ષ ખર્ચ (રૂ)
ફેબ્રુઆરી	૩,૦૦,૦૦૦	૧,૮૦,૦૦૦	૭૨,૦૦૦	૭૦,૦૦૦
માર્ચ	૨,૫૦,૦૦૦	૧,૫૦,૦૦૦	૮૦,૦૦૦	૬૫,૦૦૦
એપ્રિલ	૪,૦૦,૦૦૦	૨,૦૦,૦૦૦	૮૮,૦૦૦	૭૫,૦૦૦
મે	૫,૦૦,૦૦૦	૨,૫૦,૦૦૦	૮૪,૦૦૦	૮૦,૦૦૦
જૂન	૪,૫૦,૦૦૦	૨,૨૦,૦૦૦	૬૬,૦૦૦	૬૦,૦૦૦

૨. વેચાણના ૪૦% રોકડ અને ૫૦% ઉધાર છે.

૩. જો વેચાણના લેણાં એ જ માસમાં મળે તો ૫% રોકડ વટાવ આપવો.

૪. ઉધાર વેચાણનાં ૫૦% રકમ આવતા માસે મળશે અને બાકીના ૫૦% બીજે માસે મળશે.

૫. સપ્લાયર્સને ૧ માસની મુદ્દ્ધત આપવી.

૬. પરોક્ષ ખર્ચમાં માસિક રૂ ૧૦,૦૦૦/- ઘસારો સમાયેલ છે.

૭. મજૂરીનો સમયગાળો ૧/૪ અને પરોક્ષ ખર્ચનો સમયગાળો ૧ માસ છે.

૮. મે ૧૯૯૪માં કંપની રૂ ૩૦,૦૦૦/-નું એક યંત્ર ખરીદશે, જેમાંથી રૂ ૩૦,૦૦૦/- કરાર વખતે ચૂકવશે અને બાકીની રકમ ચાર સરખા હસામાં ચૂકવશે.

૯. જૂન ૧૯૯૪માં રૂ ૧૦,૦૦૦/- ડિલેન્ચ્યતર પર વ્યાજ ચૂકવવું.

(સ. પ. ચુનિ. ઓક્ટોબર ૧૯૯૪ પર આધારિત)

(જવાબ: છેવટની રોકડ સિલક : એપ્રિલ રૂ ૪૦,૨૫૦/-, મે રૂ ૪૬,૨૫૦/-, જૂન રૂ ૫૮,૭૫૦/-;

રોકડ આવક : એપ્રિલ રૂ ૩,૪૧,૨૫૦/-, મે રૂ ૪,૨૬,૨૫૦/-, જૂન રૂ ૪,૩૩૩,૦૦૦/-;

રોકડ ચૂકવણી : એપ્રિલ રૂ ૩,૦૧,૦૦૦/-, મે રૂ ૩,૮૦,૦૦૦/-, જૂન રૂ ૪,૩૩,૦૦૦/-)

૩. અ કંપનીની નીચેની માહિતી પરથી એપ્રિલ થી જૂન ૨૦૦૯ માસનું રોકડ અંદાજપત્ર બનાવો.

	વેચાણ (રૂ)	ખરીદી (રૂ)	મજૂરી (રૂ)	ઉત્પાદન ખર્ચ (રૂ)	ગોક્ષિસ ખર્ચ (રૂ)	વેચાણ ખર્ચ (રૂ)
ફેબ્રુઆરી	૧,૮૦,૦૦૦	૧,૨૪,૮૦૦	૧૨,૦૦૦	૩,૦૦૦	૨,૦૦૦	૨,૦૦૦
માર્ચ	૧,૬૨,૦૦૦	૧,૪૪,૦૦૦	૧૪,૦૦૦	૪,૦૦૦	૧,૦૦૦	૪,૦૦૦
એપ્રિલ	૧,૦૮,૦૦૦	૨,૪૩,૦૦૦	૧૧,૦૦૦	૩,૦૦૦	૧,૫૦૦	૨,૦૦૦
મે	૧,૭૪,૦૦૦	૨,૪૬,૦૦૦	૧૨,૦૦૦	૪,૫૦૦	૨,૦૦૦	૫,૦૦૦
જૂન	૧,૨૬,૦૦૦	૨,૫૮,૦૦૦	૧૫,૦૦૦	૫,૦૦૦	૨,૫૦૦	૪,૦૦૦
જુલાઈ	૧,૪૦,૦૦૦	૨,૮૦,૦૦૦	૧૭,૦૦૦	૫,૫૦૦	૩,૦૦૦	૪,૦૦૦

ઓગાષ	૧,૬૦,૦૦૦	૩,૦૦,૦૦૦	૧૮,૦૦૦	૬,૦૦૦	૩,૦૦૦	૫,૦૦૦
------	----------	----------	--------	-------	-------	-------

૧. ૦૧-૦૪-૨૦૦૯ના રોજ હાથ પર રોકડ સિલક ` ૨૫,૦૦૦/- છે.
૨. ઉધાર વેચાણના ૫૦% વેચાણ થયા પછીના મહિનામાં અને બાકીના ૫૦% પછીના બીજા મહિનામાં વસૂલ થાય છે.
૩. લેણદારોને ખરીદીના પછીના મહિનામાં ચૂકવાય છે.
૪. ઉત્પાદન ખર્ચનો ચૂકવવાનો ગાળો (lag) $\frac{1}{2}$ માસ છે.
૫. અન્ય ખર્ચ ચૂકવવાનો ગાળો (lag) ૧ માસ છે.

(સૌરાષ્ટ્ર ચુનિ. માર્ચ ૨૦૦૯)

(જવાબ: રોકડ આવક : એપ્રિલ રૂ ૨,૧૧,૦૦૦/-, મે રૂ ૧,૬૪,૪૦૦/-, જૂન રૂ ૭૪,૨૫૦/-;
રોકડ ચૂકવણી : એપ્રિલ રૂ ૧,૬૬,૫૦૦/-, મે રૂ ૨,૫૧,૨૫૦/-, જૂન રૂ ૨,૬૬,૭૫૦/-;
આખરની રોકડ સિલક : એપ્રિલ રૂ ૪૪,૪૦૦/-,
મે રૂ -૫૫,૭૫૦/-, જૂન રૂ -૧,૬૪,૪૦૦/-)

૪. નીચે આપેલ વિગતો પરથી ઓક્ટોબર થી ડિસેમ્બર ૨૦૦૪નું રોકડ અંદાજપત્ર તૈયાર કરો.

૧. રોકડ અને બેંક સિલક ૧-૧૦-૨૦૦૯ના રોજ રૂ ૧૦,૦૦૦/-.

૨.

માસ	વેચાણ (₹)	ખરીદી (₹)
જૂન	૩૦,૦૦૦	૧૮,૦૦૦
જુલાઈ	૩૨,૫૦૦	૨૦,૦૦૦
ઓગાષ	૩૫,૦૦૦	૨૪,૦૦૦
સપ્ટેમ્બર	૩૭,૫૦૦	૨૨,૫૦૦
ઓક્ટોબર	૪૦,૦૦૦	૨૪,૦૦૦
નવેમ્બર	૪૧,૦૦૦	૨૦,૦૦૦
ડિસેમ્બર	૪૪,૫૦૦	૨૫,૦૦૦

૩.

માસ	મજૂરી (₹)	પરોક્ષ ખર્ચ (₹)
ઓગાષ	૭,૫૦૦	૨,૫૦૦
સપ્ટેમ્બર	૭,૫૦૦	૩,૦૦૦
ઓક્ટોબર	૮,૦૦૦	૩,૦૦૦
નવેમ્બર	૮,૦૦૦	૪,૦૦૦
ડિસેમ્બર	૧૦,૦૦૦	૪,૦૦૦

૪. અગાઉથી ભરવાનો આવકયેરો રૂ ૨,૫૦૦/- નવેમ્બરમાં અને ચેતની ખરીદીના રૂ ૫,૦૦૦/- ઓક્ટોબરમાં ચૂકવ્યા.

૫. રૂ ૧,૫૦૦/- ભાડું અગાઉથી ચૂકવવાનું છે.

૬. ૧૦% ખરીદી અને વેચાણ રોકડેથી છે.

૭. સમયાગાળો: ઉધાર વેચાણ - ૨ માસ; મજૂરી - $\frac{1}{2}$ માસ
ઉધાર ખરીદી - ૧ માસ; અન્ય ખર્ચ - $\frac{1}{4}$ માસ

(શ. ગુજ. ચુનિ. માર્ચ ૨૦૦૫)

(જવાબ: રોકડ આવકો : ઓક્ટોબર ₹ ૪૫,૪૦૦/-,
નવેમ્બર ₹ ૪૪,૩૦૦/-, ડિસેમ્બર ₹ ૪૫,૭૫૦/-;
કુલ ચૂકવણી : ઓક્ટોબર ₹ ૩૬,૦૫૦/-,
નવેમ્બર ₹ ૩૬,૦૦૦/-, ડિસેમ્બર ₹ ૩૪,૧૫૦/-;
છેવટની રોકડ સિલફ : ઓક્ટોબર ₹ ૫,૪૫૦/-,
નવેમ્બર ₹ ૫,૩૦૦/-, ડિસેમ્બર ₹ ૧૧,૫૦૦/-)

૫. માર્ચ થી ઓગષ્ટ ૨૦૧૮ માટેની આવક અને ખર્ચ નીચે પ્રમાણે છે.

માસ	વેચાણ (ઉધાર) (₹)	ખરીદી (ઉધાર) (₹)	મજૂરી (₹)	ઉત્પાદન ખર્ચ (₹)	ઓફિસ ખર્ચ (₹)	વેચાણ ખર્ચ (₹)
માર્ચ	૬૦,૦૦૦	૩૫,૦૦૦	૯,૦૦૦	૪,૦૦૦	૨,૦૦૦	૪,૦૦૦
એપ્રિલ	૫૨,૦૦૦	૩૮,૦૦૦	૮,૦૦૦	૩,૦૦૦	૧,૫૦૦	૪,૦૦૦
મે	૬૪,૦૦૦	૩૩,૦૦૦	૧૦,૦૦૦	૪,૫૦૦	૨,૫૦૦	૪,૫૦૦
જૂન	૫૮,૦૦૦	૩૪,૦૦૦	૮,૫૦૦	૩,૪૦૦	૨,૦૦૦	૩,૪૦૦
જુલાઈ	૫૬,૦૦૦	૩૬,૦૦૦	૯,૦૦૦	૪,૦૦૦	૧,૦૦૦	૪,૫૦૦
ઓગષ્ટ	૬૦,૦૦૦	૩૪,૦૦૦	૮,૦૦૦	૩,૦૦૦	૧,૫૦૦	૪,૫૦૦

વધારાની માહિતી:

૧. ₹ ૧૬,૦૦૦/-ના અંત્રની ડિલિવરી જુલાઈમાં મળશે. જેના ૧૦% નાણાં તરત જ ચૂકવવા પડશે અને બાકીની રકમ ત્રણ માસ પછી ચૂકવાશે.
 ૨. ₹ ૮,૦૦૦/-નો આવકયેરો જૂનમાં ભરવાનો છે.
 ૩. માલના વેપારીઓ ર ૨ મહિનાની શાખ આપે છે, જ્યારે ગ્રાહકોને ૧ માસની શાખ આપીએ છીએ.
 ૪. ઉત્પાદન ખર્ચ $\frac{1}{2}$ માસ બાદ ચૂકવાશે.
 ૫. અન્ય ખર્ચની ચૂકવણી ૧ માસ બાદ થશે.
- તમારે ૦૧-૦૫-૨૦૧૮થી શરૂ થતાં ત્રણ માસ માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે, જ્યારે રોકડ સિલફ ₹ ૮,૦૦૦/- હશે.

(જવાબ: રોકડ સિલફ : મે ₹ ૧૫,૭૫૦/-, જૂન ₹ ૧૨,૭૫૦/-, જુલાઈ ₹ ૧૮,૪૦૦/-;
કુલ રોકડ આવકો : મે ₹ ૭૦,૦૦૦/-, જૂન ₹ ૭૬,૭૫૦/-, જુલાઈ ₹ ૭૦,૭૫૦/-;
કુલ રોકડ ચૂકવણી : મે ₹ ૫૪,૨૫૦/-, જૂન ₹ ૫૭,૦૦૦/-, જુલાઈ ₹ ૫૨,૩૫૦/-)

૬.૪.૨ પરિવર્તનશીલ અંદાજપત્ર:

આ અંદાજપત્રમાં નાણાંકીય વર્ષના કોઈપણ માસમાં પ્રવર્તમાન પરિસ્થિતિનાં સંદર્ભમાં ખર્ચ અને પડતરના અંકડામાં જરૂરી ફેરફાર કરી શકાય છે. ઉધોગ ધંધામાં ખર્ચ-પડતર અને વેચાણ અંગે ચોકસાઈપૂર્વક ધારણા કરવી શક્ય ન હોય તેવા ધંધામાં સ્થિર અંદાજપત્ર કરતા પરિવર્તનશીલ અંદાજપત્ર વધારે ઉપયોગી નીવડે છે.

પરિવર્તનશીલ અંદાજપત્રનાં દાખલા

પ્ર.: ૧ શાહ લિ. પોતાના ગ્રાહકો માટે ઉત્પાદન અને વેચાણ કરે છે. તેની માહિતી નીચે મુજબ છે.

વિગત	રકમ (₹)
<u>પ્રત્યક્ષ ખર્ચ:</u>	
માલસામાન	એકમદીઠ ₹ ૧૨/-
મજૂરી	એકમદીઠ ₹ ૬/-
ચલિત ખર્ચ	એકમદીઠ ₹ ૧૫/-
<u>અર્ધચલિત ખર્ચ:</u>	
પરોક્ષ માલસામાન	₹ ૩,૩૦૦/-
પરોક્ષ મજૂરી	₹ ૨,૪૮૦/-
શૈપેરનાં ખર્ચ	₹ ૬૦૦/-
<u>અર્ધચલિત ખર્ચભાં સમાચેલ ચલિત ખર્ચ (એકમદીઠ):</u>	
પરોક્ષ માલસામાન	એકમદીઠ ₹ ૦.૧૦
પરોક્ષ મજૂરી	એકમદીઠ ₹ ૦.૧૬
શૈપેરનાં ખર્ચ	એકમદીઠ ₹ ૦.૨૦
<u>સ્થિર ખર્ચ:</u>	
ફેક્ટરી ખર્ચ	₹ ૭૫,૦૦૦/-
વેચાણ-વિતરણ ખર્ચ	₹ ૫૦,૦૦૦/-
ઓફિસ ખર્ચ	₹ ૧૦,૦૦૦/-

ઉપરની પડતર ૫૦% સપાટીએ ૩,૦૦૦ એકમો ઉત્પાદિત કરવા માટેની છે. વેચાણ કિંમત એકમદીઠ ₹ ૨૫૦/- છે.

ઉપરની માહિતી પરથી ૮૦% અને ૧૦૦% સપાટીએ એકમદીઠ પડતર દર્શાવતું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો.

શાહ લિ.નું પરિવર્તનશીલ અંદાજપત્ર

વિગત	૫૦% સપાટીએ		૮૦% સપાટીએ		૧૦૦% સપાટીએ	
	એકમદીઠ (₹)	રકમ (₹)	એકમદીઠ (₹)	રકમ (₹)	એકમદીઠ (₹)	રકમ (₹)
<u>પ્રત્યક્ષ ખર્ચ:</u>						
માલસામાન	૧૨.૦૦	૩૬૦૦૦	૧૨.૦૦	૪૮૦૦૦	૧૨.૦૦	૫૦૦૦૦
મજૂરી	૬.૦૦	૧૮૦૦૦	૬.૦૦	૨૪૦૦૦	૬.૦૦	૩૦૦૦૦
ચલિત ખર્ચ	૧૫.૦૦	૪૫૦૦૦	૧૫.૦૦	૫૦૦૦૦	૧૫.૦૦	૭૫૦૦૦
<u>અર્ધચલિત ખર્ચ:</u>						
પરોક્ષ માલસામાન ચલિત	૦.૧૦	૩૦૦	૦.૧૦	૪૦૦	૦.૧૦	૫૦૦
સ્થિર	૧.૦૦	૩૦૦૦	૦.૭૫	૩૦૦૦	૦.૭૦	૩૦૦૦
પરોક્ષ મજૂરી ચલિત	૦.૧૬	૪૮૦	૦.૧૬	૬૪૦	૦.૧૬	૮૦૦
સ્થિર	૦.૫૭	૨૦૦૦	૦.૪૦	૨૦૦૦	૦.૪૦	૨૦૦૦
શૈપેરનાં ખર્ચ	૦.૨૦	૬૦૦	૦.૨૦	૮૦૦	૦.૨૦	૧૦૦૦

ચલિત						
સ્થિર	3.00	₹000	₹.24	₹000	₹.20	₹000
સ્થિર ખર્ચ:						
ફેક્ટરી ખર્ચ	24.00	74000	18.74	74000	14.00	74000
વેચાણ-વિતરણ ખર્ચ	20.00	50000	14.00	50000	12.00	50000
ઓફિસ ખર્ચ	30.00	₹0000	22.40	₹0000	18.00	₹0000
કુલ ખર્ચ	113.13	336320	63.21	372840	21.25	809300
+ નફો	145.87	440520	195.76	557150	178.74	863600
	250.00	720000	260.00	1080000	250.00	1300000

નોંધ:
 ૧) પ્રત્યક્ષ કે ચલિત ખર્ચ એકમદીઠ સરખા રહેશે.
 ૨) પરોક્ષ કે સ્થિર ખર્ચ કુલ રકમદીઠ સરખા રહેશે.

પ્ર.: ૨ અ લિ.ની માહિતી નીચે મુજબ છે.
 વેચાણ ₹ 2,00,000 એકમો, એકમદીઠ ₹ 14/-.

વિગત	રકમ (₹)
સ્થિર ખર્ચ:	
ફેક્ટરી ખર્ચ	₹ 1,20,000/-
વેચાણ-વિતરણ ખર્ચ	₹ 80,000/-
ઓફિસ ખર્ચ	₹ 1,50,000/-
ચલિત ખર્ચ:	
ફેક્ટરી ખર્ચ	એકમદીઠ ₹ 7/-
વેચાણ ખર્ચ	એકમદીઠ ₹ 2/-
વિતરણ ખર્ચ	એકમદીઠ ₹ 0.30
અર્ધચલિત ખર્ચ:	
ફેક્ટરી ખર્ચ (૮૦% ચલિત)	₹ 1,00,000/-
વેચાણ-વિતરણ ખર્ચ (૫૦% ચલિત)	₹ 1,40,000/-
અર્ધસ્થિર ખર્ચ:	
ફેક્ટરી ખર્ચ (૭૦% સ્થિર)	₹ 50,000/-
વેચાણ-વિતરણ ખર્ચ (૭૫% સ્થિર)	₹ 80,000/-

3,00,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ થાય છે.
 ઉપરની માહિતી પરથી ઉત્પાદન અને નફો દર્શાવતું પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવો.

અ લિ.નું પરિવર્તનશીલ અંદાજપત્ર

વિગત	૨,૦૦,૦૦૦ એકમો		૩,૦૦,૦૦૦ એકમો		
	એકમદીઠ (₹)	રકમ (₹)	એકમદીઠ (₹)	રકમ (₹)	
<u>સ્થિર ખર્ચ:</u>					
ફેક્ટરી ખર્ચ	૦.૬૦	૧૨૦૦૦૦	૦.૪૦	૧૨૦૦૦૦	
વેચાણ-વિતરણ ખર્ચ	૦.૪૦	૮૦૦૦૦	૦.૨૭	૮૦૦૦૦	
ઓફિસ ખર્ચ	૦.૮૦	૧૬૦૦૦૦	૦.૫૩	૧૬૦૦૦૦	
<u>ચલિત ખર્ચ:</u>					
ફેક્ટરી ખર્ચ	૭.૦૦	૧૪૦૦૦૦૦	૭.૦૦	૨૧૦૦૦૦૦	
વેચાણ ખર્ચ	૨.૦૦	૪૦૦૦૦૦	૨.૦૦	૬૦૦૦૦૦	
વિતરણ ખર્ચ	૦.૩૦	૬૦૦૦૦	૦.૩૦	૬૦૦૦૦	
<u>અર્ધચલિત ખર્ચ:</u>					
ફેક્ટરી ખર્ચ	ચલિત	૦.૪૦	૮૦૦૦૦	૦.૪૦	૧૨૦૦૦૦
	સ્થિર	૦.૧૦	૨૦૦૦૦	૦.૦૬૭	૨૦૦૦૦
વેચાણ-વિતરણ ખર્ચ	ચલિત	૦.૪૫	૯૦૦૦૦	૦.૪૫	૧૩૪૦૦૦
	સ્થિર	૦.૩૦	૬૦૦૦૦	૦.૨૦	૬૦૦૦૦
<u>અર્ધસ્થિર ખર્ચ:</u>					
ફેક્ટરી ખર્ચ	ચલિત	૦.૦૭૫	૧૫૦૦૦	૦.૦૭૫	૨૨૫૦૦
	સ્થિર	૦.૧૭૫	૩૪૦૦૦	૦.૧૧૭	૩૪૦૦૦
વેચાણ-વિતરણ ખર્ચ	ચલિત	૦.૦૫	૧૦૦૦૦	૦.૦૫	૧૫૦૦૦
	સ્થિર	૦.૧૫	૩૦૦૦૦	૦.૧૦	૩૦૦૦૦
+ નષો	કુલ ખર્ચ	૧૨.૮૦૦	૨૫૬૦૦૦૦	૧૧.૯૫૬	૩૫૮૭૫૦૦
	વેચાણ	૨.૨૦૦	૪૪૦૦૦૦	૩.૦૪૧	૯૧૨૫૦૦
		૧૫.૦૦૦	૩૦૦૦૦૦૦	૧૫.૦૦૦	૪૫૦૦૦૦૦

પ્ર.: ૩ ઉત્પાદન કંપની નીચેની માહિતી પૂરી પાડે છે.

વિગત	રકમ (₹ લાખમાં)
<u>સ્થિર ખર્ચ:</u>	
મજૂરી અને પગાર	૮.૫૦
ભાડું અને કરવેરા	૬.૬૦
ઘસારો	૭.૪૦
પરચૂરણ ખર્ચ	૬.૫૦
<u>અર્ધચલિત ખર્ચ: (૫૦% સપાટીએ)</u>	
રીપેર	૩.૫૦
પરોક્ષ મજૂરી	૭.૬૦
વેચાણ વિભાગનો પગાર	૩.૮૦
પરચૂરણ ખર્ચ	૨.૮૦
<u>ચલિત ખર્ચ: (૫૦% સપાટીએ)</u>	
માલ-સામાન	૨૧.૭૦

વિગત	રકમ (₹ લાખમાં)
મજૂરી	૨૦.૪૦
અન્ય ખર્ચ	૭.૬૦
કુલ	૮૮.૦૦

બધી સપાટીએ સ્થિર ખર્ચ એકસરખા રહે છે. અર્ધચલિત ખર્ચ ૪૫% થી ૬૫%ની સપાટીએ ઓકસરખા રહે છે. ૬૫% થી ૮૦% સપાટીમાં ૧૦%નો વધારો થાય છે અને ૮૧% થી ૧૦૦% સપાટીમાં ૨૦%નો વધારો થાય છે.

જુદી-જુદી સપાટીએ વેચાણ	રકમ (₹) લાખમાં
૫૦%	૧૦૦
૬૦%	૧૨૦
૭૫%	૧૪૦
૮૦%	૧૮૦
૧૦૦%	૨૦૦

ઉપરની માહિતીને આધારે ૫૦%, ૭૫%, ૮૦% અને ૧૦૦% સપાટીએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો.

ઉત્પાદન કંપનીનું પરિવર્તનશીલ અંદાજપત્ર

વિગત	૫૦% સપાટી	૬૦% સપાટી	૭૫% સપાટી	૮૦% સપાટી	૧૦૦% સપાટી
<u>સ્થિર ખર્ચ:</u>					
મજૂરી અને પગાર	૯.૫૦	૯.૫૦	૯.૫૦	૯.૫૦	૯.૫૦
ભાડું અને કરવેરા	૯.૯૦	૯.૯૦	૯.૯૦	૯.૯૦	૯.૯૦
ઘસારો	૭.૪૦	૭.૪૦	૭.૪૦	૭.૪૦	૭.૪૦
પરચૂરણ ખર્ચ	૬.૫૦	૬.૫૦	૬.૫૦	૬.૫૦	૬.૫૦
<u>અર્ધચલિત ખર્ચ:</u>			(૧૦% ↑)	(૨૦% ↑)	
રીપેર	૩.૫૦	૩.૫૦	૩.૮૫	૪.૨૦	૪.૨૦
પરોક્ષ મજૂરી	૭.૬૦	૭.૬૦	૮.૬૮	૯.૪૮	૯.૪૮
વેચાણ વિભાગનો પગાર	૩.૮૦	૩.૮૦	૪.૧૮	૪.૫૬	૪.૫૬
પરચૂરણ ખર્ચ	૨.૮૦	૨.૮૦	૩.૦૮	૩.૩૬	૩.૩૬
<u>ચલિત ખર્ચ:</u>					
માલ-સામાન (નોંધ ૧)	૨૧.૭૦	૨૬.૦૪	૩૨.૫૫	૩૬.૦૯	૪૩.૪૦
મજૂરી (નોંધ ૨)	૨૦.૪૦	૨૪.૪૮	૩૦.૬૦	૩૬.૭૨	૪૦.૮૦
અન્ય ખર્ચ (નોંધ ૩)	૭.૬૦	૯.૪૮	૧૧.૮૫	૧૪.૨૨	૧૫.૮૦
	કુલ ખર્ચ	૮૮.૦૦	૧૦૮.૦૦	૧૨૪.૮૦	૧૪૧.૫૦
+ નક્ષે		૨.૦૦	૨.૨૦	૨.૫૨	૨.૮૦
	વેચાણ	૧૦૦.૦૦	૧૨૦.૦૦	૧૪૦.૦૦	૧૬૦.૦૦
					૨૦૦.૦૦

નોંધ: ૧ માલસામાન:

$$\begin{array}{l} 40\% : 21.70 \\ 50\% : (?) \end{array} \left. \right\} 26.04$$

$$\begin{array}{l} 40\% : 21.70 \\ 75\% : (?) \end{array} \left. \right\} 32.54$$

$$\begin{array}{l} 40\% : 21.70 \\ 60\% : (?) \end{array} \left. \right\} 36.06$$

$$\begin{array}{l} 40\% : 21.70 \\ 100\% : (?) \end{array} \left. \right\} 43.40$$

નોંધ: ૨ મજૂરી:

$$\begin{array}{l} 40\% : 20.40 \\ 50\% : (?) \end{array} \left. \right\} 24.48$$

$$\begin{array}{l} 40\% : 20.40 \\ 75\% : (?) \end{array} \left. \right\} 30.50$$

$$\begin{array}{l} 40\% : 20.40 \\ 60\% : (?) \end{array} \left. \right\} 36.72$$

$$\begin{array}{l} 40\% : 20.40 \\ 100\% : (?) \end{array} \left. \right\} 40.40$$

નોંધ: ૩ અન્ય ખર્ચો:

$$\begin{array}{l} 40\% : 7.60 \\ 50\% : (?) \end{array} \left. \right\} 6.48$$

$$\begin{array}{l} 40\% : 7.60 \\ 75\% : (?) \end{array} \left. \right\} 11.84$$

$$\begin{array}{l} 40\% : 7.60 \\ 60\% : (?) \end{array} \left. \right\} 14.22$$

$$\begin{array}{l} 40\% : 7.60 \\ 100\% : (?) \end{array} \left. \right\} 14.80$$

પ્ર.: ૪ નીચે આપેલી માહિતી પરથી ૭૦%, ૮૦% અને ૬૦% સપાટીએ પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવો.

વિગત	૮૦% સપાટીએ રકમ (₹)
ચલિત ખર્ચ:	
પરોક્ષ મજૂરી	12,000
સ્ટોર્સ ઓન્ડ સ્પેર્સ	4,000
અર્ધચલિત ખર્ચ:	
પાવર (30% સ્થિર)	20,000
રીપેર (50% સ્થિર)	2,000
સ્થિર ખર્ચ:	
ઘસારો	11,000
વીમો	3,000
પગાર	10,000
કુલ ખર્ચ	52,000
અપેક્ષિત પ્રત્યક્ષ મજૂરી	1,24,000 કલાક

પરિવર્તનશીલ અંદાજપત્ર

વિગત	૭૦% સપાઈ	૮૦% સપાઈ	૯૦% સપાઈ
<u>ચલિત ખર્ચ:</u>			
પરોક્ષ મજૂરી (નોંધ ૧)	૧૦૫૦૦	૧૨૦૦૦	૧૩૪૦૦
સ્ટોર્સ એન્ડ સ્પેર્સ (નોંધ ૨)	૩૪૦૦	૪૦૦૦	૪૫૦૦
<u>અર્ધચલિત ખર્ચ:</u>			
પાવર:			
૩૦% સ્થિર	૬૦૦૦	૬૦૦૦	૬૦૦૦
૭૦% ચલિત (નોંધ ૩)	૧૨૨૫૦	૧૪૦૦૦	૧૫૭૫૦
રીપેર:			
૬૦% સ્થિર	૧૨૦૦	૧૨૦૦	૧૨૦૦
૪૦% ચલિત (નોંધ ૪)	૭૦૦	૮૦૦	૯૦૦
<u>સ્થિર ખર્ચ:</u>			
ઘસારો	૧૧૦૦૦	૧૧૦૦૦	૧૧૦૦૦
વીમો	૩૦૦૦	૩૦૦૦	૩૦૦૦
પગાર	૧૦૦૦૦	૧૦૦૦૦	૧૦૦૦૦
કુલ ખર્ચ	૫૮૧૫૦	૬૨૦૦૦	૬૫૮૫૦
<u>પ્રત્યક્ષ મજૂરી (નોંધ ૫)</u>	૧૦૮૫૦૦	૧૨૪૦૦૦	૧૩૬૫૦૦

નોંધ: ૧ પરોક્ષ મજૂરી:

$$\begin{array}{l} ૮૦\% : ૧૨૦૦૦ \\ ૭૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૧૦૫૦૦ \quad \begin{array}{l} ૮૦\% : ૧૨૦૦૦ \\ ૯૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૧૩૪૦૦$$

નોંધ: ૨ સ્ટોર્સ એન્ડ સ્પેર્સ:

$$\begin{array}{l} ૮૦\% : ૪૦૦૦ \\ ૭૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૩૪૦૦ \quad \begin{array}{l} ૮૦\% : ૪૦૦૦ \\ ૯૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૪૫૦૦$$

નોંધ: ૩ પાવર:

$$\begin{array}{l} ૮૦\% : ૧૪૦૦૦ \\ ૭૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૧૨૫૫૦ \quad \begin{array}{l} ૮૦\% : ૧૪૦૦૦ \\ ૯૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૧૫૭૫૦$$

નોંધ: ૪ રીપેર:

$$\begin{array}{l} ૮૦\% : ૮૦૦ \\ ૭૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૭૦૦ \quad \begin{array}{l} ૮૦\% : ૮૦૦ \\ ૯૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૯૦૦$$

નોંધ: ૫ પ્રત્યક્ષ મજૂરી (કલાકા):

$$\begin{array}{l} ૮૦\% : ૧૨૪૦૦૦ \\ ૭૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૧૦૮૫૦૦ \quad \begin{array}{l} ૮૦\% : ૧૨૪૦૦૦ \\ ૯૦\% : (?) \end{array} \left. \begin{array}{l} \\ \end{array} \right\} ૧૩૬૫૦૦$$

પ્ર.: ૫ ૧૦,૦૦૦ એકમોનાં ઉત્પાદનનાં ખર્ચની માહિતી નીચે મુજબ છે.

વિગત	એકમદીઠ (₹)
માલસામાન	૭૦
મજૂરી	૨૫
ચલિત ખર્ચ	૨૦
સ્થિર ખર્ચ	૧૦
ચલિત ખર્ચ (પ્રત્યક્ષ)	૫
વેચાણ ખર્ચ (૧૦% સ્થિર)	૧૩
વિતરણ ખર્ચ (૨૦% સ્થિર)	૭
ઓફિસ ખર્ચ (૪૦,૦૦૦/-)	૫
કુલ	૧૫૫

૮,૦૦૦ અને ૬,૦૦૦ એકમો માટેનું પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવો.

પરિવર્તનશીલ અંદાજપત્ર

વિગત	૧૦,૦૦૦ એકમો		૮,૦૦૦ એકમો		૬,૦૦૦ એકમો	
	એકમદીઠ (₹)	રકમ (₹)	એકમદીઠ (₹)	રકમ (₹)	એકમદીઠ (₹)	રકમ (₹)
ચલિત ખર્ચ:						
માલસામાન	૭૦.૦૦	૭૦૦૦૦૦	૭૦.૦૦	૫૬૦૦૦૦	૭૦.૦૦	૪૨૦૦૦૦
મજૂરી	૨૫.૦૦	૨૪૦૦૦૦	૨૫.૦૦	૨૦૦૦૦૦	૨૫.૦૦	૧૪૦૦૦૦
ચલિત ખર્ચ	૨૦.૦૦	૨૦૦૦૦૦	૨૦.૦૦	૧૬૦૦૦૦	૨૦.૦૦	૧૨૦૦૦૦
ચલિત ખર્ચ (પ્રત્યક્ષ)	૫.૦૦	૪૦૦૦૦	૫.૦૦	૪૦૦૦૦	૫.૦૦	૩૦૦૦૦
અર્ધચલિત ખર્ચ:						
વેચાણ ખર્ચ	સ્થિર	૧.૩૦	૧૩૦૦૦	૧.૬૩	૧૩૦૦૦	૧.૩૦
	ચલિત	૧૧.૭૦	૧૧૭૦૦૦	૧૧.૭૦	૮૩૬૦૦	૧૧.૭૦૦
વિતરણ ખર્ચ	સ્થિર	૧.૪૦	૧૪૦૦૦	૧.૭૪	૧૪૦૦૦	૧.૪૦૦
	ચલિત	૫.૫૦	૫૫૦૦૦	૫.૫૦	૪૪૮૦૦	૫.૫૦
સ્થિર ખર્ચ:						
સ્થિર ખર્ચ		૧૦.૦૦	૧૦૦૦૦૦	૧૨.૫૦	૧૦૦૦૦૦	૧૬.૬૭
ઓફિસ ખર્ચ		૫.૦૦	૪૦૦૦૦	૬.૨૫	૪૦૦૦૦	૮.૩૩
કુલ ખર્ચ		૧૫૫.૦૦	૧૫૫૦૦૦૦	૧૫૮.૪૩	૧૨૭૫૪૦૦	૧૬૬.૮૦
						૧૦૦૦૮૦૦

પ્ર.: ૬ આરએસએસ લિ.ના એક ડિપાર્ટમેન્ટનું વેચાણ માટે ૮૦% સપાઠીએ ₹ ૫,૦૦,૦૦૦/- છે. તેનાં ખર્ચ નીચે મુજબ છે.

વિગત	રકમ (₹)
ઓફિસ પગાર	૯૦,૦૦૦/-
સામાન્ય ખર્ચ	વેચાણનાં ૨%
ઘસારો	૭,૫૦૦/-
ભાડું અને વેરાં	૮,૭૫૦/-
વેચાણ ખર્ચ:	
પગાર	વેચાણનાં ૮%
ટ્રાવેલિંગ ખર્ચ	વેચાણનાં ૨%
સેલ્સ ઓફિસનાં ખર્ચ	વેચાણનાં ૧%
સામાન્ય ખર્ચ	વેચાણનાં ૧%
વિતરણ ખર્ચ:	
મજૂરી	૧૫,૦૦૦/-
ભાડું	વેચાણનાં ૧%
અન્ય ખર્ચ	વેચાણનાં ૪%

ઉપરની માહિતી પરથી ૬૦%, ૧૦૦% અને ૧૧૦% સપાઠીએ પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવો.

આરએસએસ લિ.નું પરિવર્તનશીલ અંદાજપત્ર

વિગત	૬૦% સપાઠી	૬૦% સપાઠી	૧૦૦% સપાઠી	૧૧૦% સપાઠી
ઓફિસ પગાર	૯૦,૦૦૦	૯૦,૦૦૦	૯૦,૦૦૦	૯૦,૦૦૦
સામાન્ય ખર્ચ	૧૨૦૦૦	૧૩૪૦૦	૧૪૦૦૦	૧૫૪૦૦
ઘસારો	૭૫૦૦	૭૫૦૦	૭૫૦૦	૭૫૦૦
ભાડું અને વેરાં	૮૭૫૦	૮૭૫૦	૮૭૫૦	૮૭૫૦
વેચાણ ખર્ચ:				
પગાર	૪૮૦૦૦	૫૪૦૦૦	૬૦૦૦૦	૬૬૦૦૦
ટ્રાવેલિંગ ખર્ચ	૧૨૦૦૦	૧૩૪૦૦	૧૪૦૦૦	૧૫૪૦૦
સેલ્સ ઓફિસનાં ખર્ચ	૬૦૦૦	૬૭૫૦	૭૪૦૦	૮૨૫૦
સામાન્ય ખર્ચ	૬૦૦૦	૬૭૫૦	૭૪૦૦	૮૨૫૦
વિતરણ ખર્ચ:				
મજૂરી	૧૫૦૦૦	૧૫૦૦૦	૧૫૦૦૦	૧૫૦૦૦
ભાડું	૬૦૦૦	૬૭૫૦	૭૪૦૦	૮૨૫૦
અન્ય ખર્ચ	૨૪૦૦૦	૨૭૦૦૦	૩૦૦૦૦	૩૩૦૦૦
કુલ ખર્ચ	૨૩૫૨૫૦	૨૪૯૫૦૦	૨૬૩૭૫૦	૨૭૮૦૦૦
+ નકો	૩૬૪૭૫૦	૪૨૫૫૦૦	૪૮૬૨૫૦	૫૪૭૦૦૦
વેચાણ	૯૦૦૦૦૦	૯૭૫૦૦૦	૭૫૦૦૦૦	૮૨૫૦૦૦

પ્ર.: ૭ એબીસી લિ.ની બે અલગ-અલગ સપાઠીની ઉત્પાદન અને પડતરની માહિતી નીચે મુજબ છે.

વિગત	૪૦% સપાઠી	૫૦% સપાઠી
ઉત્પાદન થયેલ એકમો	૫૦,૦૦૦	૬૦,૦૦૦
માલસામાન ખર્ચ (₹)	૬,૦૦,૦૦૦	૬,૦૦,૦૦૦
મજૂરી ખર્ચ (₹)	૬,૦૦,૦૦૦	૧૩,૫૦,૦૦૦
અન્ય ચલિત ખર્ચ (₹)	૧,૮૦,૦૦૦	૨,૭૦,૦૦૦
પરોક્ષ મજૂરી ખર્ચ (₹)	૧,૫૦,૦૦૦	૧,૮૦,૦૦૦
ઇલેક્ટ્રીસીટી પાવર ખર્ચ (₹)	૩,૦૦,૦૦૦	૩,૬૦,૦૦૦
મેઈન્ટેનાન્સ ખર્ચ (₹)	૪,૨૦,૦૦૦	૫,૧૦,૦૦૦
ભાડું (₹)	૧,૮૦,૦૦૦	૧,૮૦,૦૦૦
વીમો (₹)	૩૦,૦૦૦	૩૦,૦૦૦
ઘસારો (₹)	૧,૫૦,૦૦૦	૧,૫૦,૦૦૦

૪૦%, ૫૦%, ૮૦% અને ૧૦૦% સપાઠીએ એકમદીઠ અને કુલ પડતર દર્શાવતું પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવો.

એબીસી લિ.નું પરિવર્તનશીલ અંદાજપત્ર

વિગત	૪૦% સપાઠી ૫૦,૦૦૦ એકમો		૫૦% સપાઠી ૬૦,૦૦૦ એકમો		૮૦% સપાઠી ૧,૨૦,૦૦૦ એકમો		૧૦૦% સપાઠી ૧,૫૦,૦૦૦ એકમો	
	એકમદીન (₹)	રકમ (₹)	એકમદીન (₹)	રકમ (₹)	એકમદીન (₹)	રકમ (₹)	એકમદીન (₹)	રકમ (₹)
માદસામાન ખર્ચ	૧૦.૦૦	૫૦૦૦૦૦	૧૦.૦૦	૬૦૦૦૦૦	૧૦.૦૦	૧૨૦૦૦૦૦	૧૦.૦૦	૧૫૦૦૦૦૦
મજૂરી ખર્ચ	૧૫.૦૦	૬૦૦૦૦૦	૧૫.૦૦	૧૩૫૦૦૦૦	૧૫.૦૦	૧૮૦૦૦૦૦	૧૫.૦૦	૨૨૫૦૦૦૦
અન્ય ચલિત ખર્ચ	૩.૦૦	૧૮૦૦૦૦	૩.૦૦	૨૭૦૦૦૦	૩.૦૦	૩૬૦૦૦૦	૩.૦૦	૪૫૦૦૦૦
પરોક્ષ મજૂરી ખર્ચ: (નોંધ ૧)								
ચલિત	૧.૦૦	૫૦૦૦૦	૧.૦૦	૬૦૦૦૦	૧.૦૦	૧૨૦૦૦૦	૧.૦૦	૧૫૦૦૦૦
સ્થિર	૧.૫૦	૬૦૦૦૦	૧.૦૦	૬૦૦૦૦	૦.૭૫	૬૦૦૦૦	૦.૫૦	૬૦૦૦૦
ઇટે. પાવર ખર્ચ: (નોંધ ૨)								
ચલિત	૨.૦૦	૧૨૦૦૦૦	૨.૦૦	૧૮૦૦૦૦	૨.૦૦	૨૪૦૦૦૦	૨.૦૦	૩૦૦૦૦૦
સ્થિર	૩.૦૦	૧૮૦૦૦૦	૨.૦૦	૧૮૦૦૦૦	૧.૫૦	૧૮૦૦૦૦	૧.૨૦	૧૮૦૦૦૦
મેન્ડનેનન્સ ખર્ચ: (નોંધ ૩)								
ચલિત	૩.૦૦	૧૮૦૦૦૦	૩.૦૦	૨૭૦૦૦૦	૩.૦૦	૩૬૦૦૦૦	૩.૦૦	૪૫૦૦૦૦
સ્થિર	૪.૦૦	૨૪૦૦૦૦	૨.૬૭	૨૪૦૦૦૦	૨.૦૦	૨૪૦૦૦૦	૧.૬૦	૨૪૦૦૦૦
ભાડું	૩.૦૦	૧૮૦૦૦૦	૨.૦૦	૧૮૦૦૦૦	૧.૫૦	૧૮૦૦૦૦	૧.૨૦	૧૮૦૦૦૦
વીમો	૦.૫૦	૩૦૦૦૦	૦.૩૩	૩૦૦૦૦	૦.૨૫	૩૦૦૦૦	૦.૨૦	૩૦૦૦૦
ઘસારો	૨.૫૦	૧૫૦૦૦૦	૧.૬૭	૧૫૦૦૦૦	૧.૨૫	૧૫૦૦૦૦	૧.૦૦	૧૫૦૦૦૦
કુલ ખર્ચ	૪૮.૫૦	૨૬૧૦૦૦૦	૪૩.૬૭	૩૮૩૦૦૦૦	૪૧.૨૫	૪૮૪૦૦૦૦	૩૮.૮૦	૫૮૭૦૦૦૦

નોંધ: ૧ પરોક્ષ મજૂરી ખર્ચ:

$$\begin{array}{ll} \text{40\%} & \text{50\%} \\ \frac{\text{₹ } 1,40,000}{50,000 \text{ એકમો}} = \text{₹ } \underline{\underline{2.24}} & \frac{\text{₹ } 1,60,000}{60,000 \text{ એકમો}} = \text{₹ } \underline{\underline{2.00}} \\ \therefore \text{અર્ધચલિત ખર્ચ} & \\ \text{ચલિત ખર્ચ} = \frac{\text{રકમમાં થતો ફેરફાર}}{\text{એકમોમાં થતો ફેરફાર}} & = \frac{160000 - 140000}{60000 - 50000} \\ & \\ & = \frac{30000}{30000} = \text{₹ } \underline{\underline{1.00}} \end{array}$$

$$\begin{array}{ll} \text{ચલિત ખર્ચ} = \text{₹ } 1/- \times 50,000 \text{ એકમો} & = \text{₹ } 50,000/- \\ + \text{સ્થિર ખર્ચ} & = \text{₹ } 60,000/- \\ & \\ & \text{₹ } \underline{\underline{1,40,000/-}} \end{array}$$

નોંધ: ૨ ઇલેક્ટ્રીસીટી પાવર ખર્ચ:

$$\begin{array}{ll} \text{40\%} & \text{50\%} \\ \frac{\text{₹ } 3,00,000}{50,000 \text{ એકમો}} = \text{₹ } \underline{\underline{4.00}} & \frac{\text{₹ } 3,50,000}{60,000 \text{ એકમો}} = \text{₹ } \underline{\underline{4.00}} \\ \therefore \text{અર્ધચલિત ખર્ચ} & \\ \text{ચલિત ખર્ચ} = \frac{\text{રકમમાં થતો ફેરફાર}}{\text{એકમોમાં થતો ફેરફાર}} & = \frac{350000 - 300000}{60000 - 50000} \\ & \\ & = \frac{50000}{30000} = \text{₹ } \underline{\underline{2.00}} \end{array}$$

$$\begin{array}{ll} \text{ચલિત ખર્ચ} = \text{₹ } 2/- \times 50,000 \text{ એકમો} & = \text{₹ } 1,20,000/- \\ + \text{સ્થિર ખર્ચ} & = \text{₹ } 1,60,000/- \\ & \\ & \text{₹ } \underline{\underline{3,00,000/-}} \end{array}$$

નોંધ: ૩ મેઈન્ટેનન્સ ખર્ચ:

$$\begin{array}{ll} \text{40\%} & \text{50\%} \\ \frac{\text{₹ } 4,20,000}{50,000 \text{ એકમો}} = \text{₹ } \underline{\underline{7.00}} & \frac{\text{₹ } 4,10,000}{60,000 \text{ એકમો}} = \text{₹ } \underline{\underline{5.67}} \\ \therefore \text{અર્ધચલિત ખર્ચ} & \\ \text{ચલિત ખર્ચ} = \frac{\text{રકમમાં થતો ફેરફાર}}{\text{એકમોમાં થતો ફેરફાર}} & = \frac{410000 - 420000}{60000 - 50000} \\ & \\ & = \frac{60000}{30000} = \text{₹ } \underline{\underline{3.00}} \end{array}$$

$$\text{ચલિત ખર્ચ} = \text{₹ } 3/- \times 50,000 \text{ એકમો} = \text{₹ } 1,50,000/-$$

+ સ્થિર ખર્ચ	= ₹ 2,40,000/-
	₹ 4,20,000/-

સ્વાધ્યાય

1. નીચેની માહિતી 50% સપાટીએ આપવામાં આવી છે. જેને આધારે 80% અને 100% સપાટીએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો.

50% સપાટીએ ઉત્પાદન	500 એકમો
માલસામાન ખર્ચ	એકમદીઠ 100/-
મજૂરી	એકમદીઠ 40/-
પ્રત્યક્ષ ખર્ચ	એકમદીઠ 10/-
કારખાના ખર્ચ (40% સ્થિર)	40,000/-
વહીવટી ખર્ચ (50% સ્થિર)	30,000/-

(જવાબ: કુલ પડતર : 50% સપાટીએ ₹ 1,50,000/-,
80% સપાટીએ ₹ 2,02,000/-,
100% સપાટીએ ₹ 2,44,000/-)

2. એબીસી લિ.નું 1,00,000 એકમોનાં ઉત્પાદનની માહિતી નીચે મુજબ છે.

વિગત	રકમ (₹)
કાચો માલ	2,42,000/-
પ્રત્યક્ષ મજૂરી	74,000/-
પ્રત્યક્ષ ખર્ચ	10,000/-
કારખાના પરોક્ષ ખર્ચ (50% સ્થિર)	2,40,000/-
વહીવટી પરોક્ષ ખર્ચ (80% સ્થિર)	40,000/-
વેચાણ પરોક્ષ ખર્ચ (50% સ્થિર)	20,000/-

50,000 એકમો ભાટેનું અંદાજપત્ર તૈયાર કરો.

(જવાબ: કુલ પડતર:
1,00,000 એકમોએ ₹ 5,47,000/-, એકમદીઠ ₹ 5.47;
50,000 એકમોએ ₹ 4,54,000/-, એકમદીઠ ₹ 4.54)

3. નીચે આપેલ માહિતી પરથી પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો.

વિગત	6,000 એકમો એકમદીઠ (₹)	12,000 એકમો એકમદીઠ (₹)
માલસામગ્રી	24	24
મજૂરી	20	20
કારખાના ખર્ચ	26	22
વહીવટી ખર્ચ	17	14

વિગત	₹,000 એકમો એકમદીઠ (₹)	₹,000 એકમો એકમદીઠ (₹)
વેચાણ ખર્ચ	૧૧	૯
કુલ પડતર	૮૮	૮૦
+ ચોખો નફો	૧	૧૦
વેચાણ કિંમત	૧૦૦	૧૦૦

(જવાબ: કુલ પડતર: ₹ ૧૩,૩૨,૦૦૦/- અને ₹ ૧૪,૫૮,૦૦૦/-;
એકમદીઠ નફો ₹ ૧૬.૭૫ અને ₹ ૧૮.૦૦)

૪. નીચેની માહિતી ૮૦% ઉત્પાદનશક્તિએ ૧૦,૦૦૦ એકમોના ઉત્પાદન માટે છે. પડતરને લગતી માહિતી નીચે મુજબ છે.

વિગત	એકમદીઠ (₹)
કાચો ભાલ	૫૦.૦૦
મજૂરી	૨૦.૦૦
ચલિત કારખાના શિરોપરી ખર્ચ	૧૦.૦૦
સ્થિર કારખાના શિરોપરી ખર્ચ	૧૨.૫૦
વેચાણ શિરોપરી ખર્ચ (૨૦% સ્થિર)	૧૩.૦૦
વહેંચણી ખર્ચ (૨૫% સ્થિર)	૭.૦૦
વહીવટી ખર્ચ (૧૦૦% સ્થિર)	૫.૦૦
કુલ પડતર	૧૧૭.૫૦

ઉપરની માહિતી પરથી ૫૦%, ૬૦%, ૮૦% અને ૧૦૦% ઉત્પાદનશક્તિએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો.

(જવાબ:

	૫૦%	૬૦%	૮૦%	૧૦૦%
કુલ પડતર	₹,૩૫,૮૭૫/-	₹,૫૧,૭૫,૦૦૦/-	₹,૧૪,૧૪,૧૨૫/-	
નફો	૨,૩૩,૬૬૬/-	૨,૬૩,૭૪૦/-	૩,૪૩,૪૩૧/-	
કુલ વેચાણ	૧૦,૨૦,૩૬૧/-	૧૧,૫૬,૮૪૪/-	૧૭,૬૭,૬૫૬/-	

૫. એક કારખાનાની વાર્ષિક ઉત્પાદનશક્તિ ૪૦,૦૦૦ એકમોની છે. કારખાનાની ૪૦% અને ૬૦% ઉત્પાદનશક્તિએ ઉત્પાદન પડતરનો અંદાજ નીચે મુજબ છે.

વિગત	૪૦% ઉત્પાદનશક્તિ (₹)	૬૦% ઉત્પાદનશક્તિ (₹)
પ્રત્યક્ષ ભાલસામાન	૪,૦૦,૦૦૦	૬,૦૦,૦૦૦
પ્રત્યક્ષ મજૂરી	૨,૪૦,૦૦૦	૩,૬૦,૦૦૦
પ્રત્યક્ષ ખર્ચ	૧,૬૦,૦૦૦	૨,૪૦,૦૦૦
<u>અર્ધચલિત ખર્ચ:</u>		
કારખાના ખર્ચ	૭,૦૦,૦૦૦	૮,૦૦,૦૦૦
વહીવટી ખર્ચ	૫,૨૦,૦૦૦	૫,૮૦,૦૦૦
વેચાણ ખર્ચ	૨,૮૦,૦૦૦	૩,૨૦,૦૦૦
કુલ સ્થિર ખર્ચ	૬,૦૦,૦૦૦	૬,૦૦,૦૦૦
નફો / નુકશાન	(નુકશાન) ૧,૦૦,૦૦૦	(નફો) ૭,૦૦,૦૦૦

૫૦%, ૭૫% અને ૬૦% ઉત્પાદન સપાટીએ પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવો.

(જવાબ:

	૪૦%	૭૫%	૬૦%
કુલ પડતર	૩૨,૦૦,૦૦૦/-	૩૬,૪૦,૦૦૦/-	૪૪,૦૦,૦૦૦/-
નફો	૩,૦૦,૦૦૦/-	૧૩,૦૦,૦૦૦/-	૧૬,૦૦,૦૦૦/-
કુલ વેચાણ	૩૫,૦૦,૦૦૦/-	૫૨,૪૦,૦૦૦/-	૫૩,૦૦,૦૦૦/-

★ ★ ★

પ્રકણણ: ૭
પડતર - જથ્થા - નફા વિશ્લેષણ

૧. પ્રાસ્તાવિક
૨. વ્યાખ્યા
૩. સમતૂટ વિશ્લેષણ
૪. સમતૂટ વિશ્લેષણાની ઉપયોગીતા
ઉદાહરણો
૫. સમતૂટ બિંદુ
૬. સલામતીનો ગાળો
૭. નફા-જથ્થાનો ગુણોત્તર
૮. ફાળો
ઉદાહરણો
૯. સ્વાધ્યાય

૧. પ્રારંભિક:

ધંધાના માલિકો અને સંચાલકોને નિર્ણય ઘડતરમાં ઉપયોગી થાય તેવી ઘણી બધી પદ્ધતિઓ અસ્તિત્વમાં છે. દા. ત. ગુણોત્તર વિશ્લેષણા, પડતર-ફાયદા વિશ્લેષણ વગેરે પણ આપણે આજે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પડતર-જથ્થા-નફા વિશ્લેષણ છે. તેની નિર્ણય ઘડતરમાં સૌથી વધુ ભૂમિકા રહેલી છે. જ્યારે આપણે કોઈપણ નવી વસ્તુ બજારમાં વેચાણ માટે મુકવી હોય ત્યારે તેનો ભાવ શું રાખીશું? તેમાંથી કેટલાં એકમોનું વેચાણ કરીશું તો આપણે નહીં નશો - નહીં ખોટ એટલે કે સમતૂટ બિંદુ પર પહોંચીશું. ઉપરાંત નફા આયોજન માટે આપણે ધારો કે ₹ ૨૦,૦૦૦/- નશો મેળવવા માટે કેટલું વેચાણ કરવું પડશે? આપણે ₹ ૨,૦૦,૦૦૦/-નું વેચાણ કરીશું તો આપણને કેટલો નશો થશે? જો વેચાણમાં અમુક ટકા વધારો થાય તો નફામાં કેટલા ટકાનો વધારો થશે? જો વેચાણ મિશ્રણમાં ફેરફાર થાય તો નફા પર શું અસર થાય? જો સ્થિર ખર્ચમાં વધારો થાય તો નફા પર શું અસર થાય? આ બધાં પ્રશ્નોનાં જવાબ આપણાને પડતર-જથ્થા-નફા વિશ્લેષણ કરવાથી મળે છે.

૨. વ્યાખ્યા:

પડતર-જથ્થા-નફા વિશ્લેષણ એ એક આયોજન પ્રક્રિયા છે જેનો ઉપયોગ મેનેજમેન્ટ ભવિષ્યની પ્રવૃત્તિના લીધે ભવિષ્યમાં કેટલો ખર્ચ થશે?, કેટલું વેચાણ થશે? અને કેટલો નશો પ્રાપ્ત થશે? તેની આગાહી કરવા માટે કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ એક ગાણિતીક સમીકરણ છે જે ખર્ચ અને વેચાણનાં ફેરફારોની આવકને ભવિષ્યના સમયગાળા પર કેવી અસર થશે તેની ગાણતરી દર્શાવે છે.

સામાન્ય રીતે કોઈપણ વસ્તુનો નશો તેની વેચાણ કિંમત પર આધાર રાખે છે. તેના ઉપરાંત વસ્તુના સ્થિર ખર્ચ, વસ્તુની ચલિત પડતર, વેચાણનો જથ્થો, વેચાણ મિશ્રણ પર પણ તેનો આધાર છે. આમ, બધાં તત્ત્વો કે ઘટકો વર્ચ્યેના સંબંધ દર્શાવતી જે પદ્ધતિ છે તેને પડતર-જથ્થા-નફા વિશ્લેષણ કહે છે.

અમુક ચોક્કસ નશો કમાવવા માટે કેટલા જથ્થામાં વેચાણ કરવું જોઈએ, તેની વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ તે પડતર-જથ્થા-નફા વિશ્લેષણ પરથી શોધી શકાય છે.

૩. સમતૂટ વિશ્લેષણ:

સમતૂટ વિશ્લેષણ સંચાલકોને મહત્વનાં નિર્ણયો લેવામાં અનેક રીતે ઉપયોગી થાય છે. દા. ત.: ઉત્પાદન કે વેચાણની કઈ સપાટીએ ધંધાની કુલ આવકો અને કુલ ખર્ચ સરખા થઈ રહે છે. જેને સમતૂટ બિંદુ કહે છે. જુદી-જુદી સપાટીએ ઉપજ અને ખર્ચ કેટલા હશે, અમુક નશો મેળવવા કેટલા એકમોનું વેચાણ જરૂરી છે વગેરે સમતૂટ વિશ્લેષણ પરથી જાણી શકાય છે અને તેને આધારે વેચાણ બજેટમાં છેવઠનો આંકડો નક્કી થઈ શકે છે.

સમતૂટ બિંદુ એટલે જે સ્તર પર આવક અને ખર્ચ (વેચાણ = કુલ પડતર (ચલિત ખર્ચ + સ્થિર ખર્ચ)) સરખા થઈ રહે તે વેચાણા. સામાન્ય રીતે સમતૂટ બિંદુએ ધંધાને ખોટ પણ નથી જતી કે કોઈ નશો પણ નથી થતો તેને સમતૂટ બિંદુ કહેવામાં આવે છે. સમતૂટ બિંદુ એ સામાન્ય રીતે એક વેચાણની સપાટી દર્શાવે છે. સમતૂટ બિંદુ શોધવાની ત્રણ પદ્ધતિ છે. જેમાં પ્રથમ બે ગાણિતીક છે અને ત્રીજી આલેખની પદ્ધતિ છે.

- (૧) સમીકરણ પદ્ધતિ
- (૨) સૂત્ર પદ્ધતિ
- (૩) આલેખ પદ્ધતિ.

3.1 સમીકરણ પદ્ધતિ:

આ પદ્ધતિમાં સમતૂટ બિંદુ સમીકરણથી શોધવામાં આવે છે. જે માટેનાં સામાન્ય સમીકરણો નીચે મુજબ છે.

કુલ વેચાણ - કુલ પડતર = ચોખ્ખો નફો

વેચાણ - સ્થિર પડતર - ચલિત પડતર = નફો

વેચાણ = સ્થિર પડતર + ચલિત પડતર + નફો

ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને જ્યારે આપણે સમતૂટ બિંદુ શોધવું હોય ત્યારે સામાન્ય રીતે સમતૂટ બિંદુ એટલે વેચાણનું સ્તર કે તેના પર ધંધાળે કોઈ નફો પણ નથી થતો અને કોઈ નુકશાન પણ થતું નથી. એટલે કે કુલ પડતર પૂરેપૂરી વસુલ થાય છે. સમતૂટબિંદુ કરતા એક એકમનું વધારે વેચાણ થાય તો નફો થાય છે અને એક એકમનું ઓછું વેચાણ થાય તો ખોટ થાય છે. તેનો ઉપરના સમીકરણનો ઉપયોગ કીરીને સમતૂટ બિંદુ શોધીએ ત્યારે નફાની રકમ શૂન્ય ગણીને લખાશે.

સમતૂટ બિંદુએ વેચાણ = ચલિત પડતર + સ્થિર પડતર

3.2 સૂત્ર પદ્ધતિ:

જ્યારે સૂત્ર પદ્ધતિથી સમતૂટ બિંદુ શોધવામાં આવે છે ત્યારે તેમાં એક નવા જ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે તેને 'ફાળો' કે 'ફાળાનો ગાળો' કહેવામાં આવે છે. તેને સામાન્ય રીતે વેચાણમાંથી આપણે ચલિત ખર્ચાઓ બાદ કરીએ ત્યારે આપણાને ફાળો અથવા ફાળાનો ગાળો મળે છે.

આપણે એક ઉદાહરણ ફારા સમજુએ. દા. ત.: એક વસ્તુની એકમદીઠ વેચાણ કિંમત ₹ ૧૨/- હોય અને એકમદીઠ ચલિત ખર્ચ ₹ ૪/- હોય તો સામાન્ય રીતે તેનો ફાળો ₹ ૮/- આવે.

ફાળો = વેચાણ કિંમત - ચલિત ખર્ચ

= ₹ ૧૨/- - ₹ ૪/- = ₹ ૮/-

3.3 આલેખ પદ્ધતિ:

આ આલેખ પદ્ધતિમાં આલેખ દોરવામાં આવે છે. તેમાં એકસ-ધરી પર વેચાણનો જથ્થો દર્શાવવામાં આવે છે અને વાય-ધરી પર નાણાંકીય રકમો દર્શાવવામાં આવે છે. આલેખ પર ત્રણ રેખાઓ દોરવામાં આવે છે. કુલ પડતર રેખા, સ્થિર ખર્ચની રેખા અને વેચાણની રેખા. જ્યાં કુલ પડતરની રેખા અને વેચાણની રેખા એકબીજાને છેદે તેને સમતૂટ બિંદુ કહેવાય.

3.3.1 સમતૂટ આલેખ:

સમતૂટ આલેખ એટલે આપણે ઉપરની ઓલખ પદ્ધતિમાં સમજ્યા કે તેમાં સામાન્ય રીતે આલેખ બનાવવામાં આવે છે અને તેમાં એકસ-ધરી પર વેચાણનો જથ્થો અને વાય-ધરી પર નાણાંકીય રકમ દર્શાવવામાં આવે છે.

આલેખમાં કુલ ત્રણ રેખાઓ દોરવામાં આવે છે.

- કુલ ખર્ચ રેખા
- વેચાણની રેખા
- સ્થિર ખર્ચની રેખા

પ્રથમ સ્થિર ખર્ચની રેખા દોરવામાં આવે છે. સ્થિર ખર્ચાઓ સામાન્ય રીતે આપણે કોઈપણ સ્તર પર એટલે કે ગમે તેટલા એકમોનું ઉત્પાદન કરીએ પણ સ્થિર ખર્ચમાં કોઈ ફેફાર થતો નથી તેથી તે રેખા એકસ-ધરીને સમાંતર આવશે.


કુલ ખર્ચની રેખા એટલે તેમાં બંને ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે, સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા. આ રેખ સ્થિર ખર્ચની રેખાની ઉપર આવશે. તેની શરૂઆત વાચ-ધરી પર સ્થિર ખર્ચના બિંદુ આગળથી થશે કારણ કે ઉત્પાદન શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ જેટલો કુલ ખર્ચ તો થવાનો જ છે. ઉત્પાદન થતા તે જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે.

ત્રીજા નંબર પર વેચાણની રેખા દોરવામાં આવે છે. ગમે તેટલાં એકમોનું વેચાણ કરીએ પણ એકમદીઠ વેચાણ કિંમત એકસરખી જ રહે છે એટલે વેચાણ રેખા શૂન્ય આગળથી શરૂ થઈ ૪૫%ને ખૂણે સીધી આવશે.

આપણે સમતૂટ આલેખ એક ઉદાહરણ ફ્લારા સમજુએ. દા. ત.: એક ઉત્પાદન એકમમાં એકદીઠ ચલિત ખર્ચ ₹ ૨૫/- છે. કુલ સ્થિર ખર્ચ ₹ ૩૦,૦૦૦/- છે. વેચાણ કિંમત ₹ ૪૦/-હોય તો આલેખ ફ્લારા સમતૂટ બિંદુ શોધો.

એકમો	૦	૨૦૦૦	૪૦૦૦	૬૦૦૦	૮૦૦૦
સ્થિર ખર્ચા	૩૦૦૦૦	૩૦૦૦૦	૩૦૦૦૦	૩૦૦૦૦	૩૦૦૦૦
ચલિત ખર્ચા (₹ ૨૫/- લેખે)	૦	૫૦૦૦૦	૧૦૦૦૦૦	૧૫૦૦૦૦	૨૦૦૦૦૦
કુલ ખર્ચ	૩૦૦૦૦	૮૦૦૦૦	૧૩૦૦૦૦	૧૮૦૦૦૦	૨૩૦૦૦૦
વેચાણ	૦	૮૦૦૦૦	૧૬૦૦૦૦	૨૪૦૦૦૦	૩૨૦૦૦૦
નફો / નુકશાન	-૩૦૦૦૦	સમતૂટ બિંદુ	૩૦૦૦૦	૬૦૦૦૦	૮૦૦૦૦

નીચેના આલેખમાં ₹૨૦૦૦ એકમોનું ₹ ૪૦/-ની કિંમતે એટલે કે ₹ ૮૦,૦૦૦/-ના વેચાણે સમતૂટ બિંદુ દર્શાવે છે. તેથી વધુ ₹૪૦૦૦ એકમોના વેચાણે ₹ ૩૦,૦૦૦/-નો નફો જણાય છે, જ્યારે તેનાથી ઓછું વેચાણ કરીશું તો ખોટ થશે.



3.3.2 આપાતકોણ:

આપણો ઉપરના આલેખમાં સમતૂટ બિંદુ કેવી રીતે શોધવું તે સમજયા. હવે આપાતકોણ એટલે આલેખમાં વેચાણાની રેખા, કુલ ખર્ચની રેખાને જ્યાં છેટે ત્યાં બનતા ખૂણાને આપાતકોણ કહેવાય છે. આપાતકોણનો ગાળો એ સામાન્ય રીતે નફાનો ગાળો દર્શાવે છે. જે કચા દરે નફો થઈ રહ્યો છે તેનું સૂચન કરે છે. જો આપાતકોણનો ખૂણો મોટો હોય તો નફો ઊંચા દરે થઈ રહ્યો છે એમ કહેવાય અને જ્યારે આ ખૂણો નાનો હોય તો તેનો અર્થ એ છે કે કુલ પડતરમાં ચલિત ખર્ચનું પ્રમાણ વધારે છે અને નફાનો દર ઓછો છે. સામાન્ય રીતે જે ધંધામાં સલામતીનો ગાળો અને આપાતકોણ મોટો હોય તો તે સારી નફાકારક પરિસ્થિતિ દર્શાવે છે.

૪. સમતૂટ વિશ્લેષણની ઉપયોગીતા:

- (૧) સામાન્ય રીતે આવા આલેખો સંચાલકોને કેટલાંક મહત્વનાં પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય છે.
- (૨) ધંધામાં રોકાણકારો રોકાણ કરે તેના પર વળતર ચૂકવવામાં આવે છે. રોકાણોમાં રોકેલી મૂડી પર વ્યાજબી વળતર મેળવવા પ્રેફરન્સ શેર પર ડિવિડન અને ઓર્ડિનરી શેર પર વ્યાજબી ડિવિડન આપવા તેમજ અનામત ખાતે ચોંચ રકમ લઈ જવા માટે જરૂરી નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે તેનો ખ્યાલ આવે છે.
- (૩) સામાન્ય રીતે આલેખ પરથી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે તેથી વસ્તુની કિંમત એવી રીતે નક્કી કરવામાં મદદરૂપ થાય છે કે જેથી ઈચ્છિત સમતૂટ બિંદુએ અને ઈચ્છિત નફાની સપાટીએ પહોંચી શકાય.
- (૪) એકમદીઠ ચલિત ખર્ચાઓ સહેલાઈથી આલેખ પરથી શોધી શકાય છે.
- (૫) વેચાણાની જુદી-જુદી સપાટીએ પડતર અને ઉપજ કેટકેટલી હશે તેનો ખ્યાલ આવે છે અને તેના આધારે અંદાજપત્રમાં વેચાણ નક્કી કરી શકાય છે.

ઓદાહરણો

ઉદાહરણા: ૧ એક કંપનીનું કુલ વેચાણ રૂ ૧૨,૦૦૦/-, ચલિત ખર્ચ રૂ ૭,૨૦૦/- અને સ્થિર ખર્ચ રૂ ૨,૪૦૦/- હોય તો રૂ ૩,૬૦૦/- નાં મેળવવા કેટલું વેચાણ જરૂરી છે?

જવાબ: અહીં એકમદીઠ ફાળો નક્કી થઈ શકે તેમ નથી તેથી નીચે જણાવેલ સૂત્રનો ઉપયોગ કરીએ.

$$\begin{aligned}
 \text{अपेक्षित नक्षा भाटे} &= (\text{स्थिर खर्च} + \text{अपेक्षित नक्षे}) \times \frac{\text{वेचाण}}{\text{वेचाण} - \text{चलित खर्च}} \\
 \text{जड़ी वेचाण} &= (F + P) \times \frac{S}{S - V} \\
 &= (2400 + 3600) \times \frac{12000}{12000 - 7200} \\
 &= 6000 \times \frac{12000}{4800} \\
 &= ₹ 14,000/-
 \end{aligned}$$

ઉદાહરણ: ૨ માળી પમ્પ મેળુફેક્ટરીંગ કંપનીની એક પમ્પના ઉત્પાદનની પડતર નીચે મુજબ છે.

માલસામાન	₹ ૧૨૦/-
મજૂરી	₹ ૨૪૦/-

ચલિત પરોક્ષ ખર્ચ મજૂરી પર ૧૦૦% લેખે ગણવામાં આવે છે. સ્થાયી ખર્ચ વાર્ષિક રૂ ૧૨,૦૦,૦૦૦/- છે. જો પમ્પની વેચાણ કિંમત રૂ ૮૦૦/- હોય તો કંપનીએ કેટલા પમ્પનું ઉત્પાદન કરવું કે જેથી નફો કે ખોટ થાય નહીં, પરંતુ ખર્ચ વસ્તુ થઈ રહે.

જવાબ: સૌ પ્રથમ એકમદીઠ ફાળો શોધીશું.

માલસામાન	૧૨૦
+ મજૂરી	૨૪૦
	૩૬૦
ચલિત પરોક્ષ ખર્ચ	૨૪૦
એકમદ્દિઠ સિમાંત પડતર	૫૦૦

$$\begin{aligned}
 \text{સમતૂટ બિંદુ} &= \frac{\text{કુલ સ્થિર ખર્ચ}}{\text{એકમદીઠ ફાળો}} \\
 &= \frac{₹ 12,00,000}{200} \\
 &= ₹ 600 \text{ પમ્પનું ઉત્પાદન કરવું પડે.}
 \end{aligned}$$

ઉદાહરણ: 3 એક ઔદ્યોગિક વસાહૃતના નાના પાયાના ઉધોગે ૨૦૨૦ વર્ષમાં પોતાનું બધું ઉત્પાદન એકમદીઠ ₹ ૨૩ લેખે ₹ ૨૩,૦૦,૦૦૦/- માં વેચ્યું. તેનો કુલ સ્થિર ખર્ચ ₹ ૪,૦૦,૦૦૦/- હતો. જ્યારે એકમદીઠ ચલિત ખર્ચ ₹ ૭.૫૦ હતો. સંચાલકો વેચાણ કિંમત ઘટાડીને એકમદીઠ ₹ ૧૦/- કરવા માંગે છે અને છતાં પહેલા મળતો હતો તે જ નફો ટકાવી રાખવા માંગે છે.

આ નિર્ણયનો અભલ કરવા કેટલાં વધુ એકમોનું ઉત્પાદન કરી વેચવા જોઈએ?

જવાબ:

પ્રથમ પરિસ્થિતિમાં વેચાણ કિંમત ₹ ૨૩/- હતી ત્યારે...

$$\begin{aligned}
 \text{વેચાણ} &= \frac{₹ 23,00,000}{23} = ₹ 1,00,000 \text{ એકમો} \\
 \text{કુલ પડતર} &= \text{ચલિત ખર્ચ} + \text{સ્થિર ખર્ચ} \\
 &= (₹ 1,00,000 \times 7.50) + ₹ 4,00,000 \\
 &= ₹ 14,00,000 + ₹ 4,00,000 \\
 &= ₹ 18,00,000/- \\
 \text{નફો} &= \text{વેચાણ} - \text{કુલ પડતર} \\
 &= ₹ 23,00,000 - ₹ 18,00,000 \\
 &= ₹ 5,00,000/- \\
 \text{હવે, } \quad \text{કુલ ફાળો} &= \text{સ્થિર ખર્ચ} + \text{નફો} \\
 &= ₹ 4,00,000 + ₹ 5,00,000 \\
 &= ₹ 9,00,000/-
 \end{aligned}$$

બીજી પરિસ્થિતિમાં વેચાણ કિંમત ₹ ૧૦/- થાય ત્યારે...

કુલ નફો ટકાવી રાખવો છે અને સ્થિર ખર્ચમાં પણ કોઈ ફેર પડતો નથી.

∴ કુલ ફાળો પ્રથમ પરિસ્થિતિ જેટલો જ ₹ 9,00,000/- મળવો જોઈએ.

પરંતુ વેચાણ કિંમત ઘટાડતાં એકમદીઠ ફાળો ઘટશે.

\therefore એકમદીઠ ફાળો = ૧૦ - ૭.૫૦ = ₹ ૨.૫૦

$$\therefore \text{કુલ વેચાણ} = \frac{₹ 00,000}{₹ 2.50} = 3,20,000 \text{ એકમો}$$

હાલનું કુલ વેચાણ ૧,૦૦,૦૦૦ એકમોનું છે, તેથી પહેલાં કરતાં ૨,૨૦,૦૦૦ એકમો વધુ વેચવા જરૂરી છે.

<u>ઉદાહરણ: ૪</u>	એકમદીઠ વેચાણ કિંમત	₹ ૪૦/-
	એકમદીઠ ચલિત ખર્ચ	₹ ૩૦/-
	કુલ સ્થિર ખર્ચ	₹ ૧,૬૦,૦૦૦/-
	(૧) સમતૂટ બિંદુ શોધો.	
	(૨) જો સમતૂટ બિંદુ ૧૦,૦૦૦ એકમો સુધી ઘટાડવામાં આવે તો એકમદીઠ વેચાણ કિંમત શોધો.	
<u>જવાબ:</u>	એકમદીઠ ફાળો	= વેચાણ કિંમત - ચલિત ખર્ચ
		= ૪૦ - ૩૦
		= ₹ ૧૦/-

$$(1) \quad \text{સમતૂટ બિંદુ} = \frac{\text{કુલ સ્થિર ખર્ચ}}{\text{એકમદીઠ ફાળો}} = \frac{₹ 1,60,000}{₹ 10} = ₹ 16,000 \text{ એકમો}$$

(2) સમતૂટ બિંદુ ૧૦,૦૦૦ એકમો હોય તો...

$$\text{એકમદીઠ સ્થિર ખર્ચ} = \frac{₹ 1,60,000}{10,000} = ₹ 16/-$$

$$\therefore \text{એકમદીઠ વેચાણ કિંમત} = \text{એકમદીઠ ચલિત ખર્ચ} + \text{એકમદીઠ સ્થિર ખર્ચ}$$

$$= ૩૦ + ૧૬$$

$$= ₹ ૪૬/-$$

૫. સમતૂટ બિંદુ (Break Even Point):

સમતૂટ બિંદુ એટલે ઉત્પાદનના જે જથ્થાએ નશો પાણ ન થાય અને ખોટ પાણ ન થાય એટલે કે સામાન્ય રીતે જ્યારે ખર્ચ અને આવક સરખા રહે તેને સમતૂટ બિંદુ કહેવામાં આવે છે. જ્યારે બંને ખર્ચ અને

આવક ધંધાના સરખા હોય ત્યારે ધંધો સમતૂટ બિંદુએ છે એમ ગણાય. સમતૂટ બિંદુ એ સીમાંત પડતરનો જ એક ભાગ છે. જ્યારે ધંધાનું વેચાણ આ બિંદુએથી એટલે કે સમતૂટ બિંદુની સપાટીથી ઘટે તો ધંધાને ખોટ જાય છે કારણ કે વેચાણમાંથી મળતો ફાળો સ્થાયી ખર્ચ વસૂલ કરવા મેટે પૂરતો હોતો નથી. જ્યારે વેચાણ સમતૂટ બિંદુની સપાટીથી વધે તો ધંધાને નફો થાય છે કારણ કે ફાળામાંથી પૂરેપૂરો સ્થિર ખર્ચ વસૂલ થઈ ગયો હોય છે.

સમતૂટ બિંદુ સામાન્ય રીતે નીચેના સૂત્રોથી શોધી શકાય છે.

- (૧) એકમદીઠ ફાળો હોય ત્યારે એકમદીઠ ફાળો = એકમદીઠ વેચાણ કિંમત બાદ એકમદીઠ ચલિત ખર્ચ
- (૨) જ્યારે એકમદીઠ વેચાણ કિંમત ન આપેલ હોય ત્યારે સમતૂટ બિંદુઓ (₹ માં)

$$= \frac{\text{વેચાણ}}{\text{વેચાણ-ચલિત ખર્ચ}}$$

$$(3) \quad \text{સમતૂટ બિંદુ} = \frac{\text{કુલ સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}}$$

$$\text{સમતૂટ બિંદુ} = \frac{\text{કુલ સ્થિર ખર્ચ}}{\text{એકમદીઠ ફાળો}}$$

- (૪) * અમૃક નફો કમાવવા જરૂરી વેચાણ:

$$\text{જરૂરી વેચાણ} (\text{એકમોમાં}) = \frac{\text{કુલ સ્થિર ખર્ચ} + \text{નફો}}{\text{એકમદીઠ ફાળો}} = \frac{F + P}{C}$$

$$(5) \quad * \text{ અમૃક ખોટ થાય ત્યારે વેચાણ: } = \frac{\text{કુલ સ્થિર ખર્ચ} - \text{ખોટ}}{\text{એકમદીઠ ફાળો}}$$

$$\text{જરૂરી વેચાણ} (\ ₹ \ માં) = \frac{\text{કુલ સ્થિર ખર્ચ} + \text{નફો}}{\text{પી. વી. ગુણોત્તર}}$$

૬. સલામતીનો ગાળો (Margin of Safety):

સામાન્ય રીતે સલામતીનો ગાળો એટલે ખરેખર વેચાણ અને સમતૂટ બિંદુએ વેચાણ વર્ણનો તફાવત.

સલામતીનો ગાળો (₹ માં) = ખરેખર વેચાણ - સમતૂટ બિંદુએ વેચાણ

સામાન્ય રીતે જ્યારે કંપનીનું કુલ વેચાણ ધારો કે ₹ ૧,૦૦,૦૦૦/- હોય અને સમતૂટ બિંદુએ વેચાણ ₹ ૫૦,૦૦૦/-નું હોય તો સલામતીનો ગાળો ₹ ૫૦,૦૦૦/- ગણાય.

સલામતીનો ગાળો જ્યારે ટકાવારીમાં શોધવાનો હોય ત્યારે નીચે મુજબના સૂત્રનો ઉપયોગ થાય છે.

$$\text{સલામતીનો ગાળો (\%માં)} = \frac{\text{ખરેખર વેચાણ} - \text{સમતૂટ બિંદુએ વેચાણ}}{\text{ખરેખર વેચાણ}} \times 100$$

૭. નફા-જથ્થાનો ગુણોતર (Profit – Volume Ratio):

જ્યારે આપણે કુલ વેચાણમાંથી ચલિત ખર્ચાઓ બાદ કરીએ ત્યારે આપણાને ફાળો મળે છે. આમ, ફાળા અને વેચાણાના ગુણોતરને નફા-જથ્થાનો ગુણોતર કે પી. વી. ગુણોતર કહેવામાં આવે છે. તેનું વધુ યોગ્ય નામ ‘ફાળા-વેચાણ ગુણોતર’ કહી શકાય. નફા-જથ્થાનો ગુણોતર એ આપેલ વેચાણમાં ફેરફાર થવાથી તેની કુલ નફા પર શું અસર થશે તે દર્શાવે છે. સામાન્ય રીતે ટ્રંકાગાળામાં સ્થાયી એટલે કે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી તેથી વેચાણાના જથ્થામાં ફેરફાર થવાથી નફાના દરમાં થતો ફેરફાર નફા/જથ્થાના ગુણોતર દ્વારા જાણી શકાય. નફા/જથ્થાનો ગુણોતર વેચાણમાં નફા અને ખર્ચનું પ્રમાણ બતાવે છે જ્યારે બાકીનો ભાગ ચલિત ખર્ચનો ગુણોતર કહેવાય. ધારો કે નફા/જથ્થાનો ગુણોતર ૪૫% હોય તો વેચાણમાં ચલિત ખર્ચ ૫૫% થાય છે.

નફા-જથ્થાનો ગુણોતર નીચેના સૂત્રના ઉપયોગથી શોધી શકાય છે.

$$\text{નફા-જથ્થાનો ગુણોતર (\%માં)} = \frac{\text{ફાળો}}{\text{વેચાણ}} \times 100$$

નોંધ: નફા/જથ્થાનો ગુણોતર એકમદીઠ વિગતો અથવા કુલ વિગતોના આધારે શોધી શકાય.

૮. ફાળો (Contribution):

સામાન્ય રીતે કોઈપણ વસ્તુની વેચાણ કિંમતમાં બે ખર્ચાઓ સમાવેલાં હોય છે. તેમાં પહેલો એટલે કે સ્થાયી કે સ્થિર ખર્ચ અને બીજો ચલિત ખર્ચ. જ્યારે કુલ વેચાણમાંથી ચલિત પડતર બાદ કરી જે રકમ શોધવામાં આવે છે તેને ફાળો કહેવામાં આવે છે.

દા. ત.: એક એકમની વેચાણ કિંમત ₹ 100/- હોય અને ચલિત ખર્ચ ₹ 50/- હોય તો તફાવત ₹ 50/- ફાળો કહેવાય.

ફાળો = વેચાણ કિંમત - ચલિત ખર્ચ

C = S - V

Where, C = Contribution

S = Sales

V = Variable Cost

નફો = કુલ ફાળો - સ્થિર ખર્ચ

કુલ ફાળો = સ્થિર ખર્ચ + નફો

સ્થિર ખર્ચ = કુલ ફાળો - નફો

ચલિત ખર્ચ = વેચાણ કિંમત - ફાળો

વેચાણ મૂલ્ય = ચલિત પડતર + સ્થિર પડતર + નફો

વેચાણ કિંમત = ફાળો + ચલિત ખર્ચ

:: ઉદાહરણો ::

ઉદાહરણા: ૫ એક કંપની એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે અને તે વસ્તુ એકમદીઠ રૂ ૨૦/- લેખે વેચે છે. વસ્તુનો એકમદીઠ ચલિત ખર્ચ રૂ ૧૨/- અને વાર્ષિક સ્થાયી ખર્ચ રૂ ૮,૦૦૦/- છે. ઉપરની માહિતી પરથી શોધો.

- (૧) નફા-જથ્થાનો ગુણોત્તર (પી. વી. ગુણોત્તર)
- (૨) સમતૂટ બિંદુએ વેચાણ
- (૩) કુલ વેચાણ રૂ ૩૦,૦૦૦/- હોથ તો સલામતીનો ગાળો
- (૪) રૂ ૧૦,૦૦૦/-ના નફા માટે જરૂરી વેચાણ
- (૫) રૂ ૩૦,૦૦૦/-નું વેચાણ હોથ તો નફો.

જવાબ:

$$\begin{aligned}
 \text{ફાળો} &= \text{વેચાણ કિંમત} - \text{ચલિત ખર્ચ} \\
 &= ૨૦ - ૧૨ \\
 &= \text{રૂ } ૮/-
 \end{aligned}$$

$$\begin{aligned}
 (૧) \quad \text{પી. વી. ગુણોત્તર} &= \frac{\text{ફાળો}}{\text{વેચાણ}} \times ૧૦૦ \\
 &= \frac{૮}{૨૦} \times ૧૦૦ \\
 &= ૪૦\%
 \end{aligned}$$

$$\begin{aligned}
 (૨) \quad \text{સમતૂટ બિંદુએ વેચાણ} &= \frac{F}{P. V. \text{ Ratio}} \\
 &= \frac{૮૦૦૦}{૪૦\%} \\
 &= \text{રૂ } ૨૦૦૦૦
 \end{aligned}$$

$$\begin{aligned}
 (૩) \quad \text{સલામતીનો ગાળો} &= \text{ખરેખર વેચાણ} - \text{સમતૂટ બિંદુએ વેચાણ} \\
 &= ૩૦૦૦૦ - ૨૦૦૦૦ \\
 &= \text{રૂ } ૧૦૦૦૦
 \end{aligned}$$

$$\begin{aligned}
 (૪) \quad \text{રૂ } ૧૦,૦૦૦/-ના નફા માટે જરૂરી વેચાણ: \\
 \text{રૂ } ૧૦,૦૦૦/-ના નફા માટે કુલ ફાળો &= \text{સ્થિર ખર્ચ} + \text{નફો} \\
 &= ૮૦૦૦ + ૧૦૦૦૦ \\
 &= \text{રૂ } ૧૮,૦૦૦/-
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{₹ 10,000/--ના નફાએ વેચાણ} &= \frac{\text{ફાળો}}{\text{પી. વી. ગુણોત્તર}} \\
 &= \frac{12000}{80\%} \\
 &= ₹ 45,000/-
 \end{aligned}$$

(૫) ₹ 30,000/--ના વેચાણનો નફો:

$$\begin{aligned}
 \text{ફાળો} &= \text{વેચાણ} \times \text{પી. વી. ગુણોત્તર} \\
 &= 30000 \times 80\% \\
 &= ₹ 12,000/- \\
 \text{નફો} &= \text{ફાળો} - \text{સ્થિર ખર્ચ} \\
 &= 12000 - 2000 \\
 &= ₹ 4,000/-
 \end{aligned}$$

ઉદાહરણ: ૬ નીચેની માહિતી પરથી વર્તમાન પરિસ્થિતિનો ચોખ્ખો નફો, સમતૂટ બિંદુએ વેચાણ અને ₹ 1,80,000/- ચોખ્ખો નફો કમાવવા જરૂરી વેચાણ શોધો.

વેચાણ ₹ 6,00,000/-

ફાળો 30%

સ્થિર ખર્ચ ₹ 1,20,000/-

જવાબ:

$$\begin{aligned}
 (૧) \quad \text{ચોખ્ખો નફો} &= \text{ફાળો} - \text{સ્થિર ખર્ચ} \\
 \text{ફાળો} &= \text{વેચાણ} \times \text{પી. વી. ગુણોત્તર} \\
 &= 600000 \times 30\% \\
 &= ₹ 1,80,000/- \\
 \text{નફો} &= \text{ફાળો} - \text{સ્થિર ખર્ચ} \\
 &= 180000 - 120000 \\
 &= ₹ 60,000/-
 \end{aligned}$$

$$\begin{aligned}
 (૨) \quad \text{સમતૂટ બિંદુએ વેચાણ} &= \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\
 &= \frac{120000}{30\%}
 \end{aligned}$$

= ₹ ४,००,०००

(3) ₹ १,८०,०००/-ના નક્કો કમાવવા માટે વેચાણા:

$$\begin{aligned} \text{વેચાણ} &= \frac{\text{સ્થિર ખર્ચ} + \text{અપેક્ષિત નક્કો}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ &= \frac{120000 + 180000}{30\%} \\ &= ₹ १०,००,०००/- \end{aligned}$$

ઉદાહરણ: ૭ રાજેશ કંપની લિમિટેડના બજેટ અધિકારીએ આવતા વર્ષ માટે નીચે મુજબની અંદાજુત વિગતો તૈયાર કરેલી છે.

વેચાણ (200000) ₹ २,००,०००/-

ચલિત ખર્ચ ₹ ८૦,૦૦૦/-

રસ્થાયી ખર્ચ ₹ १,००,०००/-

ઉપરોક્ત વિગતોને આધારે નક્કા-જલ્દીનો ગુણોત્તર, સમતૂટ બિંદુ અને સલામતીનો ગાળો શોધો અને આ ત્રણોથી ઉપર નીચેના પરિબળોની અસર સમજાવો.

(અ) વેચાણ એકમોભાં ૨૦%નો વધારો

(બ) ચલિત ખર્ચમાં ૫%નો વધારો

(ક) રસ્થાયી ખર્ચમાં ૧૦%નો વધારો

(કુ) વેચાણ કિંમતમાં ૧૦%નો વધારો અને વેચાણ એકમોભાં ૨૦%નો ઘટાડો

જવાબ:

$$\begin{aligned} 1. \quad \text{પી. વી. ગુણોત્તર} &= \frac{\text{ફાળો}}{\text{વેચાણ}} \times 100 \\ &= \frac{120000}{200000} \times 100 \\ &= 60\% \text{ અથવા } \frac{3}{5} \end{aligned}$$

$$\begin{aligned} 2. \quad \text{સમતૂટ બિંદુ} &= \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ &= \frac{100000}{\frac{3}{5}} \\ &= 100000 \times \frac{5}{3} = 1,66,667 \end{aligned}$$

3. સલામતીનો ગાળો = ખરેખર વેચાણ - સમતૂટ બિંદુએ વેચાણ

$$= 200000 - 166667$$

$$= ₹ 33,333$$

(அ) வொடு ஏகமோம் 20%ன் வ஧ரோ ஥ாய் தோ...

$$\text{குல வொடு } 200000/- + 20\% = ₹ 2,40,000/-$$

$$\begin{aligned} \text{- சலித ஖ர்ச் } & 20000/- + 20\% = \underline{\underline{65,000/-}} \\ \text{காளி } & \underline{\underline{1,44,000/-}} \end{aligned}$$

$$\begin{aligned} 1. \text{ பி. வி. குடோதர} & = \frac{\text{காளி}}{\text{வொடு}} \times 100 \\ & = \frac{144000}{240000} \times 100 \\ & = 60\% \text{ அத்வா } \frac{3}{4} \end{aligned}$$

$$\begin{aligned} 2. \text{ ஸமதூட் மின்டு} & = \frac{\text{ஸிர ஖ர்ச்}}{\text{பி. வி. குடோதர}} \\ & = \frac{100000}{\frac{3}{4}} \\ & = 100000 \times \frac{4}{3} = ₹ 1,66,667 \end{aligned}$$

$$\begin{aligned} 3. \text{ ஸலாமதினா காளி} & = \text{கரைஞர வொடு} - \text{ஸமதூட் மின்டுக்கே வொடு} \\ & = 240000 - 166667 \\ & = ₹ 73,333 \end{aligned}$$

(ஆ) சலித ஖ர்சம் 5%ன் வ஧ரோ ஥ாய் தோ...

$$\text{சலித ஖ர்ச் } 20000/- + 5\% = ₹ 2,40,000/-$$

$$\begin{aligned} \text{காளி} & = \text{குல வொடு} - \text{சலித ஖ர்ச்} \\ & = 200000 - 24000 \\ & = ₹ 1,16,000/- \end{aligned}$$

$$\begin{aligned} 1. \text{ பி. வி. குடோதர} & = \frac{\text{காளி}}{\text{வொடு}} \times 100 \\ & = \frac{116000}{200000} \times 100 \end{aligned}$$

= ૫૮%

$$2. \text{ સમતૂટ બિંદુ} = \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ = \frac{100000}{58\%} \\ = ₹ 1,72,413$$

$$3. \text{ સલામતીનો ગાળો} = \text{ખરેખર વેચાણ} - \text{સમતૂટ બિંદુએ વેચાણ} \\ = 200000 - 172413 \\ = ₹ 27,587$$

$$\text{ટકાવારીમાં} = \frac{\text{સલામતીનો ગાળો}}{\text{વેચાણ}} \times 100 \\ = \frac{27587}{200000} \times 100 \\ = 13.7963\%$$

(ક) સ્થાયી ખર્ચમાં ૧૦%નો વધારો થાય તો...

$$\text{સ્થાયી ખર્ચ } 100000/- + 10\% = 1,10,000/-$$

$$1. \text{ પી. વી. ગુણોત્તર} = \frac{\text{ફાળો}}{\text{વેચાણ}} \times 100 \\ = \frac{120000}{200000} \times 100 \\ = 60\% \text{ અથવા } 3/4$$

$$2. \text{ સમતૂટ બિંદુ} = \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ = \frac{110000}{60\%} \\ = ₹ 1,83,333$$

$$3. \text{ સલામતીનો ગાળો} = \text{ખરેખર વેચાણ} - \text{સમતૂટ બિંદુએ વેચાણ} \\ = 200000 - 183333 \\ = ₹ 16,667$$

ઉદાહરણ: ક ડીસા કંપની લિભિટેન્ની વિગતો નીચે મુજબ છે.

વર્ષ	વેચાણ	નફો (₹)

૨૦૦૩	૨૦૦૦૦૦	૨૦,૦૦૦/-
૨૦૦૪	૨૪૦૦૦૦	૨૮,૦૦૦/-

ઉપરની વિગતો પરથી નીચેના જવાબો ગણો.

(૧) પી. વી. ગુણોતાર (નકા-જથ્થાનો ગુણોતાર)

(૨) જ્યારે વેચાણ રૂ ૧,૮૦,૦૦૦/- અને રૂ ૮૦,૦૦૦/- હોય ત્યારે નકાનાં આંકડાઓ

(૩) રૂ ૪૦,૦૦૦/-નો નકો કમાવા માટે વેચાણનો આંકડો

(૪) સ્થિર ખર્ચ

(૫) સમતૂલ બિંદુ

જવાબ:

$$(1) \text{ પી. વી. ગુણોતાર} = \frac{\text{નકામાં ફેરફાર}}{\text{વેચાણમાં ફેરફાર}} \\ = \frac{૮૦૦૦}{૪૦૦૦} \\ = ૨૦\% \text{ અથવા } \frac{1}{૫}$$

(૨) સ્થિર ખર્ચ

(નકાનાં આંકડા શોધવા માટે સૌ પ્રથમ સ્થિર ખર્ચ શોધવો પડશે.)

$$\text{ફાળો} = \text{નકો} + \text{સ્થિર ખર્ચ}$$

$$\therefore \text{સ્થિર ખર્ચ} = \text{ફાળો} - \text{નકો}$$

$$\begin{aligned} \text{હવે, } \text{ફાળો} &= \text{વેચાણ} \times \text{પી. વી. ગુણોતાર} \\ &= ૨૦૦૦૦૦ \times ૨૦\% \\ &= ૪૦,૦૦૦/- \end{aligned}$$

$$\text{સ્થિર ખર્ચ} = \text{ફાળો} - \text{નકો}$$

$$= ૪૦૦૦૦ - ૨૦૦૦૦$$

$$= ૨૦,૦૦૦/-$$

(૩.૧) જ્યારે વેચાણ રૂ ૧,૮૦,૦૦૦ હોય ત્યારે નકો

$$\text{ફાળો} = \text{વેચાણ} \times \text{પી. વી. ગુણોતાર}$$

$$= ૧૮૦૦૦૦ \times ૨૦\%$$

$$= ૩૬,૦૦૦/-$$

$$\text{નકો} = \text{ફાળો} - \text{સ્થિર ખર્ચ}$$

$$= ₹ 35000 - ₹ 20000$$

$$= ₹ 15,000/-$$

(3.2) જ્યારે વેચાણ ₹ 20,000 હોય ત્થારે નફો

$$\text{ફાળો} = \text{વેચાણ} \times \text{પી. વી. ગુણોત્તર}$$

$$= ₹ 20000 \times 20\%$$

$$= ₹ 15,000/-$$

$$\text{નફો} = \text{ફાળો} - \text{સ્થિર ખર્ચ}$$

$$= ₹ 15000 - ₹ 20000$$

$$= ₹ 4,000/- \text{ ખોટ}$$

(4) ₹ 40,000/--નો નફો કમાવા માટે વેચાણ

$$\begin{aligned}\text{જરૂરી વેચાણ} &= \frac{\text{સ્થિર ખર્ચ} + \text{નફો}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ &= \frac{₹ 20000 + ₹ 40000}{20\%} \\ &= \frac{₹ 60000}{20\%} \\ &= ₹ 3,00,000\end{aligned}$$

$$\begin{aligned}(5) \quad \text{સમતૂટ બિંડુ} &= \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ &= \frac{₹ 20000}{20\%} \\ &= ₹ 100000\end{aligned}$$

ઉદાહરણ: ૬ દાંતીવાડા પ્લાસ્ટિક લિમિટેડ જે પ્લાસ્ટિક ડોલ બનાવે છે. તેમના હિસાબોનું વિશ્લેષણ નીચે મુજબ દર્શાવે છે.

ચલિત ખર્ચ (ડોલદીઠ) ₹ 40/-

સ્થિર ખર્ચ ₹ 1,00,000/- વાર્ષિક

ઉત્પાદન શક્તિ 4000 ડોલ વાર્ષિક

વેચાણ કિંમત (ડોલદીઠ) ₹ 140/-

(૧) સમતૂટ બિંડુ

(૨) ₹ 50,000/--નો નફો કમાવા માટે કેટલી ડોલનું વેચાણ કરવું પડશે તે શોધો.

(3) જો કંપની વધારાનો સ્થિર ખર્ચ વાર્ષિક ₹ 4,000/- કરીને વધારાની વાર્ષિક ₹ 200 ડોલરનું ઉત્પાદન કરે તો ઉપર (2)માં દર્શાવ્યા મુજબનો ડોલરીઠ નફો જાળવી રાખવા માટે ડોલરીઠ વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ?

જવાબ:

(1) સભતૂટ બિંદુ

એકમદીઠ ફાળો = એકમદીઠ વેચાણ કિંમત - એકમદીઠ ચલિત ખર્ચ

$$= ₹ 140 - ₹ 40$$

$$= ₹ 100$$

$$\therefore \text{સભતૂટ બિંદુ} = \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{ફાળો}}$$

$$= \frac{100000}{100}$$

$$= ₹ 1000$$

(2) ₹ 50,000/-નો નફો કમાવા અપેક્ષિત વેચાણ

$$\text{અપેક્ષિત વેચાણ} = \frac{\text{સ્થિર ખર્ચ} + \text{નફો}}{\text{એકમદીઠ ફાળો}}$$

$$= \frac{100000 + 50000}{100}$$

$$= \frac{150000}{100}$$

$$= ₹ 1,500 \text{ ડોલ}$$

$$\text{ડોલરીઠ નફો} = \frac{\text{નફો}}{\text{કુલ વેચાણ એકમો}}$$

$$= \frac{50000}{1500}$$

$$= ₹ 33.33$$

(3) ડોલરીઠ નફો જાળવી રાખવા માટે વેચાણ કિંમત

$$\text{નવો સ્થિર ખર્ચ} = ₹ 100000 + ₹ 4000$$

$$= ₹ 1,04,000/-$$

$$\text{નવું કુલ ઉત્પાદન} = ₹ 4000 + ₹ 200$$

$$= ₹ 4,200 \text{ ડોલ}$$

$$\begin{aligned}
 \text{જરૂરી કુલ નફો} &= ૫૨૦૦ \times ૩૭.૫૦ \\
 &= ₹ ૧,૯૫,૦૦૦/- \\
 \therefore \text{જરૂરી કુલ ફાળો} &= ૧૦૪૦૦૦ + ૧૯૫૦૦૦ \\
 &= ₹ ૨,૯૯,૦૦૦/-
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{એકમદીઠ ફાળો} &= \frac{\text{કુલ ફાળો}}{\text{કુલ ઉત્પાદન}} \\
 &= \frac{૨૯૯૦૦૦}{૫૨૦૦} \\
 &= ₹ ૫૭.૫૦
 \end{aligned}$$

$$\begin{aligned}
 \therefore \text{વેચાણ રીતની માન} &= \text{એકમદીઠ ચલિત ખર્ચ} + \text{એકમદીઠ ફાળો} \\
 &= ૪૦ + ૫૭.૫૦ \\
 &= ₹ ૯૭.૫૦
 \end{aligned}$$

ઉદાહરણ: ૧૦ ઉત્પાદન કરતા એક એકમના ૨૦૦૪-૦૫ના વર્ષ ભાટેના તેમના ચોપડામાંથી મેળવેલા આંકડાઓ નીચે મુજબ છે.

સીધી ભાલસામગ્રી	₹ ૪,૧૦,૦૦૦/-
સીધી મજૂરી	₹ ૧,૫૦,૦૦૦/-
સ્થિર ખર્ચ	₹ ૧,૨૦,૦૦૦/-
ચલિત ખર્ચ	₹ ૨,૦૦,૦૦૦/-
વેચાણ	₹ ૧૦,૦૦,૦૦૦/-

- (૧) સમતૂટ બિંદુની ગણતરી કરો.
- (૨) સ્થિર ખર્ચ અને (૩) ચલિત ખર્ચમાં ૧૦%નો વધારો થાય તો સમતૂટ બિંદુ ઉપર શું અસર થશે?

જવાબ:

(૧) સમતૂટ બિંદુ

$$\begin{aligned}
 \text{કુલ ચલિત ખર્ચ} &= \text{સીધી ભાલસામગ્રી} + \text{સીધી મજૂરી} + \text{ચલિત ખર્ચ} \\
 &= ૪૧૦૦૦૦ + ૧૫૦૦૦૦ + ૨૦૦૦૦૦ \\
 &= ₹ ૫૬૦,૦૦૦/-
 \end{aligned}$$

$$\text{પી. વી. ગુણોત્તર} = \frac{\text{વેચાણ} - \text{કુલ ચલિત ખર્ચ}}{\text{વેચાણ}} \times 100$$

$$\begin{aligned}
 &= \frac{1000000 - 750000}{1000000} \times 100 \\
 &= \frac{250000}{1000000} \times 100 \\
 &= 25\%
 \end{aligned}$$

સમતૂટ બિંડુ

$$\begin{aligned}
 &= \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\
 &= \frac{120000}{24\%} \\
 &= ₹ 5,00,000
 \end{aligned}$$

(2) સ્થિર ખર્ચમાં 10%નો વધારો થાય તો...

$$\text{નવો સ્થિર ખર્ચ} = 120000 + 10\% = 132000/-$$

સમતૂટ બિંડુ

$$\begin{aligned}
 &= \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\
 &= \frac{132000}{24\%} \\
 &= ₹ 5,50,000
 \end{aligned}$$

(3) ચલિત ખર્ચમાં 10%નો વધારો થાય તો...

$$\text{નવો ચલિત ખર્ચ} = 750000 + 10\% = 825000/-$$

$$\begin{aligned}
 \text{નવો પી. વી. ગુણોત્તર} &= \frac{\text{વેચાણ} - \text{નવો ચલિત ખર્ચ}}{\text{વેચાણ}} \times 100 \\
 &= \frac{1000000 - 825000}{1000000} \times 100 \\
 &= \frac{175000}{1000000} \times 100 \\
 &= 17.5\%
 \end{aligned}$$

નવું સમતૂટ બિંડુ

$$\begin{aligned}
 &= \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\
 &= \frac{120000}{17.5\%} \\
 &= ₹ 7,31,700
 \end{aligned}$$

ઉદાહરણા: ૧૧ મહેશ્વરી કંપની લિમિટડના બજેટ અધિકારીએ આવતા વર્ષ માટે નીચે ગુજરાતી અંદાજિત વિગતો તૈયાર કરેલી છે.

રૂ.

વેચાણ (૧,૦૦,૦૦૦ એકમો)	૧,૦૦,૦૦૦
ચલિત ખર્ચ	૪૦,૦૦૦
સ્થાયી ખર્ચ	૫૦,૦૦૦

ઉપરોક્ત વિગતોને આધારે નફાજથાનો ગુણોત્તર સમતૂટ બિંદુ અને સલામતીનો ગાળો શોધો. અને આ ગ્રાહેય ઉપર નીચેનાં પરિબળોની અસર સમજાવો.

- (અ) વેચાણ એકમોમાં ૨૦%નો વધારો
- (બ) ચલિત ખર્ચમાં ૫%નો વધારો
- (ક) સ્થાયી ખર્ચમાં ૧૦%નો વધારો
- (સ) વેચાણ કિમતમાં ૧૦%નો વધારો અને વેચાણ એકમોમાં ૨૦%નો ઘટાડો

(ઉ. ગુ. યુનિવર્સિટી, ટી.વાય. નવે.-૨૦૧૪ પર આધારિત)

જવાબ:

$$(૧) \text{ પી. વી. ગુણોત્તર} = \frac{\text{ફાળો}}{\text{વેચાણ}} \times 100 \\ = \frac{50000}{100000} \times 100 \\ = 50\%$$

$$(૨) \text{ સમતૂટ બિંદુ} = \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ = \frac{40000}{50\%} \\ = ₹ 80,000$$

$$(૩) \text{ સલામતીનો ગાળો} = \text{ખરેખર વેચાણ} - \text{સમતૂટ બિંદુએ વેચાણ} \\ = 100000 - 80,000 \\ = ₹ 19,999$$

(અ) વેચાણ એકમોમાં ૨૦%નો વધારો થાય તો,
કુલ વેચાણ રૂ. ૧૦૦૦૦૦ + ૨૦% = ૧૨૦૦૦૦

$$\text{અલિત ખર્ચ} = ૪૦૦૦૦ + ૨૦\% = \frac{૪૮૦૦૦}{૭૨૦૦૦}$$

$$(1) \quad \text{પી. વી. ગુણોત્તર} = \frac{\text{કાળો}}{\text{વેચાણ}} \times 100 \\ = \frac{૭૨૦૦૦}{૧૨૦૦૦} \times 100 \\ = ૬૦\%$$

$$(2) \quad \text{સમતૂટ બિંદુ} = \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ = \frac{૫૦૦૦૦}{૬૦\%} \\ = ₹ ૮૩,૩૩૩$$

$$(3) \quad \text{સલામતીનો ગાળો} = \text{ખરેખર વેચાણ} - \text{સમતૂટ બિંદુએ વેચાણ} \\ = ૧૨૦૦૦૦ - ૮૩૩૩ \\ = ₹ ૩૬,૬૬૭$$

(બ) અલિત ખર્ચમાં ૫%નો વધારો થાય તો,
 $\text{અલિત ખર્ચ} = ૪૦૦૦૦ + ૫\% = ૪૨૦૦૦$
 $\text{કાળો} = ૧૦૦૦૦૦ - ૪૨૦૦૦ = ૫૮૦૦૦$

$$(1) \quad \text{પી. વી. ગુણોત્તર} = \frac{\text{કાળો}}{\text{વેચાણ}} \times 100 \\ = \frac{૫૮૦૦૦}{૧૦૦૦૦૦} \times 100 \\ = ૫૮\%$$

$$(2) \quad \text{સમતૂટ બિંદુ} = \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ = \frac{૫૦૦૦૦}{૫૮\%} \\ = ₹ ૮૬,૨૦૭$$

$$(3) \quad \text{સલામતીનો ગાળો} = \text{ખરેખર વેચાણ} - \text{સમતૂટ બિંદુએ વેચાણ}$$

$$= 1000000 - 85207$$

$$= ₹ 91,793$$

ટકાવારી

$$= \frac{\text{સલામતીનો ગાળો}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{91,793}{100000} \times 100$$

$$= 91.793\%$$

(ક) સ્થાયી ખર્ચમાં 10%નો વધારો થાય તો,

$$\text{સ્થાયી ખર્ચ} = 50000 + 5000 = 55000$$

(૧) પી. વી. ગુણોત્તર

$$= \frac{\text{ફાળો}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{50000}{100000} \times 100$$

$$= 50\%$$

(૨) સમતૂટ બિંદુ

$$= \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}}$$

$$= \frac{55000}{100000}$$

$$= 55\%$$

$$= ₹ 1,155$$

(૩) સલામતીનો ગાળો = ખરેખર વેચાણ - સમતૂટ બિંદુએ વેચાણ

$$= 1000000 - 1155$$

$$= ₹ 88444$$

(૫) વેચાણ કિંમતમાં 10%નો વધારો અને વેચાણ એકમોભાં 20%નો ઘટાડો થાય તો,

$$\text{વેચાણ એકમો} = 1000000 - 20\% \text{ ઘટાડો} = 800000$$

$$\text{વેચાણ કિંમત} = 800000 + 10\% \text{નો વધારો} = 880000$$

ચલિત ખર્ચ 1000000 એકમોના વેચાણો ઝા. 40000 છે તો 800000 એકમોના વેચાણો

$$\text{ચલિત ખર્ચ} = 800000 \text{ એકમો} \times \frac{40000}{1000000} = 32000$$

$$\text{ફાળો} = 880000 - 32000 = 56000$$

$$(1) \quad \text{પી. વી. ગુણોત્તર} = \frac{\text{ફાળો}}{\text{વેચાણ}} \times 100$$

$$= \frac{50000}{22000} \times 100$$

$$= 53.54\%$$

$$(2) \quad \text{સમતૂટ બિંદુ} = \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}}$$

$$= \frac{40000}{53.54\%}$$

$$= ₹ 78,577$$

$$(3) \quad \text{સલામતીનો ગાળો} = \text{ખરેખર વેચાણ} - \text{સમતૂટ બિંદુએ વેચાણ}$$

$$= 22000 - 78577$$

$$= ₹ 1433$$

ઉદાહરણ: ૧૩ નીચેની ભાહિતી પરથી વર્તમાન પરિસ્થિતિનો ચોખ્ખો નફો સમતૂટ બિંદુએ વેચાણ અને રૂ. 60000 ચોખ્ખો નફો કમાવવા જરૂરી વેચાણ શોધો.

રૂ.

વેચાણ	3,00,000
ફાળો	30%
સ્થિર ખર્ચ	50,000

જવાબ:

$$(1) \quad \text{વર્તમાન પરિસ્થિતિનો ચોખ્ખો નફો}$$

$$= \text{ફાળો} - \text{સ્થિર ખર્ચ}$$

$$\text{ફાળો} = \text{વેચાણ} \times \text{પી.વી. ગુણોત્તર}$$

$$= 300000 \times \frac{30}{100}$$

$$= ₹ 60000$$

$$\text{નફો} = \text{ફાળો} - \text{સ્થિર ખર્ચ}$$

$$= ₹ 60000 - ₹ 50000$$

$$\text{નફો} = ₹ 30000$$

(૨) સમતૂટ બિંદુએ વેચાણ

$$\begin{aligned} \text{સમતૂટ બિંદુ (રૂ.માં)} &= \frac{\text{સ્થિર ખર્ચ}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ &= \frac{રૂ. ૯૦૦૦૦}{૩૦\%} \\ &= રૂ. ૨૦૦,૦૦૦ \end{aligned}$$

(૩) રૂ. ૬૦૦૦૦નો નફો કમાવવા વેચાણ

$$\begin{aligned} &= \frac{\text{સ્થિર ખર્ચ} + \text{અપેક્ષિત નફો}}{\text{પી. વી. ગુણોત્તર}} \\ &= \frac{રૂ. ૯૦૦૦૦ + રૂ. ૬૦૦૦૦}{૩૦\%} \\ &= રૂ. ૪૦૦,૦૦૦ \end{aligned}$$

સ્વાધ્યાય

૧. નીચે આપેલી માહિતી પરથી સમતૂટ બિંદુ શોધો.

સ્થિર ખર્ચ (વાર્ષિક)	₹ ૧,૬૦,૦૦૦/-
ચલિત ખર્ચ (એકમદીઠ)	₹ ૮/-
અંદાજિત વેચાણ (વાર્ષિક)	₹ ૪,૦૦,૦૦૦/-
વેચાણ કિંમત (એકમદીઠ)	₹ ૪૦/-

(જવાબ: સમતૂટ બિંદુ ₹ ૫,૦૦૦ એકમો - ₹ ૨,૦૦,૦૦૦/-; એકમદીઠ ફાળો ₹ ૩૨/-.)

૨. માહિ ફેક્ટરીની માહિતી પરથી નીચેની ગણતરી કરો.

ઉત્પાદન	₹૦,૦૦૦ એકમો
સ્થાયી ખર્ચ	₹ ૬,૦૦,૦૦૦/-
ચલિત ખર્ચ (એકમદીઠ)	₹ ૧૦/-
વેચાણ કિંમત (એકમદીઠ)	₹ ૨૦/-

(૧) સમતૂટ બિંદુએ કેટલા એકમોનું ઉત્પાદન અને વેચાણ જરૂરી છે?

(૨) જો વેચાણ કિંમત એકમદીઠ ૧૦% ઘટાડવામાં આવે તો નવું સમતૂટ બિંદુ કયું હશે? (એકમોમાં)

(૩) ₹ ૪,૦૦,૦૦૦/- નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે?

(જવાબ: (૧) ₹૦,૦૦૦ એકમો, એકમદીઠ ફાળો ₹ ૧૦/-; (૨) ₹૫,૦૦૦ એકમો, એકમદીઠ વેચાણ કિંમત ૧૦% ઘટાડવામાં આવે તો નવી વેચાણ કિંમત ₹ ૧૮/- થાય અને ફાળો ₹ ૮/- થાય તેથી નવું સમતૂટ બિંદુ = સ્થિર ખર્ચ ÷ ફાળો = ₹૫,૦૦,૦૦૦ ÷ ₹ ૮ = ₹૫,૦૦૦ એકમો; (૩) ₹૧,૦૦,૦૦૦ એકમો, કુલ ફાળો = સ્થિર ખર્ચ + નફો = ₹૫,૦૦,૦૦૦ + ₹૪,૦૦,૦૦૦ = ₹૧૦,૦૦,૦૦૦ ÷ ૧૦ = ₹૧,૦૦,૦૦૦ એકમો.)

૩. એક ઉત્પાદિત વસ્તુની એકમદીઠ વેચાણ કિંમત ₹ ૧૦/- અને ચલિત ખર્ચ ₹ ૮/- હોય તથા કુલ સ્થિર ખર્ચ ₹ ૧,૨૦,૦૦૦/- હોય તો...

(૧) એકમદીઠ ₹ ૮/- નફો મેળવવા માટે કેટલું વેચાણ કરવું પડે?

(૨) એકમદીઠ ₹ ૮/- નુકશાન થાય તો વેચાણ કેટલું હશે?

(૩) સમતૂટ બિંદુ (સંખ્યામાં) શોધો.

(૪) નફા-જથ્થાનો ગુણોત્તર શોધો.

(ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., એપ્રિલ ૨૦૦૩ પર આધારિત)

(જવાબ: (૧) એકમદીઠ ₹ ૨/--નો નફો મેળવવા માટે જરૂરી વેચાણ ₹ ૫૦,૦૦૦ એકમો; (૨) એકમદીઠ ₹ ૨/- નુકશાન થાય તો ₹ ૨૦,૦૦૦ એકમોનું વેચાણ હોય; (૩) સમતૂટ બિંદુ ₹ ૩૦,૦૦૦ એકમો; (૪) નફા-જથ્થાનો ગુણોત્તર ૪૦%.)

૪. મહેશ કંપની લિમિટેડની નીચેની ભાહિતી મળી છે.

વર્ષ	વેચાણ (₹)	વેચાણ પડતર (₹)
૨૦૧૮	૧૨૦૦૦૦	૧,૨૯,૦૦૦/-
૨૦૨૦	૧૮૦૦૦૦	૧,૬૫,૦૦૦/-

નક્કી કરો.

- (૧) નફા-જથ્થાનો ગુણોત્તર
- (૨) સ્થિર ખર્ચ અને વર્ષ ૨૦૧૮ના ચલિત ખર્ચ
- (૩) સમતૂટ બિંદુ (ઢિપિયામાં)
- (૪) ₹ ૨,૪૦,૦૦૦/--ના વેચાણો નફો
- (૫) ₹ ૩,૦૦૦/- ખોટ હોય ત્યારે થનાર વેચાણ

(સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી, ટી. વાય., એપ્રિલ ૨૦૧૨ પર આધારિત)

(જવાબ: (૧) નફા-જથ્થાનો ગુણોત્તર ૪૦%; (૨) સ્થિર ખર્ચ ₹ ૫૭,૦૦૦/-, ચલિત ખર્ચ ₹ ૧,૦૮,૦૦૦/-; (૩) સમતૂટ બિંદુ ₹ ૧,૪૨,૫૦૦/-; (૪) ₹ ૨,૪૦,૦૦૦ના વેચાણો નફો ₹ ૩૬,૦૦૦/-; (૫) વેચાણ ₹ ૧,૩૪,૦૦૦/-)

૫. નીચેની ભાહિતી પરથી જો સમતૂટ બિંદુ ₹ ૧૦,૦૦૦ એકમો સુધી લઈ જવું હોય તો એકમદીઠ વેચાણ કિંમત શોધો.

એકમદીઠ વેચાણ કિંમત	₹ ૧૨૦/-
એકમદીઠ ચલિત ખર્ચ	₹ ૮૬/-
સ્થિર ખર્ચ	₹ ૩,૦૦,૦૦૦/-

(દક્ષિણ ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., માર્ચ ૨૦૧૩ પર આધારિત)

(જવાબ: એકમદીઠ વેચાણ કિંમત ₹ ૧૨૯/-.)

૬. નીચે મુજબની ભાહિતી આપવામાં આવે છે.

ઉત્પાદન એકમો	૭,૫૦,૦૦૦
સ્થિર ખર્ચ	₹ ૧૧,૨૫,૦૦૦/-
એકમદીઠ વેચાણ કિંમત	₹ ૭.૫૦
એકમદીઠ ચલિત ખર્ચ	₹ ૩/-

તમારે નક્કી કરવાનું છે...

- (૧) સમતૂટ બિંદુ (એકમોમાં અને રૂપિયામાં)
- (૨) નફા-જથ્થાનો ગુણોત્તર
- (૩) ₹ ૮,૦૦,૦૦૦/--નો નફો પ્રાપ્ત કરવા અંગેનું વેચાણ (રૂપિયામાં અને એકમોમાં)
- (૪) જો ₹ ૧૫/--ની વેચાણ કિંમતે ₹ ૫,૦૦,૦૦૦ એકમોનું વેચાણ કરવામાં આવે તો નફાની રકમ કેટલી?

(ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., એપ્રિલ ૨૦૦૮ પર આધારિત)

(જવાબ: સમતૂટ બિંદુ ₹ ૫૦૦૦૦ એકમો (૨) નફા જથ્થાનો ગુણોત્તર ૫૦% (૩) ₹ ૮,૦૦,૦૦૦નો નફો પ્રાપ્ત કરવા માટે વેચાણ ₹ ૫,૦૦,૦૦૦ એકમો અને ₹ ૩૩,૭૫,૦૦૦ રૂ.માં (૪) નફાની રકમ ₹ ૫૦,૭૫,૦૦૦.

૭. ઉત્પાદન કરતા એક એકમના વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના તેમના ચોપડામાંથી મેળવેલ આંકડા નીચે મુજબ છે.

(₹)

સીધી ભાતસામગ્રી	૩,૦૦,૦૦૦/-
સીધી મજૂરી	૧,૦૦,૦૦૦/-
સ્થિર ખર્ચ	૮૦,૦૦૦/-
ચલિત ખર્ચ	૨,૦૦,૦૦૦/-
વેચાણ	૮,૦૦,૦૦૦/-

ઉપરની માહિતી પરથી સમતૂટ બિંદુ શોધો. નીચેના સંજોગોમાં નવું સમતૂટ બિંદુ પણ શોધો.

(૧) જો સ્થિર ખર્ચમાં ૧૦%નો વધારો થાય.

(૨) જો બધા ચલિત ખર્ચમાં ૨૦%નો વધારો થાય.

(ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., માર્ચ ૨૦૦૯ પર આધારિત)

(જવાબ: સમતૂટ બિંદુ ₹ ૩,૨૦,૦૦૦/-; (૧) જો સ્થિર ખર્ચમાં ૧૦%નો વધારો થાય તો નવું સમતૂટ બિંદુ ₹ ૩,૪૨,૦૦૦/-; (૨) જો ચલિત ખર્ચમાં ૨૦%નો વધારો થાય તો નવું સમતૂટ બિંદુ ₹ ૮,૦૦,૦૦૦/-.)

૮. મહેશ્વરી કંપની લિમિટેડની માહિતી નીચે મુજબ છે.

વેચાણ (એકમદીઠ ૨૪/- લેખે) ૫૦,૦૦૦ એકમો

નફા-જથ્થાનો ગુણોત્તર ૩૩^૧/_૩

સલામતીનો ગાળો ૪૫%

નીચે મુજબ શોધો.

- (૧) સ્થિર ખર્ચની રકમ
- (૨) નફાની રકમ
- (૩) જો નફો ₹ ૨૨,૫૦૦/-વધારે કમાવવો હોય તો સલામતીના ગાળાની રકમ
- (૪) જો ચલિત ખર્ચમાં ૨૫% ઘટાડો થાય તો નવું સમતૂટ બિંદુ ઇપિયામાં
- (૫) જો વેચાણ એકમોમાં ૨૦% વધારો થાય તો નફાની રકમ
- (૬) જો સ્થિર ખર્ચમાં ૧૦% વધારો થાય તો સમતૂટ બિંદુ કેટલા એકમોથી વધે?

(દક્ષિણ ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., માર્ચ ૨૦૧૦ પર આધારિત)

(જવાબ: (૧) સ્થિર ખર્ચની રકમ ₹ ૨૨,૦૦૦/-; (૨) નફાની રકમ ₹ ૧૮,૦૦૦/-; (૩) સલામતીના ગાળાની રકમ ₹ ૧,૨૧,૫૦૦/-; (૪) નવું સમતૂટ બિંદુ ₹ ૪૪,૦૦૦/-; (૫) વેચાણ એકમોમાં ૨૦%નો વધારો થાય તો નફાની રકમ ₹ ૨૫,૦૦૦/-; (૬) જો સ્થિર ખર્ચમાં ૧૦% વધારો થાય તો સમતૂટ બિંદુ રૂપે એકમોથી વધે.)

૬. જ્યોતસના લિમિટેડની તારીખ: ૩૧-૦૩-૨૦૧૮ના રોજ પુરા થતા વર્ષની ભાહિતી નીચે આપેલ છે.

વેચાણનાં એકમ	₹ ૫૦,૦૦૦
સમતૂટ બિંદુએ વેચાણ	₹ ૧૬,૮૦,૦૦૦/-
નફા-જથ્થાનો ગુણોત્તર	૩૦%
એકમદીઠ વેચાણ કિંમત	₹ ૫૦/-

ઉપરની વિગતો પરથી ગણાતરી કરો.

- (૧) સ્થિર ખર્ચ
- (૨) ચલિત ખર્ચ
- (૩) સલામતીનો ગાળો
- (૪) વર્તમાન ચોખ્ખો નફો
- (૫) ₹ ૬,૭૨,૦૦૦/-નો નફો મેળવવા જરૂરી વેચાણની રકમ.

(ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., નવેમ્બર ૨૦૧૪ પર આધારિત)

(જવાબ: (૧) સ્થિર ખર્ચ ₹ ૫,૬૪,૦૦૦/-; (૨) ચલિત ખર્ચ ₹ ૨૫,૨૦,૦૦૦/-; (૩) સલામતીનો ગાળો ₹ ૧૬,૮૦,૦૦૦/-; (૪) વર્તમાન ચોખ્ખો નફો ₹ ૪,૮૮,૦૦૦/-; (૫) ₹ ૬,૭૨,૦૦૦/-નો નફો મેળવવા માટે જરૂરી વેચાણની રકમ ₹ ૫૨,૨૦,૦૦૦/-.)

૧૦. મહેશ્વરી કંપની લિમિટેડ તમને તેના ઉત્પાદન અંગે નીચેની ભાહિતી આપે છે.

વર્ષ	કુલ વેચાણ (₹)	કુલ પડતર (₹)
૨૦૧૮	₹ ૬,૦૦,૦૦૦	₹ ૫,૪૦,૦૦૦/-

૨૦૨૦ ૭,૨૦,૦૦૦ ₹,૩૬,૦૦૦/-

ઉપરની વિગતો પરથી નીચેના જવાબો ગણો.

- (૧) નફા-જલ્થાનો ગુણોત્તર
- (૨) સ્થિર ખર્ચ
- (૩) જથારે વેચાણ રૂ ૫,૪૦,૦૦૦/- હોય ત્યારે નફો
- (૪) જથારે નુકશાન રૂ ૧૨,૦૦૦/- હોય ત્યારે વેચાણ
- (૫) રૂ ૧,૨૦,૦૦૦/- નફો કમાવવા માટે જરૂરી વેચાણ
- (૬) સમતૂટ બિંદુ.

(ઉત્તર ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., એપ્રિલ ૨૦૧૨ તથા

નવેમ્બર ૨૦૧૩ પર આધારિત)

(જવાબ: (૧) નફા-જલ્થાનો ગુણોત્તર ૨૦%; (૨) સ્થિર ખર્ચ ₹ ૫૦,૦૦૦/-; (૩) નફો ₹ ૪૮,૦૦૦/-;
(૪) વેચાણ ₹ ૨,૪૦,૦૦૦/-; (૫) જરૂરી વેચાણ ₹ ૬,૦૦,૦૦૦/-; (૬) સમતૂટ બિંદુ
₹ ૩,૦૦,૦૦૦/-.)

☆ ☆ ☆

પ્રકારણ: ૮

પ્રમાણ પડતર પદ્ધતિ અને વિચલન વિશ્લેષણ

- ૧ પ્રાસ્તાવિક
- ૨ પ્રમાણ પડતર પદ્ધતિની વ્યાખ્યા
- ૩ પ્રમાણ પડતર પદ્ધતિનાં લક્ષણો
- ૪ પ્રમાણ પડતર પદ્ધતિ અને અંદાજપત્ર અંકુશ પદ્ધતિ વચ્ચેનો તફાવત
- ૫ વિચલનો
- ૬ સ્વાધ્યાય

૧. પ્રારંભિક:

નિર્ણય ઘડતરની પદ્ધતિમાં પ્રમાણ પડતર એ એક મહિંટનું સ્થાન ધરાવે છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ વસ્તુ બનાવવામાં આવે તેના પહેલાં તેની પડતર નક્કી કરવામાં આવે છે. જેમાં પડતરમાં ભાલસામાનનો ભાવ કેટલો હશે? ભાલસામાનનો ખર્ચ કેટલો થશે? મજૂરીનો ખર્ચ કેટલો થશે? મજૂરીનો દર કેટલો હશે? વગેરે મહિંટપૂર્ણ બાબતોને ધ્યાને લેવામાં આવે છે. પરંતુ જ્યારે ખરેખર ઉત્પાદન કરવામાં આવે ત્યારે આ ભાવે કે જથ્થો વધે કે ઘટે છે તો આમ ભાવમાં કે જથ્થામાં વધારો અથવા ઘટાડો થવાથી તેનું પરિણામ શું આવ્યું અને આ પરિણામ કથા કારણોને લીધે આવ્યું તે જાણવું એ કોઈપણ ધંધા માટે ખૂબ જરૂરી બને છે. પરીમાણ એટલે કે વિચલન જે અનુકૂળ કે પ્રતિકૂળ હોઈ શકે છે. વિચલન આવવાના કારણો શોધો અને જો પ્રતિકૂળ વિચલન આવે તો તેમાં કેવી રીતે સુધારો કરી શકાય તે અંગેનો નિર્ણય પ્રમાણ પડતર પરથી લઈ શકાય છે. પ્રમાણ પડતરમાં પ્રમાણ પડતર અને ખરેખર પડતરને સરખાવવામાં આવે છે. પડતર પદ્ધતિ એ સંચાલકીય હિસાબી પદ્ધતિનો એક ભાગ છે. પ્રમાણ પડતર પદ્ધતિ એ અંકુશાની એક મહિંટની પદ્ધતિ છે.

૨ પ્રમાણ પડતર પદ્ધતિની વ્યાખ્યા:

“પ્રમાણ પડતર એટલે નક્કી કરેલા નજુકના ભવિષ્યના સમય માટે વસ્તુના એક એકમના અથવા અનેક એકમના ઉત્પાદન માટે પૂર્વનિર્ધારીત કે અંદાજપત્રમાં જણાવેલ પડતર.”

- શ્રી વેલનના ભત મુજબ

“વસ્તુ કે સેવા ખાતે ઉધારવાનો ભાલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની વૈજ્ઞાનિક રીતે પૂર્વનિર્ધારીત કરેલ પડતર.”

- શ્રી ડીકીના ભત મુજબ

ઇંઝેનીઝની કોસ્ટીંગની ઇન્સ્ટટ્યુટ્યુટે આપેલ વ્યાખ્યા મુજબ, “પ્રમાણ પડતર એટલે સંચાલકોના ધોરણ પરથી અને સંબંધ ધરાવતાં જરૂરી ખર્ચનાં ધોરણો પરથી ગણેલ પૂર્વનિર્ધારીત પડતર, તેનો ઉપયોગ કિંમત નિર્ધારણાના આધાર તરીકે તેમ જ વિચલન વિશ્લેષણ દ્વારા પડતર નિયંત્રણ માટે થઈ શકે.”

પ્રમાણ પડતર પદ્ધતિ એટલે પ્રમાણ પડતર નક્કી કરવી અને તેનો ઉપયોગ કરવો. તેને ખરેખર પડતર સાથે સરખાવવી અને વિચલનોનું તેનાં કારણો અને ભારણસ્થાનોને અનુલક્ષી પૃથક્કરણ કરવું.

૩ પ્રમાણ પડતર પદ્ધતિનાં લક્ષણો:

- (૧) પ્રમાણ પડતર પદ્ધતિ એ પ્રમાણ પડતર નક્કી કરી તેનો ઉપયોગ કરવાની પદ્ધતિ છે.
- (૨) કાર્યક્ષમ સંચાલન હેઠળ પડતર કેટલી હોઈ શકે તેની ગણતરી કરી પ્રમાણ પડતર નક્કી કરવામાં આવે છે.
- (૩) પ્રમાણ પડતર એ પૂર્વનિર્ધારીત પડતર છે.
- (૪) પ્રમાણ પડતર પદ્ધતિનો બે હેતુ માટે ઉપયોગ થાય છે. (૧) પડતર પર અંકુશ રાખવાના સાધન તરીકે, (૨) કિંમત નક્કી કરવાના આધાર તરીકે.
- (૫) આ પદ્ધતિમાં અંકુશના હેતુ માટે પ્રમાણ પડતરને ખરેખર પડતર સાથે સરખાવવામાં આવે છે અને તેનાં વિચલનો શોધી કાઢવામાં આવે છે.
- (૬) શોધેલાં વિચલનોનું પૃથક્કરણ કરવામાં આવે છે જેથી મૂળ કારણો શોધી તે અંગે સુધારાનાં પગલાં લઈ શકાય.

(૭) પ્રમાણ પડતર પદ્ધતિ એ પડતર નક્કી કરવાની પદ્ધતિ છે જેના દ્વારા નીચેની બાબતો અંગે માહિતી મળી રહે છે.

- પ્રમાણ પડતર
- ખરેખર ખર્ચ
- બંગેનો તફાવત

૪ પ્રમાણ પડતર પદ્ધતિ અને અંદાજપત્ર અંકુશ પદ્ધતિ વચ્ચેનો તફાવત:

સામાન્ય રીતે પ્રમાણ પડતર પદ્ધતિ અને અંદાજપત્ર દ્વારા અંકુશની પદ્ધતિ બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં છે. જ્યારે પ્રમાણ પડતર પદ્ધતિનો અમલ થતો હોય અને જુદાં-જુદાં પ્રમાણો નક્કી કરવામાં આવ્યા હોય ત્યારે ઉત્પાદનની પડતર તથા વેચાણ અંગેનાં અંદાજપત્રો બનાવવાનું કામ પ્રમાણમાં સરળ છે. તેનાથી વિઝુલ, જો પ્રમાણ પડતર પદ્ધતિનો અમલ કરવો હોય તો અંદાજપત્રમાં ઉત્પાદનની સપાઠી નક્કી કરવામાં આવે તો કાર્ય સરળ બને છે. તેને આધારે સમાવેશી પ્રમાણ પડતર પદ્ધતિમાં સ્થિર પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર નક્કી થઈ શકે છે.

- (૧) અંદાજપત્ર દ્વારા જે પડતર અને વિગતો નક્કી થાય છે તે ભૂતકાળનાં આંકડાઓ પરથી નક્કી થાય છે, જ્યારે પ્રમાણ પડતર પદ્ધતિમાં ટેકનીકલ અંડાજોનો પણ આશ્રય લેવામાં આવે છે અને પડતર વૈજ્ઞાનિક રીતે નક્કી કરવામાં આવે છે.
- (૨) અંદાજપત્ર દ્વારા અંકુશ ફક્ત ઉત્પાદન માટે જ નહિ પરંતુ ધંધાની બધી પ્રવૃત્તિ માટેનાં પૂર્વનિર્ધરીત આંકડા નક્કી કરે છે, જ્યારે પ્રમાણ પડતર પદ્ધતિ સામાન્ય રીતે ઉત્પાદન ખર્ચને લગતાં જ આંકડા નક્કી કરે છે.
- (૩) અંદાજપત્ર દ્વારા અંકુશમાં દરેક ખાતા માટેનાં આંકડા નક્કી થાય છે, જ્યારે પ્રમાણ પડતર પદ્ધતિમાં દરેક વસ્તુ અને તેનાં દરેક પ્રકારનાં ખર્ચ માટે પ્રમાણો નક્કી કરવામાં આવે છે એટલે કે અંદાજપત્ર દ્વારા અંકુશ એ ‘વિશાળ’ છે જ્યારે પ્રમાણ પડતર ‘ક્રીએવટ ભરેલી’ છે.
- (૪) અંદાજપત્રમાં કુલ ખર્ચ અંગેનાં તફાવતો શોધવામાં આવે છે, પરંતુ પ્રમાણ પડતર પદ્ધતિમાં ખર્ચની નાની-નાની બાબતોનાં વિચલનો શોધવામાં આવે છે.
- (૫) પ્રમાણ પડતર પદ્ધતિમાં પડતર વધે કે ઘટે બંને કિસ્સાઓમાં તપાસ કરીને કારણો શોધી કાઢવામાં આવે છે, જ્યારે અંદાજપત્ર દ્વારા અંકુશની પદ્ધતિમાં જો ખર્ચ નક્કી કર્યા કરતાં વધે તો જ તપાસ કરવામાં આવે છે.
- (૬) સામાન્ય રીતે અંદાજપત્રમાં એવા આંકડા નક્કી થાય છે કે જેથી વધુ ખર્ચ વગેરે ન થવો જોઈએ, જ્યારે પ્રમાણ પડતરમાં કેટલી પડતર હોવી જોઈએ એ નક્કી થાય છે એટલે કે કેટલી હુદે પડતર નીચી કક્ષાએ લાવવી તે નક્કી થાય છે.

૫ વિચલનો:

નક્કી કરેલી પ્રમાણ પડતર અને ઉત્પાદન દરમ્યાન થયેલ ખરેખર ખર્ચમાં જે તફાવત જણાય છે તેને પડતરનાં વિચલન કહેવાય છે. સામાન્ય રીતે બે પ્રકારનાં વિચલન હોય છે. જેમાં પ્રથમ જો પ્રમાણ ખર્ચ કરતાં ખરેખર ખર્ચ વધુ થાય તો તેને પ્રતિકૂળ વિચલન કહેવામાં આવે છે અને બીજું જો ખરેખર ખર્ચ પ્રમાણ પડતર કરતાં ઓછો થાય તો તેને ફાયદાકરક કે અનુકૂળ વિચલન અથવા કાળું વિચલન કહેવાય.

વિચલનો સંચાલકો માટે નીતિ ઘડતર અંગે ઉપયોગી છે. દરેક પ્રકારનાં વિચલન શું છે અને તેનાં કારણો શું છે તે નક્કી કરવાની પદ્ધતિને વિચલન વિશ્લેષણ કરે છે.

પડતરના અંગોમાં પ્રત્યક્ષ માલસામાન, પ્રત્યક્ષ મજૂરી, સિથર શિરોપરી (પરોક્ષ) ખર્ચ ચલિત શિરોપરી (પરોક્ષ) ખર્ચ અને વેચાણ અંગેનો અભ્યાસ કરવો. વિચલનોના અભ્યાસમાં ઉપર જણાવેલ પાંચેચ બાબતો અંગેના વિચલનો હોય છે. અહીં માલસામાન અને મજૂરીના વિચલનો અંગે ચર્ચા કરવામાં આવેલ છે.

૫.૧ માલસામાનને લગતાં વિચલનો:

જ્યારે એકમદીઠ માલસામાનનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય અને ખરેખર ખર્ચ વધુ કે ઓછો થાય ત્યારે તેને માલસામાન ખર્ચ વિચલન કહેવામાં આવે છે.

માલસામાન ખર્ચ વિચલનનાં બે ભાગ પાડી શકાય.


(૧) માલસામાન ભાવ વિચલન

(૨) માલસામાન વપરાશ વિચલન

ઉપરાંત, માલસામાન વપરાશ વિચલનનાં પણ બે ભાગ પાડી શકાય.

(૧) માલસામાન મિશ્રણ વિચલન

(૨) માલસામાન ઉપજ વિચલન



(૧) માલસામાન ખર્ચ વિચલન:

જ્યારે માલસામાન ખર્ચ અંગે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે જો ખરેખર ખર્ચ તેના કરતા વધે કે ઘેટે તો તશીવતને 'માલસામાન ખર્ચ વિચલન' કહેવાય.

માલસામાન ખર્ચ વિચલન = (પ્રમાણ જણથો × પ્રમાણ ભાવ)

- (બાદ)

(ખરેખર જણથો × ખરેખર ભાવ)

= પ્રમાણ પડતર - ખરેખર પડતર

(૨) માલસામાન ભાવ વિચલન:

જ્યારે માલસામાનની નક્કી કરેલ પ્રમાણ કિંમત કરતા ખરેખર ખર્ચ વધુ કે ઓછી કિંમત ચૂકવવાને કારણે માલસામાન ખર્ચ વિચલન ઉભું થાય ત્યારે તેને ‘માલસામાન ભાવ વિચલન’ કહેવામાં આવે છે.

માલસામાન ભાવ વિચલન = ખરેખર જથ્થો × (પ્રમાણ કિંમત - ખરેખર કિંમત)

(૩) માલસામાન વપરાશ વિચલન:

જ્યારે નક્કી કર્યા કરતા વધુ કે ઓછા જથ્થામાં માલ ઉત્પાદનમાં વપરાયો હોય ત્યારે તેને કારણે ખર્ચમાં પડતા તફાવતને ‘માલસામાન વપરાશ વિચલન’ કહેવાય છે. આ વિચલન ‘માલસામાન જથ્થા વિચલન’ તરીકે પણ ઓળખાય છે.

માલસામાન વપરાશ વિચલન = પ્રમાણ ભાવ × (પ્રમાણ જથ્થો - ખરેખર જથ્થો)

= પ્રમાણ ભાવ × (ખરેખર ઉત્પાદનનો પ્રમાણ જથ્થો - ખરેખર જથ્થો)

(૪) માલસામાન મિશ્રણ વિચલન:

કેટલાંક ઉધોગોમાં બે કે વધુ પ્રકારનો કાચો માલ અમૃક નિશ્ચિત પ્રકારના ઉત્પાદનમાં આપવામાં આવે છે. આ રીતે બે કે વધુ પ્રકારનાં કાચા માલનું જે મિશ્રણ નક્કી કરવામાં આવે છે તેને ‘માલસામાન મિશ્રણ વિચલન’ કહેવામાં આવે છે.

(અ) જ્યારે દાખલ કરેલ પ્રમાણ મિશ્રણનું વજન અને ખરેખર વપરાયેલ કાચા માલનું વજન એકસરણું હોય ત્યારે

માલસામાન મિશ્રણ વિચલન = પ્રમાણ ભાવ × (પ્રમાણ મિશ્રણ - ખરેખર મિશ્રણ)

(બ) જો પ્રમાણ મિશ્રણનું વજન અને ખરેખર મિશ્રણનું વજન જુદું હોય તો

માલસામાન મિશ્રણ = પ્રમાણ ભાવ × (સુધારેલ પ્રમાણ મિશ્રણ - ખરેખર મિશ્રણ)

$$\text{સુધારેલ પ્રમાણ મિશ્રણ} = \frac{\text{બયાનિત માલસામાન}}{\text{કુલ પ્રમાણ માલસામાન}}$$

(૫) માલસામાન ઉપજ વિચલન:

ઉત્પાદન અંગે કાચા માલનો જેટલો જથ્થો આપ્યો હોય તેમાંથી અમૃક ઉપજ મળશે એવી ગણતરી હોય, પરંતુ કોઈ કારણાસર નક્કી કર્યા કરતાં વધુ કે ઓછું ઉત્પાદન કે ઉપજ મળે તો તેથી ખર્ચમાં જે તફાવત ઉભો થાય તેને ‘માલસામાન ઉપજ વિચલન’ કહે છે.

માલસામાન ઉપજ વિચલન = એકમદીઠ પ્રમાણ પડતર × (ખરેખર ઉપજ - પ્રમાણ ઉપજ)

$$\text{એકમદીઠ પ્રમાણ પડતર} = \frac{\text{કુલ પ્રમાણ પડતર}}{\text{કુલ પ્રમાણ ઉપજ}}$$

:: ઉદાહરણો ::

ઉદાહરણ: ૧ કલ્પેશ કંપની લિમિટેડ એક વસ્તુના ઉત્પાદનનું પ્રમાણ ૨૦૦ કિલો નક્કી કર્યું છે અને પ્રમાણ ભાવ કિલોટીચ રૂ ૧૦/- નક્કી કર્યો છે. ખરેખર વપરાશ ૨૨૦ કિલો થયો અને ખરેખર ચૂકવેલ ભાવ રૂ ૧૨/- થયો. માલસામાન ભાવ. વિચલન વપરાશ અને માલસામાન ખર્ચ ગણો.

જવાબ:

માલસામાન ખર્ચ વિચલન = (પ્રમાણ જથ્થો × પ્રમાણ ભાવ) - (ખરેખર જથ્થો × ખરેખર ભાવ)

માલસામાન ભાવ વિચલન = ખરેખર જથ્થો × (પ્રમાણ ભાવ - ખરેખર ભાવ)

માલસામાન વપરાશ વિચલન = પ્રમાણ ભાવ (પ્રમાણ જથ્થો - ખરેખર જથ્થો)

માલસામાન ખર્ચ

માલસામાન ભાવ

માલસામાન વપરાશ

વિચલન

વિચલન

વિચલન

$$(200 \times 10) - (220 \times 12)$$

$$= 220 \times (10 - 12)$$

$$10 (200 - 220)$$

$$2000 - 2540$$

$$= 220 \times (-2)$$

$$10 \times (-20)$$

$$= 540 \text{ પ્રતિકૂળ}$$

$$= -440 \text{ (પ્રતિકૂળ)}$$

$$= 200 \text{ પ્રતિકૂળ}$$

$$\text{ઓટલે કે } ૫૪૦/-$$

પ્રતિકૂળ વિચલન છે.

ઉદાહરણ: ૨ નીચેની માહિતી પરથી (૧) માલસામાન ખર્ચ વિચલન, (૨) માલસામાન ભાવ વિચલન અને (૩) માલસામાન વપરાશ વિચલન ગણો.

કાચો માલ	પ્રમાણ જથ્થો (કિલો)	પ્રમાણ ભાવ (₹)	ખરેખર જથ્થો (કિલો)	ખરેખર ભાવ (₹)
અ	૫૦૦	૮	૭૨૦	૭.૫૦
બ	૬૦૦	૧૦	૧૦૮૦	૧૦.૨૦
	<u>૧૧૦૦</u>		<u>૧૮૦૦</u>	

જવાબ:

* પ્રમાણ જથ્થાની પ્રમાણ પડતર:

$$\text{અ } 500 \times 8 = 4000/-$$

$$\text{બ } 600 \times 10 = 6000/-$$

$$\underline{\underline{13000/-}}$$

* ખરેખર જથ્થાની ખરેખર પડતર:

$$\text{અ } 720 \times 7.50 = 5400/-$$

$$\text{બ } 1080 \times 10.20 = 11016/-$$

$$\underline{\underline{15416/-}}$$

(૧)	માલસામાન ખર્ચ વિચલન = (પ્રમાણ જથ્થો × પ્રમાણ ભાવ) - (ખરેખર જથ્થો × ખરેખર ભાવ)
	= ૧૩૮૦૦ - ૧૬૪૧૬
	= - ₹ ૨૬૧૬/- (પ્રતિકૂળ)
(૨)	માલસામાન ભાવ વિચલન = ખરેખર જથ્થો × (પ્રમાણ ભાવ - ખરેખર ભાવ)
	માલસામાન 'અ' = ૭૨૦ × (૮ - ૭.૫૦)
	= ૭૨૦ × (૦.૫૦)
	= ₹ ૩૬૦/- (અનુકૂળ)
	માલસામાન 'બ'
	= ૧૦૮૦ × (૧૦ - ૧૦.૨૦)
	= ૧૦૮૦ × (-૦.૨૦)
	= - ₹ ૨૧૬/- (પ્રતિકૂળ)
	કુલ ભાવ વિચલન = ૩૬૦ - ૨૧૬
	= ₹ ૧૪૪/- (અનુકૂળ)
નોંધ :	પ્રમાણ જથ્થો એટલે ખરેખર ઉત્પાદન ભાટેનો પ્રમાણજથ્થો
(૩)	માલસામાન વપરાશ વિચલન = પ્રમાણ ભાવ × (પ્રમાણ જથ્થો - ખરેખર જથ્થો)
	માલસામાન 'અ' = ૮ × (૬૦૦ - ૭૨૦)
	= ૮ × (-૧૨૦)
	= - ₹ ૯૬૦/- (પ્રતિકૂળ)
	માલસામાન 'બ'
	= ૧૦ × (૬૦૦ - ૧૦૮૦)
	= ૧૦ × (-૧૮૦)
	= - ₹ ૧૮૦૦/- (પ્રતિકૂળ)
	કુલ વપરાશ વિચલન = - ૯૬૦ - ૧૮૦૦
	= - ₹ ૨૭૬૦/- (પ્રતિકૂળ)
માલસામાન ખર્ચ વિચલન	= માલસામાન ભાવ વિચલન +
	માલસામાન વપરાશ વિચલન
	= ₹ ૧૪૪/- + ₹ (- ૨૭૬૦/-)
	= - ₹ ૨૬૧૬/- (પ્રતિકૂળ)

ઉદાહરણ: 3 મહેશ્વરી લિમિટેડ પ્રમાણા પડતર પક્ષતિનો ઉપયોગ કરે છે. તેના માર્ચ ૨૦૧૮ના ઉત્પાદનને લગતી આહિતી નીચે મુજબ છે. પ્રમાણા: ૮૦ કિલો, માલ ઉત્પાદન માટે જરૂરી ભાલસાભાન ૧૦૦ કિલો. ભાલસાભાનની પ્રમાણા કિંમત કિલોદીઠ ર ૨/-.

ખરેખર ઉત્પાદન	૨૪,૦૦૦ કિલો
વપરાયેલ ભાલસાભાન	૨૬,૦૦૦ કિલો
વપરાયેલ ભાલસાભાનની કિંમત	ર ૫૨,૨૦૦/-

- ગાણતરી કરો: (૧) ભાલસાભાન ખર્ચ વિચલન
(૨) ભાલસાભાન વપરાશ વિચલન
(૩) ભાલસાભાન ભાવ વિચલન.

જવાબ:

- * ૮ કિલોના ઉત્પાદન માટે પ્રમાણા જથ્થો ૧૦૦ કિલો, તો
૨૪,૦૦૦ કિલોના ઉત્પાદન માટે પ્રમાણા જથ્થો (?) કિલો

$$= \frac{100 \times 24000}{80} = 30,000 \text{ કિલો}$$

$$\begin{aligned} * \quad \text{ખરેખર ભાવ} & \frac{\text{ખરેખર કુલ કિંમત}}{\text{ખરેખર કુલ વપરાયેલ જથ્થો}} = \frac{52200}{26000} \\ & = ૧.૮૦ \end{aligned}$$

$$(1) \quad \text{ભાલસાભાન ખર્ચ વિચલન} = (\text{ખરેખર ઉત્પાદનનો પ્રમાણા જથ્થો} \times \text{પ્રમાણા ભાવ}) - (\text{ખરેખર જથ્થો} \times \text{ખરેખર ભાવ})$$

$$\begin{aligned} & = (30000 \times ૨) - (26000 \times ૧.૮૦) \\ & = ₹ ૬૦૦૦૦ - ₹ ૫૨૨૦૦ \\ & = ₹ ૭૮૦૦/- \text{ (અનુકૂળ)} \end{aligned}$$

$$(2) \quad \text{ભાલસાભાન ભાવ વિચલન} = \text{ખરેખર જથ્થો} \times (\text{પ્રમાણા ભાવ} - \text{ખરેખર ભાવ})$$

$$\begin{aligned} & = ૨૬૦૦૦ \times (૨ - ૧.૮૦) \\ & = ૨૬૦૦૦ \times (૦.૨૦) \\ & = ₹ ૫૮૦૦/- \text{ (અનુકૂળ)} \end{aligned}$$

$$(3) \quad \text{ભાલસાભાન વપરાશ વિચલન} = \text{પ્રમાણા ભાવ} \times (\text{પ્રમાણા જથ્થો} - \text{ખરેખર જથ્થો})$$

$$\begin{aligned} & = ૨ \times (30000 - ૨૬૦૦૦) \\ & = ૨ \times (૧૦૦૦) \\ & = ₹ ૨૦૦૦/- \text{ (અનુકૂળ)} \end{aligned}$$

ઉદાહરણ: ૪ નીચેની આહિતી પરથી (૧) માલસામાન ખર્ચ વિચલન, (૨) માલસામાન વપરાશ વિચલન, (૩) માલસામાન ભાવ વિચલન ગણો.

ખરીએટ માલસામાનનો જથ્થો	₹ ૬,૦૦૦ કિલો
ખરીએટ માલસામાનની રીતમાં	₹ ૨૪,૦૦૦/-
૧ ટન માલના ઉત્પાદન માટે જરૂરી	
માલસામાનનો પ્રમાણ જથ્થો	૫૦ કિલો
માલસામાનનો પ્રમાણ ભાવ	₹ ૩.૫૦ એકમદીઠ
માલસામાનનો આખર સ્ટોક	૧૦૦૦ કિલો
ખરેખર ઉત્પાદન	૯૫ ટન

જવાબ:

* ખરેખર ઉત્પાદન અંગે પ્રમાણ જથ્થો: *

$$\begin{aligned} \text{૧ ટન ઉત્પાદન} &= ૫૦ \text{ કિલો} & \text{ખરીએટ રૂ માં} \\ &= \frac{\text{ખરીએટ રૂ માં}}{\text{ખરીએટ કિલોમાં}} \\ \text{૯૫ ટન ઉત્પાદન} &= (?) \text{ કિલો} & = \frac{૨૪૦૦૦}{૫૦૦૦} \\ &= \frac{૯ \times ૫૦}{૯} = ૪,૭૫૦ \text{ કિલો} & = ₹ ૪ \end{aligned}$$

* ખરેખર વપરાયેલ માલસામાનનો જથ્થો:

$$\begin{aligned} \text{માલસામાનની ખરીએટ} & ૫૦૦૦ \text{ કિલો} \\ \text{બાદ: આખર સ્ટોક} & \underline{૧૦૦૦ \text{ કિલો}} \\ & \underline{૫૦૦૦ \text{ કિલો}} \end{aligned}$$

(૧) માલસામાન ખર્ચ વિચલન = (ખરેખર ઉત્પાદનનો પ્રમાણ જથ્થો × પ્રમાણ ભાવ) - (ખરેખર જથ્થો × ખરેખર ભાવ)

$$\begin{aligned} &= (૪૭૫૦ \times ૩.૫૦) - (૫૦૦૦ \times ૪) \\ &= ₹ ૧૬૬૨૫ - ₹ ૨૦૦૦૦ \\ &= - ₹ ૩૩૭૫/- (\text{પ્રતિકૂળ}) \end{aligned}$$

(૨) માલસામાન ભાવ વિચલન = ખરેખર જથ્થો × (પ્રમાણ ભાવ - ખરેખર ભાવ)

$$\begin{aligned} &= ૫૦૦૦ \times (૩.૫૦ - ૪) \\ &= ૫૦૦૦ \times (- ૦.૫૦) \\ &= - ₹ ૨૫૦૦/- (\text{પ્રતિકૂળ}) \end{aligned}$$

$$\begin{aligned}
 (3) \quad \text{માલસામાન વપરાશ વિચલન} &= \text{પ્રમાણ ભાવ} \times (\text{પ્રમાણ જથ્થો} - \text{ખરેખર જથ્થો}) \\
 &= 3.50 \times (4750 - 5000) \\
 &= 3.50 \times (-250) \\
 &= -₹ 875/- (\text{પ્રતિકૂળ})
 \end{aligned}$$

ઉદાહરણ: ૫ એક કારખાનાના ઉત્પાદનને લગતી નીચેની માહિતી પરથી માલસામાન ઉપજ વિચલન શોધો.

માલસામાન	પ્રમાણ	ખરેખર
અ	20 કિલો	30 કિલો
₹ 50/-ના ભાવે		₹ 40/-ના ભાવે
બ	30 કિલો	50 કિલો
₹ 80/-ના ભાવે		₹ 60/-ના ભાવે

પ્રમાણ ઘટ દાખલ કરેલ એકમોના ૧૫% જેટલી છે, જ્યારે ખરેખર ઉત્પાદન 70 કિલોનું થયું છે.

જવાબ:

$$\begin{aligned}
 * \quad \text{પ્રમાણ ઉપજ} &= 20 \text{ કિલો} - 15\% \text{ તેથે } 12 \text{ કિલો બગાડ} \\
 &= 58 \text{ કિલો સુધારેલ પ્રમાણ ઉપજ}
 \end{aligned}$$

* પ્રમાણ ભિશ્રણની કુલ પડતર:


માલસામાન અ :	20 કિલો × ₹ 50/-	= ₹ 1000/-
માલસામાન બ :	30 કિલો × ₹ 80/-	= ₹ 2400/-
	40.00 કિલો	₹ 3400/-
બાદ: ૧૫% ઘટ	7.50 કિલો	
	42.50 કિલો	₹ 3400/-
	પ્રમાણ ઉપજ	પ્રમાણ પડતર

$$\begin{aligned}
 \text{એકમદીઠ પ્રમાણ પડતર} &= \frac{\text{પ્રમાણ પડતર}}{\text{પ્રમાણ ઉપજ}} \\
 &= \frac{3400/-}{42.50 \text{ કિલો}} = ₹ 80/-
 \end{aligned}$$

$$\begin{aligned}
 \text{માલસામાન ઉપજ વિચલન} &= \text{પ્રમાણ પડતર} \times (\text{ખરેખર ઉપજ} - \text{સુધારેલ પ્રમાણ ઉપજ}) \\
 &= ₹ 80/- \times (70 - 58 \text{ કિલો}) \\
 &= ₹ 80/- \times 2 \text{ કિલો} \\
 &= ₹ 160/- (\text{અનુકૂળ})
 \end{aligned}$$

.૫.૨ પ્રત્યક્ષ મજૂરીને લગતાં વિચલનો:

મજૂરી ખર્ચ જે નક્કી કર્યો હોય તેના કરતા ખરેખર મજૂરી ખર્ચ વધુ કે ઓછો થાય તો મજૂરી ખર્ચ વિચલન ઉદ્ભવે છે. સામાન્ય રીતે આ વિચલન ઉદ્ભવવાનાં બે કારણો છે: (૧) મજૂરીનો જે દર નક્કી કર્યો હોય તેના કરતા ખરેખર ચૂકવેલ મજૂરીનો દર વધુ કે ઓછો હોય તથા (૨) કામદાર માટે કામ પુરું કરવા જે પ્રમાણ સમય નક્કી કરવામાં આવ્યો હોય તેના કરતા કામદારે લીધેલો સમય વધુ કે ઓછો હોય.



(૧) મજૂરી ખર્ચ વિચલન:

મજૂરી ખર્ચ જે અગાઉથી નક્કી કર્યો હોય એટલે કે પ્રમાણ મજૂરી ખર્ચ અને ખરેખર ચૂકવેલ મજૂરી ખર્ચ વચ્ચે જે તશીબત આવે તેને 'મજૂરી ખર્ચ વિચલન' કહેવાય છે.

મજૂરી ખર્ચ વિચલન = (પ્રમાણ મજૂરી દર × પ્રમાણ કલાકો) - (ખરેખર મજૂરી દર × ખરેખર કલાકો)

$$= \text{પ્રમાણ મજૂરી ખર્ચ} - \text{ખરેખર મજૂરી ખર્ચ}$$

(૨) મજૂરી દર વિચલન:

જ્યારે મજૂરી ખર્ચ અંગેનાં પ્રમાણ નક્કી કરવામાં આવે છે ત્યારે મજૂરીનાં દર પણ નક્કી કરવામાં આવે છે. પરંતુ ખરેખર ઉત્પાદન દરમાન વધુ કુશળ કામદારો રોકવા પડે તો તેમને ઊચા દરે મજૂરી ચૂકવવી પડે એટલે ખર્ચ વધે અથવા સામાન્ય કામદારોનાં મજૂરીનાં દર વધારવા પડે એટલે મજૂરી ખર્ચમાં શા માટે વધારો થાય છે તેના કારણો શોધી વિચલનો અલગ પાડવાં જોઈએ.

મજૂરી દર વિચલન = ખરેખર સમય × (પ્રમાણ મજૂરી દર - ખરેખર મજૂરી દર)

(૩) મજૂર કાર્યક્ષમતા વિચલન:

કામદારે નિયત સમયમાં જેટલું ઉત્પાદન કર્યું જોઈએ એટલું ઉત્પાદન કરી શકે નહીં, પરંતુ તેનાથી ઓછું કે વધુ ઉત્પાદન થાય તો તેના કારણે ખર્ચમાં ઉભો થતો તશીબત 'મજૂર કાર્યક્ષમતા વિચલન' કહેવાય.

મજૂર કાર્યક્ષમતા વિચલન = પ્રમાણ મજૂરી દર × (પ્રમાણ કલાકો - ખરેખર કલાકો)

(૪) નિષ્કિય કે અનુતપાદક સમય વિચલન:

જ્યારે કામદારો તેમની ફરજ દરમ્યાન કોઈ કારણાસર કંપની દ્વારા કામ પુરુ પાડવામાં ન આવે, પરંતુ તે માટે તેમને પગાર ચૂકવવામાં આવે છે તે સમયને ‘નિષ્કિય કે અનુતપાદક સમય વિચલન’ કહેવામાં આવે છે. દા.ત. યંત્ર ખરાબ થઈ જાય, આકસ્મિક વીજ પ્રવાહ બંધ થાય વિગેરે.

નિષ્કિય સમય વિચલન = અસામાન્ય નિષ્કિય સમય × પ્રમાણ મજૂરી દર

(૫) કામદાર ભિશ્રણ વિચલન:

જ્યારે અમુક ઉત્પાદન માટે જુદાં-જુદાં પ્રકારનાં કેટલાં કામદારો જોઈશે તેનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય, પરંતુ ખરેખર ઉત્પાદન દરમ્યાન નક્કી કર્યા કરતા જુદાં જ પ્રકારનું કામદાર ભિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે અને તેને કારણે ખર્ચમાં ઉભો થતો તફાવત એ આ પ્રકારનું વિચલન ગણાય. તે માલસામાન ભિશ્રણ વિચલન જેવું જ વિચલન છે.

(૧) જ્યારે પ્રમાણ કલાકોનું ભિશ્રણ અને ખરેખર કલાકોનું ભિશ્રણ સરખું હોય

કામદાર ભિશ્રણ વિચલન = પ્રમાણ મજૂરી દર × (પ્રમાણ ભિશ્રણ - ખરેખર ભિશ્રણ)

(૨) જ્યારે પ્રમાણ કલાકોનું ભિશ્રણ અને ખરેખર કલાકોનું ભિશ્રણ જુદું હોય ત્યારે

કામદાર ભિશ્રણ વિચલન = પ્રમાણ મજૂરી દર × સુધારેલ પ્રમાણ ભિશ્રણ - ખરેખર ભિશ્રણ

:: ઉદાહરણો ::

ઉદાહરણ: ૬ પરેશ લિભિટ કંપનીની માર્ચ ૨૦૧૮ને લગતી વિગતો નીચે મુજબ છે. તેના આધારે મજૂરી ખર્ચ અંગેના વિચલનો ગણો.

ચૂક્યેલ કુલ પ્રત્યક્ષ મજૂરી	₹ ૪૩૨૦/-
કલાકદીઠ પ્રમાણ મજૂરી દર	₹ ૨/-
પ્રત્યક્ષ પ્રમાણ કલાકો	૨૦૦૦ કલાકો
ખરેખર ચૂક્યેલ કલાકો	૧૮૦૦ કલાકો
અસામાન્ય નિષ્કિય કલાકો	૮૦ કલાકો

જવાબ:

$$* \text{ ખરેખર ચૂક્યેલ કલાકદીઠ મજૂરી} = \frac{\text{ચૂક્યેલ કુલ મજૂરી}}{\text{ખરેખર કલાકો}}$$

$$= \frac{4320}{1800}$$

$$= ₹ 2.40$$

(૧) મજૂરી ખર્ચ વિચલન = પ્રમાણ સમયની પ્રમાણ મજૂરી - ખરેખર સમયની ખરેખર મજૂરી

$$= (2000 \times 2) - (1800 \times 2.40)$$

$$= ₹ 8000 - ₹ 8320$$

$$= - ₹ 320/- (\text{प्रतिकूल})$$

(२) भजूरी दर विचलन = खरेखर कलाको \times (प्रभाणा भजूरी दर - खरेखर भजूरी दर)

$$= ₹ 1800 \times (2 - 2.40)$$

$$= ₹ 1800 \times (-0.40)$$

$$= - ₹ 720/- (\text{प्रतिकूल})$$

(३) भजूर कार्यक्षमता विचलन = प्रभाणा भजूरी दर \times (प्रभाणा कलाको - खरेखर कलाको*)

$$= 2 \times (2000 - 1720)$$

$$= 2 \times (280)$$

$$= ₹ 560/- (\text{अनुकूल})$$

भजूर कार्यक्षमता विचलन शोधती वर्खते खरेखर कलाकोमांथी असामान्य निष्क्रिय समय बाद करवो अने निष्क्रिय समय विचलननी अलग गणातारी करवी।

* खरेखर कलाको = खरेखर चूक्येल कलाको - निष्क्रिय कलाको

$$= ₹ 1800 - ₹ 80 = ₹ 1720 \text{ कलाको}$$

(४) निष्क्रिय समय विचलन = असामान्य निष्क्रिय समय \times प्रभाणा भजूरी दर

$$= ₹ 80 \times 2$$

$$= - ₹ 160/- (\text{प्रतिकूल})$$

(५) भजूरी खर्च विचलन = भजूरी दर विचलन + भजूर कार्यक्षमता विचलन + निष्क्रिय समय विचलन

$$= - ₹ 720/- + ₹ 560/- + - ₹ 160/-$$

$$= - ₹ 320/- (\text{प्रतिकूल})$$

उदाहरणः ७ प्रभाणा भजूरी दर कलाकाना ₹ २/- नक्की थयो छे अने प्रभाणा समय १० कलाक नक्की करवामां आव्यो छे. खरेखर चूक्येल भजूरी ₹ २.२५ थयो अने काम पुँड करता खरेखर समय १२ कलाक थयो होय तो भजूरी खर्च विचलन गणो।

जवाबः

$$\text{भजूरी खर्च विचलन} = (\text{प्रभाणा भजूरी दर} \times \text{प्रभाणा कलाको})$$

$$- (\text{बाद}) (\text{खरेखर भजूरी दर} \times \text{खरेखर कलाको})$$

$$= (2 \times 10) - (2.25 \times 12)$$

$$= 20 - 27$$

$$= - ₹ 7/- (\text{प्रतिकूल})$$

ઉદાહરણા: ૮ નીચેની માહિતી પરથી મજૂરી ખર્ચ વિચલન ગણો.

પ્રમાણા ઉત્પાદન	૨૦૦ એકમો
પ્રમાણા કલાકો	૧૦૦૦ કલાકો
કલાકદીઠ પ્રમાણા મજૂરી દર	₹ ૪/-
ખરેખર ઉત્પાદન	૧૭૦ એકમો
ખરેખર તીધેલ સમય	૬૦૦ કલાકો
ખરેખર ચૂકવેલ મજૂરી દર	₹ ૪.૨૦

જવાબ:

$$* \text{ પ્રમાણા સમય} = \frac{\text{પ્રમાણા કલાકો}}{\text{પ્રમાણ ઉત્પાદન}} = \frac{1000}{200} = ૫ \text{ કલાકો}$$

$$* \text{ ખરેખર ઉત્પાદન } ૧૭૦ \text{ એકમો} \times ૫ \text{ કલાકો} = ૮૫૦ \text{ પ્રમાણા કલાકો}$$

$$\text{મજૂરી ખર્ચ વિચલન} = (\text{ખરેખર ઉત્પાદનનાં પ્રમાણા કલાકો} \times \text{પ્રમાણા દર}) - (\text{ખરેખર કલાકો} \times \text{ખરેખર મજૂરી દર})$$

$$= (૮૫૦ \times ૪) - (૬૦૦ \times ૪.૨૦)$$

$$= ૩૪૦૦ - ૩૭૮૦$$

$$= - ₹ ૩૮૦/- \text{ (પ્રતિકૂળ)}$$

ઉદાહરણ: ૯ કલ્પેશ લિભિટેક એક વસ્તુના એકમના ઉત્પાદન માટે રોકેલ કામદારોને લગતી માહિતી નીચે મુજબ છે.

કલાકો	મજૂરી દર (₹)	કુલ રકમ (₹)
કુશાળ કામદારો	૧૦	૩/-
બિનકુશાળ કામદારો	૧૬	૧/-
અર્ધકુશાળ કામદારો	૮	૧.૫૦
		<u>૩૦/-</u>

ખરેખર કામગીરી : ખરેખર ઉત્પાદન : ૨૦૦ એકમો

કલાકો	મજૂરી દર (₹)	કુલ રકમ (₹)
કુશાળ કામદારો	૧૨૦૦	૪/-
બિનકુશાળ કામદારો	૪૦૦૦	૦.૬૦
અર્ધકુશાળ કામદારો	૧૬૮૦	૧.૫૦
	<u>૭૪૮૦</u>	<u>૭૨૦૦/-</u>

નીચેનાં વિચલનો ગણો.

(૧) મજૂરી ખર્ચ વિચલન, (૨) મજૂર કાર્યક્ષમતા વિચલન, (૩) મજૂરી દર વિચલન, (૪) કામદાર મિશ્રણ વિચલન.

જવાબ:

* કુલ પ્રમાણ ખર્ચની ગણતરી:

		કુલ રકમ (₹)
કુશાળ કામદારો	$200 \times 10 = 2000 \times 3$	₹ 6000/-
બિનકુશાળ કામદારો	$200 \times 15 = 3200 \times 1$	₹ 3200/-
અર્ધકુશાળ કામદારો	$200 \times 8 = 1600 \times 1.40$	₹ 2400/-
	<u>5200</u>	<u>₹ 11600/-</u>

(૧) મજૂરી ખર્ચ વિચલન = પ્રમાણ સમયની પ્રમાણ મજૂરી - ખરેખર સમયની ખરેખર મજૂરી
 $= ₹ 11600 - ₹ 13320$
 $= - ₹ 1720/-$ (પ્રતિકૂળ)

(૨) મજૂરી દર વિચલન = ખરેખર કલાકો \times (પ્રમાણ મજૂરી દર - ખરેખર મજૂરી દર)

કુશાળ કામદારો	$1800 \times (3 - 4)$	- ₹ 1800/- (પ્રતિકૂળ)
બિનકુશાળ કામદારો	$4000 \times (1 - 0.60)$	+ ₹ 400/- (અનુકૂળ)
અર્ધકુશાળ કામદારો	$1600 \times (1.40 - 1.40)$	0/-
	<u>7480</u>	<u>- ₹ 1400/- (પ્રતિકૂળ)</u>

(૩) કામદાર ભિશ્રણ વિચલન:

સુધારેલ પ્રમાણ ભિશ્રણ = કુલ ખરેખર કલાકો \times $\frac{\text{બાકીગત પ્રમાણ કલાકો}}{\text{કુલ પ્રમાણ કલાકો}}$

કુશાળ કામદારો: $7480 \times \frac{2000}{5200} = ₹ 2200$ કલાકો

બિનકુશાળ કામદારો: $7480 \times \frac{3200}{5200} = ₹ 3420$ કલાકો

અર્ધકુશાળ કામદારો: $7480 \times \frac{1600}{5200} = ₹ 1760$ કલાકો

કામદાર ભિશ્રણ વિચલન = પ્રમાણ મજૂરી દર \times (સુધારેલ પ્રમાણ ભિશ્રણ - ખરેખર ભિશ્રણ)

કુશાળ કામદારો: $3 \times (2200 - 1800)$
 $= 3 \times 400 = ₹ 1200/-$ (અનુકૂળ)

બિનકુશાળ કામદારો: $1 \times (3420 - 4000)$
 $= 1 \times - 580 = - ₹ 580/-$ (પ્રતિકૂળ)

અર્ધકુશાળ કામદારો: $1.40 \times (1760 - 1600)$
 $= 1.40 \times 160 = ₹ 120/-$ (અનુકૂળ)

કામદાર ભિશ્રણ વિચલન = ₹ 1200/- + - ₹ 580/- + ₹ 120/-

$$= ₹ 840/- (\text{અનુકૂળ})$$

જ્યારે પ્રમાણ મિશ્રણ અને ખરેખર મિશ્રણ સરખા ન હોય ત્યારે સુધારેલ મજૂર કાર્યક્ષમતા વિચલન શોધાય.

(૪) સુધારેલ મજૂર કાર્યક્ષમતા વિચલન = પ્રમાણ મજૂરી દર \times (પ્રમાણ કલાકો - સુધારેલ પ્રમાણ કલાકો)

$$\text{કુશળ કામદારો: } 3 \times (2000 - 2200)$$

$$= 3 \times (-200)$$

$$= - ₹ 600/- (\text{પ્રતિકૂળ})$$

$$\text{બિનકુશળ કામદારો: } 1 \times (3200 - 3420)$$

$$= 1 \times (-220)$$

$$= - ₹ 320/- (\text{પ્રતિકૂળ})$$

$$\text{અર્દુકુશળ કામદારો: } 1.40 \times (1600 - 1760)$$

$$= 1.40 \times (-160)$$

$$= - ₹ 240/- (\text{પ્રતિકૂળ})$$

$$= - ₹ 600/- + - ₹ 320/- + ₹ 240/-$$

$$= - ₹ 1120/- (\text{પ્રતિકૂળ})$$

(૫) મજૂરી ખર્ચ વિચલન = મજૂરી દર વિચલન + કામદાર મિશ્રણ વિચલન + સુધારેલ મજૂર કાર્યક્ષમતા વિચલન

$$= - ₹ 1400/- + ₹ 80/- + - ₹ 1120/-$$

$$= - ₹ 1720/- (\text{પ્રતિકૂળ})$$

ઉદાહરણ: ૧૦ એક વસ્તુના એક એકમના ઉત્પાદનના પ્રમાણને લગતી માહિતી નીચે મુજબ છે.

માલસામાન : ૪ કિલો	₹ ૫૦/- એક કિલોના	૨૦૦
-------------------	------------------	-----

મજૂરી : ૫૦ કલાક	₹ ૧/- કલાક્ટીઠ	૫૦
		<u>૨૫૦</u>

ખરેખર ખર્ચની માહિતી:

ખરેખર ઉત્પાદન	૧૦૦ એકમો
---------------	----------

માલસામાન : ૩૮૦ કિલો	₹ ૫૨/- એક કિલોના	૨૦૨૮૦
---------------------	------------------	-------

મજૂરી : ૪૮૨૦ કલાકો	₹ ૧.૧૦ કલાક્ટીઠ	<u>૫૪૧૨</u>
--------------------	-----------------	-------------

માલસામાન અને મજૂરીનાં વિચલનો ગણો.	<u>૨૫૫૮૨</u>
-----------------------------------	--------------

જવાબ:

* ૧૦૦ એકમો ભાટે પ્રમાણ માલસામાન ખર્ચ:

$$100 \text{ એકમો} \times 4 \text{ કિલો} = 400 \text{ કિલો} \times ₹ 50/-$$

$$= ₹ 20000/-$$

* માલસામાનને લગતાં વિચલનો:

$$(1) \quad \text{માલસામાન ખર્ચ વિચલન} = (\text{પ્રમાણ જથ્થો} \times \text{પ્રમાણ ભાવ}) - (\text{ખરેખર જથ્થો} \times \text{ખરેખર ભાવ})$$

$$= (400 \times 50) - (360 \times 42)$$

$$= ₹ 20000 - ₹ 20280$$

$$= - ₹ 280/- (\text{પ્રતિકૂળ})$$

$$(2) \quad \text{માલસામાન ભાવ વિચલન} = \text{ખરેખર જથ્થો} \times (\text{પ્રમાણ ભાવ} - \text{ખરેખર ભાવ})$$

$$= 360 \times (50 - 42)$$

$$= 360 \times (- 8/-)$$

$$= - ₹ 280/- (\text{પ્રતિકૂળ})$$

$$(3) \quad \text{માલસામાન વપરાશ વિચલન} = \text{પ્રમાણ ભાવ} \times (\text{પ્રમાણ જથ્થો} - \text{ખરેખર જથ્થો})$$

$$= 50 \times (400 - 360)$$

$$= 50 \times (10)$$

$$= ₹ 500/- (\text{અનુકૂળ})$$

$$\text{માલસામાન ખર્ચ વિચલન} = \text{માલસામાન ભાવ વિચલન} + \text{માલસામાન વપરાશ વિચલન}$$

$$= - ₹ 280/- + ₹ 500/-$$

$$= - ₹ 220/- (\text{પ્રતિકૂળ})$$

* મજૂરીને લગતાં વિચલનો:

$$(1) \quad \text{મજૂરી ખર્ચ વિચલન} = \text{પ્રમાણ ખર્ચ} - \text{ખરેખર ખર્ચ}$$

અથવા

$$5000 \text{ કલાકો} \times ₹ 10$$

$$= (100 \times 50) - (4812)$$

$$= ₹ 5000/- - ₹ 4812/-$$

$$= - ₹ 188/- (\text{પ્રતિકૂળ})$$

- (२) મજૂરી દર વિચલન = ખરેખર કલાકો × (પ્રમાણ મજૂરી દર - ખરેખર મજૂરી દર)
 $= 4620 \times (1 - 0.10)$
 $= 4620 \times (-0.10)$
 $= - ₹ 462/-$ (પ્રતિકૂળ)
- (३) મજૂર કાર્યક્ષમતા વિચલન = પ્રમાણ મજૂરી દર × (પ્રમાણ કલાકો - ખરેખર કલાકો)
 $= 1 \times (4000 - 4620)$
 $= 1 \times (-62)$
 $= ₹ 62/-$ (અનુકૂળ)
- (૪) મજૂરી ખર્ચ વિચલન = મજૂરી દર વિચલન + મજૂર કાર્યક્ષમતા વિચલન
 $= - 462/- + 62/-$
 $= - ₹ 400/-$ (પ્રતિકૂળ)

સ્વાધ્યાય

૧. એક રસાયણની પ્રમાણ પડતર નીચે મુજબ છે.

માલસામાનાન 'અ'	40%	કિલોદીઠ ₹ 20/-
માલસામાનાન 'બ'	60%	કિલોદીઠ ₹ 30/-

ઉત્પાદનમાં 10% જેટલી પ્રમાણ ઘટ અપેક્ષિત છે. એક મુશ્કુલ દરમ્યાન વપરાશ નીચે મુજબ થયો.

માલસામાનાન 'અ'	60 કિલો	કિલોદીઠ ₹ 18/-
માલસામાનાન 'બ'	110 કિલો	કિલોદીઠ ₹ 34/-

સારા ઉત્પાદનનું વજન 186 કિલો હતું.

નીચેની ગણતરી કરો.

(૧) માલસામાન ભાવ વિચલન, (૨) માલસામાન મિશ્રણ વિચલન, (૩) માલસામાન ઉપજ વિચલન,
(૪) માલસામાન ખર્ચ વિચલન.

(સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી, ટી. વાચ., માર્ચ ૨૦૧૧ પર આધારિત)

(જવાબ: માલસામાન ભાવ વિચલન - ₹ 250/- (અઃ ₹ 180/-, બઃ - ₹ 440/-); માલસામાન મિશ્રણ વિચલન ₹ 100/-; માલસામાન ઉપજ વિચલન ₹ 250/-; માલસામાન ખર્ચ વિચલન - ₹ 100/-.)

૨. એક વસ્તુના એક એકમના ઉત્પાદન માટેનું પ્રમાણ મિશ્રણ નીચે મુજબ છે.

માલસામાન	કિલો	કિલોડીઠ કિંમત (₹)
અ	૫	૭.૫૦
બ	૨	૬.૦૦
ક	૩	૧૫.૦૦

સામાન્ય બગાડનું પ્રમાણ દાખલ દરેક એકમોના ૧૦% જેટલું છે. ભંગારની ઉપજ કિંમત નથી. ખરેખર ઉત્પાદન ૨૭૦ કિલો થયું. ખરેખર માલસામાનનો વપરાશ અને પક્તર નીચે મુજબ છે.

માલસામાન	કિલો	કિલોડીઠ કિંમત (₹)
અ	૧૬૦	૮.૨૫
બ	૬૦	૫.૫૦
ક	૧૦૦	૧૪.૨૫

નીચે મુજબનાં વિચલનોની ગણતરી કરો.

(૧) માલસામાન ભાવ વિચલન, (૨) માલસામાન ખર્ચ વિચલન, (૩) માલસામાન મિશ્રણ વિચલન,
(૪) માલસામાન ઉપજ વિચલન.

(ગુજરાત યુનિવર્સિટી, ટી. વાચ., માર્ચ ૧૯૯૯ પર આધારિત)

(જવાબ: માલસામાન ભાવ વિચલન - ₹ ૧૫/- (પ્રતીકૂળ); માલસામાન ખર્ચ વિચલન - ₹ ૨૪૦/- (પ્રતીકૂળ); માલસામાન મિશ્રણ વિચલન - ₹ ૩૬/- (પ્રતીકૂળ); માલસામાન ઉપજ વિચલન - ₹ ૧૮૬/- (પ્રતીકૂળ).)

૩. નીચે દર્શાવેલ માહિતી પરથી ગણતરી કરો.

(૧) માલસામાન ખર્ચ વિચલન, (૨) માલસામાન કિંમત વિચલન, (૩) માલસામાન વપરાશ વિચલન,
(૪) માલસામાન મિશ્રણ વિચલન, (૫) માલસામાન ઉપજ વિચલન.

માલસામાન	કિલોડીઠ પ્રમાણ કિંમત (₹)	ઉત્પાદનના એકમના ખરેખર દરેક એકમદીઠ પ્રમાણ વજન (કિલો)	ઉત્પાદનમાં વપરાયેલ માલસામાન (કિલો)	કિલોડીઠ ખરેખર કિંમત (₹)
				અ
અ	૧૦	૨	૭૨	૧૨
બ	૧	૪	૧૦૮	૧
ક	૫	૩	૧૨૯	૪
		૯	૩૦૯	

(ગુજરાત યુનિવર્સિટી, ટી. વાચ., માર્ચ ૨૦૦૦ પર આધારિત)

(જવાબ: માલસામાન ખર્ચ વિચલન - ₹ ૭૨/- (પ્રતિકૂળ); માલસામાન ભાવ વિચલન - ₹ ૧૮/- (પ્રતિકૂળ); માલસામાન વપરાશ વિચલન - ₹ ૫૪/- (પ્રતિકૂળ); માલસામાન મિશ્રણ વિચલન - ₹ ૧૩૨/- (પ્રતિકૂળ); માલસામાન ઉપજ વિચલન ₹ ૭૮/- (અનુકૂળ).)

૪. એક વસ્તુના ઉત્પાદન માટેનું પ્રમાણ મિશ્રણ નીચે પ્રમાણે છે.

માલસામાન	કિલો	કિલોદીઠ કિંમત (₹)
અ	૫૦	૨.૫૦
બ	૨૦	૨.૦૦
ક	૩૦	૫.૦૦

બગાડનું સામાન્ય પ્રમાણ દાખલ કરેલ એકમોના ૧૦% છે. જેની કોઈ ભંગાર કિંમત નથી. વસ્તુનું ખરેખર ઉત્પાદન ૩૬૦૦૦ કિલો થયું છે.

ખરેખર માલસામાનની વપરાશ અને પડતર કિંમત નીચે મુજબ છે.

માલસામાન	કિલો	કિલોદીઠ કિંમત (₹)
અ	૨૦૮૦૦	૨.૭૫
બ	૮૪૦૦	૧.૮૭૫
ક	૧૨૮૦૦	૪.૭૫

ઉપરની માહિતી પરથી નીચેનાં વિચલનો શોધો.

(૧) માલસામાન ખર્ચ વિચલન, (૨) માલસામાન ભાવ વિચલન, (૩) માલસામાન વપરાશ વિચલન,
(૪) માલસામાન મિશ્રણ વિચલન, (૫) માલસામાન ઉપજ વિચલન.

(ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., એપ્રિલ ૨૦૦૩ પર આધારિત)

(જવાબ: માલસામાન ખર્ચ વિચલન - ₹ ૭૭૫૦/- (પ્રતિકૂળ); માલસામાન ભાવ વિચલન - ₹ ૯૫૦/- (પ્રતિકૂળ); માલસામાન વપરાશ વિચલન - ₹ ૫૮૦૦/- (પ્રતિકૂળ); માલસામાન મિશ્રણ વિચલન - ₹ ૫૦૦/- (પ્રતિકૂળ); માલસામાન ઉપજ વિચલન - ₹ ૫૩૦૦/- (પ્રતિકૂળ).)

૫. એક કંપનીના માર્ય ૨૦૨૦ના ઉત્પાદન અંગે મજૂરી ખર્ચની વિગતો નીચે મુજબ છે.

કુલ પ્રત્યક્ષ મજૂરી	₹ ૬૫૦૦૦/-
પ્રમાણ કલાકો	૫૪૦૦
કલાકદીઠ મજૂરીનો પ્રમાણ દર	₹ ૧૧/-
ખરેખર કામનાં કલાકો	૫૨૦૦
મજૂરી ખર્ચને લગતાં જરૂરી વિચલનો શોધો.	

(જવાબ: પ્રત્યક્ષ મજૂરી ખર્ચ વિચલન - ₹ ૫૬૦૦/- (પ્રતિકૂળ); મજૂરી દર વિચલન - ₹ ૭૮૦૦/- (પ્રતિકૂળ); મજૂર કાર્યક્ષમતા વિચલન ₹ ૨૨૦૦/- (અનુકૂળ).)

૬. મૈત્રી કંપની લિમિટેડની નીચે આપેલ માહિતી પરથી શોધો.

(૧) મજૂરી ખર્ચ વિચલન, (૨) મજૂરી દર વિચલન, (૩) મજૂર કાર્યક્ષમતા વિચલન.

ભાલસાભાન	પ્રમાણ		ખરેખર	
	કલાકો	કલાકદીન	કલાકો	કલાકદીન
	(₹)		(₹)	
કુશળ કામદારો	૫૦૦	૩	૭૦૦	૪
બિનકુશળ	૩૦૦	૨	૩૦૦	૧
કામદારો				

(ઉત્તર ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., ૧ એપ્રિલ ૨૦૦૭ પર આધારિત)

(જવાબ: (૧) મજૂરી ખર્ચ વિચલન = કુશળ - ૧૩૦૦ (પ્રતિ), બિનકુશળ + ૩૦૦ (અનુ); મજૂરી દર વિચલન = કુશળ - ૭૦૦ (પ્રતિ), બિનકુશળ + ૩૦૦ (અનુ); મજૂર કાર્યક્ષમતા વિચલન = કુશળ - ૫૦૦ (પ્રતિ), બિનકુશળ = ૦)

૭. મનનની વિગતો નીચે મુજબ છે.

વિગત	પ્રમાણ		ખરેખર	
	કલાક	દર (₹)	કલાક	દર (₹)
પુરણો	૧૦૦૦	૩	૧૪૦૦	૩.૨૦
સ્ત્રીઓ	૬૦૦	૧.૨૦	૬૦૦	૧
<hr/>				<hr/>
	૧૬૦૦		૨૦૦૦	

નીચેનાં વિચલનો મેળવો.

(૧) મજૂરી ખર્ચ વિચલન, (૨) મજૂરી દર વિચલન, (૩) મજૂર કાર્યક્ષમતા વિચલન, (૪) મજૂરી મિશ્રણ વિચલન.

(સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી, ટી. વાય., એપ્રિલ ૨૦૦૭ પર આધારિત)

(જવાબ: મજૂરી ખર્ચ વિચલન - ₹ ૧૩૫૦/- (પ્રતિકુણ); મજૂરી દર વિચલન - ₹ ૧૫૦/- (પ્રતિકુણ); મજૂર કાર્યક્ષમતા વિચલન - ₹ ૮૩૦/- (પ્રતિકુણ); મજૂરી મિશ્રણ વિચલન - ₹ ૨૭૦/- (પ્રતિકુણ).)

૮. કપિલા કંપની લિમિટેડની એક વસ્તુના એકમદીઠ પ્રમાણ મજૂર કલાકો અને પ્રમાણ મજૂરી દર નીચે મુજબ છે.

મજૂર	કલાકો	કલાકદીન દર (₹)	કુલ (₹)
કુશળ કારીગર	૧૦	૩/-	૩૦/-
અર્ધકુશળ કારીગર	૮	૧.૫૦	૧૨/-
બિનકુશળ કારીગર	૧૬	૧/-	૧૬/-
<hr/>			૫૮/-

વस्तुનું ખરેખર ઉત્પાદન ૧૦૦૦ એકમોનું થયું હતું. જેનાં ખરેખર કલાકો અને ખરેખર મજૂરી નીચે મુજબ છે.

કારીગર	કુલ કલાકો	કુલ (₹)
કુશળ કારીગર	૬૦૦૦	૩૬૦૦૦
અર્ધકુશળ કારીગર	૮૪૦૦	૧૨૫૦૦
બિનકુશળ કારીગર	૧૨૦૦૦૦	૧૮૦૦૦

ઉપરની માહિતી પરથી ગણતરી કરો.

(૧) મજૂરી ખર્ચ વિચલન, (૨) મજૂરી દર વિચલન, (૩) મજૂર કાર્યક્ષમતા વિચલન.

(દક્ષિણ ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., એપ્રિલ ૨૦૧૧ પર આધારિત)

(જવાબ: મજૂરી ખર્ચ વિચલન - ₹ ૮૫૦૦/- (પ્રતીકૂળ); મજૂરી દર વિચલન - ₹ ૭૦૦૦/- (પ્રતીકૂળ); મજૂર કાર્યક્ષમતા વિચલન - ₹ ૧૫૦૦/- (પ્રતીકૂળ).)

e. એક કારખાનામાં એક વસ્તુના એક એકમના ઉત્પાદન માટે રોકેલા કામદારોને લગતી માહિતી નીચે મુજબ છે.

પ્રકાર	કલાકો	મજૂરી દર (₹)	કુલ (₹)
પુરષો	૩૦	૫/-	૧૮૦/-
સ્ત્રીઓ	૪૮	૩/-	૧૪૪/-
બાળકો	૨૪	૪.૫૦/-	૧૦૮/-
			<u>૪૩૨/-</u>

ખરેખર કામગીરી : ખરેખર ઉત્પાદન ૧૦૦ એકમોનું થયું છે.

પ્રકાર	કલાકો	મજૂરી દર (₹)	કુલ (₹)
પુરષો	૨૮૦૦	૭.૫૦	૨૧૦૦/-
સ્ત્રીઓ	૬૦૦૦	૨.૭૦	૧૬૨૦૦/-
બાળકો	૨૫૨૦	૪.૫૦	૧૧૩૪૦/-
			<u>૪૮૫૪૦/-</u>

નીચેનાં વિચલનો ગણો.

(૧) મજૂરી ખર્ચ વિચલન, (૨) મજૂરી દર વિચલન, (૩) મજૂર કાર્યક્ષમતા વિચલન, (૪) મજૂર ભિશ્રણ વિચલન.

(ઉત્તર ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાય., માર્ચ ૨૦૧૦ પર આધારિત)

(જવાબ: ખરેખર ઉત્પાદનનાં પ્રમાણા કલાકો ૧૦૨૦૦; મજૂરી ખર્ચ વિચલન - ₹ ૫૩૪૦/- (પ્રતીકૂળ); મજૂરી દર વિચલન - ₹ ૨૪૦૦/- (પ્રતીકૂળ); મજૂર ભિશ્રણ વિચલન ₹ ૧૮૦૩/- (અનુકૂળ); મજૂર કાર્યક્ષમતા વિચલન - ₹ ૪૭૪૩/- (પ્રતીકૂળ).)

૧૦. પાલી લિમિટેડની એક પ્રોડક્ટનું પ્રમાણ મિશ્રણ નીચે મુજબ છે.

વિગત	પ્રમાણ મિશ્રણ	કિલોડીઠ પ્રમાણિત
	(કિલો)	કિંમત (₹)
X	૫૦	૫/-
Y	૪૦	૧૦/-

દાખલ કરેલ માલના ૧૦% બગાડ અંદાજવામાં આવે છે. બગાડની ઉપજ નથી. આ મહિનામાં પ્રોડક્ટનું ઉત્પાદન ₹૦૦૦ કિલો થયું હતું.

ખરેખર ખરીદી અને વપરાશ નીચે મુજબ છે.

વિગત	ખરેખર મિશ્રણ	કિવન્ટલદીઠ ખરેખર
	(કિલો)	કિંમત (₹)
X	૫૫૦૦	૫૫૦/-
Y	૪૦૦૦	૬૦૦/-

ગણતરી કરો: (૧) માલસામાન ખર્ચ વિચલન, (૨) માલસામાન મિશ્રણ વિચલન, (૩) માલસામાન ઉપજ વિચલન.

(ગુજરાત યુનિવર્સિટી, ટી. વાથ., એપ્રિલ ૨૦૧૦ પર આધારિત)

(જવાબ: ખરેખર ઉત્પાદન ₹૦૦૦ કિલો છે. તેના પ્રમાણે જથ્થો ૧૦૦૦૦ કિલો $(\text{₹}000 \times \frac{100}{10})$; માલસામાન ખર્ચ વિચલન - ₹ ૨૨૫૦/- (પ્રતિકુળ); માલસામાન મિશ્રણ વિચલન ₹ ૮૦૦/- (અનુકૂળ); માલસામાન ઉપજ વિચલન - ₹ ૩૮૦૦/- (પ્રતિકુળ).)

૧૧. કલ્પના લિમિટેડની નીચેની ભાહિતી પરથી શોધો.

(૧) માલસામાન ખર્ચ વિચલન, (૨) માલસામાન ભાવ વિચલન, (૩) માલસામાન વપરાશ વિચલન, (૪) માલસામાન મિશ્રણ વિચલન.

માલસામાન	પ્રમાણ		ખરેખર	
	જથ્થો (કિલો)	ભાવ (₹)	જથ્થો (કિલો)	ભાવ (₹)
A	૭૨૦૦	૩/-	૫૭૫૦	૩.૫૦
B	૨૭૦૦	૪/-	૨૮૭૦	૩.૭૫
C	૧૮૦૦	૬/-	૨૨૧૪	૬.૨૫

(ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ટી. વાથ., માર્ચ ૨૦૧૧ પર આધારિત)

(જવાબ: માલસામાન ખર્ચ વિચલન - ₹ ૫૪૦૦/- (પ્રતિકુળ); માલસામાન ભાવ વિચલન - ₹ ૩૧૮૬/- (પ્રતિકુળ); માલસામાન વપરાશ વિચલન - ₹ ૨૨૧૪/- (પ્રતિકુળ); માલસામાન મિશ્રણ વિચલન - ₹ ૧૩૫૦/- (પ્રતિકુળ).)

૧૨. કલાપી કંપની લિમિટેડની નીચેની માહિતી પરથી શોધો.

- (૧) માલસામાન ખર્ચ વિચલન, (૨) માલસામાન ભાવ વિચલન, (૩) માલસામાન વપરાશ વિચલન,
(૪) માલસામાન મિશ્રણ વિચલન.

માલસામાન	પ્રમાણ		ખરેખર	
	જથ્થો (કિલો)	ભાવ (₹)	જથ્થો (કિલો)	ભાવ (₹)
P	૧૨૦૦૦	૨.૧૦	૧૧૨૫૦	૨.૪૦
Q	૪૫૦૦	૪.૩૦	૪૯૫૦	૪.૬૦
R	૩૦૦૦	૬.૬૦	૩૬૦૦	૭.૦૦

(ઉત્તર ગુજરાત ચુનિવર્સિટી, ટી. વાથ., માર્ચ ૨૦૧૦ પર આધારિત)

(જવાબ: માલસામાન ખર્ચ વિચલન - ₹ ૧૦૬૨૦/- (પ્રતીકૂળ); માલસામાન ભાવ વિચલન - ₹ ૬૩૦૦/- (પ્રતીકૂળ); માલસામાન વપરાશ વિચલન - ₹ ૪૩૨૦/- (પ્રતીકૂળ); માલસામાન મિશ્રણ વિચલન - ₹ ૩૩૩૧/- (પ્રતીકૂળ).)

☆ ☆ ☆